

પ્રશ્નો અને ઉત્તરો

૧૯૫૭-૧૯૫૮

શાતાળી ગ્રંથ



શ્રી ભા

○

જીનમં

હેઠુંઆરી ૨૧, ૧૯૭૮

લઘસતમાં વાતાવરણ


જાર્ય ૨૬, ૧૯૭૪

અષાસમાં

નવેમ્બર ૧૭, ૧૯૭૩

જીનમં શાતાખી

હેઠુંઆરી ૨૧, ૧૯૭૮



# શ્રી માતૃપદ્માં

પ્રક્રો અને ઉત્તરો

૧૯૫૭-૧૯૫૮

શ્રી ભાતાલ

: આતુવાદક :

શાંતિલાલ ઠાકેર



શ્રી આરંધ સોચાયદી (સાખી)

આમાદારાં : ૩૮૦ ૦૦૬

પ્રકાશક : શ્રી અરવિંદ આશમ ટ્રસ્ટ વતી  
શ્રી હસમુખ શાહ - શ્રી અરવિંદ સોસાયટી,  
‘સેન્ટર’ પ્રિતમનગર, પણેલો ઢાળ, અમદાવાદ-૩૮૦ ૦૦૬.



#### શતાખ્દિ અંથ ૬

પ્રથમ આવૃત્તિ (શતાખ્દિ આવૃત્તિ) એપ્રિલ ૧૯૭૫

પ્રત : ૧૦૦૦

કિલો : ૩. ૨૬-૦૦

© શ્રી અરવિંદ આશમ પ્રસ્ત, પોંડિચેરી.

#### પ્રાપ્તિકાણ :

૧. શ્રી અરવિંદ આશમ સેલ્સ એમ્પોરિયમ, પ્રિતમનગર પણેલો ઢાળ,  
એલિસબ્રિજ, અમદાવાદ ૩૮૦ ૦૦૬.
૨. શ્રી અરવિંદ આશમ સેલ્સ એમ્પોરિયમ, શ્રી અરવિંદ નિવાસ,  
દાંડિયા બજાર, વડોદરા-૩૬૦ ૦૦૧.
૩. SABDA, SRI AUROBINDO ASHRAM  
PONDICHERRY-605 002.

---

સુદ્રક : ગોવર્ધન દવે, નવસર્જન એકેડેમી, પ્રેસ્, નારગોલ 396 135

## નિવેદન

ગુજરાતી ભાષામાં પ્રેસિલ્ડ થતાં શ્રી માતાજીના આ નવમા શતાબ્દી ગ્રંથમાં શ્રી માતાજીએ પોતાના બુધવારના વર્ગોમાં આકામના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સાધકો સમક્ષ ૧૯૫૭ ના આરંભથી ૧૯૫૮ ના નવેમ્બર માસ સુધીમાં આપેલા વાર્તાલાપોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખેગાઉન્ડમાં તેમણે આપેલા આ છેલ્લા વાર્તાલાપો હતા. શ્રી માતાજી સામાન્ય રીતે શ્રી અરવિંદના કોઈ એક ગ્રંથના તેમણે પોતે કરેલા ફ્રેન્ચ અનુવાદમાંથી થોડો ભાગ વાંચીને આ વાર્તાલાપોનો આરંભ કરતાં, જન્યુઆરીથી એપ્રિલ ૧૯૫૭ ના વાર્તાલાપો માટે તેમનું ‘થોટું એન્ડ ડિલેપસીઝ’ (વિચારલો અને સૂક્તો) એ પુસ્તક “ કરવામાં આવ્યું” હતું. એપ્રિલથી ઓક્ટોબર ૧૯૫૭ માટે “ધી સુપ્રામેન્ટલ મેનિફેસ્ટેશન અપોન : ”, અને ઓક્ટોબર ૧૯૫૭ થી નવેમ્બર ૧૯૫૮ માટે “લાઈફ ડિવાઈન” ના છેલ્લાં છ પ્રકરણો. ઉપર્યુક્ત પુસ્તકોમાંથી વાચન થઈ ગયા બાદ માતાજીએ દ્વારા ઉપર વિવરણ કરતાં અથવા તો તે અંગેના પ્રશ્નોના ઉત્તરો આપતાં.

ફ્રેન્ચ ભાષામાં અપાયેલા આ વાર્તાલાપો તે વખતે ટેઈપરેન્ડ કરી બેપાયા હતા અને એમાંથી મોટા ભાગના વાર્તાલાપો આકામના એક ગૈમાસિક “બુવેટીન ઓફ શીજીકલ એજયુકેશન”માં (પાછાથી જેનું નામ ‘બુવેટીન ઓફ શ્રી અરવિંદ ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એજયુકેશન’ રાખવામાં આવ્યું હતું.) ફેઝુઅારી ૧૯૫૭ થી નવેમ્બર ૧૯૫૮ સુધીના, ઓગસ્ટ ૧૯૬૧ ના તથા ફેઝુઅારીથી ઓગસ્ટ ૧૯૬૩ ના અંકોમાં પ્રથમ વાર પ્રેસિલ્ડ થયા હતા. ફ્રેન્ચ ભાષામાં ૧૯૫૭ના બધા વાર્તાલાપો ૧૯૬૮માં અને ૧૯૫૮ ના વાર્તાલાપો ૧૯૭૨માં પુસ્તકાકારે પ્રેસિલ્ડ થયા હતા. આ આખીય કાલુંનું નવું અંગ્રેજ ભાષાના હિન્દુનું નામ ‘ક્વેશન્સ એન્ડ એન્સર્સ-૧૯૫૭-૫૮’ એ શિર્પિંક હેઠળ પ્રગટ થયું. અને ‘ક્વેક્ટેડ વર્કસ ઓફ ધ મધર (સિન્ટીનરી એડિશન)’ નો નવમા ગ્રંથ ૧૯૭૩નો આ આવૃત્તિનું જ પુનરાવર્તન છે, જેનું ગુજરાતી ભાષાના આ ગ્રંથમાં પ્રેસિલ્ડ થઈ રહ્યું છે.

શ્રી અરવિંદની ને ને કુનિઓનો આ ગ્રંથમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં શ્રી અરવિંદ બર્થ સેન્ટીનરી લાયબ્રેરીના અંગ્રેજ આવૃત્તિનો સંદર્ભ આપવામાં આવ્યો છે. તેથી જ્યાં જ્યાં ‘અતિમાનસંના આવિભાવ’ એ પુસ્તકનો ઉલ્લેખ છે, ત્યાં ત્યાં ‘ધી સુપ્રામેન્ટલ મેનિફેસ્ટેશન’ અને દિવ્ય જગતના સ્થાને ‘ધી લાઈફ ડિવાઈન’ સમજવાનું છે.

અંતે, શ્રી માતાજીના આ દિવ્ય વાણી ગુજરાતની પ્રણ સમક્ષ ગુજરાતી ભાષામાં રજૂ કરવાના અમારા નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન છતાં એમાં કોઈ ક્ષતિઓ રહી નથી પામી હોય તેને દરગુજર કરવાની વિનાંતિ છે.

\* \* \*

## સુધારો

પૃષ્ઠ-૫, લીટી ૨૬ ઉપર ‘અધિમનસ’ ના સ્થાને ‘અતિમનસ’.

પૃષ્ઠ-૮૯ ફક્રા-૧ પછી ઉમરો ૯ મે ૧૯૫૭

પૃષ્ઠ-૧૪૩, લીટી ૬ અને ૧૦ ‘અતિમનસ’ ના સ્થાને ‘અધિમનસ’

પૃષ્ઠ-૧૪૬ બીજા અને ત્રીજા ફક્રાની વચ્ચે ઉમરો ૧૭ જુલાઈ ૧૯૫૭

પૃષ્ઠ-૨૦૨ છેલ્લા ફક્રા ઉપર ઉમરો ૩૦ ઓક્ટોબર, ૧૯૫૭

પૃષ્ઠ-૩૪૫, લીટી ૧૩ : ‘અતિમનસ’ ના સ્થાને ‘અધિમનસ’

## અનુક્રમ

૧૯૫૭	૫૪	૫૫
<b>૧ અનુઆરી :</b>		
વ્યક્તિન અવકાશ અને કાળની પર જઈ શકે?	૧	
કોસ પર ચઢેલું નહિ પણ તેજોમય શરીર જગતને બચાવશે.	૩	
વ્યક્તિનો પ્રથંન અન નવીન શક્તિન.	૬	
<b>૨ અનુઆરી :</b>		
અગવાન તત્ત્વના આનંદ રૂપ છે.	૭	
અગવાન અને પ્રકૃતિનો સંતા-		
કુકુરના ઘેવ	૧૦	
તમે કયારે અને થા માટે ગંભીર હો છો?	૧૪	
<b>૩ અનુઆરી :</b>		
આથ્યા વિના શોધ કરવી	૧૬	
આપણે થા માટે અહીં છીએ	૧૮	
<b>૪ અનુઆરી :</b>		
શુદ્ધ આનંદને આપણે કેવી રીતે સમજ્યું?	૨૧	
“મધુભિન્દુ”	૨૫	
જગતમાં દિવ્ય સંકલપનું કાર્ય	૨૭	
<b>૫ અનુઆરી</b>		
કષા ગૂંથણી એ કેવળ તુલના લેદ હો	૨૮	
અગવાનની દોરવણી કેવી રીતે પારખવી?	૩૧	
<b>૬ ઇષ્ટુઆરી :</b>		
મૃત્યુ : પ્રગતિની એક આવ- શ્યકતા		૩૪
પ્રકૃતિની કાર્ય પદ્ધતિ બદલવી		૩૫
<b>૭ ઇષ્ટુઆરી</b>		
વૈયક્તિક અને સામુહિક ધ્યાન		૩૮
<b>૮ ઇષ્ટુઆરી</b>		
વેદના : સુખ અને દુઃખ		૪૧
માંદળી અને તેનો ઈલાજ		૪૩
<b>૯ ઇષ્ટુઆરી</b>		
શરીરની મર્યાદાઓ અને		
વૈયક્તિકરણ		૪૪
<b>૧૦ માર્ય</b>		
સ્વતંત્રતા, દાસતા અને પ્રેમ		૫૦
<b>૧૧ માર્ય</b>		
એક બોલ વાર્તા		૫૨
<b>૧૨ માર્ય</b>		
આપણો ઉત્તમ મિત્ર		૫૪
<b>૧૩ માર્ય</b>		
ટ્યેમસેનના સંસ્મરણો		૫૮
<b>૧૪ માર્ય</b>		
કદાચ ‘બેસી નહિ રહેલું’ સાચી		
વિશ્વાસિતિ		૬૪
<b>૧૫ માર્ય</b>		
એક વિજ્ઞાની કથા : જ્ઞાન અને		
આચરણ		૬૬
<b>૧૬ માર્ય</b>		
નો માનવજીત કેવળ આધ્યાત્મિક		
બનવાને સંમત થાય		૭૨

<b>૩ એપ્રિલ</b>		<b>સૌમાં દિવ્યતાની ઉપસ્થિતિ</b>	૧૩૨
ઈશ્વર અગેના વિવિધ ખ્યાલોનું		નવીન જાત્મ	
મિલન : ધર્મ અને આધ્યાત્મિકતા	૭૫	<b>૩ જુલાઈ</b>	
<b>૧૦ એપ્રિલ</b>		સામુહિક યોગ ('મારી હોટલ')	
રમતગમતો અને યોગ	૭૬	નૃ દર્શન)	૧૩૩
પોતાના જીવનનું સંગ્રહન	૮૨	<b>૪ જુલાઈ</b>	
<b>૧૭ એપ્રિલ</b>		વાણીનો અસંયમ	૧૩૮
શરીરનું રૂપાંતર	૮૪	<b>૧૦ જુલાઈ</b>	
<b>૨૪ એપ્રિલ</b>		ઓક નવીન જગત જાત્મયું છે	૧૩૯
પૂર્ણતા : ઊર્ધ્વની અને નિમ્નની	૮૮	અધિમનસ સૃજિણું વિલીનીકરણ ૧૪૪	
<b>૧ મે</b>		<b>૧૭ જુલાઈ</b>	
રમતગમતની સ્પર્ધાઓ :		પદાર્થતત્ત્વ ઉપર સચેતન સંકલપનો	
તેમનું મૂલ્ય	૯૩	પ્રભાવ	૧૪૬
<b>૧૫ મે</b>		<b>૨૪ જુલાઈ</b>	
યોનિલેદ	૧૦૦	'નિગૃઢ અનિમનસ'	૧૪૦
ઊર્ધ્વથી નિમ્ન સુધીનું રૂપાંતર	૧૦૩	નવીન જગત ; તોપારી ;	
<b>૨૬ મે</b>		પ્રગતિ માટેની ઈચ્છા	૧૪૨
પ્રાગનિક રૂપાંતર	૧૦૪	<b>૩૧ જુલાઈ</b>	
<b>૫ જૂન</b>		શરીરમાં દિવ્યતા માટેની	
પ્રશ્નો અને શાંતિ	૧૦૮	અભીષ્ટાની જગૃતિ	૧૪૪
ધ્યાનની પદ્ધતિઓ	૧૧૧	<b>૭ ઑગસ્ટ</b>	
<b>૧૨ જૂન</b>		અવરોધીઃ રાજકારણ અને ધર્મ	૧૪૮
ઉપવાસ અને આધ્યાત્મિક	૧૧૩	અનિમાનસ જીવનના સાક્ષા-	
પ્રગતિ		તારની અભીષ્ટા	૧૫૩
<b>૧૬ જૂન</b>		<b>૧૪ ઑગસ્ટ</b>	
માંદગી, એના કારણો, ભય	૧૧૬	ક્રી અરવિંદ ઉપર ધ્યાન	૧૫૪
મનના વ્યાપાર : કાદા અને		<b>૧૯ ઑગસ્ટ</b>	
માંદગી	૧૨૨	આશામ અને સાચું સામુહિક	
<b>૨૧ જૂન</b>		જીવન	૧૫૫
સૌવા રૂપાંતરણ દ્વારા જાત્મ	૧૨૪	આશામમાં ચેતનાનું સર્વસામાન્ય	
પુરુષ અને સ્ત્રી	૧૨૭	સ્તર	૧૬૭
બીજાઓ વિષે અભિપ્રાય આપવા	૧૨૯		

૧૮ ઓફસટ		૧૭ નોંધર	
સ્વતંત્રતા અને દિવ્ય સંકલ્પ	૧૬૮	'દિવ્ય જીવન' માં શ્રી અરવિંદની	
૪ સાર્વેધર		પદ્ધતિ	૨૧૦
શ્રી અરવિંદ : 'એક શાખત જીવનમ'	૧૭૦	વૈષણવિક અને વૈષણવ ઉત્કૃતિ	૨૧૩
૧૧ સાર્વેધર		૪ ડિસેંધર	
પ્રાણનું રસાયન શાખ :		'દિવ્ય જીવન' ની પદ્ધતિ	૨૧૫
આકર્ષણ અને અપકર્ષણ	૧૭૨	નવી જતિના આવિભાગની	
૧૮ સાર્વેન્થર		સમસ્યા	૨૧૬
ગુણવિદ્યા અને અતિમાનસ જીવન	૧૭૩	૧૧ ડિસેંધર	
ગુણવિદ્યા અને અતિમાનસ જીવન	૧૭૫	પ્રથમ માનવનું પ્રાગટ્ય	૨૨૧
૧૫ સાર્વેન્થર		૮ ડિસેંધર	
'મધ્યંતર જીવો' માટેની તૈયારી	૧૮૨	જગતનો પ્રેમ ; આધુનિક વિજ્ઞાન	૨૨૪
૨ ઓફસેન્થર		અનુભવનું મૂલ્ય :	
'તેજેમનસ'	૧૮૩	એનો રૂપાંતરકારી પ્રભાવ	૨૨૫
બુધની પ્રતિમાઓ	૧૮૬	અતિમાનસ શક્તિ : અભિવ્યક્ત	
ભૂતકાળનો લાર	૧૮૮	થનારું પ્રથમ પાસું	૨૨૬
૬ ઓફસેન્થર			
વ્યક્તિ તેટબા વિશ્વ (વિલિન વિશ્વદર્શનો)	૧૯૦		૧૬૫૮
ઉદ્દ્વ ગોળાર્ધનો માર્ગ	૧૯૪	૧ જાન્યુઆરી	
૧૬ ઓફસેન્થર		ભૌતિક પ્રકૃતિનો સહયોગ	૨૨૭
ક્રમિક અવકાંતિની કથા	૧૯૪	ગણનદૃષ્ટિને ગમ્ય ચમત્કારો	૨૨૮
૨૩ ઓફસેન્થર		પરિરિષ્ઠ	
ખાંસારિક જીવનનો કેન્દ્રવતી હેતુ	૧૯૮	નવીન વર્ષના સંદેશનું	
ઉત્કૃતિ	૨૦૨	સ્પાટીકરણ	૨૨૯
૩૦ ઓફસેન્થર		૮ જાન્યુઆરી	
ઉત્કાંતિની બેવડી પ્રક્રિયા	૨૦૨	શ્રી અરવિંદની વિવરસુની	
જતિની વિલુપ્તિ	૨૦૪	પદ્ધતિ	૨૩૧
૧૩ નોંધર		મન એક "જહેર જગ્યા"	૨૩૨
મનુષ્યનું પશુ મર ચઢિયાતાપણું	૨૦૫	માનसિક સંયમ	૨૩૩
આકાર અગાઉ ચેતના	૨૦૮	શ્રી અરવિંદનો 'સૂક્મ ઉસ્ત'	૨૩૫

<b>૧૫ જાન્યુઆરી</b>		<b>૧૬ માર્ચ</b>	
હથમણી ન ઉઠે તેવો અપાર	૨૩૭	સર્વસાધારણ તંગાદિલી : એનાથી	
<b>૨૨ જાન્યુઆરી</b>		ઉપર ઉઠવા અથવા અવમાનણ	
બૌધ્ધિક સિદ્ધાતો	૨૩૮	જૂમિકાઓ ઉત્તરદું	૨૭૨
કૃષ્ણ જ છોડી શકાય નહિઃ		શાંતિ અને પ્રગતિ	૨૭૫
વાસ્તવિક સત્યની અભિવ્યક્તિ	૨૩૯	રૂપાંતરનું દર્શન અને તેની વિકૃતિ	૨૭૭
<b>૨૬ જાન્યુઆરી</b>		<b>૧૬ માર્ચ</b>	
વિશ્વની યોજના	૨૪૦	માનસિક ચિત્તા અને આધ્યાત્મિક	
આત્મસલાનતા	૨૪૩	શક્તિમાં વિશ્વાસ	૨૭૮
<b>૫ ફેબ્રુઆરી</b>		<b>૧૮ એપ્રિલ</b>	
પરમની ભલાયાત્રા	૨૪૫	બૂલસુધાર	૨૮૨
સ્વતંત્રતા અને નિયતિ	૨૪૭	<b>૧૯ એપ્રિલ</b>	
<b>૧૧ ફેબ્રુઆરી</b>		આત્માની ચક્ષુઓ	૨૮૩
એક જીવનથી ભીજ જીવન		આત્માનું દર્શન	૨૮૪
પ્રત્યે ચોત્ય વિકાસ	૨૪૮	<b>૨૦ એપ્રિલ</b>	
પૃથ્વી, વિકાસની જૂમિ	૨૫૦	અતિમાનણ	૨૮૩
<b>૧૬ ફેબ્રુઆરી</b>		નવીન સાક્ષાત્કાર	૨૮૬
૩ ફેબ્રુઆરી ૧૯૫૮ની અનુભૂતિ (અતિમાનસ હોયી)	૨૫૧	<b>૨૧ એપ્રિલ</b>	
પરિશિષ્ટ		પ્રુગતિ અને સોદાબાળ	
નિયંત્રકો	૨૫૮	<b>૨૨ એપ્રિલ</b>	
કૃત્રિમ ઉપાયોની નિર્યક્તા	૨૬૧	માનસિક રમતો અને અનુભૂતિ	૨૯૨
<b>૨૫ ફેબ્રુઆરી</b>		<b>૨૩ એ</b>	
નોરાઓની ભાષા અને ચાંદ્ર	૨૬૨	પ્રકૃતિનું રહસ્ય	૨૯૪
જન્મકુંડલી અને યોગ	૨૬૩	<b>૨૪ એ</b>	
<b>૫ માર્ચ</b>		બૌધ્ધિક પ્રવૃત્તિ અને સૂક્ષ્મ જ્ઞાન	૨૯૮
ઓદ્દોદનો અને શબ્દો	૨૬૪	થરીર દ્વારા સમજસૂ	૨૯૯
વિચારની શક્તિ,	૨૬૫	<b>૨૫ એ</b>	
‘વાણીની બલિસ’	૨૬૬	માનસિક પ્રામાણિકતા	૩૦૦
<b>૧૨ માર્ચ</b>		<b>૨૬ એ</b>	
જૂતકાળના રૂપાંતરોની ચાવી	૨૬૭	અવતાર	૩૦૩
		<b>૨૭ એ</b>	
		જૂન	
		નવીન જાનમ	૩૦૬

<b>૧૧ જૂન</b>		<b>૩ સપ્ટેમ્બર</b>
સર્વમાં નિહિત આધ્યાત્મિક સત્તા,		કલ્પનાને નિર્ણિત કેવી રીતે
એક સંરક્ષણ	૩૧૦	કરવી ૩૫૩ માનસિક રચનાઓ ૩૫૫
<b>૧૮ જૂન</b>		<b>૧૦ સપ્ટેમ્બર</b>
તત્ત્વજ્ઞાન, ધર્મ, ગુણવિદ્યા અને		જાહુ, ગુણવિદ્યા, ભૌતિક વિજ્ઞાન ૩૫૭
આધ્યાત્મિક અનુભૂતિ	૩૧૨	
<b>૨૫ જૂન</b>		<b>૧૭ સપ્ટેમ્બર</b>
શરીરમાં કરવાનો સાધના	૩૧૭	અનુભૂતિની સંરચનાની શક્તિ ૩૬૫ માનસિક વિકાસની ઉપયોગિતા ૩૬૭
<b>૬ જુલાઈ</b>		
શક્તા અને અંગત પ્રથળ	૩૨૦	<b>૨૪ સપ્ટેમ્બર</b>
<b>૧૨ જુલાઈ</b>		સત્ય અનુસાર જીવનું ૩૭૦ શબ્દો અને અનુભૂતિ ૩૭૨
શું ધર્મ એક આવશ્યકતા છે? ૩૨૩		
<b>૧૩ જુલાઈ</b>		<b>૧ ઓક્ટોબર</b>
અંતર્જાનની શક્તિ કેવી રીતે		નૈતિક પૂર્ણતાનો આદર્શ ૩૭૫
ખીલવવી	૩૨૬	
એકાગ્રતા	૩૩૦	<b>૨ ઓક્ટોબર</b>
<b>૩૦ જુલાઈ</b>		માનવ અને અતિમાનવ વર્ણનની
લેન્યેટ, સ્વર્યાંભૂતેખન	૩૩૧	અવસ્થાઓ ૩૭૬
‘સાભિતીઓ’ અને જ્ઞાન	૩૩૬	
<b>૬ ઓગસ્ટ</b>		<b>૨૨ ઓક્ટોબર</b>
સામુહિક પ્રાર્થના, આદર્શ સમૂહ ૩૩૭		આધ્યાત્મિક જીવન : ચેતનાનું અપક્રમણ ૩૭૮ બીજાઓને સહાય કરવી ૩૮૦
<b>૧૩ ઓગસ્ટ</b>		
અમારા આશ્રમ નિવાસથી અમને		<b>૨૬ ઓક્ટોબર</b>
લાલ કેમ થતો નથી? ૩૩૪		માનસિક સ્વર્યાંપ્રયાપ્તિતામાં નાનું છિદ્ર ; કૃપા ૩૮૩
ક્રી અરવિંદ આપણને શું કહે-		
વાને આપ્યા છે? ૩૪૩		<b>૫ નવેમ્બર</b>
ભગવાનની પ્રાપ્તિ	૩૪૪	શાંત કેમ થવું તે જાણું ૩૮૬
<b>૧૫ ઓગસ્ટ</b>		<b>૧૨ નવેમ્બર</b>
ક્રી અરવિંદ અને દેવો સાથેનો		પરમાત્માનું લક્ષ્ય ૩૮૮
સંબંધ	૩૪૪	ભગવાન્નામાં વિશ્વાસ ૩૮૯
<b>૨૭ ઓગસ્ટ</b>		<b>૧૬ નવેમ્બર</b>
ધ્યાન અને કલ્પના	૩૪૬	આત્માનું કાર્ય ૩૯૨
ચિત્તનથી અભિકૃપન અને		નવીન જરૂર ૩૯૪
અભિકૃપનથી સિદ્ધાંત તરફ ૩૪૦		<b>૧૭ નવેમ્બર</b> ૩૯૭

18  
19

## ર જાન્યુઆરી ૧૯૫૭

“જો બ્રહ્મ માત્ર બિનઅંગત ભાવવાચક તત્ત્વ હોય કે જે આપણા સુધન અસ્તિત્વની દેખીતી હકીકતનો સનાતને કાળ માટે વિરોધ કરે, તો આપણા અહિત-ત્વનો, સંપૂર્ણ વિરાટ જીવનનો તથા વિશ્વનો સાચો અંત એ જ ઉકેલ ગણાય; પણ આપણે પ્રેમને, આનંદને, અને આત્મભાનને પણ જાણતરીમાં લેવાં જોઈએ.

વિશ્વ એ સંખ્યાઓ અને સિદ્ધાંતોના કહેવાતાં અમૃત માનસિક ભાવવાચક તત્ત્વોના સંબંધને સમજવા માટેનો એક માત્ર ગાણિતિક સૂત્ર નથી કે જેનો અંત છેવટે શૂન્યમાં આવે; વળી તે એક ભૌતિક કિયા માત્ર નથી કે જે શક્તિઓના અમૃત સમીકરણને મૂર્ત કરે. વિશ્વ એક આત્મપ્રેમીનો આનંદ છે, સનાતન બાળકની લીલા છે, અનંત સર્જકતા પોતાની શક્તિના અતિઅનંદથી ઉનમત બનેલા એક કવિનો અનંત આત્મવિસ્તાર છે.

આપણે પરમાત્માઓ સંખ્યાઓમાં વૈશિષ્ટ દાખલાઓનો ઉકેલ કરતા એક ગણિત શાસ્ત્રી હોય તેમ વર્ણવી શકીએ, અથવા પ્રયોગ દ્વારા તત્ત્વોના સંખ્યામાં તથા શક્તિઓની સમતુલ્યામાં એક સમસ્યાનો ઉકેલ કરતા વિચારક હોય તેમં વર્ણવી શકીએ; પણ એ સાથે આપણે તે એક ગ્રંથી છે, વૈશિષ્ટ અને વિશિષ્ટ રંગાદભ્ય-તાઓના ગાયક છે, બાળક છે, કવિ છે એમ પણ તેમના વિષે કથન કરવું જોઈએ. માત્ર વૈચારિક બાળુ પર્યાપ્ત નથી; આનંદની બાળુ પણ સંપૂર્ણપણે આપણે પકડવી જોઈએ, જ્યાં સુધી વિચારોને, બળોને, અસ્તિત્વોને, તત્ત્વોને ભગવાનનાઃ આનંદના ઉચ્છ્વાસથી પરિપૂર્ણ કરવામાં ન આવે, ત્યાં સુધી તે માત્ર પોતાં બીબાં છે.”

આ વસ્તુઓ મૂર્તીકરણો છે, પણ સર્વ એક મૂર્તીકરણ છે. ભાવવાચક તત્ત્વો આપણને અગવાનનાં સંતોનો વિશુદ્ધ જ્યાલ રૂપો છે; મૂર્તીકરણો આપણને તે સંતોની જીવત વાસ્તવિકતા આપે છે.

જો શક્તિને આવિગત આપતા વિચારે ભૂષિષ્ઠઓનું સર્જન કર્યું છે, તો પરમ અહિતત્વના આનંદે તે વિચારનું સર્જન કર્યું છે. અનંત પરમાત્માએ પોતામાં અંસંખ્ય આનંદની કદ્દિના કરી, અને તેથી જગતો અને વિશ્વ અસ્તિત્વોના પ્રગટ્યાં.

સત્તની ચેતના અને સત્તનો આનંદ એ પ્રથમ ભાતાપિતા છે. વળી તે બે આખરી ઉત્કુમણો છે. અચેતનના માત્ર સચેતનની વયગાળાની મૂર્છા અથવા તેની અસ્પષ્ટ નિદ્રા છે; વ્યથા અને આત્મવિલોપન સત્ત પોતાની જાતથી દૂર ભાગી જાય છે જેથી તે પોતાની જાતને અન્યત્ર અથવા અન્યથા ખોલી કાઢે શકે તેનો આનંદ માત્ર છે.

સત્તનો આનંદ કાળમાં મર્યાદિત નથી, તે અનાદિ અને અનંત છે. પરમાત્મા એક રૂપમાંથી બહાર આવે છે તે માત્ર બીજા રૂપમાં પ્રવેશ કરવા માટે જ.

આખરે પરમાત્મા શું છે? તે એક સનાતન ઉદ્ઘાનમાં સનાતન કીડા કરી રહેલો સનાતન બાળક છે.

( થોટ્ટસ એન્ડ એફેરિશન્સ સેન્ટીનરી વોલ્યુમ્સ ૧૯, પૃષ્ઠ ૩૮૦-૮૧ )

મધુર ભાતાજી, માણુસ દેશકાળથી બહાર જઈ શકે?

તે કર્મિકરણની ( દૃશ્યીકરણની ), આવિજ્ઞકરણની હકીકત છે, વાસ્તવિકતા છે, જેણે દેશકાળનું સર્જન કર્યું છે. તેમાંથી બહાર જવા માટે માણુસોએ મૂળમાં પાછાં જવું જોઈએ, અર્થાત્ આવિજ્ઞકરણની પર જવું જોઈએ. બાકી તો, પ્રથમ દૃશ્યીકરણથી માંગીને જ દેશકાળ સર્જયાં હતાં.

શાશ્વતીની અને અનંતતાની એવી એક લાગણી, એવું એક દર્શન અથવા એવી એક અનુભૂતિ છે, કે જેમાં માણુસને દેશકાળથી પર ચાલ્યા ગયાની લાગણી થાય છે. પણ તે એક લાગણી જ્યાદ માત્ર છે.

માણુસે બધાં રૂપોથી, ચેતનાનાં ખૂબ સૂક્ષ્મ રૂપોથી પણ પર ચાલ્યા જવું જોઈએ; તો જ તે દેશકાળથી પર ચાલ્યા જવાની લાગણી પ્રાપ્ત કરી શકે. સાચી સમાધિમાં પ્રવેશ કરેલા બોકોની તેવી સ્થિતિ હોય છે. જ્યારે તેઓ ફરી પાછા સામાન્ય ચેતનામાં આવે છે, કેમને કશું યાદ રહેનું હોતું નથી; કારણકે તે સમયે એવી ઝોઈ વસ્તુ જ ન હતી કે જેને તેઓ યાદ કરી શકે. આ બાબતમાં કોઈ અરવિંદ કરું છું કોઈ ભુલ માગ બિનઅંગત ભાવવાચક તત્ત્વ હોય, તો સંપૂર્ણ વિનાશ જ

તેનો એક માર્ગ તર્કસંગત ઉકેલ હોય. કારણે એ વાત સ્પષ્ટ છે કે જે માણસ દેશકાળની બહાર ચાલ્યો હોય, તો સર્વ ભિન્ન અસ્તિત્વ આપોઆપ વિરામ પાડી હોય.

તો પછી માણસ દેશકાળની બહાર ચાલ્યો જઈ શકે છે, પણ તેથી કાંઈ જાર્યું પરિણામ આપતું નથી !

બસ એટલું જ છે ? તમે દેશકાળથી બહાર ચાલ્યા જવાનો પ્રયત્ન કર્યો છે ?

( બાળક જોરપૂર્વક માથું ખલાવે છે.)

માતાજી, તમે નવા વર્ષનો સંદેશ સમજાવશો ? “કોસ પર ચઢેલું શરીર નહિ, પણ તેનેમણે બનેલું શરીર જગતનો ઉદ્ઘાર કરશો ” એ વાક્યનો અર્થ શેં છે ? \*

તમે સમજું શક્યો તેવી કોઈ વાત હું તમને કહીશ.

એક દિવસે, ક્યારે તે મને બરાબર યાદ નથી, મને એચિત્તી એક સમૃતિ થઈ આવી કે મારે નવા વર્ષનો સંદેશ આપવાનો છે. સામાન્ય રીતે આવા સંદેશમાં નવીન વર્ષમાં શું બનવાનું છે તે કહેવામાં આપતું હોય છે. કેટલાંક કારણોસર મારે કાંઈ કહેવાનું ન હતું; એટલે મેં મારી જાતને પૂછ્યું કે મારે શું કહેવાનું છે તે બાબત મને કોઈ સ્પષ્ટ સૂચન પ્રાપ્ત થશે કે કેમ ? મેં બરાબર આ જ પૂછ્યું હતું કે જગતમાં ક્રોષ સ્થિતિ કર્યી છે ? આ લોકોને મદદ કરવા માટે અથવા તેમને સત્યની વધારે નજીક આકર્ષવા માટે ચેતનાની આ સ્થિતિને લાવવામાં કર્યી વસ્તુ જરૂરી છે ?

ક્રોષ સ્થિતિ કર્યી હતી ?

થોડાક કલાકો પછી મારા હાથમાં અમેરિકાથી આવેલી એક પુસ્તકા આવી. તેનું નામ હતું ‘માનવ કુટુંબ’ જે હેટોગ્રાહિક પ્રદર્શનના એક પ્રકારના સમાચાર

\* “અનિષ્ટની શક્તિ કરતાં કોઈ વધારે ભળવાન શક્તિ જ વિજ્ઞયને પ્રાપ્ત કરી કરે. કોસ પર ચઢેલું શરીર નહિ, પણ તેનેમણ શરીર જ જગતનો ઉદ્ઘાર કરી શકશે.”

તરીકે પ્રકાશિત કરવામાં આવી હતી. એ પુસ્તિકામાં વિષય અનુસાર વળ્ણકરણ કરાગેલાં ઉદ્ધરણો અને ઘણા ફોટાઓ હતા. તે બધાંનો હેતુ માલુસોમાં ભ્રાતુભાવની સાચી ભાવના જગૃત કરવા માટે પ્રયત્ન કરવાનો હતો. તે બધું શક્ય પુછ્ણે નિવારવા માટે એક મહાન, કરુસ પ્રયાસ રૂપ હતું. ઉદ્ધરણો એવી એક સમાચારદાતા નારીએ પરસંદ કર્યા હતા, કે જે અહીં આવી હતી અને જેને હું મળી હતી. એટલે આ બધું ખરેખર હૃદયંગમ રીતે આવ્યું. તે સામુહિક દૃષ્ટિબિનદુથી અત્યારે પૃથ્વી પર આવિલ્લિવ પામી શકે તેવી માનવીની શ્રેષ્ઠ સંકલ્પપથકિતને અભિવ્યક્ત કરતું હતું. હું એમ નથી કહેતો કે કેટલાક લોકો વધારે ઉચ્ચ ભૂમિકા પર નથી થઢ્યા અથવા વધારે સારી રીતે નથી સમજી શકતા; પણ તે વ્યક્તિગત પ્રસંગો છે, માનવજ્ઞતિ માટે કાંઈક કરવા માટેનો સામુહિક પ્રયત્ન નથી. માતું હૃદય ખળખળી ઉઠ્યું.

પછી હું તે પુસ્તિકાના અંતભાગ પર આવી, જેમાં માલુસો એકબીજાને મારી નાંખતા અટકે તે માટેનો ઉપાય તેમની અજ્ઞાનભરેલી શુલેચ્છામાં, સૂચ્યવવામાં આવ્યો હતો. તે ઉપાય એટલો બધો દરિદ્ર, નિર્બિંબ, અજ્ઞાનપૂર્ણ, અને બિનઅસરકારક હતો. કે મારું હૃદય ખરેખર ખળખળી ઉઠ્યું, અને મને સ્વપ્ન આવ્યું કે આ પ્રદર્શન અહીં ચોડિયેરીમાં આવે જેથી આપણે તેમને બતાવી શકીએ, અને તેમની પુસ્તિકામાં એક ઉપસંહાર ઉમેરી શકીએ, જેમાં તેમની સમજ સાચા ઉપાયને પ્રગટ કરવામાં આવ્યો હોય. તે બધું એક સધન આકાર રૂપ બન્યું, જેમાં જરૂરી ફોટાઓ અને ઉદ્ધરણોનો સમાવેશ કરવામાં આવે. પછી તદ્દન નિશ્ચયાત્મક રીતે, ચેતનાના ઊંડાણુમાંથી કાંઈક ઉલ્લરાઈ આપતું હોય તેમ, આ પાક્ય આવ્યું. મેં તે લખી લીધું. મેં લખી લીધું કે તરત જ મેં મારી જતને કહું કે, “આ મારો સંદેશ છે.” તેથી મેં નિર્ણય કર્યો કે તે મારો સદિય હશે તેથી તે પ્રગટ કરવામાં આવ્યો છે.

તેનો અર્થ એ છે કે આ વસ્તુ જ માનવ જતિમાં સદ્ગ્રાવના પેદા કરશે, આજે પૃથ્વી પર અભિવ્યક્ત થઈ શકે, પ્રગતિ કરવે, તેવી શ્રેષ્ઠ વસ્તુ હોય, તેણે એક વિશિષ્ટ રૂપ ધારણ કર્યું છે. કારણ કે આ સદ્ગ્રાવના એક ખ્રિસ્તી દેશમાંથી આવી છે, અને તેથી તેમાં સ્વાભાવિક રીતે જ એક ખાસ ખ્રિસ્તી અસર વરતાય છે. પણ આ વલણ જગતમાં સર્વત્ર જોવામાં આવે છે, પછી લખે બિજી બિજી પ્રકારના દ્રોષા અને ધર્મો અનુસાર તેને બિન્ન બિન્ન રીતે અભિવ્યક્ત કરવામાં આવી હોય. આ “વલણમાં” અંશાન સામે પ્રતિકાર્ય તરીકે મેં

આ લખ્યું હતું. સ્વાભાવિક રીતે જ જગતમાં પણ તે જ વિચાર પ્રવર્તે છે: સર્વ ભૌતિક વાસ્તવિકતાના સંપૂર્ણ ત્યાગનો વિચાર, ભૌતિક જગત માટે એક ગુહન તિરસ્કાર કે જે જગતને મિથ્યા અને અસત્ય માને છે, અને જે વિચાર ક્રી અરવિંદ કહે છે તે મુજબ, વિરોધી શક્તિઓના સાખ્રાણ્ય માટે ક્ષેત્રને નિમુંક્ત કરી આપે છે. જો તમે દૂરની ભાવપાયક વાસ્તવિકતાની ખાતર સધન વાસ્તવિકતામાંથી છટકી જાઓ, તો તમે સધન સાક્ષાત્કારના સમગ્ર ક્ષેત્રને વિરોધી શક્તિઓને હવાલે સંપૂર્ણ રીતે છોડી દો છો, જે શક્તિઓએ અત્યારે જગત પર પકડ જમાવી છે અને ઓછાપત્તા પ્રમાણમાં જે શક્તિઓ તેનું શાસન કરી રહી છે. અને તમે આ વાસ્તવિકતામાંથી એટલા માટે છટકી જાઓ છો કે ક્રી અરવિંદ જેને શૂન્ય કહે છે તેને તમે પ્રામ કરી શકો, તમે શૂન્યના સભ્રાટ બની શકો, તે નિર્વાણમાં પુનર્જમન છે. આ વિચાર જગતમાં સર્વત્ર પ્રવર્તે છે, પણ તેને લિન્ન લિન્ન રીતે અભિવ્યક્ત કરવામાં આવ્યો છે.

અત્યાર સુધી આ દુષ્ટાનો સામનો નિર્બળતાએ, ભૌતિક જગતમાં ઝ્યાંતર માટેની કોઈ તાકાત વગરના આધ્યાત્મિક બળો કર્યો હતો અને તેથી આ સદ્ભાવનાનો વિશાળ પ્રયાસ કરેલાજનક નિર્ઝળતામાં પરિણમયો છે અને જગતને તેણે દુઃખની, ભ્રષ્ટાચારની, અસત્યની તેજ સ્થિતિમાં છોડી દીનું છે. વિરોધી શક્તિઓ ને ભૂમિકા ઉપર શાસન કરી રહી છે, તે જ ભૂમિકા ઉપર માણસે તેમના કરતાં વધારે બળ પ્રામ કરવું જોઈએ, જે બળ તે જ પ્રદેશમાં તેમના ઉપર સંપૂર્ણ વિજય પ્રામ કરી શકે. બીજા શર્દીઓમાં કહીએ તો તે એક એવું આધ્યાત્મિક બળ હોવું જોઈએ કે જે ચેતનાનું તથા ભૌતિક જગતનું ઝ્યાંતર કરવા સમર્થ હોય. આ બળ તે અતિમાનસ શક્તિ છે. જરૂરનું એ છે કે આપણે ભૌતિક ભૂમિકા પર તેના કાર્ય પ્રત્યે ખુલ્લા બનીએ અને દૂરના નિર્વાણમાં ન દોડી જઈએ, પોતે ન્યાણ દીધેલા ક્ષેત્રને શરૂના સંપૂર્ણ કાબૂમાં ન છોડી દઈએ.

બલિદાન, ત્યાગ, સંન્યાસ કે નિર્બળતા આપણને વિજય પ્રામ નહિ કરાવી શકે. માત્ર આનંદ જ વિજય પ્રામ કરાવી શકે, કે જે આનંદ બળ છે, સહિષ્ણુતા છે, પરમ ધીર્ય અને હિંમત છે, તે આનંદ અધિમનસની શક્તિ લાવી આપે છે. બધાનો ત્યાગ કરીને ભાગી જવા કરતાં આનંદને પ્રામ કરવો તે ધણું કહીન છે, તે અનંતગણી મહાન વીરતાની માંગ કરે છે. પણ વિજય પ્રામ કરવાનો તે જ એક માર્ગ છે.

શું બીજું કંઈજ નહિ? આહી મારી પાસે કેટલાક પ્રશ્નો છે, પણ અન્યારે મોડું થઈ ગયું છે.

શ્રી માતાજી, આ નવી શક્તિ કે જે કાર્ય કરવાની છે તે વ્યક્તિગત પ્રયત્ન દ્વારા કાર્ય કરશે કે તેના પર આધાર રાખ્યા સિવાય?

આ વિરોધ શા માટે જિલ્લો કરો છો? તે સર્વ વ્યક્તિગત પ્રયત્ન પર આધાર રાખ્યા સિવાય, સ્વતંત્ર રીતે, જગતમાં કાર્ય કરે છે, પણ તે વ્યક્તિગત પ્રયત્નને સંજો છે, તેનો ઉપયોગ કરે છે. વ્યક્તિગત પ્રયત્ન તેનાં કાર્ય કરવાનાં સાધનોમાંનું એક સાધન છે, કદાચ સૌથી વધારે બળિષ્ઠ. જે કોઈ એમ માને કે વ્યક્તિગત પ્રયત્ન તે વ્યક્તિનો પોતાનો છે, તો તે એક ભ્રમણા છે, પણ જે વ્યક્તિ એવું બહાનું કાઢે કે વૈશ્વિક હિયા પોતાનાથી સ્વતંત્ર રીતે કાર્ય કરી રહી છે અને પોતે વ્યક્તિગત પ્રયત્ન કરવાનો ઈન્કાર કરે, તો તે પોતાનું સહકાર્ય કરવાની ના પાડે છે. અતિમનસું શક્તિ હકીકતમાં વ્યક્તિગત પ્રયત્નને પોતાનું સૌથી વધારે બળવાન સાધન માની તેનો ઉપયોગ કરે છે. એ શક્તિ જ તમારો વ્યક્તિગત પ્રયત્ન છે.

એટલે તમે જોઈ શક્ષો કે જ્યારે પ્રાણિક અભિમાનને એમ કહેવામાં આવે છે કે તું તારા પોતામાં અસ્તિત્વ ધરાવતો જ નથી, ત્યારે તેની પ્રથમ ગતિ એમ કહેવાની હોય છે કે, તો પછી હવે હું કશું જ કરવાનો નથી. હું કાર્ય કરતો જ નથી તો પછી હવે હું કાર્ય નહિ કરું. એ તો બહુ સરસ થયું. ભગવાન પોતે બધું કરી શકે છે, તે તેમનું કામ છે, હવે હું જરાપણું હલનયલન કરીશ નહિ. જે હું પથભાગી ન બનવાનો હોઉં, તો હવે હું કંઈ જ કરવાનો નથી. હીક, પણ આમ કહેવું એ નિર્યક છે. હું વારંવાર એ જવાબ સાંભળું છું. જે તે ખોટું લાગ્યું છે તેવું અભિમાન તે રીતે પોતાનો ઊભરો ઠાકવે છે. પણ સાચું વિશુદ્ધ પ્રતિકાર્ય એ છે કે માસુસે ઊસાહપૂર્વક અતિમનસના કાર્યમાં ભાગ લેવો, તેમાં પોતાની ચેતનાની સર્વ સંકલ્પ-શક્તિનો વિનિયોગ કરવો. પછી પોતે જે સ્થિતિમાં હોય ત્યાં રહીને, એવી લાગણી સેવવી કે મારા કરતાં અનંતગણી મહાન શક્તિ મને ટેકો આપી રહી છે, મને દૃશી રહી છે કે જે શક્તિ કદી ભૂલો કરતી નથી, જે મારું રક્ષણ કરે છે, અને સાથે સાથે મને જરૂરી સર્વ બળ આપે છે અને શ્રોષ સાધન તરીકે મારો ઉપયોગ કરે છે. જ્યારે માસુસ એવી લાગણી અનુભવે છે કે હું સલામતીમાં કાર્ય કરી

રહ્યો છું, ત્યારે તે કદી ભૂલો કરતો હોતો નથી, પોતે જે કરે છે તે અતિ આનંદ-પૂર્વક કરીને વધારેમાં વધારે સારાં પરિણામો લાવે છે, આ સાચી ગનિ છે. એમ અનુભવવંનું કે મારી સંકલપશક્તિ ખૂબ પરિપુષ્ટ અને બળિષ્ઠ અની છે. કારણું કે તે અનંતતામાં એક નાનકડી, અતિસૂક્ષ્મ વ્યક્તિ નથી પણ એક અનંત વૈચિક શક્તિ છે કે જે તે તસારી પાસે કાર્ય કરાવી રહી છે, તે સત્યની શક્તિ છે! આ જ સાચું પ્રતિકાર્ય છે.

બીજું પ્રતિકાર્ય દુઃખપૂર્ણ છે. “અરે, હું તો કાર્ય કરતો જ નથી; અરે, મારી સંકલપશક્તિ અભિવ્યક્ત થતી જ નથી, અરે, મારી શક્તિ કાર્ય કરતી જ નથી; એટબે હું સૂઈ જઈશ, તદ્દન જડ નિષ્ઠયતામાં આડે તાણીને સૂઈ જઈશ. હું હવનયવન નહિ કરું.” તે ભગવાનને કહે છે કે “તો પછી તમને હીક લાગે તેમ કર્યા કરો. મારું અસ્તિત્વ હવે રહ્યું જ નથી.” એ તો સાચે જ હીન વલસ ડાઢેવાય.

\*

“પ્રકૃતિ પ્રત્યે નીચા વળ્યા સિવાય ભગવાન રહી શકતા નથી અને મનુષ્ય ભગવાન પ્રત્યે અભીપ્તા સેવ્યા સિવાય રહી શકતો નથી. તે સાન્તનો અનંત સાથે સનાતન સંબંધ છે. જ્યારે તે બન્ને એકબીજીથી વિમુખ બનતા દેખાય છે, ત્યારે તે બંને વધારે ગાઢ મિલન માટે જ વિમુખ બનતા હોય છે.

મનુષ્યમાં જગતની પ્રકૃતિ હરી પાછી આત્મસભાન બને છે, જેથી તે તેના બોકતા પ્રત્યે વધારે મોટી છડાંગ મારી શકે. તે બોકતાને અશાનપણે પોતાનો બનાવી લે છે; પોતાનો બનાવી લીધેલા બોકતાનો જીવન અને ઈન્દ્રિયજન્ય લાગણી ઈન્કાર કરે છે અને ઈન્કાર કરતાં કરતાં તે બોકતાની જ ખોજ કરે છે. વિશ્વની પ્રકૃતિ ભગવાનને જાણતી નથી, કારણું કે પોતાની જતને જાણતી હોતી નથી. જ્યારે તે પોતાની જતને જાણે છે, ત્યારે તે અસ્તિત્વના વિશુંઘ આનંદને જાણશે.

એકતામાં સ્વામિત્વ, એકતામાં જોવાપણું નહિ એ રહસ્ય છે. ભગવાન અને મનુષ્ય, વિશ્વ અને વિશ્વથી પર જ્યારે એક બીજાને જાણે છે, ત્યારે તે બન્ને એક બની જાય છે. તે બેનો બેદ અજ્ઞાનનું કારણ છે, કારણુંકે અજ્ઞાન દુઃખનું કારણ છે.

(થાડુસ એન્ડ એફારિઅમ્સ સેન્ટીનરી વોલ્યુમ્સ ૧૬, પૃષ્ઠ ૩૮૨)

અહીં શ્રી અરવિંદ ને કહી રહ્યા છે તે મુજબ, વિશ્વની વાસ્તવિકતા એ ભગવાન છે, પણ તાત્ત્વિક રીતે તે આનંદ છે. વિશ્વ આનંદમાં અને આનંદ માટે સર્જાયું છે. પણ આનંદ માત્ર સૂષ્ટિની સ્થાન સાથે એકતામાં જ અસ્તિત્વ ધરાવી શકે. શ્રી અરવિંદ આ એકતાને સ્વામિત્વ ધરાવતાર, સર્જક તરીકે વર્ણવી છે, સ્વામી પર તેમની સૂષ્ટિનું સ્વામિત્વ સ્થપાય છે; તે એક પ્રકારનું પરસ્પર સ્વામિત્વ છે, જે એકતાનું પરમ તત્ત્વ છે, સર્વ આનંદનું ઉદ્ગમસ્થાન છે.

બેદને કારણે, કારણુંકે સ્વામી સ્વામિત્વ રાખતો નથી અને જેના પર સ્વામિત્વ છે તે સૂષ્ટિ સ્વામી પર સ્વામિત્વ રાખતી નથી, તેથી બેદ સર્જાય છે અને તાત્ત્વિક આનંદ અજ્ઞાનમાં પરિણત થાય છે; આ અજ્ઞાન જ સર્વ દુઃખનું કારણ છે. આ અજ્ઞાન, સામાન્ય રીતે જેને કહેવામાં આવે છે તે અજ્ઞાન નથી, કારણુંકે તેને તો શ્રી અરવિંદ અવિદ્યા કહે છે. તે અજ્ઞાન અવિદ્યાનું પરિણામ છે. સાચું અજ્ઞાન તો એકતાનું, મિલનનું, તાદાત્મ્યનું અજ્ઞાન છે. તે જ અજ્ઞાન સર્વ દુઃખનું કારણ છે.

જ્યારથી બેદ શરૂ થયો અને સૂષ્ટિએ પોતાના સ્થાન સાથેનો સંપર્ક ગુમાવ્યો. ત્યારથી અજ્ઞાનનું શાસન ચાલતું આવ્યું છે અને સર્વ દુઃખ તેનું પરિણામ છે.

જેમને ઝાંતર અનુભૂતિ પ્રાપ્ત થઈ છે તેવા બધાનો આ અનુભૂપ છે કે જે ક્ષણે મનુષ્ય પોતાના દિવ્ય ઉદ્ગમસ્થાન સાથે ફરી મિલન સ્થાપિત કરે છે, તે જ ક્ષણે સર્વ દુઃખ અદૃશ્ય થઈ જાય છે. પણ એક ખૂબ પકડ જમાવેલી ગતિ છે, જેને વિષે મેળે તમને ગયે અઠવાડિયે વાત કરી હતી, જે ગતિએ સૂષ્ટિના મૂળમાં આ તાત્ત્વિક મૂળ આનંદને નહિ, પણ કામનાને મૂકી આપી હતી. સૂષ્ટિના, આત્મ-પ્રગટીકરણના, આત્માભિવ્યક્તિના આ આનંદને ઘણા સાધકોએ અને ઋષિઓએ કામ તરીકે વર્ણવ્યો છે, આનંદ તરીકે નહિ. બૌધ્ધ ધર્મની આખી પરંપરા તે પ્રકારની છે. જે એકતા આપણને આવિભાવિના કરને અસ્તિત્વના તાત્ત્વિક આનંદને પાછો લાવી આપે છે, તેમાં ઉકેલ શોધવાને બદલે તેમણે એમ માની લીધું છે કે અસ્તિત્વ

ધરાવવાની સર્વ કામનાનો સંપૂર્ણ ત્યાગ અને વિનાશમાં પુનર્જીમન એ જ લક્ષ્ય છે અને માર્ગ છે.

આ જ્યાલ એ મૌલિક ગેરસમજ છે. આત્મમુક્તિ માટે જેમની ભલામણ કરવામાં આવી છે તે પદ્ધતિઓ વિકાસ માટેની પદ્ધતિઓ છે, જે ખૂબ ઉપયોગી નીવડી શકે. પણ આ જ્યાલ કે જગત્ત મૂળ મુદ્રે જરાબ છે; કારણકે તે કામનાનું પરિણામ છે, જે જગત્તમાંથી આપણે બને તેટલા જઈએ, જમે તે લોગે, છટકી જવું જોઈએ એ જ્યાલ માનવજીતિના ઈતિહાસમાં સર્વ આધ્યાત્મિક જીવનની સૌથી વધારે મોટી ઝાંચે ગંભીર વિકૃતિ છે.

તે જ્યાલ કદાચ અમૃક સમય માટે ઉપયોગી બની શક્યો હશે, કારણકે જગતના ઈતિહાસમાં દરેક વસ્તુ ઉપયોગી છે; પણ તેની ઉપયોગિતા લૂતકણની બની ગઈ છે, તે ધસાઈ ગઈ છે, અને એ જ્યાલને તિલાંજલિ આપવાનો સમય પાકી ગયો છે; આપણે વધારે તાત્ત્વિક અને ઉચ્ચતર સત્ય પ્રત્યે પાછા જવું જોઈએ, અસિતત્વના આનંદને પ્રાપ્ત કરી શકીએ, ભગવાનના મિલનના અને પ્રગટીકરણના આનંદને માસ્તી શકીએ.

પાર્થિવ સાક્ષાત્કારની આ નવીન સમજે સર્વ પહેલાંના આધ્યાત્મિક જ્યાલોનું સ્થાન બેનું જોઈએ અને અતિમનસ્ત્તા સાક્ષાત્કારની નવીન અનુભૂતિનો માર્ગ ખુલ્લો કરી આપવો જોઈએ. તેથી મેં તમને ગયે અઠવાદિયે કલ્લું હતું કે માત્ર સાચ્યા દિવ્ય આનંદ જ વિજયને લાવી શક્યે.

સ્વાભાવિક રીતે જ આ આનંદના સ્વરૂપ વિષે કોઈ પણ પ્રકારનો ગુંચવાડો ન હોવો જોઈએ. તેથી ક્રી અરવિંદ શરૂઆતથી જ આપણને સાવધાન કરે છે કે જ્યારે સાધક સર્વ ઊપલોગોથી પર ચાલ્યો જાય છે, ત્યારે જ તે આનંદમાં પ્રવેશી શકે છે. આનંદ ચોકકસપણે તે સ્થિતિ છે, કે જે આનંદના પ્રગટીકરણમાંથી પ્રાપ્ત થાય છે. પણ સામાન્ય રીતે જેને ઊપલોગનો આનંદ કહેવામાં આવે છે તેમાંથી તે તદ્દન વિરુદ્ધ પ્રકારનો છે. તે ઈન્દ્રિયજન્ય સુષોનો સંપૂર્ણપણે ત્યાગ કરવો જોઈએ; તો જ તે ભૂમાનો આનંદ મળે.

(એક બાળકને) તારે કંઈ પૂછવું છે?

મારે એક પ્રેરણ છે, પણ તે ભાગ હજુ આપણે વાંચ્યો નથી.

તે પ્રેરણ શો છે ?

તે પ્રેરણ પરમાત્મા અને પ્રકૃતિ સંબંધી છે.

તે પ્રેરણ શો છે ?

જ્યારે તેમની જાંખી થાય છે, ત્યારે પરમાત્મા અને પ્રકૃતિ એકબીજાથી અલગ શા માટે ભાગી જાય છે ? \*

કીડા માટે, લીલા માટે, તે કહે છે કે તે બન્ને ખેલી રહ્યા છે.

( એક તરુણ શિષ્ય ) માતાજી, તે લીલા છે, કીડા છે એ વાત શું પ્રકૃતિ જાણે છે ? અગવાન તો જાણે છે કે તે લીલા છે ; પણ પ્રકૃતિ તે જાણે છે ?

મને લાગે છે કે પ્રકૃતિ પણ તે જાણે છે ; માત્ર મનુષ્ય જ તે નથી જાણતો !

( બીજો બાળક ) મધુર મા, પ્રકૃતિ કયાં સંતાઈ જઈ શકે ?

તે કયાં સંતાઈ જઈ શકે ? મારા બાળક તે અયેતનતામાં સંતાઈ જાય છે. અયેતનતા એ સંતાઈ જવા માટેનું મોટામાં મોટું સ્થાન છે. વળી પરમાત્મા પણ અયેતનતામાં સંતાઈ જાય છે.

કદાચ, જ્યારે માણસ જાણે છે કે એ એક લીલા છે, ગમમત માટેની કીડા છે, ત્યારે તે આનંદદાયક લાગે છે. પણ જ્યારે માણસ તેને લીલા જાણતો નથી, ત્યારે

\* "પરમાત્મા અને પ્રકૃતિ એકખીલના પ્રેમમાં પડેલાં અને ખેલતાં કુમાર અને કુમારી જેવાં છે. ( જાંખી થતાં ) તેઓ એકખીલથી સંતાઈ જાય છે, જેથી તેઓ એકખીલને શોધે, પીછો પકડે અને પકડી પાડે.

તે આનંદદાયક નથી લાગતો. સમજ્યા? જ્યારે સાધક બીજું બાજુંથે, ભગવાનની બાજુંથે ચાલ્યો જાય છે, ત્યારે જ તેને તે લીલા તરીકે જોઈ શકે છે. અર્થાત् જ્યાં સુધી આપણે અજ્ઞાનમાં છીએ, ત્યાં સુધી જે વસ્તુ આપણને પથ આપવા, પ્રસન્ન કરવા સર્જાઈ હતી તે આપણને દુઃખદાયી નીવડે છે. તેનો પાયાનો અર્થ આ નીકળે છે કે જ્યારે માણુસ કોઈ કાર્ય બુદ્ધિપૂર્વક કરે છે, પોતે શું કરી રહ્યો છે તેની સમજપૂર્વક કરે છે, ત્યારે તે રસગ્રદ અને ખૂબ આનંદદાયી નીવડે છે, પણ જ્યારે તમે તે બુદ્ધિપૂર્વક કરતા હોતા નથી, સમજપૂર્વક કરતા હોતા નથી, જ્યારે તમને એમ લાગે છે કે તે તમારા પર ઢેકી બેસાડવામાં આવ્યું છે, તમારે તે સહન કર્યે જ ધૂટકો છે, ત્યારે તે આનંદદાયી બનતું નથી.

એટલે તમને હમેશાં આ ઉકેલ આપવામાં આવતો હોય છે કે તમારે શીખી બેનું જોઈએ, જાણવું જોઈએ, તે કાર્ય બુદ્ધિપૂર્વક કરવું જોઈએ. પણ મારી સારી માગણી આ છે કે તે લીલામાં પરિવર્તન લાનવું તે વધારે સારું છે. જ્યારે માણુસ તે સ્થિતિમાં આવે છે, ત્યારે તે સિમત કરી શકે છે, સમજ શકે છે, મજા પણ માણુસ શકે છે. પણ જ્યારે તે જુએ છે અને સલાન બને છે કે બીજી બધા લોકો એમ જાણતા હોતા નથી કે તેઓ કીડા, લીલા કરે છે, લીલાને તે બહુ ગંભીરપણે સ્વીકારકતા હોય છે, અને તેમને તે દુઃખદાયી લાગે છે, ત્યારે મને એમ લાગે છે કે તે માણુસે લીલામાં પરિવર્તન લાવવાનું પસંદ કરવું જોઈએ. આ ઉકેલ મારો અંગત અલિપ્રાય છે.

હું બરાબર જાણું શું કે જ્યારે નીચે રહીને સહન કરવાને બદલે માણુસ બીજું બાજુંથે તરી જયા હોય છે, જ્યારે તે ઊર્ધ્વમાં હોય છે, માત્ર સાક્ષીભાવે જોતો જ હોતો નથી, પણ પોતે કિયાશીલ બને છે, ત્યારે એક એવું સંપૂર્ણ પરિવર્તન થઈ જાય છે કે આ અચેતનતામાં પોતે જે ભાર વહન કરી રહ્યો હતો, અજ્ઞાનને પોતાની પીડ પર લાઈને ફરતો હતો, પોતે કંપાં, કેવી રીતે, થા માટે જઈ રહ્યો છે તે જાણ્યા સિવાય પરિસ્થિતિઓને સહન કરી રહ્યો હતો, તેને સમૃતિમાં લાવવું કઠિન બની જાય છે. જ્યારે તે બધું બુલી જાય છે, ત્યારે જ તે કહી શકે કે આ બધું એક સનાતન ઉદ્ઘાનમાં એક સનાતન કીડા છે. પણ તે એક આનંદદાયી કીડા બની શકે તેટલા માટે, દરેક જણે તે જેવના નિયમો જાણી વઈને તે જેવ રમવા સમર્થ બનવું જોઈએ. જ્યાં સુધી માણુસ જેવના નિયમો જાણતો હોતો નથી, ત્યાં સુધી તે કીડા તેને માટે આનંદદાયી બનતી નથી. એટલે તમને આ ઉકેલ આપવામાં આવે છે કે જેવના નિયમો જાણી વો. પણ દરેક માણુસ તેમ કરી શકે તેમ નથી.

મારા મનમાં એક એવી પ્રબળ છાપ છે કે એક વ્યવહારુ મશ્કરો આવ્યો, તેણે રમતને બગાડી મૂકી, રમતને નાટયાત્મક બનાવી મૂકી. આ વ્યવહારુ મશ્કરો તે સ્થષ્ટ રીતે ભેદનું અને અજ્ઞાનનું કારણ છે કે જે અજ્ઞાન આ ભેદનું પરિણામ છે. બધી આધ્યાત્મિક પરંપરા હોવા છતાં, એમ માની બેનું કહિન છે કે આ ભેદની, અજ્ઞાનની, દુઃખની સિથિતિ, સૂણિના પ્રારંભ કાળે, પહેલેથી જોઈ લેવામાં બધું કહેવાયું હોવા છતાં, માણસને એમ માનતું ગમતું હોતું નથી આવી હતી, કે પહેલેથી જોઈ લઈ શકાય તેવી તે સિથિતિ હતી. સાચેજ, હું એમ માનતી નથી. હું તેને એક લયંકર અક્સમાત કહું છું; પણ છતાં માનવ ચેતના માટે તે એક લયંકર અક્સમાત છે; વૈશિષ્ટ ચેતના માટે તે એક એવો અક્સમાત હોઈ શકે કે જેનો ઈલાજ થઈ શકે તેમ છે. જ્યારે તે અક્સમાતનો ઈલાજ બેવાઈ ગયો હોય, ત્યારે આપણા તેને યાદ કરીને એમ કહેવા માટે સમર્થ બનીશું કે ઓહ, તે અક્સમાતે આપણને એનું કાંઈક આપ્યું છે કે જે અક્સમાત સિવાય આપણે પ્રામ ન કરી શક્યા હોત પણ પ્રથમ તો આપણે તેનો ઈલાજ કરવા માટે રાહ એવી જોઈએ.

જમે તેમ હોય, પણ મને ખબર નથી કે એવા લોકો છે કે જેઓ એમ કહે છે કે આ બધું પહેલેથી જોઈ લેવામાં આવ્યું હતું, ભગવાને તે માટેનો સંકલ્પ કર્યો હતો. પણ હું તમને કહું છું કે આ બધું પહેલેથી જોઈ લેવામાં આવ્યું ન હતું. ભગવાને તે માટેનો સંકલ્પ કર્યો ન હતો. તેટલા જ માટે જ્યારે તે ઓચિતો અક્સમાતૂ બન્યો, ત્યારે મૂળ ઉદ્ગમસ્થાનમાંથી તરત એક એવી કોઈ ચીજ ઉછળી આવી, જે જે આ અક્સમાત ન બન્યો હોત તો કદાચ પ્રગટ ન થાત. જો આનંદ આનંદ રહ્યો હોત, આનંદ તરીકે જ તેનો ઝ્યાલ રહ્યો હોત, બધું આનંદમાં અને મિલનમાં જ ઉદ્ભવ્યું હોત, બેદમાં નહિં, તો દિવ્ય ચેતનાને અયેતનતામાં પ્રેમ તરીકે ઝૂબકી મારવાની જરૂર ઉલ્લી ન થઈ હોત. તેથી જ્યારે માણસ દૂર-સુદૂરથી, ઊર્ધ્વમાંથી આને જુઓ છે, ત્યારે તે કહે છે કે આખરે આ અક્સમાતમાંથી અમૃક લાલ તો પ્રામ થયો જ છે. પણ તે પ્રમાણે કહેવા માટે માણસે તે અક્સમાતને ખૂબ દૂરથી, મોટી ઊંચાઈ પરથી જોવો જોઈએ. જ્યારે તે અક્સમાતને ખૂબ પાછળ મૂકી દેવામાં આવ્યો હોય છે, માણસ કા સિથિતિથી પર ચાલ્યો ગયો હોય છે, એકતામાં અને આનંદમાં પ્રવેશ્યો હોય છે, જ્યારે બેદ, અયેતનતા, દુઃખ અદૃશ્ય થઈ ગયાં હોય છે, ત્યારે તે ખૂબ જ્ઞાનપૂર્વક કહી શકે કે, ઓહ, હા, હા, આપણે એવી એક અનુભૂતિ પ્રામ કરી છે કે જેને આપણે તે અક્સમાત વિના પ્રામ ન કરી હોત. પણ તે અનુભૂતિ આપણી પાછળ હોવી જોઈએ, આપણે તે અનુભૂતિની

મધ્યમાં ન હોવા જોઈએ. હું આ વાત જાણું છું કે જે કોઈ માસુસ આ સિથિતમાંથી બહાર આવ્યો છે, જે ઓક્તોબરની ચેતનામાં જીવન ધારણ કરે છે, જેને માટે અજ્ઞાન કોઈક બાબ્દ ચીજ છે, જેને માટે હવે અજ્ઞાન નશિકનું અને દુઃખદાયી નથી, તેવા માસુસ માટે પણ, ઉપેક્ષાના સ્મિત સાથે, તે સિથિતમાંથી બહાર નહિ આવેલા વોકેનાં દુઃખો જોવાં તે અથક્ય છે. મને તે અથક્ય લાગે છે. તેથી એ આપશ્યક છે કે, વિશ્વમાંની વસ્તુઓનું પરિવર્તન થતું જોઈએ, અને માંદળીની તીવ્ર સિથિત અદૃશ્ય થઈ જવી જોઈએ. જેથી આપણે કહી શકાય કે, હા, હા, અમને આ અક્ષમાતથી લાલ પ્રામ થયો છે. એ સાચું છે કે કોઈક લાલ પ્રામ થયો છે, પણ તે લાલ માટે આડયે કિંમત ચૂકવવી પડી છે.

તેથી હું માનું છું કે, તે કારણે કે ઘસ્તા દીક્ષિતો અને ઋષિમુનિઓ નિર્વાણના ઉકેલ પ્રત્યે આકર્ષણીયા છે, કારણે અજ્ઞાનમથી આવિર્જિનાં પરિણામેમાંથી છટકી જવાનો, તે સ્પષ્ટ રીતે ખૂબ મૌખિક માર્ગ છે.

આ પ્રગટીકરણનું સાચી દિવ્ય વાસ્તવિકતામાં રૂપાંતર કરવું તે જ ઘણે વધારે ઉચ્ચ ઉકેલ છે. આ ઉકેલ માટે જ અત્યારે અમે પ્રથમ કરવા માયીએ છીએ, અને એક યા તો બીજા દિવસે તેમાં સફળ થવાની ખાતરી રાખીએ છીએ, કારણે વસ્તુસિથિત ગમે તેવી હોય, પણ સત્ય સેનાતન કાળ માટે સત્ય જ રહેવાનું છે, જે તાત્ત્વિક રીતે સત્ય છે. તે આજે કે કાલે સાક્ષાત્કારમાં પણ અનિવાર્ય રીતે સત્ય થવાનું છે. શ્રી અરવિંદે આપણું કશ્યું છે કે આપણે તે માર્ગ પર પ્રથમ પગલાં માંડયાં હતાં, અને હવે તે કાર્ય પરિપૂર્ણ રીતે સિદ્ધ કરવાનો સમર્પ પાકી હોય છે; તેથી આપણે માત્ર યાત્રાનો પ્રારંભ જ કરવાનું જ કરવાનું, છે.

એટબે તારો પ્રેરણ? (સંતાકુકૃતીની રમત વિષે જે બાળકે પ્રેરણ કર્યો હતો તેના પ્રત્યે) તારે આ જોણવાની ઈરંધ્રા હતી ને?

વાસ્તવિક રીતે તું પુછવા માગતો હતો કે વિશ્વ આવું કેમ?

હા, આપણે તે વાતને જીવટાવી શકીએ. વિશ્વ આ પ્રકારનું છે, ભગવાન અને મનુષ્ય આ પ્રકારના છે, આ પ્રકારના દેખાય છે, એમ કહેવાને બદલે આપણે એમ કહેવું જોઈએ કે વર્તમાન કણે ભગવાન અને માનવ વચ્ચે જે તાત્ત્વિક સંબંધ છે તેની કદાચ આ બાબ્દ, ઉપરથોડિયા અભિવ્યક્તિ છે.

અથવા જ્યારે માણસ લીલા, કીડા કરે છે, ત્યારે તે ગંભીર હોય છે, તેના કરતાં વધારે દિવ્ય હોય છે. (હાસ્પિર્વક) પણ આમ કહેવું તે હંમેશાં સારું નથી. કદાચ પર્દિતની વિદ્વત્તા કરતાં અથવા સંતની તપસ્યા કરતાં બાળકોની સ્વર્ણલૂં કીડામાં વધારે દિવ્યતા રહેલી છે. હંમેશાં હું એમ જ વિચારતી આવી છું, (સિમતપૂર્વક) બાળકોની દિવ્યતા પોતાની જતથી અભાન હોય છે, એટલું જ.

મારે ઉબૂવ કરવું જેઈએ કે જ્યારે હું ખૂબ ગંભીર હોઉં છું, ત્યારે મને એમ લાગે છે કે હું તાત્ત્વિક રીતે મારી સાચી જતને વ્યક્ત કરી રહ્યું છું. ગંભીરતા મને એવો ત્રાસ પેદા કરે છે કે જાણે હું આ સૃષ્ટિનો અસ્પષ્ટ, વજનદાર ભાર વહન ન કરતી હોઉં. પણ જ્યારે હું જેલતી હોઉં છું, હસતી હોઉં છું, મારી જતની મજા માણસતી હોઉં છું, ત્યારે મને એમ લાગે છે કે જાણે આનંદનું સૂક્ષ્મ ચૂંઝું જિધ્ર્વમાંથી વરસે છે, અને આ સૃષ્ટિને, જગતને એક બહુ ખાસ રંગથી રંગી દે છે. અને તે વિશ્વે તાત્ત્વિક રીતે જે પ્રકારનું બનવું જેઈએ તે સ્વરૂપ પ્રત્યે તે જગતને વધારે નજીક લઈ જાય છે.

માતાજી, તમે ક્યારે અને શા માટે ગંભીર બની જતાં હો છો ?

કીક તમે મને કોઈ વાર ગંભીર બનેલી જેઈ છે, નહિ, વારું? જ્યારે હું એક પગથિયું નીચે ઉત્તરતી હોઉં છું, જ્યારે કોઈક ઝૂભી જતું હોય છે અથવા મુશ્કેલીમાં મુકાઈ ગયેલું હોય છે, ત્યારે તેને પાણીમાંથી જેંચી કાઢીને બહાર કિનારે લાવવા માટે માણસે કિનારા પરથી નીચે પાણીમાં ઉત્તરવું જ પડે છે, કદાચ તે મારી ગંભીરતાનું કારણ છે. જ્યારે સૃષ્ટિ ખાસ પ્રકારની મુશ્કેલીમાં હોય, ત્યારે થોડું નીચે આવવું પડે છે, જરાક જેંચવું પડે છે, અને તેથી ગંભીર થઈ જવાય છે. પણ જ્યારે બધું બરાબર ચાલવતું હોય, ત્યારે હસી શકાય અને આત્મ-મોદ માણી શકાય.

એમ કહી શકાય કે સર્વ ઉપદેશો, સર્વ પ્રોત્સાહનો, સર્વ પ્રાર્થનાઓ અને આહુવાનો, તી અરવિંદ જેને નિમ્નનાર જોગાઈ કરે છે ત્યાંથી, આવતાં હોય છે. તે શિખર હોય, સીમાડાનો પ્રદેશ હોય, આ નિમ્નનાર જોગાઈનો છેડો હોય, પણ ત્યારે માણસ હજુ પણ નિમ્નનાર જોગાઈમાં જ હોય છે. જે કલે તે બીજી બાળુએ

ચાલ્યો જાય છે, ત્યારે આ ખંડું નિરર્થક, લગભગ છોકરમત જેવું, અને અશાનપૂર્ણ લાગે છે. છતાં પણ અમૃત વખતે આ સ્થિતિમાં હોવું અને બીજે સમયે બીજી બાજૂના છોડા પર હોવું તે એક ખૂબ રસપ્રદ અનુભવ છે. આ બીજી બાજૂનો છોડો, કે જે માનવ ચેતના માટે લગભગ અપ્રાપ્ય શિખર સમાન છે તે સચેતનતાપૂર્વક, નિર્મુક્તિપૂર્વક ઉચ્ચતર ગોળાઈમાં રહેનાર વ્યક્તિત માટે એક અવતરણ છે.

પાછળથી હું ઈચ્છું છું કે, આપણે 'દિવ્ય જીવન'નાં છેલ્લાં પ્રકરણો વાંચીશું. મને લાગે છે કે, તમે તે પ્રકરણો સમજવા પૂરતા પાકટ અને પરિપક્વ બનતા જાઓ છો, ત્યારે તમે અનેક પ્રકારની વસ્તુઓ સમજવા શક્તિતથાળી બનશો; ત્યારે આપણે મૂળ ભાગ પર આધ્યાત્મિક વિષયો ચચીશું તેમને તમે સમજ શકશો. તે તમને સાક્ષાત્કાર પ્રયે એક મહત્વનું પગલું આગળ ભરવામાં મદદગાર થશે. શ્રી અરવિંદ બહુ જ ચોક્કસ રીતે, આશ્રમકારક રીતે, ચેતનાની આ બે સ્થિતિઓ વચ્ચેના લેદનું વર્ણન કરે છે, માણસને જે સાક્ષાત્કારની આખરી પરિપૂર્ણતા લાગે છે તે કેવી રીતે હજુ પણ નિમનતર ગોળાઈમાંની વસ્તુ હોય છે, જેમાં માનવે જાણેલા દેવો સાથેના સંબંધોનો પણ સમાવેશ થઈ જાય છે, કયી રીતે આ બધી વસ્તુઓ હજુ પણ ખૂબખૂબ નિમનતર ગોળાઈમાં હોય છે, અને સાચી સ્થિતિ, જેને શ્રી અરવિંદ અતિમનત્ત્વની સ્થિતિ કહે છે તે કયા પ્રકારની હોય છે, જેને નિમનતર ગોળાઈની પર ગણેલો માનવ પ્રાપ્ત કરતો હોય છે.

જ્યાં સુધી માનવ નિમનતર ગોળાઈથી સભાનપણે પર ગણો હોતો નથી, ત્યાં સુધી અનેક વસ્તુઓનું એવું એક જગત છે કે જેને તે સમજ શકતો નથી. એટલે હું હવે એમ ઈચ્છું છું કે આપણે બધાં એકઠો મળીને માર્ગને ખુલ્લો કરીએ અને જરાક ઉધ્વર્મમાં આગળ ધ્યાનો આપણો તે સ્થિતિ છે.

## ૧૬ જાન્યુઆરી ૧૯૮૭

“પ્રથમ તો માસુસ અંધતાપૂર્વક ખોજ કરે છે, અને તે જાણતો પણ નથી હોતો કે હું મારો દિવ્ય આત્માની જોગ્ય કરી રહ્યો છું,” કારણકે તે ભૌતિક પ્રકૃતિની અસ્પષ્ટતામાંથી, જડતામાંથી ખોજની શરૂઆત કરે છે. અને તે દર્શન કરવાની શરૂઆત કરે છે, ત્યારે પણ પોતાનામાં વધતા જતા પ્રકાશથી લંબા સમય સુધી તે અંજાઈ જતો હોય છે, અંધ બની જતો હોય છે. પરમાત્મા પણ તેની ખોજનો પ્રત્યુત્તર અસ્પષ્ટતાપૂર્વક આપે છે; તે પણ માનવની અંધતાને ખોજતા હોય છે એને તેની મજા માસુતા હોય છે. પોતાની માતાને ફિલ્મેસીને ખોજતા નાના બાળકના હાથની પેઢે.”

(શ્રીદસ એન્ડ એફેરિઓર્સ, સેન્ટ્રિની વેલ્યુઝસ ૧૬, પૃષ્ઠ ૩૮૨)

મધુર માતાજી, એ કેવી રીતે બની શકે કે માસુસ કોઈક વસ્તુને ખોજતો હોય અને છતાં પોતે ખોજ રહ્યો છે તે જાણતો ન હોય?

એટલી બધી વસ્તુઓ વિષે તમે વિચારતા હો છો, વાગ્યાં અનુભવતા હો છો, હૃદિષ્ઠા હો છો, કરતા હો છો, અને તે સધણું અજાણતાં જ. તમે તમારી જાતથી અને તમારામાં જે કાઈ થઈ રહ્યું છે તે બધાથી પૂર્ણ રીતે સભાન હો જરા? ના, જરા પણ નહિ. દાખલા તરીકે, ઓધિતી, તમે આશા ન ચાખો હોય ત્યારે, અમુક કાલે હું તમને પૂછું કે તમે શેનો વિચાર કરી રહ્યા હો? તો છુટ ટકા બોકો તો એવો જવાબ આપ્યો કે હું જાણતો નથી તે જ રીતે જે હું બોજો પ્રશ્ન પૂછું કે તમારે શું જોઈએ છો? તો તમે કહેશો કે મને ખબર નથી. જે હું પૂછું કે તમને કેવી વાગ્યાં થાય છે? તો જવાબ મળવાનો કે મને ખબર નથી. જે બોકેને આત્મનિરીક્ષણ કરવાની ટેવ છે, પોતે કેવી રીતે જીવી રહ્યો છે તેના પર ચાંપતી નજર રાખતા હોય છે, પોતાનામાંથી ચાઢી રહ્યું છે તે જાણવાની જરૂરિયાત ઉપર નેચો એકાગ્ર બન્યા હોય છે, માત્ર તેવા બોકેને કોઈ આવો ચોક્કસ સપાલ પૂછી શકાય, અને માત્ર તેચો જ તરત તેના જવાબ આપો શકે. જીવનમાં કેટલાક દાખલાઓમાં માસુસ પોતે જે વિચારતો હોય, વાગ્યાં અનુભવતો હોય, હૃદિષ્ઠતો હોય તેમાં એટલો બધો તલ્લીન બની ગયો હોય છે/કે તે કહી શકે કે હા, આ

વસ્તુ મીંથું છું, હું ને પ્રસ્તુતો વિચાર કરી રહ્યો છું, હું આ લાગણી અનુભવું છું; પણ એ તો અસિતન્યની અમૃત શક્તિ જ હોય છે, સમગ્ર સમય નથી હોતે.

તમે આનો અનુભવ નથી કર્યો ના?

ઓચી રીતે પોતે શું છે તે જોળી કાઢવા માટે, પોતે શા માટે પૃથ્વી પર આવ્યો છે ને જોળીનું કાઢવા માટે, ભૌતિક અસિતન્યનો હેતુ થા છે તે જોળી કાઢવા માટે, પૃથ્વી પર પોતાની હાજરીનો, આ રૂપ ધારણ કર્યાન્તા, આ અસિતન્યનો ઉદેશ શોષ્ણી કાઢવા માટે, બોકેનો મોટો ભાગ અસમર્થ છે, તેઓ એક વાર પણ તેવા પ્રશ્નનો પોતાની જતને પુછ્યા વગર જ જવના હોય છે, માત્ર ગ્રાન્યાગ્રાંઠ્યા, પસંદગી પામેલા લોકો જ રમાયુર્વકઃ એવી સવાલ પોતાની જવને પુછતા હોય છે, અને નેથી પણ થોડા લોકો તે પ્રશ્નનો પ્રત્યુત્તર જેજવવા માટે પ્રયાસ કરવાનો પ્રારંભ કરતા હોય છે. કારણું તે પ્રત્યુત્તર જાણાર મહાપુરુષના મિલનનું સદ્ગુર્યાનું જો તેને ન સાંપડે, તો તે વસ્તુ જોળી કાઢવી એ જરા પણ સહેલું નથી. દાખલા તરીકે, ધારો કે શ્રી અરવિંદનું કોઈક પુસ્તક તમને કદી પણ પણ પ્રાપ્ત થયું ન હોત, અથવા આ જોળને પોતાનું જવના સમર્પિત કરી દેનીર કોઈ પણ ઋષિ-મુનિનું, તત્ત્વજીતકનું, વૈખ્યકનું કોઈપણ પુસ્તક તમને પ્રાપ્ત થયું ન હોત, ધારો કે તમે એવા લાગ્યો બોકેમાંના એક સામાન્ય આલુસ છો કે જેમણે કેટલાક દેદો વિષે, અમૃત પર્યના રૂપ વિષે કે જે શક્તા કરતાં વધારે ટેવ રૂપ છે, જે ધર્મ તમે શા માટે પૃથ્વી પર આવ્યા છો તે વિષે ભાગ્યે જ તમને કશું ઉદેતો હોય છે (અત્યારે તો માણસને ભાગ્યે જ ધર્મ કે હેવો વિષે સાંભળવાનું મળતું હોય છે), તો તમને ભાગ્યે જ આ જવનના હેતુ વિષે વિચારવાનો પણ વિચાર આવતું માણસ દિનપ્રતિદિન રોજની ઘટનાઓ ઘટમાળમાં જીવતો હોય છે. જ્યારે તે બાબક હોય છે, ત્યારે તે બેખવાનો અને ખાવાનો જ વિચાર કરતો હોય છે. થોડાક સમય પછી તે જાણવાનો વિચાર કરવા લાગે છે, વળી થોડાક સમય પછી તે જવનના સર્વ પ્રસંગોનો વિચાર કરતો થઈ જય છે. પણ પોતાની જત સમસ આ સમસ્યા રજૂ કરવી, આ સમસ્યાનો સામનો કરી પોતાની જતને પુછ્યું કે - આખરે હું જન્મ્યો હું શા માટે એમ કેટલાક લોકો મૂછે છે. કેટલાક લોકો પર જ્યારે વિપત્તિ આવી પૂર્ણ છે ત્યારે જ તેઓ આ સવાલ જોતાની જતને પુછતા હોય છે. જ્યારે પોતાના પ્રિય સુજાનને તેઓ મયે જતો જુઓ છે, જ્યારે પોતે હુંખદાયી, મુશ્કેલ્યાલ્યા સંભેગોમાં જપદાઈ ગયા હોય છે, ત્યારે જે તેઓ પૂરતા ભુલિયાયી હોય તો પોતાની પ્રત્યે પાછળ ફૂઝેને

તે પોતાની જતને પુછે છે કે, આપણે જે છીએ રસ્થા છીએ તો કરુશુ કણની કર્યા  
પ્રકારચી છે, તેનો ઉપયોગ થાયે છે, તેનો હેતુ થાયે છે?

તે જ કષે માસુસ જાણવાની ખોજ શરૂ કરે છે.

અને જયારે માલુમ પડે છે કે તેને દિવ્ય આત્મા છે, અને તેથી  
તણે તેને શ્યેષી અફ્ટેઓ બેઈએ, તેનું શાન મેળવવું બેઈએ. પણ આ બહુ પાછળથી  
બને છે, અને છતાં ભૌતિક દેહમાં જન્મ બેતાની સાથે જ તે કાલથી જ અસ્તિત્વમાં,  
તેનો ઊંડાણોમાં આ ચૈત્ય હજારી હોય છે, જે સમગ્ર અસ્તિત્વને પરિપૂર્ણતા તરફ  
ધરુંથે. પણ આ ચૈત્ય પુરુષને કોઈ જાણે છે અને સ્વીકારે છે તે પણ કેટલાક  
ખાસ સંજોગેમાં બનતું હોય છે, અને કમનસીજે તે સંજોગો કિક્ટ અને દુઃખદાયી  
હોવાના; નહિ તો માસુસ વિચાર કર્યા કિના જ જીવ્યે જાય છે. અસ્તિત્વનાં  
ઊંડાણોમાં આ ચૈત્ય પુરુષ છે, જે ચેતનાને જગૃત કરતા માટે અને ભિલનાં  
પુનર્નિર્માણ કરતા માટે શોધ કર્યા જ કરતો હોય છે.

જયારે તમારી ઊમર દશ વર્ષની હતી, ત્યારે તમે આ વાત જાણતા હતાં | ના,  
તમે નહાતા જાણતા. છતાં પણ તમારા અસ્તિત્વનાં ઊંડાણોમાં તમહરો ચૈત્ય પુરુષ  
કર્યારનોં ય તે માગતો-ઈચ્છતો હતો, તેને માટે શોધ કરતો હતો. તમારો ચૈત્ય પુરુષ  
જ તમને અહીં લઈ આવ્યો છે.

પણી વસ્તુઓ બનતી હોય છે, અને તે શા માટે બને છે એમ તમે તમારી  
જતને પુછતા હોતા નથી. તમે જે વસ્તુઓને સ્વીકારી બો છો, તે તે પ્રકારનું છે.  
( કારણકે તે તે પ્રકારનું છે.) મેં તમને વાત કરી ત્યાર પહેલાં, તમારામાંના કેટલા  
જણે પોતાની જતને પુછ્યું હતું કે અમે અહીં આવી ચઢ્યા તે શાથી બન્યું? તે  
જાણનું એ બહુ રસપ્રેદ બીજા છે.

સ્વાભાવિક રીતે જ, ઘણી વાર તો, તેનો જવાબ તદ્દન સાદો છે કે ભારો  
મસતાપિતા અહીં છે, એટલે હું અહીં છું. પણ તમે અહીં જન્મયા તો ન હતા.  
અહીં કોઈ જન્મનું ન હતું, તમે પણ નહિ. તમે બેંગલોરમાં જન્મયા હતા. અહીં  
કોઈ જન્મનું ન હતું અને છતાં તમે બધા અહીં છો. તમે તમારી જતને તેના  
કારણ વિષે પુછ્યું નથી. તે એમ બન્યું, કારણકે તે એમ બન્યું. પોતાની જતને

તે કિએ પૂછવાની અને આખરી તરીકે સ્વીકારી શકાય તેવો સંતોષકારક બાબુની આપવાની વર્ણે, અમે એમ કહેવું કે 'કદાચ મારું અહીં આગમન એ ભાવિનું એક સુચન છે, મારા જીવનનો હેતુ છે.' તેની વર્ણે કેટલું બધું અંતર છે, તે કથન પર આવતા પહેલાં કેટલી લાંબી મુસાફરી કરવી પડે છે !

દરેક જન્મને માટે ઓછાવતા પ્રમાણમાં બાબુ અરસોં હોય છે, જેમની આજી કિમતાનથી છેતી અને ને દરેક વસ્તુની ખૂલ્લાં મુર્ખતાસોરી રીતે સમજૂતી આપે છે, પણ એક ગણતનકે કારણ હોય છે કે જેને તમે હજુ જાણતા નથી. તમારામાંશું ધર્મા વોડો છે કે જેમને સોટે અહીં શા માટે આવી ચઠ્યા તે જાણવામાં ભૂલ કરું છે ? તમારામાંના કેટલા જણે તમારી જતને આ સવાલ પૂછ્યો છે કે - મારા અહીં આગમનનું સાચું કારણ શું છે ?

તમે તમારી જતને એક વાર આ પ્રશ્ન પૂછ્યો છે ?

મધુર મા, મૈં તમને એકવાર એ પ્રશ્ન પૂછ્યો હતો.

ઓછ, તે ખરું ; પણ તમે ? ..... અને તમે ?

અને તે યાદ નથી.

તમને યાદ નથી. અને તમે ?

મા, પહેલાં કઢી મેં મારી જતને આ સવાલ પૂછ્યો ન હતો. પહેલાં નહિ. હવે તે સવાલ આવ્યા વાર્યો છે. અને તમે ?

ના..... કાંચે હજુ હું બીજા ધર્માઓને એ સવાલ મુછી શકું મને જરાબર ખબર છે. નેઓ જીવનના કેટલાક અનુભવ પછી આવ્યા છે, તેમને આપવું હતું માટે આવ્યા છે, જેમને અહીં આપવા પાછળ એક સલાન કારણ હતું, તેઓ મને ચેષ્કસ કઢી શકે કે હું આ કારણે અહીં આવ્યો છું, અને તે એક અંધિક સમજૂતી

હોય. તદ્દન સાર્થુ, ગહનતમ કરશુ હજુ પણ તેમની પકડાંથી છટકી જાય, અર્થાત્ એ કરશુ કે તેમને આ યોગના કાર્યમાં શેનો સાક્ષાત્કાર કરવાનો છે, તે કરશુ જસુવા માટે માસુસાચા માર્ગ પરની ધર્શી ભૂમિકાઓમાંથી પસાર થયેલો હોવો જોઈએ.

તત્ત્વક રીતે, જ્યારે માશસ પોતાના આત્માથી સલાન બને છે, પોતાના ચોય પુરુષસાથે એકતા પ્રાપ્ત કરે છે, ત્યારે જ તે એક ચમુકારમાં યુઝો સુધી કરેલા પોતાના વ્યક્તિગત વિજ્ઞાને જોઈ શકે છે. ત્યારે જ મરેખર તે જાસુવાની શરૂઆત કરે છે, તે પહેલાં નહિ. હું તમને ખાતરી આપું છું કે ત્યારે જ તે રસપ્રદ બની જાય છે. તે તેના જીવનની પરિસ્થિતિને પદ્ધી બાબે છે.

અનિશ્ચિતતાપૂર્વક માગણી અનુભવવી, કોઈક શક્તિનો, ગતિનો, આવેગનો, અકર્ષણનો, જીવનમાં આપણને જે કાંઈક ધક્કેલે છે તેનો અધ્યક્ષયરો ખ્યાલ પ્રાપ્ત કરવો કે જે ખ્યાલ અનિશ્ચિત અને જ્યાંદો હોય છે, તેની વચ્ચે અને સ્પષ્ટ દર્શના પ્રાપ્ત કરવી, નિશ્ચિત દર્શના હોવી, પોતાના જીવનના હેતુની પરિપૂર્ણ સમજ હોવી તેની વચ્ચે બહુ મોટો તફાવત છે, ત્યારે જ માસુસ વસ્તુઓને યથાર્થ રીતે જોવાની શરૂઆત કરે છે, ત્યાર પહેલાં નહિ, ત્યારે જ માસુસ પોતાના ભવિતવ્યતાના રૂપને અનુસરી શકે છે, અને સ્પષ્ટતાપૂર્વક પોતાના લક્ષ્યને તથા તેને પહોંચવાના માર્ગને જોઈ શકે છે. પણ તે આંતર જગૃતિઓની પરંપરા દ્વારા જ બને છે, જાણ કે નવીન ક્ષિતિજોનાં દ્વાર ઓચિતા ખુલ્લી ગયાં; સાચે જ તે વધારે સાચી, ગહનતર, વધારે સ્થાયી ચેતનામાં નવો જન્મ હોય છે.

ત્યાં સુધી તમે ફાંફાં મારતા ધુમ્મસથી આચછાદિત વાદળ નીચે, ભવિતવ્યતાના ભાર હેઠળ જીવતા હો છો, જે ભાર કેટલીક વાર તમને ચંગદી નાંબે છે, જે અમુક રીતે તમાચ પર આવી પડ્યો છે એમ તમને લાગે છે, પણ તમે તે બાબત કશું કરી શકતા હોના નથી. તમે અસ્તિત્વના એક એવા ભાર હેઠળ છો કે જે તમને ચંગદી નાંબે છે, ઉપર ઊર્ધ્વમાં ચઢવાને બદલે અને તમને દોરનારા, લિખ લિખ વસ્તુઓને સ્પષ્ટ બનતા જતા સાક્ષાત્કાર પ્રત્યેની પ્રગતિની એક ગતિમાં બાંધનારા રૂપુંઓને જોઈ શકવાને બદલે તમને ભૂમિ પર એટ ઘસડીને ચાલવાની ફરજ પાડે છે.

સામાન્ય રીતે સ્વાભાવિક મનાતી આ અર્થ ચેતનામાંથી સાધકે ઉપર ઉઠવાનું છે. આ અસ્તિત્વ તો સામાન્ય પ્રકાર છે, તમે તેમાંથી પર્યાપ્ત રીતે પાછા ફરી

શક્તા નથી કે જેથી તમે આ અનિશ્ચિતતાને જોઈ શકો અને આશ્વર્ય અનુભવી શકો. તેથી દ્વિષ્ટું, સભાનતાપૂર્વક, વિચારપૂર્વક, સિથરતાપૂર્વક, પદ્ધતિપૂર્વક પોતે શોધ કરી રહ્યો છે એમ જાણું તે એક અપવાદૃપ, અસાધારણ સિથતિ છે. અને છતાં આ સીતે જ માસુસ સાચી રીતે જીવાનની થડુભાત કરી શકે.

## ૨૩ જાન્યુઆરી ૧૯૫૭

“માનવનું અને ભગવાનનું મિથન એટબે ભગવાનનો માનવમાં આંતર-પ્રવેશ અને માનવનો ભગવાનમાં આત્મવિલય.

પણ તે આત્મવિલય એટબે સર્વ વિનાશ નહિ. અસ્તિત્વમાંથી ભૂસાઈ જઈ એ આ સંશોધનાની, આવેગની, દુઃખની અને આનંદની પરિપૂર્ણતા નથી. જે તે લીલાનો અંત હોત, તો આ લીલાનો પ્રારંભ જ ન થયો હોત.

આનંદ એ રહસ્ય છે. વિશુદ્ધ આનંદને ઓળખો, અને તમે ભગવાનને ઓળખો.

તો પછી આ સુધિનો આરંભ યા માટે? અસ્તિત્વના આનંદ માટે એક અનેકરૂપ જન્યું, તેણે અસંખ્ય રૂપોમાં ઝૂબકી મારી, જેથી તે પોતાની જતને અસંખ્ય રીતે અનુભવી શકે.

અને વયગાળામાં, મધ્યમાં શું છે? અનેકરૂપ એકતા પ્રત્યે જવા મથતો લેટ, વિવિધ પ્રકાશના પૂર પ્રત્યે ગતિ કરવા મથતું અશાન, અકર્ષ્ય આનંદના રૂપર્થી પ્રત્યે ગતિ કરતું દુઃખ, કારણ કે આ બધી વસ્તુઓ અંધકારમય આકૃતિઓ છે, વિકૃત આકંપનો છે.

આ બધાનો અંત શો? જાણે મધ્ય પોતાની જતને અને તેનાં બિદુઓને એકસાથે ચાખી શકે અને બધાં બિદુઓ એક બીજાને ચાખી શકે, દરેક બિદુ

આખ્યા મધુકોથને પોતાની જત પેઠે ચાખી શકે, તે પ્રકારનો અંત ભગવાન અને માણુસના આત્મા અને જીવાત્મા માટે હોવો જોઈએ.

ઘેમ એ ચાવી રૂપ મુખ્ય સૂર છે, આનંદ સંગીત છે, થકિત તેનો તાલ છે, જ્ઞાન સંગીતકાર છે, અનંત સર્વ સંગીત સર્જક અને કોતાવર્ગ છે, આપણે માત્ર પ્રારંભના વિસંવાદો જ જાણીએ જીએ. સંવાદિતા જેટલી મહાન હોય, તેટલા જ ભયંકર આ પ્રારંભના વિસંવાદો હોય છે. પણ આખરે આપણે ચોક્કસ દિવ્ય આનંદના અંતને, સંગીતને પ્રામ કરવાના."

(બ્રાહ્મસ એન્ડ એફરિઝન્સ, સેન્ટીનરી વોલ્યુમ્સ ૧૬, પૃષ્ઠ ૩૮૪)

માણુસ કેવી રીતે વિશુદ્ધ આનંદને માણી શકે?

પ્રથમ તો માણુસે એકાગ્રતાપૂર્વકના અવલોકન દ્વારા સભાન બનદું જોઈએ કે કામનાઓ અને તેમની પૂર્તિમાત્ર એક અનિયિત, અસ્પષ્ટ, મિશ્ર, અસ્થાયી અને અસ્તોષપ્રદ સુખ આપે છે. આ પ્રારંભ બિદ્ધ છે.

પછી, જે માણુસ તર્કબુદ્ધિવાળો હોય, તો તેણે કામના શું છે તેનો વિવેક કરતાં શીખદું જોઈએ, અને તે કામનાની પૂર્તિ માટે કાંઈ પણ ન કરદું જોઈએ. કામનાઓને સંતોષવાને બદલે સાધકે તેમનો ત્યાગ કરવો જોઈએ. તેનું પ્રથમ પરિણામ એ આવશે કે જેણે બુધે પોતાના ઉપદેશમાં કહ્યું છે કે "કામનાને નૃમ કરવા કરતાં તેને જિતવામાં અને દૂર કરવામાં અનંતગણ્ણા મહાન આનંદ રહેલો છે." દરેક સાચા દિલના અને રિથર સાધકને મોડો વહેલો (કેટલીક વાર તો ખૂબ જ જલ્દી) જ્યાલ આવશે કે આ એક પરમ સત્ય છે; કામનાઓને સંતોષવાથી જે કુદ્ર, અસ્થાયી, મિશ્ર સુખોપલોગ પ્રામ થાય છે તેના કરતાં કામનાને જિતવાથી જે આનંદ પ્રામ થાય છે તે અતુલ રીતે ઉચ્ચતર હોય છે. આ બીજું, પગથિયું છે.

સ્વાભાવિક રીતે જ, આવા સતત અભ્યાસથી થોડા જ સમયમાં કામનાઓ ચાલ્યી જશે અને તમને સત્તાવશે નહિ. પરિણામે તમે તમારા અસ્તિત્વમાં જરાક વધારે ઊડા ઉત્ત્વા માટે, અને આનંદ, દિવ્ય તત્ત્વ, દિવ્ય કૃપાના દાતા પ્રત્યે

અલોપસા કેળવવા માટે મુક્ત બનશો. જો તમે આ સાચા દિલના સમર્પણ ભાવથી, બદલામાં કશાની પણ અપેક્ષા રાખ્યા સિંપાય કરશો, તો તમને એક મધુર, આશ્વા-સનદાયી, સધન, તેણેયુક્ત ઉખા અનુભવશો, જે ઉખા હદ્યને ભરી દેશે અને જે આનંદની પુરોગામી હશે.

ત્યાર પછી માર્ગ સહેલો છે.

મધુર માતાજી, અસ્તિત્વનો સાચો આનંદ શું છે ?

જેણી હું વાત કરી રહી છું તે જે.

તો પછી, મધુર માતાજી, શ્રી અરવિંદ અહીં “અસ્તિત્વના આનંદ માટે તે એક અનેક રૂપ બન્યું” એમ ડબું છે તે આનંદ ક્યો ?

હોવાનો આનંદ.

એક એવો સમય આવે છે કે જ્યારે સાધક લગભગ નૈયાર થઈ જાય છે, જ્યારે તે સર્વ વસ્તુઓમાં, દરેક પદાર્થમાં, દરેક ગતિમાં, દરેક આકંપનમાં, માત્ર માણસોમાં અને સચેતન સત્તવોમાં જ નહિ, પણ વસ્તુઓમાં, પદાર્થોમાં, માત્ર વૃક્ષોમાં અને છોડોમાં અને સજ્જવ વસ્તુઓમાં જ નહિ, પણ આસપાસની દરેક વસ્તુમાં, પોતે જેણે વાપરે છે તે પદાર્થમાંયે આ અસ્તિત્વનો, હોવાનો આનંદ અનુભવે છે. ત્યારે તે સર્વ વસ્તુઓને આનંદ વડે આકંપિત થતી જુઓ છે. તે કોઈક વસ્તુનો સ્પર્શ કરે છે, અને આનંદ અનુભવે છે. પણ તેણે મેં થર્ઝાતમાં જેણે વિષે તે સંયમનું અનુસરણ કર્યું હોય જોઈએ. નહિ તો, જ્યાં સુધી તેનામાં કામના રહી હશે, પરંદગી, આસક્તિ, રાગદ્વેષ રાખા હશે, જ્યાં સુધી તે આનંદ નહિ અનુભવાય.

જ્યાં સુધી માણસને વસ્તુમાં પ્રાણિક અથવા શારીરિક સુખ પ્રાપ્ત થાય છે, ત્યાં સુધી તે આ આનંદને પ્રાપ્ત કરી શકતો નથી. કારણે આ આનંદ સર્વત્ર છે. આ આનંદ બહુ સૂક્ષ્મ છે. જ્યારે માણસ વસ્તુઓની મધ્યમાં થઈને જતો હોય છે, ત્યારે જાણે કે તે વસ્તુઓ તેને માટે આનંદનું જાન કરી રહી હોય છે. એક એવો સમય

આવે છે કે જ્યારે આસપાસ જીવનમાં તે આનંદ તમને ખૂબ પરિચિત બની જય છે, અલબજ્ઝ, મારે કબૂલ કરનું જોઈએ કે માનવ પ્રાણીઓમાં તે આનંદને અનુભવવો તે જરાક વધારે કઠિન છે, કારણકે તેમનાં માનસિક અને પ્રાણિક રૂપદટનો દર્શનાના ક્ષેત્રમાં આવી તેને વિશ્વિમ બનાવી મૂકે છે. તેમનામાં ખૂબ અહંતા હોય છે, જે વસ્તુઓ સાથે મિશ્રિત થઈ જય છે, અને તેથી માનવોમાં આનંદનો સંપર્ક સાધવો એ વધારે કઠિન હોય છે. પશુઓમાં પણ તે આનંદનો અનુભવ આપણને થાય છે. વૃક્ષો અને છોડો કરતાં પશુઓમાં આનંદ પ્રાપ્ત કરવો એ જરાક વધારે કઠિન હોય છે. પણ છોડોમાં અને પુષ્પોમાં તે આનંદ અદ્ભુત હોય છે. છોડો અને પુષ્પો પોતાના સર્વ આનંદને કહેતાં હોય છે, અભિવ્યક્ત કરતાં હોય છે. મેં કલ્યાણ તેમ, સર્વ પરિચિત પદાર્થોમાં, તમારી આસપાસની વસ્તુઓમાં, જેમનો તમે ઉપયોગ કરો છો, ચેતનાની એવી એક સ્થિતિ છે, જેમાં રહેવાથી તે દરેક જલ્દ સુખ અનુભવે છે. તેથી તે જીલે માલસને એમ લાગે છે કે મેં સાચા આનંદનો સ્પર્શ કર્યો. તે આનંદ મંયાદિત નથી, બીજા કથા પર આધાર રાખતો નથી. તે બાબ્દ સંજોગો ઉપર આધાર રાખતો નથી, વત્તીઓછી અનુકૂલ સ્થિતિ ઉપર તે આધાર રાખતો નથી, તે કથા પર આધાર રાખતો નથી, તે વિશ્વના મૂળ કારણ સાથે ગાઢ સંબંધ ધરવે છે.

જ્યારે તે આનંદ આવે છે, ત્યારે તે શરીરનાં સર્વ કોપાણ્યોને ભરી દે છે. તે આનંદ વિષે વિચાર કરવાનો હોતો નથી, તેને વિષે તર્ક દોડાવવાનો હોતો નથી, તેનું પૃથક્કરણ કરવાનું હોનું નથી. તે એક એવી સ્થિતિ છે કે જેમાં માલસ જો છે. જ્યારે શરીર તેમાં ભાગ બે છે, ત્યારે તે આનંદ એટલો બધો તાજે અને સ્વયંભૂ હોય છે કે તે પણો સંકોચાઈ જતો હોતો નથી; ત્યારે આત્મ અવલોકનની, આત્મ પૃથક્કરણની; અથવા વસ્તુઓના પૃથક્કરણની કેંઠી ભાવના રહેતી હોતી નથી. તે સર્વ આનંદ પૂર્ણ આકર્પનોનો નાદ હોય છે, પણ તે ખૂબખૂબ તીવ્ર, શાન્ત, બળજબરીઓવેગ વગરનો હોય છે. તે એકી સાથે ખૂબ સૂક્ષ્મ અને ખૂબ હોય છે, જ્યારે તે આવે છે, ત્યારે સમગ્ર વિશ્વ એક આશર્યજનક સંવાદિતા ભાસે છે. સામાન્ય માનવચેતનાને જે કદુમુ, અલગમનું લાગે છે, તે પણ ત્યારે અદ્ભુત લાગવા માંડે છે.

કુમનસીબે, માલુસો, સંજોગો, માલુસોનાં માનસિક તથા પ્રાણિક રૂપદટનો બધો સમગ્ર તે આનંદમાં વિશેપ કરતાં હોય છે, ત્યારે માલસને આ અજ્ઞાનમય,

વસ્તુઓની અંધે દર્શના પ્રત્યે પાછા આવવાની હૃજ પડે છે. નહિ તો, આ બધું જ્યારે બંધ પડી જાય છે, અને માલુસ તેનાથી બહાર ચાંચો જઈ શકે છે, ત્યારે સધ્યું પરિરતિત થઈ જાય છે. તે આશ્ર્યજનક સંવાદિતા હોય છે. ત્યારે સર્વ આનંદ, સાચો આનંદ, વાસ્તવિક આનંદ હોય છે.

આ થોડાક કામની માગ કરે છે.

મેં જે સંયમ વિષે વાત કરી હતી, તેનો જે આનંદ પ્રાપ્ત કરવાના હેતુથી અભ્યાસ કરવામાં આવે તો પરિણામ આવવામાં વિવંબ થાય છે, કારણકે તેમાં અહેંતાના તત્ત્વને દાખલ કરવામાં આવ્યું હોય છે, અપેક્ષાપૂર્વક તે કરવામાં આવ્યું હોય છે. અને તેથી તે પૂજાના બળિદ્દુપ બની જતો નથી, તે એક પ્રકારની માગ હોય છે. જ્યારે માલુસ કશું જ માગતો નથી, કશાની અપેક્ષા રાખતો નથી, કશાની આશા રાખતો નથી, જ્યારે તે કાર્ય આત્મસર્પણ અને અલીગ્રસાર્પ હોય છે, સોઢો કરવાની વૃત્તિ વગરની સ્વયંભૂ જરૂરિયાત હોય છે, માત્ર દિવ્ય બનવાની જરૂરિયાત રૂપ હોય છે, ત્યારે તે આનંદ પ્રાપ્ત થાય છે.

માતાજી, આ ‘મધુબિદ્ધ’ ને તમે ક્રમાંવશે?

ઓહ! હે મારી મુત્ર, મધુ તો એક પ્રતીક માત્ર છે.

શ્રી અર્વિદ કહે છે: કે “જાણે કે, જે કોઈ કલ્પના કરે તો, “ભૌલિક ભાવવાચક તત્ત્વો કરતાં તે માત્ર વખતે સધન અભિગમ આપે છે. શ્રી અર્વિદ કહે છે કે જે તમે એવો કલ્પના કરી શકો કે મધ્યપૂડામાં પોતાનો અને ચાંચે ચાંચે દરેક મધુબિદ્ધનો સ્વાદ ચાખવાની શક્તિ હોય, દરેક મધુબિદ્ધમાં મધ્યપૂડાને ચાખવાની શક્તિ હોય, અને જે દરેક મધુબિદ્ધ બીજી મધુબિદ્ધઓને અને પોતાની જતને એકી વખતે ચાખી શકે, દરેક મધુબિદ્ધ સમગ્ર મધ્યપૂડાને, જાણે પોતે જ હોય તે રીતે, ચાખી શકે, તો તમને જગવાનનો, માલુસનો, અને વિશ્વનો આનંદ સમજમાં આવે.

અર્થાતું તે એવો મધ્યપૂડો હોય, જે પોતાને ચાખી શકે, મધ્યપૂડામાંનાં બધાં મધુબિદ્ધઓને વિગતવાર ચાખી શકે, અને પ્રત્યેક મધુબિદ્ધ પોતાની જતને, બીજાં

મધુબિદુઓને વ્યક્તિગત રીતે, અને સમગ્ર મધુપૂડાને, પોતાની જતની ચેઠે, ચાખી શકે, તો તે પરિપૂર્ણ આનંદ સમજાય. આ સમજવા માટે તમારી પસે કલ્પના-શક્તિ હોવી જોઈએ !

હું તે પ્રમાણે સમજું છું. પણ હું તેનો અર્થ પૂછું છું.

મધ એક સ્વાદિષ્ટ ચીજ છે, નહિ વારુ ? એટલે આ બધી વસ્તુઓ દિવ્ય આનંદની મધુરતાઓ છે.

જ્યારે હું વસ્તુઓમાં રહેવા, સ્વર્યભૂ, સાદા, દરેક વસ્તુના હૃદયમાં રહેતા આનંદનું આહવાન કરી રહી હતી, ત્યારે ભૌતિક શરીર માટે તે આનંદ સાચી રીતે, સ્વાભાવિક રીતે મધુર છે. મધુનો સ્વાદ તો સરખામણીમાં ખૂબ સ્થૂલ અને અસુંદર છે, પણ તે સ્વાદ બહું સ્વાદિષ્ટ હોય છે. તે આનંદ ખૂબ સાદો અને સરબ હોય છે, સમગ્ર હોય છે, સાદાઈમાં પરિપૂર્ણ હોય છે, અને છતાં ખૂબ સરબ હોય છે.

આ વિચારવાની વસ્તુ નથી. માણસમાં તેને ખ્રગટ કરવાની શક્તિ, થોડીક કલ્પના હોવી જોઈએ. એ માણસમાં તે શક્તિની હોય, તો માત્ર વાચનથી પણ તે આનંદ પ્રામ કરી શકે, તેને સમજ શકે. મધુ અને મધુપૂડો તો એક સામ્ય છે, ઉપમા છે, પણ સાચે જ તે સામ્યમાં આહવાન કરવાની તાકાત છે.

પણ માતાજી, દરેક જણ એક વસ્તુની ભિન્ન ભિન્ન કલ્પના કરશે, નહિ વારુ ?

એ વાત તો સ્પષ્ટ જ છે. પણ તેથી કોઈ હરકત નહિ આવે. તેને માટે તે કલ્પના કલ્યાણકારી હશે.

(મૌન)

બસ, પતી ગયું ?

મને પૂછવામાં આવેલા કેટલાક પ્રશ્નો હું લઈ આવી છું. પણ મને લાગે છે કે મોહું થઈ ગયું છે. (માતાજી કેટલાક સવાલો પર નજર નાંબે છે.)

એક પ્રશ્ન ખૂબ જ બૌધ્ધિક છે; તેને આપણે પછી કોઈક દિવસ ચર્ચાશું બીજો એક પ્રશ્ન માત્ર પ્રશ્નાભાગ છે. ત્રીજો પ્રશ્ન રસપ્રદ છે, પણ તેનો જવાબ વિગતવાર આપવો પડે તેમ છે, અને આજે જરા મોડું થઈ ગયું છે.

પણ આ એક સવાલનો જવાબ બહુ સહેલાઈથી આપ્યો શકાય તેમ છે. તે મારાં લખાણેમાંનાં એકમાંથી છે. મેં બધ્યું હતું કે,

“ભગવાનનો સંકલ્પ જગતમાં ખુલ્લી રીતે કાર્ય કરે છે એમ માનતું તે એક લુલ છે.”

શ્રી અર્થવિદ “યોગના સમન્વય” માં કહે છે કે,

“જો આપણે સર્વત્ર એકતા જોઈએ, જો આપણે સ્વીકારીએ કે સર્વ કાર્ય ભગવાનના સંકલ્પથી જો છે... વળેરે.”

‘પ્રાર્થનાઓ અને ધ્યાનો’ નામના મારા પુસ્તકમાં લખેલું છે કે,

“હે પ્રભુ, દરેક વસ્તુમાં અને દરેક પ્રાણીમાં તું જ કાર્ય કરી રહ્યો છે, અને જે કોઈ, અપવાદ સિવાય, સર્વ કાર્યોમાં તને જ જોઈ શકવા જેટલો તારી નાણક છે, તે જાણી શકશે કે, દરેક કિયાને આશીર્વાદના ઝપમાં કેમ પરિવર્તિત કરવી.”

( ૧૦ ડિસેમ્બર, ૧૯૧૨ )

મને પૂછ્યામાં આવ્યું છે કે, આ વિરોધીનું સમાધાન કેવી રીતે કરવું. પણ મને ઉપલાં કથનોમાં કોઈ વિરોધ જણાતો નથી. પ્રથમ વાક્યમાં કહ્યું છે કે ભગવાનનો સંકલ્પ જગતમાં હંમેશાં ખુલ્લી રીતે કાર્ય કરે છે એમ માનતું એ લુલ છે. મારે કહેવું જોઈએ કે ભગવાનનો સંકલ્પ ખુલ્લી રીતે કાર્ય કરે તે બહુ જ વિરલ જનતું હોય છે. તે હંમેશાં કાર્ય તો કરે છે, પણ ખુલ્લી રીતે નહિ. અને જ્યારે તે ખુલ્લી રીતે કાર્ય કરે છે, ત્યારે લોકો તેને ‘ચમતકારો’ કહે છે. તે બહુ વિરલ હોય છે. મોટે ભાગે તો તે ખુલ્લી રીતે કાર્ય કરતો હોતો નથી, પણ તેનો અર્થ એવો નથી કે ભગવાનનો સંકલ્પ કાર્ય કરતો નથી. કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે તે ખુલ્લી રીતે કાર્ય કરતો નથી. એટલે તેમાં કોઈ વિરોધ નથી. મારો કહેવાનો ભાવાર્થ માત્ર એટલો જ હતો. શબ્દોની ગેરસમજમાંથી ઉદ્ભલવેલો તે માત્ર ઉપરછલ્યો વિરોધ છે.

ભગવાનનો સંકલ્પ કાર્ય કરે છે, પણ ખુલ્લી રીતે નહિ. જ્યારે તે ખુલ્લી રીતે કાર્ય કરે છે, ત્યારે લોકો તેને ચમતકારો કહે છે. પણ તે ભગવાનને કાર્ય કરતા અટકાવતા નથી.

## ૩૦ બાયુઆરી ૧૯૫૭

“ સમગ્ર વિશ્વ સ્વતંત્રતાને, મુક્તિને માટે જંખે છે, અને છતાં દરેક પ્રાણી પોતાની બેદીઓ સાથે પ્રેમમાં પડેલું હોય છે. આ આપણા સ્વભાવનો પ્રથમ વિરોધ છે, ન ઉકેલી શકાય તેવી ગાંઠ છે.

માનવ જન્મનાં બંધનો સાથે પ્રેમમાં પડેલો હોય છે; પરિણામે તે મૃત્યુનાં સહચારી બંધનોમાં જકડાયેલો છે. આ બંધનોમાં પડ્યો, પડ્યો તે પોતાના અસ્તિત્વની મુક્તિ માટે અને પોતાની આત્મ પરિપૂર્ણતા પર પ્રભુત્વ સ્થાપવા માટે અલીખા કરતો હોય છે.

માનવ પોતાની શક્તિ સાથે પ્રેમમાં પડેલો છે. તેથી તે નિર્જાળતાનો શિકાર બનતો હોય છે. વિશ્વશક્તિનાં મોણનો એક મહાસાગર છે. જે મોણ એક બીજાને મળે છે અને એક બીજા સાથે અથડાય છે. એક મોણના શિખર પર સપારી કરેલા માનવે સેંકડો મોણાંભોના આધાત હેઠળ મૂર્છા પામણું જ જોઈએ...

માનવ સુખ સાથે પ્રેમમાં પડેલો છે. તેથી તેણે શોકની અને દુઃખની ધૂંઘરી સહન કરતી જ જોઈએ. નિર્ભેણ આનંદ માત્ર મુક્તા અને અનાસક્ત આત્માને જ મળે છે. માનવમાં સુખની પાછળ જે દોડનું હોય છે, તે દુઃખ સહન કરતી અને પ્રાસ કરતી શક્તિ છે.

માનવ શાન્ત માટે જંખતો હોય છે. પણ તે વિકિતમ મનની અને દુઃખી હદ્દયની અનુભૂતિઓ માટે પણ જંખતો હોય છે, સુખોપલોગ તેને મન એક પ્રકારનો તાપ હોય છે, શાન્ત તેને જડતા વાગે છે, નીરસ એકરસતા વાગે છે.

માનવ પોતાના શારીરિક અસ્તિત્વની મર્યાદાઓ સાથે પ્રેમમાં પડેલો છે, અને છતાં તે પોતાના અનંત મનની અને અમર આત્માની મુક્તિ પણ ઈચ્છે છે.

આ વિરોધીમાં તેનામાં રહેલા કોઈક તત્ત્વને આકર્ષણ અનુભવાય છે. તેના માનસિક સત્ત્વને તે વિરોધી જીવનની એક કલા ગૂંધણી ભાસે છે. માનવમાં સ્વાદને અને તેના ઝનૂઝલને માત્ર અમૃત જ નહિ પણ વિષ પણ આકર્ષણું હોય છે.

(ચોડસ અન્ડ એક્સાર્ટિભસ, સેન્ટીનરી વોલ્યુમ ૧૯, પૃષ્ઠ ૩૮૫)

મોટા લાગના મનુષો વિરોધને જ કણા ગુંથણી કહેતા હોય છે. કલાકારોને એમ લગતું હોય છે કે છોયાઓ પ્રકાશને સર્જ છે; જે વિરોધન હોય સો કલાકારો ચિત્ર ને સર્જ સકે સંગીનની બાબતના પણ તેમ જ છે. ‘ફોટો’ અને પિયાનો વર્ચેનો વિરોધ એ સંખીતની ઓક્સીથી મહાન સુદૃષ્ટા છે.

હું કેટલાક કવિઓને ઓળખું છું, “કોઈઓ એમ કહેતા હતા કે મારા શત્રુઓના દ્વારાને કરાયે મારા મિત્રોના પ્રેમનું મૂલ્ય હું આંકી રહ્યું છું. અનિવાર્ય વિપત્તિ સુખને ખૂબ સ્વાદિષ્ટ બનાવે છે. દીનિક વિકેષને લઈને લોકો આરોગ્યની કિમત આંકતા હોય છે. રોજિલા ધાંધલને લઈને લોકો મૌનની કિમત આંકતા હોય છે. કેટલાક લોકો તો એમ પણ કહેતા હોય છે કે માંદગીઓને લઈને જ અમને સુંદર આરોગ્યની કિમત સમજાય છે. જ્યારે વસ્તુ શુભાવી દેવામાં આવે છે, ત્યારે જ તેનું મૂલ્ય સમજાય છે. અહીં શ્રી અરવિંદ કહે છે: તેમ જ્યારે આ હીયાનો શતિનો સર્જક વિચારના વિકેષાભનો તાત્ત્વ નથી હોતો; ત્યારે માસુસને પોતે અચેતનાતોમાં, જરૂરામાં ગરી પડ્યો હોય એમ લાગે છે. ધર્માખરા લોકો મૌનથી, શાન્નિધી બળરાત્રા હોય છે. જ્યારે તેમો વિકિષ નથી હોતા, ત્યારે તેમને ‘પોતે છુપતા ન હોય’ એમ લાગે છે.

હું ધર્મા કિસ્સાઓ જાણું છું જેમાં કી અરવિંદ એઈક સાધકને શાન્ત આપી હતી, તેના મનને શાન્ત બનાવી દીધું હતું. પછી નિરાશાપૂર્વક, તે સાધકે તેમની પાસે આવીને કલ્યું કે “પણ હું તો મૂર્જા બની ગયો છું!” કરાયું તેનો વિચાર હવે વિશુદ્ધ ન હતો.

અહીં શ્રી અરવિંદ કહે છે તે લીપણ હીતે સત્ય છે. માસુસો મુક્તિને શાહે છે, પણ પોતાની બેદીઓ સાથે તેઓ પ્રેમમાં પડેલા હોય છે. જ્યારે તે બેદીઓ તેમની પાસેથી લઈ વેવામાં આવે છે, જ્યારે તેમને મુક્તિનો માર્ગ બતાવવામાં આવે છે, ત્યારે તેમને બીક લાગતી હોય છે અને તેઓ વિરોધ કરતા હોય છે.

સાહિન્યિક, કાલ્યમય, કલાકૃતિમય માસુસની સઘળી કલાકૃતિઓ જીવનમાં આવતા વિરોધિના બળ પર આધારિત હોય છે. જ્યારે કોઈક તેમને તેમના દીનિક

નાટકોમાંથી બહાર ભેંચી કઢે છે, ત્યાં તેમને એમ લાગે છે કે આ વસ્તુ કલામય નથી. જો તેમને કોઈ પુસ્તક વખવાની ઈચ્છા હોય, અથવા નાટક રચવાની ઈચ્છા હોય, કે જેમાં વિરોધો ન હોય, ચિત્રોમાં છાયાઓ ન હોય, તે તેમને તે રસહીન, શુદ્ધ લાગે છે, નિર્જન લાગે છે, કારણ કે માણસ જીવનના નાટકને જીવન કહેતો હોય છે, જીવનની ચિત્તાઓને અને વિરોધોના સંઘર્ષને જીવન કહેતો હોય છે. જો કદાચ મૃત્યુ ના હોત, તો જેથી જીવનથી બહુ કંટાળી ગયા હોત.

( લાંબા સમય મૌન )

મેં પહેલાંના વર્ગોમાં જે કલ્યાણ હતું તે વિષે એક સવાલ પૂછવામાં આવ્યો છે. મેં કલ્યાણ હતું કે;

“ જાથારે કોઈ માણસ અમૃતક લક્ષ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે, ત્યારે માર્ગમાં જે વિધનો અને મુશ્કેલીઓ આવે છે તે એમ બતાવી આપનાર ચિહ્ન છે કે જે આ યોજના કે નિર્ણય બેવામાં આવ્યાં હતાં, તે પ્રથમથી જ ભૂલભરેલા હતો, અને નેથી તેણે તેમાં મંડ્યા ન રહેવું જોઈએ. અથવા તે એમ બતાવી આપનાર ચિહ્ન છે કે જીલ્દું તે મુશ્કેલીઓ જે વિજય પ્રાપ્ત કરવાનો છે, જે રૂપાંતર સિદ્ધ કરવાનું છે તેને સૂચવતી તો નથી? શું તે એવું ચિહ્ન છે કે માણસે યોતાના લક્ષ્ય પાછળ ખંતપૂર્વક મંડ્યા રહેવું? અહીં હું યોગના માર્ગને અનુસરવાના નિર્ણય વિષે વાત નથી કરતો, પણ કાર્ય, રમતગમતો અથવા બીજી પ્રવૃત્તિઓ; સાથે સંકળાયેલી નાની વસ્તુઓની વાત કરું છું. બીજી શબ્દોમાં કહીએ તો, સંજોગો, બીજાઓ સાથેના સંબંધો. અને અનુભવ દ્વારા જે દોરવણી મળે છે તેને કેવી રીતે સ્વીકારવી અને સમજવી ? ”

મને લાગે છે કે આ ભાગ એક દ્વિતીય જ વિરોધાભાસ છે.

જે કોઈ માણસ યોગાભ્યાસ કરવાની ઈચ્છા રાખતો હોય, તો દ્વાલાંપિડ રીતે જ કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલાં તેણે વિવેક કરીને જાણી બેનું જોઈએ કે તે કાર્ય કરવાની પ્રેરણ અગવાન પાસેથી આવેલી સાચી પ્રેરણ છે કે પછી તે પ્રેરણ માત્ર બાધ સંજોગો પ્રત્યેનું એક પ્રતિકાર્ય છે, પ્રાણીક કે માનસિક આવેગ માત્ર છે. વિવેક કરીને, કારણના પરિપૂર્ણ જ્ઞાન સાથે, કર્મ કરવું તે બહુ જ મહત્વાનું છે. પણ માણસ

ધૂમી વસ્તુઓ કરતો હોય છે કે જેમને વિષે પૂર્વવિચારણ કરવાની તેને ટેવ નથી હોતી. જ્યારે સંશોદ આવી પડે છે, ત્યારે માસુસ તેને વશ વર્તો હોય છે. અને ખરેખર, માસુસ જીવનમાં જે કાર્યો કરતો હોય છે તે પોતે જીતેજ મહત્વનાં નથી હોતાં. તેમાં મહત્વની વસ્તુ તો એ છે કે માસુસ કર્યું વલસ અભિવ્યક્ત કરીને ને કાર્યો કરે છે, એક યા બીજે અરસે, તમારી સામે અમૃત કર્યું આવી પડ્યું છે અને તેથી તમે તે કરો છો; બાબી જીવન તમે જીવી રહ્યા હો ત્યાં સુધી તે કાર્ય કરવાની તમને ફરજ પડે છે. જીવનમાં તે કાર્યની અસર લાબા સમય સુધી ગોટા પ્રમાસુભાં પડવાની છે, એ લકીકતને જીવન જીવાના હઘિલિંદુથી જોતાં, અમૃત મહત્વનું છે; દા. ત. લગ્ન કર્યું, અમૃત સ્થાને નિવાસ કરવા જરૂર અમૃત ધર્યો. સ્વીકારવો, આ બધી વસ્તુઓ મહત્વની મનાય છે; યોગના હઘિલિંદુથી જોતાં પણ ઓછાનવત્તા પ્રમાસુભાં તે વસ્તુઓ મહત્વની છે. પણ તે વસ્તુના પોતાના કરતાં માસુસ ને વલસ અભિવ્યક્ત કરે છે તેના ઉપર દરેક વસ્તુ આપાર રાખે છે. તેથી રેઝિન્ડા જીવનની, નાનકદી કિયાયોનું મહત્વ ખૂબ ખૂબ ધારી જાય છે:

કેટલાક બહુ ચીકણા હોય છે, જેઓ પોતાને માટે સમસ્યાઓ ઉલ્લો કરે છે અને તેમનો નિર્ણય કરવાનું તેમને બહુ કઠિન લાગે છે, અરસુકે તેમો સમસ્યાને ખાટી રીતે ઉલ્લો કરે છે. હું એક યુવતીને ઓળખતી હતી, તે વિયોસોફિસ્ટ હતી. તે સોંબાભ્યાસ કરવા માયાતી હતી. તેણે મને પૂછ્યું, “કરમે એમ શિખવવામાં આવ્યું છે કે, આપણે જે કંઈ કરીએ તેમાં ભગવાનનો સંકલ્પ કે સિદ્ધ થવો જોઈએ. પણ સવારે જ્યારે હું નાસ્તો કરવા બેસું છું, ત્યારે ભગવાન હું કેફિમાં ખાંડના બે ચમચા નાંખું કે એક તેમાંનું શું ઈછે તે હું કેવી રીતે જાણો શકું?” તે હદ્યને સૃપણી જાચ એવો પ્રશ્ન હતો. તેને સમજાવતાં મને બોડીક મુશ્કેલી પડે કે તેણે કોણીમાં કેટલા ચમચા ખાંડ નાખો છો તેના કરતાં તમે કઈ ભાવનાથી કોણી પીએ છો, લોજન પ્રત્યે તમારું<sup>2</sup> કઈ જતનું વલસ છે તે વધારે મહત્વનું છે. ૧

માસુસ પ્રતિકાલે જે નાની-નાની વસ્તુઓ કરે છે, તેને પણ આ જ લાગુ પડે છે. ભગવાનની ચેતના માનવી રીતે કાર્ય નથી કરતી. કોણીમાં તમે કેટલા

૨. આ વાત સંબંધમાં, એક રિષ્યને ભાંતાજીએ એટું કલ્યાણ થાહ છે કે “અત્યારે હું તે જિચારી રીતે હું હસી ન કાઢું. ડારીમાં કેટલાં ચમચા ખાંડ નાંખવી તે ચાખત પર પણ ભગવાન ખાન આપે છે કે નહિ, તે હું આતરી પૂર્વક ઉછી રાકતી રહ્યું.

ચમચા ખાડ નાણો તે લગવાનની ચેતના નક્કી નથી કરતી. ધીમે ધીમે તે હિવ્ય ચેતના તમને વસ્તુઓ તથા કિયાઓ પ્રત્યે સમર્પણ ભાવના, ચપળતાના, સંમતિના, અલીપ્સાના, ભદ્ર વૃત્તિના, પરિવર્તનશીલતાના, પ્રગતિ માટે પ્રપણના વલસુમાં મુજી આપે છે, અને આ વાત તમે દરેક કાણે જે નાનકડો નિર્ણય બેવા હો છો તેના કરતાં ખૂબ મહત્વની છે. વધારે સાચામાં સાચી, કરવા યોગ્ય, કઈ વસ્તુ છે તે શોધી કાઢવા માટે માલુસ પ્રયત્ન । એ માનસિક ચર્ચા-વિચારણા દ્વારા આ વસ્તુઓનો ઉદ્દેશ આણી શકતો નથી. જે આંતર વલસુ સંવાદિતાનું વાતાવરણ સંબોધને છે, પ્રગતિશીલ સંવાદિતાનું વાતાવરણ સંબોધને છે, તેના વડે અમુક સંબોધનો જે ક્રોઝ કરવા યોગ્ય વસ્તુ તે કરી શકાય છે, આદર્શ રૂપે તો તે વલસુ એટલું પરિપૂર્ણ હોય જોઈએ; કે જેથી તે કિયા સ્વર્ણભૂ બની રહે, ભાલ તર્ક-બુદ્ધિ કરતાં કોઈ બિનન, ઉચ્ચતર વસ્તુ વડે એ કિયા ભાબન નિર્ણય આપવામાં આવ્યો હોય. પણ તે આદર્શ છે, જેને માટે માલુસે અલીપ્સા સેવવી જોઈએ અને જે તે અમુક સમય પછી જ માલુસ પ્રામ કરી શકે છે તે પ્રામ થાય ત્યાં સુધી કસરત કરવી કે નહિ, કૂચમાં, કવાયતમાં જોડાવું કે નહિ, અમુક વર્ગમાં હજાર્યો આપવા જવું કે નહિ તે ભાબતોનો નિર્ણય કરવા કરતાં સાચું વલસુ અખત્યાર કરવું, સાચી અલીપ્સા સેવવી તે ખૂબ વધારે મહત્વનું છે, આ વસ્તું એમાં પોતામાં કોઈ વાસ્તવિક મહત્વ નથી, તેમનું મહત્વ તદ્દન સાપેક્ષ છે; એટલે પોતાની અલીપ્સામાં સાચું દૃષ્ટિબિદ્ધ રાખવું, પ્રગતિ માટે જીવંત સંકલ્પ રાખવો એ જ મહત્વની વસ્તુ છે.

સામાન્ય નિયમ તરીકે, અનુભરનો પુરેપૂરો લાલે મળે તે માટે, જ્યારે માલુસ કોઈ કરવાનું માણે બે, ત્યારે તેણે તે ખંતપૂર્વક કરવું જોઈએ, વચ્ચે આવતાં વિધનોની અને મુશ્કેલીઓની દરકાર ન કરવી જોઈએ; અને તે ત્યાં સુધી કે જ્યાં સુધી એક નકારી ન શકાય તેવી કોઈ નિક્ષિત ઘટના સૂચવે કે હવે તેણે તે કાર્ય કરવાની જરૂર નથી. પણ આમ વિરલ બનનું હોય છે.

સામાન્ય રીતે, વસ્તુઓ પોતાના જ વળાંકને અનુભરતી હોય છે, અને જ્યારે પરિણામ રૂપે ઈચ્છિત વસ્તુ પ્રામ થાય છે ત્યારે માલુસને તે કિયા કરવા પાછળના કારણની જાણ થાય છે. પણ વિધનોને, વિરોધીને, અથવા પ્રોત્સાહનોને અનુભરણ કરવા યોગ્ય, નિક્ષિત ચિહ્નનો ન માની બેવા જોઈએ, કારણ કે એ વસ્તુઓનો

વિકિત-વિકિત પરતવે લિન્ન-લિન્ન અર્થ હોય છે. આ લાંબા ઘટનાઓની પણ પોતાની સમજસુની પ્રામાણિકતાનો નિર્ણય માણસે ન કરવો જોઈએ.

ન્યારે માણસ ખૂબ સાવધાન અને સાચા દિલ્લનો હોય છે, ન્યારે પોતે જે કાર્ય કરી રહ્યો હોય છે તેના મૂલ્યનું આત્મિક પણ દુષ્પિતોષ્ટ સૂચન તેને મળી રહે છે. સાચે જ, જેનામાં સંપૂર્ણ લવમનસ્તાઈ છે, જે સંપૂર્ણ દિલ્લની સંચાઈ પૂર્વક અને પોતાના અસ્તિત્વના સંપૂર્ણ સ્વચેતન ભાગ વડે બોંબ માર્ગે બોંબ વસ્તુ કરવા માર્ગે છે, તેવા માણસને હુમેશાં સૂચન મળી રહે છે. જે એક યા બીજી કારણે માણસ બોંધા-વત્તા પ્રમાણમાં ખૂબ નુકસાનકારક કાર્ય કરવાનો પ્રારંભ કરે છે, તો તેને સૂર્યાંકના પ્રદેશમાં હુમેશાં એક પ્રકારનું અસુખ જણાય છે, જે ઉગ્ર નથી હોયનું, જે નાટ્યાભક્ત રીતે તેનું ધ્યાન નથી બેંચાયનું, પણ જે ખૂબ સાવધાન માણસને સ્પષ્ટ રીતે અનુભવાય છે, એક પ્રકારના પશ્ચાત્તાપની પેઠે સંખતિનાં અલા-વની પેઢે, તે કાર્યમાં સહકાર આપવાના ફિન્કારની હંડ મુખી જઈ શકે. ખૂબ મારે એ વાત પર ભારે મુક્કવો જોઈએ કે તે અસુખમાં ઉગ્રતા નથી હોતી, પાશ્ચાત્ય અહૃતાની બેંચ નથી હોતી, તે અવાજાંકે પાંખલ કર્ણું નથી, ઈજ પહોંચાડતું નથી, બહુ બંધુ તો તે બોડાક અસુખ તરીકે અનુભવાય છે. જે તમે તેના પર ધ્યાન ન આપો, તેની અવગણુની કરો, તેને મહાંદ્ર ન આપો, તો બોંધા સમય પછી તે તદ્દન અદૃશ્ય થઈ જશે, તમને તે તદ્દન અનુભવાયે નહિ.

શુદ્ધ જેમ વધતી શાબે, તેમ તે અસુખ 'વધતુ' શાબે છે એમ નથી. જિવટું તે અસુખ અદૃશ્ય થઈ જાય છે અને એમના આપરાણી આચાંદિત થઈ જાય છે.

તેથી આ અસુખને એક નિશ્ચિત ચિહ્ન ન ગણાવી શકાય, કારણ કે જે તમે આ નાનકડા સૂચનને અનેક વાર અવગણુંથો, તો પછી તે આવશેજ નહિ. પણ હું તમને કહું છું કે જે દિલ્લની સંચાઈપૂર્વક તરે તેનો પ્રત્યે ખૂબ ધ્યાન આપશો, તો તે એક ખૂબ સુનિશ્ચિત અને ઝીમતી માર્ગદર્શક બની રહેશે.

પણ જે અસુખની લાગણી આવે છે, તો તે પ્રારંભમાં જ, તરત જ આવે છે. જ્યારે તે અસુખની લાગણી ન અનુભવાય, ત્યારે તમે ગમે તે કામ માણે ઉપાડયું હોય તેને પૂરું કરીને જ નંબણે, જેથી પૂરો અનુભવ પ્રાપ્ત કરી શકાય, સિવાય કે તે કામ ન કરીનું તેદ્દન સુનિશ્ચિત અને દબાણ કરે તેવું સૂચન પ્રાપ્ત કાય.

મૃત્યુ એ જીવન સમકાં પ્રકૃતિ વડે સતત મૂક્તાતો પ્રશ્ન છે, તે જીવનને યાદ કરાવે છે કે તેણે હજુ તેની જતને શોધી કાઢી નથી. જે મૃત્યુનો ધેરો ન હોતું તો પ્રાણી સદાને માટે અપૂર્વી જીવનના ચેકાઈમાં બંધાઈ રહ્યું હોત. મૃત્યુ માલસનો પીછો પ્રકદે છે, અને તેથી તે પરિપૂર્વી જીવનના આદર્શે પ્રત્યે જગૃત બને છે અને તેના ઉપાયો, સ્થાપનો અને શક્યતા શોધી કાઢે છે.”

(યોડસ એન્ડ એફોરિઝન્સ, સેન્ટીનરી વોલ્યુમ ૧૬, પૃષ્ઠ ૩૮૯)

આહી આપણુંને પૂરતી સામગ્રી મળી રહે છે; એટબે આપણુંને આગળ જવાની જરૂર નથી. આ એક એવો સવાલ છે કે જેને યોડા ઘણા પ્રમાણમાં પણ જગૃત થયેલી ચેતનાવાળો-માલસ જીવનમાં કમ ચેક વાર તેથી પોતાની જતને પૂછે છે. અસ્તિત્વના ઉંડાણમાં જીવનને આખુ રાખવાની, બાળું જુનાવવાની, વિકસાવવાની એવી તો એક જરૂરિયાત છે કે જે ક્ષમે માલસને મૃત્યુ સાથે પ્રથમ સંપર્ક થાય, પછી જાદે તે સંપર્ક આપકિમક હોય, પણ જયારે સંપર્ક અનિવાર્ય છે તે જ ક્ષમે અસ્તિત્વમાં મૃત્યુ તરફથી એક પ્રકારની પીછેલી અનુભવાણ છે.

“લાગણી પ્રધાન માલસોમાં તે ખૂબ લીટિ પેદા કરે છે; બીજાઓમાં તે ગુસ્સો પેદા કરે છે. માલસને એમ પૂછવાનું વલસ થઈ આવે છે કે આ મૃત્યુ ઇથી લીધાણ ફારસ કેવા પ્રકારનું છે કે જેમાં ઈચ્છા સિવાય, તેને સમજાય સિવાય માલસને ભાગ બેબો પડે છે? જે મરવાનું નક્કી છે, તો પછી જન્મયા થા માટે? જે છેવટે કીશ્શના અને મૃત્યુ જ આવવાના હોય, તો પછી વિકાય માટે, પ્રગતિ માટે, બુદ્ધિ-શક્તિઓને ખિલવવા માટે પ્રયાસ થા માટે? કેટલાક બળવાન બોકો તેની સામે બળવાની લાગણી અનુભવે છે, તેમના કરતાં એંદ્રા બળવાન બોકો નિરાશા અનુભવે છે જો આ બધાની પાછળ કોઈક અચેતન સંકલ્પ હોય, તો તે સંકલ્પ રામસી ભાસે છે.

પણ અહીં શ્રી અરવિંદ આપણુંને કહે છે કે પદ્ધતિતર્પની ચેતનામાં પરિપૂર્ણતા માટેની અને પ્રગતિ માટેની જરૂરિયાત જગૃત કરવા માટે આ એક અનિ-

વાર્ષિક ઉત્પાદ હતો. મુનુરૂપી સંકટ ન હોત તો બધી પ્રાણીઓ પોતે જે સિથિતમાં હતાં તેમાં કદાચ સંતોષ માની હેત; આ વાત નિષ્ઠિત નથી.

પણ આપણે તો વસ્તુઓ જેવી છે તેવી તેમને સ્વીકારવાની છે, અને આપણે જાતને તે બધામાંથી માર્ગ શોધી કાઢવાનું કહેવાનું છે.

હકીકતમાં દરેક વસ્તુ અત્ત પ્રગતિથીલ વિકાસની સિથિતમાં છે. આખી સૂચિ, આખું વિશ્વ પરિપૂર્ણતા પ્રત્યે આગેકૂચ કરી રહ્યું છે, જે પરિપૂર્ણતા જેમ જેમ માનુસ તેમી પણે જાય છે તેમ તેમ પીછેફાડ કરતી ચાલે છે. કારણકે અમુક જાણ જે પરિપૂર્ણતા ભાસતી હતી, તે શોધક સમય પછી પરિપૂર્ણતા વાખતી નથી. ચેતનામાં અસ્તિત્વની ખૂબ સૂધ્ય સ્થિતિઓ આ ચાલી રહેલી આગેકૂચને અનુસરે છે. માનુસ જેમ જેમ ઉધ્વરમાં પ્રગતિ કરે છે, તેમ તેમ તે પ્રગતિની છંદોલયતા વીજિવક વિકાસની છંદોલયતા સાથે વધારે ને વધારે સામ્ય ધર્યાવતી ચાલે છે, અને છેષટે દિવ્ય વિકાસની છંદોલયતાની નજીક આવી પહોંચ છે, પણ ભૌતિક જગતનો સ્વભાવ જ મુલાયમ નથી, કઢેર છે. જ્યારે ઝ્યાત્રા જાહૂ ધીમુ હોય છે; માનવ ચેતનાં કામને જે રીતે માણે છે તે તેને હૃદિંગોયર નથી હોતું. નેથી આતંક અને બાધ્ય જગતની વર્ચ્યે સતત અસમેતુલા હોય છે. સમતુલાનો આ અભાવ, અંતર પ્રગતિની ગતિને અનુસરવા અણેની બાધ્ય રૂપોની અંયકિત શીલુતાની અને રૂપોમાં પરિવર્તનની જરૂરિયાત ઉલ્લી કરે છે. પણ જે આ પદાર્થતત્વમાં માનુસ તે જ પ્રકારની છંદોલયતા પ્રાપ્ત કર્યા માટે પર્યાત ચેતના દાખલ કરી શકે, જો આંતર આગેકૂચને અનુસરવા માટે પદાર્થતત્વ પૂર્તું મુલાયમ બની શકે, તો આ સમતુલાનો ભંગ ન થાય, અને મુંયું અનિવાર્ય ન બની રહે.

એટબે શ્રી અર્દેવિંદ આપણને કહે છે એ મુજબ, પ્રકૃતિએ ભૌતિક ચેતનામાં જરૂરી અણીપ્સા અને મુલાયમતા જગૃત કરવા માટે આ મુનુરૂપી ભૌતિક ઉપાય શોધી કાઢયો છે.

એ તો સ્પષ્ટ છે કે પદાર્થતત્વનું ખૂબ પ્રધાન લક્ષણ છે જડતા. જે આ બધાબધારી (શીલુતા અને મુંયુ) ન હોત, તો વ્યક્તિ ચેતના એટલી જથી જડ બની આત કે અસ્તિત્વની કરવા કરતાં તે સતત અપૂર્ણિતામાં જ અસ્વાનું એવીકારી હોત. સે શક્ય છે, ગમે તેમ, પણ વસ્તુઓનું નિર્માણ આ પ્રકાસનું થયું છે. અને

કંઈક વધારે જાણતા એવા આપણે માટે એક જ કામ કરવાનું રહે છે. અને જો એ કે આપણાં સાધનો અનુસાર, થકિતાનું, ચેતનાનું નવીન બળનું આવાજન કરીને આ બધાનું પરિવર્તન કરવું, કે જે થકિત, ચેતના નવીન બળ ભૌતિક પદાર્થતત્ત્વમાં તેનું હવ્યાંતર કરવા માટે, તેને મુલાયમ, ચપળ, પ્રગતિશીલ બનાવવા માટે, સમર્થ આકંખનને દાખલ કરી શકે તેમ છે.

એ વાત સ્પષ્ટ છે કે પસુંઓ જેવી છે તેવીમાં આસક્તિ એ સૌથી મોટી કુકાપટ છે. પણ પ્રકૃતિ જાણે છે કે ગાહનખર શાનવાળા બોકો ખૂબ જડપથી પ્રગતિ કરવા માગે છે. પ્રકૃતિને પોતાનાં પરિભ્રમણો, એક પછી એક કરતા પ્રયાસો, પોતાની નિષ્ઠળતાઓ, પોતાના તાજ પ્રારંભો, પોતાનાં નવાં સંશોધનો ગમતાં હોય છે. તેને માર્ગની કલ્પના, અનુભવનું અનપેલિત નવીનપણું ગમતાં હોય છે. એમ પણ કહી શકાય કે જેમ જેમ તે આગેકૂચ લાંબોને લાંબો સમય બે છે, તેમ તેમ તેની મોજ પ્રકૃતિ વધારે ને વધારે માણે છે.

પણ રમત ગમે તેટલી કોઈ હોય, છતાં અમૃક વખતે તો માણસ તેનાથી કંટાળી જાય છે. એવા સમય આવે છે કે જ્યારે તે રમતને તે બદલવા માગે છે. તે એવી એવી રમતની કલ્પના કરે છે, જેમાં પ્રગતિ કરવા માટે સંહાર કરવાની જરૂર રહેતી નથી. જેસાં પ્રગતિ માટેનો ઉત્સાહ નવીન સાધનો; અને નવીન અલિ-વ્યક્તિઓ શોધી કાઢવા માટે પર્યામ હોય છે, જેમાં જડતાને, શિથિલતાને, સમજના અભાવને, થાકને, ઉપેક્ષાને અભિભૂત ફર્વાને માટે વેગતું બળ પૂર્તું ઉત્સુક હોય છે.

થોડીક પ્રચતિ ચાધ્યા પછી, આ શરીરને થાક ભાવાની જરૂરિયાત શ્યા માટે લાગે છે? શરીર થાકી જાય છે. તે કહે છે કે તમારે રાહ જેવી જોઈએ. મને આરામનો યોદેક સમય આપવો જોઈએ, આ તેને મુશ્ય. તરફ દોચી જાય છે. જે વધારે સારું કામ કરવા માટેનો ઉત્સાહ શરીર પોતાનામાં અનુભવે, જો તે વધારે પારદર્શક, વધારે સુંદર, વધારે તેજોમય, સનાતન કાળ માટે પુષ્ટાન બની શકે, તો પ્રકૃતિની આ કૂર મશકરીમાંથી માણસ છટકી જઈ શકે.

પ્રકૃતિ માટે આ મહત્વની વસ્તુ નથી. તે સમગ્રને, સકળતાને જુઓ છે. તે જુઓ છે કે કશું જ ગુમાવાઈ જતું હોતું નથી, એ તો જલ્દીઓને મુનઃ સંપુક્ત કરવા જેસી વાત છે, અરંભ સૂક્ષ્મ તર્ફોનું મુનર્ઘટન કરવાની વાત છે, તેમાં કશું

મહત્વનું કે અગત્યનું નથી, તે તત્ત્વોને ઘડામાં પાછાં મુક્કીને સારીચીવે સંમિશ્રિત કરવા જેવી વાત છે અને સંમિક્ષાલુમાંથી ઓઈક નવીન વસ્તુ પ્રગટ થાય છે. પણ તે રમતમાં દરેક જાણને મજા પડતી હોતી નથી, જો માણસ પોતાની ચેતનામાં પ્રકૃતિ બેટલો જાવિશાળ બની શકે, તેના કરતાં વધારે શક્તિશાળી ભૂની શકે, તો માણસે તે જ વસ્તુ વધારે સારી રીતે થા માટે ન કરવી જોઈએ?

અત્યારે આપણી સમજ આ સમસ્યા ખડી છે. અપતરણ પદ્મેલી, પ્રગટ થતી, કાર્ય કરતી આ શક્તિની નવીન મદદથી, તેના ઉમેરાથી, માણસ થા માટે આ લીપણું રમતને પોતાના હાથમાં ન હે, અને તેને વધારે સુંદર, વધારે સંવાદી, અને વધારે સત્ય ન બનાવે?

તેમાં જરૂર છે માત્ર એવા મસ્તિષ્કોની (બુદ્ધિની) કે જે આ શક્તિને જીવપા માટે અને શક્ય કાર્યની રૂપરેખા ઘડી કંઢવા માટે પૂરાં શક્તિશાળી હોય. એવા સચેતન પ્રાણીઓ હોનાં જોઈએ, જે પ્રકૃતિને ખાતરી કરાવી આપવા સમર્થ હોય કે તેની પદ્ધતિઓ કરતાં બીજા પ્રકારની પદ્ધતિઓ છે આ વાત પાગલપણું જેવી લાગે છે, પણ સર્વ નવીન વસ્તુઓ, તે વાસ્તવિકતાઓ બની ત્યાર ફેલવા હુમેણાં પાગલપણા જેવી ને લાગતી હતી.

આ પાગલપણને સત્ય સિદ્ધ કરવાનો સમય આવી પેઢીઓ છે. તમારામાંના ઘણાખર્યને આપણે અહીં થા માટે એકઠાં મળ્યાં છીએ. તેની કદમ્બ ખજર નહિ હોય; પણ તે ખૂબ સચેત કારણો છે. એટથે આપણે તે પાગલપણને પરિપૂર્ણ બનાવવા માટે પ્રયાસ કરવાનો પ્રારંભ કરવો જોઈએ; કમથી કમ, તેને જીવનમાં ઉત્તારવું તે યોગ્ય પરિકામ છે.

*			
૧૯૫૭	૧૯૫૮	૧૯૫૯	૧૯૬૦
૧૧૧	૧૧૨	૧૧૩	૧૧૪
૧૧૩	૧૧૪	૧૧૫	૧૧૬
૧૧૫	૧૧૬	૧૧૭	૧૧૮
૧૧૭	૧૧૮	૧૧૯	૧૨૦
૧૧૯	૧૨૦	૧૨૧	૧૨૨
૧૨૧	૧૨૨	૧૨૩	૧૨૪

## ૭ ફેબ્રુઆરી, ૧૯૪૭

(અપવાદ-રૂપે, માતાજીએ કા વાતાવાપ એક જુનવારે સાંજે સામૂહિક ધ્યાન પહેલાં આપ્યે હતો.)

આંજે સાંજે ધ્યાન પહેલાં હું તમને કેટલક શંટો કહેવા માગુ છું, કારણ કે કેટલાક બોકોએ મને પૂછ્યું છે કે સામૂહિક ધ્યાન અને વ્યક્તિગત ધ્યાન વચ્ચે થોડો તફાવત છે?

મેં તમને ધાર્યોવાર ધ્યાનના બિન્ન બિન્ન પ્રકારો સમજાવ્યા છે, અને તેથી હું તેની પુનરસૃતિ નહિ કરું. આટલું વ્યક્તિગત ધ્યાન વિષે.

સામૂહિક ધ્યાનો સર્વ યુગોમાં બિન્ન બિન્ન કરણો માટે, બિન્ન બિન્ન રીતે અને બિન્ન બિન્ન હેતુઓથી કરવામાં આવતાં હતાં. બોકોનો અમુક સમૂહ અમુક નિશ્ચિત હેતુ માટે એકનિત થઈને ધ્યાન કરે છે, તેને સામૂહિક ધ્યાન કહેવામાં આવે છે. દા. ત. સર્વ યુગોમાં પ્રાર્થના માટે એકઠા મળવાનો બોકોનો રીવાજ હતો. સ્વાભાવિક રીતે જ દેવજોમાં એક પ્રકારનું સામૂહિક ધ્યાન હોય છે; પણ દેવજોની બહાર પણ, કેટલાક બોકોએ સામૂહિક પ્રાર્થના માટે સામૂહિક ધ્યાનનું સંગઠન કર્યું છે. આ પ્રાર્થનાઓ બિન્ન બિન્ન બે પ્રકારની હોય છે.

માનવ ઈતિહાસના પ્રારંભકાળથી બોકોના કેટલાક સમૂહો આત્માની અમુક સર્વસાધારણ સ્થિતિને અભિવ્યક્ત કરવા માટે એકઠા મળતા હતા, બોકો ભગવાનની સ્તુતિ ગાવા માટે એકઠા મળતા હતા. સુક્રો ગાવા, આલાર માનવા, પૂજયબુદ્ધ અભિવ્યક્ત કરવા, ભગવાનની પ્રશ્નિત કરવા એકઠા મળતા હતા. આ ઘોનિહાસિક દાખલાઓ છે. બોકો અમુક સંખ્યામાં સર્વસાધારણ આવાહન કરવા માટે એકઠા મળતા, દા. ત. ભગવાન પાસેથી અમુક ચીજ માગવા માટે, અને તે યાચના સમૂહમાં કરવામાં આવતી, એવી આશાઓ કે એ પ્રકારનું આવાહન, યાચના, પ્રાર્થના વધારે પ્રબળ વજનદાર નીવડથે. તેના કેટલાક ખૂબ પ્રેરિત દાખલાઓ છે. ઈથું ખ્રિસ્ત પછી ૧૦૦૦ મા વર્ષમાં કેટલાક પથગંબરોએ જાહેર કર્યું હતું કે

આ જીવનમાં જગતનો પ્રવાહ હતે, ત્યારે સર્વત્ર જરૂરસપ્તધરણ પ્રાર્થનાઓ કરવા માટે, અને જગતનો પ્રવાહ ન થાય તે માટે, જગતનું જગવાન રહેણું કરે તે માટે કેંકે એકદા મળયા હતા. તાજેજાતમાં, જ્યારે છેઠ્ઠાંડા રાજ જ્યોત્ર્ય ન્યૂગોનિયાથી (ગ્રિફોનિયા) જરૂર પથસ્કેરે હતા, ત્યારે કેંકે આજ દેખેલમાં જ નહિ, પરં ચન્મસેલની ખામે સ્ફ્રેટાઓ ઉપર પણ, ગ્રાને સાજ કરવા માટે જગવાનને પ્રાર્થનાઓ કરવા એકદા મળયા હતા. બન્ધું એવું કે રાજને મટી ગયું, અને વોકેઓ માન્યું કે તે અસ્થાયી પ્રાર્થનાઓનું હૃળ છે. સામુહિક ધ્યાનનું આ તદ્દન બાબા, હુન્યાં સ્વરૂપ છે.

અથાં દીક્ષિકલેના સામુહેલાં, પ્રાચીન સમયની આધ્યાત્મિક શાસ્ત્રાઓમાં સામુહિક ધ્યાન હંમેશાં કલ્પસમાં અધિકાર, અને તે દિલ્લિસમાં ધ્યાનથો હેતુ તદ્દન લિન્ન પ્રકારનો હતો સામુહિક પ્રગતિ માટે, શક્તિન પ્રન્યે સામુહિક શીર્ષે ખુલ્લા થવા માટે, પ્રકાશની અમૃત અસર પ્રન્યે ખુલ્લા થવા માટે તેથો એકદા મળતા. દરતા-ઓથા પ્રમાણમાં આવું જ કાંઈક કશ્વથો આપણે પ્રયત્ન કરવા ભાગીએ છીએ.

પણ તેમાં બે પદ્ધતિઓ છે. હું તમને આજે એ સમજાવવા માગું છું. તે બંને પદ્ધતિઓમાં માસૂરો, વ્યક્તિગત ધ્યાનમાં ચોતે કહે છે. તેવો જ અભ્યાસ કર-શકે હોય છે. તે ધ્યાનમાં દરેક જાણે સગવદભરેલા સુખાસ્તમાં બેસવાનું હોય છે; પણ તે એટલું બધું સુખમય ન હોયનું એઈએ કે ધ્યાન કરનાર જિંદ્ઘી જાય! ત્યાર પછી મેં તમને મયફળીઓ વહેંચતી વખતે કશ્યું હતું. તે તમારે કરવાનું છે. ૧ અર્થાતિ તમારે ધ્યાન કરવા માટે તોયારી કરવાની છે, શાંત અને શીન રહેવા પ્રયત્ન કરવસ્તો છે, વિચારણમાં વેર-વિષેર થશેલા મનને શાન્ત કરવાનું છે, ચેતનાને એકચિત્ત કરવાની છે, બધા વિચારણને અને પૂર્વ-કાર્યોને શાંત કરી દેવાના છે, તેને પ્રયાશક્ષય તમારી જીતમાં પ્રાણી કાઈ આપવાની છે, અને તેને સૂર્ય ચકની પાસે-હંસમાં લેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, કેથી મસ્તિષ્કની સર્વ શક્તિઓને અને મગજને જે દોડતું લુચાતું રાખે છે તે સર્વને પાછાં લાવીને હદ્યમાં એકાગ્ર કરી શકાય. આ બોડીક કાણોમાં, બોડીક મિનિટોમાં કરી શકાય તેમ છે. તે પણ દરેક જણુના પેંટલના પર અધ્યાર રાખે છે આ એક પૂર્વતેથાયી માટેનું વલસુ છે. આ પ્રયાશક્ષય કરી શીક્ષા પણી, તમારે બેમાંથી એક વબસુ અપનાવવાનું છે : સંકિય વબસુ અધ્યાર તો નિર્મિક્ષ વલસુ.

૧. દરેક સાંચે, ધ્યાન અમદ્વા તો કાર્ત્વિકાપ પહેલાં ‘લીલા નાથ’ નાં માળકને, પાસેજાં કીટાંગણ્ય પણ મગજુણીઓ કરેનીએ.

સક્રિય વલણ એટબે તમારા ધ્યાનમાં દોરવણી આપનાર વ્યક્તિ તમને જે કંઈ આપવા માગે છે તે જીવવા માટે તમારે તે વ્યક્તિ પ્રત્યે ખુલ્લા બનનું તે અથવા તો તે વ્યક્તિ તમને જે શક્તિનો સંપર્ક સધારવા માગે છે તે શક્તિ પ્રત્યે ખુલ્લા થનું તે. તે સક્રિય વલણ છે, કારણકે એમાં સંકલ્પ કામ કરી રહ્યો હોય છે, અને કોઈક વ્યક્તિ પ્રત્યે ખુલ્લા થવા માટે સક્રિય ધ્યાન તમારે કરવાનું હોય છે.

નિષ્ઠિક ધ્યાનમાં તમારે માત્ર એકાગ્ર જ થવાનું હોય છે; એવી જેમ માણસ કોઈ દ્વાર ખાલે છે તેમ, તમારે તમારી જતને ખોલી નાખવાની હોય છે. (પોતાના હદ્દ્ય તરફ અંગુઝીનિદેશ કરીને) આ જગ્યાએ તમારામાં એક દ્વાર રહેલું છે. ત્યાં તમે એકવાર એકાગ્ર થઈ જાઓ, એટબે દ્વાર ખોલીને તમે આંસુનિમાં રહી રહ્યો છો (સ્થિરતાનો અભિનય). અથવા તો તમે બીજું એક પ્રતીક બદી રહ્યો છો, તમે તમારા પુસ્તકને ખૂબ વિશ્વા શીતે ઉધાડો છો, જેમાં પૃષ્ઠ તદ્દન કોરાં-અર્થાત્ શાન્ત, મૌનસભર હોય છે, અને કંઈ બનવાની પ્રતીક્ષા કરતા તમારે તે સ્થિરનિમાં રહેવાનું છે.

આ બે પ્રકારના વલણો છે, તે જેમાંથી એકનો તમે દિવસ અનુસાર, પ્રેરણ અનુસાર, અથવા પરસ્દભી અનુસાર, સ્વીકાર કરી રહ્યો છો જે તે તમને વધારે મદદગાર બની રહે તેમ હોય તો, બને વલણો અસરકારક છે, અને સમાન રીતે સારાં પરિણામ લાવી આપે છે.

હવે હું તમને આપણા ખાસ કિરસા પરત્વે કહીય. અતિમાનસ, શક્તિના પ્રંગટીકરણને, જે એક ખુખ્યવારે થયું હતું તેને એક વર્ષ થવા આવ્યું. તે દિવસથી તે શક્તિ ખૂબ સક્રિય રીતે કાર્ય કરી રહી છે, જે કે બહુ થોડા બોકો તે બાબત સુભાન છે! પણ મને લાગે છે કે, એવો સમય આવી ગયો છે કે જ્યારે આપણે તેને જીવવાનો પ્રયાસ કરીને, તે શક્તિને થોડી ઘણી મદદ કરવી જોઈએ.

અલખતા, તે શક્તિ માત્ર આશ્રમમાં જ કાર્ય નથી કરી રહી. જ્યાં જ્યાં બોડું ઘણ્યું ખુલ્લવાપણું હોય છે, ત્યાં ત્યાં બસે જ, આખા જગતમાં તે શક્તિ કાર્ય કરી રહી છે. મારે કહેણું જોઈએ કે જગતમાં આશ્રમને જ માત્ર ખુલ્લવાપણુનો પરવાનો નથી; આશ્રમે જ તે બાબતમાં સર્વ હજી સ્વામીન કરેલા નથી. પણ જે બન્યું છે તેને અહીં આપણે બધાં થોડા ઘણ્યાં પ્રમાણસાં જાહીએ છીએ; અને તેથી હું

ઓથી આશા રાખું છું કે દરેક જસુ તે પ્રસંગનો વાળ ઉઠાવવા માટે સોતાથી બનતું બધું જ કરી છૂટતો હો. પણ સામૃહિક રીતે, આપણે જમીનને સરળી કરવાનો, વધારેમાં વધારે ભૂત્વાપણું પ્રામણ થાય તે માટે જમીનને ફષ્ટુપ જનાવવાનો સામૃહિક પ્રયત્ન કરી શકીએ, અને તે કર્યામાં સખ્યનો તથા શક્તિઓનો ઓછામાં ઓછા બગડ થાય તે વાત પર ધ્યાન રાખી શકીએ.

સામન્ય રીતે તમે જે કરો એમ અમે હુદ્ધીએ છીએ, તે મેં તમને કહી દીધું છે. હવે તમારે આત્મ કરવાનું જ બાકી રહે છે.

\*

## ૧૩ ફેલાચારી ૧૯૫૭

“ દુઃખ અને શોક દ્વારા પ્રકૃતિ જીવાત્માને યાદ દેવરાવે છે કે તે ને સુખોપલોગ કરી રહ્યા છે તે અસ્તિત્વના વાસ્તવિક આનંદનું એક નિર્જલ સૂચન છે. આપણા અસ્તિત્વનું દરેક દુઃખ અને વ્યથા એ આનંદની જવાદાનું રહેસ્ય છે, જે આનંદની જવાદાની સરખામણીમાં આપણા સૌથી મોટા સુખોપલોગ માત્ર જાંખા જબકારા છે. આ રહેસ્યને કારણે જીવાત્માને જીવનની મહાન પરીક્ષાઓ પ્રત્યે, દુઃખો પ્રત્યે, લીધણું અનુભવો પ્રત્યે આર્દ્ધાલું રહે છે. આપણું જીબનતંત્રમય મન તે બધી વસ્તુઓને તિરસ્કરતાનું હોય છે, તેમનાથી દૂર રહેવા માગતું હોય છે.”

( યોદ્ધસ એન્ડ એઝેરિઝન્સ, સેન્ટીનરી વોલ્યુમ ૧૬, પૃષ્ઠ ૩૮૯ )

સ્વાભાવિક રીતે આપણે આપણી જાતને પુછીએ છીએ કે એ રહેસ્ય શું છે કે જેના પ્રાણે દુઃખ આપણને દોરી જાય છે. ઉપરયોગિયા અને અસ્પૂર્ણ સમજવાળો માણસ એમ માણી શકે કે જીવાત્મા દુઃખચી જોંજ કર્સો હોય છે. પણ તે વાત તદ્દન જોઈ છે. જીવાત્માનો સ્વભાવ જ દિવ્ય, સિથર, આપરિપત્તનશીલ, બિનશર્ટી, વિશ્વાણ અસરદ છે. એ વાત સાચી છે કે એ માણસ હિંસ્તપૂર્વક, અહિંસ્યનાયુર્વક,

ભાગ્યવાનની કૃપામાં અડગ શક્કાપૂર્વક દુઃખનો સામનો કરી શકે; એ દુઃખથી છટકી જવાને પ્રયત્ન કરવાને બદલે માલુસ આ સંકલ્પ સાથે, આ અભીષ્ટા સાથે તે દુઃખમાંથી પસાર થવાનો અને પ્રકાશકાળ સત્યને, સર્વ વસ્તુઓની હદમાં રહેવા અવિકારી આનંદને શોધી કાઢવાનો પ્રયાસ કરે, તો સાંતોષના દ્વાર ઝણાં દુઃખનું દ્વાર ઘણીવાર સીધુસ્ટ અને વધારે નિકટનું જણી જાય છે.

કું સુખોપલોભની વાત નથી કરતી, કારસુકે સુખોપલોજ તો સતત અને પરિપૂર્ણ રીતે, પોતાનું મુખ શહન દિવ્ય અસંદર્ભ તરફથી ફેલ્યી દેતો હોય છે.

સુખોપલોગ એક છેતરામણો અને વિકૃત બુરખો છે, જે આપણને આપણા લક્ષ્યથી વિમુખ બનાવે છે, જે આપણે સત્યને શોધી કાઢવા માટે આતુર હોઈએ, તો આપણે સુખોપલોભની શોધમાં ન પડવું જોઈએ. સુખોપલોગ આપણને વરાળ-રૂપ બનાવી મુકે છે, આપણને છેતરે છે, આપણને ગેરમાર્ગ દોરી જાય છે, દુઃખ આપણને ગહનતર સત્ય પ્રન્યે પાછા લાવે છે, કારસુકે દુઃખ સહન કરતા આપણે શક્તિમાન બનીએ, આપણને કચરી નાંખતા દુઃખનો આપણે સામનો કરી શક્યો, તે માટે દુઃખ આપણને એકાગ્ર બનતા ફરજ પાડે છે. જે માલુસ બળવાન હોય તે દુઃખમાં ખૂબ સહેલાઈથી પોતાના સાચા બળને ફૂલી પ્રામ કરી શકે છે. દુઃખમાં જ માલુસ જહુ સહેલાઈથી ઊર્ધ્વમાં રહેવા, સર્વ દુઃખથી પર રહેવા, કોઈક તત્ત્વમાં ફરી સાચી શક્તા પ્રામ કરી શકે છે.

જ્યારે માલુસ મોજ માણે છે અને ભુલી જાય છે, વસ્તુઓ આવે તેમ તેમને સ્વીકારી બે છે, ગંભીર બનીને જીવનનો સામનો કરવાનો ત્યાગ કરે છે, જ્યારે ભુલી જાય છે કે મારે એક સમસ્યાનો ઉકેલ લાવવાનો છે, કંઈક શોધી કાઢવાનું છે, મારા અસ્તિત્વનો કોઈક હેતુ છે, મારે માત્ર સમય પસાર કરીને કાઈ પણ શીખ્યા કે કર્યા વિના અહીંથી ચાલ્યા જણાનું છે, ત્યારે રે ખરેખર પોતાનો સમય બગાડી રહ્યો હોય છે, આપણને જે તક સાંપરી છે તે ગુમાવી દેતો હોય છે. આ તક જીવનની એક મહાન તક છે, આ જીવન પ્રણાલીનું જેત્રા છે, આ ધાર્મકીયની એવી એક કાણ છે કે જ્યારે તમે જીવનના રહસ્યને શોધી આવી શકો આ ભૌતિક, શારીરિક અસ્તિત્વ એક અદ્ભુત તક છે, જીવનને હેતુ શોધી કાઢવા માટેની શક્યતા છે, આ ગહનતર સત્ય પ્રાત્મે એક હંગલું આગળ પણવાની તક છે, દિવ્ય જીવનના જીવન આનંદનો સાંપર્ક સાયનાનું રહેસ્ય શોધી કાઢવાની એક સહાયી ચક્ક છે.

(મોન)

મેં તમને અનેક વાર કહું છે કે દુઃખને અને વિભત્તિને શોધવા એ ઓકે રોગિક વષય છે, જેનો નાગ કરવો જોઈએ. પણ બુધી કરીને દુઃખાથી ભાગી જવું; ઉપરચેટિયા કુદ્ર ગતિ દ્વારા, બીજામાં મન પરોલોને દુઃખાથી ભાગી જવું એ બાયકાપણું છે. દુઃખ આપણને કંઈક શીખવાડવા માટે આવતું હોય છે. જેમ આપણે તે બોધપાઠ જલ્દી શીખી બઈએ, તેમ દુઃખની જરૂરિયાત એછી થતી જાય છે. જ્યારે આપણે રહસ્યને જાણીએ છીએ, ત્યારે દુઃખ સહન કરવાનું રહેણું જ નથી, કારણ કે તે રહસ્ય આપણી સમજ ને દુઃખનું કરણ પ્રગત કરી દે છે અને તેમાંથી પર થઈ જવાના માર્ગને પણ ખુલ્લો કરી દે છે.

અહેતામાંથી બહાર આવવું, તેની જેવમાંથી બહાર આવવું, ભગવાન સાથે આપણી જાતને એકરૂપ બનાવવી, તેમનામાં વિલીન થઈ જવું, કોઈ પણ વસ્તુને આપણને ભગવાનથી વિઝૂટા પાડવા ન દેવા એ જે રહસ્ય છે. ચાલુસ એક વાર આ રહસ્યને શોધી શકે છે, જોતાના અસ્તિત્વમાં તેનો સ્વકારકાર કરે છે, એટલે દુઃખને રહેવાનું કોઈ કારણ રહેણું નથી. તે અહૃદય થઈ જાય છે. તે રહસ્ય એક સર્વશક્તિમાન ઉપાય છે. તે ઉપાય માત્ર અંપણ અસ્તિત્વના અફનતર ભાગોમાં આત્મામાં, આધ્યાત્મિક ચેતનામાં જ કામિયાબ નથી નીવડતો, પણ જીવનમાં તથા શરીરમાં પણ તે કામિયાબ નીવડે છે. કેંદ્ર પણ માંદળી કે જેરબ્યવસ્થા આ રહસ્યનો અને તેના અભ્યાસનો સામનો કરી શકતી નથી. અસ્તિત્વના ઉચ્ચતર ભાગોમાં જ માત્ર નહિ શરીરનાં એપાણુંઓમાં પણ.

કોષાણુંઓમાં રહેવા તેજ વિષે તેમને શીખવાડવાનું જે માસુકને આવડી જાય, કોષાણુંઓ જેના વડે અસ્તિત્વમાં આવ્યા છે તે કાસ્તાવિકતા વિષે તેમને સમજાવતાં જે માસુકને આવડી જાય, તે તે કોષાણુંઓ પણ સંવાદિતમાં પ્રવેશે છે, અને માંદળીને ઊપરના કરતી શારીરિક જેરબ્યવસ્થા અસ્તિત્વની બીજી જખીજ જેરબ્યવસ્થાઓ અહૃદય થઈ જાય છે.

“પણ તેમ ધીય તે માટે, ભાસુસ જાખલો કે ઉર્પોંક વિશેનો જોઈએ, તેમજ જેનાએ શારીરિક જેરબ્યવસ્થા આત્મિ પડે, ત્યારે ભાસુસે ત્થી જવું ન જોઈએ, જેણે જેનાથી દૂર ન ભાગી જવું જોઈએ, તેણે હિમતપૂર્વક, શારીરિક, જ્ઞાનવિદ્યાસ-

પૂર્વક તેનો સામનો કરવો જોઈએ, તેને ખાતરી હોવી જોઈએ કે માંદળી એ એક જૂઠાણું છે. જે માસુસ સંપૂર્ણપણે, પૂર્ણ વિશ્વાસથી પૂર્ણ થાંતિથી લગવાનની કૃપા પ્રત્યે વળે જો તે કૃપા, જેમ અસ્તિત્વનાં ઊડાણોમાં સ્થાપિત થયેલી છે તેમ તે કોષાણુઓમાં પણ સ્થાપિત થશે, અને કોષાણુઓ પોતે શાશ્વત ચર્યમાં, આનંદમાં ભાગીદાર બનશે.

\*

૨૦ ફેબ્રુઆરી, ૧૯૫૭

“ શરીરની ભર્યાદાઓ એ એક બીજું છે. આત્માએ અને મને તેમાં પોતાની જાતને રેઝવાની છે, તેને ભાંગીને સતત તેનું વિશ્વાળતર સીમાઓમાં. મુનર્નિર્માલ કરવાનું છે અને તે ત્યાં સુધી કે જયારે આ સાન્ત શરીરની અને આત્મા-મનની અનંતતાઓ વચ્ચે સંભતિ સ્થપાય.”

(યોટ્સ એન્ડ એફ્રારિઝન્સ, સેન્ટીનલી વોલ્યુમ ૧૬, પૃષ્ઠ ૪૮૬)

વધાલાં માતાજી, “ શરીરની ભર્યાદાઓ એ એક બીજું છે,”  
તેનો અમારે શો અર્થ કરવો ?

જો તમારે ચેષ્ટસ ડ્રપ વાળું શરીર ન હોત, જો તમે સંપૂર્ણ રીતે સચેતન અને પોતાના ગુણોથી યુક્ત, નિર્માલ થયેલી વ્યક્તિ ન હોત, તો તમે એક બીજામાં ભળી જાત અને દરેકને જુદી રીતે ન ઓળખી શકત. જે આપણે જરાક અંદર જઈએ, ખૂબ ભૌતિક, પ્રાણિક અસ્તિત્વમાં આંદર જઈએ, તો ત્યાં લિન્ન-લિન્ન લોકેનાં આકંપનો વચ્ચે એવું તો એક સંમિક્ષાસુ થઈ ગયેલું હોય છે કે તમારામાંના કોઈને પણ બીજાઓથી લિન્ન રીતે ઓળખવો એ કહિન થઈ મદ્દ તેથી આ શરીર એક બીજાની ગરજ આરે છે. (બાળકને ઉદ્દેશીને) બીજું શું હોય, તે તું જાણે છે ? માસુસ બીભાંમાં પ્રવાહી અથવા અર્ધ પ્રવાહી ડ્રપમાં કશુંક રેઝ છે, અને

જ્યારે તે હૃતી જાય છે, ત્યારે માસૂસ તે બીજાને ભાંગી નાખે છે અને ઓમાંશી-  
શોક્કસ રૂપવાળો પદાર્થ પ્રાપ્ત કરે છે. શરીરનું રૂપ બીજાની ગરણ સારે છે, જેમાં  
પ્રાણીક અને માનસિક શક્તિઓ અમૃત શોક્કસ રૂપ ધારણ કરે છે, કેથી તમે  
બીજી વ્યક્તિઓ કરતાં બિનન એવી એક વ્યક્તિત્વ બની શકો.

બહુ જ ધીમે ધીમે, જરૂરની ગતિઓ દ્વારા તથા આ ઓછીવતી દરકારમુક્ત  
પરિપૂર્ણ ક્રેષ્ટસ્વી દ્વારા, તમે અંગત લાગસ્વીએ, અંગત ઈન્દ્રિયજન્ય સંસ્કારો  
અને અંગત વિચારો પ્રાપ્ત કરવાનો પ્રારંભ કરો છો. વ્યક્તિત્વને પ્રાપ્ત કરેલું મન  
એ બહુ જ વિરલ ચીજ છે, જે લાભ સમયની ક્રેષ્ટસ્વી પછી જ પ્રાપ્ત થાય છે.  
નહિ તો તે એક પ્રકારનો વિચારપ્રવાહ હોય છે, જે તમારા મસ્તિષ્ઠમાંથી પસાર  
થાય છે, પછી બીજાના મસ્તિષ્ઠમાંથી, અને પછી બીજાં અનેક મસ્તિષ્ઠમાંથી  
પસાર થાય છે. આ બધું સતત ગતિમાં ચાલનું હોય છે, તેને કોઈ વ્યક્તિત્વ નથી  
હાનું. બીજાએ જે વિચારે છે તેને માસૂસ વિચારતો હોય છે, તેમનાથી બીજાએ  
વિચારત્ય હોય છે તે તે જે બીજાએ વિચારના હતા, દરેક જસુ તે રીતે અહાન  
સંમિક્ષાસુમાં વિચારતો હોય છે, કારણે આ વિચારેના પ્રવાહો, આંકંધનો, એક  
પાસેથી બીજા પાસે પસાર થતાં હોય છે. જે તમે ધ્યાનપૂર્વક તમારી જત તરફ  
જોણો તો તમને તરત જ જસ્તાએ કે બહુ શેડા વિચારો તમાસ પોતાના અંગત છે.  
તેમને તમે કયાંથી મેળવો છે? તમે જે સાંભળ્યું હોય છે, જે વાંચ્યું હોય છે, જે  
તમને શિખવાનામાં આવ્યું હોય છે, તેમાંથી તમારા આ વિચારોમાંના કેટલા વિચારો  
તમારી પોતાની અનુભૂતિના, ચિત્તના, ડેવન તમારા અંગત અવલોકનના પરિસ્થિતિનું  
રૂપ છે? બહુ તો નહિ જ.

જેમનું બૌદ્ધિક જ્ઞાન ખૂબ ઉત્કટ છે, જેમને વિચાર કરવાની, અવલોકન  
કરવાની, વિચારેને એકત્રિત કરવાની ટેવ છે, તેઓ જ પોતાને માટે ધીમે ધીમે  
માનસિક વ્યક્તિત્વનું નિર્માણ કરી શકે છે.

ધર્માભારા બોકોમાં માત્ર બિનકેળવાયેલા જ નહિ, પણ ખૂબ વાચન કરેલા  
બોકોમાં પણ ખૂબ વિરોધી વિચારો હોઈ શકે છે. અને તે વિરોધોથી તેઓ સભાન  
પણ નથી હોતા. મેં એવા ધર્મા બોકોન્ય દાખલા જેણું છું, જેમનામાં રાજકારણી,  
સામાજિક, ધાર્મિક અભિપ્રાયો હોય છે, માનવબૃદ્ધિના કહેવતાના ઉચ્ચતર સેત્રો-  
પરત્વે પણ જેમણે અભિપ્રાયો બાધિલા હોય છે, અને છતાં એક જ વિષય પરના

તેમના અભિપ્રાયોમાં તદ્દન વિરોધ હોય છે, જેનું તેમને ભાન પણ હોનું નથી. જો તમે તમારી જાતનું અવલોકન કરશો, તો તમને જણાયે કે, તમારામાં ઘરસા એવા વિચારો છે જેમને વચ્ચગાળાના વિચારેની કરીથી જોડવા જોઈએ કે જે વિચારો જો તેમણે એક અસંભવિત રીતે સાથે-સાથે ન રહેનું હોય તો, વિચારસાની ખૂબ વિસ્તૃતતાના પરિણામરૂપ હોવા જોઈએ.

તેથી વ્યક્તિએ સાચી વ્યક્તિત્વ જનતા પહેલાં, પોતાના ગુહો પ્રાપ્ત કરતા પહેલાં, તેના વ્યક્તિત્વને એક પાત્રમાં સમાવી બેનું જોઈએ. નહિ તો તે પાસુંની એઠે બધે બધાર પ્રસરો જથે અને તેને કોઈ નિશ્ચિત રૂપ પ્રાપ્ત નહિ થાય. નિન્નતર ભૂમિકાના કેટલાક બેઠો પોતાને માત્ર પોતાના નામથી જ ઓળખતા હોય છે. પોતાના નામ સિવાય, તે પોતાને પોતાના પડોશીઓ કરતાં જુદાં પાછી શકતા હોતા નથી. જો તેમને પૂછવામાં આવે કે તમે કોણ છો? તો તેઓ કહેશે કે મારું નામ ફલાણું છે. થોડીક વાર પછી, તેઓ પોતાના ધ્યાનનું અથવા પોતાના મુખ્ય લક્ષણનું નામ આપશે. જો તેમને પૂછવામાં આવે કે, તમે કોણ છો? તો તેઓ કહેશે કે હું ચિત્રકાર છું.

પણ અમુક ભૂમિકા ઉપર, નામ જ તેમનો જવાબ હોય છે.

નામ શું છે? તે માત્ર એક શબ્દ છે, નહિ વારુ? તેની પાછળી શું હોય છે? કાઈ જ નહિ. તે અનિશ્ચિત વસ્તુઓનો સમૂહે માત્ર હોય છે, કે કે વસ્તુઓ તેના પડોશીથી તે વ્યક્તિની લિન્નતાનું પ્રતિનિધિત્વ કરતો-હોતો નથી. તેનું નામ લિન્ન છે, અને તે જ તેના બેદને બતાવી આપનું હોય છે. જો દરેક જણનું તે જ નામ હોય, તો એક માલસને બીજથી લિન્ન તરીકે ઓળખવું કઠિનું થઈ પડે!

મે એક વખત આકાશ ઉત્ત્યનર પરના પુસ્તકમાંથી થોડુંક વાંચી સંભળાયું હતું. તેમાં એક ગુલામની વાત આવે છે. જયારે જયારે તેને કોઈ પ્રશ્ન પૂછવામાં આવતો, ત્યારે જવાબમાં તે પોતાનું નામ આપતો. પણ બીજા ગુલામોની સરખા-મણીમાં તેને પ્રગતિ કહેવાય, કારણ કે બીજા બધાં ગુલામો માત્ર ‘ગુલામ’ શબ્દથી ઓળખાતા હતા; તે બધાએ તે નામ સ્વીકારી લીધું હતું, તેમણે એક જ વ્યક્તિ હોવાનું સ્વીકારી લીધું હતું. કારણ કે તેમનામાં કોઈ વ્યક્તિત્વ ન હતું, તેમને માત્ર

૧. સેઈન્ટ એક્ઝિયરી, તરે દ હોમ્સ.

ધર્મા, જી હતો, બધા ગુલામોનો, પેઢી દર-પેઢી, તે જ ધર્મા, હલો, તેથી તે બાસાનું એક જ નામ હતું.

માણસ એક પ્રકારની ટેવ વડે અહે છે, જે ટેવ ભાગે જ અર્ધ સલ્પણ હોય છે. જે જીવનો હોય છે; પોતે શું કરે છે, શા માટે કરે છે, કેવી રીતે કરે છે તેનો સુધ્યાલ સરળો તેને હોતો નથી. ટેવથી તે તેમ કરતો હોય છે. જે બેઝો અમૃત પરિસ્થિતિમાં, અમૃત દેશમાં જામા હોય છે, તેથો સ્વયંભૂ રીતે જ તે પરિસ્થિતિની ટેવો સ્વીકારી બેતા હોય છે. માત્ર ભૌતિક ટેવો જ નહિ, પણ વિચારની વાગ્યાની અને કિયાની ટેવો પણ સ્વાભાવિક રીતે જ, પોતાની જતનું અવલોકન કર્યા કિવાય, તેઓ તેમ કરતા હોય છે. જે કોઈ માણસ તે હકીકત-તરફ તેમનું ધ્યાન જેંચે, તો તેમને આશ્ર્ય થાય છે.

હકીકતમાં, માણસને જીંધ્યારાની, બોલવાની, ખાવાની, હરવાફરવાની ટેવ હોય છે, તે આ બધું તફન સ્વાભાવિક હોય હેતુ, કરતો હોય છે, તે શા માટે અને કેવી રીતે તે બાબત તેને આશ્ર્ય થનું હોનું નથી. માણસ ઉપર ચાણાવેલી કરતાં બોણ પણ ધણી વસ્તુઓ કરતો હોય છે. તે સ્વયંભૂ રીતે, ટેવને કારણે તે બધું કરતો હોય છે. તે પોતાનું આત્માવલોકન કરતો હોનો નથી. જ્યારે માણસ અમૃત સાચાજમાં રહેતો હોય છે, ત્યારે તે સાધપરસુ, રીતે તે સમાજ ને કરતો હોય તે સ્વયંભૂ રીતે જ કરતો હોય છે. જે કોઈ માણસ કર્ય કરનારની પોતાની જતનું અવલોકન કરુવાની શકુંઘત કરે તો તે તે પરિસ્થિતિમાં જીવે છે સેની સરખામણીમાં તે એક પ્રકારની ચકાસી ઘટના રૂપ લાગે.

તેથી વ્યક્તિત્વ એ નિયમનથી, પણ અપવાદ છે. જે તમણે પણ તે પ્રકારનો થલો-થરીર-બાબુ રૂપ ન હોય, તો તમને એક બીજાથી લિન્ન ઓળખવા એ બહુ જ મુખ્યલ થઈ પડે.

વ્યક્તિત્વ એ વિજય છે. અહીં શ્રી અરવિદ કહે છે કે આ પ્રથમપણી એ માત્ર પ્રાથમિક લુભિડા છે. એક વાર તમને તમણી જાતમાં કોઈ અંગત, સ્વતંત્ર, સુચેતન સતતનું ભાન થઈ જાય, તો તમારે રૂપ જાંગી નાંખીને આગળ વધવાનું રહે છે. દા. ત. જે તમારે માનસિક વિકાસ સાથવા હોય તેણે તમારે બધી માનસિક દુષ્પ્રેણ માનસિક રચનાઓને બંધગી નાખવી જેઈશે; તો જ તમે તર્વા રૂપોનું નિર્માણ

કરી શક્યો. એટલે પ્રારબમાં જ ચોતાની વ્યક્તિત્વા પ્રાપ્ત કરવા માટે ખૂબ ખૂબ પરિશ્રમ કરવો પડે છે, અને પછી, પ્રગતિ કરવા માટે, જે કોઈ પહેલાં કરવામાં આવ્યું હોય છે તેનો સંહાર કરવો પડે છે. તમે તમારી જતનું, કાર્ય કરતી જતનું અપણોકન કરતા નથી, તે માત્ર ટેવ છે—અલગત, બધી જ નહિ, પણ અહીંથાં આમ કરવાની, ચાંચવાની, વિકાસ આપવાની, કંઈક કાર્ય સિદ્ધ કરવા પ્રયાસ કરવાની, તમારું થોડું ધાર્યું નિર્માણ કરવાની ટેવ છે; અને તેથી તમે તે તદ્દન સ્વાભાવિક રીતે, તમારી જતનું નિરીક્ષણ કર્યા સિવાય, કરતા હો છો.

તમે જીવનમાં કેટલી બધી વસ્તુઓ, મુખ્યત્વે બીજીઓ કરતા હોય છે તે જ રીતે કરો છો? — દા. ત. નિંદા, હલનયલન, ખાવું વિશે, તમે તમારી જતને કોઈ દિવસ પૂછતા નથી કે હું અમુક વસ્તુ આ પ્રકારે જ કેમ કરું છું, અને બીજી રીતે નહિ? તેનો જવાબ તમે નહિ આપી શકો. જે હું તમને પૂછું કે તમે આ રીતે કેમ વરો છો, અને બીજી રીતે નહિ? તો શો જવાબ આપકો તે તમને નહિ જડે. પણ તેનું સાદું કારણ એ જ છે કે તમે અમુક પરિસ્થિતિઓમાં જતન્યાં હતા, અને તે પરિસ્થિતિઓમાં તેવા હોવાની તમને ટેવ પડી ગઈ છે. જે તમે બીજી પરિસ્થિતિઓમાં અને બીજા યુગમાં જતન્યાં હોત, તો તમે લેદ પારખા સિવાય, તદ્દન બીજી જ રીતે વન્યા હોત; તે તમને તદ્દન સ્વાભાવિક લાગ્યું હોત. એક તદ્દન નાનકડો દાખલો હો, ઘણાખરા પણિમના દેખેંથાં અને કેટલાક પૂર્વના દ્યોદ્યો બોકો જમણી બાળુંથી ડાબી બાળુંથી શીવે છે; પણ જાપોનમાં બોકો ડાબી બાળુંથી ડાબણી બાળુંથી જમણી બાળુંથી શીવનું એ તમને તદ્દન સ્વાભાવિક લાગે છે, નહિ વારુ? તમને તે સીંતે શીવતાં શિખવણ્યામાં આવ્યું છે અને તમે તેને વિષે કણો વિચાર કરતા નથી, તમે તે રીતે જ શીવો છો. જે તમે જપાનમાં જાઓ અને લાંના બોકો તમને તે સીંતે શીવતાં જુયો, તો તે બોકો હસે, કારણ કે તેમને જુદી રીતે શીવવાની ટેવ છે. બખવાની બાબતમાં પણ તેનું જ છે. તમે ડાબેથી જમણી બાળુંથી લખો છો, પણ કેટલાક બોકો ઉપરથી નીચે લખે છે, અને કેટલાક બોકો જમણેથી ડાબી બાળુંથી લખે છે. તેઓ સ્વાભાવિક રીતે જ તેમ કરે છે. હું તે બોકો વિષે વાત નથી કરતી, કે જેમસું બખવાના પ્રકારોનું અધ્યયન કર્યું છે, તેમના પર વિચાર કર્યો છે, તે પ્રકારોની સરખામણી કરી છે. હું વિદ્ધાન વેકેન્ચી વાત નથી કરતી. હું તદ્દન સાધારણ બોકો વિષે વાત કરું છું: ખાસ કરીને બાળકો વિષે તે નોંધો સ્વર્ણનું રીતે, પ્રશ્ન પૂછ્યા સિવાય બીજીઓ કરતા હોય છે તેથે જ કરે છે. પણ જાપારે અક્ષમાત અથવા સંજોગેનથાત તેમની

સામે કામ કરવાનો બીજો પ્રકાર આવી પડે છે, ત્યારે તેમને ખૂબ આશર્ય થાય છે કે તેમના કરતાં બીજું પ્રકારે વસ્તુઓ કરી શકાય છે.

આ તદ્દન સાદી વસ્તુઓ છે કે જે તમારા ધ્યાનમાં એકદમ આવે છે, પણ નાનામાં નાની વિગત પરત્વે ચણું આ વાત સાચી છે. તમે વસ્તુઓ અમુક પ્રકારે કરો છો, કારણકે તમે જે સ્થાનમાં અને પરિસ્થિતિમાં છોવો છો, ત્યાં તે વસ્તુઓ તે પ્રકારે કરવામાં આવતી હોય છે. તમે તે વસ્તુઓ કરતાં તમારી જતનું અવલોકન કરતા હોતા નથી.

સાચેજ, મૂળ ઉદ્ગમસ્થાન એક જ (પરમાત્મા) હતું, અને સૂભિને બહુવિધ બનવાનું હતું. આ અનેકનાને એક હોવાનું ભાન કરવામાં ખૂબ પરિશ્રમ કરવો પડે છે. જે માસુસ ખૂબ ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરે, તો તેને માલુમ પડે કે જે સૂભિને તેના મૂળ ઉદ્ગમસ્થાનની સમૃતિ હોત, તો કદાચ તે વિવિધ અનેકતા ન બની શકી હોત. દરેક સત્ત્વના કેન્દ્રમાં પરિપૂર્ણ એકતાનો ભાવ રહ્યો હોત, અને વિવિધતાની કદાચ અભિવ્યક્તિ જ ન થઈ હોત.

આ એકતાની સમૃતિ ગુમાવી દેવાને કારણે, બેઠોથી અભાન બનવાની શક્યતા ઉભી થઈ. જ્યારે માસુસ બીજી છેડે અભાનતામાં ચાલ્યો જાય છે, ત્યારે તે એક પ્રકારની એકતામાં જસી પડે છે કે જે પોતાની જતથી અભાન છે, જેમાં, મૂળ ઉદ્ગમસ્થાનની પેઠે, વિવિધતા અભિવ્યક્ત થઈ નથી.

બંને છેડાઓ પર, એક જ પ્રકારનો બેઠનો અભાવ છે. એક ડિસ્સામાં, તે એકતાની પરમ ચેતનાને કારણે છે, જ્યારે બીજ ડિસ્સામાં, તે એકતાના પરિપૂર્ણ અભાનને કારણે છે.

રૂપની નિશ્ચિતતા-રૂપી સાધન દ્વારા વ્યક્તિત્વાનું નિર્માણ થઈ શકે છે.  
આજે આટલું બસ છે.



૬ માર્ચ, ૧૯૫૭

આજે મારી આંખ મને વાંચવા દઈ શકે તેમ નથી. ૧ પણ ગયે અઠવાડિયે મેં જે વાંચન કરું હતું તેના ઉપર મને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. આજે સાંજે હું તેનો જવાબ આપીશ. પવિત્ર, મહેરનાની કરીને તમે તે ભાગ વાંચશો?

(પવિત્ર વાંચે છે) આ ફકરાનો થો અર્થ છે? “અસ્તિત્વની અસીમ એકતામાં, સ્વતંત્રતા, અસ્તિત્વનો નિયમ (કાયદો) છે. તે સર્વ પ્રકૃતિનો નિગૂઢ સ્વામી છે. ગુલામી અસ્તિત્વમાં પ્રેમનો કાયદો છે, ને સ્વેચ્છાપૂર્વક અનેકતામાં પોતાના બીજા આત્માઓની લીધાને બર લાવવા માટે પોતાની જતને ન્યોછાવર કરી દે છે.”<sup>૧</sup>

(થોટ્સ એન્ડ એફ્ઝેરિઝસ, સેન્ટીનારી વૉલ્યુમ ૧૬, પુષ્ટ ૩૮૫)

ઉપરચોટિયા નજરે, આ બે વસ્તુઓ તદ્દન વિરોધી અને અસંગત ભાસે છે. બાબ્ય દુષ્ટાને કોઈના પણ માન્યામાં ન આવે કે માસુસ એકીજ વખતે સ્વતંત્રતામાં અને ગુલામીમાં કેવી રીતે હોઈ શકે. પણ એક અનું વલણ છે, કે ને આ બંનેને સુસંગત બનાવે છે અને તે બંનેને ભૌતિક અસ્તિત્વની એક સૌથી વધારે સુખમંય સ્થિતિ બનાવી દે છે.

સ્વતંત્રતા એક પ્રકારની સાહજિક જરૂરિયાત છે, અસ્તિત્વના પરિપૂર્ણ વિકાસ માટે એક આરથ્યકતા છે. તાત્ત્વક રીતે, તે ઉચ્ચતમ ચેતનાનો પરિપૂર્ણ સાક્ષાત્કાર છે, ભગવાન સાથેના એકયનો આવિર્ભાવ છે, મૂળ ઉદ્ગમસ્થાનની અને સિદ્ધિની ભાવના છે. પણ આ એકતા અનેકતામાં પ્રગટ થઈ છે, અને એથી કથાકે મૂળ ઉદ્ગમસ્થાનની અને પ્રકૃતીકરણની વર્ણે કથી રૂપ બનાવું જોઈએ. પ્રેમ એ સૌથી વધારે પરિપૂર્ણ કરી છે. પ્રેમનો પ્રથમ આવિર્ભાવ કર્યો હોય છે? પોતાની જતને ન્યોછાવર કરી દેવી, સેવા કરવી, પ્રેમની સ્વર્ણલૂ, નિકટની, અનિવાર્ય ગતિ કરી

૧. ૨૭ મી ફેન્સુઅસ્ટ્રીલીને માત્ર વાંચન યથું હતું અને પછી જ્યાન કરવામાં આવ્યું હતું; વાર્તાવાપ આપવામાં આવ્યો ન હતો. ૨૪ મી નવેમ્બરના દર્શાન પછી, માતાજીને ડાખી આંખમાં થાડું ક લોહી પડતું હતું.

હોય છે? સેવા કરવાની આનંદપૂર્ણ, પરિપૂર્ણ, સમગ્ર આત્મ- સમર્પણની ભાવનાથી સેવા કરવાની.

એટલે તેમની વિશુદ્ધિમાં, તેમના સત્યમાં, આ બે વસ્તુઓ સ્વતંત્રતા અને સેવા એ વિરોધી નથી, પણ પરસ્પરપૂર્ક છે. પરમ વાસ્તવિકતા સાથે પરિપૂર્ણ એકતામાં પરિપૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. કારણે સર્વ અજ્ઞાન, સર્વ અચેતનતા એક બંધન રૂપ છે, કે જે તમને બિનઅસરકારક, મર્યાદિત, અશક્તિતમાન બનાવી મુકે છે. પોતાનામાં જે થોડુક પણ અજ્ઞાન હોય, તો તે એક મર્યાદા છે, બંધન છે પરમાત્મા સાથે પરિપૂર્ણ એકતામાં જ પરિપૂર્ણ સ્વતંત્રતા રહી થકે છે, સ્વર્યાભૂ આત્મસમર્પણ સિવાય કષ્ટ રીતે આ એકતનો સાક્ષાત્કાર થઈ થકવાનો હતો? માત્ર પ્રેમના દાન દારા જ તે શક્ય છે. એટલે મેં કહું તેમની પ્રેમની પ્રથમ અભિવ્યક્તિ સેવા છે.

એટલે સ્વતંત્રતા અને સેવા સત્યમાં ગાઢ રીતે એકદૃપ બની જાય છે. પણ અજ્ઞાનના અને અચેતનતાના આ જગતમાં જે સેવા સ્વર્યાભૂ, પ્રેમપૂર્ણ, પ્રેમની જ અભિવ્યક્તિનું બનવી જોઈતી હતી તે બળજબરીનો સોદો કે અનિવાર્ય જરૂરિયાત બની જાય છે. જે જીવન ટકાવી રાખવા માટે, અસ્તિત્વના સાતલ્ય માટે કરવામાં આવે છે, અને પરિણામે તે કદુપી, દુઃખપૂર્ણ, અપમાનજનક બની ગઈ છે. જે બાજત પ્રકૃત્વના, આનંદ બનવી જોઈતી હતી, તે કદ્ર પતા, થાક, કુક્ર ફરજ રૂપ બની ગઈ છે. સ્વતંત્રતાની આ જરૂરિયાત પણ વિકૃત બની ગઈ છે, સ્વતંત્રતા માટેની એવી એક પ્રકારની નૃથા બની ગઈ છે કે જે સીધી બળવા પ્રત્યે, વિચ્છેદ પ્રત્યે, એકલતા પ્રત્યે દોરી જાય છે કે જે વસ્તુઓ સાચી સ્વતંત્રતાથી તદ્દન વિકુદ્ધની છે.

સ્વાધીનતા! એક ગુણ જ્ઞાની પુરુષ પાસે એક માલુસ આવ્યો. તે માલુસે કહું, “મારે સ્વતંત્ર થયું છે! હું એક સ્વતંત્ર પ્રાણી છું! નયારે હું સ્વતંત્ર હોઈ છું, ત્યારે જ હું અસ્તિત્વ ધરાયું છું!” તે જ્ઞાની પુરુષે સિમત કરીને જવાબ આપ્યો, “તો તેનો અર્થ તો એ થયો કે કોઈ તમને ચાહશે નહિ, કારણ કે જો કોઈ તમને ચાહે, તો તરત તમે આ પ્રેમને પરાધીન બની જવાના.”

તે જવાબ સુંદર છે, કારણ કે પ્રેમ ઔક્ય પ્રત્યે દોરી જાય છે, અને ઔક્ય એ સ્વતંત્રતાની સાચી અભિવ્યક્તિ છે. એટલે જે બોકો, સ્વતંત્રતાના અધિકારને

નામે, સ્વાધીનતા માટે હક્ક-દાવો કરે છે, તેઓ સાચી સ્વતંત્રતા પ્રત્યે પોતાની પીડ ફેરદી હોય, કારણ કે તેઓ પ્રેમનો ઈનકાર કરે છે.

બળજબરીને કારણે વિકૃતિ આવે છે.

બળજબરીથી પ્રેમ ન કરી શકાય. તેવો પ્રેમ પ્રેમ જ નથી રહેતો. બળજબરી વંચ્યે આવી પડે, તો તે એક જૂઠાણું બની જાય છે. આનંદ સત્ત્વની બધી ગતિઓ સ્વર્યભૂત છોવી જોઈશે. તે રવયંભૂતના આંતર સંવાદિનામાંથી, સમજમાંથી, સ્વેચ્છા-પૂર્વકના આત્મસમર્પણમાંથી, ગહનતર સત્ય પ્રત્યે પાછા વળવામાંથી, અસ્તિત્વની વાસ્તવિકતામાંથી પ્રગટે છે, કે જે વાસ્તવિકતા મૂળ ઉદ્ગમસ્થાન અને લક્ષ્ય છે.

\*

૮ માર્ચ, ૧૯૫૭

શુક્રવારના વર્ગોમાં માતાજી સામાન્ય રીતે બાળકો સમકાં વાચન કરતાં હોય છે. પણ એક શુક્રવારે તેમણે નીચે આપેલી કથા કહી હતી.

### એક ખૌદ્ધ કથા

આજે સાંજે તમારી સમકાં વાચન કરી શકું તેમ નથી. એટલે તમને હું એક ખૌદ્ધ કથા કહીશ. કદાચ તમે જાહુતા હણો કે તે આધુનિક છે, પણ તે સાચી છે. મેં મેડિમ એડ પાસેથી તે સાંભળી હતી. તે સન્નારી એક વિખ્યાત ખૌદ્ધ છે. લ્હાસામાં પ્રરોચનાર તે પ્રથમ યુરોપીય સન્નારી હતાં. નિબેટમાંની તેમની મુસાફરી ખૂબ જોખમપૂર્ણ અને અરેરાટી પેદા કરે તેવી હતી. તેમણે મને તે મુસાફરીની એક ઘટના વર્ણવી બતાવી હતી. આજે સાંજે તે કથા હું તમને કહેવા માગું છું.

તેમની સાથે કેટલાક સહયોગીઓ હતા, અને તેથી તે સમૂહ એક વાણિજ્યારાના સમૂહ જેવો બની ગયો હતો. ઈન્ડોચાયનામાંથી નિબેટમાં જવું સહેલું પડે છે, એટલે ને વોકો લાંથી નિબેટમાં જતાં હતા. ઈન્ડોચાયનામાં વિશાળ વનવગડાઓ છે, અને

તે જંગલમાં વાધ બહુ રહે છે. કેટલાક વાધ માનવભક્તી બની જય છે. ત્યારે તે “મિસ્ટર ટાઈગર” કહેવાય છે.

એક વાર મોડી સાંજે તેઓ એક ગાઢ જંગલમાંથી પસાર થતાં હતાં. સહીસલામતીપૂર્વક પડાવ નાખવા માટે તેમણે તે જંગલને વટાવવાનું હતું. શ્રીમતી જેઠને ખ્યાલ આન્દો કે આ મારે માટે ધ્યાનનો કલાક છે. તેમને નિશ્ચિન સમયે, નિયમિત રીતે, ધ્યાનમાં બેસવાની ટેવ હતી. તે કદ્દી ધ્યાન કરવાનું ચૂકતાં નહિ. ધ્યાનનો સમય આવી ગયો હોવાથી, તેમણે પોતાના સાથીદારોને કહ્યું, “તમે આગળ મુસાફરી કરો. હું અહીં બેસીને ધ્યાન કરીશ. જ્યારે મારું ધ્યાન પતી જરૂર, ત્યારે હું તમારી પસે આવી પહોંચીશ. તે દરમિયાન તમે હવે પછીના સ્થાને પહોંચી જાઓ અને પડાવ માટેની તૈયારી કરો. એક મજૂરે તેમને કહ્યું કે ના, શ્રીમતી ના, તેમ કરવું અશક્ય છે. મજૂર સ્વાભાવિક રીતે જ પોતાની ભાગ્યમાં બોલતો હતો. પણ શ્રીમતી જેઠ ને એક તિબેટવાસી પેઢે જ તિબેટની ભાષા આવડતી હતી. મજૂરે કહ્યું “તે અશક્ય છે. મિસ્ટર ટાઈગર જંગલમાં છે. અત્યારે તેને આવવાનો અને ભોજન શોધવાનો સમય આવી રહ્યો છે. અમે તમને એકલા છોડી ને જઈ ન શકીએ. તમે આહી રોકાઈ જાઓ તે બરાબર નથી.” તે સંનારીએ જરાણ આપ્યો, “તમે તેની ચિંતા ન કરો. સહીસલામતી કરતાં ધ્યાન વધારે મહત્વની ચીજ છે. તમે બધા જાઓ હું એકલી આહી રહીશ.”

ખૂબ નામરજૂપૂર્વક તે બધા આગળ ચાલ્યા, કારણકે તે સંનારી સાથે તર્ક્ઝમાં ઉત્તરબું એ અશક્ય હતું. જ્યારે તે અમુક કામ કરવાનો નિશ્ચય કરતાં, ત્યારે કોઈ પણ ચીજ તેમને તે કામ કરતાં અટકાવી શકતી નહિ. તેઓ ચાલ્યા ગયા, અને તે સંનારી એક વૃક્ષ નીચે સગવડપૂર્વક ધ્યાનમાં બેઠો. ચોડાક સમય પછી તેમને કોઈક અલગમતી હાજરીનો ભાય થાયો, તે શું હતું તે જ્યાં માટે તેમણે આંદો જોલી. જ્યાંચાર ડગલાં દૂર એમની સામે મિસ્ટર ટાઈગર ખડો હતો! તેની આંદો લોભપૂર્ણ હતી. એટલે એક સાચા બૌદ્ધની પેઢે, તે સંનારી બૌદ્ધાં, “જે આ રીતે નિર્વાણ પ્રાપ્ત કરવાની હોઊં તો તો તે સુંદર વાત છે. મરે મારા શરીરનો ત્યાગ યોગ્ય રીતે, યોગ્ય ભાવનાપૂર્વક કરવાની તૈયારી કરવી જોઈને.” પછી હાલ્યા ચાલ્યા સિવાય, જરા પણ થડકાટ અનુભવ્યા સિવાય, તેમણે પોતાની આંદો ફરી બંધ કરી જાને ફરી ધ્યાનમાં પ્રવેશ્યાં. વધારે ગાઢ અને ઉલ્કટ ધ્યાનમાં, જગતન ભ્રાન્તિમાંથી તે તદ્દન અનાસકત બની ગયાં. નિર્વાણમાં જવાની તેમણે તૈયારી

કરી. પાંચ મિનિટ વીતી ગઈ, દશ મિનિટ વીતી ગઈ, આડ્યો કલાક વીતી ગયો. અને કાઈ જ ન બન્યું. ધ્યાનનો સમય પૂરો થતાં તેમણે આંખો ઉધારી. સામે વાધ ન હતો! બેશક તે સ્થિર શરીર જોઈને વાધને લાગ્યું હોયે કે આ શરીર ખાવા યોગ્ય નથી! કારણું સામાન્યતઃ વાધ અને બીજાં નંગલી પણું મુત દેહને ખાતાં નથી. એ શરીરની સ્થિરતાનો પ્રભાવ વાધ પર ખૂબ પડ્યો. હું એમ કહેવાની હિસ્ત કરતી નથી કે વાધ પર ધ્યાનનો પ્રભાવ પડ્યો હતો. વાધ ચાલ્યો ગયો. તે સન્તારી લાં એકલાં જ રહ્યાં. જોખમ ચાલ્યું ગયું હતું. શાન્તિપૂર્વક તેમણે આગળ ચાલવા માંડ્યું. પડાવમાં આવતાં તે બોલ્યાં કે હું આવી ગઈ છું!

... આ મારી કથા છે. હવે આપણે ક્રીમતી ઝેડની માફક ધ્યાન કરવાનું છે. નિર્બાણમાં જવાની તૈયારી કરવા માટે નહિ (હસાઇસ), પણ આપણી ચેતનાને જીર્ધવર્તર બનાવવા માટે!

\*

### ૧૩ માર્ચ ૧૯૫૭

આજે સાંજે પણ વાચન નહિ. પણ મેં જે કાઈ લખ્યું છે તે નિષે ઓઈકે પ્રશ્ન પૂછ્યો છે. પવિત્ર, તમારી પાસે તે પ્રશ્ન છે. વાચન.

(પવિત્ર વાંચે છે) “આપણો શ્રોષ મિત્ર તે છે કે જે આપણુને આપણા શ્રોષ ભાગમાં ચાહે છે, અને છતાં આપણે જે છીએ તેનાથી બિનન પ્રકારના બનવાનું જે આપણુને કહેતો નથી.”

(માતાજીની વાણી, શ્રીઅ શ્રોષી, ૧૯૬૬ની આવૃત્તિ, પૃષ્ઠ ૬૬)

આનો અર્થું સમજાવવાનું મને કહેવામાં આવ્યું છે. અનેક પ્રકારની વિરોધી વાત્તી તમને કહેવાનું મને મત થાય છે. પણ...

ગમે તેમ પણ, જ્યારે મારા મનમાં કાઈક હતું, ત્યારે મેં આ લખ્યું હતું. પણ ધ્યે ભાગે માણસ મનમાં શું હતું તે ભુલી જાય છે. માણસ પોતાના મિત્રોને અને આસપાસના માણસોને તેઓ જેવા છે તેનાથી બિન્ન પ્રકારના બનવાનું કહેતો હોય છે. માણસ પોતાને માટે એક આદર્શનું નિર્માણ કરે છે અને દરેક જણને તે આદર્શ લાગુ પાડે છે. પણ... આ મને ટોલસ્ટોયના પુત્રની યાદ દેવડાવે છે, જેને હું જપાનમાં મળી હતી. માનવોમાં એકતા લાવવા માટે તે જગતની યાત્રાએ નીકળ્યો હતો. તેનો ઈરાદો સુંદર હતો. પણ તે સિદ્ધ કરવા માટેની તેની રીતસમે ઓછી સુખકારક હતી. તે અક્ષોલ્ય ગંલીરનાથી કહેતો કે જો દરેકજણ એક જ ભાગ બોલે, જો દરેક જણ એક જ પ્રકારનો પોશાક ધરે એક જ પ્રકારનું ભોજન જરૂર, અને એક જ રીતે વર્તે, તો જરૂર માનવોમાં એકતા સ્થપાય! જ્યારે તેને એમ પૂછવામાં આયું કે તે સિદ્ધ કરવા માટે તમારી શી ગોળના છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે પ્રત્યેક દેશમાં જઈને એક નવીન પણ વૈશ્વિક ભાષાનો ઉપદેશ આપવો, એક નવીન પણ વૈશ્વિક પોશાકનો, નવીન પણ વૈશ્વિક ટેવોનો ઉપદેશ આપવો તે બસ છે. એ કરવાનો તેનો ઈરાદો હતો!

(હસતાં હસતાં) પોતાના નાનકડા ક્ષેત્રમાં દરેક જણ તે પ્રકારનો જ માણસ હોય છે. તેને એક આદર્શ હોય છે, સત્યનો, રૌદ્રયનો, ઉદાતત્તવનો એક ઘ્યાલ હોય છે. અરે, ભગવાનનો પણ; તે ઘ્યાલને તે બીજાઓ પર હોકી બેસાડવા માગતો હોય છે. કેટલાક લોકોને ભગવાન વિષે પણ ઘ્યાલ હોય છે, અને તે ઘ્યાલને તેઓ ભગવાન પર પણ હોકી બેસાડવા માગતા હોય છે, અને ભરતા સુધી તેઓ નિરાશ બનના હોતા નથી!

મારા મનમાં આ સ્વરૂપું અને લગભગ અચેતન વલાય હતું, કારણેકે જો હું તમારામાંના કેરીકને કહું કે તું આ કરવા માગો છે, તો તે ખૂબ જોરપૂર્વક વિરોધ કરીને કહેશે કે ના, ના, મારા જીવનમાં હું તે કદ્દી કરવા માગતો નથી! પણ જ્યારે માણસ બીજા લોકોને માટે આચ કરીને તેમની જીવન પદ્ધતિ પ્રત્યે પ્રનિકાર્યો માટે અભિપ્રાયો બાંધતો હોય છે, ત્યારે તેઓ કેવા હોવા જોઈએ તે વિષે પોતે જે માને છે તેનાથી બિન્ન પ્રકારના હોવા માટે તે તેમનો દોષ કાઢતો હોય છે. વિશ્વમાં બે વસ્તુઓ તદ્દન એક સરખી નથી, ન હોવી જોઈએ, કારણેકે તે પ્રકારની એક વસ્તુ હોવાથી બીજી નિરૂપયોગી છે, અનંત અનેકતાની સંવાદિતા માટે જે અનેકતામાં બે ગતિઓ, અને બે ચેતનાઓ પણ કદ્દી એક સરખી હોતી નથી. આ

વિશ્વનું સર્જન થયું છે. જે આપણે આ વાત કંઈ ભૂલી ન જઈએ, તો પછી કોઈ માણસ આપણા વિચારને અગત્યાવે તેમ ઈચ્છાનો અને તેની વર્ણે પડવાનો આપણને શો અવિકાર છે? જે તમે અમુક રીતે વિચારતા હોયા, તો એ વાત નિશ્ચિત છે કે બીજે માણસ તેજ પ્રકારે વિચારી શકે નહિએ. જે તમે અમુક પ્રકારની વ્યક્તિત હોયા, તો તે વાત તદ્દન નિશ્ચિત છે કે બીજે માણસ તે જ પ્રકારનો ન હોઈ શકે. દરેક વસ્તુને તેની યોગ્ય જગ્યાએ મૂકીને વિશ્વમાં તમારે સર્વ વિરોધી વસ્તુઓને ઓકન્ટ્રિત કરતાં, સંવાદમય કરતાં, સમન્વય કરતાં શિખણું જોઈએ.

શાચા મિત્ર પાસેથી જે પ્રનિકાર્યની આપણે આશા રખીએ તેના પાયામાં આ વસ્તુ હોવી જોઈએ. મિત્રે એમ ન ઈચ્છાયું જોઈએ કે મારો મિત્ર મારો જેવો જ બને! તે જેવો છે તેવો જ હીક છે.

વાક્યની શરૂઆતમાં મેં કહ્યું છે કે “તે તમારા શ્રોષ ભાગમાં તમને ચાહે છે...” તેને વધારે વિધાયક રીતે મૂકીએ તો, તમારા મિત્રે તમને તમારી નિમનતમ ભૂમિકા ઉપર નીચે ઉત્તરી આપવામાં પ્રોત્સાહન ન આપવું જોઈએ, તેની સાથે મૂખ્યાઈ ભરેલા કૃત્યો કરવા અથવા તેની સાથે ખરાબ રેવોમાં ગંભીર પડવા, અથવા તમે જે ખરાબ કૃત્યો કરો છો તેને માટે તમારી પ્રશંસા કરવા પ્રોત્સાહન ન આપવું જોઈએ. એ વાત તદ્દન સાચું છે. પણ ધ્યાની ધ્યાની વાર એમ જ બનતું હોય છે કે પોતે જગતે નિમનતર ભૂમિકા પર અહીં પડશો હોય ત્યારે જેની સોબતમાં તેને અસુખ ન થાય તેની સાથે જ માણસ મિત્રાચારી બાંધતો હોય છે. જે પોતાની મૂખ્યાઈઓને પ્રોત્સાહન આપતો હોય છે તેને જ માણસ પોતાનો શ્રોષ મિત્ર માનતો હોય છે. શાળામાં જવાને બદલે અટકવા માટે, ઉધાનોમાંથી ઝ્યોં ચોરી લાવવા માટે, પોતાના શિક્ષકોની ડેકડી ઉડાવવા માટે, તેવી અનેક વસ્તુઓ માટે માણસ બીજોઓની મિત્રાચારી કરતો હોય છે. હું કોઈ વ્યક્તિની અંગત ટીકા કરતી નથી, પણ સાથે જ દુઃખની વાત છે કે હું તે બાબત ઘણા દાખલા ટાંકી શકું તેમ છું. કદાચ તેથી મેં કહ્યું હતું કે તેઓ તમારા સાચા મિત્રો નથી. પણ તેઓ ખૂબ સગવડ ભરેલા મિત્રો હોય છે, કારણ કે તેમની સોબતમાં તમે ઓટું કરી રહ્યા છો એમ તેઓ તમને લાગવા દેતા નથી. તેને બદલે જો કોઈ આવીને તમને કહે કે જે રખડવાને બદલે અથવા ઓગસ્ટમાં સમય જાળવાને બદલે અથવા મૂખ્યાઈભરેલા કૃત્યો કરવાને બદલે, જો તમે વર્જમાં આવો તો તે વધારે સાચું નથી? તો માટે ભાગે તમે જગત આપશો કે તું મારી સાથે માથાડૂટ ન કર,

હું મારો મિત્ર નથી, કદાચ મેં આ વાક્ય લખ્યું હતું. હું ફરીવાર કહું છું કે હું કોઈની અંગત ટીકા કરતી નથી, પણ કમનસીએ આમ વારંવાર બનતું હોય છે, અને તેથી તે કહેવાની નક હું જરૂરી લઉં છું.

અહીં એવાં બાળકો છે, જે બહુ આશારપદ હતાં, પોતાના વર્ગમાં પહેલે નંબર રાખતાં હતાં, જે ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતાં હતાં, જેમની પાસેથી મે મોટી આશા રાખી હતી, અને જેઓ આ પ્રકારની મૌત્રીથી તદ્દન વિનાશ પામી જયા છે. હું આજે આ વાત કહી રહી છું એટલે હું કહીથા કે, તેથી મને શહું દુઃખ થયું છે; હું તેવા લોકોને મિત્રો નથી કહેતી પણ કટૂર શત્રુઓ કહું છું, જેમનાથી, કોઈ ભયંકર ચેપી રોગથી યોતે દૂર રહેતો જોઈએ.

ચેપી રોગવાળા માણસની સોબત આપણે કરતા નથી, કાળજીપૂર્વક તેનાથી દૂર રહ્યો છીએ. સામાન્ય રીતે તેને એક ખાસ અલગ જગ્યાએ રાખવામાં આવે છે, જેથી તે ચેપી રોગ ફેલાય નહિએ, પણ દુર્ગુણનો, દુરાચારનો, દુષ્ટતાનો, અસંયનો, અધમનો ચેપ કોઈ પણ ચોગના ચેપ કરતાં વધારે જોગમડારક હોય છે. તેનાથી કાળજીપૂર્વક દૂર રહેતું જોઈએ. તમને કહે કે હું તારા દુષ્કૃત્યોમાં જાગ નહિં થઈ, જે તમને પ્રદોષનોનો ચામનો કરવા માટે હિસ્ત આપે, તેવા માણસને તમારે તમારો શોષ મિત્ર માનવો જોઈએ. તમારે તેની સાથે સમાગમ કરવા જોઈએ, અને નહિં કે તેની સાથે જેની સાથે તમે ગમ્મત-મજાક કરો છો, અને જે તમારી દુષ્ટ વૃત્તિઓને ભગવાન બનાવે છે.

હવે હું આ બાબતમાં જાણું નહિં કહું. હું જેમને ઉદ્દેશ્યોને આ કહી રહ્યું છું તે બાળકો મારા કહેવાનો ભાવાર્થ સમજી જશે એવી હું આશા રાખ્યું છું.

અરેણર, તમારે તમારા કરતાં વધારે ડાઢા માણસોની, જેમની સોબત તમને ઉદાત્ત બનાવે તેવી હોય તેમની, જે તમને સંયમ રાખવામાં અને પ્રગતિ કરવામાં, વધારે સારી રીતે વર્તવામાં અને વધારે સ્પષ્ટ રીતે જોવામાં મદદરૂપ હોય તેવા લોકોને મિત્રો તરીકે પસાંદ કરવા જોઈએ. અને છેવટે શું ભગવાન જ આપણા શોષ મિત્ર નથી? ભગવાનને આપણે બધું જ કહી શકીએ છીએ, બધી ગુમ વાતો તેમની અજગ્ર પ્રગત કરી શકીએ છીએ. ભગવાનમાં સર્વ દ્યાનું, જો પુનરાવૃત્તિ

ન કરાય, ૧. દરેક ભૂલને ભૂસી નાંખવાની શક્તિનું ઉદ્ગમસ્થાન છે. સાચા સાક્ષાત્કારનો માર્ગ ચોલ્યો નાંખવાની અગવાનમાં શક્તિ છે. અગવાન બધું જ સમજી શકે છે, બધા રોગોને મટાડી શકે છે, માર્ગમાં તમે ઠોકર ન ખાઓ, ગબડી ન પડો, લક્ષ્ય પ્રત્યે સીધાસર ચાલ્યા જાઓ તે રીતે મદદ કરી શકે છે. તે સારા-માઠા દિવસોમાં સાચ્યો મિત્ર છે. અગવાન સમજી શકે છે, રોગ મટાડી શકે છે. જ્યારે તમને તેની જરૂર પડે, ત્યારે તે હાજર જ હોય છે. જ્યારે તમે સાચા દિલથી તેમને બોલાવો છો, ત્યારે તમને માર્ગદર્શન આપવા માટે, ટકાવી રાખવા માટે, આવી રીતે તમને ચાહવા માટે અગવાન હંમેથાં હાજર જ હોય છે.

\*

## ૧૫ માર્ચ ૧૯૫૭

(નીચેનો વાર્તાલાપ માતાજીએ શુફ્ફરારે આપ્યો હતો, જ્યારે માતાજી બાળકો સમજી વાચન કરતો હતો.

### ટલેમસ્ટેનની સ્મૃતિઓ

આજે ક્રી વાર હું વાંચન કરવાની નથી. પણ હું તમને કોઈ વાર્તા નહિ કહું. હું તમને શીર્ષતી એકસ વિષે કહીશ.

૧. ૧૯૬૧માં જ્યારે ચા વાર્તાલાપને પ્રસિદ્ધ કરવામાં આવ્યો, ત્યારે માતાજીએ કહું હતું, “જ્યાં સુધી માણુસ પોતાની ભૂલેણી પુનરાવૃત્તિ કરેછે, ત્યાં સુધી કોઈ ભૂલને ભૂસી શકાતી નથી, કારણ કે માણુસ હર-ક્ષણે તે ભૂલને પુનર્જીવિત કરતો હોય છે. જ્યારે માણુસ કોઈ ગંભીર કે નાનીભૂલ પોતાના જીવનમાં કરે છે, ત્યારે તેના પરિણામો તેને મળે જ છે. તે ‘કર્મ’ ને કોણવિનું જ પડે છે, અગવાનની કૃપા પ્રત્યે માણુસ વળે, તો તેમાં સર્વ પરિણામોનો નાશ કરવાની તાકાત છે. પણ તે કૃપા મેળવવા માટે દુષ્કૃત્યની પુનરાવૃત્તિ ન થવી જોઈએ, માણુસે એમ ન માનતું જોઈએ કે હું બધાં દુષ્કૃત્યો કર્યા જ કરીશ, અને અગવાનની કૃપા તે બધાંના પરિણામોને જુરી નાંખ્યા જ કર્યો. કુત કાળને વિશુદ્ધ બનાવી શકાય કે જેથી તે સાચિ પર કોઈ વિપરિત અસર ના ગીયાને. પણ તેમાં એ શરત છે કે તેણે તે કુતકાળને સતત ચાલુ વર્તમાનકાળ ન બનાવી શુદ્ધે. જોઈએ. તમારામાંના દુષ્ટ આહોલને તમારે જ બંધ પાડી દેવું જોઈએ. તમારે તે આહોલનની વારંવાર પુનરાવૃત્તિ ન કરવી જોઈએ.

શ્રીમતી એકસ વાઈટ ટાપુ પર જનમાં હતાં. તે ટલેમસેનમાં પોતાના પતિ સાથે રહેતાં હતાં. તેમનો પતિ એક મહાન મમી રહસ્યવાદી હતો. શ્રીમતી એકસ પણ એક મહાન મમી હતાં. તેમનામાં ઘણી શક્તિઓ હતી. તે દૂરદર્શન કરી શકતાં. તેમનામાં માધ્યમ બનવાના ગુણો હતા. તેમનામાં અસાધારણ શક્તિઓ હતી. તેમને ખૂબ પરિપૂર્ણ અને કઠોર તાલીમ પ્રામ થઈ હતી. તે પોતાના ભૌતિક શરીરમાંથી, પૂર્ણ ચેતનામાં, સૂક્ષ્મ શરીરને બહાર કાઢી શકતાં, અને તે પણ એક પછી બીજી વાર- એમ બાર વાર. તે સભાનનતાપૂર્વક અસ્તિત્વની એક ચેતનામાંથી બીજી ચેતનામાં જઈ શકતાં, તેમાં પોતે પોતાના ભૌતિક દેહમાં સભાનનતાપૂર્વક રહી શકતાં હતાં તે જ રીતે, સભાનનતાપૂર્વક રહી શકતાં. પછી તે ફરીને પોતાના સૂક્ષ્મ દેહને સમાધિમાં મુકી શકતાં, અને પોતાની જતને તેમાંથી વારંવાર બહાર કાઢી શકતાં અને તે પણ ઇપોના જગતના છેક છેવાડાના સીમાડા સુધી. તે વાત હું તમને બોડા સમય પછી કરીશ, જ્યારે તમે મારી વાત વધારે સારી રીતે સમજ શકશો. પણ હું તમને કેટલીક નાનકડી ઘટનાઓ વર્ણવી બતાવીશ. હું પોતે જ્યારે (૧૯૭૦માં) ટલેમસેનમાં હતી, ત્યારે મેં તે ઘટનાઓ જોઈ હતી. તેમણે મને જે કથા કહી હતી, તે પણ હું તમને કહી સંભળાવીશ.

એ ઘટનાઓ વધારે બાધ્ય પ્રકારની છે, પણ છતાં રમુજુ છે.

તે બગભગ હંમેશાં સમાધિમાં જ રહેતાં. તેમણે પોતાના શરીરને એવી તો સારી તાલીમ આપી હતી કે જ્યારે તે સમાધિમાં હતાં અને જ્યારે તે પોતાના અસ્તિત્વના એક અથવા વધારે ભાગોને બહાર મોકલતાં હતાં, ત્યારે પણ તેમના શરીરને પોતાનું આગણું જીવન રહેતું. તેઓ હરી ફરી શકતાં અને કેટલાંક નાનકડા શારીરિક કાર્યો કરી શકતાં. તે ઘણું કામ કરતાં, કારણું સમાધિમાં પણ તેઓ મુક્ત રીતે વાતચીત કરી શકતાં, પોતે ને જ્યું હતું તેનું તે વર્ણન કરતાં કે જેની પાછળથી નોંધ બેવામાં આવતી, અને પછી તે ઉપદેશો પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યા છે. તે અને બીજું રહસ્યવાદી કાર્ય કરવાને કારણે, ઘણીવાર તે થાકી જતાં અર્થાત્ તેમનું શરીર થાકી જતું, અને તેને સધન રીતે પોતાની પ્રાણશક્તિને તાજી જતાવવાની જરૂર પડતી.

એક દિવસ તે થાકી ગયાં હતાં, ત્યારે તેમણે મને કલ્યાં કે હું કેવી રીતે મારી શક્તિને ફરી પ્રામ કરી લઉં છું તે તમે જોશો. તેમની પાસે એક વિશાળ જગીર

હતી. તેમાં ખૂબ પ્રાચીન ઓલિવ વૃક્ષો અને ફિઝ વૃક્ષો ઉગેલાં હતાં, તેમના જેવાં વૃક્ષો મેં બીજે કયાંય કદી જોયાં નથી. તે એક અદ્ભુત ઉદ્ઘાન હતું. આ વિશાળ જમીન તે પર્વતની બાજુ પર હતી, તળેટીથી લગ્જગ અહિથે ઉચે આ ઉદ્ઘાનમાં અનેક લીધુનાં અને નારંગીનાં વૃક્ષો હનાં, દ્રાક્ષના વેલા પણ હતા. નારંગીની કણીઓ કરતાં દ્રાક્ષના વેલાનાં પુષ્પોમાં વધારે સારી સુગંધ હોય છે. તે પુષ્પો મોટાં હોય છે. તેમાંથી તેમને રસ કાડતાં આવડતું હતું. તેમણે મને તેની એકભરેલી શીશી આપી હતી. તેમણે આટલું મોટું (અભિનય) એક દ્રાક્ષનું ફલ ચૂંટ્યું હતું. તે પાડું હતું, તે પથારીમાં સૂઈ ગયાં અને તે દ્રાક્ષ ફળને તેમણે અહીં (અભિનય) પોતાના સુર્યાંક ઉપર મૂક્યું. જેલાના બંને હાથ વડે તેમણે તે દ્રાક્ષ ફળને પકડી રાખ્યું હતું. સૂઈ જઈને તે આરામ લઈ રહ્યાં હનાં. તે જિંધી ગયા ન હતાં, માત્ર આરામ લેતાં હનાં તેમણે મને કહ્યું કે એક કલાક પણી આવજો. એક કલાક પછી હું તેમની પાસે ગઈ. દ્રાક્ષ ફળ પાન કોઈક (મોટી રોટલી) જેટલું પહોળું બની ગયું હતું. તેનો અર્થ એ થયો કે તેમનામાં પ્રાણુશક્તિ ચૂસી લેવાની એટલું બધું બણ હતું કે તેમણે ફળમાંથી આખું જીવન ચૂસી લીધું હતું અને તે ફળ નરમ અને તદ્દન પહોળું બની ગયું હતું. મેં પોતે જ તે જોયું હતું ! તમે તેમ કરવા પ્રયત્ન કરો; નમે સફળ નહીં બનો ! (હસાહસ)

બીજી એક ઘટના આનાથી પણ વધારે રમુછુ છે. પણ પ્રથમ હું તમને ટ્યેમસેન વિષે કંઈક કહીશ, જે કદાચ તમે નહિ જાણતા હો. ટ્યેમ-સેન સહરાની સરહદ પર દક્ષિણ એલ્જરિયામાં આવેલું એક નાનું શહેર છે. તે શહેરનું નિર્માણ એક ભીણમાં કરવામાં આવ્યું છે. તે ભીણની આસ-પાસ એક પર્વતોનું વર્તું છે. તે પર્વતો બદ્ધું ઊંચા નથી, પણ ટેકરીઓ કરતાં વધારે ઊંચા છે. તે ભીણ ખૂબ ફળદુષ, લીલીછમ, અને લભ્ય છે. તેમાં મોટે ભાગે આરાયાની અને શ્રીમંત વેપારીઓની વસ્તી છે. તે શહેર ખૂબ સમૃદ્ધિશાળી હતું. અત્યારે તેની સ્થિતિ કેવી છે તે હું કહી શકું તેમ નથી, કારણકે આ ઘટના આ સદીના પ્રારંભમાં બની હતી. તે શહેરમાં ખૂબ શ્રીમંત આરબો રહેતા હતા. અનેકવાર તેઓ એકસની મુલાકાત વેવા તેમની પાસે આવતા હતા. તેઓ કશું જાણતા ન હતા, કશું સમજતા ન હતા, પણ તેમને તેમાં રસ હતો.

એક દિવસ સાંજે એક આરબ આવ્યો, અને હસવા જેવા પ્રશ્નો પૂછવા વાગ્યો. પછી શ્રીમતી એકસે મને કહ્યું કે તમે જોશો કે આપણને રમૂજ પડે તેવું

કંઈક બનવાનું છે. મકાનના વરંડામાં એક ખૂબ મોટું ડાઈનિંગ-ટેબલ હતું. તેને આઠ પાયા હતા. દરેક બાજુએ ચાર ચાર. તે ખૂબ વજનદાર અને મોટું હતું. ટેબલથી થોડે દૂર, એ આરથનું સ્વાગત કરવા માટે, ખુરશીઓ ગોઠવવામાં જ્યાંવી હતી. તે એક ખૂલે બેઠો હતો. શ્રીમતી એક્સ ટેબલને બીજે છેડે બેઠાં હતાં. હું અને ક્રી એક્સ એક બાજુએ બેઠાં હતાં. ત્યાં અમે ચાર જણા હતાં. કોઈ પણ ટેબલની નજીક ન હતું. અમે બધા ટેબલથી દૂર હતાં. તે આરબ માસુસ કર્યા પ્રકારની શક્તિઓ પ્રામ કરી શકે તે વિષે અને જાહુ વિષે, હસવા જેવા પ્રશ્નો પૂછ્યા હતો. શ્રીમતી એક્સ મારી સામે જોયું, તે કશું બોલ્યાં નહિ. તે મૌન બેઠાં હતાં. ઓંચિતી મેં એક ભયસૂચક ચીસ સાંભળી. ટેબલે ખસરાની શરૂઆત કરી, અને તેણે, વીરતાભર્યા અભિનય સાથે, બિચારા તે આરબ પર (જે ટેબલને બીજે છેડે બેઠો હતો) આકમણ કર્યું! ટેબલ તેની સાથે અફણાયું. શ્રીમતી એક્સ ટેબલને સ્પર્શ કર્યો ન હતો; પોતાની પ્રાણિક શક્તિથી તેમણે ટેબલને ગતિ આપી હતી. શરૂઆતમાં તે ટેબલ જરાક કચવાટપૂર્વક હાલવા માંથું હતું, પછી તેણે ધીમે-ધીમે ગતિ શરૂ કરી, અને આખરે એક ફૂદકો મારીને ટેબલ ચોતાની જતને તે આરબ ઉપર અફણ્યો. તે આરબ ચાલ્યો ગયો અને ફરી આવ્યો જ નહિ!

તેમનામાં વસ્તુઓને અભૌતિક બનાવી દેવાની અને તેમને ફરી વાર બૌતિક બનાવી દેવાની શક્તિ હતી. તે કદી તે બાબત આત્મશ્વાધા કરતાં નહિ, તે શક્તિ વિષે કદી બોલતાં નહિ કે હું અમુક વસ્તુ કરી રહી છું; તે બધી વસ્તુઓ મૌનપૂર્વક કરતાં. તે આ વસ્તુઓને વધુ મહત્વ આપતાં નહિ. તે જણતાં હતાં કે કેવળ ભૌતિક શક્તિઓ કરતાં બીજી પ્રકારની શક્તિઓ છે. એ હકીકતની તે વસ્તુઓ સાબિતી છે.

સાંજે હું શ્રી એક્સ જ્ઞાયે તે ગ્રામ વિસ્તારને જોતા માટે ફરજા જતી, પર્વતોમાં અને પડોશનાં ગામડામાં ફરતી. મારા મકાનને તાળું મારવાની મને ટેવ હતી. મેં કલ્યું છે તે કરણેસર શ્રીમતી એક્સ આગયે જ બહાર જતાં. ઘણાખરો સમય તે સમાધિમાં રહેતાં. તેમને ઘરમાં રહેવું જમતું. પણ જયારે હું રાતે પાછી ફરતી, ત્યારે હું મારા મકાનને તાળું મારીને જતી અને તેથી કોઈ તેમાં પ્રવેશ કરી શકે તેમ ન હતું; છતાં હું હમેશાં મારા ઓષિકા પર એક પુષ્પમાળા જોતી. સે ઉદ્ઘાનમાં ઉગતાં ‘બેલે દ નુર્ઝ ર નામનાં પુષ્પો હતાં. તે પુષ્પો આપણે અછીં છે.

\* ૧. મિરાલિમિસ, પેરુનું ચાર્કર્ચ; માતાજીએ તેને ચાચાસનનું પ્રતીક કહું હતું:

તે સાંજે ખિલે છે. તેમની સુગંધ અદભૂત હોય છે. ત્યાં તે પુષ્પ છોડોની એક શ્રોતૃ હતી; તે છોડોની આડોઓ આટલી (અભિનવ) મોટી હોય છે. તે પુષ્પો બહુ નોંધપાત્ર છે. અહીં પણ તેજ પુષ્પો છે. એક જ જાહેમાં ભિન્ન ભિન્ન રંગનાં પુષ્પો ખિલતાં હોય છે. પીળાં, રાતાં, મિશ્ર રંગના, લુખરાં, જ્વયુલેલ જેવાં તે નાનકડા પુષ્પો હોય છે. ના, ના, તે પુષ્પો કોન્વોલ્યુમસ જેવાં હોય છે. આ પુષ્પો જાડો પર ઉગે છે, જ્યારે કોન્વોલ્યુમસ એક વતા હોય છે. અહીં બાગમાં તે છે. શ્રીમતી એકસ હમેશાં તે પુષ્પોને પોતાના કાન પાછળ પહેરતાં, કારણકે તેમની સુગંધ આનંદપ્રદ રીતે સુંદર હોય છે. એટલે તે આ મોટી જાડોની વચ્ચેની ગલીમાં થોડું ફરતાં. તે જાડોઓ ખૂબ ઉંચી હતી. તે ફૂલો એકઠાં કરતાં. જ્યારે હું ફરીને પાછી આવતી, ત્યારે હું તે ફૂલોને મારી રૂમમાં જોતી! તે કેવી રીતે તે કરતાં હતાં. તે વિષે તેમણે મને કદી વાત કરી ન હતી. પણ તે મારી રૂમમાં પ્રવેશ કરતાં ન હતાં. તે વાત ચોક્કસ. એકપાર તેમણે મને પૂછ્યું કે તમારી રૂમમાં ફૂલ ન હતાં? મેં જવાબ આપેલો કે હા, જરૂર હતાં. બસ, એટલું જ, ત્યારે મને ખબર પડી કે તે મારી રૂમમાં ફૂલો મૂડી આપતાં હતાં.

હું તમને ઘણી વાતો કહી શકું તેમ છું. પણ તેમણે મને કહેલી, મેં પોતે નહિ જેયેલી. એક વાત કહીને આંજે હું વિરમીશ.

ટ્યેમસેન સહરાની નજીક છે. તેનું હવામાન રસુના જેવું છે. અપવાદ માત્ર એટલો કે ખીલુમાં એક નદી વહે છે, જે કદી સૂકાઈ જતી નથી અને સમગ્ર પ્રદેશને ફળદુર્ઘ બનાવે છે. પણ પર્વતો તો તદ્દન શુષ્ક હતા. માત્ર જે ભાગોમાં જોડુતો રહેતા હતા ત્યાં કંઈક ઉગનું હતું. ક્રી એકસનો ઉધાન (મોટી જગ્યીર) એક અદભૂત સ્થાન હતું. તેમાં બધું ઉગનું હતું—અને તે પણ અભ્ય કદમાં. તે પતિપત્ની ત્યાં ઘરું સમયથી રહેતાં હતાં. પાંચ-છ વર્ષ પહેલાં શ્રીમતી એકસે મને કહેલું કે અમને એમ લાગતું હતું કે આ વંદ્ય પર્વતો મોડા વહેલા આ નદીને સૂક્ષ્મ નાંખશે, તેથી ત્યાં વૃક્ષો રોપવાં તે વધારે યોગ્ય છે, ટ્યેમસેનના વહીવટદાર આજ્ઞા કરી કે બધા દોકો પાસેની બધી ટેકરીઓ પર વૃક્ષો રોપે. એક વિશાળ અર્ધવર્તુળાકારે. તેણે કદ્યું કે પાઈન વૃક્ષો રોપવાં જોઈએ, કારણકે એલજરિયામાં દરિયાઈ પાઈન બહુ સારી રીતે ઉગે છે. તેમને તો અખતરો કરવાનું મન થયું. લગવાન જાણે શા કારણે—કદ્યના કે ભૂલાઈ જવાને કરણે પાઈન વૃક્ષો માટે હુકમ આપવાને બદલે વહીવટદારના માલસોએ ફર વૃક્ષોનો હુકમ આપ્યો! ફર વૃક્ષો

સ્કેન્ડિનેવિઅના દેશોમાં ઉગે છે, રણના પ્રદેશોમાં નહિ, બધું ચીપટપૂર્વક તે ફર વૃક્ષો વાવવામાં આવ્યા. શ્રીમતી એકસે તે જોયું, અને તેમણે એક પ્રથોગ કર્યો, એમ મને લાગે છે. ચાર-પાંચ વર્ષ પછી તે ફર વૃક્ષો ઉંઘાં. એટલું જ નહિ, પણ તે ભવ્ય રીતે ઉગી નીકળ્યાં. જ્યારે હું ટ્રેન્સેન્સમાં ગઈ, ત્યારે ચારેય બાજુના પર્વતો લીલાછમ અને તે વૃક્ષો વડે ભવ્ય બની ગ્રયેલા હતા. તેમણે મને કહ્યું કે જુઓ, આ પાઈને વૃક્ષો નથી. આ તો ફર વૃક્ષો છે, ને નાતાબનાં વૃક્ષો છે, તે તમે જણો છો ને? તે ફર વૃક્ષો હતાં. પછી તેમણે મને કહ્યું કે, “ફર વૃક્ષોને વાખ્યાને ત્રણ વર્ષ પછી, એક ડિસેમ્બરની રાતો હું દીવો હોલવીને સૂઈ ગઈ હતી. એક નાનકડા અવાજથી હું જગી ગઈ. અવાજ પ્રત્યે હું બધું લાગણી- પ્રધાન છું. આંખો ઉધાડતાં મેં ચંદ્રકિરણ જેવું કાંઈક જોયું. તે રાતે આકાશમાં ચંદ્ર ન હતો. તે ચંદ્રકિરણથી મારી રૂમનો ખૂણો પ્રકાશિત બની ગયો. એક નાનકડું ભૂત જોયું; નોવે, સ્કેન્ડિનેવિઅના અને સ્વીડનની પરીક્થાઓમાં તમે જમને વિષે વાચો છો તેવું તે ભૂત હન્યું. તે ભૂત નાનકડું હન્યું, તેનું માથુમોટું હન્યું, તેણે અણીદાર ટોપી પહેરી હતી અને ગાડી લીલા રંગના બૂટ પહેર્યા હતા. તેને લાંબી ધોળી દાઢી હતી, તે તદ્દન બરફ્ફી આચ્છાદિત હતું.

તેમની આંખો ઉધારી હતી, તેમણે તે ભૂત તરફ નજર ફેંકી. તે બોલ્યાં કે તું અહીં શું કરી રહ્યું છે? તે જરાક ચિંતિત હતાં, કારણકે તેમની રૂમની જરમીમાં બરફ પીગળી રહ્યો હતો અને તેમની રૂમની ફરસબંધી પર એક નાનકડું ખાબોચિયું બનાવી રહ્યો હતો. તેમણે પૂછ્યું કે તું અહીં શું કરી રહ્યું છે?

ખૂબ મધુરતાપૂર્વક સિમત કરીને તેણે જવાબ આપ્યો, “અમને ફર વૃક્ષોએ જોલાવ્યાં છે. ફર વૃક્ષો બરફને બોલાવે છે. તે ઠડા મુલકનાં વૃક્ષો છે. હું બરફનો રાજ છું. એટબે હું તમને જાહેર કરવા આવ્યો છું કે અમે આવી રહ્યાં છીએ; અમને બોલાવવામાં આવ્યાં છે, અમે આવી રહ્યાં છીએ.

“બરફ? પણ અમે તો સહરા પાસે છીએ!” તે બોલ્યાં.

તેણે કહ્યું કે, “તો પછી તમારે ફર વૃક્ષો રોપવાં જોઈતાં ન હતાં.”

છેવટે તેમણે તેણે કહ્યું, “સાંભળ, તું ને કહે છે તે સાચું છે કે નહિ તે હું જાણતી નથી. પણ તું મારી ફરસબંધી બગાડી રહ્યું છે. ચાલી જો.”

એટલે તે ચાલ્યું ગયું. ચાંદની તેની સાથે ચાલ્યી ગઈ. તેમણે દીવો સળગાન્યો, કારણુંકે ત્યાં વીજળી ન હતી. અને જ્યાં તે ભૂન ઉણું હતું ત્યાં તેમણે પાણીનું એક નાનકડું ખાગેચિયું જેયું. એટલે તે એક સ્વપ્ન ન હતું. એક સાચા નાનકડા સત્ત્વનો ભરફું તેમની રૂમમાં પીગળી ગયો હતો. બીજી સવારે જ્યારે સૂર્ય ઉગ્યો, ત્યારે તે હિમાચછાદિત પર્વતો પર ઉગી રહ્યો હતો. તે પ્રદેશમાં તેવું પહેલી વાર જ બન્યું હતું. ત્યારથી દરેક શિયાળામાં ત્યાંના બધા પર્વતો હિમાચછાદિત બની જય છે.

એ મારી કથા છે.

\*

## ૨૦ માર્ચ ૧૯૫૭

“કેટલીક વાર વિજયનો આનંદ સંધર્ષના અને સંકટના આકર્ષણું કરતાં ન્યૂન હોય છે. છતાં વિજય પ્રાપ્ત કરતા માનવ-આત્માનું લક્ષ્ય વિજય કલગી હોવી જોઈએ, કોસ નહિ.

અભીભ્વા નહિ કરતા જીવાત્માઓ ભગવાનની નિષ્ફળતાઓ છે. પણ પ્રકૃતિ તેમનાથી આનંદ પામે છે રાજ થાય છે. અને તેવા જીવાત્માઓની સંખ્યામાં વૃદ્ધિ કરવાનું તેને ગમતું હોય છે, કારણુંકે તેઓ તેની સ્થિરતાની ભાતરી આપતા હોય છે અને પ્રકૃતિના સામ્રાજ્યને લંઘાવતા હોય છે.

જેઓ ગરીબ, અશ્વાની, નિમનદુઃખમાં જન્મેલા, અને ખરાબ રીતે ઉછેરવામાં આવેલા છે, તેઓ સામાન્ય માનવસમૂહ નથી હોતો. જેથે કુદ્રતામાં અને સામાન્ય ગાનવતમાં સંતોષ માને છે, તે બધા સામાન્ય માનવસમૂહ છે.

માણ્યસોને મદદ કરો, પણ તેમને શક્તિ વગરના ન બનાવી તેમને દોરવણી અને બોધ આપો, પણ તેમની મૌલિકતા અને કાર્યનો આરંભ કરવાનો આવેગ

કાયમ રહે તે બાબત ધ્યાન રાખો. બીજોઓને તમારી જાતમાં અપનાવી બો. પણ બહલામાં તેમને તેમના સ્વભાવની પૂર્ણ હિંદ્વતા આપો. જે આમ કરી શકે, તે નેતા અને ગુરું છે.

ભગવાને જગતને રહુકોન્ન બનાવ્યુ છે, અને તેને ઝડૂમનાર બોકોના પગના પડછંદાથી અને એક મહાન સંધર્ષના અને કુસ્તીના અવાજોથી ભરી દીધ્યુ છે. ભગવાને શાન્ત માટે જે કિમત નક્કી કરી છે તે કિમત ભરપાઈ કર્યા સિવાય શું તમે શાન્તિને પ્રાપ્ત કરી શકોયો?

પરિપૂર્ણ દેખાતા વિજય પર વિશ્વાસ ન મૂક્યો. વિજય પ્રાપ્ત કર્યા પછી પણ જ્યારે તમને હજુ પણ વધારે કાંઈક કરવાનું બાકી છે એમ જણાય, ત્યારે આનંદ માલાજે અને આગેકૂચ કરજો, કારણ કે સાચી પરિપૂર્ણતા પ્રાપ્ત કરતા પહેલાં, વાંબા સમય સુધી પરિશ્રમ કરવો પડે છે.

વચગાળાની સ્થિતિને લક્ષ્ય માની બેવાની ભૂલ કરવી, અથવા વિશ્રામસ્થાનમાં જરૂરી હોય તેના કરતાં વધારે સમય સુની રોકાઈ રહેવું, તેના કરતાં કોઈ વધારે જરૂર બનાવી દેનારી ભૂલ નથી.”

(યોટ્ટસ એન્ડ એફ્ઝારિઝમ્સ, સેન્ટીનરી વોલ્યુમ્સ ૧૯, પૃષ્ઠ ૩૮૯)

માનવ-પ્રકૃતિની જડતા, ભારેખમપાણું, આળસ, સહેલા સંતોષો, પ્રયાસ પ્રત્યે વિરોધ, આ બધાંની સામે યુદ્ધ કરવાની બાબત શ્રી અરવિંદ આ ફક્રામાં કંઢી રહ્યા છે. જીવનમાં કેટલા બધા ઓવા માણસો મળે છે કે જેઓ સંધર્ષથી ઉત્તા હોવાને કારણે શાન્તિવાદી બની ગયા હોય છે? તેઓ કિમત ચૂક્યા વગર વિશ્રાન્ત બેવા ઈચ્છિતા હોય છે, કલ્પનામાં પ્રાપ્ત કરેલી થોડી પ્રગતિથી સંતોષ માની બેન્ટા હોય છે તેમની કામનાઓ. તેમના માર્ગમાં કરાતા વિશ્રામને સાચો હેરવવા માટે એક પ્રકારની અદ્ભુત સભાનતા ઊભી કરે છે.

સાધાન્ય જીવનમાં આમ ધર્મી વાર બનતું હોય છે. આ શ્રીમંત, બેઠાખાઉ બોકોનો આદર્થ છે, જેણે માનવજીતિને નિઃપ્રાણ બનાવી દીધી છે, અને માનવને તે અત્યારે છે તે પ્રકારનો બનાવી મૂક્યો છે. તેવા બોકો કષેત્રાં હોય છે કે

૬...

“જુવાનીમાં આમ કરી લો, ધનમાન, મોખો, સત્તા કમાઈ લો, થોડી ઘણી બચત કરો, અગમયેતી રાખો, મૂડી ઉલ્લી કરો, સત્તાધીશ બનો, જેથી ચાલીસ વર્ષની ઉમ્મર પછી તમે આરામ કરી શકો, તમારી આવકનો, પેન્શનનો ઉપયોગ કરી શકો, અને મહેનત કરીને કમાયેલી વિકાનિત માણી શકો.” આનો અર્થ આ થયો કે, “બેસો, માર્ગમાં અટકી જાઓ, આગળ ન વધો, ઊંઘી જાઓ, મૃત્યુનો સમય આવે ત્યારે પહેલાં કબર પ્રત્યે સરી પડો, જીવનનો હેતુ સિદ્ધ કરવાની માથાકૂટમાં ન પડો !”

જે કાણે માણસ આગળ વધતો અટકી જાય છે, તે જે કાણે તે પીछેહઠ કરતો હોય છે. જે કાણે તે સંતોષ માની લઈ અભીખસા સેવતો નથી, તે જે કાણે તે ભરવાની શરૂઆત કરે છે. અથવા એક ગતિ છે, પ્રથાસ છે, નવીન આવિભારો પ્રત્યે આરોહણ છે, આગેકૂચ છે, પર્વતારોહણ છે, ભાવિ સાક્ષાત્કારો પ્રત્યે આરોહણ છે. આરામ કરવાની વૃત્તિ કરતાં બીજી ઓઈ વધારે જોખમકારક ચીજ નથી. કિયામાં, પ્રયાસમાં, આગેકૂચમાં, આરામ શોધી કાઢવો જેઈએ. ભગવાનની કૃપામાં સંપૂર્ણ વિશ્વાસ, કામનાઓનો અભાવ, અહંતા પર વિજય, આમાં સાચો આરામ મળો છે.

યેતનાને વિશાળ વૈશિષ્ટક બનાવવાથી સાચો આરામ પ્રાપ્ત થાય છે. વિશ્વ જેટલા વિશાળ બનો, અને તમે સદાને માટે આરામમાં જ રહેશો. ખૂનખાર સંધર્ષમાં, પુષ્ટની મધ્યમાં, પ્રયાસમાં તમને અનંતતાનો અને શાશ્વતતીનો આરામ જડશે.

\*

## ૨૨ માર્ચ ૧૯૫૭

શુક્રવારના વર્ગમાં માતાજીએ નીચેની કથા કહી હતી.

આજે સાંજે હું તમારી સમક્ષ એક ટૂંકી વાર્તા કાંચીશ. મને તે ખૂબ બોધદારી લાગી છે. તે પ્રાચીન સમયની કથા છે, જ્યારે છાપખાનાં અને પુસ્તકો ને છેતાં, જ્યારે ગુરુ અથવા દીક્ષિત પાસે જ શાન હતું અને તે શાન તેઓ

અધિકારી વ્યક્તિને જ આપતા તેમને મન અધિકારી એટલે શીખેલી વસ્તુ આચરણમાં, મૂકે એવી અપેક્ષા રાજીતા જ્યારે તે સત્યને આચરણમાં મૂકી દો, ત્યારું પુસ્તકો તે તમને બીજું સત્ય આપવા સહીત થતા.

૧૯૪૮

અન્યારે તો વસ્તુઓ પલકાઈ ગઈ છે. ગમે તે કોઈ પુસ્તક વાંચવા લઈ શકે છે, અને મરજી મુજબ તેમાંના બોધને આચરણમાં મૂકી શકે છે અથવા નથી મૂક્તો. આ બધું હીક છે, પણ તેથી ઘણા લોકોના મનમાં એક પ્રકારનો જાંચવાડો ઉભો થાય છે. જેમણે ઘણાં પુસ્તકો વાંચી લીધાં હોય છે. તેઓ એમ માની વતો હોય છે કે, “આ પૂરતું છે. મેં અનેક પુસ્તકો વાંચ્યાં છે. એટલે મારામાં કૃતિકું પ્રકારના ચમત્કારો ભનવા જોઈએ.” તેઓ આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરતા હાતા નથી. એટલે તેઓ અધીર બની જઈને કહેતા હોય છે કે, “મેં આટલા બધા પુસ્તક વાંચ્યાં છે, છતાં હું પહેલાં હતો તેવો જ કેમ રહ્યો છું? મને પહેલાંના જેવી જ મુશ્કેલીઓ આવી પડે છે. મેં કોઈ સાક્ષાત્કાર પ્રાપ્ત નથી કર્યો. હું ઘણીવાર આવાં કથનો સાંભળતી હોઉં છું.

તેઓ એક વાત ભુલી જતા હોય છે કે, અધિકારી બન્યા એહેલી તેમણે બૌધ્ધિક, માનસિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે. વાંચેલી વસ્તુ તેમણે આચરણમાં ઉત્તારી હોતી નથી. તેથી સ્વાભાવિક રીતે જ, તેમની ચેતનાની સ્થિતિ વર્ણે એનું તેમના વિચારો, વાંચેલા પણ આચરણમાં નહિ મૂકાપેલા જ્ઞાન વર્ણે મોટી જીએ હોય છે.

તેવા અધીર લોકો માટે હું આ વાર્તા સમજ વાંચી સંખેણાવવાની છું. આ તે સમયની વાત છે કે જ્યારે માનુસ વાંચવા માટે પ્રાપ્ત પ્રાપ્તિકરી શક્યો ન હતો, જ્ઞાન માટે તેણે ગુરુ પર અથવા દીક્ષિત પર આધાર રાખ્યાં એડેટો હતો, જ્ઞાન માત્ર ગુરુ પાસે જ હતું, તેણે તે બીજા ગુરુ પાસેથી મેળ્યાં હતું, યોગ્ય લાગે ત્યારે તે ગુરુ તમારામાં તે જ્ઞાન સંકાન્ત કરતા, અંશીત તેમે એધિકારી બનો ન્યારે.

૧. કાની જાહેર

મારી વાર્તા આ રહી. (માતાજી વાંચે છે.)

૨. મીઠ જ કંદરું ક શક

શર્માં કર્યાનું ક શક

દીક્ષાની કથા

નાનાં કંદરું કર્યાનું

૩. મીઠ મીઠ હું કંદર

નાનાં કર્યાનું ક શક

એક વખત એક મહાત્મા હતા, તે મહાન તપફળીજીસ્કુલે પુંડિલ, કુલપુરુષે વુદ્ધ અને જ્ઞાની હતા. બધા લોકો તેમને માન આપતા, તેમનું નામ જુનું હતું.

ધંણા તરુણો અને યુવાનો તેમની પાસે દીક્ષા બેવા માટે આવતા તેઓ તેમના આક્રમમાં રહેતા, પર્દિત બનતા, અને લાંબો સુમય અધ્યયન કરીને પોતાને ધેર પાછા જતા.

એક દિવસ એક યુવાન તેમની પાસે આવ્યો. તેનું નામ યુસુફ હુસેન હતું. તેને તે કોણ હતો એ પૂછ્યા સિવાય જ મહાત્માએ તેને પોતાની સાથે રહેવાની રજા આપી. ચાર વર્ષ આમ વીતી જયા. એક સવારે, પહેલી જ વાર, જુનુને યુસુફને બોલાવ્યો અને તેને પૂછ્યું કે તું અહો શા માટે આવ્યો છે? એક કણના પણ વિચાર વગર યુસુફ જવાબ આપ્યો કે ધાર્મિક દીક્ષા બેવા માટે. જુનુન કોઈ પણ બોલ્યા નહિ. તેમણે એક નોકરને બોલાવીને પૂછ્યું કે મેં કશું હતું તેવી પેટી તેં બનાવી છે?

નોકરે કશું કે ગુરુજી, હો, પેટી તૈયાર છે.

જુનુને કદ્યું કે વિલંબ કર્યા સિવાય તે પેટી લઈ આવ.

ખૂબ કણજીપૂર્વક નોકરે પેટી મહાત્મા પાસે મૂકી. પેટી લઈને તેમણે તે યુસુફને આપનાં કશું, “નીવા નદીના તરફ પર મારો એક મિત્ર રહે છે. આ પેટીને તું મારી પાસેથી તેની પાસે લઈ જા. પણ ખૂબ કણજી રાખજો. માર્ગમાં કોઈ ભૂલ કરતો નહિ. કણજીપૂર્વક આ પેટીને તારી પાસે રાખજો અને જેને હું તે આપવા માગું છું તેને જ ઓં પેટી તું આપજો. તું પાછોં આવીશ, ત્યારે હું તેને દીક્ષા આપીશ.” મહાત્માએ ઝીરી વાર યુસુફને તેની તે જ સલાહ આપી, અને નીવા નદીના તરે પહેંચવાનો માર્ગ વર્ણવી બતાવ્યો. યુસુફ ગુરુને પગે લાગ્યો. તેણે પેટી લીધી અને પ્રયાસ આદર્યું.

ગુરુના મિત્ર જ્યાં રહેતા હતા તે આક્રમ બહુ દૂર હતો. તે જમાનામાં કાર કે રેલ્વે ન હતી. એટબે યુસુફને પગે ચાલીને મુસાહિયે કરવાની હતી. આખી સવાર તે ચાલ્યો. બપોર થઈ. તાપ ખૂબ હતો, તે બધે ફેલાઈ જતો હતો. યુસુફ થાકી ગયો. એટબે આરામ કરવા તે માર્ગની બાળ્યના એક વૃક્ષની છાયામાં બેઠો. પેટી બહુ નાની હતી. તેને તાળું વાસેલું ન હતું. યુસુફ પેટી તરફ બિલકુલ ધ્યાન આપ્યું ન હતું ગુરુએ તેની પેટી લઈ જવાની આશા આપી હતી, અને એક

પણ શબ્દ બોલ્યા સિવાય તે ચાલી નીકળ્યો હતો. પણ બપોર ગાળવાના સમયે તેને વિચાર આવ્યો. તેના મનને બીજું કોઈ કામ ન હતું. એટલે તે વિચારો કરવા લાગ્યો. આવે પ્રસંગે જે કોઈ મૂર્ખાઈભરેલો વિચાર ન ઉદ્ભવે, તો તે એક વિરલ વસ્તુ કહેવાય. તેની નજર પેટી પર પડી. તે તેના તરફ જોવા લાગ્યો. તેના મનમાં વિચાર ઉઠ્યો, “કેવી સુંદર, નાની પેટી છે! તેને તાજું તો વાસેલું નથી. તે કેટલી બધી હવકી છે. શું તેમાં કોઈ ચીજ હો? તે બધું હવકી છે. કદાચ તે ખાલી પણ હોય” યુસુફ જાણે કે તે પેટી ઉધાડવા માટે પોતાના હાથને લંબાવ્યો. ઓચિંતો તેને વિચાર આવ્યો, “ના, ના ખાલી હોય કે ભરેલી. પેટીમાં શું છે તે જાણવાનું કામ મારું નથી. મારા ગુરુએ આ પેટી તેમના મિત્રને આપવાની આજા કરી છે. તેથી વધારે બીજું કંઈ જ નહિ. મારે તેટલું જ કરવાનું છે. મારે બીજું પંચાતમાં પડવાની જરૂર નથી.”

થોડીક વાર સુધી યુસુફ શાન્તિપૂર્વક બેસી રહ્યો. પણ તેનું મન શાન્ત રહ્યી શકે તેમ ન હતું. પેટી તેની આંખો સામે પડી હતી. તેણે વિચાર્યું, “કેવી સુંદર, નાનકદી પેટી! તે તદ્દન ખાલી જાણાય છે. ખાલી પેટીને ઉધાડવામાં શી હરકત છે? જે તેને તાજું મારવામાં આવ્યું હોત, તો તો મારે તે ખોલવી તે અયોગ્ય કહેવાય. તેને તાજું માર્યું નથી. એટલે તેને ઉધાડવામાં કશી હરકત નથી. એક કાણ માટે ઉધાડીને તેને હું બંધ કરી દઈશ.”

યુસુફનો વિચાર તે પેટીની આસપાસ સંકમણું કરવા લાગ્યો, પેટી પ્રત્યે અનાસકત રહેવું તેને માટે અશક્ય હતું. તેના મગજમાં ખૂસી ગયેલા વિચાર પર કાબૂ રાખવો એ તેને માટે અશક્ય હતું. તેણે વિચાર્યું કે એક ઝડપી નજર હુંતે પેટીમાં નાંખી લઉં. ફરી તેણે પોતાનો હાથ લંબાવ્યો. ફરી વાર તેણે પોતાનો હાથ પાછા એંચા લીધો. પછી તે શાન્તિપૂર્વક બેઠો. પણ વ્યર્થ. છેવટે યુસુફ નિર્ણય કરી લીધો. તેણે ખૂબ ધીમે રહીને પેટી ઉધાડી. તેણે ભાગ્યે જ તે પૂરી ઉધાડી હશે અને એક નાગો ઉદર તેમાંથી કૂદાને અદૃશ્ય થઈ ગયો. તે વિચારો ઉદર પેટીમાં દુલાઈ ગયો હતો. તેણે કૂદકો મારીને મુક્ત થઈ જવામાં એક કાણ પણ ગુમાવી નહિ.

યુસુફ ગલરાઈ ગયો. આંખો ફાડીને તે જોઈ રહ્યો. પેટી ખાલી પડી હતી. શેકપૂર્વક તેનું હદ્ય ધબહવા લાગ્યું, “મહાત્માએ તો પેટીમાં માત્ર એક નાનકડો

ઉદર જ સોકલ્યો હતો. હું તેને સહીતલામત રીતે લક્ષ્ય સ્થળે ન લઈ જઈ શક્યો. સાચે જ, મેં ગંભીર ભૂલ કરી. હવે હું શું કરેશ?"

યુસુફને પશ્ચાત્તાપ થવા લાગ્યો. પણ હવે શું થઈ શકે? તે જાડની આસપાસ ફરી વળ્યો. માર્ગ પર આમતેમ ફરી વળ્યો. પણ બધું વર્ધ્યું? ઉદર ભાગી ગયો હતો. ધૂજીને હાથે યુસુફ પેટીનું ઢાંકણું બંધ કર્યું, અને આશર્યચિત્ત બનીને આગળ મુસાફરી ચાલુ કરી.

જ્યારે તે નીલા નદીના તટ પર, ગુરુના મિત્રના આશમે પહોંચ્યો, ત્યારે તેણે મહાત્માની બેટ તેમને સૌંપી દીધી. એતે ગુનો કર્યો હતો, એટલે મૌનપૂર્વક એક ખૂલ્લામાં ઉલ્લા રહ્યો. ગુરુના મિત્રે એક મહાન સંત હતો. તેમણે પેટી ઉધારી. તે બધી વાત સમજી ગયા. તે બોલ્યા, "યુસુફ, તેં ઉદર ગુમાવી દીયો છે. મને દખેશન છે કે મહાત્મા જુનુન તને દીક્ષા નહિ આપે, કારણકે પરમ જ્ઞાનના અધિકારી બનવા માટે, માલિનને પોતાના મન ઉપર સંપૂર્ણકાબુ હોવો જોઈએ. તારા ગુરુને તારા સંકલ્પ બળ વિષે શંકા હતી. તેથી તેમણે આ યુક્તિ અજમાવી હતી. તેમણે તારી કસોટી કરી હતી. જે તું પેટીમાં એક નાનકડા ઉદરને સાચવવા નેવી એક કુદ્ર વસ્તુને પણ બિલ ન કરી શક્યો, તો પછી તું તારા મહિતાકમાં મહાન વિચારોને રાખવાનાં, હદ્યમાં સાચા જ્ઞાનને સાચવી રાખવાની આશા કેવી રીતે રાખી શકે? યુસુફ, કોઈ વસ્તુ જિનમહત્વની નથી. તું તારા ગુરુ પાસે પાછો જા. ચારિત્યની સ્થિરતા, ખાંત કેળવી વિશ્વાસને યોગ્ય બન, કેથી તું એક દિવસ તે મહાત્માનો સાચો શિષ્ય બની શકે.

ખિન બનેલો યુસુફ મહાત્મા પાસે ગયો, અને તેણે પોતાના ગુનો કબૂલ કર્યો. મહાત્મા બોલ્યા, "યુસુફ, તે એક અદ્ભુત તક ગુમાવી દીધી છે. મેં એક કુદ્ર ઉદર તને જાળવવા સૌંપ્યો હતો. તું તેટલું પણ ન કરી શક્યો? તો પછી તું ખૂબ મૂલ્યવાન અજ્ઞાનાને, દિવ્ય સત્યને સાચવી રાખવાની આશા કેવી રીતે રાખી શકે? તેમ કરવા માટે તારામાં આત્મસંયમ હોવો જોઈએ. જ અને શીખ. તારા મનનો સ્વામી બનતાં શીખ. તે સિવાય કોઈ મહાન સિદ્ધ પ્રામ થતી નથી."

લાજાવાન મુખે યુસુફ ચાલ્યો ગયો. ત્યારથી તેના મનમાં એક જ વિચાર ઘોળાતો રહ્યો. મનના સ્વામી બનવાનો. વર્ષો સુધી તેણે અથાગ પરિક્રમ કર્યો. તેણે કઠોર તપસ્યા કરી. છેવટે મનના સ્વામી બનવામાં સફળ થયો. પછી વિશ્વાસ

કરી યુસુફ ગુરુ પાસે ગયો. તેને તૈયાર બનેલો જોઈને મહાત્મા ખૂબ રજી થયા આ રીતે, યુસુફે મહાત્મા જુનુન પાસેથી મહા દીક્ષા પ્રાપ્ત કરી.

ઘણા વર્ષ વીતી ગયાં. યુસુફના જ્ઞાનમાં તથા સ્વામિત્વમાં વૃદ્ધિ થઈ. તે ઈસ્વા-મનો એક મહાન, અસાધારણ સાંત બન્યો.

(માતાજી બાળકો પ્રત્યે બોલ્યા) તમારે અધીર ન બનવું જોઈએ. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, તમારે તેને આચરણમાં મૂકવું જોઈએ, તમારું પર સંયમ સ્થાપવો જોઈએ, જેથી તમે તે જ્ઞાનને ડિયામાં અભિવ્યક્ત કરી શકો.

અહીં આવેલાં તમને ઘણી વસ્તુઓ વિષે કહેવામાં આવતું હોય છે. તમને સત્યના જગત સાથે સંપર્કમાં મૂકવામાં આવ્યાં છે. તમે તેમાં જીવી રહ્યાં છો. તમે જે હવા શ્વાસમાં બો છો તે સત્યથી પરિપૂર્ણ છે. છાં તમારામાંથી કેટવા થોડા બાળકો જાણે છે કે આ સત્યને આચરણમાં મૂકવાનું છે? જોકે તમે ચેતનાને, જ્ઞાનને, સમતાને, વૈશ્વિકતાને, અનંતતાને, શાશ્વતતીને, પરમ સત્યને, દિવ્ય હાજરીને વળેરેને આચરણમાં ન મૂકો, તમારામાં તે બધાનો સધન અનુભવ ન કરો, તો તમને વિષે વાતો કરવી એ નિર્દ્યક છે. તમે તમારી જતને એમ ન કહેશો કે હું ઘણા વર્ષોથી અહીં રહું છું, મારા પ્રયત્નોનું પરિણામ મેળવવાની મને ખૂબ ઈચ્છા છે. પોતાના સ્વભાવમાંની નાનામાં નાની નબજાઈ પર, નાનામાં નાની કુદ્રતા પર, નાનામાં નાની અધિમત્તા પર પ્રભુત્વ મેળવવા માટે, સતત પ્રયત્ન, ખૂબ સ્થિર સહિષ્ણુતા આવશ્યક છે. જો માણસ અહેના-રહિત જનીને ચાહી ન શકે, તો ભગવાનના પ્રેમની વાતો કરવાથી શો ફયદો? જો માણસ બૂતકળ અને વર્તમાનકળ પ્રત્યે જરૂરી રીતે આસક્ત હોય, જો બધું જ પ્રાપ્ત કરવા માટે તે કશું જ આપવાની ઈચ્છા ન કરતો હોય, તો અમરતાની વાતો કરવાથી શું વળવાનું હતું?

તમે હજુ બહુ નાના છો. પણ તમારે હમણાં જ જાહી બેનું જોઈએ કે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કિમત ચુકવવી પડે છે, પરમ સત્યોને સમજવા માટે તેમને રોઝિદા જીવનમાં આચરણમાં મૂકવાં પડે છે.

આજે આઠવું બસ છે.

જ્યાં જ્યાં તું એક મહાન અંતને જુઓ, ત્યાં ત્યાં ખાતરી રાખજે કે કોઈ મહાન પ્રારંભ થઈ રહ્યો છે. જ્યાં તને કોઈ રાક્ષસી અને દુઃખમય સંહાર થઈ રહેલો તારે મનને જણાય, ત્યાં ત્યાં કોઈ મહાન સર્જન થઈ રહ્યું છે એવી ખાતરી રાખીને તારા મનને આશ્વાસન આપજે. અગવાન માત્ર અંતઃકરણના થાની અવાંજમાંથી નથી, પણ અભિનમાં તથા ઝંજવાતમાંથી છે.

જેમ સંહાર મોટો, તેમ સર્જનની તકો પણ વધારે મુક્ત. પણ સંહાર દીર્ઘકાળીન, ધીમો, અને જુદ્ધમગાર હોય છે. સર્જન આવવામાં વિલંબ કરે છે, તેના વિજયમાં અવરોધો આવતા હોય છે. રાત્રિ વાર વાર આવતી હોય છે, અને દિવસ વિલંબપૂર્વક આવે છે; કેટલીક વાર તેનું પ્રભાત ખોટું પણ ઠરનું હોય છે. તેથી નિરાશ ન બનો જતો, પણ સાવધાનીપૂર્વક કાર્ય કર્યે જ. જેઓ ખૂબ ખૂબ આશા રાખે છે તેઓ જદ્દી નિરાશાનો બોગ થઈ પડે છે. આશા પણ ન રાખ અને લીતિ પણ ન રાખ પણ પરમાત્માના હેતુમાં અને કાર્ય સિદ્ધ કરવાના તારા સંકલ્પ-બળમાં શક્તા રાખ.

દિવ્ય કળાકારનો હાથ ઘણીવાર એવી રીતે કામ કરે છે કે જ્યાં તેમને પોતાની પ્રતિભામાં અને સામગ્રીમાં પૂરો વિશ્વાસ ન હોય તેમનો હાથ સ્પર્શ કરતો, ચોક્કાઈ કરતો અને કામ છાડી દેતો જણાય છે, સામગ્રીને ઉપાડી લેતો અને પછી નાંખી દેતો જણાય છે, ફરી સામગ્રી ઉપાડી લેતો, પરિક્રમ કરતો, નિષ્ઠળ જતો અને સામગ્રીનાં દ્રવ્યોને ફરી એકત્રિત કરતો જણાય છે. બધી વસ્તુઓ તૈયાર થઈ જય ત્યાર પહેલાં તે હાથના કાર્યોમાં આશ્ર્યો અને નિરાશાઓ દેખાતાં રહે છે. જે સામગ્રીને પસંદ કરવામાં આવી હતી, તેને ફરી વધારે સારું નિર્માણ કરવા માટે ખાડામાં ફેંકી દેવામાં આવે છે. જેને ફેંકી દેવામાં આવી હતી, તે એક મહાન ઈમારતની આધાર-શીંચા બની જાય છે. પણ આ સધળાની પીઠમાં આપણી તર્ક-બુદ્ધિથી પર એવા જ્ઞાનની ચોક્કસ આંખ હોય છે, અનંત શક્તિનું આદું સ્થિત હોય છે.

અગવાનની સામે સમગ્ર શાશ્વતી પડી હોય છે; તે હંમેશાં ઉતાવળ કરતા હોતા નથી. તેમને પોતાના લક્ષ્ય અને વિજય માટે ખાતરી હોય છે, અને પોતાના

કાર્યને પરિપૂર્ણ બનાવવા માટે તેને સેંકડો વાર ભાંગી નાંખવામાં દરકાર કરતા નથી. ધીરજ આપણે પ્રથમ, આવશ્યક બોધપાઠ છે. પણ તે ધીરજ બીકણની, શંકાશીલની, અમિતની, આપસુની, મહત્વકંશા-રહિતની, કાચા-પોચા માનવીની વૃત્તિ નથી હોતી. તે ધીરજ શાન્તિપૂર્ણ અને બળ પ્રામ કરતી ધીરજ હોય છે, જે ઝડપી સોટા પ્રહારોના ઘણના સમય માટે સાવધાનતાપૂર્વક તૈયાર કરતી હોય છે. તે પ્રહારો ભાવિને પદ્ધતી નાંખવા માટે થોડાક પણ પૂરતા હોય છે.

ભગવાન શા માટે પોતાના જગત પર આવા ભીષણ પ્રહારો કરે છે, રોટલીની કણુકના લોટ ચેઠે તેને મસ્તકે છે, ગુંડે છે, અનેકવાર તેને રક્તસનાન કરાવે છે, ભર્તીના નરકમય અભિનમાં ઓગળે છે? કારણુંકે હજુ સુધી માનવજાતિ એક કઠિન, અધમ, કાચી ધાતુ છે. તેને પ્રહારો ન કરે, તે ઓગળી જઈને અમુક નિશ્ચિત આકાર ધારણ કરવા જીમર્ય નથી. જેવી ભગવાનની દ્રવ્ય-સામગ્રી છે, તેવી તેમની કર્મપદ્ધતિ છે. જે માનવજાતિ પોતાની જાતને વધારે ઉદાત્ત અને વિશુદ્ધ ધાતુ બનાવશે તો તેની સાથે કામ કરવાની ભગવાનની પદ્ધતિ વધારે મુલાયમ અને મધુર બનશે. તે ધાતુના ઉપયોગો વધારે ઉચ્ચ અને સુંદર બનશે.

ભગવાન પાસે દ્રવ્ય-સામગ્રી પસંદ કરવાની અનંત શક્યતાઓ હતી; તો પછી તેમણે આવી દ્રવ્ય-સામગ્રી શા માટે પસંદ કરી અથવા તો બનાવી? કારણુંકે તેમના દિવ્ય વિચારે પોતાની સમક્ષ માત્ર સૌનદર્ય, મધુરતા, અને વિશુદ્ધિ જ જોયા ન હતાં, પણ શક્તિ, સંકલપ-બળ અને મહત્ત્વાને પણ જોયા હતાં. શક્તિના કેટલાક પાસાં વરવાં-કદ્યાં છે, તેથી શક્તિનો નિરસ્કાર ન કરીશ; ભગવાન માત્ર પ્રેમ જ છે એમ ન માનીશ; પરિપૂર્ણતામાં વીરના-રાક્ષસના બળ જેવું કોઈક તત્ત્વ પણ હોવું જોઈએ. મોટામાં મેટી મુશ્કેલીમાંથી મોટામાં મોટી શક્તિ જન્મતી હોય છે.

(બોલ્ડ એન્ડ એફેલ્ટિક્સ બોલ્ડ્યુમ ૧૬, પૃષ્ઠ ૩૬૨-૬૩)

આખરે આ સમસ્યા જ્ઞાવીને ખરી થાય છે કે માનવજાતિએ વિશુદ્ધસુવર્ણની સિથતિ પ્રામ કરી છે, તે હજુ તેને લડ્યીમાં નાંખી તપાવવાની જરૂર રહી છે?

એક વાત સ્પષ્ટ છેકે માનવજાતિ હજુ વિશુદ્ધ સુવર્ણ બની નથી. એ હકીકત તો સ્પષ્ટ દેખી શકાય તેવી, બોક્કસ છે.

પણ જગતના ઈતિહાસમાં એવું કાઈક બન્યું છે કે જેથી એવી આશા રાખી શકાય કે માનવજાતિમાંથી કેટલાક બધુ જ થોડા, પસંદ કરાયેલા બોકો વિશુદ્ધ સુવર્ણમાં રૂપાંતરિત થવા માટે તૈપાર થયેલા છે. તેઓ જુદ્ધમ કર્યા વગર બળ પ્રગટ કરી શકે તેમ છે, સંહાર વગર વીરતા બતાવી શકે તેમ છે, સંકટ વગર હિમત બતાવી શકે તેમ છે.

પણ બીજા જ ફક્રામાં શ્રી અરવિદ જવાબ આપે છે કે, “જો માણસ એકવાર આધ્યાત્મિક બનવા માટે સંમતિ આપે.”

માણસમાં રહેલું કશુંક આધ્યાત્મિકતાની માંગ કરી રહ્ય છે, અભીષ્ટા કરી રહ્યું છે; અને તેનામાં રહેલું બીજું બધું તેમ કરવાનો ઇન્કાર કરે છે યોતે છે તેવું જ રહેવા માગે છે. તે એક પ્રકારની મિશા, કાચી ધાતુ છે, જેને બહુમાં નાખવાની જરૂર છે.

અત્યારે, ફરી એકવાર, આપણે પૃથ્વીના ઈતિહાસમાં એક નિર્ણયાત્મક વળાંક પાસે આવીને ઉભા છીએ. ચારેય બાળ્યાદેથી મને પૂછવામાં આવે છે કે હવે શુથ્યો? સર્વત્ર પીડા, અપેક્ષા, લીતિ વ્યાપી રહેલી છે. તે પ્રશ્નનો એક જ જવાબ છે કે, માણસે આધ્યાત્મિક બનવામાં સંમતિ આપવી જોઈએ.

થોડાક માણસો વિશુદ્ધ કુંદન બને એટલું પૂરનું છે, કારણકે તેથી ઘટનાઓનો માર્ગ પછ્યાઈ જશે. આપણી સામે આ જરૂરિયાત ખૂબ ભીરતાપૂર્વક આવીને ખડી થઈ ગઈ છે.

ભગવાન આપણી પાસે જે હિમતની, વીરતાની અપેક્ષા રાખે છે, તેનો ઉપયોગ આપણી પોતાની મુશ્કેલીઓ, અપૂર્ણતાઓ, અંશાન સાથે ઝગડવામાં શા માટે ન કરવો જોઈએ? વીરતાપૂર્વક આંતર વિશુદ્ધિની બહુ શા માટે ન સ્વીકારી લેવી, કે જેથી ફરી વાર તે ભીષણ, રાક્ષસી સંહારમાંથી આપણે પસાર ન થનું પડે, જે સંહાર સમગ્ર સંસ્કૃતિને અંધકારમાં ફૂંગોળી દે છે?

આ સમસ્યા આપણી સામે ખડી છે. દરેક જણે પોતાની રીતે તેનો ઉકેલ લાવવાનો છે.

આજે સાંજરે મને પૂછાયેલા પ્રશ્નોનો જવાબ હું આપી રહી છું. મારો જવાબ કી અરવિદના જેવો જ છે. “જે માણસ આધ્યાત્મિક બનવામાં સંમતિ આપે, તો.....”?

હું ઉમેરીશ કે, માનવ દૃષ્ટિબિદ્ધથી જોતાં, કાલ તેની આગ્રહ-પૂર્વક માંગ કરી રહ્યા છે.

\*

### ૩ અપ્રિલ ૧૯૫૭

જે માણસ એક વાર આધ્યાત્મિક બનવામાં સંમતિ આપે, તો બધું જ પહૃષ્ટાઈ જાય પણ તેની માનસિક, પ્રાણીક, શારીરિક પ્રકૃતિ ઉચ્ચતર નિયમ પ્રત્યે બળવો પોકારતી હોય છે. તે પોતાની અપૂર્ણતાને ચાહે છે.

આત્મા આપણા અસ્તિત્વનું સત્ય છે. મન-પ્રાણ-શરીર તેના અપૂર્ણ બુરખા છે, પણ તેમની પરિપૂર્ણતામાં તે બુરખાઓ આત્માનાં વાધાં બની રહે છે. આધ્યાત્મિક બનવું તે માત્ર પૂરતું નથી. તે ઘણા જીવાત્માઓને સ્વર્ગ માટે તૈયાર બનાવે છે. પણ પૃથ્વીને જ્યાં હતી ત્યાં જ રહેવા હે છે. તેમાં સમાધાન કરવું એ ઉદ્ધારનો માર્ગ ૧ નથી.

જગત ત્રણ પ્રકારની કાનિત જાણે છે. લોતિક કાનિતનાં પરિણામો બળવાન હોય છે. નોતિક અને બીજિક કાનિતઓનો વિષય અનંતગણ્યો વિશાળ હોય છે અને

૧ જે માણસ આધ્યાત્મિક બનવામાં સંમતિ આપે તો બધું જ પહૃષ્ટાઈ જય. પણ તેની માનસિક, પ્રાણીક, શારીરિક પ્રકૃતિ ઉચ્ચતર નિયમ પ્રત્યે બળવો પોકારતી હોય છે. માણસ પોતાની અપૂર્ણતાઓને ચાહુતો હોય છે.

તેનાં ફોં વધારે સમૃદ્ધ હોય છે. પણ આધ્યાત્મિક કાન્નિતઓ મહાન વસ્તુઓનું વાવેતર કરતી હોય છે.

જો આ ત્રણેય કાન્નિતઓ પરિપૂર્ણ સંવાદિતામાં જોડાઈ જાય, તો એક ખૂબ વગરનું કાર્ય નિષ્પત્ત થાય. પણ માનવજાતિનાં મન અને શરીર બળવાન આધ્યાત્મિક આવેગને પરિપૂર્ણ રીતે ધારણ કરી શકતાં હોના નથી, તે બેનું ધ્યાનખરું કાર્ય વેર-વિષેર થઈ જતું હોય છે, દૂધિત બની જતું હોય છે. મહાન આધ્યાત્મિક વાવેતર-માંથી ઘોડુક પરિણામ પ્રાપ્ત કરવા માટે, આપણી બુદ્ધિની તથા શરીરની જમીનને ખૂબ ઉથલાવવી પડે છે, જોદવી પડે છે.

દરેક ધર્મે માનવજાતિને મદદ કરી છે. પ્રાથમિક ધર્મ (પેગનિઝને) માનવમાં સૌન્દર્યના પ્રકાશમાં, જીવનની વિશાળતામાં તથા ઉંચાઈમાં, અનેક પાસાંવાળી પરિપૂર્ણતાના ઉદ્દેશ્યમાં વુદ્ધિ કરી, ખ્રિસ્તી-ધર્મ માનવને દિવ્ય પ્રેમની અને દાનવૃત્તિની કાંઈક જાંખી કરાવી, બૌધ્ધ ધર્મે માનવને વધારે ડાખ્યો, વધારે નભ્ર, વધારે વિશુદ્ધ બત્તવાનો માર્ગ ચીંદ્યો. યહુદી ધર્મે તથા ઈસ્લામે માણસને કર્મમાં ધાર્મિક રીતે પજ્ઞાદાર બનતાં અને ઉત્સાહપૂર્વક ભગવાનમાં ભક્તિ રાખતાં શિખત્યું, હિન્દુ ધર્મ માનવ સમક્ષ વિશાળતમ અને ગણનતમ, આધ્યાત્મિક શક્યતાઓને ખુલ્લી કરી. જો આ બધાં ભગવાનના દર્શનો એક બીજાને આલિંગે અને સમન્વય સિદ્ધ કરે, તો એક મહાન વસ્તુ સિદ્ધ થાય. પણ તેમાં બૌદ્ધિક કટૂર સિદ્ધાંત અને સંપ્રદાયોની અહંતા અવરોધી ઉલ્લા કરે છે.

બધા ધર્મેએ ધારા જીવાત્માઓનો ઉદ્ધાર કર્યો છે. પણ કોઈ ધર્મ હજી સુધી માનવને આધ્યાત્મિક બનાવ્યો નથી. તેમ કરવા માટે, સંપ્રદાય અને અમુક સિદ્ધાંત જરૂરી નથી, પણ આધ્યાત્મિક ઉત્કાન્ત માટે સ્થિર અને સર્વસમન્વયી પ્રયાસની જરૂર છે.

આપણે જગતમાં અત્યારે જે પરિવર્તનો જોઈ રહ્યા છીએ, તે પોતાના આદર્શમાં, ઈરાદામાં બૌદ્ધિક, નૈતિક અને ભૌતિક છે. આધ્યાત્મિક કાન્નિત પોતાના સમયની રાહ જોતી ઉલ્લી છે, તે અમુક જગ્યાઓએ પોતાનાં મોઝાંઓ હુંકતી રહી છે. જ્યાં સુધી આધ્યાત્મિક કાન્નિત નહિ આવે, ત્યાં સુધી બીજી કાન્નિતઓનો મર્મ નહિ સમજાય. આધુનિક ધટનાઓની સમજૂતિઓ અને માનવના ભાવિ વિષેની આગાહીઓ

બન્ધુવસ્તુઓ બની રહેયે જરણ કે આધ્યાત્મિક કાન્તિનો સ્વભાવ તેની શક્તિ, તેની ઘટના આપણી માનવ-જીવના હવે પછીના યુગનું નિર્માણ કરશે.

(થાએસ એન્ડ એફેરિઝન્સ, શતાખ્ચી અંથ ૧૬, પૃષ્ઠ ૨૬૩-૬૪)

માતાજી, અહીં શ્રી અરવિદ લખે છે કે “જો આ બધાં ભગવાન સંબંધી દર્શિનો એક બીજાને આવિશે, એકબીજા સાથે સમન્વય સાધી તો એક મહાન વસ્તુ સિદ્ધ થાય, પણ બૌધિક કટૂર સિદ્ધાંત અને સંપ્રદાયની અહેતુ તેમાં અવસેધી ઉલા કરે છે.”

આ બધાં અભિપ્રાયોનો એકબીજા સાથે સમન્વય કેવી રીતે સાધવો?

માનસિક ચેતનામાં આ વસ્તુઓની સંવાદિતા-સમન્વય સાધી શકાય નહિ. એમ કરવા માટે, મનથી પર જવાની, અભિપ્રાયની પીડમાં રહેલા વિચારને શોધી કાઢવાની જરૂર છે. દા. ત. આ ફક્રમાં શ્રી અરવિદે માનવ પ્રયત્નમાં, દરેક ધર્મ શેનું પ્રતિનિધિત્વ કરે છે તે બતાવી આપ્યું છે. અલ્લીપ્લામાં અને સાક્ષાત્કારમાં આ ધર્મોનાં બાધ્ય રૂપો તો માત્ર કટૂર સિદ્ધાંતો અને બૌધિક જ્યાદો છે. તેમનો બાધ્યાર્થ વેવાને બદલે, જો આપણે તેમના અંતર ભાવને, તત્ત્વને સ્વીકારીએ, તો તેમજે સમન્વય સાધવામાં કોઈ તકલીફ ન પડે. તે ધર્મો માનવ પ્રગતિની બિનાબિન બાળ્યો છે, તેઓ પરિપૂર્ણ રીતે એકબીજાની પૂર્ણ કરે છે; વધારે પરિપૂર્ણ અને સમગ્ર પ્રગતિ સાધવા માટે, જીવનની વધારે પરિપૂર્ણ સમજ પ્રાપ્ત કરવા માટે, ભગવાન પ્રયે વધારે સમન્વયી અભિગમ પ્રાપ્ત કરવા માટે, આ બધાં ધર્મોને બીજી ધર્યો બાળ્યો સાથે સમન્વિત કરવા જોઈએ. આ સમન્વય વસ્તુઓની પીડમાં રહેલા આત્મા પ્રત્યે પાછા વળવાની માંગ કરે છે. અને છન્હાં તેટલું જ પૂરતું નથી. તેમાં ભાવિનું દર્શન, માનવ જીવિ જેના પ્રત્યે આગેકૂચ કરી રહી છે તે લક્ષ્ય, જગતનો ભાવિ સાક્ષાત્કાર, શ્રી અરવિદ જેને વિષે વાત કરે છે તે આધ્યાત્મિક કાન્તિ કે જે નવીન યુગનું નિર્માણ કરશે, અતિ મનસું કાન્તિ, આ બધાં ઉમેરાવાં જોઈએ.

અતિ મનસું ચેતનામાં આ બધી વસ્તુઓ વિરોધી અથવા એકલવાઈ રહેતી નથી. તે પરસ્પર પૂરક બની જાય છે. માત્ર માનસિક રૂપ જ જેદો પાણું જાય છે.

આ માનસિક રૂપ જેનું પ્રતિનિધિત્વ કરે છે, તેને બીજાં માનસિક રૂપો જેનું પ્રતિનિધિત્વ કરે છે તેની સાથે એકરૂપ બનાવવું જોઈએ, જેથી એક સંવાદમય સમગ્રતા રચાય. ધર્મ અને સાચી આધ્યાત્મિકતા વચ્ચે આ જ મહત્વનો તફાવત છે.

ધર્મ માત્ર તેનાં રૂપોમાં, કટૂર સિદ્ધાતોમાં, વિચારોમાં અમુક નિશ્ચિત જોખામાં રહેણો હોય છે, અને તે માત્ર યોગીક અપવાદરૂપ વ્યક્તિત્વોની આધ્યાત્મિકતા દ્વારા જ મહાન બનણો હોય છે. જ્યારે સાચું આધ્યાત્મિક જીવન અને સૌથી વધારે તે અતિ માનસનો સાક્ષાત્કાર દરેક નિશ્ચિત બૌધ્ધિક રૂપથી, જીવનના દરેક ભર્યાદિત રૂપથી સ્વતંત્ર હોય છે, સર્વ શક્યતાઓને અને આવિભાવિને આલિગન આપતો હોય છે, અને તે તેમને વધારે ઉચ્ચ અને વૈશ્વિક સત્યની અભિવ્યક્તિનું વાહન બનાવતો હોય છે.

નવીન ધર્મ માત્ર નિરૂપયોગી જ નહિ, પણ નુકસાનકારક પણ બને. નવીન જીવનનું સર્જન કરવાનું છે. નવીન ચેતનાની અભિવ્યક્તિ કરવાની છે. આ બૌધ્ધિક મર્યાદાઓથી તથા માનસિક ફેરફાર્યાથી પર છે. જીવંત સત્ય પ્રગટ થવું જોઈએ.

આ સાક્ષાત્કારમાં દરેક વસ્તુના સારનો અને તેના સત્યનો સમાવેશ થવો જોઈએ. આ સાક્ષાત્કાર દિવ્ય વાસ્તવિકતાનો થવો જોઈએ; તે બને તેટબો સમગ્ર, સંપૂર્ણ અને વૈશ્વિક હોવો જોઈએ. માત્ર તે જ જગતને અને માનવજાતને બચાવી શકે. શ્રી અરવિદ તે મહાન આધ્યાત્મિક કાંતિના વાત કરે છે. આપણે તેનો સક્ષાત્કાર કરીએ. એમ તે ઈચ્છતા હતા.

આપણે આવતા બુધવારથી ‘અતિ-મનસનો આવિભાવ’ નામનું પુસ્તક વાંચવાના છીએ. તેમાં તેમણે તે સાક્ષાત્કારની વિશાળ રૂપરેખા આપી છે.

મેં આજે જે પ્રથમ વાક્ય વાંચ્યું, તે માત્ર વ્યક્તિગત નહિ, પણ સામૂહિક સમસ્યાના ઉકેલની ચાવી છે. વાક્ય આ રહ્યું છે:

“જો માણુસ એક વાર આધ્યાત્મિક બનવામાં સંમતિ આપે, તો બધું” જ પહ્લાઈ જાય. પણ તેની માનસિક, પ્રાણીક અને શારીરિક પ્રકૃતિ ઉચ્ચતર નિયમ સામે બળવો પોકારતી હોય છે. માણુસ પોતાની અપૂર્ણતાઓ સાથે પ્રેમ કરતો હોય છે.’

હું ઈચ્છા છું કે આપણે આ વાક્યને આપણા ધ્યાનનો વિષય બનાવીએ.

(ધ્યાન)

\*

## ૧૦ એપ્રિલ ૧૯૫૭

“આ પ્રવૃત્તિઓનું” (રમત-ગમતો વગેરેનું) એક મૂલ્યવાન પરિલામ એ આવે છે કે તેમનાથી આપણી જેવાટીની ભાવનામાં વૃદ્ધિ થાય છે. તેમાં મજાક-મશકથીનો, સહિષ્ણુતાનો, બધા લોકોના અભિપ્રાયોને ગણુતરીમાં બેવાનો, પ્રતિસ્પદીઓ પ્રયોગ સાચા વલાણો અને મૈત્રીભાવનો, આત્મસંયમનો અને રમતના નિયમોના જીસુપટપૂર્વક પાવનોનો, ન્યાયપૂર્વક રમત રમવાનો, અન્યાયી સાધનોનો ઉપયોગ ન કરવાનો, સમતુલ્ય ગુમાવ્યા સિવાય, ગુસ્સો કર્યા સિવાય છતને તથા હારને સ્વીકારી બેવાનો, નીમાયેલા નિર્ણયિકના નિર્ણયોનો વફાદારીપૂર્વક સ્વીકાર કરવાનો સમાવેશ થાય છે. આ સદ્ગુણો માત્ર રમતગમતમાં જ નહિ, પણ સામાન્ય છુફનમાં પણ મૂલ્યવાન છે. તે ગુણોના વિકાસમાં રમતગમત જે મદદ આપે છે, તે સીધીસટ અને અમૂલ્ય હોય છે. જો તે ગુણોને માત્ર વ્યક્તિના જ નહિ, પણ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય છુફનમાં (કે જેમાં અત્યારે તે ગુણોથી વિરુદ્ધના દોષોની બોલભાલા છે.) અપનાવી શકાય તો આપણું વિકિસ અસ્તિત્વ વધારેમાં વધારે સરળ બને, તેમાં વધારે સંવાદિતા અને સવાહ- સંપુર્ણ સ્થપાય, જેની અત્યારે ખૂબ જરૂર છે. શરીરની કેળવણી વિના, મનની ઉચ્ચતમ અને સંપૂર્ણતમ કેળવણી બસ નથી. જે રાષ્ટ્ર આ સદ્ગુણોને પરિપૂર્ણ માત્રામાં પ્રાપ્ત કરશે, તે સંભવત: વિજય, સફળતા અને મહત્ત્વ માટે સૌથી વધારે બળવાન બનશે. તે રાષ્ટ્ર જગતમાં એકતા અને

સંવાદિતા લાવવામાં ખૂબ માટે ફાળો આપી શક્યો, કે જેની તરફ માનવ અતિના ભાવ માટે આપણે આશાની મીટ માંડી રહ્યા છીએ.”

(“અતિ-મનસુનો આવિષ્કાર”, પૃષ્ઠ ૨-૪ ૧)

વહાલાં માતાજી, આપણી ટુન્મેન્ટોમાં ઘણાં બાળકો ખરાબ ભાવનાથી રમતા હોય છે. જીતગા માટે તેઓ બીજાઓને ઈજ કરવા પ્રયત્ન કરતો હોય છે. બાળકો પણ તેમનું અનુકરણ કરવા માંડતા હોય છે. આને કેવી રીતે અટકાવી શકાય ?

અજ્ઞાન અને ખરાબ દૃષ્ટાંત બાળકોની બાબતમાં નુકસાનકારક બનતાં હોય છે. એટલે રમતગમત શરૂ થાય ત્યાર પહેલાં, જો સમુહનાથકો, કેઢણો પોતાણી દીમના બધા ખેલાડીઓને બોલાવીને શ્રી અરવિંદ અહીં જે વાત કહી છે તે સમજવે, અમે ‘ખેલદિલની નિયમાવળી’ અને ‘આદર્શ બાળક’ (અથવા ‘બાળક હમેશાં યાદ રાખવા જેવી વસ્તુઓ’) નામનાં કે પુસ્તકોમાં વિસ્તારપૂર્વક સમજવું છે, તે સમજવો તો રૂંડાં પરિણામ આવે. આ વસ્તુઓ બાળક સમજ વારંવાર કહેવાવી જોઈએ. મેં પહેલાંના વર્ગમાં કહું હતું તેમ, તમારે બાળકોને ખરાબ સોબત પ્રત્યે, ખરાબ મિત્રોથી સાવધાન રહેવા કહેવું જોઈએ.

સૌથી મોટી વાત તો એ છે કે, તમે બાળકો સમજ સાચું દૃષ્ટાંત પૂરું પાડો. તમે બાળકોને જેવા જનવાનું કહો છો, તેવા પ્રથમ તમે જાતે બનો. તમે નિઃસ્વાર્થ-તાના, ધીરજના, આત્મસંયમના, સતત ખુશમિજાજવા, પોતાના નાનકડા અંગત અશુગમાઓ પર જીત મેળવવાનાં, અતત શુલેચ્છાના, બીજાઓની મુશ્કેલીઓ સમજ-વાના, મગજની સમતુલ્યા કે જે બાળકોને ભગ્નમુક્ત કરે છે, ઝારણકે શિક્ષા થવાના ભયથી બાળકો છેનરપિંડી કરનારાં, જુદ્ધું બોલનારાં, અને લુચ્ચા બનતાં હોય છે, દૃષ્ટાંતરૂપ બનો. જે તેમનામાં સલામતિની ખાતરી જતમણે, તો બાળકો કશી વસ્તુ સાંતારણે નહિ, અને તમે તેમને વફાદાર અને પ્રામાણિક બનવામાં મદદ કરી શકશો. સારું દૃષ્ટાંત એ બધી વસ્તુઓ કરતાં વધારે મહત્વનું છે. શ્રી અરવિંદ તેની,

૧ ૧૯૪૮ ના લિસેઅરની ૩૦ મી તારીખનો આ સંદેશ આશ્રમના (૧૯૪૮ ફેબ્રુઆરીના) “શારીરિક ડેળવણીના ખુલેદીન” ના પ્રથમ અંકમાં પહેલી વાર આપવામાં આવ્યો હતો. તે પૃથ્વી પર અતિ-મનસુના આવિષ્કારની પ્રસ્તાવના છે. તે પુસ્તકમાં આડ કેણા છે; જે શ્રી અરવિંદ મૂળ ખુલેદીન માટે લાગ્યા હતા.

અપરિવર્તનશીલ ખુશમિજાળની કે જે સર્વ સંભિગેતમાં કાયમ રહેવો જોઈએ તેની, આત્મવિસમૃતિની, પોતાની નાનકડી મુશ્કેલી બીજાઓને માથે ન ઢોળી દેવાની, થાક લાગે અથવા કંટાળી જવાય ત્યારે પણ ધીરજ ન જોઈ દેવાની, બીજાઓને નાખુશ કરે તેવી રીતે ન વર્તવાની વાત કરે છે. આ બધું એક એવી પરિપૂર્ણતા, આત્મ-સંયમ માર્ગી બે છે, કે જે સાક્ષાત્કારના માર્ગમાં મહાન આગેકૂચ છે. જે માણસ એક નાનકડા સમૂહનો પણ સાચો નેતા બનવાની શરતો પૂરી કરે, તો તેણે યોગ-સિદ્ધિમાં જરૂરી એવી શિસ્તમાં ખૂબ પ્રગતિ કરી ગણ્યાય.

આ આત્મસવામિત્વના, સંયમના, સહિષ્ણુતાના (જે તમારી અંગત સ્થિતિને તમારા સમૂહકાર્ય પર પ્રતિકાર્ય નહિ કરવા એ) દખિકોલાથી સમસ્યાને નિહાજવાની જરૂર છે. પોતાની જતને લુલી જવી, સ્વાર્થ ન હોવો, પોતાને માટે કોઈ પણ વસ્તુની ઈચ્છા ન કરવી, માત્ર સમૂહના, સમગ્રના જ કલ્યાણની ગણુના કરવી (જે કલ્યાણનો આધાર પોતાના પર છે), પોતાના કાર્યમાંથી કોઈ અંગત લાભની ઈચ્છા ન રાખવી, મનમાં તે જ લક્ષ્ય રાખીને કાર્ય કરવું. આ ગુણો સાચો નેતામાં ખૂબ જરૂરી છે.

આ રીતે એક નાનકડા સમૂહનો નેતા મોટા સમૂહનો, રાષ્ટ્રનો પરિપૂર્ણ નેતા બની શકે છે, અને સામૂહિક ભાગ ભજવવા માટે પોતાની જતને તૈયાર કરી શકે છે, તે બધું મહત્વની તાલીમ ભૂમિ છે. અહીં અમે તે જ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને કરવાનું ચાલુ રાખીશું. અમે દરેક જાણને, જેમ બને તેમ જલ્દી, નાનીમે ટી જવાબદારી સોંપવા માગીએ છીએ, જેથી તે સાચો નેતા બની શકે.

સાચો નેતા બનવા માટે, માણસે તદ્દન નિઃસ્વાધીં બનવું જોઈએ, તેણે યથાશક્ય સર્વ અભિમાનને અને સ્વાર્થમય ગતિઓને તિલાંજલિ આપવી જોઈએ. નેતા બનવા માટે, માણસે અહેત્તા પર વિજય મેળવવો જોઈએ. યોગ કરવા માટે અહેત્તા પર વિજય એ પ્રથમનું, અનિવાર્ય પગલું છે. તે રમતગમતને ભગવાનના સાક્ષાત્કારમાં એક બળવાન મદદ રૂપ બળાવી શકે છે.

ઘણા થોડા બોકો આ વાત સમજે છે. મોટે ભાગે જે બોકો રમતગમતની આ બાધ્ય શિસ્તનો, ભૌતિક સાક્ષાત્કાર પર એકાગ્રતાનો વિરોધ કરે છે, તેમનામાં શારીરિક અસ્તિત્વ પર કાબૂનો તદ્દન અભાવ હોય છે. ક્રી અરવિંદના પૂર્ણયોગના

સાક્ષાત્કાર કરવા માટે, શરીર પરનો કાબૂ એ પ્રથમનું અનિવાર્ય પગલું છે, જે બોકો શારીરિક કિયાઓનો તિરસ્કાર કરે છે, તેઓ પૂર્ણ યોગના સાચા ભાગી પર એક ડગલું પણ ભરવા શક્તિમાન હોતા નથી. શરીરના બધા દ્વોમાં શરીર પરનો કાબૂ એ અનિવાર્ય પાયો છે. તમારા પર કાબૂ ધરાવતું શરીર તમારો શત્રુ છે, તે ગેરવ્યવસ્થાને તમે ન સ્વીકારી શકો, મનમાં રહેલા, પ્રકાશમય સંકલ્પ અને શરીરનું નિયમન કરવું જોઈએ; શરીરે મન પર પોતાનો કાયદો ન વાદવો જોઈએ. જ્યારે માલુસ જાણે કે, અમુક વસ્તુ ખરાબ છે, ત્યારે તે ન કરવાનું સામર્થ્ય તેનામાં હોવું જોઈએ. જ્યારે માલુસ અમુક વસ્તુ સિદ્ધ કરવા માગો, ત્યારે તેનામાં તે કાર્ય કરવાનું સામર્થ્ય હોવું જોઈએ; શરીરની અશક્તિથી અથવા શરીરની અનિશ્ચાથી અથવા શરીરના અસહકારથી તેણે ડગલે ને પગલે વચ્ચે અટકી ન પડવું જોઈએ. તે માટે માલુસે શારીરિક શિસ્તનું અનુસરણ કરવું જોઈએ અને પોતાના ધરમાં પોતે સ્વામી બનવું જોઈએ.

ધ્યાનમાં છટકી જવું, અને કહેવાતી ભવ્યતાની ઊંચાઈ પરથી ભૌતિક વસ્તુઓનો તિરસ્કાર કરવો એ બહુ સુંદર વસ્તુ છે; પણ જે માલુસ પોતાના ધરમાં સ્વામી નથી, તે ગુલામ છે.

( મૌન )

હવે કોઈને કાંઈ પૂછવાનું નથી?

માતાજી, શારીરિક કિયાઓમાં એક સમસ્યા ઉભી થાય છે; અને તે એ કે અમુક એક રમતમાં અથવા કિયામાં પરિપૂર્ણ બનવા માટે માલુસે માત્ર તે જ રમત અથવા કિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે.

તે તદ્દન જોટી વાત છે. બુલેટિનના પ્રથમ અંકમાં જ મેં આ વાત વિસ્તાર-પૂર્વક સમજવી છે.<sup>૧</sup> તે તદ્દન જોટી વાત છે. જેણે પોતાની જત પર કાબૂ મેળવ્યો છે અને એકાગ્રતાની શક્તિ વિકસાવી છે, તે આ એકાગ્રતાની શક્તિને તદ્દન લિન વસ્તુઓ પ્રત્યે પણ લાગુ કરી શકે. કેટલીક વાર તો વિશુદ્ધ વસ્તુઓ પ્રત્યે પણ. તે, એક વસ્તુ બીજી વસ્તુમાં ખેલ ન પહોંચાડે તે રીતે, તે બધી વસ્તુઓ કરવા સમર્થ બને. એમ થણું જોઈએ.

<sup>૧</sup> ‘એકાગ્રતા અને બ્યાગ્રતા’, ભુલેટિન, ૧૯૪૬

તેમાં સમયના પ્રશ્નની ગણુતરી કરવાની રહે છે. પણ તે પ્રશ્નનો ઉકેલ બે વસ્તુઓ વડે લાવી શકાય. પોતાના જીવનના પ્રકાશમય અને વધુ વિસ્તરતા સંગઠન દ્વારા, અને નકામી કિયાઓમાં સમયનો બગાડ ન કરવા વડે. જે આ બે વસ્તુઓ અહૃત્ય થઈ જાય, તો તે દરેકને ચાટે આશીર્વાદ રૂપ નીવડે. પ્રશ્ન તો બબડાટ, મિત્રો-સહકાર્ય કરો સાથે નકામી વાતો બંધ કરી દેવાં જોઈએ. માલુસ રાતોમાં ખૂબ સમય બગાડતો હોય છે! જ્યાં એક શબ્દથી કામ સરે એમ હોય છે, ત્યાં તે પચાસ શબ્દો બોલતો હોય છે તે માત્ર સમયનો જ બગાડ નથી? જ્યારે માલુસને સમયનો અભાવ હોય છે, ત્યારે એમ સમજવું કે તેને પોતાના જીવનને સંગઠિત કરનાં આવડતું નથી. અલબજન, કેટલાક વોકો ધણી ધણી વસ્તુઓ કરતા હોય છે; પણ તે પણ જીવનમાં સંગઠનનો અભાવ બતાવે છે.

સાચા સંગઠનમાં દરેક વસ્તુને, તેની જરૂરિયાતની માત્રા અનુસાર સ્થાન મળતું હોય છે. તમે જીણો છો કે દસપંદર મિનિટની સુસમનિવત કસરતથી તમે તમારા શરીરને જરૂરી તાલીમ આપી શકો છો. અહીં તમને તે વાત શિખવવામાં આવી છે, અને તમારી સમક્ષ તે સાબિત કરી આપવામાં આવી છે. શરીરની સમતુલ્ય માટે આ પૂરતું છે. સ્વાભાવિક રીતે જ, રમતગમતો તમારામાં બીજા ગુણો પણ લાવી આપે છે; પણ તમે રોજ એક કલાકથી વધારે રમતા હોતા નથી; અને એક કલાક એ કાંઈ બહુ સમય તો ન જ કહેવાય.

તે માત્ર બહાનું છે! તમારા જીવનને સંગઠિત કરો, અને તમને માલૂમ પડ્યો કે તમે દરેક વસ્તુને અવકાશ આપી શકોયો, સરા વિધાર્થી બનવાને પણ.

## ૧૭ એપ્રિલ ૧૯૫૭

“આધ્યાત્મિક, ચૌત્ય, માનસિક અને પ્રાણિક સંસ્કૃતિનું સાચું લક્ષ્ય પરિપૂર્ણતા છે, અને શારીરિક સંસ્કૃતિનું પણ તે જ લક્ષ્ય હોવું જોઈએ. જો આપણાં અસ્તિત્વની, સમગ્ર પરિપૂર્ણતાની ઓળજ કરતા હોઈએ, તો તેના શારીરિક ભાગની આપણે ઉપેક્ષા ન કરી શકીએ, કારણે શરીર એ ભૌતિક પાયો છે, આપણે વાપરવાનું કરશું છે. એક પ્રાચીન સંસ્કૃત સુભાષિત કહે છે કે “શરીરમાદ્ય ખલુ ધર્મસાધનમ્ય.” શરીર સાચે જ ધર્મની પરિપૂર્ણતાનું સાધન છે. ધર્મ એટલે આપણું જાતની સમક્ષ આપણે જે આદર્શ રાખીએ તે, તેને સિદ્ધ કરવાનો નિયમ, તેનું કાર્ય. અને આપણું સમક્ષ આપણે સમગ્ર પરિપૂર્ણતાનું લક્ષ્ય રાખીએ છીએ, કારણે આપણો આદર્શ અહીં દિવ્ય જીવનનું સર્જન કરવાનો છે, પૃથ્વી પર આત્મિક જીવનની પરિપૂર્ણ કરવાની છે, ભૌતિક વિશ્વની પરિસ્થિતિઓમાં, અહીં પૃથ્વી પર પણ, જીવને પોતાનું આધ્યાત્મિક રૂપાંતર ન થાય, શરીર વડે થતું કર્મ પરમ શક્તિને પ્રાપ્ત ન થાય, અને શરીર જે પરિપૂર્ણતા પ્રાપ્ત કરી શકે તેમ છે તે સિદ્ધ ન થાય, ત્યાં સુધી તે લક્ષ્યની સ્થિર થક્ય નથો.”

(‘અતિમનસ્રૂતો આવિલ્લાવ’ પૃષ્ઠ ૫)

માતાજી, શરીરનું કાર્ય કેવી રીતે પરમ શક્તિને પ્રાપ્ત કરી શકે?

રૂપાંતર દ્વારા જ. એ સંપૂર્ણ રૂપાંતર હોવું જોઈએ. શ્રી અરવિંદ પઢીથી તેને વિશે કથન કરે છે.

અત્યારે તો આપણું શરીર પણ ના શરીર કરતાં હોડું જ વિકાસ પામ્યું છે અને તે પણ થંકાસ્પદ છે. કારણે અમુક દૃષ્ટિબિદ્ધથી આપણે કંઈક વધારે પ્રાપ્ત કર્યું છે, તો બીજા દૃષ્ટિબિદ્ધથી આપણે ગુમાવ્યું પણ છે. એ વાત ચોક્કસ છે કે શારીરિક શક્તિની દૃષ્ટિએ જોતાં, પણઓ આપણાં કરતાં વધારે શક્તિશાળી છે. જો આપણે ખાસ સંસ્કૃતિ અને રૂપાંતર દ્વારા, આપણું શક્તિઓનું રૂપાંતર કરવામાં સફળ ન બનીએ, તો આપણે કહી શકીએ કે બળની તથા સનાયુઓની શક્તિના દૃષ્ટિબિદ્ધથી જોતાં, વાધ અને સિદ્ધ આપણા કરતાં ચંદ્રિયાતા છે. ચપળતાની દૃષ્ટિ જોતાં, વાંદરો આપણાથી ચંદ્રિયાતો છે. પંખી બાત યંત્ર કે અનોખેઈનની મદદ

સિવાય આકાશમાં ઊરી શકે છે, આપણે નહિ, વગેરે. કિયા કરતાં આપણા અંગોની પશુજરૂરિયાંતો વડે આપણે જકડાપેલા છીએ, દા. ત. આપણે અજ્ઞ પર, અસંસ્કૃત રૂપમાં બેવાતા ભૂતપદાર્થ પર આધાર રાખવો પડે છે. ત્યાં સુધી આપણે નિમ્ન કોટિના પ્રાણીઓ છીએ.

હું જે વાચવાની છું તેની વાત આગળથી નહિ કહું. પણ આપણા શરીરના પશુ સમાન કર્ય માટે, પશુજીવન સમાન જ આ બધા ભાગો માટે, આપણે તુધિરનાં અભિસરણ ઉપર, તુધિર મેળવવા માટે લોજન ઉપર આધાર રાખવો પડે છે. આ ભયંકર બંધનો, મર્યાદાઓ છે! જ્યાં સુધી ભૌતિક જીવનને તેના પર આધાર રાખવો પડે છે, ત્યાં સુધી આપણે આપણા જીવનનું દિવ્યીકરણ નહિ કરી શકીએ.

એટબે આપણે માનવું પડશે કે, માનવ પ્રાણીમાં રહેલી પશુતાને સ્થાને જીવનનું કોઈ બીજું ઉદ્ગમસ્થાન સ્થપાનું જોઈએ. આ આપણે આંશિક રીતે સિદ્ધ કરી શકીએ તેમ છીએ. જો આપણે ભૂતપદાર્થનું રૂપાંતર કરવું હોય, અને તેને દિવ્ય ગુણોની અભિવ્યક્તિ કરવા માટે સમર્વ બનાવવું હોય, તો આપણે તે લક્ષ્યને આપણી નજર સામે રાખવું પડશે.

એક ખૂબ પ્રાચીન પરંપરા હતી, જે વૈદિક અને કેદિયાની પરંપરાનું ઉદ્ગમસ્થાન હતી. તે પરંપરામાં એક તેજેમય દેહ વિષે કથન કરવામાં આવ્ય છે, જેનું ગદ્દનતર ચેતના વડે હર કષે રૂપાંતર થઈ શકતું હતું. તે એટલું બધું મુલાયમ હતું; ને તે ચેતનાને અભિવ્યક્ત કરી શકતું હતું, તેમાં રૂપની નિશ્ચિતતા ન હતી. સ્વેચ્છાપૂર્વક તે દેહનું ભૂત તત્ત્વ તેજેમય બની શકતું. તેનામાં લઘુતાની સિદ્ધ આવી શકતી, જેના વડે તે માણસ માત્ર સંકલ્પણ વડે જ આકાશગમન કરી શકતો; તે માત્ર આંતર શરીરતના સંયમની અમુક પ્રક્રિયાઓનો જ ઉપયોગ કરતો. આ બાબતમાં ધાર્યાં ધાર્યાં કહેવાનું છે.

આ પૃથ્વી ઉપર આ બધી વસ્તુઓનો સાથાત્કાર કરેલા માણસો હતા કે તેમ તે હું જાણતી નથી. પણ તેમાંની એક યા તો બીજી વસ્તુના આંશિક દૃષ્ટાંતો ઉપલબ્ધ થયેલાં છે, જે તે સિદ્ધાંતોની શક્યતા બતાવી આપે છે. આ વિચારને આગળ ધરાવીએ, તો આપણે એવો જ્યાલ પણ બાંધી શકીએ કે ભૌતિક અંગોને

અને તેમની કિયાને સ્થાને શક્તિની એકાગ્રતાનાં કેન્દ્રો સ્થાપી શકાય તેમ છે. તે કેન્દ્રો ઉચ્ચતર શક્તિઓ પ્રત્યે ખુલ્બાં હશે, અને એક પ્રકારની રસાયણ વિદ્યા વડે જીવનની તથા શરીરની જરૂરિયાનો માટે તે શક્તિઓનો ઉપયોગ કરતા હશે. યોગાભ્યાસ કરતાર બોકો શરીરમાં રહેલાં છ ચોકો વિષે જાણતા હોય છે. પણ આ ચોકોને સ્થાને, ઉચ્ચતર શક્તિની અને ભૂત પદાર્થ પર છોડાયેલાં આકંપનોની સીધી કિયા દ્વારા બિન્ન બિન્ન પ્રકારનાં, પરિપૂર્ણ અંગો સ્થાપી શકાય. જે બોકોએ, તેના સમગ્ર રૂપમાં, રહેસ્યવિદ્યાનો સારી રીતે અભ્યાસ કર્યો છે, તેઓ સૂક્ષ્મ શક્તિઓને ભૌતિક રૂપ આપવાની પ્રક્રિયા જાણતા હોય છે, અને તે ભૌતિક રૂપને તેઓ ભૌતિક આકંપનો સાથે સંપર્કમાં મૂકી શકતા હોય છે. આ વસ્તુ કરી શકાય છે એટલું જ નહિ, પણ તે કરાય છે જ. તે એક વિજ્ઞાન છે, જેને પરિપૂર્ણ બનાવવાનું છે તે વિજ્ઞાનનો ઉપયોગ નવાં શરીરોનું સર્જન કરીને તેમને કિયાશીલ બનાવવામાં થવો જોઈએ, તે નવાં શરીરો ભૌનિક જગતમાં અનિમાનસિક જીવનને પ્રગટ કરવા સમર્થ થશે.

પણ શ્રી અરવિંદ કહે છે તેમ, તે વસ્તુ સિલ્ફ થાય ત્યાર પહેલાં, આપણી પાસે જે છે તેનો સરસ ઉપયોગ કરી દેવો જોઈએ, જેથી શારીરિક કિયાઓ પર વૃદ્ધાં ચોક્કાં કાળ્ય સ્થાપી શકાય. એ વાત સ્પષ્ટ છે કે જે બોકો વૈજ્ઞાનિક રીતે અને સમન્વયપૂર્વક શારીરિક વ્યાયામ કરે છે, તેઓ પોતાના શરીર પર, બીજા બોકો કલ્પી ન શકે દેવો, કાળ્ય પ્રાપ્ત કરે છે. જ્યારે રશિયાના કસરતબાળે અહો આવ્યા હતા, ત્યારે આપણે જોયું હતું કે તેઓ કેટલી સરળતાપૂર્વક કસરતના જેબો કરતા હતા; સામાન્ય બોકો તો તે કરી જ ન શકે; તેઓ તે કસરતના પ્રયોગો એવી રીતે કરતા હતા કે જાણે તે તદ્દન સરળ વસ્તુ હોય, જાણે તે કરવામાં તેમને જરાયણ પ્રયત્ન ન કરવો પડતો હોય! શરીર પરનું તે પ્રભુત્વ શરીરના રૂપાંતરની દિશામાં એક મહાન પગલું છે. આ કસરતબાળે ધંધાની દૃષ્ટિએ ભૌતિકપાદીઓ હતા, પોતાની વ્યાયામ-શિક્ષામાં તેઓ આધ્યાત્મિક પદ્ધતિનો ઉપયોગ કરતા ન હતા. તેમણે માત્ર ભૌનિક સાધનો વડે અને માનવ-સંકલ્પ બળના પ્રકાશમય ઉપયોગ વડે આ પરિણામો પ્રાપ્ત કર્યો હતાં. જો તેમણે તેમાં આધ્યાત્મિક જ્ઞાનને અને શક્તિને ઉમેર્યા હોત, તો તેમણે ચમત્કારિક પરિણામો પ્રાપ્ત કર્યા હોત. જગતમાં જોટા ખ્યાલો પ્રયત્નિત છે, તેથી આપણે આધ્યાત્મિક પ્રભુત્વને અને ભૌતિક પ્રભુત્વને સાંકળી શકતા નથી. તેથી બીજા જિવાય એક ચીજ અધૂરી રહી જાય છે. પણ આપણે એ જ વસ્તુ કરવા માગીએ છીએ. શ્રી અરવિંદ તે જ વસ્તુ સમજવે છે. જો એ જે વસ્તુઓને એકત્રિત કરવામાં આવે, તો એવી પરિપૂર્ણતા સધાય કે જેની

કવપના મનુષ્યનું સામાન્ય મન ન કરી શકે આપણે એ જ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

ક્રી અરવિંદ આજણ કહે છે (જે આપણે આવતી વખતે વાંચીશું) કે પ્રથમ તો માણસે મૂર્ખાઈભરેલાં પૂર્વગ્રહેના બીજાંનું સભૂહ સાથે જઘડણું પડ્યો, જે પૂર્વગ્રહેલાં ભૌતિક અને આધ્યાત્મિક જીવન વચ્ચે કંડક વિરોધ પેદા કરે છે. તેણે માનવ ચેતનામાં એવી તો ઉંડી જડ ધાલી છે, કે જે લોકો એમ માને છે કે અમે ક્રી અરવિંદની શિક્ષાને સમજ્યા છીએ, તેઓ પણ તે જડને ઉંડેડી નાંખી શકે તેમ નથી! જ્યારે બીજાં કારણોસર મેં ધ્યાનોની થરુભાત કરી, ત્યારે કેટલાક લોકો કહેતા હતા કે છેનટે આપણે આધ્યાત્મિક જીવન તરફ પાછા જઈએ છીએ. તેથી લાંબા સમય સુધી મેં ધ્યાનના વર્ગી વેવાનું બંધ કર્યું હતું. આ મૂર્ખાઈને ઉત્તેજન આપવા મેં તેમ કર્યું ન હતું, પણ તેમાં બીજાં કારણો હતાં. જ્યાં સુધી મૂર્ખાઈને માનવ ચેતનામાંથી ઉંડેડી નાંખવામાં નહિં આવે, ત્યાં સુધી અતિમાનસિક શક્તિન આ અજ્ઞાની મનની અસ્પષ્ટતામાં અફતરણ નહિં કરી શકે. તેમ છતાં પણ આપણે જરૂર સફળ થવાનાં છીએ.

મેં આ ‘અતિમનસનો આવિભાવ’ પુસ્તક એટલા માટે પસંદ કર્યું હતું કે જેથી હું ‘વ્યૂહાત્મક રૂપમાં અભિવ્યક્ત કરાયેલા સત્ય સાથે સંપર્કમાં મુક્વાની તક મેળવી શકું’, જેથી તમે આ આધ્યાત્મિક અને ભૌતિક વચ્ચેના વિરોધ સામે જધ્વા શકો, કારણે તે વિરોધ એક સનાતન સત્ય વિષે સંપૂર્ણ જેરસમજ છે.

જ્યારે તે પુસ્તક હું પૂરું વાંચી લઈશ, ત્યારે મેં ફરી ધ્યાન કેમ થરુ કર્યું તે બાબત હું તમને કહી શકીશ, અલગતા, “ફરી પાછા આધ્યાત્મિક જીવન પ્રત્યે આપવાં” માટે તો નહિં જ !

તે વિરોધનો જ્યાલ ખૂબ જ જડ ધાલીને બેઠો છે કે જે લોકો એમ માને છે કે અમે વધુ સમજ્ઞાએ છીએ. તેઓ પણ જ્યારે આધ્યાત્મિક જીવન વિષે વિચાર કરે છે, ત્યારે તરત તેઓ ધ્યાનનો વિચાર કરતા હોય છે !

હવે આપણે ધ્યાનમાં જોસીશું, પણ બીજા જ કારણ માટે.

(ધ્યાન)

## ૨૪ એપ્રિલ ૧૯૫૭

“ ભૌતિક જગતમાં દિવ્ય જીવન, આવશ્યક રીતે, અસ્તિત્વના બે છેડાઓનું, આધ્યાત્મિક શિખરનું અને ભૌતિક પાયાનું મિથન સ્વુચ્છે છે. ભૌતિક પદાર્થમાં સ્થાપિત થયેલા જીવનના પાયા પરથી જીવાત્મા આત્માની ઊંચાઈઓ પર આરોહણ કરે છે, પણ તે પોતાના પાયાને હેંકી દેતો નથી, તે ઊંચાઈઓને અને ઊંડાણેને સંયુક્ત કરે છે. આત્મા પદાર્થતત્ત્વમાં અવરોહણ કરે છે. ભૌતિક જગતમાં તે પોતાનાં પ્રકાશને, તેજેને, શક્તિઓને લઈ આવે છે, અને તેમના વડે ભૌતિક જગતને ભરી દે છે, તેનું રૂપાંતર કરે છે જેથી ભૌતિક જગત વધારે ને વધારે દિવ્ય બનતું ચાલે છે. રૂપાંતર એ માત્ર વિશુદ્ધ આધ્યાત્મિકમાં અને સુક્ષ્મમાં પરિવર્તન નથી, જેના પ્રત્યે પદાર્થતત્ત્વને સ્વાભાવિક રીતે જ અલુગમો હોય છે અને જે પદાર્થતત્ત્વ આત્માને બંધન કરનાર કોઈક અવરોહણ આસે છે. રૂપાંતર પદાર્થતત્ત્વને આત્માનું એક રૂપ માને છે. અત્યારે તે રૂપ આત્માને સંતાડી રાખતું હોય છે, પણ ધીમે ધીમે તે આત્માને પ્રગટ કરતું કરણ બની જાય છે. રૂપાંતર પદાર્થતત્ત્વની શક્તિઓને, પદ્ધતિઓને હેંકી દૃતું નથી. તે પદાર્થતત્ત્વની નિગૂઢ શક્યતાઓને બહાર લાવે છે, તેમને ઉન્નત બનાવે છે, તેમનું દિવ્યીકરણ કરે છે. તેમની અંદર રહેલી દિવ્યતાને પ્રગટ કરે છે. દિવ્ય જીવન, જેનામાં દિવ્ય બનવાનું સામર્થ્ય છે તેવી કોઈ પણ વસ્તુનો અસ્વીકાર કરતું નથી. દરેક વસ્તુને પકડમાં લેવાની હોય છે, ઉન્નત બનાવવાની હોય છે, તદ્દન પરિપૂર્ણ બનાવવાની હોય છે.

પરિપૂર્ણતા પ્રામ કરવાનાં આપણા પ્રયાસમાં, આપણે અસ્તિત્વના બે છેડાઓમાંથી ગમે તે એકથી શરૂઆત કરી શકીએ. આપણી પસંદગીને અનુરૂપ સાધનોનો અને પ્રક્રિયાઓનો ઉપયોગ પછી આપણે કરવાનો રહે છે. યોગમાં તે પ્રક્રિયા આધ્યાત્મિક અને ચૈત્ય છે. તેની પ્રાણિક અને શારીરિક પ્રક્રિયાઓને પણ આધ્યાત્મિક અથવા ચૈત્ય વળાંક આપવાનો હોય છે, અને સામાન્ય જીવન અને પદાર્થતત્ત્વની કિયાઓને પણ ઉચ્ચતર ગતિમાં ઉન્નત કરવાની હોય છે. દા. ત. હઠ્યોગમાં તથા રાજ્યોગમાં ઉપયોગમાં લેવાતાં પ્રાણાયામ તથા આસનો. તેથી ઉબંટું, જે આપણે નિઝનતર છેડાના કોઈ પણ કેન્દ્રથી શરૂઆત કરીએ, તો આપણને જીવન અને પદાર્થતત્ત્વ જે સાધનો અને પ્રક્રિયાઓ આપે છે તેમનો ઉપયોગ કરવાનો હોય છે, અને પ્રાણિક તથા ભૌતિક શક્તિઓની શરતો તથા પ્રક્રિયાઓ સ્વીકારવાની રહે છે. આપણે પ્રારંભિક, સાધારણ શક્યતાઓથી પર જે સિદ્ધિઓ અને પરિપૂર્ણ-

તાથો પ્રાપ્ત કરી હોય, તેમને વિસ્તૃત બનાવવાની રહે છે. અને છતાં આપણે જે પાયાથી શરૂઆત કરી હતી તેના પર આપણે ખડા રહેવાનું રહે છે, તે પાયાની મર્યાદાઓ પાળવાની રહે છે. એનો અર્થ એવો નથી કે, આ બે છેડાઓ પરથી થતું કાર્ય એક બીજા સાથે મિલન ન સાધી શકે, ઉચ્ચતર છેડો નિમ્નતર પરિપૂર્ણતાને ઉન્નત બનાવીને પોતામાં એકરૂપ ન કરી શકે. પણ તેમ થવા માટે નિમ્નતર દૃષ્ટિ-બિદ્ધમાંથી ઉચ્ચતર દૃષ્ટિબિદ્ધમાં પરિવર્તન કરવું પડે છે, નિમ્નતર અભીષ્ટાને અને હેતુને ઉચ્ચતર બનાવવાં પડે છે. જે આપણે માનવ જીવનનું દિવ્ય જીવનમાં રૂપાંતર કરવાનું ધ્યેય રાખ્યું હશે, તો આપણે તેમ કરવું જ પડશે. પણ અહીં, માનવ જીવનની કિયાઓને આત્માની શક્તિ વડે ઉદાત્ત બનાવવાની જરૂરિયાત ઉલ્લી થાય છે. અહીં નિમ્નતર પરિપૂર્ણતા અદૃશ્ય નહિં બની જાય. તે રહેશે, પણ માત્ર આત્માની શક્તિ જ આપી શકે તેવી ઉચ્ચતર પરિપૂર્ણતા વડે તેને વિસ્તૃત બનાવવાની રહેશે, તેનું રૂપાંતર કરવાનું રહેશે.”

( અતિમનસ્નો આવિર્ભાવ, પૃષ્ઠ ૫-૮ )

વહાલાં માતાજી, અહીં શ્રી અરવિંદ ઉચ્ચતર પરિપૂર્ણતાની અને નિમ્નતર પરિપૂર્ણતાની વાત કરે છે. તે કયી ?

ઉચ્ચતર પરિપૂર્ણતા એટલે આધ્યાત્મિક પરિપૂર્ણતા, ભગવાન સાથે સંપૂર્ણ મિલન, ભગવાન સાથે તાદાત્મ્ય, નિમ્નતર જગતના બધાં બંધનોમાંથી મુક્તિ તે આધ્યાત્મિક પરિપૂર્ણતા છે, જે યોગ વડે પ્રામ થાય છે. તે શરીરથી અને ભૌતિક જગતથી તદ્દન સ્વતંત્ર છે. પ્રાચીન સમયમાં તેનો એવો અર્થ કરવામાં આવતો હતો કે શરીરનો તથા ભૌતિક જીવનનો પ્રથમ ન્યાય કરી દેવો, જેથી માત્ર ઉચ્ચતર જગત સાથે જ અને છેવટે ભગવાન સાથે જ સંબંધ રહે. આ ઉચ્ચતર પરિપૂર્ણતા છે.

નિમ્નતર પરિપૂર્ણતા એટલે માનવ અન્યારે જે રૂપમાં અને શરીરમાં છે, સર્વ પાર્થિવ વસ્તુઓના સંબંધમાં છે, તેમાં રહીને પોતાનાથી બને તેટલું બંધું જ કરી ધૂટવું. બધાં પ્રતિભાશાળી માણસોએ તેમજ કર્યું હતું. કલાકારો, સાહિન્યક પ્રતિભાશાળી લેખકો અને કવિઓ, સંગઠનકારો, મહાન શાસકો, શારીરિક શક્તિઓને પૂર્ણ-રૂપે વિકસાવનાર લોકો, માનવ વિકાસને સર્વ શક્ત રીતે આગળ વધારવાના લોકો આ બધાઓએ તેમજ કર્યું હોય છે. દા. ત. યુદ્ધ દરમિયાન કેન્દ્રલાક લોકોએ પોતાના

શરીર ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો અને વિમાનીઓની એઠે ચમત્કારિક વસ્તુઓ સિદ્ધ કરવામાં સફળતા મેળવી હતી. અથકય લાગે તેવી વસ્તુઓ તેમણે પોતાનાં શરીરો પાસે કરાવી હતી. તેમણે પોતાનાં શરીરોમાં અકલ્ય સહિષ્ણુતા, ચાતુર્ય, શક્તિ પ્રગટ કર્યા હતાં. શારીરિક બળની, બૌલિક સાક્ષાત્કારની, શક્તિની, હિંમતની, નાસ્વાર્થતાની, ભવમનસાઈની, ભદ્રતાની દૃષ્ટિથી જોતાં તેમણે માનવગુણોને પરિપૂર્ણ રીતે વિકસાયા હતા. આ નિમન્તર પરિપૂર્ણતા છે.

ઉચ્ચતર પરિપૂર્ણતા આધ્યાત્મિક અને અતિમાનવ છે. નિમન્તર પરિપૂર્ણતા એ વધારેમાં વધારે મર્યાદાઓ સુધી વઈ જ્વાયેલી માનવ પરિપૂર્ણતા છે, જે આધ્યાત્મિક અભીષ્ટા સાથે સંબંધ વગરની હોય છે. માણુસ, આધ્યાત્મિક અભીષ્ટા સિવાય, પ્રતિભાશાળી વ્યક્તિત હોઈ શકે. માણુસમાં સર્વ, ખૂબ અસાધારણ નેતૃત્વ ગુણો હોય, અને છતાં તેનું જીવન આધ્યાત્મિક ન પણ હોય. જે બોકોમાં માનવી સાક્ષાત્કારો માટે ખૂબ મોટી શક્તિ હોય છે, તેઓ પોતાની સ્થિતિથી ઓછાવત્તા પ્રમાણમાં સંતુષ્ટ હોય છે. તેમને લાગતું હોય છે કે અમે સ્વપર્યામ છીએ. પોતામાં જ તેઓ તેમની સિદ્ધિનું અને આનંદનું ઉદ્ગમસ્થાન રાખતા હોય છે. તમે તમારા સર્જનોના ક્ષણીયો નથી. એમ તેમને સમજાવવું તે મોટે ભાગે બહુ કઠિન હોય છે. જો તેમને એમ કહેવામાં આવે કે તમે જે કરી રહ્યા છો તેમા ક્ષણી તમે નથી, પણ કોઈ ઉચ્ચતર શક્તિ હોય; તમે તો માત્ર તેના કરણ છો ” તો તે વાત તેમને નહિ ગમે. તે કહેશો કે તમે તમારું કામ કરો, મારી સાથે નકામી માથાડૂટ ન કરો ! તેથી સામાન્ય જીવનમાં આ બે પરિપૂર્ણતાઓ બિજ-બિજ હોય છે. પ્રાચીન યોગમાં એમ કહેવામાં આપતું હતું કે જીવનથી કંટાળો આવકો એ યોગ કરવા માટેની પ્રથમ શરત છે. પણ આ માનવ પરિપૂર્ણતા સિદ્ધ કરેલા બોકોને ભાગ્યે જ જીવનથી કંટાળો આવતો હોય છે. સિવાય કે તેમને માથે અંગત મુશ્કેલીઓ આવી પડી હોય, જેવી કે બોકો તેમનો આભાર ન માને તે, પોતાની પ્રતિભાની બોકો કદર ન કરે; તે બાકી જ્યાં સુધી તેમની સફળતા અને તેમના સર્જન ધમધાકાર ચાલતાં હોય છે, ત્યાં સુધી તેઓ સંપૂર્ણ સંતોષ અનુભવતા હોય છે. સ્વ-સંતુષ્ટ હોવાથી તેઓ બીજી કોઈ વસ્તુને ખોજતા હોતા નથી.

તાત્ત્વિક રીતે તે સત્યનુથી, પણ મોટે ભાગે વસ્તુઓ આ રીતે જ બનતી હોય છે. જો આ પ્રતિભાશાળી વ્યક્તિમાં એવા આત્મા ન હોય, કે જે સંપૂર્ણ રીતે પોતાની જતથી સભાન છે અને જે જાણે છે કે, હું અમુક ખાસ કામ કરવા

માટે પૃથ્વી પર આવ્યો છું, તો તે સારી રીતે ભવે જન્મ્યો હોય, મોટો થાય, પણ પાર્થિવ જીવન કરતા બીજી કોઈક વર્કનું છે તે જાણ્યા શિવાય જ તે મરી જશે. ચોતાનાથી શક્ય ઓવી કોઈક સિદ્ધિ પ્રાપ્ત કર્યાની લાગણી જ માણસને સંતોષ આપે છે, અને પછી તેને બીજું કંઈ કરવાની જરૂર લાગતી હોતી નથી. જે તે બોકોને ચોતાની જંતથી સભાન અને ભૌતિક જગતમાં પોતાનાં હેતુથી સંપૂર્ણ સભાન એવો આન્મા હોય, તો તેને એવી અસ્પષ્ટ લાગણી થશે કે, આ બધું ચોલું છે, આ બધી સિદ્ધિઓ ઉપરચોટિયા છે, કશીક વસ્તુને હજુ અભાવ વરતાય છે. પણ તેવી લાગણી તેવા બોકેમાં જ પેદા થાય છે કે જેમને માટે, માનવજાતના સમૂહમાં, કોઈક ભાવિ નિમિસું થયેલું છે, એવા બોકે જાંયાં નથી હોતા.

જે કંઈક કરી બતાવવા જન્મ્યા હોય છે, તેઓ જ આ બે પરિપૂર્ણતાઓને સંયુક્ત કરી શકે છે અને કંઈક સમગ્રનો સાક્ષાત્કાર કરી શકે છે. પણ આ બહુ વિરલ જનતું હોય છે, મહાન આધ્યાત્મિક નેતાઓ ભાજ્યે જ ભૌતિક જગતમાં મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા હોય છે. તેમ બધું છે, પણ વિરલ, જે બોકો લગવાનના સચેતન અવનારો છે, તેઓ સ્વાભાવિક રીતે જ આ બે પરિપૂર્ણતાઓની શક્યતાને ચોતામાં વઈ આવતા હોય છે; પણ તે અપવાદરૂપ છે. આધ્યાત્મિક જીવનવાળા, મહાન આધ્યાત્મિક સાક્ષાત્કારવાળા બોકો, અમુક અપવાદરૂપ કશેણમાં, બાબુ સાક્ષાત્કાર માટેની શક્તિ પ્રાપ્ત કરી શક્યા હતા. પણ તેવ અપવાદરૂપ હતું. તેમાં પણ વચ્ચે તુકાવટો આવતી. ભૌતિક સાક્ષાત્કાર પર એકાગ્ર બનેલા બોકોની પરિપૂર્ણતા, સમગ્રતા, સમન્વય તેઓ ચોતામાં સ્થાપી શક્યા ન હતા. તેથી માત્ર બાબુ ચેતનામાં જ જીવનાર, પાર્થિવ ભૌતિક જીવનને જ વાસ્તવિક, સધન, દૃષ્ટિગ્રભ્ય, સ્પર્શગ્રભ્ય માનનાર, બોકોને આધ્યાત્મિક જીવન હુમેશાં જાંખું, ભૌતિક દૃષ્ટિબિન્દુથી તદ્દન સામાન્ય જ લાગ્યું છે.

હું ધલ્લા બોકોને મળી છું કે જેઓ બતાવવા માગતા હતા કે, આધ્યાત્મિક શક્તિઓ બાબુ સાક્ષાત્કાર માટે ખૂબ બળ આપે છે, જેમણે અમુક અપવાદરૂપ આધ્યાત્મિક અવસ્થાઓમાં ચિત્ર ચીતરવાનો, સંગીત સર્જવાનો, અથવા કવિતા બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તૈમનાં સર્જનો તદ્દન (નીચલી) કલ્યાનાં હતો, જેમને ભૌતિક પ્રકૃતિ ઉપર પ્રલૂલ્ય મેળવેલા મહાન પ્રતિભાશણી સર્જકોની કૃતિઓ સાથે સરખાવી પણ ન શકાય. આથી ભૌતિકવાદી બોકોને એમ કહેવાની તક મળી જતી કે, “જેણું ને ? તમારી કહેવાતી આધ્યાત્મિક શક્તિમાં કંઈ માલ નથી.”

પણ આનું કારણ એ હતું કે તે સર્જકો તેમના બાધ જીવનમાં સામાન્ય મનુષ્યો હતા. જો મહત્તમ આધ્યાત્મિક શક્તિ બિનકેળવાયેલી દ્રવ્ય-સામગ્રીમાં પ્રવેશ કરે છે, તો સામાન્ય સિથિતિમાં તે વ્યક્તિએ જે સિદ્ધિ પ્રાપ્ત કરી હોત તેના કરતાં ચઢિયાતું પરિણામ તે લાવી શકે છે, પણ ભૌતિક પર પ્રભુત્વ મેળવેલી પ્રતિભાશાળી વ્યક્તિના સર્જન કરતાં તે ધાર્યું ઉત્તરું હોય છે. “આત્મા પ્રાપ્ત થાય” એટલું જ બસ નથી; કરણ પણ તેને વ્યક્ત કરવા માટે સમર્થ હોવું જોઈએ.

હું માનું છું કે શ્રી અરવિંદ તે વાત સમજાવવા માણે છે કે, બાધ શારીરિક સત્ત્વને શા માટે સંપૂર્ણ વિકસાવીને સીધી રીતે પદાર્થતત્ત્વ પર કાબૂ મેળવવાની શક્તિ આપવી જોઈએ. ત્યાર પછી જ, તમે આત્માને પ્રગટ કરી શકે તેવું કરણ તેની સેવામાં આપી શકો. નહિ તો...હું એવા કેટલાક લોકોને જાણું છું કે જેઓ, તેમની સામાન્ય સિથિતિમાં ગ્રસુ લીટીએ પણ જોડણીની અને ભાગાની ભૂલો કર્યા સિવાય લખી શકતા ન હતા, જેઓ એક પણ વિચારને સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકતા નથી, તે લોકો આધ્યાત્મિક પ્રેરણાની ક્ષણોમાં ખૂબ સુંદર વસ્તુઓ વખી શકતા હતા; પણ તે સુંદર વસ્તુઓ ખૂબ મહાન બેખ્કોની કૃતિઓ જેટલી સુંદર ન હતી. સામાન્ય સિથિતિમાં સર્જયેલી કૃતિઓ કરતાં તે કૃતિઓ નોંધપાત્ર હતી; તેમની વર્તમાન શક્યતાઓનો વધારેમાં વધારે ઉપયોગ કરવામાં આવ્યો હતો; તે મૂલ્યવાન સર્જનો હતો, જે સામાન્ય સિથિતિમાં ન બની શક્યાં હોત. પણ તમે પ્રતિભાશાળી સંગીતકારનો, ડલાકારનો કે વેખકનો દાખલો કે જેણે પોતાના કરણ પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું છે, જે તે કરણનો ઉપયોગ ઉચ્ચતમ માનવ શક્યતાને વ્યક્ત કરતી કૃતિઓ સર્જવામાં કરી શકે છે, અને તેને જે આધ્યાત્મિક ચેતના - અનિમાનસ શક્તિ પ્રાપ્ત થાય, તો તમને સાચી દિવ્યકૃતિ મળે.

શ્રીઅરવિંદ આપણને જે પ્રયાસ કરવાનું કહે છે તેની આ ચાવી છે.

જો તમે તમારા શરીરમાં જે શક્યતાઓ છે તેમને બહાર લાવો, જો તમે શરીરને સામાન્ય, સુપ્રસિદ્ધ, વેજાનિક પદ્ધતિઓથી ઉણવો, જો તમે આ કરણને બનો તેટલું પરિપૂર્ણ બનાવો, તો જ્યારે અતિમાનસ સત્ય તે શરીરમાં અવતરણ કરશો, ન્યારે તે તરત જ-સદીએ સુધી નૈયાર કર્યા વગર જ-આત્માની અલિવ્યક્તિનું અદ્ભુત કરણ બની જશો.

તેથી શ્રી અરવિદ વારવાર કહેતા આવ્યા છે કે, તમારે બને છેખાણોણું  
કાર્ય કરવું જોઈએ, એક છેડાની ઘાતર બીજા છેડાનો ત્યાગ ન કરવો જોઈએ.  
જો તમારે દિવ્ય ચેતના પ્રામ કરવી હોય, તો તમારે આધ્યાત્મિક અભોપ્સાનો  
ત્યાગ ન કરવો જોઈએ, પણ જો તમારે પૃથ્વી પર એક સમન્વિત દિવ્ય વ્યક્તિત  
બનવું હોય, તો બીજા છેડાનો ત્યાગ ન કરશો, તમારા શરીરને શ્રેષ્ઠ કરશુ  
બનાવજો.

સામાન્ય માનવબુદ્ધિનો એ રોગ છે—જે લેદમાંથી પેદા થાય છે—કે  
હંમેશાં આ કે પેલું, એમ બેમાંથી એક વસ્તુ પસંદ કરવાનું વલલુ સેવવું, જો  
તમે આને પસંદ કરો, તો તમે પેલાથી વિમુખ બનો છો. જો તમે પેલાને પસંદ  
કરો, તો આનાથી વિમુખ બનો છો.

તે દરિદ્રતા છે. માણસે દરેક વસ્તુને ગ્રહણ કરતાં, દરેક વસ્તુને સંયુક્ત  
કરતાં, દરેક વસ્તુનો સમાન્ય સાધતાં જાણવું જોઈએ. તો જ સમગ્ર સાખાકાર  
શક્ય બને.

(બાળકો તરફ વળીને) હવે તમારે કંઈ કહેવું છે?

કહેવા કરતાં કરવું તે વધારે સારું છે. હવે મેં તમને કંઈ પ્રોત્સાહન  
આપ્યું છે.

\*

## ૧ મે ૧૯૫૭

“આકાશમાં રમતગમતો અને શારીરિક વ્યાયામ જેવી પ્રવૃત્તિઓ દાખલ  
કરવામાં આવી છે, તેથી એ કૃત સ્પૃષ્ટ બને છે કે, અસ્તિત્વના નિર્મનતર છેડાથી  
થરુ કરીને આપણે પદ્ધતિઓ અને પ્રથમના હેતુઓ સિદ્ધ કરવાનાં છે. મૂળ તો  
તે આકાશની શાળાનાં બાળકોની શારીરિક ક્રેણવલું અને તેમના શારીરિક વિકાસ

માટે દાખલ કરવામાં આવ્યાં છે, અને બાળકો શુદ્ધ ગાધ્યાત્મિક લક્ષ્ય અથવા અભ્યાસ માટે તે પ્રવૃત્તિઓ કરે તેવી પુષ્ટ ઊંમરે હજુ પહોંચ્યા નથી. છતાં માનવ મર્યાદાઓમાં જે કાઈ પ્રામ થઈ શકે તે ગણનાપાત્ર અને વિપુલ હશે. આપણે જેને પ્રતિભા કહીએ છીએ તે માનવના વિકાસનો એક ભાગ છે; મન અને સંકલ્પબળની વસ્તુઓમાં પ્રતિભાની સિદ્ધિઓ ભગવાન પ્રત્યે આપણને અરથે રસ્તે થઈ જઈ શકે તેમ છે. શારીરિક ક્ષેત્રમાં મન અને સંકલ્પ-બળ જે સિદ્ધિ-ઓ પ્રામ કરી શકે છે તે, શારીરિક સહિપ્પણું, અનેક પ્રકારના વારતાલર્વા કર્મો, થાકનો અભાર, ભાંગી પડવું તે - અશક્ય લાગે તેવાં કર્માની પાછળ મંડળ રહેવું, હિમત, અન્ત શારીરિક વેદનાને તાબે ન થવું તે, અને ચમત્કારિક ગણ્ય તેવા વિજયો માનવક્ષેત્રમાં જોવામાં આવે છે. તેમને આપણે સમગ્ર પરિપૂર્ણાનો એક ભાગ ગણવો જોઈએ.

શરીર અચેતનનું સર્જન છે, તે પોતે અવચેતન ભાગોમાં અને નિગૂઢ કાર્યમાં અચેતન છે. પણ આપણે જેને અચેતન કહીએ છીએ, તે એક નિગૂઢ ચેતનાનો અથવા અતિચેતનાનો આભાસ છે, નિવાસરસ્થાન છે, કરણ છે, કે જે અતિચેતને આ વિશ્વરૂપી ચમત્કારનું સર્જન કર્યું છે. પદાર્થ તત્ત્વ અચેતનનું સર્જન અને ક્ષેત્ર છે. અચેતન પદાર્થ તત્ત્વની કિયાઓની પરિપૂર્ણા, તે કિયાઓને લક્ષ્યને અનુરૂપ બનાવવી તે, તે ને આશ્રમ્યકારક કિયાઓ કરે છે તે, સૌન્દર્યનાં જે આશ્રમ્યનું તે સર્જન કરે છે તે. આપણે ગમે તેટબો અજ્ઞાનપૂર્ણ વિરોધ કરીએ છતાં પણ, ભૌતિક વિશ્વના દરેક ભાગમાં અને ગતિમાં અતિચેતનની હાજરીને અને શક્તિને પુરવાર કરે છે. તે અતિચેતન શરીરમાં છે, તેણે શરીરનું સર્જન કર્યું છે. આપણું ચેતનામાં તે અતિચેતનનું પ્રાગટ્ય એ ઉત્કાન્તનો નિગૂઢ ઊંદેશ છે, આપણા અસ્તિત્વના રહસ્યની ચાવી છે.”

(અતિમનસનો આવિભાવ, પૃષ્ઠ ૮-૧૧

માતાજી, રમતગમતોની હરીફાઈઓ આપણી પ્રગતિ માટે જરૂરી છે ?

ભૌતિક કેળવણીની દૃષ્ટિએ તે આવશ્યક છે. કારણ કે જે માણસ સાચી ભાવનાથી તેમાં ભાગ બે, તો અહંતા પર પ્રભુત્વ મેળવવા માટે તે એક ઘણી સુંદર તક છે. જે પોતાની નબળાઈઓ અને નિમનતર ગતિઓ પર વિજય

મેળવવાનો પ્રયત્ન કર્યા સિવાય માણસ તેમાં ભાગ બે, તેને તેમાંથી કણો લાલ પ્રાસ થતો નથી. પણ જો સાચી ભાવનાથી રમતગમતોની હરીકાઈમાં માણસ ભાગ બે, તેમાં નિમનતર ગતિને-અદેખાઈને મહત્વાકંક્ષાને ઘૂસી જવા ન હે, એવિલીનું વલસુ અપનાવે, યથાશક્તિ પ્રયાસ કરે અને પરિણામની દરકાર ન રાખે, નિષ્ઠણતાથી વિકિષ ન બની જાય, તો તે હરીકાઈઓ બહુ ઉપયોગી નીવડે. તેમાં તે રીતે ભાગ બેવાથી માણસમાં વધારે આત્મ સંયમ અને પરિણામો પ્રત્યે અનાસક્તિ આવે, જે ઉચ્ચ ચારિત્રયના નિર્માણમાં ખૂબ મદદગાર છે. સ્વાભાવિક રીતે જ, જો તમે તે સામાન્ય રીતે જ કરો, સામાન્ય પ્રતિકારો અને વરવી ગતિઓ સાથે કરો, તો તે જરા પણ મદદગાર ન નીવડે. પણ તે વાત માત્ર રમતગમતોને જ નથી પડતી. બૌધિક ક્ષેત્રમાં પણ જો તમે સામાન્ય રીતે જ કામ કરો, તો તે સમયનો બગાડ છે. પણ રમતગમતોની હરીકાઈઓમાં અથવા ટુનામેન્ટોમાં તમે સાચી ભાવનાથી ભાગ બેનો, તો તે એક બહુ સુંદર કેળવસું છે, કારણકે તેમાં તમારે એક ખાસ પ્રયાસ કરવો પડે છે. તમારી સામાન્ય મર્યાદાઓને ઓળંગી જવી પડે છે, તમારી ઘણી ગતિઓને સભાન બનાવવા માટે તે ચોક્કસ એક તક પૂરી પાડે છે, કે જે ગતિઓ નહિ તો અભાન રહી ગઈ હોત.

પણ તમારે એ લુલી જવું ન જોઈઓ કે આ એક તક છે, પ્રગતિ માટેનું સાધન છે. જો તમે સામાન્ય રીતે જ તેમાં ભાગ બેનો, તો તે સમયનો બગાડ છે, પણ તે માત્ર રમતગમતોને જ નહિ, પણ દરેક વસ્તુને લાગુ પડે છે. દા. ત. અભ્યાસનો, દરેક વસ્તુ તે જે રીતે કરવામાં આવે છે તેના પર આધાર રાખે છે; માણસ જે કરે છે તેના પર નહિ. પણ કથી ભાવનાથી તે કરે છે તેના પર.

જો તમે યોગી હો, અને તમારાથી શક્ય પ્રયાસથી, શક્યતાઓથી, બને તેટલી સરસ રીતે, વધારે સારી રીતે કરવાની તમનનાથી તે કામ કરો તો હરીકાઈઓની, ઈનામેની, બદ્લાઓની કેંઠ જરૂર ન રહે. પણ કી અરવિંદ લખે છે તેમ, નાનાં બાળકો યોગીઓ બને તેવી આશા ન રાખી શકાય. તૈયારીના સમય દરમિયાન, સ્થૂળ ભૌતિક ચેતના પ્રગતિ માટે પ્રયત્ન કરે તે માટે, પ્રોત્સાહનની જરૂર હોય છે. આ બાલ્યાવસ્થાનો સમય ઘણા વર્ષો સુધી પણ ચાલુ રહે!

છેલ્લા બુલેટિનમાં (એપ્રિલ ૧૯૫૭) મેં જે લખ્યું છે, તે આદર્શ છે. મને ખબર નથી કે તે તમે વાંચ્યું છો કે નહિ. પણ મેં આવું કંઈક લખ્યું છે:

મહત્વાકંદ્ધા ન રહ્યો,  
કોઈ પ્રકારનો દંબ ન કરો,  
પણ હરકણે પ્રયત્નપૂર્વક  
તમે જે બની શકો તેવા બનો.

જે તમને ગમતું હોય, તો આને આપણે આપણા ધ્યાનનો વિષય જનાવીશું.

(ધ્યાન)

માતાજી, મોટે ભાગે અમારામાંના ધ્યાનખરા જે રમત-ગમતોમાં કંઈક ઉશ્કેરાટ હોય છે, તેમાં જ રસ બેતા હોઈએ છીએ. પણ ગંભીર પ્રવૃત્તિઓમાં, ગંભીર કસરતોમાં બહુ થોડા જ રસ બેતા હોય છે. આનું કારણ શું?

કારણ કે મોટાભાગના બોકોમાં પ્રાણિક સંતોષ રસ પેદા કરતો હોય છે. રસ પેદા ન કરે તેવી, તમને તાલીમ આપતી, રમતગમતોમાં રસ બેવા માટે તમારે તર્કબુદ્ધિને અસ્તિત્વનું નિયમન કરવા દેવું જોઈએ. સામાન્ય બોકોમાં તર્કબુદ્ધિ માનવચૈતનાનું ચિખર હોય છે, અને તેણે અસ્તિત્વના બીજા ભાગોનું નિયમન કરવું જોઈએ, કારણકે તે વ્યવસ્થિત હોય છે. તર્કબુદ્ધિ વ્યવસ્થા માટે, ભજતા માટે, ઉપયોગિતા માટે, યોજના માટે સભાન બનીને કાર્ય કરતી હોય છે; જ્યારે અસ્તિત્વના પ્રાણિક ભાગને ઉશ્કેરાટ, અનપેક્ષિત વસ્તુ, સાહસ, રમતગમતોને આકર્ષક બનાવે તેવાં બધાં જ તત્ત્વો, સ્પર્ધા, જિતવા માટેનો પ્રયાસ, પ્રતિસ્પદ્ધી પર વિજય ગમતાં હોય છે. માણસમાં રહેવો પ્રાણિક આવેગ ઉત્સાહનું, ઉત્કટતાનું, સામાન્ય શક્તિનું નિવાસસ્થાન છે. જ્યારે અનપેક્ષિત વસ્તુનું, સંધર્ષનું, વિજયનું આકર્ષણ નથી હોતું, ત્યારે પ્રાણિક આવેગ ઊંઘી જાય છે, સિવાય કે તેને તર્કબુદ્ધિના સંકલ્પની, નિયમિત અને સ્વયંભૂ રીતે, આશા પાળવાની ટેવ હોય. આ પ્રથમ કોટિની વસ્તુ છે, જેને માટે શારીરિક તાલીમ ઉપયોગી નીવડે છે જે શરીરને પ્રાણિક આવેગને બદલે તર્કબુદ્ધિની આશા પાળવાની ટેવ ન હોય, તો તે કામ બરાબર કરી શકતું હોતું નથી. દા. ત. શારીરિક પરિપૂર્ણતાના સમગ્ર વિકાસ માટે, ઉમ્બેલસ વડે તથા કસરતો વડે, જેમાં કશું ઉશ્કેરાટજનક નથી અને જે શિસ્ત તથા નિયમિત તર્કયુક્ત ટેવો માણી બે છે, જેમાં આવેગને કોઈ અવકાશ

નથી કામનાને, આવેશને કોઈ અવકાશ નથી, તેમને સારી રીતે કરવા માટે માણસે ખૂબ નિયમિત અને ખૂબ કડક શિસ્ત અનુસાર જીવનને વ્યવસ્થિત બનાવવું જોઈએ. તેમને સારી રીતે કરવા માટે, માણસે તર્કબુદ્ધિ વડે જીવનનું નિયમન કરવાની ટેવ પાડવી જોઈએ.

આ મોટે લાગે જોવામાં આવવનું નથી. જો તર્કબુદ્ધિ વડે જીવનનું નિયમન કરવામાં ન આવ્યું હોય તો કામનાના આવેગો, ઉત્સાહેના આવેગો, અને તેમનાં પ્રતિકાર્યો માનવ જીવનનો કબજો લઈ બે છે. શરીરની કડક શિસ્તમાંથી પસાર થવા માટે અને શરીર પાસેથી પરિપૂર્ણતા લાવે તેવા વ્યવસ્થિત નિયમિત પ્રયાસને પ્રાપ્ત કરવા માટે માણસે થોડા ધર્માણસાં સાંત બનવું પડે છે. તેમાં કામનાની કલ્પનાઓ માટે કોઈ અવકાશ રહેતો નથી. માણસ જ્યારે અતિથયતાઓને, મધ્યમસરતાના અભાવને, અવ્યવસ્થિત જીવનને અવકાશ આપે છે, ત્યારે શરીર પર કાબૂ રાખવાનું અને તેના સામાન્ય વિકાસ કરવાનું અશક્ય બની જાય છે, પોતાનું આરોગ્ય બળાડે છે, અને પરિણામે પરિપૂર્ણ શરીરના આદર્શનો એક મહત્વનો ભાગ અદૃશ્ય બની જાય છે, કારણકે રોગિષ શરીર વડે, નાદુરસ્ત તબિયત વડે માણસ કોઈ પણ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી. કામના અને પ્રાણિક આવેગોનો સંતોષ, અમુક મહત્વાકાંક્ષાઓની અતાંકિક માંગોનો સંતોષ માણસના શરીરને માંદું પડે છે.

સ્વાભાવિક રીતે જી, માણસે જીવનના ધર્માખરા પાયાના નિયમોને પણ જાણતા હોતા નથી, તે તેમનું અજ્ઞાન છે. પણ દરેક માણસે કેમ જીવનું તે જાણવું જોઈએ, દા. ત. અગ્નિન બળે છે અને પાણી ઝૂબાડી દે છે! માણસોને તે વસ્તુઓ કહેવી પડતી નથી, તેઓ મોટા થાય છે કે તરત જી તે વસ્તુઓ શીખી બે છે. પણ નિકૃષ્ટ કોટિનો માણસ હંમેશાં એ વાત સ્વીકારતો હોતો નથી કે, સારા આરોગ્ય માટે જીવન પર તર્કબુદ્ધિનો કાબૂ હોવો તે તદ્દન અનિવાર્ય છે, તે માણસને તો પોતાના આવેગો અનુસાર જીવામાં જી મજા પડી હોય છે.

મને એક માણસ બાદ આવે છે. બહુ સમય પહેલાં તે સરકારમાં ઉમેદવાર તરીકે ઉલા રહેવા માટે અહીં આવ્યો હતો. તે બોકોઓ મને તેની મુલાકાત કરાવી. કારણકે તેઓ તે માણસ વિષે મારો અભિપ્રાય જાણવા માગતાં હતા. તેણે મને આશ્રમ વિષે, અહીં જાળવામાં આવતા જીવન વિષે, હું કેને જીવન માટે અનિવાર્ય શિસ્ત ગણુંથી હતી તેને વિષે પ્રશ્નો પૂછ્યા. તે માણસ આપો દિવસ

સિગારેટો પીવા કરતો હતો અને જરૂર કરતાં વધારે દાડ દીંખતો હતો; તેથી તેણે ફરિયાદ કરી કે ધણી વાર હું થાકી આઉ છું. કેટલીક વાર હું મારી જત પર કાબુ રાખી શકતો નથી. મેં તેને કલ્પના કે પ્રથમ તો તમારે સિગારેટ પીવાનું અને દાડ પીવાનું છોડી હેઠું જોઈએ. માની શકાય તેરા ગુંચવાડા સાથે મારી સામે જોઈને તે બોલ્યો કે જે માસુસ સિગારેટ અને દાડ ન પીએ, તો જીવનમાં ભજ શી રહે? મેં જવાબ આપ્યો કે જે તમે હજ તે સ્થિતિમાં હો, તો તમને વધારે કાઈ કહેવું તે નિરર્થક છે.

આમ તમે ધારો તેના કરતાં ધણી વાર જુદું બનતું હોય છે. આપણને તે વિચિત્ર, અસંભવિત લાગતું હોય છે, કારણકે આપણને સિગારેટ અને દાડ પીવા કરતાં બીજી કોઈ વસ્તુમાં વધારે રસ હોય છે. પણ સામાન્ય માણસો માટે, કાગળાઓની તૃતીએ જ જીવનનો હેતુ હોય છે. પોતાની તે પ્રકારની ટેવોને તેઓ સ્વતંત્રતા માનતા હોય છે, જીવનનો હેતુ માનતા હોય છે, તે એક વિકૃતિ છે, જીવન વૃત્તિનો અસ્વીકાર છે, વરવું રૂપ છે, શારીરિક જીવનમાં વિચારની અને પ્રાણિક આવેગની દખલગીરી છે, તે અનારોગ્યપ્રદ આવેગ મોટે ભાગે પશુઓમાં પણ જોવામાં આવતો નથી. પશુઓની વૃત્તિ માનવોની વૃત્તિ કરતાં અનંતગણી વધારે તર્કધૂકત હોય છે. માસુસમાં તો વૃત્તિ રહેવા જ પામી નથી. તેનું સ્થાન એક ખૂબ વિકૃત આવેગે બર્દી લીધું છે.

વિકૃતિ એ માનવી રોગ છે. પશુઓમાં તે ભાગે જ જોવામાં આવે છે. વિકૃતિ એ પશુઓમાં જ જોવામાં આવે છે કે જે માનવના ખૂબ સંપર્કમાં આવ્યાં હોય છે અને જેમને માનવની વિકૃતિનો ચેપ લાગ્યો છે.

અદ્ભુતરિયામાં—ઉત્તર આદ્રિકામાં કેટલાક અમલદારો વિષે એક કથા છે. તેમણે એક વાંદરો દાતાક લીધો હતો. વાંદરો તેમની સાથે રહેતો હતો. એક દિવસ બોજન સમયે તે લોકોમાં એક વિચિત્ર વિચાર આવ્યો, તેમણે વાંદરને આલ્કાહોલ દાડ પીવા આપ્યો, વાંદરાએ બીજી લોકોને તે પીતા જોયા. તેમાં તેને મજા પડી. તેણે પણ દારુનો એક ખાલો પીધો. પછી તે વાંદરો ગાંઢો પડ્યો. ખૂબ માંઢો પડ્યો. ટેબલ નીચે તે ખૂબ પીડાથી આળોટવા લાગ્યો, તેની સ્થિતિ બંધુ ખરાબ જની ગઈ. જ્યારે શારીરિક પ્રકૃતિ વિકૃત જની ગઈ હોતી નથી, ત્યારે દાડની જે સ્વયંલ્બુ અસર થાય છે તેનું દૃષ્ટાંત તે વાંદરાએ તેમને પૂરુ પાડ્યું. તે દાડના જેરથી

અધમૂઓ બની ગયો. પછી તે સાંજે થયો. ઘોડાક સમય પછી તેને ફરી વાર બોજન સમયે હાજર રાખવામાં આવ્યો. કોઈએ તેની આગળ દાડનો ખાલો મુક્યો. ખૂબ ક્રોધપૂર્વક તેણે તે ખાલો ઉપાડીને આપનાર માણસના માથા પર ફેંક્યો. તે શીતે તેણે બતાવી આવ્યું કે પોતે માણસો કરતાં ધણો વધારે હતો!

કાર્યસાધક જીવન જીવા માટે અને શરીર પાસેથી તેનાથી શક્ય હોય તેટલું કામ કઢાવી બેવા માટે, માણસે તર્કબુદ્ધિને પોતાના ધરની સ્વામિની બનાવવી જોઈએ. આ વાત નાની ઉમ્મરમાં શીખી બેવી તે એક સરસ વાત છે. તેમાં યોગનો કે ઉચ્ચતર સાક્ષાત્કારનો જ પ્રશ્ન નથી. તે સર્વત્ર, દરેક શાશ્વતમાં, દરેક કુટુંબમાં, દરેક ધરમાં શિખવાડવું જોઈએ. માણસનું સર્જન, તે માનસિક સર્તા બને તેટલા માટે, કરવામાં આવ્યું હતું. આપણે માત્ર માનવ બનવાની જ વાત કરીએ છીએ, બીજા કથાની નહિ. માનવ બનવા માટે, તેણે પોતાની જતનું નિયમન તર્કબુદ્ધિ વડે કરવું જોઈએ, પ્રાણિક આવેગો વડે નહિ. આ વાત બાળકોને તેમની બાલ્યાવસ્થામાંથી જ શિખવાડવી જોઈએ. જો માણસનું નિયમન તર્કબુદ્ધિ વડે ન થાય, તો તે પશુ કરતાં પશુ બદતર છે, કારણ કે પશુઓમાં નિયમન કરનાર મન કે તર્કબુદ્ધિ નથી હોતાં, પશુ તેઓ જતિની સાહજીક વૃત્તિની આશાનું પાલન કરે છે. તે વૃત્તિ ખૂબ તર્કયુક્ત હોય છે. તે પશુઓમાં નિયમન કરતી હોય છે. તે જતિના દૃષ્ટિબિન્દુથી હોતાં, તે વૃત્તિ ખૂબ તર્કયુક્ત હોય છે. જે પશુઓમાં, માણસોની સાથે રહેવાને કારણે, તે વૃત્તિ નથી હોતી, જેઓ પોતાની વૃત્તિને બદલે માનવની આશાનું પાલન કરે છે, તેઓ વિકૃત બની જાય છે. અને પોતાની જતિના ગુણો ગુમાવી બેસે છે. પશુ જે પશુ પોતાનું સ્વાભાવિક જીવન જાળતું હોય છે, માનવની અસરથી મુક્ત હોય છે, તે પોતાના દૃષ્ટિબિન્દુથી એક ખૂબ તર્કયુક્ત પ્રાણી હોય છે. કારણ કે તે પોતાની પ્રકૃતિ સાથે સુસંગત, પોતા માટે કલ્યાણકારી વસ્તુઓ જ કરતું હોય છે. સ્વાભાવિક રીતે જ, તેને માથે સંકટો આવી પડે છે, કારણ કે તે સતત પોતાની જતિનાં બીજા પશુઓ સાથે અધડતું હોય છે; પશુ તે મૂર્ખાઈભરેલી રીતે વર્તતું હોતું નથી. મૂર્ખાઈઓનો અને વિકૃતિનો પ્રારંભ સચેતન મન જાથે, માનવજાતિ સાથે થતો હોય છે. માનવ પોતાની માનસિક શક્તિઓનો ખરાબ ઉપયોગ કરતો હોય છે તે તેમાં કારણભૂત છે. વિકૃતિની શરૂઆત માનવજાતિથી થાય છે. માનસિક ચેતના જેનું પ્રતિનિધિત્વ કરે છે તે પ્રકૃતિની પ્રગતિની તે વિકૃતિ છે. માટે માણસ વિચાર કરતો બને ત્યારે તેને પ્રથમ આ વસ્તુ શિખવાડવી જોઈએ કે તારે માનવજાતિની પરમ વૃત્તિદ્વારા તર્કબુદ્ધિના આદશોનું પાલન કરવું જોઈએ,



મનો અને ઉત્તરો

તર્કબુદ્ધિ માનવજીતના સ્વભાવનો સ્વામી છે. માણસે તર્કબુદ્ધિના આદેશોનું પાલન કરવું જોઈએ, પુત્તિઓના ગુલામ બનવાનો ઈન્કાર કરવો જોઈએ. અહીં હું તમને યોગ વિષે નથી કહેતી, આધ્યાત્મિક જીવન વિષે નથી કહેતી. એ તો માનવજીવનનું પાયાનું ડાખાપણ છે. જે માણસ તર્કબુદ્ધિ કરતાં બીજા કથાના આદેશોનું પાલન કરે છે, તે પણ કરતાં પણ બદલ્યું હોય જે શીખવાડી જોઈએ. આ પાયાની કેળવણી બાળકોને અપાવી જોઈએ.

જ્યારે ભગવાનના સંકલને પ્રગટ કરનાર શોત્ય નિયમનો ઉદ્ય થાય, ત્યારે જે તર્કબુદ્ધિના સામ્રાજ્યનો અંત આવી શકે.

\*

## ૧૫ મે ૧૯૫૭

માતાજી, સુષ્ઠિના પ્રારંભ કાળથી આ પુરુષ અને શીની કથ્યે તફાવત શા કારણે છે ?

કથી સુષ્ઠિના પ્રારંભ કાળથી ? તમે કથી સુષ્ઠિની વાત કરો છો ? પૃથ્વીની ?

હા.

પ્રથમ તો આ વાત સાચી નથી. એવી જતિઓ છે જ્યાં શીપુરુષ કથ્યે ઝોઈ લેટ નથી હોતો. પ્રારંભમાં પણ ન હતો. બીજે મુદ્રો. પાથીવ સુષ્ઠિ કેવળ ભૌતિક સુષ્ઠિ છે, તે વૈશ્વિક સુષ્ઠિનું એક પ્રકારનું ભૌતિકીકરણ છે, જડતામાં થીજી ગેણ્ણું હું છે. પણ વૈશ્વિક સુષ્ઠિમાં આ તફાવત અનિવાર્ય રીત નથી

હોતો. તેમાં બધી શક્યતાઓ હોય છે, બધી શક્ય વસ્તુઓ તેમાં હતી અને છે, આ તફાવત જરાપણ સુધિનો પાણો નથી.

એટલે તમારો પ્રશ્ન જોટો છે, ઉભો રહી શકે તેમ નથી.

પણ ભૌતિક સુધિમાં તે તફાવત થા માટે છે ?

તે લેદ પ્રારંભકાળથી નથી. પ્રાણીશાખી તમને કહી શક્યે કે, કેટલીક જાતિ-ઓમાં નરમાદાના લેદ નથી હોતા. પ્રકૃતિએ આ પદ્ધતિનો પ્રયોગ કર્યો છે. તે ઘણી વસ્તુઓના પ્રયોગો કરે છે, તેણે સર્વ શક્ય જાતિઓનું સર્જન કર્યું છે, એકમાથી બે બનાવ્યાં છે, દરેક શક્ય વસ્તુ બનાવી છે. તેણે નરમાદાનો પ્રયોગ કર્યો છે, કારણ કે તે તેને વધારે વ્યવહારું લાગ્યો હોય. હું ચોક્કસ કહી શકતી નથી. બસ.

પણ બીજી ભૂમિકાઓ પર, પાર્થિવ જગતમાં પણ, પાર્થિવ જગતની વધારે સૂક્ષ્મ ભૂમિકા પર, સૂક્ષ્મ શારીરિક, પ્રાણીક, માનसિકમાં પણ, આમ નરમાદા રૂપે વિભક્ત થયેલાં સત્ત્વો હોય છે, પણ એવાં પણ સત્ત્વો હોય છે કે જે મુજુખ પણ નથી અને માદા પણ નથી હોતાં. તેઓ અસ્તિત્વ ધરાવે છે. દા. ત. પ્રાણીક જગતમાં જાતીય લેદો બહુ જ વિરલ જોવામાં આવે છે, તે સત્ત્વો મોટે ભાગે જાતિ-ધીન હોય છે ( નર પણ નહિ, અને માદા પણ નહિ. ) અને એવી શંકા જાય છે કે, માસુસો વડે વર્ણવાયેલાં દેવોના જગત પર માનવ વિચારની ખૂબ અસર પડેલી છે. એવા ઘણા દેવો છે કે જે જાતિરહિત છે. બધા દેશોના દેવો વિષે કહેવાયેલી કથાઓમાં એવી ઘણી વસ્તુઓ છે, જેના પર માનવી વિચારની ઘણી અસર પડેલી છે. એટલે આ જાતીય લેદ એક સાધન માત્ર છે, જેનો ઉપયોગ પ્રકૃતિએ પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે કરેલો છે. જાતીય લેદ કોઈ સન્નાતન પ્રતીક નથી.

કેટલાક વોકો આ જાતીય લેદને બહુ મહત્વ આપે છે. જો તે તેમને ગમતો હોય, તો બબે તેઓ તેને રાખે, પણ તે આખરી, સન્નાતન, કે પરિપૂર્ણ નથી. કદાચ તે અધિમનસ્ત્રના સર્જનનો આદર્થી હતો, તે વાત શક્ય છે. પણ તે સંપૂર્ણ પણ શક્ય નથી. આંશિક રીતે શક્ય છે. પણ જેમને આ જાતીય લેદ ખૂબ ગમતો હોય, તે બબે તેને રાખે. જો તેમને સુધી આપતો હોય તો ! તેના લાભો છે, પણ ગેરલાભો ઘણા છે.

માતાજી, તો પછી પ્રાણિક જગતની શક્તિઓ આ શરત-  
માંથી કેમ છટકી જય છે?

શું?

તમે કહો છો કે, આ જતીય બેદ પ્રાણિક જગતમાં અસ્તિત્વ ધરાવતો નથી.  
હું એમ નથી કહેતી કે, તે અસ્તિત્વ ધરાવતો નથી. હું કહું છું કે, તે સર્વ-સામાન્ય  
નિયમ નથી, ઊલટું તેમાં જતીય બેદવાળાં સત્ત્વો કરતાં જતીય બેદ વગરનાં સત્ત્વો  
વધારે જોવા મળે છે. સંભવ છે કે પ્રાણિક જગતમાં આ બેદ આવવાનું કારણ ધરે  
આગે પૃથ્વીની અસર હોય.

તમે આ સવાલો શા માટે પૂછો છો? તમે શો અર્થે કઢાવવા માગો છો?  
મારે તે જાણું છે. સુણિના પ્રારંભકાળથી જતીય બેદ હતો, એમ તમને કોણે  
કહું? તે બોકોએ, કે નેમને તે બેદ ચાલુ રહે તેમાં ખૂબ મજા પડે છે? જો  
તમને તે ગમતો હોય, તો ભવે તેઓ તેને ચાલુ રાખો, કોઈ તેમાં વિકેપ નહિ  
કરો. જો તેથી તેઓ સુખી થતા હોય, તો ભવે તેને તેઓ ચાલુ રાખો.

“આપણું અત્યારે ઘ્યાલ ન આવી શકે તેવી ભ્યાનવી ઉચ્ચતર ભૂમિકાઓ  
છે. એક દિવસ આપણે ત્યાં પહોંચવું જોઈએ, અને પછી તેમનાથી પણ પર  
જઈ મહત્તર આધ્યાત્મિક અસ્તિત્વની ઊંચાઈઓ પર પહોંચવું જોઈએ. આપણે નેમ  
નેમ ઊર્ધ્વમાં જઈએ છીએ, તેમ તેમ તે ભૂમિકાઓ, ઊંચાઈઓ પ્રણ્યે આપણે  
આપણા નિમ્નતર ભાગોને ખુલ્લવા કરવા જોઈએ અને તેમને પ્રકાશના અને શક્તિના  
ઉચ્ચતર પરમ આવેગોથી પરિપૂર્ણ કરવા જોઈએ. આપણે શરીરને વધારેને વધારે  
સચેતન કરશું, આત્માનું સચેતન ચિહ્ન-સીલ અને શક્તિ બનાવવાનું છે. નેમ  
નેમ તે આ પરિપૂર્ણતામાં વૃદ્ધિ પામે છે, તેમ તેમ તેના વેળીલા કાર્યનું બળ  
તથા માત્રા, અને આત્મા પ્રત્યેના તેનાં પ્રત્યુત્તર અને સેવા વધવાં જોઈએ, તેના  
પર આત્માના કાબુમાં પણ વૃદ્ધિ થવી જોઈએ, તેના વિકસિત અને પ્રામ કરેલા  
શક્તિના ભાગોમાં, અત્યારે કેવળ અગેણા ગણ્યાય તેવાં તેનાં સ્વયંભૂ પ્રતિકર્ષામાં,  
અત્યારે કે યાંત્રિક અવચેતનતાની લાગે છે તેવી તેની ગતિઓમાં, આ બધાનાં  
કાર્યોમાં શરીરની મુદ્દાયમતા વૃદ્ધિ પામવી જોઈએ. સાચાં ઝૂપાંતર સિવાય આ બની  
ન શકે. આપણી ઉત્કાનિત નિગૂઢ રીતે ને પરિવર્તન તરફ ગતિ કરી રહી છે, તે

મન-પ્રાણ શરીરનું રૂપાંતર છે. આ રૂપાંતર સિવાય, પૃથ્વી પર દિવ્ય જીવનની અમંગુષ્ઠા પરિપૂર્ણતા પ્રગટ ન થઈ શકે. આ રૂપાંતરમાં શરીર પોતે પણ એજન્ટ અને ભાગીડાર બની શકે એ શક્ય છે કે, શરીર એક નિષ્ક્રિય અને અયૂર્ણ રીતે સચેતન અનું, છેક નીચેનું, ભૌતિક કાર્ય કરવા માટેનું સાધન રહે, અને છતાં આત્મા એક મહાન આવિભાવને સિદ્ધ કરી શકે, પણ આને પરિપૂર્ણ ન કલ્પી શકાય સંપૂર્ણ સીને સચેતન શરીર સાચી ભૌતિક પદ્ધતિને અને ભૌતિક રૂપાંતરની પ્રક્રિયાને શોધી કાઢી શકે અને કાપાન્વિત પણ જનાવી શકે. અબજત, ઓમ બને તે માટે, આત્માનો પરમ પ્રકાશ, શક્તિ, અને સર્જનાત્મક આનંદ વ્યક્તિત્વના ચેતનાના શિખર પર થયેલાં હોવાં જોઈએ. અને તેમણે પોતાના હુકમને શરીરમાં મોકલ્યો. હોવો જોઈએ.”

( અનિમનસસ્નો અદ્વિભાવ, પૃષ્ઠ ૧૫-૧૬ )

માતાજી, શરીરનું રૂપાંતર મન-પ્રાણના રૂપાંતર પછી આવશે કે તે સ્વર્યાંભૂ રીતે જાતે જ આવી જશે?

સામાન્ય રીતે આ પ્રકારનું રૂપાંતર ઉદ્ઘર્મમાંથી નીચે આવનું હોય છે, નીચેથી ઉદ્ઘર્મમાં નહિ.

સ્પષ્ટ છે કે જો તમે પૂરા ભૌતિકવાદી હશો તો તમે કહેશો કે રૂપનો વિકાસ નવીન શક્તિઓ પ્રગટ કરે છે. પણ તે વાત તદ્દન સાચી નથી. વસ્તુઓ મોટે ભાગે તે પ્રકારે બનતી હોતી નથી. હું તમને પડકાર હેંકું છું કે પ્રથમ મનનું રૂપાંતર સિદ્ધ કર્યા પહેલાં તમારા શરીરનું રૂપાંતર કરી બનાવો. પ્રયત્ન કરો, અમને જોવા દો!

મન વચ્ચે કાર્ય ન કરે, તો તમે આંગળી પણ હવાવી ન શકો, એક શરીરનું પણ ઉચ્ચારણ ન કરી શકો, એક હગલું પણ ન ચાલો શકો. તો પછી જે મનનું રૂપાંતર ન થઈ ચૂક્યું હોય, તો તમે કયા સાધન વડે શરીરનું રૂપાંતર કરી શકવાના હતા?

જો તમે પૂર્ણ અધ્યાત્મની સ્થિતિમાં રહો, જેમાં તમારું મન અત્યારે છે, તો તમારા શરીરના રૂપાંતરની આશા તરે કેવી રીતે રાખો શકો?

કેટલીક વાર માણસને શરીરમાં ખૂબ પ્રતિરોધ જણાય છે. તેનું કારણ શું છે? મન વચ્ચે પડતું નથી, પણ પ્રતિરોધ હોય છે. મોટામાં મોટો પ્રતિરોધ શરીરમાંથી આવતો હોય છે; ભૌતિકનો પ્રતિરોધ એક ખાસ પ્રકારનો હોય છે.

સૌથી મોટો પ્રતિરોધ ક્યાં છે? તમારા મહિતખુમાં (હસાહસ). આ કોઈ ખાસ કિસ્સો નથી. ધ્યાનિવાર ભૌતિક મન જ પરિવર્તન પ્રત્યે વધારેમાં વધારે પ્રતિરોધ કરતું હોય છે. તેને પોતાની શક્તિ માટે ખૂબ ખાતરી હોય છે, તે જરૂરી હોય છે, નહિ વારું? પોતાના અશાન પ્રત્યેના પ્રેમમાં, પોતાની વિચારણાના પ્રકારમાં, પોતાના અશાનના પ્રકારમાં ભૌતિક મન બહુ જ જરૂરી હોય છે.

બસ, પતી ગયું? કીક, તો પછી આપણે વાર્તાવાપ બંધ કરીશું.

હું તેના ઉપાય વિષે પૂછું છું.

ઓહ! ઓહ!... (વાંબા સમય સુધી મૌન)... એ તો ઉપાય છે.

\*

## ૧૯ મે ૧૯૫૭

“ દિલ્લી શરીરમાં દિલ્લી જીવન • આપણા આર્દ્ધની એ ફોર્મુલા છે. પૃથ્વી પર ઉત્કાંતિની પ્રક્રિયા ધીમી અને વિદ્યબન્ધુક્લ છે. રૂપાંતર, પ્રગતિકારક અથવા ઓચિતું પરિવર્તન થાય તે માટે ક્યા તત્ત્વે દરમિયાનગિયે કરવાની છે?

સારે જ, આપણી ઉત્કાંતિના પરિણામઢરે જ આપણે રૂપાંતરની શક્યતાને ગ્રામ કરી શક્યા છીએ. પ્રકૃતિ પદાર્થતત્ત્વમાંથી ઉત્કાંત બની, અને તેણે પ્રાણ-

તસ્વને પ્રગટ કર્યું. પ્રાણતત્ત્વમાંથી ઉત્કોઠ બનીને તેણે મન પ્રગટ કર્યું. તેજ રીતે, તેણે મનથી પર ઉત્કાંત થઈને, આપણા માનસિક અસ્તિત્વની અભૂત્તાભોધી તથા મર્યાદાઓથી મુક્ત એવા અસ્તિત્વની શક્તિને—ચેતનાને પ્રગટ કરવી જોઈએ. તે અતિમાનસ અથવા ઋત-ચેતના હોય, તે આત્માની શક્તિને તથા પરિપૂર્ણતાને વિકસાવવા સમર્થ હોય. અહીં આપણી ઉત્કાનિતનું નિયમને કે રીત એવાં નહીં હોય, કે જેથી પરિવર્તન ધીમું અને વિલંબયુક્ત બને. જ્યાં સુધી માનસિક અજ્ઞાન આપણા આરોહણને ચોટી રહે, તેમાં અવરોધ ઉભા કરે, ત્યાં સુધી જ ઓછાવતા પ્રમાણમાં તે પરિવર્તન ધીમું અને વિલંબયુક્ત બને. પણ એકવાર આપણે ઋત ચેતનામાં વૃદ્ધિ પામીએ, તો પછી અસ્તિત્વના આધ્યાત્મિક સત્યની શક્તિ જ બધું નક્કી કરી લેશે.

એમ પણ બને કે રૂપાંતર ક્રમશાસિદ્ધ થાય. માનસિક પ્રદેશની એવી શક્તિ ઓ છે, જે આપણી માનવ માનસિકતાથી પર રહેતા, વૃદ્ધિ પામતા સત્યની માત્ર શક્તયતાઓ જ છે અને જે લગવાબના પ્રકાશમાં અને શક્તિમાં ભાગીદાર હોય છે. આ ભૂમિકાઓમાં થઈને આપણા આરોહણમાં પણ તે ભાગીદાર હોય છે; તેઓ માનસિક અસ્તિત્વમાં ઘાણા અવરોધણ કરે એ ઉત્કાનિતનો સ્વાલ્પાવિક ક્રમ હોય છે. પણ વ્યવહારમાં એમ નંદ્યાય છે કે આ વચ્ચાળાની ભૂમિકાઓ સમગ્ર રૂપાંતર માટે પર્યાપ્ત નથી, કારણ કે તે માનસિક અસ્તિત્વના પ્રકાશમય શક્તયતાઓ છે, તેના પૂરા અર્થમાં તે અતિમાનસ નથી હોતી. તેઓ મન માત્ર આંશિક દિવ્યતા લાવી શકે અથવા મનને તેની પ્રત્યે ઊધર્યો કૃત બનાવી શકે; પણ ઋતચેતના પરિપૂર્ણ અતિમાનસિકતામાં તેનું ઊધર્યો કરણ સિદ્ધ ન કરી શકે. છતાં આ ભૂમિકાઓ આરોહણની કમિક અવસ્થાઓ બની શકે. જેમને કેટલાક પહોંચી શકે અને ત્યાં અટકી જાય, જ્યારે બીજાઓ વધારે ઊધર્યો અર્થમાં જાય, અર્ધદિવ્ય અસ્તિત્વની ઉચ્ચાતર ભૂમિકાઓને પ્રાપ્ત કરે અને તેમાં જોડે. એમ માની લેવાનું નથી કે સમગ્ર માનવજી સમૂહરૂપે અતિમનસ્માં પહોંચી જશે.”

( અતિમનસ્નો આવિભાવ, પૃષ્ઠ ૨૦-૨૨ )

આજે સાંજે આ પ્રગતિશીલ રૂપાંતર વિષે છું, તમને વાત કરવાની છું. ધ્યાનીવાર પૂછવામાં આવ્યું કે—“આપણે એક આર્થિક સિદ્ધાંત સ્થાપિત કર્યો છે કે જ્યારે આપણે આપણા કશીર સાથે કામ લઈએ, ત્યારે આપણે તેવા શાનપૂર્વક તેમ

કરવું જોઈએ કે શરીર વિશની પરમ વાસ્તવિકતાનું, આપણા અસ્તિત્વના સત્યનું પરિણામ અને સાધન માત્ર છે. આ સત્યનો સાક્ષાત્કાર કરવાનો છે એમ શિખવાં ડ્યા પછી, આપણા આજામમાં ડોક્ટરો, દ્વાખાનાં, આધુનિક સિલ્ફાંતો પર સ્થાપિત એવી શારીરિક કેળવણી થા માટે છે? જ્યારે તમારામાંના કેટલાક વન-લોજન માટે બહાર જાઓ છો, ત્યારે હું તમને ગમે ત્યાંથી પાણી પીવાની મનાઈ થા માટે કરું છું? થા માટે હું તમને ફિલ્ટર કરેલું (ગાળેલું) પાણી સાથે લઈ જવાનું કરું છું? તમે જે ફોન ખાચો છો, તેમાંથી ચેપ કાઢી નાખવા માટે હું થા માટે દવાઓનો ઉપયોગ કરું છું? વગેરે.

આ બધું વિરોધી લાગે છે. પણ આજે સાંજે હું તમને તે વિરોધી લાગણી તમારામાંથી દૂર થઈ જાય તેવી સમજૂતી આપવા માગું છું. હકીકતમાં મેં તમને અનેક વાર કહ્યું છે કે જ્યારે જે વિચારો અથવા સિલ્ફાંતો એક બીજાથી વિરોધી દેખાય, ત્યારે તમારે તમારા વિચારમાં જરાક ઉદ્ઘર્ભમાં જવું જોઈએ, અને જ્યાં તે વિરોધી એક વિશાળ સમન્વયમાં એકઠા મળે છે. તે બિંદુને, થાથી કાઢવું જોઈએ.

અહીં એક વસ્તુ જાણવાથી બધું સુગમ બની જશે. અને તે એ કે આપણા શરીરને આપણે ટકાવી રાખવા માટે, તેને સુસ્થિતિમાં રાખવા માટે, તેમાં સુધારણા કરવા માટે, તેને નીરોગી રાખવા માટે આપણે જે પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, તે માત્ર આપણી ચેતનાની સિદ્ધતિ ઉપરની આધાર રખે છે, કરણ કે આપણું શરીર આપણી ચેતનાનું કરશું છે, આપણી ચેતના સીધી રીતે તેના પર કાર્ય કરી શકે છે, અને પોતે જે ઈચ્છે છે તેને તેની પાસેથી પ્રાપ્ત કરી શકે છે.

જે તમે સામાન્ય શારીરિક ચેતનામાં હશો, જે તમે સામાન્ય શારીરિક ચેતનાની આંખો વડે વસ્તુઓને જોતા હશો, જે તમે સામાન્ય શારીરિક ચેતના વડે તેમને વિષે વિચાર કરતા હશો, તો તમારે તમારા શરીર પર કાર્ય કરવા માટે સામાન્ય ભૌતિક (શારીરિક) સાધનોનો ઉપયોગ કરવો પડશે. આ ભૌતિક સાધનો સમગ્ર વિજ્ઞાનમાં એકન્તિત કરાયાં છે, જે વિજ્ઞાને માનવ અસ્તિત્વનાં હજરો વર્ષો દરમિયાન તેમને એકન્તિત કર્યાં છે. આ વિજ્ઞાન બહુ જટિલ છે, તેની પ્રક્રિયાઓ અસંખ્ય, ગૂંચ-પાડાબરેલી, અનિશ્ચિત, ધસ્તી વાર પરસ્પર વિરોધી, હર્મેશાં, પ્રગતિશીલ, અને લગ-ભગ તદ્દન સાપેક્ષ છે! છતાં બહુ નિશ્ચિત પરિણામો પ્રાપ્ત કરવામાં આવ્યા છે. જ્યારથી શારીરિક કેળવણીમાં માણસો ગંભીરતાપૂર્વક રસ બેતા થયા છે, ત્યારથી

અમુક સંખ્યામાં પ્રયોગો, અધ્યયનો, અવલોકનો વધતાં ગયાં છે, જેને પરિણામે આદ્યારનું, કિયાઓનું, કસરતનું જીવનના સમગ્ર બાધ સંગળનું નિયમન કરી શકીએ છીએ, અને એક પર્યામ પાયો સ્થાપી શકીએ છીએ કે જે બોકો આ વસ્તુઓનું અધ્યયન કરવાનો અને કડકાઈપૂર્વક તેમને અનુરૂપ બનવાનો પ્રયત્ન કરશે, તેમનું શરીર આરોગ્યમય બનશે, તેઓ શરીરની જોડાંપણોનું નિવારણ કરી શકશે, શરીરની સામાન્ય સ્થિતિ સુધારી શકશે, અને નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કરી શકશે.

હું ઉમેરીશ કે આ બૌધ્ધિક માનવ વિજ્ઞાન, સત્યને શોધવા માટેના તેના સાચા દિલના પ્રયાસોમાં, આશર્વણક રીતે પર્યામ છે. તે આત્માના તાત્ત્વક સત્યની વધારે જો વધારે નજીક પહોંચનું જાય છે. આ બંને તાત્ત્વક સત્યની એક ખૂબ ગફન અને નિકટની સમજૂતિમાં એક બીજા સાથે સંપુર્કત થશે તે ગતિનું પૂર્ણદર્શને કરવું તે અશક્ય નથી.

એટલે જે બોકો શારીરિક લૂભિકા પર જીવે છે, બૌતિક ચેતનામાં જીવે છે, તેમણે શરીર સાથે કામ બેતી વખતે બૌતિક સાધનોનો અને પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો પડશે. આશમમાં પણ મોટા ભાગના બોકો તદ્દન શારીરિક ચેતનામાં, અથવા તો મહદ્દી શારીરિક ચેતનામાં જીવે છે; એટલે શરીરની દરકાર રાખવા માટે બૌતિક વિજ્ઞાને જે સિદ્ધાંતો વિહિત કરેવા છે તેમને અનુસરવું અને તેમનું પાલન કરવું તે તેમને માટે તદ્દન સ્વાભાવિક છે.

ક્રી અરવિંદ આપણને શિખવે છે તે મુજબ, આ આખરી સાક્ષાત્કાર નથી, આપણે તે આદર્શને પહોંચવા માગતા નથી. આના કરતાં એક ઉચ્ચતર સ્થિતિ છે; જેમાં ચેતના જો કે તે હજુ, મુખ્યત્વે અથવા આંશિક રીતે, પોતાના કાર્યમાં માનસિક હોય છે. છતાં પણ આધ્યાત્મિક જીવન માટેની અભીષ્ટામાં ઉચ્ચતર પ્રત્યે અને અતિમાનસ અસર પ્રયોગ ખૂલ્લી હોય છે.

ત્યારે આ ખુલ્લાપણું આવે છે, કે તરત જ માણસ જીવન જેમા ક્રેવલ બૌતિક હોય છે તેનાથી પર ચાલ્યો જાય છે. હું 'બૌતિક' માં સમગ્ર માનસિક અને બૌધ્ધિક જીવનનો અને ખૂબ નોંધપાત્ર માનવ સિદ્ધિઓનો સમાવેશ કરું છું. હું તે બૌતિકની પાત કરું છું કે જે માનવ શક્તિઓનું, પાર્થીન અને બૌતિક જીવનનું શિખર છે, જેમાં માણસ, માનસિક અને બૌધ્ધિક દૃષ્ટિબિંદુથી, ઉચ્ચતર પ્રકારના

મુલ્યોને અભિવ્યક્ત કરી શકે છે. માસુસ તે સ્થિતિથી પર જઈ શકે છે, અત્યારે પૃથ્વી પર કાર્ય કરતી અતિમાનસ શક્તિ પ્રયો પોતાની જતને ખુલ્લી કરી શકે છે, અને એક પરિવર્તનમય પ્રદેશમાં પ્રવેશ કરે છે, જ્યાં બે અસરો મળે છે એક-બીજાને બેદ છે, જ્યાં ચેતના હજી સુધી પોતાના કાર્યમાં માનસિક અને બૌધ્ધિક છે, પણ અતિમાનસ શક્તિનો તે બનેમાં પર્યામપણે પ્રવેશ થયેલો હેય છે, જેવી તે ઉચ્ચતર સત્યનું કરશું બની શકે.

અત્યારે, જે વોકોએ પ્રંગટ થતી અતિમાનસ શક્તિને જીવંતા માટે પોતાની જતને તૈયાર કરી હોય છે; તેઓ જ પૃથ્વી પર આ સ્થિતિને સિદ્ધ કરી શકે છે. તે સ્થિતિમાં તે ચેતનાની સ્થિતિમાં, પહેલાંના કરતાં ખૂબ વધારે સારી સ્થિતિમાંથી લાભ મેળવી શકે છે. શરીરને અસ્તિત્વના તાત્ત્વિક સત્ય સાથે સીધા સંપર્કમાં મૂકી શકાય છે, અને તે પણ એટલી માત્રામાં કે જે કાંઈ કરવાનું છે તેને તે શરીર સ્વર્યાભૂ રીતે, વૃત્તિજીવન્ય રીતે હર કાણે જાણે છે અને તેને સિદ્ધ કરી શકે છે.

હું કહું છું તેમ, અત્યારે આ સ્થિતિ માત્ર તેજ વોકો સિદ્ધ કરી શકે છે કે જેઓ અતિમાનસ શક્તિને સ્વીકારવા માટે, તેને આત્મસાત્ત્બ કરવા માટે, અને તેની આજ્ઞાનું પાલન કરવા માટે, પોતાની જતને તૈયાર કરવા જહેમત ઉંઘાવે છે.

અવબસ, આ સ્થિતિ કરતાં એક ઉચ્ચતર સ્થિતિ છે, જેને શ્રી અરવિંદ આપણે સિદ્ધ કરવાનો આદેશ આપે છે. દિવ્ય શરીરમાં દિવ્ય જીવન. પણ તે પોતે જ આપણને કહે છે કે આને સમય લાગશે; તે એક પરિપૂર્ણ રૂપાંતર છે, જે એક કાળજીમાં સિદ્ધ શઈ શકતું નથી. તે ખૂબ વધારે સમય પણ વે. પણ જ્યારે તે સિદ્ધ થયે, જ્યારે ચેતના અતિમાનસ ચેતના બની જશે, ત્યારે કાર્યનો નિર્ણય હર કાણે માનસિક પરસંદર્ભી દ્વારા નહિ થાય અથવા તે શારીરિક શક્તિ ઉપર આધાર નહિ રાખે. સમગ્ર શરીર, સ્વર્યાભૂ રીતે, સમગ્ર રીતે, આંતર સત્યની પરિપૂર્ણ અભિવ્યક્તિ બની રહેશે.

આપણે આ આદર્શને આપણી સમક્ષ રાખવાનો છે, જેના સાક્ષાત્કાર માટે આપણે પ્રયાસ કરવાનો છે. પણ આપણે આપણી જતની પ્રતારણ કરીને એમ ન માની બેનું જોઈએ કે તે એક જરૂરી રૂપાંતર હશે? ચમત્કારિક, હમણાં જ બને તેનું, અદભૂત રૂપાંતર હશે, જે પ્રયાસ અને પરિશ્રમ વગર સિદ્ધ શઈ શકશે.

છતો, તે માત્ર એક શક્યતા નથી, દૂર-સુદૂરના ભાવિ માટેનું વચન માત્ર નથી; તેનું નિર્માલું થઈ રહ્યું છે. માણસ તે કાસુનું માત્ર પૂર્વર્દ્ધન જ નહિ, પણ અનુભવ પણ કરી શકે, જ્યારે જેમ આત્માએ ક્યારનું એ કર્યું છે તેમ, શરીર, સમગ્ર શીતે અસ્તિત્વના એક સૌથી વધારે આધ્યાત્મિક ભાગની અનુભૂતિનું પુનરાવર્તન કરવા સમર્થ બનશે, પોતાની શારીરિક ચેતનામાં પરમ વાસ્તવિકતા સમજી ઓછું રહી શકશે. પોતાના સર્વ કોણાણુંઓના સંપૂર્ણ આત્મસમર્પલમાં સંપૂર્ણ પણ તેના પ્રત્યે વળીને દિવની સચ્ચાઈપૂર્વક કહેશે કે “કેવળ, પરિપૂર્ણ શીતે, અનંત શીતે, સનાતન કામ માટે, તદ્દન સરલતાપૂર્વક તારાડૃપ બનાવવા માટે.” \*

## ૫ જુન ૧૯૫૭

તમારે કોઈ પ્રશ્ન પૂછવાના છે? ના?

વહાલાં માતાજી, જે પ્રશ્નો સ્વયંલૂ શીતે ઉભા નથી થતા, તે પૂછવા જોઈએ?

સ્વયંલૂ શીતે ન ઉભા થતા પ્રશ્નો નો તમે હો અર્થ કરો છો?

ધ્યાન લાગે, કે અમે વર્ગમાં સવાલો પૂછતા હોતા નથી, તો તમે કશું જ કહેતાં નથી. તેથી અમારે ખૂબ વિચાર કરીતે પ્રશ્નો પૂછવા પડે છે!

તે તો તમને જે પ્રશ્ન જડે તેના પર આધાર રાખે છે. તમે પ્રશ્ન શોધી કાઢવા પ્રયત્ન કરો છો, તેથી કાઈ તે ખરાબ હોય એવું નથી. આ તો એક રસ-પ્રદ બીના કહેવાય.

તમારે એ પ્રકારનો કોઈ પ્રશ્ન પૂછવાનો છે?

ના

(લાંબા વખત સુધી મૌન)

જે કોઈ શ્રી અરવિંદે જે કાંઈ લખ્યું છે તે ધ્યાનપૂર્વક વાચે તો તેને દરેક સવાલનો જવાબ મળ્યો રહે. પણ અમૃત ક્ષણો અને વિચારો રજૂ કરવાની અમૃત રીતો હોય છે જે ચેતના ઉપર સંકિય અસર પેદા કરે છે અને તમને આધ્યાત્મિક પ્રગતિ કરવામાં મદદ કરે છે. રજૂઆત અસરકારક બનાવવા માટે, ચોક્કસ એક સીધી અનુભૂતિની સ્વર્ણલ્લું અભિવ્યક્તિ હોવી જોઈએ. જે વસ્તુઓ ભૂતકાળમાં કહેવાઈ ગઈ છે. જે ભૂતકાળની અનુભૂતિની હોય છે, તેમનું જે પુનરાવર્તન તે જ રીતે કરવામાં આવે તો તે એક પ્રકારના ઉપદેશાત્મક વાતાવરણ બની જાય છે, તેથી મસ્તિષ્કનાં અમૃત કોશાઘુંઓ ગતિમાન બને છે, પણ હકીકતમાં તે બહુ ઉપયોગી નથી હોતું.

હું જે કરતા પ્રયત્ન કરી રહી છું, તેમાં હમેશાં મૌનમાં કાર્ય વધારે મહત્વનું હોય છે. કાર્ય કરી રહેલી થકિત શબ્દોથી મર્યાદિત નથી બનતી; આ તેને અનંતગણ્ય વધારે બળ આપે છે; તે પોતાની જતને દરેક ચેતનામાં, તેના ખાસ પ્રકાર અનુસાર, પોતાની જતને અભિવ્યક્ત કરે છે. જે તેને અનંતગણ્ય અસરકારક બનાવે છે. અમૃત નિશ્ચિત પરિણામ લાવવા માટે, ખાસ હેતુપૂર્વક, મૌનમાં અમૃત આકંપન મોકલવામાં આવે છે. પણ દરેક માણસની માનસિક ગ્રહણશીલતા અનુસાર, તે દરેક વ્યક્તિની ચેતનામાં બરાબર તે જ રૂપમાં અભિવ્યક્ત થાય છે, જે ખૂબખૂબ અસરકારક બની શકે, ખૂબ સંકિય, દરેક વ્યક્તિને ખૂબ ઉપયોગી બની શકે; જે તેને શબ્દોની ફોર્માલામાં કહેવામાં આવે, તો દરેક માણસે તે ફોર્માલાને તેની નિશ્ચિતતામાં સ્વીકારવાની રહે છે, તે શબ્દોએ આપેલી નિશ્ચિતતા હોય છે. તે પોતાના ખૂબ બળને અને ક્રિયાની પરિપૂર્ણતાને ગુમાવી બેસે છે. કારણકે એક તો શબ્દોને હમેશાં યથાર્થ રીતે સમજાવવામાં આવતા હોતા નથી, અને બીજું કે તે શબ્દો દરેક જણની સમજ થકિતને અનુરૂપ બનાવેલા હોતા નથી.

એટલે મારા મત અનુસાર, જે પ્રશ્ન એક નવાં ફોર્માલામાં અભિવ્યક્ત થઈ શકે તેવી અનુભૂતિને તરત ઉત્પન્ન ન કરતો હોય, તો મૌન રાખવું એ વધારે સારું છે. જે પ્રશ્ન જીવંત હોય, તો જ તે એવી અનુભૂતિને ઉત્પન્ન કરે કે જે એક જીવંત ઉપદેશ માટે પ્રસંગરૂપ બને. પ્રશ્ન જીવંત ત્યારેજ કહેવાય કે જયારે તે પ્રગતિ માટેની કોઈ આંતર જરૂરિયાતને વાચા આપી શકતો હોય. માનસિક અથવા તો બીજી ભૂમિકા પર પ્રગતિ કરવા માટેની સ્વર્ણલ્લું જરૂરિયાતને વાચા આપી શકતો હોય. પણ જે અકસ્માત તે આંતર અભીભ્વાને, પોતે જેનો ઉકેલ

લાવવા મથે છે તેવી સમસ્યાને વાચા આપતો હોય, તો તે પ્રશ્ન રસપ્રદ અને જીવંત જની જય છે. તે એક દર્શનને, ઉચ્ચતર લૂભિડા ઉપર કોઈ દર્શનને, ચેતનામાં કોઈ અનુભૂતિને પેદા કરે છે, જે ફોર્મ્યુલાને નવીન બનાવી દે છે, જેથી તેનામાં સાક્ષાત્કાર માટેની એક નવીન શક્તિ આવેલી હોય છે.

તેવા કિસ્સાઓને બાદ કરીએ તો હું હંમેશાં મૌન રાખવાનું વધારે સારું માનું છું, ધ્યાનની થોડી કાણો હંમેશાં બહુ ઉપયોગી નીવડતી હોય છે.

શરૂઆતમાં હું જે વાચન કરું છું, જેણે વિચારને અમુક નીકમાં વહેવડાવવો જોઈએ, વિચારને અમુક સમસ્યા પર અથવા અમુક વિચારો પર, અથવા વાચેલા ફકરાની સમજૂતિની નવીન શક્યતા પર કેન્દ્રિત કરવો જોઈએ. હકીકતમાં, વાચન પછી કરતા મૌનમાં તે ધ્યાનનો વિષય બની જવો જોઈએ.

બોલવા ખાતર બોલવું એ જરા પણ રસપ્રદ નથી. તેને માટે તો નિશાળો હોય છે! અહીં તેમ કરવામાં આવતું હોતું નથી.

પણ વહાલાં માતાજી, જ્યારે તમે બોલો છો, ત્યારે તેવું નથી હોતું!

( મૌન )

( બીજો બાળક ) માતાજી, જ્યારે તમે બોલો છો, ત્યારે અમે મન વડે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ જ્યારે તમે મૌનમાં કશું સંકાંત કરતાં હો છો ત્યારે અમારે અસ્તિત્વના કયા ભાગ પર એકાગ્રતા કરવી જોઈએ?

ધ્યાન માટે તે હંમેશાં વધારે સારું છે. પણ તેનો અર્થ એવો નથી કે મસ્તિષ્ણની આસપાસ વિચારોને ફેરબ્યા કરવા તેથી તદ્દન ઊંબડું જ કરવાનું હોય છે. અભીભ્વાના કેન્દ્રમાં, જ્યાં અભીભ્વાની જવાલા જવાતી હોય ત્યાં, સૂર્યચકમાં સર્વ શક્તિઓને એકત્રિત કરવી અને એકાગ્ર સાવધાન મનને પ્રામ કરતું તે હંમેશાં વધારે સારું છે. તે મૌન એવું હોતું જોઈએ કે જાણે માણસ કોઈક ખૂબ સૂક્ષ્મ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવા ન માગતો હોય, કે ને ધ્યાન સંપૂર્ણ એકાગ્રતાની,

ધ્યાનની, મૌનની માગણી કરે છે. પછી જરા પણ હાલવું ચાલવું નહિ, વિચાર ન કરવો, હાલવું નહિ, અને સ્વીકારી શકાય તેવી બધી વસ્તુ પ્રત્યે ખુલ્લા બનવું. પણ તેમાં જે બને તે શા માટે બને છે તે જાણવા પ્રયાસ ન કરવો, કરણ કે જ્યારે માણસ સહિક રીતે સમજવાનો અથવા અવલોકન કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેના મસ્તિષ્કની કિયા ચાલુ રહેતી હોય છે. જે સ્વીકૃતિની પરિપૂર્ણતા માટે પ્રત્યક્ષુળ છે. યથાશક્ય સંપૂર્ણ મૌન બનો, એકાગ્ર ધ્યાનમાં મૌન બનો.

જ્યારે માણસ આ પ્રકારના મૌનમાં - ધ્યાનમાં સહૃદી બને છે, ત્યારે ધ્યાન ધૂટ્યા પછી - થોડાક સમય પછી, ચેતનામાં કોઈક નવીન વસ્તુ પ્રગટ થાય છે. નવીન સમજ, વસ્તુઓનું નવીન મૂલ્યાંકન, જીવનમાં એક નવીન વલસુ, ટૂંકમાં અસ્તિત્વનો એક નવીન પ્રકાર; આ વસ્તુ છટકી જાય તેવી હોય; નજીકની સાચી સમજ હોઈ શકે અથવા રૂપાંતરની શક્તિ હોઈ શકે જે તેમને પણ તે કણે માણસ જે અવલોકન કરે, તો તેને જાણ્યા કે, સમજના અથવા રૂપાંતરના માર્ગ પર કોઈક વસ્તુએ એક ડગલું આગળ ભર્યું છે. તે પ્રકાશ હોઈ શકે, સત્યની માનસશાસ્ત્રીય પ્રગતિ ચેતનાની વિસ્તૃતતા, તમારી ગતિઓ ઉપર - અસ્તિત્વની કિયાઓ પર વધારે કાળું સિલ્ફ કરવામાં મદદ કરે છે.

આ પરિણામો કદી એકદમ આવતાં હોતાં નથી. જે માણસ તે પરિણામોને જલ્દી પ્રામ કરવા પ્રયત્ન કરે, તો તેને કિયાની સ્થિતિમાં રહેવું પડતું હોય છે, જે સાચા ખુલ્લાંપણાંથી તદ્દન વિરુદ્ધની વસ્તુ છે. માણસે તદ્દન તટસ્થ, સ્થિર, યથાશક્ય નિષ્ઠિક રહેવું જોઈએ. તેની પીઠમાં મૌન અભીભ્વસા રહેવી જોઈએ, જેને શરૂદોમાં વિચારોમાં કે લાગણીઓમાં જોઈવાની હોતી નથી. કંઈક આમ કરવાનું (ઉપર ચઢતી જવાલા જેવો અભિનય); તેમાં ઉત્કટ આકંધન હેવું જોઈએ, પણ તેને કોઈ ફોર્મ્યુલામાં જોઈવાનું નથી, તે પોતાની જતને સમજવાનો પ્રયત્ન કરતું નથી.

થોડાક અભ્યાસથી માણસ એક એવી સ્થિતિમાં પહોંચી જય છે, કે જે સ્થિતિને મરજી પડે ત્યારે થોડીક કણેઓમાં પ્રામ કરી શકાય છે. અર્થાત તે માણસ ધ્યાનના સમયનો બગાડ કરતો નથી. સ્વાભાવિક રીતે જ, પ્રારંભમાં માણસે મનને ધીમે ધીમે શાન્ત કરવું પડશે, પોતાની ચેતનાને એકન્તિત કરવી પડશે, એકાગ્રતા કરવી પડશે. માણસ ધ્યાનનો પોતો ભાગ તો તૈયારો કરવામાં ગુમાવતો હોય છે.

— પણ અભ્યાસ કર્યા પછી, માસુસ બે કે ત્રણ કલેશમાં એ સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે, અને પછી ખુલ્લાપણના સમગ્ર સમયનો લાભ તેને મળે છે.

સ્વાભાવિક રીતે નં, હજુ પણ વધારે પ્રગતિમાન અને પરિપૂર્ણ સ્થિતિઓ છે, પણ તે પાછળથી આવે છે, પણ જો માસુસ તે સ્થિતિને પહોંચે તો તેને ધ્યાનનો પૂર્ણ લાભ મળે.

તેને માટે આપણે પ્રયત્ન કરીશું

( ધ્યાન )

૧૨ જુન ૧૯૪૭

“ખૂબ લાંબા સમય સુધી ઉપવાસ કરીએ ત્યારે પણ આન્માની, મનની, પ્રાણની, અને શરીરની પણ કિયાઓને તથા શક્તિઓને પૂર્ણ રીતે ટકાવી રાખવી; બધી સમય યોગમાં એકાગ્ર અને જાગૃત રહેવું, ડિંડો વિચાર કરવો અને રાત-દિવસ વેખો લખવા, નિદ્રા વગર ચલાવી લેવું, દિવસના આઠ કલાક ચાલવું આ બધી કિયાઓ વારાફરી અથવા એકસાથે કરવી, અને છતાં નિર્બળ ન બનવું, થાક ન લાગવો, કોઈપણ પ્રકારની નિષ્ફળતા કે કીસુતા ન અનુભવવી એ સાચેજ શક્ય છે. ઉપવાસના અંગે પહેલાંના જેટલો જ અથવા તેથી વધારે પણ જોરાક લઈ શકાય અને તેમાં કોઈ સાપ્ચેતી રાખવાની જરૂર ન પડે જેને વિષે દાક્તારી વિજ્ઞાન સલાહ આપે છે. જ્ઞાને કે પૂર્ણ ઉપવાસ અને પૂર્ણ મિજબાની એને તદ્દન સ્વાભાવિક સ્થિતિઓ ન હોય, ઉપવાસની સ્થિતિમાંથી તદ્દન સરળતાપૂર્વક મિષ્ટાન્ન-ભોજન પ્રત્યે જઈ શકાય છે. જો એક પ્રકારના પ્રાથમિક રૂપાંતર દ્વારા શરીરને યોગની શક્તિઓનું તથા કિયાઓનું કરસું બનવાની તાતીમ આપવામાં આવી હોય. પણ તેમાં શરીરના ભૌતિક

નંતુઓની, માસની પદાર્થતત્ત્વની ક્ષીણતામાંથી છટકી શકતું નથી. જે કોઈ વ્યવહાર ઉપાય અને સાધન શોધી કાઢવામાં આવે તો આ છેલ્લા અજ્ઞય વિધનને પણ પાર કરી શકાય અને ભૌતિક પ્રકૃતિની શક્તિઓની તથા શરીરની શક્તિઓની અદલાબદ્ધિથી, જેમાં વ્યક્તિત્વ પ્રકૃતિને તેની જરૂરિયાત અનુસાર આપે અને પ્રકૃતિના વૈશ્વિક અસ્તિત્વને ટકાવી રાખે તેવી શક્તિઓમાંથી વ્યક્તિત્વ સોધી શેને પોતાને જરૂરી સામગ્રી આપણે જવનની ઉત્કાન્તિના પાયામાં જે વસ્તુ જોઈએ છીએ તેને ઉત્કાન્તિના શિખર પર ફરી શોધી કાઢી શકાય અને સ્થાપિત કરી શકાય-પોતે ટકી રહે તે માટે પોતાના નવીનીકરણ માટેના સાધનો સર્વ આસપાસની વસ્તુઓ-માંથી જેંચી લેવાની શક્તિ અથવા આસપાસના વાયુમંડળમાંથી તે સાધનોને જેંચવાને બદલે, ઉત્કાન્તિ થયેલો માનવ ઉધ્વર્માંથી વધારે મહાન શક્તિ પ્રાપ્ત કરી શકે, આસપાસથી અને નીચેથી પણ.”

( અતિમનસનો આવિલ્લિવ, પૃષ્ઠ ૨૮-૨૯ )

ક્રી અરવિદ અહીં જે વાંબા ઉપવાસનું અને છતાં સર્વ કિયાઓ ટકાવી રાખવાનું વર્ણન આપે છે, તે તેમના પોતાના અનુભવનું વર્ણન છે.

તે શક્યતાની વાત નથી કરતા, પણ પોતે જે કર્યું હતું એની વાત કરે છે. પણ તે અનુભવનું તેના બાબુ રૂપમાં અનુકરણ થઈ શકે એમ માનવું એ એક મોટી ભૂલ છે જે કોઈ સંકલ્પના બણથી તેમ કરી શકે, તો પણ આધ્યાત્મિક દ્વિદ્વિદુથી તે તદ્દન બિનઉપયોગી બને, કારણ કે તે અનુભવની પહેલાં ચેતનાનું પરિવર્તન થયેલું હોવું જોઈએ, કે જે પ્રાથમિક મુક્તિ છે.

ઉપવાસથી તમે આધ્યાત્મિક પ્રગતિ સાધી ન શકો તે માટે તમારે માત્ર આસક્તિથી, સર્વ કામનાઓથી, જોરાકના રસમાંથી મુક્ત બનવાનું છે એટલું જ નહિ, પણ તેની જરૂરિયાતથી પણ મુક્ત બનવાનું છે. તમારે એવી સ્થિતિ પ્રાપ્ત કરવાની હોય છે કે જેમાં આ બધી વસ્તુઓ તમારી ચેતનાને પરદેશી-અપરિચિત લાગે અને તેમને માટે કોઈ સ્થાન ન હોય. ત્યારે જે એક સ્વયંભૂ સ્વાભાવિક પરિણામરૂપે, તમે ખાવાનું બંધ કરી શકો એમ કહી શકાય કે ખાવાનું ભુલી જવું એ અનિવાર્ય શરત છે, કારણ કે અસ્તિત્વની બધી શક્તિઓ અને તેની એકાગ્રતા વધારે સંપૂર્ણ, વધારે સાચા આંતર સાક્ષાત્કાર પ્રત્યે વળેલી હોય છે. આ શરીરના

ક્રોષાલુઓ સહિત સમગ્ર અસ્તિત્વને દિવ્ય શક્તિઓનાં આકંપનો સાથે એકરૂપ કરવા પ્રયોગ વળેલી હોય છે, પ્રગટ થતી અતિમાનત્વ શક્તિ સાથે એકત્તા સ્થાપવા તરફ વળેલી હોય છે, જેથી આ જીવન સત્ય બની શકે, માત્ર જીવનનો હેતુ જ નહિ, પણ જીવનનું સારતત્ત્વ, માત્ર જીવનની અનિવાર્ય જરૂરિયાત જ નહિ, પણ તેનો સર્વ આનંદ અને સર્વ હેતુ.

જ્યારે આ સાક્ષાત્કાર સીધી થયો હોય છે, ત્યારે ખાંધું કે ન ખાંધું, ઊંઘું કે ન ઊંઘું, આ બધાનું કોઈ મહત્વ રહેતું નથી. તે એક બાધ્યતર છંદોમયતા છે, જેને વૈજ્ઞાનિક શક્તિઓની લીલા પર છોડી દેવામાં આવી હોય છે. અને જે તમારી આસપાસના લોકો અને સંજોગો દ્વારા અભિવ્યક્ત કરવામાં આવતી હોય છે. ત્યારે આંતર સત્ય સાથે એકરૂપ બનેલું શરીર ચપળતા, સતત અનુરૂપ બનવાની શક્તિને પ્રાપ્ત કરે છે. જે બોજન આવી પડે, તો તે ખાય છે. જે બોજન ન આવી પડે, તો તેને તેનો કંધો વિચાર આપતો હોતો નથી. બીજી બધી વસ્તુઓની બાબતમાં પણ તેમ જ બનનું હોય છે. આ જીવન નથી! તે અસ્તિત્વ ધરાવવાની એવી રીતો છે કે તેમને વિષે વિચાર કર્યા વગર તમે એમને અનુરૂપ બની જાઓ છો. જેમ પુષ્પ છોડ પર ખીલે છે, તેવી ખીલવાની કોઈક લાગણી તમે અનુભવો છો. તે એકાગ્ર બનેલા સંકલ્પમાંથી આવતી કિયા જેવું નથી હોતું, પણ તે તમારી આસપાસની સર્વ શક્તિઓ સાથે સંવાદિતામાં છે. તમે જે સંજોગોમાં જોવો છો તેને અનુરૂપ અસ્તિત્વનો એક પ્રકાર છે. જે સંજોગોને પોતામાં કર્યું મહત્વ હોતું નથી.

એવી એક કાળું આવે છે, જ્યારે તે માણસ બધી વસ્તુઓથી સ્વતંત્ર બની જાય છે, તેને કથાની જરૂર પડતી હોતી નથી, તે ગમે તે વસ્તુનો ઉપયોગ કરી શકે છે, જમે તે વસ્તુ કરી શકે છે અને છતાં તેની ચેતના પર તેની કશી અસર પડતી હોતી નથી. આ બહુ મહત્વની સ્થિતિ છે. ઉચ્ચતર જીવન માટેની અભીષ્ટા કરતી માનસિક ચેતનામાંથી આવતા સ્વર્ચંદ્રી નિર્ણયો અથરા બાધ અભિનયો દ્વારા તે સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો એ સાધન હોઈ શકે, બહુ અસરકારક સાધન તો નહિ જ; તે પ્રયત્ન અસ્તિત્વને યાદ દેવરાવે છે કે તું તારી પશુનામાં જે છે, તેનાથી તરે કોઈ બીજી જ વસ્તુ બનાં જોઈએ, પણ એટલું જ માત્ર બસ નથી. જે માણસ પોતાની આંતર અભીષ્ટામાં સંપૂર્ણપણે નિમગ્ન બની શકે, આ બધી બાધ વસ્તુઓની દરકાર તેને ન રાખવી પડે, તેમનો વિચાર સરખો પણ તેને ન આવે, જે આવી પડેલી વસ્તુને સ્વીકારે અને ન આવેલી વસ્તુનો વિચાર

સુધ્યાં ન કરે, તે સાક્ષાત્કાર પ્રાપ્ત થશે એવા જ્યાલથી તપસ્યા કરનાર માણસ કરતાં આધ્યાત્મિક માર્ગમાં અનંતગણે આગળ વધેલો ગણ્યાય.

માત્ર ચેતનાનું પરિવર્તન ઓજ સાચી રીતે અસરકારક વસ્તુ છે, તે અતિમાનસ શક્તિઓમાં આકંપનો સાથે સધન, સતત, પરિપૂર્ણ, અનિવાર્ય મિલન દ્વારા પ્રાપ્ત થતી આંતર મુક્તિ છે. દરેક ક્ષણનો ઈરાદો, અસ્તિત્વનાં સર્વ તત્ત્વોનો સંકલ્પ, શરીરનાં કોષાળુઓ સહિત સમગ્ર અસ્તિત્વની અભીષ્ટા, આ અતિમાનસ દિવ્ય શક્તિઓ સાથેના મિલન માટે હોય છે, પછી પરિણામોની દરકાર કરવાની જરૂર રહેતી નથી. જે વસ્તુ વૈશ્વિક શક્તિઓની લીલામાં અને તેમના પ્રગતી-કરણુભાં જનવાની છે, તે સ્વાભાવિક રીતે જી, સ્વયંભૂ રીતે આપોઆપ થઈ રહેશે. તેનો વિચાર કરવાની કથી જરૂર નથી. અતિમાનસ ચેતનાનાં શક્તિપ્રકાશ-સત્ય-બળ અને અનિવાર્ય નીચ આનંદ સાથે સતત, સમગ્ર, પરિપૂર્ણ સંપર્ક ઓજ મહત્વની વસ્તુ છે.

તે દિવની સર્વચાઈ છે. બીજું બધું અનુકરણ માત્ર છે, પોતાને માટે માનવ દ્વારા જનવાતું નાટક માત્ર છે.

સદા વધારેને વધારે પ્રમાણમાં, આન્ભપરિપૂર્ણતા લાવતા જીવનમાં અવસ્થિત બનવું ઓજ પરિપૂર્ણ નિશુલ્ખ છે. માણસે તેવા વિશુદ્ધ હેવાનો દંલ ન કરવો જોઈએ. તેણે સ્વયંભૂ રીતે બનવું જોઈએ. તેનું નામ દિવની સર્વચાઈ.

૧૯ જુન ૧૯૫૭

વહીલાં માતાજી, જે કોઈ માણસ ગંભીર માંદગીમાં જીવડાઈ જાય તો એ તથ્ય કુશળ શારીરિક ધરના છે કે આધ્યાત્મિક જીવનમાં કોઈ મુશ્કેલીનો નિર્દેશ કરે છે?

તે વાત તે વ્યક્તિ ઉપર આધાર રાખે છે. જે તે માલસ યોગ કરવાનો હોય તો તે સ્પષ્ટ રીતે તેના આધ્યાત્મિક જીવનમાં કોઈ મુશ્કેલી છે. જે માલસ યોગસાધના ન કરતો હોય અને સામાન્ય પ્રકારે સામાન્ય જીવન ગાળતો હોય તો તે એક તદ્દન સામાન્ય અકસ્માત છે. તે માલસ પર આધાર રાખે છે. બાબુ ઘટનાઓ એક સરખી હોય, પણ આંતર કારણો તદ્દન બિન્ન હોય છે. રોગો પર લેબલ ચોડવામાં આવે છે. અને તેમને એક સમૃહમાં ચોડવવા માટે પ્રયાસો કરવામાં આવે છે, પણ બે માંદગીઓ સમાન નથી હોતી. હકીકતમાં દરેક માલસ તેની પોતાની રીતે માંદો હોય છે. તે પ્રકાર તે જે હોય છે તેના પર, તેની ચેતનાની સ્થિતિ પર, તે જે પ્રકારનું જીવન ગાળતો હોય છે તેના પર આધાર રાખે છે.

અમે હંમેશાં કહ્યું છે કે માંદગીઓ હંમેશાં સમતુલ્યાના વિક્ષેપનું પરિણામ હોય છે, પણ આ વિક્ષેપ અસ્તિત્વની તદ્દન બિન્ન-બિન્ન સ્થિતિઓમાં પેદા થઈ શકે છે. જેની ચેતના બાબુ ભૌતિક જીવનમાં કેન્દ્રિત થયેલી હોય છે તેવા સામાન્ય માલસને માટે, તે સમતુલ્યાનો ભાંગ કેવળ ભૌતિક હોય છે, બિન્ન બિન્ન અંગોની કામગીરી પરત્વેનો હોય છે. પણ જ્યારે આ કેવળ બાબુ જીવનની પાછળ આંતર જીવનનું નિર્માણ થતું હોય ત્યારે માંદગીના કારણો બદલાઈ જાય છે, તે કારણો હંમેશાં અસ્તિત્વના બિન્નબિન્ન ભાગો વચ્ચેના વિક્ષેપની અભિવ્યક્તિ હોય છે. તે વિક્ષેપ આંતર પ્રગતિ અથવા પ્રયાસ અને બાબુ પ્રતિરોધિ અથવા પોતાના જીવનની પરિસ્થિતિ વચ્ચેનો હોય છે.

સામાન્ય બાબુ દુનિયિંદુમાંથી નેતાં પણ એ વાત ધરા સમયથી સ્વીકાર્પામાં આવી છે કે નિકટનાં નૌતિક કારણેને લીધી પ્રાલુશક્તિમાં રહેલી પ્રતિરોધ કરવાની શક્તિ ઓછી થઈ જાય છે, અને તે માંદગીને પેદા કરે છે, જ્યારે માલસ સમતુલ્યાની સામાન્ય સ્થિતિમાં હોય છે અને તે સામાન્ય શારીરિક સંવાદિતામાં જીવતો હોય છે ત્યારે શરીરમાં પ્રતિરોધ કરવાની શક્તિ હોય છે, તેમાં માંદગીનો પ્રતિકાર કરવા માટે પૂરતું બળવાન વાયુમંડળ હોય છે. શરીરનું ખૂબ ભૌતિક તત્ત્વ એવો સૂક્ષ્મ આકંધનો બહાર પ્રગટ કરે છે, કે જેમનામાં રોગોનો પણ પ્રતીકાર કરવાનું બળ હોય છે. હકીકતમાં બધા આકંધનો ચેપી હોય છે, પણ, કેટલાક રોગો ખાસ ચેપી મનાય છે. જે માલસ કેવળ બાબુ દુનિયિંદુથી પણ એવી સ્થિતિમાં છે કે તેના અંગો સંવાદિતાપૂર્વક કામ કરી શકે અને જેનામાં પૂરતા

પ્રમાણમાં માનસથાયીય સમતુલ્ય હોય છે, તેનામાં ચેપની અસર પોતા પર ન પડે એવી પ્રતીકારથકિત હોય છે, પણ જે એક યા બીજા કારણે તે આ સમતુલ્ય ગુમાવી જેસે, અને અવસાદને-અસતોષને નૌતિક મુશ્કેલીઓને અથવા ખૂબ થાકને કારણે તે સમતુલ્ય નભળી પડી ગઈ હોય, તો તેના શરીરની પ્રતીકારથકિત ઘટી જાય છે અને તે માંદગી પ્રત્યે ખુલ્લો બને છે. પણ જે આપણે કોઈ યોગ કરનાર માણસની વાત કરીએ, તો સમતુલ્યાના ભંગના કારણો તદ્દન મિન્ન હોય છે. અને માંદગી જેને જીતવાની છે એવી કોઈ આંતર મુશ્કેલીની અભિવ્યક્તિ બની જાય છે.

એટલે પોતે થા માટે માંદો પડ્યો છે તે દરેક જણે પોતે શાધી કાઢવું જોઈએ. પણ સામાન્ય દ્રાષ્ટિબિહુથી જેતાં, ધર્માખરા કિરસાઓમાં, મોટે ભાગે ભય ચેપનું દ્વાર જોલી નાંખતું હોય છે; પછી તે ભય માનસિક હોય કે પ્રાણિક હોય, મોટે ભાગે તો તે શારીરિક ભય હોય છે, કોષાણુઓમાં રહેતો ભય હોય છે. જેમનામાં પોતાની જત પર યોડેક પણ કાબૂ છે અથવા માનવી ગૌરવ છે, તેએ માનસિક ભયને દૂર કરી શકે છે પ્રાણિક ભય વધારે સૂક્ષ્મ હોય છે, અને તે વધારે કાબૂ માગી વે છે. શારીરિક ભયને જીતવા માટે સાચા યોગની જરૂર પડે છે, કારણ કે શરીરનાં કોષાણુઓ દરેક પીડાજનક, અપ્રિય વસ્તુથી ડરતાં હોય છે. યોગીક પણ બેચેની લાગે પછી ભલે તે તદ્દન નાનકડી-નગર્ય હોય, તો શરીરનાં કોષાણુઓ ચિંતિત બની જાય છે, તેમને બેચેની ગમતી હોતી નથી. તેના પર જિત મેળવવા માટે, સચેતન સંકલ્પનો કાબૂ જરૂરી છે. મોટે ભાગે, આ પ્રકારનો ભય માંદગીના દ્વારને જોલી નાંખતો હોય છે. હું પહેલા બે પ્રકારના ભયોની વાત નથી કરતી, કારણ કે જે માણસ તે શરીરના ઉદાત્તમ અર્થમાં માનવ બનવા માગે છે, તે બે ભયો પર જય મેળવી શકે છે, કારણ કે ભય એ બાયલાપણું છે, નામદારી છે. પણ શારીરિક ભયને જીતવો તે વધારે કઠિન છે, જો તે ભય ન હોય તો ખૂબ ખૂબ બળવાન આકમણોને પણ ભાળી શકાય છે. જે માણસમાં પોતાના શરીર પર યોડો પણ કાબૂ હોય, તો તેની અસરો ઓછી કરી શકાય છે, પણ તે ચેપમાંથી મુક્તિ નથી હોતી. શરીરના કોષાણુઓમાં આ પ્રકારની, લોતિક શારીરિક ભયની છુફુઝારી ભધા રોગોને વધારી મૂકતી હોય છે.

કેટલાક લોકો શરીરમાં પણ સ્વર્ણભૂ રીતે જ ભયથી મુક્ત હોય છે. તેમનામાં પૂરતા પ્રમાણમાં પ્રાણિક સમતુલ્ય હોય છે, તેમના પ્રાકૃતિક જીવનના છંદોમયતામાં

એક સ્વાભાવિક સંવાદિતા હોય છે, કે જેથી તેઓ ભયથી મુક્ત રહી શકે છે અને માંદગીને ઓછામાં ઓછી બનાવી દેવા માટે શક્તિમાન હોય છે. જેથી જિવટું, કેટલાક લોકો એવા હોય છે, જેમને માટે વસ્તુઓ બની શકે તેટલી ખરાબ બની જતી હોય છે, કેટલીક પાર તો તે મહાન સંટકૃપ બની જાય તેટલી હુદે પહોંચી જતી હોય છે. આ એક સહેલાઈથી જેઈ શકાય તેવો વિસ્તૃત પ્રદેશ હોય છે. આનો આધાર તેમના જીવનની ગતિની એક પ્રકારની સુખમય છંદોમયતા ઉપર હોય છે, જે છંદોમયતા તેમને માંદગીના બાહી આકમણોનો પ્રતીકાર કરવાની શક્તિ આપે છે. કેટલાક લોકોમાં તે શક્તિ પૂરતી હોતી નથી, અને જેથી તેઓ ભય વડે ધૂજરી અનુભવતા હોય છે. તે પ્રકારનું વૃત્તિજ્ઞન્ય દુઃખ થોડા એવા બેચેનીજનક સંપર્કને પણ ખૂબ દુઃખદાયી અને નુકસાનકારક બનાવી મૂકે છે. તે વિસ્તૃત પ્રદેશ એવી રીતે વિસ્તરતો હોય છે કે એક માણસ ખરાબમાં ખરાબ યેપી રેંગો પાસેથી પસાર થાય છીંતાં પણ યેપ લાગતો હોતો નથી, જ્યારે બીજો માણસ નાનામાં નાની તક મળતાં માંદો પડી જતો હોય છે. એટલે સ્વાભાવિક રીતે જ, તે વસ્તુ માણસના બંધારણ પર આધાર રાખતી હોય છે. જ્યારે માણસ પ્રગતિ માટે પ્રયાસ કરવાની ઈચ્છા કરે છે, ત્યારે તે સ્વાભાવિક રીતે જ તેણે મન પર પ્રાપ્ત કરેલા કાબૂ પર આધાર રાખતી હોય છે. જ્યારે શરીર ઉચ્ચતર સંકલ્પનાનું આજાંકિત કરણું બની જાય છે, અને તેનો પાસેથી સર્વ આકમણોનો પ્રતીકાર કરવાની તકાત મેળવે છે, ત્યારે માંદગી કે તેનો ભય તે માણસ પાસે ફરકતાં હોતાં નથી.

જ્યારે માણસ ભયને દૂર કરે છે, ત્યારે તે હંમેશાં સલામત હોય છે. દા. ન. અત્યારે ચાર્ચી રહેલા યેપી રેંગોમાંના હટ ટકા રેંગો ભય વડે ઉત્પન્ન થતા હોય છે. તે ભય એક પ્રકારનો માનસિક ભય બની જાય છે, તે ખૂબ શોકજનક રૂપ ધારણ કરે છે, અને સમાચાર પત્રો વાંચવાથી, નકામી વાતો કરવાથી, વગેરેથી તેમાં વૃદ્ધિ થાય છે.

માતાજી, તદ્દન અચેતન નહિ એવા શરીર માટે દવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો? જ્યારે આપણે ભગવાનની કૃપાને પોકાર કરતા હોઈએ છીએ, ત્યારે પણ થોડીક દવાની તો જરૂર આપણને પડતી હોય છે. જો તેને થોડીક દવા આપવામાં આવે, તો તેની અસર આરી નીપજે છે. શું આનો અર્થ એવો થાય છે કે માત્ર શરીરને જ દવાની જરૂર છોય છે, કે પછી મનમાં અને પ્રાણમાં પણ કોઈક ગરણડ હોય છે?

ઘણાં ખરા કિસ્સાઓમાં, યોગ્ય માત્રામાં દવાનો ઉપયોગ માત્ર શરીરને પોતામાં વિશ્વાસ પ્રાપ્ત કરવામાં મદદ કરવા પૂરતો હોય છે. પણ દવાથી શરીરમાં એર ઉત્પન્ન ન થાય તેની માલસે દરકાર રાખવી પડે છે. શરીર પોતે જ પોતાને રોગ મટાડે દેતું હોય છે. જ્યારે તે સાજ થવાની ઈચ્છા કરે છે, ત્યારે તે સાજું થઈ જાય છે. અત્યારે આ વસ્તુનો વ્યાપક પ્રમાણમાં સ્વીકાર કરવામાં આવેલો છે. ખૂબ પરંપરા જાળવનારા ડોક્ટરો પણ તમને કહેતા હોય છે કે હા, દવાઓ રોગને મટાડે છે, મટાડવામાં મદદ કરે છે. પણ દવાઓ મટાડતી નથી હોતી, પણ શરીર પોતે જ સાજ થવાનો નિર્ણય કરી બેતું હોય છે.” જ્યારે શરીરને એમ કહેવામાં આવે છે આ દવા ખા, ત્યારે શરીર પોતાની જતને કહે છે કે હવે હું સાજું થઈ જઈશ, અને પરિણામે તેનો રોગ મટી જતો હોય છે.

લગભગ દરેક કિસ્સામાં, વસ્તુઓ જે યોગ્ય મર્યાદામાં લેવામાં આવે, તો તે શરીરને સાજ થવામાં મદદ કરે છે. જે તે દવાઓ યોગ્ય પ્રમાણમાં લેવામાં ન આવે, તો શરીર જરૂર તદ્દન ભાગી પડવાનું. તમે એક રોગને મટાડો છો. પણ બીજી એક વધારે ખરાબ રોગને પંકડી બેતા હો છો. પણ તમારા શરીરને વિશ્વાસ પ્રાપ્ત કરાવે, તેવી યોડી દવા, યોડી ઘણી મદદ રૂપ બને છે. “હવે હું સાજે થઈ જઈશ. મેં આ દવા ખાયી છું, એટલે મને મટી જશે” આ વિચાર શરીરને ખૂબ મદદ કરતો હોય છે. પછી શરીર રોગમુક્ત બનવાનો નિર્ણય કરે છે, અને તેનો રોગ જતો રહે છે.

તેમાં પણ શક્યતાઓનો એક વિસ્તૃત પ્રદેશ હોય છે. યોગીમાં આંતર કાબૂની પરિપૂર્ણ સ્થિતિ હોય છે, એટલે તે એર લે તો પણ તેને તેની કશી અસર થતી હોતી નથી. તેથી ઊલટું, બીજે એક એવા માલસ હોય છે કે જે ઊઝરો પડતાં વેંત ડોક્ટરો પાસે દોડી જતો હોય છે અને શરીર સાજું થઈ જાય તે પ્રકારની ગતિ શરીર કરી શકે, તે માટે તેને અનેક પ્રકારની ખાસ દવાઓની જરૂર પડે છે. સમગ્ર પરમ પ્રભુત્વથી માંડીને તે બાધ દવાઓના સંપૂર્ણ બંધન સુધી તે વિસ્તૃત પ્રદેશ વિસ્તારતો હોય છે. સંપૂર્ણ બંધન અને સંપૂર્ણ મુક્તિ. એટલે બધું જ શક્ય છે. ને એક પ્રકારનું જટિલ અને પરિપૂર્ણ કી-બોર્ડ (ચાવીઓ ભરવવાનું પાટિયું) હોય છે, જેના પર તમે રમત કરી શકો છો. અને શરીર તેનું કારણ છે.

માતાજી, યોગીક પ્રયાસથી દા. ત. માંદગીના સમયમાં દવા ન લેવાના

નિશ્ચયથી માણુસ શરીરને સમજવામાં સક્ષળતા પ્રાપ્ત કરી શકે ખરો?

માનસિક નિશ્ચય પૂરતો નથી. તમારા શરીરમાં સૂક્ષ્મ પ્રતિક્રિયો થતાં રહેતો હોય છે, જે માનસિક નિશ્ચયની આજા માનતાં હોતા નથી. તેથી નિશ્ચય જ માણસ પર્યાપ્ત નથી. બીજા કથાંકની જરૂર છે.

બીજા પ્રદેશોનો સંપર્ક સાધવો પડે છે. મન કરતાં ઉચ્ચતર શક્તિની જરૂર પડે છે.

આ ફિલ્મિદુથી જોતાં, મનમાં જે કાંઈ છે, તે હંમેશાં શંકને આધીન હોય છે. તમે નિશ્ચય કરો, પણ તેમાં જરૂર એનું કાંઈક આવી પડવાનું, કે જે ખુલ્લી રીતે મન સાથે જ્ઞાનનું હોનું નથી, પણ જે તેની અસરકારકતા બાબતમાં શંકા ઉઠાવવાનું. જરા પણ શંકા પેદા થાય, એટલે નિશ્ચયની અધીં અસરકારકતા ચાલી જાય છે. જ્યારે તમે કહો છો કે હું આ વસ્તુ ઈચ્છાં દ્વારા, ત્યારે બીજી કોઈક, પશ્ચાદ્ભૂતિમાં કયાંક લપાઈ બેઠેલી વસ્તુ માનપૂર્વક પૂછતી હોય છે કે આનું પરિણામ શું આવશે? તે શંકા બધી બાજુને બગાડી મુકે છે.

મનની આ રમત બહુ સૂક્ષ્મ હોય છે. સામાન્ય માનવી મન તેને સંપૂર્ણપણે કાબૂમાં રાખવામાં સહજ થતો હોતો નથી, દા. ત. યોગ કરતાં અને શરીર પર સંયમ રાખવા ઈચ્છિતા વોકો નીચેની વાત બરાબર જાણતા હોય છે. પ્રયત્નપૂર્વક પોતામાંની કોઈક વસ્તુ પર કાબૂ મેળવામાં તેઓ સહજ થયા હોય, શરીરની અમુક નન્દગાઈ પર, અમુક સમતુલ્યાના ભંગ પ્રત્યે ખુલ્લા ન રહેવામાં તેઓ સહજ બન્યા હોય, ઘણાં વર્ષો સુધી તે સમતુલ્યાના ભંગ ચેતનામાંથી અદૃશ્ય થઈ ગયો હોય, એક દિવસ તેમને એમ વાગ્યું હોય કે મેં આ વસ્તુ પૂરેપૂરી સિદ્ધ કરી લીધી છે. છનાં પણ બીજી જ કાંઈ તે નન્દગાઈ પાછી તેમનામાં આવતી હોય છે. તેનો અર્થ એ થયો કે જે વસ્તુનો તેમણે ઈન્કાર કર્યો હતો, તેનાં આકાંપનો સાથે તેઓ સંપર્કમાં આવ્યા હતા, કારણ કે તે વિચારની ભૂમિકા પર તેઓ આકભણ પ્રત્યે ખુલ્લા હતા. એક યા બીજા કારણે, શક્તિઓની લીલામાં તેઓ ખુલ્લા હતા અને તેથી તે નન્દગાઈ પાછી આવી જાય છે.

આ વસ્તુ યોગમાં ઘણી જાણીતી છે. પોતે પ્રાપ્ત કરેલા દિજયનું માનસિક રીતે અવલોકન, તેનો વિચાર વર્ષો સુધી કેટલા યોગની અસરનો નાશ કરસા માટે

પૂરતો છે. બાધ્ય આકાંપનોને અંદર ન ધુસવા દે તેવી બળવાન, માનસિક શાન્તિ અનિવાર્ય છે. તે શાંતિ પ્રાપ્ત કરવી ધ્યાન કઠીન છે. તે માટે તો, શ્રી અરવિદ કહે છે તેમ તેણે નિમ્નતર ગોળાઈમાંથી ઉચ્ચતર, કેવળ આધ્યાત્મિક ગોળાઈમાં જવું પડે છે.

માનસિક ક્ષેત્રમાં વિજયો પ્રાપ્ત થતા હોતા નથી. તે અશક્ય છે. મન બધી અસરો પ્રત્યે, સર્વ વિરોધી પ્રવાહો પ્રત્યે ખુલ્લું હોય છે. માનસ જે જે માનસિક રચનાઓ કરે છે, તેમનામાંજ તેમનો વિરોધ રહેલો હોય છે. માણુસ તે વિરોધિને ન ગાંઠે, બને તેટલા બિનનુકશાનકારક બનાવે, છતાં વિરોધ અંદર રહી જતો જ હોય છે. જરા પણ નબળાઈ આવે, સાવધાનતામાં ચૂકી જવાય, તો તે અંદર ધુસી જાય છે. અને બધા કાર્યનો વિનાશ કરી દે છે. માનસિક સીતે માણુસ બહુ થોડા પરિણામો પ્રાપ્ત કરી શકતો હોય છે, અને વળી તે મિક્રિત હોય છે. બીજી કોઈ વસ્તુની જરૂર છે, સલામત રીતે કાર્ય કરવા માટે, માણુસે મનમાંથી શક્તાના અથવા ઉચ્ચતર બેતનાના ક્ષેત્રમાં જવું જોઈએ.

એ વાત નહુન સ્પષ્ટ છે કે શરીર પર કાર્ય કરવા માટે શક્તા ઓક ખૂબ બળવાન સાધન છે. જે લોકો સરળ હદ્યના હોય છે. ખૂબ ગુંચવાડા ભરેલા મનવાળા નથી હોતા, જેમનામાં બહુ મહાન અને જટિલ માનસિક વિકાસ નથી હોતો પણ ખૂબ ઉંડી શક્તા હોય છે તેમનામાં શરીર પર કાર્ય કરવાની મહાન શક્તિ હોય છે. તેથી કેટલાક માણુસો કેટલીક વાર ખૂબ આશર્યચક્રિત બની જાય છે; કે “આ ઓક મહાન સાક્ષાત્કારવાળો માણુસ છે. અપવાદ રૂપ વ્યક્તિ છે. પણ તે સર્વ નાનામાં નાની ભૌતિક વસ્તુઓનો ગુલામ છે, જ્યારે આ માણુસ તદ્દન સરળ છે. ખૂબ અણુધડ દેખાય છે, પણ તેનામાં ખૂબ શક્તા છે, અને મુશ્કેલીઓમાંથી તથા વિધનોમાંથી તે વિજેતાની પોઠે પસાર થઈ જાય છે.”

હું એમ નથી કહેતી કે ખૂબ સુસભ્ય માણુસમાં શક્તા ન હોઈ શકે, પણ તેમ હોવું વધારે કહિન છે, કારણે આ માનસિક તત્ત્વ હમેં થાં વિરોધ કરતું હોય છે, ચર્ચા ચલાવતું હોય છે. સમજવા માટે કેંશિશ કરતું હોય છે. જેને ખાતરી કરી આપવી તે મુશ્કેલ હોય છે. જેને સાબિતીઓ જોઈતી હોય છે, તેની શક્તા ઓછી વિશુદ્ધ હોય છે. તેને ઉત્કાન્તિની સીક્રેમાં વધારે ઊંચે જવાની જરૂર હોય

છે માનસિકમાંથી આધ્યાત્મિકમાં જવાનું હોય છે, પછી શ્રદ્ધામાં એક ખૂબ ઉચ્ચ પ્રકારનો ગુણ પેદા થાય છે. રેઝિંડા સામાન્ય જીવનમાં ઉત્કટ શ્રદ્ધાવાળો, તદ્દન સરળ માલાસ પોતાના શરીર ઉપર પ્રલુંત્વ પ્રાપ્ત કરી શકે છે. પણ તે સાચા અર્થમાં પ્રલુંત્વ નથી હોતું, તે માત્ર એક સ્વયંભૂ ગતિ હોય છે, તેને પોતાના શરીર પર કાબૂ હોય છે. ને વધારે ઉચ્ચતર વિકાસ પામેલા માલાસના કાબૂ કરતા ખૂબ-ખૂબ વધારે મહાન હોય છે.

માતાજી, હું તમને એક નાનો, અંગત સવાલ પૂછું છું. ન મટાડી શકાય તેવો રોગ, અંગોની માંદગી તમારી કૃપાથી મટી ગઈ છે, પણ કેવળ કિયા બાબતની માંદગી મટી શકી નથી તેમ કેમ બન્યું? તેણે શરીરમાં એમ કેમ બન્યું? તે ખુલ્લાપણાના અભાવને કારણે હતું કે પછી?

તે એટલું બધું અંગત છે, કે તેનો જવાબ આપવો અશક્ય છે. દરેક માલાસનો કેઈસ તદ્દન લિન્ન હોય છે તે અંગોની કિયાઓની વિગતમાં ઉત્તર્ય સિવાય આ વસ્તુઓની સમજૂતી આપી શકાતી હોતી નથી. દરેક જલુ માટે કેઈસ લિન્ન હોય છે.

દરેક વસ્તુ માટે, દરેક ઘટના માટે. ચેતનાની જેટલી ભૂમિકાઓ છે તેટલી સમજૂતિઓ હોય છે. તદ્દન સરળ રીતે કહીએ તો, શારીરિક સમજૂતિ હોય છે, પ્રાપ્તિક સમજૂતિ હોય છે, માનસિક સમજૂતિ હોય છે. એક જ ઘટના માટે તમે અસંખ્ય સમજૂતિઓ આપી શકો; તે સીડીનાં પગથિયાં પેઠે એક કમિક પરંપરા હોય છે. જો તેમાંની કોઈ એક સંપૂર્ણપણે સાચી નથી હોતી: બધીમાં સત્યનો કાંઈક અંશ હોય છે. જો તમે સમજૂતિઓના સમગ્ર ક્ષેત્રને લો, એક વસ્તુ લો. અને તેની પાછળ પાછળ આગળ વધો, તો તમારે હંમેશાં તે એક વસ્તુને બીજી વસ્તુ દ્વારા સમજાવવી પડશે; તમે અનિશ્ચિત રીતે આખા જગતમાં ફરી વળો, એક વસ્તુને બીજી દ્વારા સમજાવવો, અને છતાં તમે સમજૂતિના અંતને નહિ પ્રાપ્ત કરો.

જ્યારે માલાસ આને સમગ્રપણે અને તાત્ત્વિક રીતે જુબે છે, ત્યારે તે વધારેમાં વધારે ઉહાપણુભરેલી રીતે એમ જ કહી શકે કે તે આ પ્રકારનું છે, અને તેથી તે આવું છે.

“ પણ હજુથી આપણે સંતતિ પ્રજાનનના સામાન્ય સાધનનો, ભૌતિક પ્રકૃતિની સ્થૂળ પદ્ધતિનો આક્રાય લેવાની જરૂર રહે છે. જો આપણે એ જરૂરને દૂર કરવી હોય, તો કેવળ રહસ્યવાદી પદ્ધતિને, ભૌતિક પરિણામો માટે અતિભૌતિક રાખનો વડે કામ કરતી અતિભૌતિક પ્રક્રિયાના આક્રાયને શક્ય બનાવવો જોઈએ. નહિ તો જાતીય આવેગના આક્રાયથી, અને તેની પાશવી પ્રક્રિયાથી પર જઈ નહિ શક્ય. ભૌતિકિકરણ અને અભૌતિકિકરણ બાબત, તે શક્ય હોવાનો ને દાવો મર્મીએ કરે છે, અને આપણે જેએલી અનેક ઘટનાઓ તેમની સત્યતા વિશે સાખીતી આપે છે તે જો સત્ય હોય, તો આ પ્રકારની પદ્ધતિને આપણે અશક્ય ન માની શકીએ. કારણ કે ગૂઢવાદીઓના સિદ્ધાંતમાં અને યોગનું જ્ઞાન આપણા અસ્તિત્વ ને કમિક ભૂમિકાઓ ગણાવે છે તેમાં, એમ જણાવેલું છે કે સૂક્ષ્મ ભૌતિક શક્તિ છે. એટલું જ નહિ પણ જીવન અને સ્થૂળ પદાર્થ તત્ત્વની વચ્ચે એક સૂક્ષ્મ ભૌતિક પદાર્થ તત્ત્વ છે. ને સૂક્ષ્મ ભૌતિક પ્રદાર્થ તત્ત્વમાં સર્જન કરવા, અને તે રીતે

૧. જ્યારે શ્રી અરવિંદ પોંડીચેરીમાં ‘અતિથિ-ગૃહ’માં રહેતા હતાં, ત્યારે ૧૯૨૧માં બનેલી ઘણના વિષે તે અહીં ઉલ્લેખ કરે છે. એક રસોઈઓને કાઢી ભૂદ્વામાં આપ્યો હતો. વેર લેવા માટે તે એક સ્થાનિક મેલી વિધા જણનાર અભિયાર કરનાર માણુસ પાસે ગયો. કેટલાક હિસ્સો સુધી, અતિથિ ગૃહમાં નિયમિત રીતે પત્થરનો વરસાદ વરસવેલા શરીર થયો. પહેલા માળ પરના લોકો પોતાની આંખો સામે આકાર ધારણ કરતા પત્થરોને નેઈ શકતા હતાં. પછી તે પત્થરો આંગણામાં વરસતા હતા, તે પત્થરો એટલા બધા સાચા હતા કે તેમનાથી એક જીવાન નોકરને ઈન થઈ હતી. તે પત્થરોને ડંચુકી લઈ શકતા હતા. આશ્રમની વાત તો એ હતી કે તે બધા પત્થરો પર શેવાળ નભી ગઈ હતી. આખરે બંધ બારણાવાળી ઉમોમાં મોટા ને મોટા પત્થરો પડવા લાગ્યા. તે ગૂઢવાદી રીતે ઉત્પન્ન કરવામાં આવ્યા હતા, તે વિષે કાઈ સંદેહ નરહો. માતાજી, પોતાની આંતર શક્તિ સાથે વચ્ચે પડ્યાં, અને પત્થરનો વરસાદ બંધ થઈ ગયો. ઘાડાક હિસ્સ પછી તે રસોઈઓની પણી હોડતી હોડતી શ્રી અરવિંદની મારી માગવા આવી. રસોઈઓ દ્વારાનામાં મરણ પથારી પર પડ્યો હતો. પત્થરોની વૃષ્ટિ પાણી ફરીને તેના પર થઈ હતી. શ્રી અરવિંદ જવાબ આપ્યો કે આ કારણે તેણે મરી જવાની જરૂર નથી! પછી બધું ઠીકાડક થઈ ગયું. આ ઘણનાનું વિસ્તૃત વણ્ણીન શ્રી અંધુલાઈ પુરાળીએ તેમનાં શ્રી અરવિંદનું જીવન-ચરિત્ર “નામના પુસ્તકમાં કર્યું” છે, ૧૯૬૪ની આવૃત્તિ, પૃષ્ઠ ૨૮૨-૮૩.

નિર્માણ થયેલા રૂપોને આપણી સ્થૂળતર ભૌતિકતામાં પ્રગટ કરવા એ શક્ય છે. આ સૂક્ષ્મ ભૌતિક પદાર્થ તત્ત્વમાં નિર્માણ કરાયેલી વસ્તુ સૂક્ષ્મતામાંથી સ્થૂળ પદાર્થ તત્ત્વની સ્થિતિમાં સંકાન્ત થઈ શકે છે. ગુઢવાદી શક્તિ અને પ્રક્રિયા, કોઈ સ્થૂળ ભૌતિક કિયા દ્વારા અથવા તો તેની મદદ સિવાય, તે વસ્તુને સૂક્ષ્મતામાંથી સ્થૂળમાં લાવી શકે છે. જે આત્મા શરીરમાં પ્રવેશ કરવા માગતો હોય અથવા શરીરનું નિર્માણ કરવા માગતો હોય અને પૃથ્વી પર દિવ્ય જીવનમાં ભાગ બેવા ઈચ્છતો હોય, તેને જતીય પ્રક્રિયા વડે જન્મ પ્રામ કર્યા સિવાય, કોઈ અવનતિમાં ઉત્ત્યા સિવાય, આપણા અત્યારના અસ્તિત્વમાં અનિવાર્ય એવા શરીર કે મનમાં વૃદ્ધિ કે વિકાસની ભારે મર્યાદાઓ. સ્વીકાર્ય સિવાય, તે આ રીતે તેમ કરી શકે છે.

માતાજી, હવે અતિમનસ પૃથ્વી પર આવ્યું છે, એટલે જન્મમાંથી પસાર થયા સિવાય શરીર ધારણ કરવાની આ પદ્ધતિ શક્ય છે ખરી?

તે શક્ય છે એમ તમે પુછો છો? દરેક વસ્તુ શક્ય છે. તમે શું જાણવા માગો છો? આ કરવામાં આવ્યું છે ખરું, એમ પુછવા માગો છો.

હા.

તદ્દન ભૌતિક ભૂમિકા સુધી તો નહિ, દૃષ્ટિગોચર સૂક્ષ્મ ભૌતિક વચ્ચગાળાની ઇન્દ્રિયોને દૃષ્ટિગોચર, ભૌતિક ઇન્દ્રિયો અને સૂક્ષ્મ પદાર્થ તત્ત્વની ભૌતિક ઇન્દ્રિયોના વચ્ચગાળાની ઇન્દ્રિયોને દૃષ્ટિગોચર. દા. ત. વાસ એક મૃદુ વાયુલડરી સમાન અનુભવાય છે, અતાર જેવા કેટલાક બંધના અનુભવો આ બધાને આંતર દર્શનાવાળા બેઝો જોઈ શકે છે. પણ ખૂબ ભૌતિક ઇન્દ્રિયો માટે તે શક્ય નથી. આપણે ભૌતિક રીતે જેને જાહીએ છેબો તે રીતે ભૌતિક શરીર વડે તેમને સ્થાયીપણું મળ્યું નથી. કેટલાંક દૃશ્યો જોઈ શકાય છે, પણ તે અસ્થિર હોય છે. તેમાં પદાર્થ તત્ત્વની સ્થિરતા, નિશ્ચિતતા પ્રાપ્ત થઈ નથી. તેમાં રૂપર્થનો કે દર્શનનો સંપર્ક સધાર્યો હોય છે, પણ ભૌતિક શરીર જે આપે છે તેવું સ્થાયીપણું હજી તેમાં પ્રાપ્ત થયું નથી. તે કાણુભંગુર ઘટનાઓ હોય છે, જે ઇન્દ્રિયન્યન્ય વાસ્તવિકતાની લાગણી આપી શકતી હોતી નથી. છતાં તેમની અસર સતત થતી રહેતી હોય છે. તેઓ સતત રીતે આવતાં રહેતાં હોય છે, તેમનું દર્શન સતત થતું રહેતું હોય છે, પણ તેમાં શરીરની સ્થિરતા નથી હોતી. જે રીતે શરીર રૂમની બહાર જાય છે અને તે જ રૂપમાં પાછું રૂમમાં આવે છે, તેવું તેમાં નથી હોતું, સમજાયા? જાયારે તમે અમુક જગ્યાએ બેસો છો, ત્યારે શરીર સંધન રીતે એ જગ્યાને રોકાનું હોય છે.

હું કહી શકતી નથી, કારણ કે પૃથ્વી પર જે બની ગયું છે અને જે બની રહ્યું છે તે સર્વને હું જાણતી નથી. પણ હું જાણું છું ત્યાં સુધી, આ સધન સ્થાયીપણું હજુ સુધી પ્રાપ્ત થયું નથી.

છતાં તે પદાર્થતત્ત્વનું હતું, કારણ કે તેમાં દર્શન, સ્પર્શ, શ્રવણ હતાં પણ શ્રવણને બહુ ભૌતિક બનવાની જરૂર નથી પડતી. સૂક્ષ્મ ભૌતિક જીવનના ઘ્રણનિઓ તેનાં આકંપનો બહુ સારી રીતે સાંભળી શકાય છે. અને આશ્રયની વાત તો એ છે કે સૂક્ષ્મ ભૌતિક જગતમાં શ્રવણ અને ગંધ વધારેમાં વધારે સ્થાયી જણાય છે. રૂપના દર્શન કરતાં પણ વધારે. સંપર્કની અમુક માગણી પણ ખૂબ ખૂબ સધન હોય છે. આ ભૌતિક શરીરની ભારે ભૌતિક હજરી એક તદ્દન નિશ્ચિત અને સધન જગ્યાને રોકનું હોય છે, તે બીજી કોઈ વસ્તુને તે જગ્યાએ બેસવા હેતુ હોતું નથી; તેવું હજુ તે અનુભવોમાં શક્ય બન્યું નથી. તેથી જે સિદ્ધ થયું છે તે ખૂબ ભારે પદાર્થતત્ત્વ કરતાં જરાક વધારે પ્રવાહી હોય છે.

શું આ પ્રગતિ માનવ ચેતના પર આધાર રાખે છે?

તમે વધારે પરિપૂર્ણ ભૌતિકીકરણ વિષે પૂછો છો? તેનો આધાર પદાર્થ-તત્ત્વનાં આકંપનો સાથે કામ બેવાની શક્તિ પર છે. આકંપનો સાથે કામ બેવાની આ શક્તિ ચેતનાની અમુક સ્થિતિના પરિણામરૂપ હોય છે. તમે જે દાખિબિદુ સ્વીકારો તેના પર તે બધાનો આધાર છે, કારણે ભગવાનના સંકલ્પની સત્તા સિવાય કાઈ વ્યક્તિગત પ્રગતિ સિદ્ધ થતી હોતી નથી. આખરે, ભગવાનના સંકલ્પની મંજુરી સિવાય, સુધિમાં કશું જ બની શકતું હોતું નથી.

માતાજી, પ્રથમ અતિમાનસ શરીર આના જેવું જ હશે?

શેના જેવું?

પાઠ્યિક જન્મમાંથી પસાર થયા વિના સીધું કેટલું રૂપાંતર?

મને માફ કરો તમારે વસ્તુઓને ગુંચવી નાખવી ન જોઈએ. બે વસ્તુઓ છે. એક બાળુએ કેવળ અતિમાનસ સર્જનની શક્યતા છે, અને બીજી બાળુએ, ભૌતિક શરીરના અતિમાનસ શરીરમાં વિકાસશીળ રૂપાંતરની શક્યતા છે. માનવ

શરીરના અતિમાનવ શરીરમાં રૂપાંતરની શક્યતા છે. તો તો તે વિકાસશીલ રૂપાંતર હોય, જેને સીધુ થતાં ઘણાં ઘણાં વર્ષો લાગે, અને જે એવા પ્રાણીને પેદા કરે છે કે જેને પશુ-અર્થમાં આપણે માનવ ન કહી શકીએ, પણ જે પશુતાથી તદ્દન મુક્ત એવું અતિમાનસ પ્રાણી નહિ હોય, કારણ કે તેનો વર્તમાન ઉદ્ગમ અનિવાર્ય રીતે પશુના જેવો છે. એટલે એવું રૂપાંતર સીધુ થાય કે જે માલુસને આ ઉદ્ગમમાણી મુક્ત કરવા સમર્થ હોય. પણ તે સમગ્રપણે અને વિશુદ્ધ રીતે અતિમાનસ સર્જન નહિ હોય. કોઈ અરવિદે કહ્યું છે કે એક વચ્ચગાળાની જાતિ આપણે. જાતિ કે અમૃક વ્યક્તિઓ તે આપણે જાણતાં નથી, જે એક માર્ગ બનાવવાની સેવા આપણે. અર્થવા સૂર્યિની જરૂરિયાત અનુસાર જેમને કાયમ બનાવવામાં આવણે, પણ જે અત્યારે જે રીતે શરીરો પેદા થાય છે તે રીતે પેદા થયેલા શરીરથી તેણે પ્રારંભ કર્યો હોય, તો કેવળ અતિમાનસ પદ્ધતિથી અને પ્રક્રિયાથી નિર્માણ થયેલા શરીર દ્વારા જે પરિણામો આવે તેના જેવાં પરિણામો નહિ આવી શકે. તે વધારે પ્રમાણમાં અતિમાનસ હોય, કારણ કે સર્વ પશુ અભિવ્યક્તિ અદશ્ય થઈ ગઈ હોય, પણ તે તેના નિર્માણમાં વિશુદ્ધ રીતે અતિમાનસ શરીર નહિ હોય, અને તેથી તેવા શરીરની પૂર્ણ પરિપૂર્ણતા પ્રાપ્ત કરવા તે સંભર્ય નહિ હોય.

આ રૂપાંતર સિંદ્ધ કરેલા માનવ શરીરમાં ખી-પુરુષના બેદ હોય ?

તમે શું કહો છો ?

જો અતિમનસ આ રૂપાંતર પામેલા શરીરનો સ્વીકાર કરે, તો...

‘સ્વીકાર કરે’ તે શબ્દ વડે તમે શું કહેવા માગો છો ?

હું એમ કહેવા માગું છું કે આ અર્ધમાનવ શરીરમાં જો અતિમનસ અવતરણ કરે, તો તેમાં ખી-પુરુષના બેદ હોય ?

પણ તે માલુસ જેમ એક શીશીમાં કોઈ પ્રવાહી રેડે, તેના જેવી વાત નથી !

તમે એમ પૂછો છો કે - ત્યારે શરીર તેનું પુરુષનું અથવા ઝીનું રૂપ રાખશે ? મકાનમાં રહેવા આવનાર માલુસની પસંદગી પર તે વાત છોડી દેવાયે. શું તમે આ ખી-પુરુષના બેદમાં ખૂબ રસ છો ? (હસાહસ)

તમે અમને કહો છો કે ત્યારે એવો ઓઈ લેદ નહિ હોય. પણ હજુ સુધી તો તેવો ખૂબ લેદ છે.

ક્યા દિલ્હીનુથી? જો તે શારીરિક દેખાવ બાબત હોય, તો હું સંમત થાઉં છું, અને છતાં તે લેદ જાઓ નહિ હોય. ક્યા દિલ્હીનુથી?

જાતીય વિચારના દિલ્હીનુથી પુરુષ અને સ્ત્રી એ ભિન્ન જાતિઓ છે, હજુ પણ છે.

આંતર વિચારમાં તે માગણી અનુભવાય છે, પણ ભૌતિક જીવનની વાસ્તવિકતામાં.....

કેવો વિચાર! તેવો વિચાર કરનાર માણસનાં તે ભૂલ છે. તે વિચાર કરવો બંધ કર્યો તે હીક છે. તમે શરીરનું રૂપાંતર સિલ્ડ કરવા પ્રયત્ન કરો, ત્યાર પહેલાં વિચારની આ કુદ્ર મર્યાદાઓ અદરથ્ય થઈ જવી જોઈએ. જો આ કુદ્ર, કેવળ પાશવી વિચારો તમારામાં હજુ રહ્યા હોય, "તો તમારા શરીરનું રૂપાંતર કરવાની પ્રક્રિયા તમે શરૂ કરી શકો તેવી બહુ આશા નથી પ્રથમ તો તમારે તમારા વિચારનું રૂપાંતર કરવું જોઈએ, કારણ કે તે તો હજુ ખૂબ નીચે ઝીડાની માહક પેટે ચાલવા જોવું છે. જો તમે એવો વિચાર ન કરી શકતા હો કે સચેતન અને જીવાંત પ્રાણી જાતીય માગણીથી અમુક નિશ્ચિત રૂપમાં પણ તદ્દન મુક્ત ન જની શકે, તો તેને અર્થ એ થયો કે હજુ તમે મૂળની પશુતામાં ગળાબૂડ ડૂબેલા છો.

વાસ્તવિકતા વિષે શું?

બાધ્ય જીવનમાં મને હજુ તેનો સાક્ષાત્કાર થયો નથી આંતર...

તે વિષે વિચાર કરવામાં તમે તમારો સમય ગાળો છો ?

આ જાતીય લેદ વિષે એક પણ વિચાર આવવા દીધા સિવાય માણસ દિવસના ચોવીસેય કલાક ગાળી શકે છે ! તમે આ બાબતથી હિંનોટાઈઝ થઈ ગયા છો ( તમારા પર જાદુ થયો હોય તેમ લાગે છે ). શું તમે એમ માનો છો કે જયરે હું તમારી સાથે વાત કરતી હોઉં છું, ત્યારે હું એમ વિચાર કરતી હોઉં છું કે તમે પુરુષ છો; અને તારા સાથે વાત કરતી હોઉં, ત્યારે એમ વિચાર કરતી હોઉં છું કે તે સ્ત્રી છે ?

ઇતાં બેદ તો છે જ !

પણ તેની જરૂર જરૂર નથી,

સિદ્ધાંતમાં તો તે વાત હું સમજું છું.

સિદ્ધાંતમાં ? ક્યા સિદ્ધાંતમાં ?

કે છી પુરૂષ વચ્ચે બેદ નથી. પણ જપારે હું કોઈના સંપર્કમાં આવું શું, ત્યારે મને વિચાર આવે છે કે તે છી કે પુરૂષ ?

લલે, પણ તે તમારે માટે એમ જ, તે બીજી વ્યક્તિ માટે ખૂબ શોચનીય છે.

નહીં, જે હાવું જોઈએ તેના કરતાં તે તદ્દન ઊબટી વાત છે ! જ્યારે તમે કોઈના સંપર્કમાં આવો છો અને તેની સાથે વાત કરો છો, ત્યારે તમારે પશુતાથી જે પર છે તેની સાથે વાત કરવી જોઈએ, તમારે આત્મા સાથે વાત કરવી જોઈએ, શરીર સાથે નહિં. તમારી પાસે તો તેથી પણ વધારેની આચા રાખવામાં આવે છે, કારણું કે તમે અગ્રવાન સાથે વાત કરી રહ્યા છો, આત્મા સાથે પણ નહિં, કે જે અગ્રવાન દરેક પ્રાણીમાં છે. તમારે તેનાથી સભાન બનાવું જોઈએ.

પણ જો એક જણ સભાન હોય, અને બીજી વ્યક્તિ પણ હોય તો શું બને ?

જે તમે એકલા સભાન હો તો ? તમે બીજ વિષે શું જાણો છો ? બીજી વ્યક્તિ સભાન નથી એવો નિર્ણય તમે કેવી રીતે અને કયી લૂભિડા પર કરો છો ?

તેની જવાબ આપવાની રીત પરથી.

પણ કદાચ તે વ્યક્તિ તમારે વિષે તેવું જ ધારતી હોય તો ?

જે તમે જેની સાથે વાત કરો છો, તેને અગ્રવાન માનો તો તેનો અર્થ એ થયો કે તમે પોતે તેનાથી સભાન નથી. તો તે પછી બીજી વ્યક્તિની સ્થિતિ માટે નિર્ણય બાંધવો જાંયકર ધૃષ્ટના છે. તમે તે સ્થિતિ વિષે શું જાણો છો ? જે તમે પોતે જ બીજમાં રહેલા અગ્રવાનથી સભાન ન હો, તો તે સભાન છે કે નહિં તે કહેવાનો તમને થો અધિકાર છે ? ક્યા પાયા ઉપર ? તમારી નાનકડી બાબુ બુદ્ધિના પાયા ઉપર ? પણ તે તો કાંઈ જ જાણતી નથી હોતી ! તે કશું જાણવા માટે સમર્થ નથી હોતી.

જ્યાં સુધી તમે બધી વસ્તુઓમાં ભગવાનનાં દર્શન કરી શકતા હોતા નથી, ત્યાં સુધી બીજાઓ કથી સ્થિતિમાં છે તેનો નિર્ણય કરવાનો તમને અધિકાર નથી. એટલું જ નહિ, પણ તેમ કરવાની તમારામાં શક્તિ પણ નથી. સ્વયંભૂ રીતે, પ્રયત્ન કર્યા સિવાય, આ દૃષ્ટિને પ્રાપ્ત કર્યા સિવાય કોઈને વિષે નિર્ણય બાંધવો, ઉચ્ચારવો, તેને શ્રી અરવિંદ માનસિક ધૃષ્ટાનો દાખલો કહેતા, જેનામાં દર્શન હોય છે, ચેતના હોય છે, સર્વ વસ્તુઓમાં રહેવા સત્યને જેવાની શક્તિ હોય છે. તેમને કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ વિષે નિર્ણય બાંધવાની જરૂર જ પડતી નથી. કારણ કે તે બધું જ જાળતો હોય છે, સમજતો હોય છે. માટે સર્વ સમયે તમારે તમારી જતને કહી દેવું જોઈએ કે જે ક્ષણે તમે વસ્તુઓ, માલસો, સંજોગો વિષે નિર્ણય બાંધવાની શરૂઆત કરો છો, તે જ ક્ષણે તમે સંપૂર્ણ માનવ અજ્ઞાનમાં હો છો.

ટુંકમાં આપણે એમ કહી શકીએ કે જ્યારે માલસ સમજે છે, ત્યારે તે નિર્ણય કરતો હોતો નથી, અને જ્યારે માલસ નિર્ણય કરતો હોય છે. ત્યારે તે જાણતો હોતો નથી.

અતિમાનસ માર્ગ પર એક ડગલું પણ આગળ ભરતાં પહેલાં, પ્રથમ તો માલસો વિષે નિર્ણય બાંધવાનું બંધ કરી દેવું જોઈએ, કારણ કે તે ભૌતિક કે શારીરિક પ્રગતિ નથી, તે માત્ર વિચારની થોડીક જ પ્રગતિ છે, માનસિક પ્રગતિ છે. જ્યાં સુધી તમે મનના સર્વ અજ્ઞાનને દૂર કરતા હોતા નથી, ત્યાં સુધી તમે અતિમાનસ માર્ગ પર એક પણ ડગલું આગળ ભરી શકતા નથી.

હકીકતમાં તમે એક ભયંકર વાત કહી છે. જ્યારે તમે કણું કે “તે પણ હોત, તો હું આત્મા સાથે વાત કરી શકતો નથી,” ત્યારે તમે બાજુ હારી ગયા છો, તમે તમારી જત ઉપર બેબલ ચોટી દીધું છો.

જે બોકોને સાચી રીતે અને દિલની સચ્ચાઈપૂર્વક ભગવાનની હાજરીનો અનુભવ હોય છે, જેએ સાચી રીતે ભગવાનના સંપર્કમાં આવ્યા છે, તેમણે હમેશાં એક જ વાત કરી છે કે માલસો જેનો ખૂબ ખૂબ તિરસ્કાર કરતા હોય છે, માનવી જ્ઞાન જેને ખૂબ-ખૂબ ધિક્કારતું હોય છે, તેનામાં માલસ ભગવાન પ્રકાશને પ્રકાશતો જોઈ શકે છે.

આ માત્ર શબ્દો નથી, પણ જીવંત અનુભૂતિઓ છે.

સારા નરસાના, ઉચ્ચ અધમના જ્યાલો માનવ મનના અજ્ઞાનના હોય છે. એ માસુસ ખરેખર દિવ્ય જીવનના સંપર્કમાં આવતું હોય, તો તેણે સંપૂર્ણપણે તે અજ્ઞાનમાંથી પોતાની જાનને મુક્ત કરવી જોઈએ, તેણે તે ચેતનાના ઉચ્ચતર પ્રદેશમાં જવું જોઈએ, જ્યાં આ વસ્તુઓમાં વાસ્તવિકતા રહેતી નથી ત્યાં ઉચ્ચતાની અને નીચતાની માગણી તદ્દન નાબૂદ થઈ જાય છે. તેને સ્થાને એક ખૂબ લાન્ચ સ્વભાવની વસ્તુ આવીને બેસી જાય છે, દેખાવોને ફિલ્ટર કરવાની, ગાળવાની, શક્તિ આવી જાય છે. મહોરાને ચીરેને લીતરમાં જવાની, દૃષ્ટિબિંદુ પછી નાખવાની શક્તિ આવી જાય છે.

આ માત્ર શર્ષેદી નથી; તે તદ્દન સાચી વાત છે કે ત્યારે દરેક વસ્તુ તેના દેખાવમાં સંપૂર્ણપણે પરિવર્તન પામી જાય છે. જીવન અને વસ્તુઓ જેવાં દેખાતાં હોય છે તેનાથી તદ્દન બિન્ન પ્રકારનાં બની જાય છે.

આ જગતનો સર્વ સંપર્ક, તેનું સામાન્ય દર્શન સંપૂર્ણપણે તેની વાસ્તવિકતા ગુમાવી દે છે. તે અવાસ્તવિક, કાલ્પનિક, ભ્રાન્તિક, અસત્ત બની જાય છે. ત્યારે કોઈક ભૌતિક, ખૂબ સધન, ખૂબ શારીરિક વસ્તુ અસ્તિત્વની વાસ્તવિકતા બની જાય છે. તે જેવાના સામાન્ય પ્રકારથી તદ્દન બિન્ન હોય છે. જ્યારે માસુસને દિવ્ય શક્તિના આ કાર્યનું, દેખાવની પશ્ચાદભૂમિમાં સધળી ગતિનું દર્શન થાય છે, ત્યારે તે માનવના સામાન્ય જૂદાણાં કરતાં કોઈ રહારે સાચી વસ્તુને જીવવા માટે તૈયારી કરે છે, તેથી પહેલાં નહિ.

આમાં તડાડ નથી હોતી, સમજ્યા? તે માંદળી પછી સાજ થવાની કિયા જેવું નથી હોતું. તમારે જગતોનું પરિવર્તન કરવાનું હોય છે. જ્યાં સુધી તમે મનને વાસ્તવિક માનો છો, તમારી વિચારસરણીને સાચી અને સધન માનો છો, ત્યાં સુધી તમે તે લિખતિને પ્રામ નથી કરી એ વાત સિદ્ધ થાય છે. તમારે પ્રથમ તો બીજુ બાજુએ ચાલ્યા જવાનું હોય છે. પછી તમે મારી વાતને સમજી શક્યો.

બીજુ બાજુએ ચાલ્યા જાઓ.

માસુસ ધીરે ધીરે સમજતો હોય છે એ વાત સાચી નથી. આ પ્રકારના પ્રગતિ બિન્ન હોય છે. વધારે સાચી વાત તો એ છે કે ઈંડામાં બદ્ધાનું બનતું હોય છે તેમ, તે માસુસ એક કોચલામાં પૂરાઈ રહ્યો હોય છે અને અંધર કાંઈક બની

રહ્યું હોય છે. તે જોઈ શકતું હોતું નથી. કોચલામાં કાંઈક થઈ રહ્યું હોય છે, પણ બહાર કથું દેખાતું હોતું નથી. જ્યારે અંદર બધું તૈવાર થઈ જાય છે, ત્યારે કોચલાને લેદ્વાની અને દિવસના પ્રકાશમાં જન્મવાની શક્તિ આવે છે.

ત્યારે માસુસ ધોમે ધોમે વધારે ને વધારે દૃષ્ટિગોચર બનતો જાય છે એવું નથી હેતું. તે તો અંદર પૂરાઈ ગયેલો હોય છે. સામાન્ય વાગ્યુપદ્ધતિ લોકોને તો એમ પણ વાગતું હોય છે કે હું કચડાઈ-લોંસાઈ રહ્યો છું, બહાર આવતાં ભીત સાથે અફ્ઝાઈ રહ્યો છું, તે દ્વારા ખખદ્વષતો જ રહે છે, પણ બહાર આવી શકતો નથી.

જ્યાં સુધી માસુસ અંદર હોય છે, જ્યાં સુધી તે અસત્યમાં હોય છે. જ્યારે જગવાનની કૃપાથી એક દિવસ તે કોચલાને લેદીને બહાર આવે છે, ત્યારે જ તે મુક્ત બને છે.

આ ઓચિતું, સ્વયંભૂ અને પદ્ધતિપૂર્વક બની શકે.

મને એમ નથી વાગતું કે માસુસ ધોમે-ધોમે તેમાંથી પસાર થઈ શકે. તે કોચલું ધોમે ધોમે ઘસાઈ જાય અને પોતે તેની આર પાર જોઈ શકે, હજુ સુધી મને તેવું દૃષ્ટાંત જડયું નથી. તેમાં તો આંતર શક્તિમાં એક પ્રકારની વૃદ્ધિ થતી જ રહે છે, જરૂરિયાત ઉત્કટ બનતી ચાલે છે, તે પ્રયત્ન કરવામાં એવી સહિતણુંના આવે છે કે જે સર્વ ભયથી, સર્વ ચિંતાથી, સર્વ ગ્રસુતરીથી મુક્ત બની જતી હોય છે; તે જરૂરિયાત પછી પરિસ્થિતિમાની દરકાર કરતી હોતી નથી.

તે એવો એક લડાકો હોય છે, કે જેનો પ્રતિરોધ કોઈ પણ વસ્તુ કરી શકતી નથી. ત્યારે માસુસ પોતાની જ્યોતિરીથી પ્રકાશના જળહળાટમાં કૂદી પડે છે.

પછી તે માસુસ કદ્દી પાછો તે કોચલામાં પડી જતો હોતો નથી.

તે સાચે જ એક નવીન જન્મ હોય છે.

### ૩ જુલાઈ ૧૯૭૭

મને પૂછવામાં આવ્યું છે કે આપણે સામૂહિક યોગ કરી રહ્યા છીએ? સામૂહિક યોગની શરૂઆત થી છે?

પ્રથમ તો મારે તમને કહેવું જોઈએ કે સામૂહિક યોગ કરવા માટે પથમ તો સમૂહ હોવો જોઈએ. અને પછી તે સમૂહ બનવા માટે જે અનેક પ્રકારની શરતો છે તે વિષે ચાત કરવી જોઈએ. (સિમત કરતાં) પણ ગઈ કાઢે રાતે મને આપણી સામૂહિકતાની એક પ્રતીકમય અનુભૂતિ પ્રાપ્ત થઈ હતી.

તે અનુભૂતિ રાતના પ્રથમના ભાગમાં પ્રાપ્ત થઈ હતી. તેથી હું અલુગમતી માગણીપૂર્વક જાગી ગઈ હતી. પછી હું ઊંઘી ગઈ અને તે અનુભૂતિ ભૂવી ગઈ. જ્યારે હમણાં જ મને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એચિંતી તે અનુભૂતિ મારી પાસે પાછી આવી. તે અનુભૂતિ ખૂબ ઉત્કટતાપૂર્વક અનિવાર્ય રીતે મારામાં પાછી આવી. શ્રીઅરવિંદ 'દિવ્ય જીવન'ના છેલ્લા પ્રકરણમાં ને આદર્થ રજુ કર્યો છે તે અનુસાર આપણે કયા પ્રકારના સમૂહનો સાક્ષાત્કાર કરવો જોઈએ, તે વિષે હું વાત કરવા માગતી હતી. તે સમૂહ અતિમાનસ, જ્ઞાનપૂર્ણ હોવો જોઈએ, તો જ તે શ્રીઅરવિંદના પૂર્ણયોગનો અભ્યાસ કરી શકે, અને પ્રગતિમય સામૂહિક શરીરમાં ભૌતિક રીતે તેનો સાક્ષાત્કાર થઈ શકે, ને ભૌતિક શરીર વધારેમાં વધારે દિવ્ય બનતું ચાલે. આ અનુભૂતિની સ્મૃતિ એટલી બધી બળવાન, અને અનિવાર્ય હતી કે, તેણે મને બેબતા અટકાવી.

તેનું પ્રતીક સ્પષ્ટ અને તદ્દન પરિચિત હતું. પણ પરિચિતતામાં તે ભૂવન થઈ શકે તે રીતે વાસ્તવિક હતું. તે એટલું બધું જાટિબ હતું કે જો હું તમને વિસ્તારપૂર્વક તેનું વર્ણન કરું, તો કદાચ તમે તે સમજ નહિ શકો. તે પ્રતીક એક હોટેલનું હતું, જેમાં લિન્ન લિન્ન ખંડોમાં સર્વ પાર્થિવ શક્યતાઓને નિવાસ આપવામાં આવ્યો હતો. તે બધું સતત પરિવર્નનની સ્થિતિમાં હતું. તે મકાનના ટૂકડા અથવા સમગ્ર પાંખો એકદમ ભાંગી નાંખવામાં આવતાં હતાં, અને તેમનું નવનિર્માણ કરવામાં આવતું હતું. છતાં બધા લોકો હજુ પોતાના ખંડોમાં રહેતા હતાં અને તે પણ એવી રીતે કે જો કોઈ માલુસ હોટેલમાં જ પોતાના ખંડની બલાર ગણો હોય, તો તેને ફરી પોતાના ખંડ ન જડે! કરણકે તે ખંડને ભાંગી નાંખવામાં

આવ્યો હો અને બીજી યોજના અનુસાર તેનું નવનિર્માણ થઈ રહ્યું હતું. ત્યાં વ્યવસ્થિતતા હતી, સંગઠન હતું, અને છતાં ત્યાં મેં વર્ષાવી છે તેવી વિચિત્ર અંધાધૂંધી હતી, તેમાં એક પ્રતીક હતું, જે શ્રી અરવિંદે જેને વિષે લખ્યું છે તેને બરાબર લાગુ પડે છે. શ્રી અરવિંદે શરીરના રૂપાંતરની જરૂરિયાત વિષે, જીવન દિવ્ય બને તે માટે, તે રૂપાંતર કર્યા પ્રકારનું હોય જોઈએ તે વિષે લખ્યું છે.

તે કાંઈક આ પ્રકારનું પ્રતીક હતું. તે મકાનના ભદ્ય લાગમાં એક ખંડ એક માતા અને તેની પુત્રી માટે અલાયદો રાખવામાં આવ્યો હતો. માતા વૃદ્ધ હતી. તે પોતાની જાતને ખૂબ મહત્વ આપતી. તે સત્તાશીલ હતી. તે સમગ્ર સંગઠન પર પોતાના અભિપ્રાયો ઠોકી બેસાડતી હતી. પુત્રીમાં ગતિની અને કિયાની એવી શક્તિ હતી કે તે પોતાની રૂમમાં જ બેઠી હોય, અને છતાં તેજ સમયે તે સર્વોત્તમ હોય તેમ અનુભવતી. તે ખંડ જરાક મોટો હતો, તેનું મુખ્ય લક્ષણ એ હતું કે તે ખંડ કેન્દ્રમાં હતો. પણ પુત્રી સતત પોતાની માતા સાથે દલીલો કર્યા કરતી. માતા વસ્તુઓ હતી તેમ જ રાખવા માગતી હતી, તેની તેજ છંદોમયતા જળવી રાખવા માગતી હતી, તે છંદોમયતા અનુસાર જ એક વસ્તુ ભાંગી નાંખીને તેનું નવનિર્માણ કરવાની તેને ટેવ હતી. જેને પરિણામે મકાનમાં ભીષણ ગુંચવાડો ઉભો થતો હતો. પુત્રીને તે પસંદ ન હતું. તેની પાસે બીજી યોજના હતી. તે આ સંગઠનમાં કોઈક તદ્દન નવી જ વસ્તુ લાવવા માગતી હતી, એક પ્રકારનું અલોકિક સંગઠન, જે આ બધા ગુંચવાડાને નિર્ણય કરનાંથી દે. માતા સાથે કોઈ સમજૂતિ પર ન આવી શકવાને કારણે, પુત્રી પોતાના ખંડમાંથી આખા મકાનનું નિરીક્ષણ કરવા ફરવા લાગી. તેણે બધું નિરીક્ષણ કરી લીધું. પછી તેને પોતાના ખંડમાં જવાની ઈચ્છા થઈ. ત્યાં જઈને તે કોઈ નિર્ણયાત્મક કાર્ય કરવા માગતી હતી. ત્યારે એક ખાસ, વિચિત્ર ઘટના જીવા લાગી. પોતાનો ખંડ કયાં હતો તે તેને બરાબર યાદ હતું. પણ દરેક વખતે, જ્યારે તે એક માર્ગ પોતાના ખંડમાં જવાનીકળતી, ત્યારે કાંતો નીસંરણીનાં પગથિયાં અદૃશ્ય થઈ જતાં અથવા વસ્તુઓ એટલી બધી પરિવર્તન પામી જતી કે તે પોતાના માર્ગને ઓળખી શકતી નહિ! એટલે તે આમતેમ ફરી, ઉપર ચઢી અને નીચે ઉત્તરી, શોધ કરી, અંદર ગઈ અને બહાર આવી, પણ તેને પોતાના ખંડનો રસ્તો જડયો નહિ! આ બધું એક ભૌતિક દેખાવ હતો. જે ખૂબ પરિચિત અને સામાન્ય હતો. પ્રતીકમય અનુભૂતિ-ઓમાં હમેશાં એવું જ બનતું હોય છે. પણ કયાંક તે હોટેલના મેનેજરની ઓફિસ

હતી. મેનેજર એક છી હતી. તેની પાસે બધી ચાવીઓ હતી. દરેક જાણ ક્યાં રહેતું હતું તે તે જાણતી હતી. એટલે પુત્રીએ તેની પાસે જઈને પૂછ્યું કે તમે મને મારા ખંડનો માર્ગ બતાવશો? તેણે જવાબ આપ્યો કે હા, જરૂર, તે બહુજ સહેલી વાત છે. બધા લોકો જાણે આશ્રમપૂર્વક કહી રહ્યા હતા કે તમે એમ કુશી રીતે કહી શકો છો? પણ તે ઉલ્લી થઈ, અને સત્તાવાહી અવાજમાં તેણે પૂછ્યું કે તે ખંડની ચાવી ક્યાં છે? હું તમને ત્યાં લઈ જઈશ. પછી તે બધા માર્ગો પર ફરી વળ્યો. તે બધા માર્ગો બહુ જટિલ, ગુંચવાયેલા હતા! તે પોતાની નજર બહાર ચાલી ન જાય તે રીતે, પુત્રી ધ્યાનપૂર્વક તેની પાછળ પાછળ ગઈ. જે કાણે તેઓ તે પુત્રીના ખંડ પાસે આવતાં હતાં તેજ કાણે તે મેનેજર ચાવી સાથે, અદૃશ્ય થઈ ગઈ! આ અદૃશ્ય બની જવાની લાગણી એવી તો તીવ્ર હતી કે તેની સાથે બધુંજ અદૃશ્ય થઈ ગયું.

તમે આ સમસ્યાને સમજ શકો એટલા માટે હું કહીશ કે માતા એ ભૌતિક પ્રકૃતિ છે, પુત્રી એ નરીન સુષ્ઠિ છે. માનસિક ચેતના એ મેનેજર છે, જે પ્રકૃતિએ અત્યાર સુધી બનાવેલા જગતનું સંગઠન કરે છે, અર્થાતું ભૌતિક પ્રકૃતિમાં પ્રગટ થયેલા વર્તમાન સંગઠનની ઉત્ત્યતમ ભાવના છે. અનુભૂતિની આ ચાવી છે. સ્વાભાવિક રીતે જ, જ્યારે હું જગી ગઈ, ત્યારે જેનો ઉકેલ લાવી શકવો અધ્યાતું હતું એ સમસ્યાનો ઉકેલ કોણું લાવી શકે તે મેં તરત જાણી લીધું. મેનેજર અને ચાવી અદૃશ્ય થઈ ગયાં તે સ્પષ્ટ રીતે સૂચવે છે કે તે સાચી જગ્યાએ નવીન સુષ્ઠિની સર્જનાત્મક ચેતના પ્રત્યે દોરી જવા માટે અસર્વાદ હતી.

હું તે જાણતી હતી, પણ તેના ઉકેલની અનુભૂતિ મને પ્રાપ્ત થઈ ન હતી, અર્થાત તે એક એવી વસ્તુ છે કે જેનું પ્રાગટ્ય હજી કરવાનું બાકી છે. તે હોટેલના મકાનમાં હજી તે વસ્તુ પ્રગટ થઈ ન હતી. ચેતનાનો આ જ નિશ્ચિત પ્રકાર છે, જે અસંબદ્ધ સુષ્ઠિને કોઈક એવી વસ્તુમાં પરિવર્તિત કરશે, કે જે વાસ્તવિક હશે, જેનો ધ્યાલ સાચી રીતે બાંધવામાં આવ્યો હશે, જેને માટે સંકદ્ય કરવામાં આવ્યો હશે, જે કાર્યાન્વિત બનશે, જેનું કેન્દ્ર તેની સાચી સ્વીકૃત જગ્યાએ હશે, જેનામાં સાચી અસરકારક શક્તિ હશે.

( મૌન )

૧. ‘અતિ-મનસ્યનો આવિર્ભાવ પૃષ્ઠ ૩૩-૩૯.

તેનું પ્રતીક સાવ સ્પષ્ટ છે, અર્થાત ત્યાં બધી જ શક્યતાઓ છે, સર્વ કિયાઓ છે, પણ તે બધી અભ્યવહિસ્થિત અને ગુંઘવાડા બરેલી સ્થિતિમાં છે. તે બધાનો સમન્વય સાધવામાં નથી આવ્યો, એક કેન્દ્રસ્થ સત્યચેતના અને સંકલ્પની આસપાસ તેમને એકત્રિત કરવામાં નથી આવી હવે આપણે સામુહિક યોગની વાત પર આવીએ, તેનો સાક્ષાત્કાર કરી શકે તેવા સમૂહની વાત પર આવીએ. આ સમૂહ કેવા પ્રકારનો હોવો જોઈએ?

તે ચોક્કસ સામાન્ય માલુસો વડે નિર્માણ કરાતી સ્વેચ્છાપૂર્વકની ઈમારત નથી, જેમાં તેઓ બધી વસ્તુઓ અસ્તિવ્યસ્ત રીતે ખડકતા હોય છે, જેમાં કોઈ વ્યવસ્થા કે વાસ્તવિકતા નથી હોતી, જ્યાં બધી વસ્તુઓ ભ્રાન્તમય કરીએ હોય એક બીજ સાથે સાંકળવામાં આવતી હોય છે. જેનું પ્રતીક અહીં હેઠેલની ભીંતો હતી. સામાન્ય માનવીય રચનાઓમાં જે આપણે એક ધાર્મિક સંઘનો દાખલો વઈએ, તો તેના પ્રતીકો હોય છે. મથુર, એક જ પ્રકારનો વેશ, એક જ પ્રકારની કિયાઓ, એક જ પ્રકારની ગતિઓ. હું તેને વધારે સ્પષ્ટ કરીશ. દરેક જણ એક જ પ્રકારનો ગણુવેશ પછેરે છે, દરેક જણ તેજ નિશ્ચિત કલાકે જગે છે, એક જ પ્રકારની વસ્તુઓ ખાય છે, એકઠા મળીને એક જ પ્રકારની પ્રાર્થનાએ. કરે છે વગેરે. આ સર્વસાધારણ એક જ પ્રકારની સમાનતા છે. અને સ્વાભાવિક રીતે જ, અંદર ચેતનાની અંધાધુંધી હોય છે. દરેક જણ પોતાની રીતે વર્તતો હોય છે. કારણ કે માન્યતાની અને કટૂર સિદ્ધાંતની આ એકતા અને સમાનતા તદ્દન ભ્રાન્તમૂલક એકતા અને સમાનતા હોય છે.

માનવ સમૂહ મોટે ભાગે આ પ્રકારનો હોય છે. તે એક સર્વસાધારણ આદર્શની આસપાસ, એક સર્વસાધારણ કિયાની આસપાસ, એક સર્વસાધારણ સાક્ષાત્કારની આસપાસ એકત્રિત થયેલો હોય છે, સંકળાયેલો હોય છે; પણ તે તદ્દન કૃત્રિમ રીતે. આનાંદી વિરુદ્ધ, શ્રીમરવિંદ આપણને કહે છે કે સાચો, અતિમાનસિક, શાનમય સંઘ તેમાંના દરેક સભ્યના આંતર સાક્ષાત્કારના પાયા પર જ રચાઈ શકે. તેમાં દરેક સભ્યે સંઘના બીજ સભ્યો સાથે સાચી, સધન એકતા સાધવાની છે. તેમાં દરેક સભ્યને લાગવું જોઈએ કે બધા સભ્યો મારામાં એકરૂપ છે, નહિ કે કોઈક રીતે હું બીજ સભ્યો સાથે જોડાયેલો છું. દરેકને બીજ બધા સભ્યો, પોતાના શરીર જેવા જ, પોતાના રૂપ લાગવા જોઈએ, અને તે પણ માનસિક અને કૃત્રિમ રીતે નહિ, પણ ચેતનાની હકીકત વડે, આંતર સાક્ષાત્કાર વડે.

## (મોન)

તેનો અર્થ એ થયો કે આ જ્ઞાનમય સંઘના નિર્માણની આશા રાખતા પહેલાં, દરેક જ્ઞાને પ્રથમ જ્ઞાનમય બનનું જોઈએ અથવા બનવા માટે પ્રયત્ન કરવો જોઈએ, આ વાત સ્પષ્ટ છે. વ્યક્તિનું કાર્ય આગળ ધ્યાનું જોઈએ, અને સાંધિક કાર્યો તેને અનુસરનું જોઈએ. પણ તેમાં એવું બને છે કે સ્વયંભૂ રીતે, સંક્લયની કોઈ સ્વેચ્છિક દખલગીરી બિવાય, વ્યક્તિની પ્રગતિ સાંધિક સ્થિતિ વડે તુંધાઈ જાય છે. વ્યક્તિ અને સંઘ એક બીજા પર આધાર રાખતાં હોય છે; પ્રયત્ન કરવા છતાં કોઈ વ્યક્તિ તેમાંથી છટકી જઈ શકતી નથી, જે માલસ યેતનાની પાર્થિવ અને માનવીય સ્થિતિમાંથી પોતાની જાતને સંપૂર્ણ પણે મુક્ત કરવાનો પ્રયત્ન, પોતાના યોગમાં કરે છે, તે પણ, છેવટે તેની અવયેતનામાં, સમૂહની સ્થિતિ વડે બંધાઈ જતો હોય છે, જે સ્થિતિ બ્રેકની પેઠે કામ કરે છે અને તેને ખરેખર પાછો જોંથી પાડે છે. માલસ વધારે જડપથી પ્રગતિ કરવા પ્રયત્ન કરે, આસક્તિ-ઓના અને જવાબદારીઓના સર્વ વજનને હેંડી દેવાનો પ્રયત્ન કરે, પણ છતાં ઉત્કાંતિની આગેકુચમાં પ્રથમ રહેલા, શિખર પર પહોંચેલા માલસનો પણ સાક્ષાત્કાર, સમગ્રના સાક્ષાત્કાર ઉપર, પાર્થિવ સમૂહની સ્થિતિ ઉપર આધાર રાખતો હોય છે, તે તેને પાછો જોંથતો હોય છે, અને કેટલીક વાર તો, પૃથ્વી નૈયાર થાય તે માટે, જે કરવાનો છે તે સાક્ષાત્કાર સિદ્ધ કરવા માટે, તેણે સદીઓ સુધી રાહ જોવી પડતી હોય છે.

તેથી શ્રી અરવિંદ અન્યત્ર કહે છે કે “ દ્રિમુખી ગતિની જરૂર છે. વ્યક્તિગત પ્રગતિના અને સાક્ષાત્કારના પ્રયાસને સમગ્ર સમૂહને ઉન્નત બનાવવાના પ્રયાસ સાથે જોડી દેવાનો હોય છે, જેથી વ્યક્તિની મહત્તર પ્રગતિને શક્ય બનાવવા માટે અનિવાર્ય એવી સામૂહિક પ્રગતિ પણ સધાય. તેને તમે સામૂહિક પ્રગતિ કહી શકો, કે જે વ્યક્તિને એક ડગનું આગળ વધવા માટે છૂટ આપે છે.

તેથી હું સામૂહિક ધ્યાનને ઉપયોગી માનું છું, જેથી ગઈ કાબે રાતે મને જે હોટેલનું દર્શન થયું હતું તેના કરતાં વધારે સંગઠિત, સર્વસાધારણ વાતા-વરણના સર્જન ઉપર કાર્ય કરી શકાય.

આપણે હવે વહેંચણીઓને બદલે વધારે વાર ટૂંકા સમય માટેના ધ્યાનો કરીએ છીએ. આ ધ્યાનોનો કોઇ ઉપયોગ આ રીતે કરી શકાય; અંદર પ્રવેશ

કરવો, પોતાના અસ્તિત્વના ઊંડાણોમાં વથાશક્તિ જરૂર, એવી એક જગ્યા ખોળી કાઢવી, જરૂર પડે તેનું સર્જન કરવું, જગ્યાં એકતાનું વાતાવરણ હોય, જેમાં વ્યવસ્થાની અને સંગૃહનની શક્તિ દરેક તર્ફને એની વૈષ્ય જગ્યાએ મૂકી આપે, અને અત્યારની અંધાધુંધીમાંથી એક નવી સમન્વિત સુભિંદું સર્જન કરે.

\*

## ૬ જુલાઈ ૧૯૫૭

અપવાદ રૂપે, એક મંગળવારે, ધ્યાન પહેલાં આ ટૂંકો વાર્તાલાય બાળકોને આપવામાં આવ્યો હતો.

આપણે કહ્યું કે આપણે પદ્ધતિપૂર્વક આપણી જતને સાધના માટે તૈયાર કરવા માગીએ છીએ. મેં એક મુદ્દા ખર બધુ જ ભાર મૂક્યો છે, પણ કમનસીબે તેનું તમારા પર જાળું પરિણામ આવ્યું હોય તેમ દેખાનું નથી. તેથી મેં વિચાર્યું કે ભાવિ સાધના માટે તમને તૈયાર કરવા કદાચ તેનાથી શરૂઆત કરવી એ વધારે સારું થશે.

એટલે આજ સાંજના આપણા ધ્યાનનો વિષય રહેશે “વાણીના અસંયમથી થતું નુકસાન.”

મેં તમને ઘસ્તીવાર કહ્યું છે કે નિરર્થક બોલાયેલો દરેક શર્જદ એ જોખમકારક બબડાટ છે. પણ અહીં તો સિથિત પરાકાણાએ પણોચી ગઈ છે. માનવ જતિને પરિપૂર્ણ બનાવવા મયનાર લોકો વડે અમુક વસ્તુઓ વારંવાર કહેવામાં આવી છે, પણ કમનસીબે તેનું પરિણામ જાળું આવ્યું નથી. તે દ્વોષપૂર્ણ ગપ્પાં મારવાની ટેવ છે, નિંદા કરવાની ટેવ છે, બીજાનું ભુડું બોલવાની ટેવ છે. આ પ્રકારના વાણીના અસંયમમાં ભજ લેનાર માણસ પોતાની ચેતનાને નિકૃષ્ટ બનાવે છે. જયારે વાણીના આ અસંયમમાં જંગલી કંજિયા કરવાની અને તેમને કઠોર ભાષામાં

વ્યક્ત કરવાની ટેવ ઉમેરાય છે, ત્યારે તે પોતાની જતમાં આધ્યાત્મિક આપદાત બની જય છે.

હું આ બાબત પર ભાર મૂકું છું, અને આગ્રહ કરું છું કે તમે આ બાબતનો ખૂબ ગંભીરતાપૂર્વક વિચાર કરો.

( શ્યામ )

## ૧૦ જુલાઈ ૧૯૪૭

“ એમ પણ બને કે ઉત્કાનિતનો આવેગ, તેમના ભૌતિક કાર્યમાં, અંગોને પરિવર્તિત કરે, તેમનો કરણો તરીકે ઉપયોગ કરવાનું ઓછું કરી જ નાથે, અને તેમના અસ્તિત્વની પણ પછી જરૂર ન રહે. પછી તે માસુસ સૂક્મ શરીરનો કેન્દ્રોથી, ચક્કોથી સભાન બને છે, તેમાં શાલતી સર્વ ઘટનાઓથી સભાન બને. પછી તે થકો પોતાની શક્તિઓ ભૌતિક જ્ઞાનતંત્રમાં, મજાજતંત્રમાં રેખાવે અને તેમને આખા ભૌતિક શરીરમાં પ્રકાશિત કરે. આ નવીન અસ્તિત્વમાં, સર્વ શારીરિક જીવનને અને તેની જરૂરી કિયાઓને આ ઉચ્ચતર શક્તિઓ, વંધારે મુક્ત અને વિશાળ રીતે, ટકાવી રાખે અને સક્રિય બનાવે અને તે પણ ઓછી ભારદાયક અને નિયંત્રયકારી પદ્ધતિથી એ વાત વાં સુધી પહોંચી જય કે આ અંગો પછી અનિવાર્ય ન બની રહે, તે રૂક્મવટકારી લાગે કેન્દ્રસ્થ શક્તિનો તેમનો થોડોને થોડો ઉપયોગ કરે, અને આખરે તેમના ઉપયોગને સંપૂર્ણપણે ફેંકી દે. તેમ બને, તો અંગો બિનઉપયોગથી કીસું બની જય, તેમનો થોડામાં થોડો ઉપયોગ થાય, અથવા છેવટે તે અદૃશ્ય બની જય, કેન્દ્રસ્થ શક્તિનો બદલે ખૂબ જુદા પ્રકારના સૂક્મ અંગો સ્થાપે અથવા જો કોઈક ભૌતિક વસ્તુની જરૂર પડે તો કિયાશીલતાના રૂપો જેવાં, સિથિતસ્થાપક ટ્રાન્સમિટરો જેવાં કરણોનો ઉપયોગ કરે, આપણે જેમને અંગો જાણુંને છીએ તેમનો નહિ. શરીરના સમગ્ર પરિપૂર્ણ રૂપાંતરનો આ એક ભાજ બની રહે, જો કે આપણે આખરી તો નથી જ, આવા પરિવર્તનોંની જાંખી કરવી એટલે ખૂબ ખૂબ આગળ જેવું. વસ્તુઓના અત્યારના રૂપમાં આસક્ત મન આ

શક્યતાને માનવા માટે સમર્થ ન બને, ઉત્કાન્તિતના આવેગ પર એવી કોઈ મર્યાદાઓ, જરૂરી પરિવર્તન બાબત એવી કોઈ અથક્યતા ન લાદી શકાય જેનાથી આગળ વધવાનું છે, જેનો હવે કોઈ ઉપયોગ રહ્યો નથી, જે નિકૃષ્ટ બની ગયું છે. જે મદદરૂપ રહ્યું નથી અથવા જે પ્રતિરોધક છે, તે બધાને ભાર્ગમાં ફેંકી દેવું જોઈએ. ઉત્કાન્તિતના ઈતિહાસમાં શરીર પ્રથમ પ્રાથમિક રૂપોવાળું હતું, તે વિકસીને માનવીય રૂપનું બન્યું, તે આજ વાતને સિદ્ધ કરે છે. માનવીય શરીર દિવ્ય શરીર બને, તે રૂપાંતરમાં આ પ્રક્રિયા વચ્ચે ન આવે એમ માનવાને કોઈ કારણ નથી. પુઢ્યી પર દિવ્ય શરીરનો આવિલ્લાવ કરવા માટે અથવા તો તેનું નિર્માણ કરવા માટે, એક પ્રાથમિક પરિવર્તન થવું જોઈએ; એક નવીન મહત્તર, વધારે વિકસિત પ્રકાર ( ટાઈપ ) પેદા થવો જોઈએ. તેમાં અત્યારના ભૌતિક રૂપને અને તેની મર્યાદિત શક્યતાઓને ચાલુ ન રાખી શકાય. ”

( અતિમનસ્નો આનિર્ભાવ, પૃષ્ઠ ૩૮-૩૯ )

અસ્તિત્વની જૂની ટેવેમાંથી મુક્ત બનવું, અને મુક્ત રીતે નવીન જીવન વિને, નવીન જગત વિષે જ્યાલ બાંધવા સમર્થ બનવું એ બધું કહિન છે. સ્વાભાવિક રીતે જ મુક્ત ચેતનાથી ઉચ્ચતમ ભૂમિકાઓ પર શરૂ થતી હોય છે. પ્રાણીક સર્વ કરતાં મન અથવા તો ઉચ્ચતર બુદ્ધિ નવીન વસ્તુઓનો જ્યાલ વધારે સહેલાઈથી કરી શકે છે. દા. ત. વસ્તુઓને એક નવીન પ્રકારે અનુભવવી, એ નવીન જગત કેવું હશે તેનું સ્પષ્ટ ભૌતિક દર્શન કરવું તે શરીરને માટે તો તેથી (પ્રાણીક કરતાં) પણ વધારે કહિન છે. છતાં આદર્શને, ભૌતિક રૂપાંતર સીધું થતાં પહેલાં આપવું જોઈએ. પ્રથમ તો માસુસને જૂની વસ્તુઓની વિચિત્રતા તેમની સંબંધતાનો અભાવ સથન રીતે અનુભવવો જોઈએ. તેને એવી માગણી, -ભૌતિક સંસ્કાર થવો જોઈએ કે આ જૂની વસ્તુઓનો સમય હવે રહ્યો નથી, તે ભૂતકાળની બની ગઈ છે અને તેથી નિરર્થક બની ગઈ છે. જે ભૂતકાળની વસ્તુ ઐતિહાસિક બની ગઈ છે તે દૃષ્ટિબિંદુથી જેમનામાં રસ લઈ શકાય તેમ છે અને જે વર્તમાનકાળની તથા ભાવિની પ્રગતિમાં મદદ કરે છે, તેમના સંસ્કારો પણ જૂના જગતની ગતિરૂપ છે. તે જૂનું જગત જ ભૂતકાળને, વર્તમાનને અને ભાવિને પ્રગટ કરતું રહે છે. પણ નવીન જગતના સર્જન માટે પરિવર્તનનું સાનત્ય જરૂરી છે. તેમાં બે વસ્તુઓ એક બીજા સાથે મિશ્રિત થઈ ગયેલી હોય છે. અને છતાં તે વિભિન્ન હોય છે તેનો જ્યાલ તે પરિવર્તન આપનું

હોય છે. ભૂતકળની વસ્તુઓમાં, નવીન વસ્તુઓની મધ્યમાં, ટક્કે રહેવાનું બળ નથી. પછી તેમનામાં ગમે નેટલા ફેરફારો કરવામાં આવે તે બીજું જગત આવશ્યક રીતે એક તદ્દન નવી અનુભૂતિ છે. તેનો સમય શોધા કાઢવા માટે, આપણે તે સમય પર પાછા જવું જોઈએ કે જ્યારે પશુમાંથી માનવતારૂપમાં પરિવર્તન થયું હતું ત્યારે ચેતનાનું આટલું બધું માનસીકરણ થયું ન હતું કે જેથી તે પરિવર્તનનું અવલોકન કરી સમજ શકે. બુદ્ધિપૂર્વક અનુભવી શકે તે માર્ગ બહુ સુસ્પષ્ટ રીતે વટાવવામાં આવ્યો હોવો જોઈએ. એટલે હું જેને વિષે વાત કરી રહી છું તે એક તદ્દન નવી વસ્તુ છે. પાર્થિવ સૂણિમાં અસાધારણ વસ્તુ છે, અભૂતપૂર્વ વસ્તુ છે. સાચી રીતે એક નવીન, તદ્દન વિચિત્ર અનુભૂતિ, સંસ્કાર છે. (થોડીક વાર મૌન પછી) તે એક પ્રકારનો વિચ્છેદ છે. જૂની વસ્તુનો જવાનો સમય આવી પહોંચ્યો છે, તેને અસ્તિત્વનું ખૂબ ગૌણ બળ છે, જે નવી વસ્તુ આવી રહી છે તેનાથી તદ્દન જિલ્લા છે. પણ નવી આપતી વસ્તુ હજી બાલ્યાવસ્થામાં દૃષ્ટિ-ગોચર નથી, નિર્બળ છે, હજી તેનામાં જૂની વસ્તુનું સ્થાન બેવાની શક્તિ નથી, તેના પર પ્રભુત્વ મેળવે એટલું બળ નથી, એટલે તે બન્ને સાથે સાથે રહે છે અને છતાં તે બેમાં વિચ્છેદ છે, તે જે વચ્ચેનો સંબંધ હજી ઉપલબ્ધ થયો નથી.

તેનું વસ્તુનું કરવું અધ્યકું છે. પણ હું તમને એને વિષે કહી રહી છું: કરણ કે ગઈ કાલે સાંજે મને તેનો અનુભવ થયો હતો. મને તે એવો તો નીદ્ર અનુભવ થયો હતો કે, મને તેણે અમૃત વસ્તુઓ તરફ જોવાની ફરજ પાડી અને જોયા પછી મને એમ લાગ્યું કે તેના વિષે તમને કહેવું એ રસપ્રદ થઈ પડશે.

(મૌન)

કિલ્મ-શ્ચો જેણું કંઈક નવીન, કંઈક ખાસ, કંઈક અનપેક્ષિત જેણું બને છે, એ વિચિત્ર વાત છે. જે બોકો એમ માને છે કે અમૃત વસ્તુઓ મહત્વની છે અને અમૃત વસ્તુઓ મહત્વની નથી, કેટલીક ક્રિયાઓ યોગમાં મદદદ્યપ હોય છે અને બીજી તેમાં મદદગાર નથી હોતી, તે જોટા છે એમ સાબિત કરવાની આ એક વધારે તક છે. મેં હંમેશાં જોયું છે કે અનપેક્ષિત વસ્તુઓ જ ખૂબ રસપ્રદ અનુભૂતિઓ આપતી હોય છે.

ગઈ કાલે સાંજે એંદ્રાધિંતી જે વસ્તુ બની હતી, તેનું વસ્તુનું મેં હમણાં જ યથાશક્તિ કર્યું છે. તમે મને સમજ શક્યા છો કે નહિ, તે હું જાણતી નથી.

પણ તે તદ્દન નવીન અને અનપેક્ષિત હતું. આપણને જરાક બેઢૂઢી રીતે, ગંગાતટ પરના તે મંદિરનું ચિત્ર મને લાગે છે કે તે મૂર્તિની છબી હતી; હું તેની ચોક્કસ માહિતી મેળવી શકી નથી. મને તે બતાવવામાં આવ્યું હતું. જ્યારે હું તે ઉપરચ્ચાટિયું અને બેઢૂઢું ચિત્ર જેતી હતી, ત્યારે મને તેના પીડમાં જે વાસ્તવિકતા હતી, જે વસ્તુને બનવા માટે તે પ્રયત્ન કર્઱ું હતું, તે દેખાઈ. તે દર્શને મને ધર્મના, પૂજાના, અભીપ્રાસાના, માલસના દેવો સાથેના સમગ્ર સંબંધના, માનવ કરતાં વધારે દિવ્ય એવી કોઈક વસ્તુ પ્રત્યેના માનવના આધ્યાત્મિક પ્રયત્નના મુખ્યમાં, માનવ કરતાં ઉચ્ચતર તત્ત્વ પ્રત્યે માનવના પ્રયાસની જે ઉચ્ચતમ અને વિશુદ્ધતમ અભિવ્યક્તિ છે તેવા કાંઈકના સંપર્કમાં મૂકી આપી. મને ઓછિંતો, સધનતાપૂર્વક, ભૌતિક રીતે એવી લાગણી થઈ આવી કે તે એક બીજું જગત હતું, જે વાસ્તવિક અને જીવંત રહ્યું નથી, જે પુરાણું બની ગયું છે, જેણે પોતાની વાસ્તવિકતા અને પોતાનું સત્ય ગુમાવી દીધાં છે, જેણે જન્મ લીધાં છે અને જે પોતાની જાતને પ્રગટ કરવાની શરૂઆત કરી રહ્યું છે તેવું કાંઈક તે પુરાણું જગતથી પર અધિક બની રહ્યું છે, પણ તે કાંઈક એવું તો ઉત્કટ, સત્ય અને ઉદાત હતું કે જેણી આગળ આ પુરાણું જગત અસત્ય, અવાસ્તવિક, મૂલ્ય વરણું બની ગયું.

ત્યારે મસ્તિષ્ક અને બુદ્ધિ વડે નહિ પણ શરીર વડે, શરીરના કોણાણું ઓમાં હું સમજી કે એક નવીન જગત જન્મી ચુક્કું છે અને વૃદ્ધિને પ્રાપ્ત કરી રહ્યું છે.

જ્યારે મેં આ બધું જોયું, ત્યારે ૧૯૨૬માં જે બન્યું હતું તે મને યાદ આવ્યું.

શ્રી અરવિંદે મને બાધ કામકાજ સોંઘ્યું, કારણ કે તે ધ્યાન કરવા માટે એકાંતમાં ચાલ્યા જવા માગના હતા, જેથી અતિમનસની ચેતનાનું પ્રાગટ્ય જલ્દી થાગ. જેઓ ન્યાં હતા તે ચોડાક બોંડાને તેમણે કલ્યું હતું કે “તમને માર્ગદર્શિન આપવાનું અને મદદ કરવાનું કામ માતાજીને સોંઘ્યું દ્યું. માતાજી મારી સાથે સ્વાભાવિક રીતે જ સંપર્કમાં રહેશે. તેમની મારફતે હું કાર્ય કરીશ.” વસ્તુઓએ ઓછિંતો, તરત જ અમુક આકાર લીધા, અસાધારણ વિગરોપૂર્વક એક તેજેમય સુદીનું નિર્માણ થયું, જેમાં અદ્ભુત અનુભૂતિઓ હતી, દિવ્ય સત્ત્વો સાથે સંપર્ક હતા, અને ચમત્કારો ગણ્યાય તેવા સર્વ પ્રકારના આવિલાવિંદો હતા. એક પછી બીજી

એમ, અનુભૂતિઓ થવા લાગી, વસ્તુઓ તદ્દન તેજોમય રીતે પ્રગટ થવા લાગી અને તે પણ ખૂબ રસપ્રદ રીતે.

એક દિવસ, નિયમ પ્રમાણે શું બની રહ્યું હતું તે કહેવા માટે હું શ્રી અરવિંદ પાસે ગઈ. સાચે જી, કોઈ ખૂબ રસપ્રદ વસ્તુ આપણને પ્રામ થઈ હતી. મેં તેનું વસ્તુંન જરાક ઉત્સાહપૂર્વક કરી અરવિંદ આગળ કર્યું. મારા તરફ જોઈને શ્રી અરવિંદ બોલ્યા, “હા, એ અતિમનસુની સૃષ્ટિ છે. તે ખૂબ રસપ્રદ છે, સારી રીતે કરવામાં આવી છે. તમે એવા ચ્યામન્કારો કરશો, કે જે તમને જગતમાં વિદ્યાત બનાવી મુક્ષે. સાચે જી, તમે પૃથ્વી પરની સર્વ ઘટનાઓને ઊંધી-ચત્તી કરી મુક્ષો.” પછી તે સિમત કરીને બોલ્યા, “તે એક મહાન સફળતા હશે પણ તે અતિમનસુની સૃષ્ટિ છે. આપણે તે સફળતા માગતા નથી; આપણે પૃથ્વી પર અતિમનસુને સ્થાપવા માગીએ છીએ. નવીન જગતનું સર્જન કરવા માટે, સંપૂર્ણપણે અતિમનસુની સૃષ્ટિનું સર્જન કરવા માટે, આપણને નિકટની સફળતાનો ત્યાગ કરતાં આપડનું જોઈએ.”

મારી આંતર ચેતના વડે હું તે વાત તરત સમજું ગઈ. થોડા કલાક પછી તે સૃષ્ટિ ચાલી ગઈ. તે ક્ષણથી અમે, બીજા પાયાએ ઉપર, નવીન પ્રારંભ કર્યો.

મેં તમારી આગળ જાહેર કર્યું કે આ નવીન જગત જનમી ચૂક્યું છે. પણ જીનું જગત તેને એટલું બધું વીંટપાઈ વળ્યું છે કે ઘણા લોકોને તે બે વર્ષોનો તફાવત દેખાયો નથી. છતાં નવીન શક્તિઓનું કાર્ય ખૂબ નિયમિત રીતે, ખૂબ આગ્રહપૂર્વક, ખૂબ સ્થિરતાપૂર્વક, અને અમુક પ્રમાણમાં ખૂબ અસરકારક રીતે, ચાલુ રહ્યું છે. ગઈ કાલનો મારો સાંજનો અનુભવ એ આ કાર્યનો એક નવીન આવિલ્લાવ હતો. મેં આ બધાનું પરિણામ, કમિક રીતે, લગભગ દેનિક અનુભૂતિ-ઓમાં જોણું છે, તેને સંક્ષેપમાં, એક લીટોની રીતે, અલિવ્યક્ત કરી શકાય.

પ્રથમ તો આ આધ્યાત્મિક જીવનનો અને દિવ્ય વાસ્તવિકતાનો એક નવીન જ્યાલ માત્ર નથી. તે જ્યાલને શ્રી અરવિંદે વ્યક્ત કર્યો છે, મેં પણ તે ઘણીવાર

‘૧. રાણી રાસમણી’ નામની એક બંગાળી ફિલ્મમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ અને એક ખૂબ સમૃદ્ધ, યુદ્ધિશાળી, રાણી રાસમણી નામની વિધવાનું વસ્તુંન આવે છે. તે વિધવાએ ૧૯૪૭માં દક્ષિણાખ્રમાં (બંગાળમાં) કાલી મંદિર બંધાવ્યું હતું જ્યાં રામકૃષ્ણ રહેતા હતા અને કાલીની પુન કરતા હતા. ૨. ૧૯૨૬ની ૨૪મી નવેમ્બરે શ્રી અરવિંદ એકાન્તમાં ચાલ્યા ગયા. અને માતાજીએ આત્રમતું કામકાજ સંભાળવાનું માયે લીધું.

વક્તા કર્યો છે. તેને આમ રબૂ કરી થકાય; જુની આધ્યાત્મિકતા એ જીવનમાંથી દિવ્ય વાસ્તવિકતામાં ભાગી દૂષ્ટવાની વાત હતી. તેમાં જગત જ્યાં હતું અને જેણું હતું તેને ત્યજી દેવાની વાત હતી. તેથી જિલ્લાટું, અમારું નવા દર્શાન અધિનનું દિવ્યીકરણનું છે, ભૌનિક જગતનું દિવ્ય જગતમાં રૂપાંતરનું છે. આ વાત વારંવાર કહેવામાં આવી છે, યોગી ધર્મી સમજાઈ પણ છે, સાચે જે, તે આપણે ને કરવા માગીએ છીએ તેનો પાયાનો વિચાર છે. પણ તે થોડાક સુધારા વધારા સાથે જુની વસ્તુને ચાલુ રાખવા જેવું પણ બની રહે, તે જુના જગતનું પિસ્તૃતીકરણ બની રહે. વિચારના ક્ષેત્રમાં તે એક ઘ્યાલ માત્ર બની રહે. પણ જે સાચી નવી વસ્તુ બની છે તે એ છે કે એક નવીન જગત જન્મ્યું છે, જન્મ્યું છે, જન્મ્યું છે. તે રૂપાંતર પામેલું જૂનું જગત નથી. તે જન્મેલું નવીન જગત છે. આપણે આ પરિવર્તનના સમયની બરાબર મધ્યમાં છીએ, જેમાં બંને એકબીજા સાથે ગુંગવાઈ ગયા છે, જેમાં જુનું જગત સર્વ સમર્યાદા છે, સામાન્ય ચેતના પર પ્રલુચ સ્થાપીને બેઠું છે, જ્યારે નવું જગત શાન્તિપૂર્વક સરકી આવી રહ્યું છે, તે ખૂબ વિનાય છે, એટલું બધું અદૃષ્ટ છે કે બાધ રીતે તે અત્યારે તો કોઈ પણ વસ્તુને વિકિસ બનાવતું નથી, ધર્માખરા લોકોની ચેતનામાં તે તદ્દન અદૃષ્ટગોચર છે. અને છનાં તે કાર્ય કરી રહ્યું છે, વૃદ્ધિ પામી રહ્યું છે. આખરે તે દૃષ્ટિગોચર રીતે કાર્ય કરવા થકિતમાન થશે.

આ વાતને સાદી રીતે મૂકીએ તો, કો અરવિંદ નેને અધિમનસ્ત સૂષિટ કહી હતી તે જૂનું જગત દેવોનો અને ધર્મેનિં યુગ હતો. પરતત્ત્વ પ્રત્યેના માનવીય પ્રયાસના પુષ્પે અસંખ્ય ધાર્મિક રૂપોને, કોઈ જીવાત્માઓ અને અદૃષ્ટ જગત વચ્ચેના ધાર્મિક સંબંધને પ્રગટાત્યા હતાં. તે સર્વના શિખર પર, ઉત્થનર સાક્ષાત્કાર પ્રત્યે પ્રયાસના રૂપમાં, બધા ધર્મેની એકતાનો વિચાર ઉદ્ભબ્યો છે, આ જીવ આવિભાગિની પીઠમાં રહેલી એક વસ્તુનો વિચાર ઉદ્ભબ્યો છે. આ વિચાર ખરેખર માનવીય અલ્લીખ્સાની છેલ્લામાં છેલ્લી મર્યાદા છે. તે સીમાઢા પર છે. તે હજ સંપૂર્ણપણે અધિમનસના જગતની છે. તે અધિમનસની સૂષિટ ત્યાંથી આ નવીન સૂષિટ પ્રત્યે દૃષ્ટિ નાંખી રહી છે, પણ તેને તે સમજી શકતી નથી. તેને પહેંચવાનો તે પ્રયત્ન કરે છે. તેને આવતી તે અનુભવી શકે છે, પણ સમજી શકતી નથી. જો વસ્તુઓ તદ્દન પલટાઈ જાય, જો અદલા બદલી થઈ જાય તો જ તે તેને સમજી શકી. અધિ-મનસ્તની સૂષિટનો ત્યાગ કરવાની જરૂર છે. તેની જગતાએ અતિમાનસ સૂષિટ, આ નવોન સૂષિટ આવે એ જરૂરી છે.

હવે આ બધી જૂની વસ્તુઓ ખૂબ જૂની લાગે છે, સમય બહાર ની મરજી મુજબ કરાયેલી, વાસ્તવિક સત્યની દાખા-મથકરી સમાન લાગે છે.

અતિમાનસ સૃષ્ટિમાં કોઈ ધર્મો નહિ હોય. સમગ્ર જીવન જગતમાં પ્રગટ થતી દિવ્ય એકતાની અભિવ્યક્તિ હશે. રૂપોમાં જિલ્લવાની કિયારૂપ હશે. માણસો અત્યારે જેમને દેવો કહે છે, તે પણ તે સૃષ્ટિમાં નહિ હોય.

આ મહાન દિવ્ય સત્ત્વો પોતે જ આ નવી સૃષ્ટિમાં ભાગ બેવા શક્તિમાન બનશે. પણ તેમ કરવા માટે તેમણે પૃથ્વી પર અતિમાનસ તત્ત્વને ધારણ કરવું પડશે. જે તેમાંના કેટલાંક પોતાના જગતમાં પોતે છે તેવાં જ રહેવા માગશે, જે તે ભૌતિક રીતે પ્રગટ થવાનો નિર્ણય નહિ કરે, તો અતિમાનસ સૃષ્ટિના સર્વો સાથે તેમનો સંબંધ મિત્રો તરીકેનો રહેશે, સહકાર્યકરો તરીકેનો, સમાન દરજાના સત્ત્વો તરીકેનો રહેશે, કારણ કે પૃથ્વી પર નવીન આત્માનસ જગતના સત્ત્વોમાં ઉચ્ચતમ દિવ્ય તત્ત્વ પ્રગટ થયું હશે.

જ્યારે ભૌતિક પદાર્થતત્ત્વનું અતિમાનસીકરણ થશે, ત્યારે પૃથ્વી પર અવતરવું એ નિકૃષ્ટતાનું કારણ નહિ હોય, તેથી તદ્દન ઉલટી જ વાત હશે, તે એક એવી પરિપૂર્ણતા હશે, કે જે તેમ કર્યા ચિવાય ન જને.

પણ આ બધી તો આવિની વાત છે, જેનો પ્રારંભ થઈ ચૂક્યો છે, પણ સંપૂર્ણપણે જેનો સાક્ષાત્કાર કરતાં હજુ સમય લાગશે. તે દરમિયાન આપણે એક ખાસ, વિશિષ્ટ પરિસ્થિતિમાં છીએ કે, જે અભૂતપૂર્વ છે. અત્યારે આપણે એક નવીન જગતના જન્મને જોઈ રહ્યા છીએ જે બહુ બાધ્યાપસ્થામાં છે, નિર્બંધ છે. સારતત્ત્વમાં નિર્બંધ નહિ પણ બાધ્ય આવિભાવિમાં જેને હજુ મોટા ભાગના બોકોએ સ્વીકૃતિ આપી નથી, જેનો તેમણે અનુભવ કર્યો નથી, જેનો તેઓ ઈન્કાર પણ કરતા હોય છે, પણ તે અતિમનસ અહીં આવી ચૂકયું છે. તે વૃદ્ધિ પામવાનો પ્રયાસ કરી રહ્યું છે, પોતાના પરિણામ બાબત તેને પૂરી ખાતરી છે. પણ તેનો માર્ગ એક તદ્દન નવીન માર્ગ છે, તે હજુ સુધી કોઈ ખોળી શક્યું ન હતું, જ્યાં હજુ સુધી કોઈ ગયું નથી, કોઈએ તે વસ્તુ સિદ્ધ કરી નથી. તે એક વૈશિષ્ટ પ્રારંભ છે. તેથી તે એક અચિંતિત સાહજ છે, જેને વિષે કોઈ આગાહી ન કરી શકાય.

કેટલાક બોકો સાહસને ચાહતા હોય છે. તેમને હું બોલાવું છુ. કહું છું કે આ મહાન સાહસમાં ભાગ બેવા હું તમને નિમંત્રું છું.

તે આપણું પહેલાંના લોકોએ કરેલી વસ્તુનું આધ્યાત્મિક રીતે મુનરાવર્તન કરવાની વાત નથી, કારણકે આપણું સાહસ તેથી પરનું છે, તેથી પર આપણા સાહસનો પ્રારંભ થાય છે. તે એક તદ્દન નવી સુષ્ટિ પેદા કરવાની વાત છે, જેમાં અનેક અદ્ભુતપૂર્વ ઘટનાઓ, જોખમો રહેલાં છે. તે એક વાસ્તવિક સાહસ છે, જેનું લક્ષ્ય નિશ્ચિત વિજય છે, પણ જેનો માર્ગ અજાણ્યો છે અને જે માર્ગને આપણે અજ્ઞાતમાં એક પછી બીજું એમ હળવાં મારીને શોધી કાઢવાનો છે. તે એક એવી વસ્તુ છે, કે જે આ વર્તમાન વિશ્વમાં પહેલાં કદી જની ન હતી અને તેજ રીતે જે અવિષ્યમાં બનવાની નથી. જે તેમાં તમને રસ પડુતો હોય, તો ચાલો આપણે તે સાહસમાં જંપલાવીએ. આવતી કાલે તમારું શું થશે કું જાણતી નથી.

જે પહેલેથી જોવાયું હતું, જેની યોજના પહેલાં ધડાઈ હતી, જેનું નિર્માણ પહેલાં થયું હતું, તે બધાને બાળુએ મૂકી દેવું પડે. અને અજ્ઞાતમાં ચાલી નીકળવું પડશે. પછી લબે છે થવાનું હોય તે થાય ?

કોઈને આપણા વાંચન અંગે કોઈ પ્રશ્નો પૂછવાના નથી ? આજે સાંજે મારે તમને ખાસ કશું કહેવાનું નથી. શરીરની નવી પરિપૂર્ણતાઓ વિષે તમને કોઈને જાળવાની ઉત્કંદા હોય એમ લાગતું નથી.

માતાજી, અમે અહીં જે શારીરિક કેષવણી લઈએ છીએ, તેમાં અમારો હેતુ શરીર પર વધુ ને વધુ કાબૂ મેળવવાનો હોય છે, નહિ વડું ? આપણે ગઈ વખતે જે વાંચ્યું હતું તેમાં શ્રી અરવિંદ કહે છે કે હઠયોગ અને તાંત્રિક પદ્ધતિઓ શરીર પર એક ખૂબ મહાન કાબૂ આપે છે ? આપણે શા માટે આપણી પદ્ધતિમાં તે દાખલ કરતા નથી ?

આ શરીર પર કાર્ય કરવા માટેની ચૂઢવાઈ, તાંત્રિક પ્રક્રિયાઓ છે, જ્યારે વિકાસની આધુનિક પદ્ધતિઓ, સમયમાં શરીર જે પરિપૂર્ણતા સિદ્ધ કરી શકે છે તેમ છે તેની સામાન્ય શારીરિક પ્રક્રિયાનું અનુસરણ કરતી હોય છે. હું તમારા પ્રુણને બરાબર સમજ થકતી નથી. પ્રક્રિયાઓ તદ્દન લિન્ન હોય છે.

આ બધી પદ્ધતિઓનો પાણો છે પદ્ધાર્થતત્ત્વ ઉપર સચેતન સંકલ્પ જે શક્તિ ચલાવે છે તે. સામાન્ય રીતે, એ પદ્ધતિનો ઉપયોગ કોઈક માણસે સફળતાપૂર્વક

કર્યો હોય છે, અને તેણે કાર્ય કરવાનો એક સિંગાંત સ્થાપણો હોય છે. તેણે તે બીજા વોકોને શિખવાઉણો હોય છે. બીજા વોકો તે પદ્ધતિને ચાલુ રાખે છે અને તેને પરિપૂર્ણ બનાવે છે. આખરે તે એક પ્રકારનું નિશ્ચિત રૂપ ધારણ કરે છે, અને એક પદ્ધતિ બની જાય છે. પણ તેનો પાપો શરીર પર કાર્ય કરતો સચેતન સંકલ્પ છે. પદ્ધતિનું નિશ્ચિત રૂપ બહુ મહત્વનું નથી. બિનન બિનન સમયે, એક યા તો બીજી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. પણ તેની પીઠમાં હમેશાં એક વહેતી માનસિક શક્તિ હોય છે, જે પદ્ધતિપૂર્વક કાર્ય કરતી હોય છે અલબત્ત, કેટલીક પદ્ધતિઓ ઉચ્ચતર શક્તિનો ઉપયોગ કરવા પ્રયત્ન કરે છે, કે જે શક્તિ પોતાનું બળ માનસિક શક્તિમાં સંકાંત કરતી હોય છે. જે માનસિક પદ્ધતિમાં ઉચ્ચતર પ્રકારની શક્તિને રેડવામાં આવે, તો આ પદ્ધતિ સ્વાભાવિક રીતે

૧. આપણામાં કાંઈક એવું છે અથવા કાંઈક એવું વિકસાવવાનું છે, કદાચ આપણા અસ્તિત્વના કેન્દ્રસ્થ અને હજુ સુધી નિગ્રંથ ભાગમાં એવી શક્તિએ છે કે જે આપણા વર્તમાન સહ્ય બંધારણુમાં હોણી જોઈએ તેનો ભાગ ખંડ જ છે. પણ જો તે શક્તિએ પરિપૂર્ણ અને પ્રભાવશાળી બને, તો તે શક્તિએ, આત્માની અને કોત ચેતનાની શક્તિ તથા પ્રકાશ વડે જરૂરી શારીરિક રૂપાંતર અને તેનાં પરિણામો સિદ્ધ કરી શકે. તાંત્રિક જ્ઞાન વડે પ્રગટ થતા ચકોની પદ્ધતિમાં તથા યોગની પદ્ધતિ એમાં આ વસ્તુ લેવામાં આવે છે તે સ્થેતન ડેન્ડ્રોમાંથી, આપણા અસ્તિત્વની કિયાશીલ શક્તિએનાં ઉદ્ગમ-સ્થાનોમાંથી તેમના કાર્યનું સંગ્રહન થતું હોય છે. નિર્મન-તર શારીરિક ડેન્ડ્રોમાંથી, ચઢ્ઠી શૈખિયમાં, ઉચ્ચતરમ માનસિક ડેન્ડ્રોમાં અને આધ્યાત્મિક ડેન્ડ્રોમાં જરૂર શક્તિ હોય છે, જેને હજાર પાંખ્રીઓનાજું કમળ (સહસ્રાર્થક) કહેવામાં આવે છે, જ્યાં તાંત્રિકાની કુંડલિની શક્તિનું અન્ધ સાથે મિલન થાય છે, અને પણ તે પ્રકૃતિ હિંય સત્તમાં મુક્ત બને છે. આપણામાં આ ચકો બંધ અથવા અડધા બંધ હોય છે. તેમને ઉધાડવાનાં હોય છે, પણ જ તેમની પરિપૂર્ણ શક્તિ આપણી શારીરિક પ્રકૃતિમાં પ્રગટ થાય છે. એક વાર તે ખૂદી જાય અને સહ્ય બને તો પણ તેમની શક્તિએ પર, તેમનાં વિકાસ પર, અને સંપૂર્ણ રૂપાંતર પર કાંઈ ભર્યાશો. રહેતી નથી. છતાં પણ આ પરિવર્તનો સિદ્ધ કર્યા પણ, લૌતિક પ્રક્રિયાઓનો અવરોધ રહે છે, તે પોતાની જૂની રીતે જ કાર્ય કરે છે, તે ઉચ્ચતર નિયમનને તાણે થતી હોતી નથી. જો તેમનું પરિવર્તન કરવામાં ન આવે, તો રૂપાંતરનું કાર્ય અધૂરું રહે છે, તેમાં રૂકાવટ આવે છે. શરીરનું પરિપૂર્ણ રૂપાંતર આખા થંત્રના ખૂલ્ય લૌતિક ભાગનું પણ પરાપર પરિવર્તન ભાગી લે છે. તેનાં બંધારણનું, તેની પ્રક્રિયાએનું, તેની પ્રકૃતિનું પણ પરાપર પરિવર્તન ભાગી લે છે.

( અતિમનસનો આભિર્ભાવ, ૪૩૩૪-૩૫ )

ને વિધારે અસરકારક અને શક્તિશાળી બની જાય છે. પણ આ બધી પદ્ધતિઓ તેમનો ઉપયોગ કરનાર વ્યક્તિ ઉપર, અને તે તેમનો ઉપયોગ કેવી રીતે કરે છે તેનો ઉપર આધાર રાખતી હોય છે. માણસ, ખૂબ ખૂબ લોતિક અને સામાન્ય પદ્ધતિઓમાં પણ, તેમનામાં ઉચ્ચતર પ્રકારની શક્તિઓ રેડવા માટે, આ તદ્દન બાધ્ય પાયાનો ઉપયોગ કરી શકે. પદ્ધતિ ગમે તે હોય. પણ બધી પદ્ધતિઓ માત્ર તેમનો ઉપયોગ કરનાર વ્યક્તિ ઉપર, તે વ્યક્તિ તે પદ્ધતિઓમાં શું રેડી આપી શકે તેના ઉપર આધાર રાખતી હોય છે.

જે પદ્ધતિનાનો વિચાર તેના અદ્યતન, ખૂબ બાધ્ય રૂપમાં કરવામાં આવે, તો આપણે રોજ-રોજ આપણા દેનિક જીવનમાં સતત જે ગતિઓ કરતા હોઈએ, જે તે શારીરિક કામ હોય તો જે ગતિઓ આપણે કરવી પડતી હોય છે, તે સનાયુઓ વિકસાવવામાં અથવા શરીરમાં સંવાદિતાનું સર્જન કરવામાં તે કેમ મદદરૂપ થતી નથી, અથવા તો બહુ નજીવા પ્રમાણમાં થતી હોય છે? તેથી ઊંબટું, જે તે જ ગતિઓ સભાનતાપૂર્વક, વિચારપૂર્વક, નિશ્ચિન હેતુપૂર્વક કરવામાં આવે, તો એકદમ તે તમારા સનાયુઓને વિકસાવવામાં અને શરીરને સુધારિત કરવામાં મદદ બની જાય છે. એવાં કામો હોય છે, જેમાં માણસોને સીમેન્ટના થેલા, અનાજના કોથળા, કોલસાના કોથળા જેવી વજનદાર વસ્તુઓ ઊંચકીને લઈ જવી પડતી હોય છે, અને તેમાં ખૂબ પરિક્રમ કરવો પડતો હોય છે. અમુક પ્રમાણમાં તે કામ તેઓ પ્રાપ્ત કરેલી સહેલાઈથી કરતા હોય છે, પણ તેથી તેમને શરીરની સંવાદિતા પ્રાપ્ત થતી હોતી નથી, કારણકે તેઓ તે કામ સનાયુઓનો વિકાસ કરવાના હેતુથી કરતા હોતા નથી; કરવું પડે છે માટે તેઓ તે કામ કરતાં હોય છે. જે માણસ પોતે રાખેલી અથવા પોતાને માટે કાર્યાન્વિત કરેલી પદ્ધતિનું અનુસરણ કરે છે. એક યા તો બીજા સનાયુનો વિકાસ કરવા માટે અને પોતાના શરીરમાં સામાન્ય સંવાદિતાનું સર્જન કરવા માટે, આ જ ગતિઓ સંકલ્પપૂર્વક કરતો હોય છે, તે સફળ થાય છે. એટલે સચેતન સંકલ્પમાં જ એલું કાંઈક છે, કે જે આ ગતિમાં ખૂબ વૃદ્ધિ કરતું હોય છે. જે બોકો અત્યારે સમજવામાં આવે છે તે પ્રકારનો શારીરિક વ્યાયામ કરવાની સાચી ઈચ્છા રાખતા હોય છે, તેઓ જે કાંઈ કરતા હોય છે તે સભાનતાપૂર્વક કરે છે. તેઓ સભાનતાપૂર્વક નીસરસ્સીનાં પગથિયાં ઉત્તરતા હોય છે, તેઓ જીવનની સામાન્ય ગતિઓ સભાનતાપૂર્વક કરતા હોય છે, ધાર્ત્રિક રીતે નહિ. ધ્યાનયુક્ત અંભ કદાચ તેમાં થોડોક તફાવત જોઈ શકશે, પણ મોટો તફાવત તો તે વ્યાયામમાં જે સંકલ્પ મૂકી આપતા હોય છે, તેમાં તેઓ જે ચેતના મૂકી

આપતા હોય છે તેમાં હોય છે. કોઈ જગ્યાએ જવા માટે ચાલવું અને વ્યાયામ માટે ચાલવું એ બે એક જ વસ્તુ નથી. આ બધી વસ્તુઓમાં સભાન સંકલ્પ જ મહત્વનો હોય છે, તે જ પ્રગતિ અને પરિણામ લાવી આપતો હોય છે. એટલે હું એમ કહેવા માગું છું કે માણસ જેનો ઉપયોગ કરે છે તે પદ્ધતિ બહુ મહત્વની નથી, અમુક પરિણામ લાવવાનો સંકલ્પ જ મહત્વનો હોય છે.

યોગી અથવા અભીષ્ટા સેવતો યોગી, જે આધ્યાત્મિક પરિણામ લાવવા માટે અથવા તો માત્ર શારીરિક કાખું પ્રાપ્ત કરવા માટે આસનો કરતો હોય છે. તે આ હેતુ લક્ષ્યમાં રાખીને આસનો કરે છે અને તેથી આ પરિણામોને પ્રાપ્ત કરતો હોય છે. જ્યારે હું એવા કેટલાક લોકોને જાણું છું કે જેઓ બરાબર તે જ વસ્તુઓ કરતા હોય છે, પણ તેમનાં તે કરવાનાં કારણોને આધ્યાત્મિક વિકાસ સાથે કોઈ સંબંધ હોતો નથી, અને તેથી તેઓ સારું આરોગ્ય પણ પ્રાપ્ત કરી શક્યા હોતાં નથી! અને છતાં તેઓ તે જ કાર્યો કરતા હોય છે કેટલીક ગર તો યોગી કરતાં પણ વધારે સારી રીતે, અને છતાં તેમને સ્થિર આરોગ્ય પ્રાપ્ત થતું હોનું નથી, કારણે તેમણે તે બાબત વિચાર કર્યો હોતો નથી, મનમાં હેતુ રાખીને તે વસ્તુઓ કરેલી હોતી નથી. મેં તેમને પૂછ્યું છે કે આ બધું કર્યું હોવા છતાં તમે માંડા કેમ પડો છો? તેઓ મને જવાબ આપતા હોય છે કે મેં એ બાબત કશો વિચાર જ કર્યો ન હતો; સારું આરોગ્ય પ્રાપ્ત કરવા માટે મેં આસનો કર્યાં જ ન હતાં. આનો અર્થ એ થયો કે સચેતન સંકલ્પ જ મહત્વનો છે, તે જ પદાર્થતત્વ ઉપર કાર્ય કરે છે, ભૌતિક કિયા મહત્વની નથી હોતી.

તમારે માત્ર તે માટે પ્રયત્ન કરવાની જરૂર છે. તમે મારા કહેવાનો ભાવાર્થ પછી સારી રીતે સમજૂ જશો. દા. ત. કપડાં પહેરતી વખતે, સ્નાન કરતી વખતે, તમારી રૂમ વાળી ઝૂંદીને સાછે કરતી વખતે ગમે તે કામ કરતી વખતે, તમે જે ગતિઓ કરતા હો છો, તેમને સભાનતાપૂર્વક કરો, આ સનાયુએ કામ કરવું જોઈએ, ચેલા સનાયુએ કામ કરવું જોઈએ, એવા સંકલ્પપૂર્વક કરો તો તમને માલમ પડશે કે તમે આશ્રયકારક પરિણામો પ્રાપ્ત કરી શકશો.

નીસરાહુનાં પગથિયાં ચડતાં અથવા ઉત્તરતાં તે કિયા શારીરિક વ્યાયામની દ્રષ્ટિએ કેટલી બધી ઉપયોગી નીવડી શકે છે તેની તમને કલ્પના નહિ આવે; પણ તે ઉપયોગી ત્યારે જ નીવડે, કે જે તમને તે કિયાનો ઉપયોગ કરતાં આવડતો હોય. સામાન્ય માણસની ચેઠે, ઉપર જવાનું છે માટે તમે પગથિયાં ચઢો અને નીચે

જવાનું છે માહેરિયાં ઉતરો તેને બદલે જો તમે કાર્ય કરતા સનાયુઓની અને તેમને સંવાદિતાપૂર્વક કાર્ય કરવાનાં ચેતના સાથે ચઢો અથવા ઉતરો, તો ઘણો ફેર પડી જય. તમે તે પ્રકારનો પ્રયત્ન કરો, અને તેમને તે વાત સમજશે! આનો અર્થ એ થયો કે શરીરના સંવાદિતામય વિકાસ માટે તમે તમારા જીવનની સર્વ ગતિઓનો ઉપયોગ કરી શકો છો.

કાઈક વસ્તુ ઉંચકી બેવા માટે તમે નીચા નમતા હો છો. કબાટ ઉપરની અમુક વસ્તુને બેવા માટે તમે ઊંચા થતા હો છો, તમે બારાણું ઉધાડો છો, બંધ કરો છો, તમારે વિધીને પાર કરવાનું હોય છે. તમે સભાનતાપૂર્વક એકસો અને એક વસ્તુઓ કરતા હો છો. તે બધાનો ઉપયોગ તમે શારીરિક વ્યાયામ માટે કરી શકો છો. તેમ કરતાં તમે જોઈ શક્શો કે કમો કરવાની ભૌતિક હક્કીકત કરતાં સો ગણી વધારે અસર તેમાં ચેતના મૂકવાથી પ્રાપ્ત કરી શકાય છે. એટલે તમને મન-પસંદ આવે તેવી પદ્ધતિને પસંદ કરો પણ તમે આ રીતે તમારા દૈનિક જીવનનો ઉપયોગ કરી શકો છો. તેમાં તમારે સતત શરીરની સંવાદિતા બાબતો ગતિઓના સૌંદર્ય બાબત, કોઈપણ અસુંદર અને બેહૂદી વસ્તુ ન કરવા બાબત ધ્યાન રાખવાનું હોય છે, તેમ કરવાથી તમે અસાધારણ ગતિની અને અભિનયની છાંદોમયતા પ્રાપ્ત કરી શકશો.

આજે આપણે આ બાબત ધ્યાન કરવાનાં છીએ.

\*

## ૨૪ જુલાઈ ૧૯૫૭

“ અનિમનસ ક્યારનુંય અહીં આવી ગયેલું છે, પણ તે પ્રગટ થયેલાં મન, પ્રાણ પદાર્થતત્ત્વની પીઠમાં નિગૃદ્ધ છે, તે દેખાય તે રીતે હજી કાર્ય કરતું નથી. પોતાની શક્તિપૂર્વક કાર્ય કરતું નથી. તે આ નિકૃષ્ટ પ્રકારની શક્તિ દ્વારા કાર્ય કરે છે, તેમના લક્ષણોને કારણે તેમાં થોડુંધાણું પરિવર્તન આવી જતું હોય છે, અને તેથી તે ઓળખી શકાય તેવું નથી. માત્ર અતિમનસના આગમન અને અવ-

તરણ દ્વારા જ પૃથ્વી પર તેને મુક્ત કરી શકાય, અને તે આપણા ભૌતિક, પ્રાણીક અને માનસિક ભાગોમાં પ્રગટ થઈ શકે, જેથી આ નિમ્નતર શક્તિઓ આપણા સમગ્ર અસ્તિત્વની પરિપૂર્ણ દિવ્ય કિયાના ભાગો બની શકે. તે જ આપણે માટે સંપૂર્ણપણે સાક્ષાત્કાર કરાયેલી દિવ્યતા અથવા દિવ્ય જીવન લાવી શકે. તેજ રીતે પદાર્થતત્ત્વમાં નિગૂઢ રહેલો પ્રાણ અને મન અહીં પ્રગટ થયાં છે, કારણે જે નિગૂઢ હોય તેજ ઉત્કાંત થઈ શકે, તે સિવાય કોઈ પ્રાગટ્ય સંભવી ન શકે”

( અતિમનસુનો આવિભાવ, પૃષ્ઠ ૪૩ )

વહાલાં માતાજી, નિગૂઢ અતિમનસુશું છે ?

તે જ પ્રગટ અતિમનસું છે !

શ્રીઅરવિંદ તે જ વાત કહે છે કે “ જો સર્વના કન્દમાં ભગવાન ન હોય, તો તે કદ્દી વિશ્વમાં પ્રગટ ન થઈ શકે. તાત્ત્વિક રીતે, પોતાના ઉદ્ગમમાં અને ગહુનતમ બાંધારણમાં, સુષ્ટિ દિવ્ય છે, જગત દિવ્ય છે. તે જ કારણે, એક દિવસ આ દિવ્યતા પ્રગટ થઈ શકશે, સ્પર્શગમ્ય બની શકશે, અત્યારે તેને જે વસ્તુ આવૃત કરી રહી છે, કદ્દમ્ય બનાવી રહી છે તેને સ્થાને પોતાની જતને તે પરિપૂર્ણ રીતે પ્રગટ કરી શકશે. અત્યાર સુધી તો આપણે જાણીએ છીએ તેનો જગતઝે જ આ દિવ્યતા પ્રગટ થઈ છે, પણ આવિભાવ અનન્ત છે. અત્યારના માનસિક જગતનું શિખર છે માનવ. પણ હવે પછી બીજી વાસ્તવિકતા પ્રગટ થશે, જેને શ્રી અરવિંદ અતિમનસું કહે છે, કારણે મન પદ્ધતિનું પગલું અતિમનસું છે. એટલે અત્યારે જગત જેવું છે તેની દૃષ્ટિથી જેતાં, તે સ્વાભાવિક રીતે જ અતિમનસું હશે, મનથી પર હશે, શ્રી અરવિંદ કહે છે કે તે આ જગતનું બીજા જગતમાં પરિર્વતન હશે. કારણ કે અત્યાર સુધી સમગ્ર સુષ્ટિ નિમ્નતર ગોળાર્ધમાં રહેલી હતી. તે ગોળાર્ધ પર અજ્ઞાનનું નિયમન ચાલે છે. તે ગોળાર્ધ અવચેતનના પાયા પર આધારિત છે. જ્યારે ઉધ્વત્તર ગોળાર્ધ તેનાથી તદ્દન ઊલટા પ્રકારનો હશે, તેમાં ડોરી બોજ જ પ્રકારના જગતનું તત્ત્વ ઓચિંતુ પ્રગટ થશે. તે અજ્ઞાન પર નહિ, પણ સત્ય પર આધારિત હશે. તેથી તે સાચી રીતે એક નવીન જગત બની રહેશે. જે આ જગતનાં સારતત્ત્વનો સમાવેશ આપણાથી જ્ઞાત એવા પહેલાંના જગતમાં ન થયેલો હોત તો તે જૂના જગતનું આજના જગતમાં રૂપાંતર સિદ્ધ કરવાની આશા ન

રાખી શકાઈ હોત. તે બે જગતો એક બીજાથી એટલા બધાં ભિન્ન અને વિરોધી હોત કે તેમની વચ્ચે કોઈ સંપર્ક ન રહી શકે; જ્યારે માણસ આ જગતમાંથી સત્યના, પ્રકાશના, શાનના જગતમાં જાય, ત્યારે અનિવાર્ય રીતે તે અદૃષ્ટગોચર બની જાય, અશાનના અને અચેતનતાના જગત માટે તે અસ્તિત્વ વળરનો બની જાય.

જ્યારે આ પરિવર્તન સિદ્ધ થાય, ત્યારે જૂના અને નવા જગત વચ્ચે સંબંધ કેવી રીતે સ્થપાઈ શકે? આ નવું જગત જૂના જગત પર કેવી રીતે કાર્ય કરી શકે? તેનું કારણ એ જ છે કે તાત્ત્વક રીતે, જૂના જગતમાં આ નવું જગત સમાવિષ્ટ હતું; તે તેની અંદર, તેના ઊંડાણોમાં નિગૂઢ, અદશ્ય, અનપેક્ષિત હતું; પણ તાત્ત્વક રીતે તે ત્યાં હતું જ. જે પોતાની પરમ ઊચાઈઓ પરથી અતિમનસ ચેતના, શક્તિ અને આનંદ સીધી રીતે આ જગતમાં પ્રગટ ન થાય, જેવું દોઢ વર્ષ પહેલાં બન્યું હતું, તો ભૌતિક જગતની આધારશિલ્પ આ અતિમનસને પોતાની જાતને અહીં પ્રગટ કરવાની શક્યતા જ ન રહે. તે જગૃત થાય, અહીં નીચે દઘિગોચર થાય તે ઊર્ધ્વના સ્પર્શીના જવાબદ્દી હશે, અને અત્યારના પદ્ધાર્યતત્ત્વના ઊંડાણોમાં નિગૂઢ અનુભૂત તત્ત્વને પ્રગટ કરશે. અત્યારે આ જ વસ્તુ બની રહી છે. મેં તમને બે અઠવાડિયાં પહેલાં કલ્યું હતું કે- આ ભૌતિક જગત એટલું બધું શક્તિશાળી છે, સામાન્ય ચેતના માટે એટલું બધું વાસ્તવિક છે, કે તેણે આ પ્રગટ થતી અતિમનસ શક્તિને આવૃત કરી લીધી છે. તેની હાજરીની ઝાંખી થાય, તેની અનુભૂતિ થાય, એક યા બીજી રીતે તે દઘિગોચર અને, ત્યાર પહેલાં ખૂબ લાંબા સમય સુધી તૈયારી કરવાની જરૂર છે. અત્યારે તે અતિમનસ આ જ કાર્ય કરી રહ્યું છે.

તેને કેટલો સમય લાગશે તેની આગાહી કરવી કઠિન છે. તે અમુક સંખ્યાના માણસોની સહૃદાવના ઉપર તથા તેમના ખુલ્લાંપણ્ણા ઉપર મોટે ભાગે આધાર રાખે છે, કારણ કે હમેશાં વ્યક્તિ ચમૂહ કરતાં વધારે જડપી પ્રગતિ કરી શકતી હોય છે, અને પોતાના સ્વભાવ વડે જ, પ્રકૃતિ વડે જ, માનવ જાતિ સુંદરિના બીજ ભાગો કરતાં અતિમનસને પહેલું પ્રગટ કરે એવું ભાવિનું નિર્માણ છે.

આ સહકાર્યના પાયામાં પરિવર્તન માટેનો સંકલ્પ ખૂબ જ અનિવાર્ય છે. માણસે જેવો પોતે છે એવો ન રહેવાનો, વસ્તુઓ જેવી છે નેવી ન રહેવી જોઈએ તે પ્રકારના સંકલ્પ કરવાનો છે. તેને પ્રાપ્ત કરવાની અનેક પદ્ધતિઓ છે. જ્યારે

તેમો સફળ બને છે, ત્યારે તે બધી સારી જ છે એમ કહી શકાય! માણસ પરિસ્થિતિથી ખૂબ કંટાળી ગયો હોય, તે બધામાંથી બહાર આવવાની ઉત્કટતા સેવતો હોય, બીજી કોઈક વસ્તુ પ્રાપ્ત કરવા ઈચ્છિતો હોય; અને વધારે વિધાયક રીત તો આ છે કે તેને પોતાની અંદર કોઈક સુંદર અને સાચી વસ્તુનો સ્પર્શ લાદ્યો હોય, અને રાજ્યભૂષિથી બીજી બધી વસ્તુઓ છોડી દેવાની તેનામાં ઈચ્છા પ્રગટી હોય, જેથી આ નવીન સત્ય અને સૌનાર્ય પ્રત્યેની તેની યાત્રામાં કોઈ પણ વસ્તુ બોઝડુય ન બને.

દરેક કિરસામાં અનિવાર્ય વસ્તુ છે પ્રગતિ માટે ઉત્કટ સંકલ્પ, પ્રગતિમાં રૂક્ષવટ નાખનારી બધી વસ્તુઓનો હર્ષપૂર્વક, રાજ્યભૂષિથી ત્યાગ, પ્રગતિમાં રૂક્ષવટ કરતી સર્વ વસ્તુઓને ફ્રાવી દેવી, એવી ઉત્કટ શક્તાથી અજ્ઞાનમાં ચાલી નીકળવું કે આ જ આવતી કાલનું સત્ય છે, તે અનિવાર્ય છે, કોઈ પણ વસ્તુ કોઈ પણ માણસ, પ્રકૃતિનો પણ બૂરો સંકલ્પ તેને વાસ્તવિકતા બનતાં રોકી શકે એમ નથી, કદાચ નજીકના અવિષ્યમાં જ તે વાસ્તવિકતા આવી રહેવાની છે. તે વાસ્તવિકતા સાકાર બને એટલા માટે કાર્ય ચાલી રહેલું છે, જે બોકોને પરિવર્તન કેમ કરવું તે આપડે છે, જેઓ જૂની ટેવોના ભારને કેવી રીતે વહન કરવો તે જાણતા હોય છે. આવા બોકો ચેક્કસ અતિમનસુને માત્ર જોવા પૂરતી જ નહિ, પણ તેનો સાક્ષાત્કાર કરવા પણ ભાગ્યશાળી બનશે.

માણસો ઊંઘતા હોય છે, લુલી જતા હોય છે, જીવનનો સ્વીકાર હળવી રીતે કરતા હોય છે. પણ જે આપણે યાદ રાખીએ કે આપણે સમય અપવાદૃપ છે, અસાધારણ છે, આપણને આ મહાન સદ્ગુર્ય પ્રાપ્ત થયું છે, નવીન જગતના જન્મ સમયે હાજર રહેવાનો આપણને અમૂલ્ય વિશિષ્ટ અધિકાર સાંપડ્યો છે તો આપણે આપણી પ્રગતિમાં રૂક્ષવટ નાખનાર બધી વસ્તુઓને સહેલાઈથી ફ્રાવી દઈ શકીએ.

એટલે સૌથી અગત્યની વાત આ છે કે સધન અનુભૂતિ ન થતી હોય તો પણ, ત્યારે પણ આ વસ્તુને યાદ રાખવી, તેમાં શક્તા, ખાતરી રાખવી તે વાતને હંમેશાં યાદ રાખવી, સતત યાદ રાખવી, તે વિચાર કરીને જ ઊંઘી જવું, આ વાતને યાદ કરતાં જ ઊંઘમાંથી જગલું, આ મહાન સત્યને પદ્ધતાં ભૂમિ-

ક્રમાં રાખીને જ બધાં કામો કરવાં, તે સત્યનો જ સતત આધાર રાખવો કે આપણે નવીન જગતનો જન્મ જોઈ રહ્યા છીએ.

આપણે તેમાં ભાગ લઈ શકીએ, આપણે આ નવીન જગત બનો શકીએ. સાચે જ, જયરે માણસને આવી અદ્ભુત તક સાંપડો છે, ત્યારે તેની ખાતર તેણે સર્વસ્વનો લોગ આપવા માટે તૈયાર રહેવું જોઈએ.

\*

## ૩૧ જુલાઈ ૧૯૫૭

વહાલા માતાજી, શુક્રવારે તમે ધ્યાન માટે “ભગવાન માટે શરીરમાં અભીષ્ટા કેવી રીતે જગૃત કરવી ?” એ વિષય આપ્યો હતો.

હા.

વહાલા માતાજી, તે અભીષ્ટા કેવી રીતે જગૃત કરી શકાય ?

સ્વાભાવિક રીતે જ, તે કરવાની અનેક રીતો છે; દરેક જણે પોતાની રીત શોધી બેવાની હોય છે. પણ તેનું આરંભિક તદ્દન ભિન્ન હોઈ શકે, દોષીતી રીતે વગભગ તદ્દન વિરુદ્ધ પણ હોય.

જ્યારે યોગ જીવનમાંથી ભાગી ધૂટવા માટે હતો તે પ્રાચીન સમયમાં, કેટલાક પૂર્વનિર્ધારિત બોકોની વાત છોડી દઈએ તો, બોકો મોટે ભાગે વૃદ્ધાવસ્થામાં જ યોગ વિષે વિચાર કરતાં, ને અવસ્થાએ પહોંચતા પહેલાં તેમણે ઘણો ઘણો અનુભૂત કરી લીધો હોય, જીવનનાં સંકટો જોઈ લીધાં હોય, જીવનનાં સુખો, દુઃખો જવાબ-દારીઓ, ભ્રાન્તિઓ ભાગી જય તે સ્થિતિ, જીવનની ઘણીખરી અનુભૂતિઓ ભોગવી લીધાં હોય. પરિણામે સ્વાભાવિક રીતે જ અસ્તિત્વનાં સુખ વિષેની ભ્રમણાં ભાગી ગઈ હોય, એટલે તેઓ બીજી કોઈ વસ્તુનો વિચાર કરી શકે. તે સમયે શરીરમાં

થોવનનો ઉત્સાહ ન રહ્યો હોય એ વાત ખરી, પણ, કામથી કામ, તે વિક્ષેપણ બની શકે તેવી સ્થિતિમાં તો ન જ હોય. કારણ કે શરીર બધું ભોગવીને ધરાઈ ગયું હોય, એટલે તે વધારે ભોગવવાની માગણી તો ન જ કરે. જે માણસ આધ્યાત્મિક વલણ દ્વારા જીવનમાંથી ભાગી જવા માગતો હોય, તો તો એ છેડાથી શરૂઆત કરવી તે બરાબર ગણાય, કારણ કે તે રૂપાંતર સિદ્ધ કરવામાં શરીરના સહકારની અપેક્ષા રાખતો હોતો નથી. આ સ્પષ્ટ રીતે સહેલામાં સહેલી પદ્ધતિ છે. પણ જે માણસ ભૌતિક અસ્તિત્વ પણ દિવ્ય જીવનમાં ભાગીદાર બને એવી અપેક્ષા રાખતો હોય. ભૌતિક અસ્તિત્વને કાર્યનું તથા સાક્ષાત્કારનું કેવ બનાવવા માગતો હોય, તો ઘસારાથી શરીર ક્ષીણ, શાંત બની જાય અને યોગમાં વિક્ષેપ ન કરી શકે ત્યાં સુધી રાહ જોવી એ ઈચ્છનીય નથી. તેથી ઉલટું, શરીર જ્યારે તદ્દન યુવાન હોય, શક્તિપૂર્ણ હોય, અભીષ્ટામાં ખૂબ વેળ અને ઉલ્કટતા મૂડી આપી શકે તેવી સ્થિતિમાં હોય, ત્યારે યોગ શરૂ કરવો એ વધારે સારું છે. આ બાબતમાં, કશું જ ન માગતા કંઠાળા, થાક ઉપર આધાર રાખવા કરતાં. માણસે પરિપૂર્ણતા માટે, નવીન અજ્ઞાત વસ્તુ માટે, એક પ્રકારના આંતર ઉત્સાહ પર આધાર રાખવો જોઈએ. બાલ્યાવસ્થામાંથી જ માર્ગદર્શન અને મદદ મળે તેવી સ્થિતિ પ્રાપ્ત કરવા ત્યારે ભાગ્યશાળી બન્યા હો, તો યુવાવસ્થામાં જ તમારે જીવનનાં અસ્થિર છેતરામણાં સુઝો તથા પરિપૂર્ણતાના અને સત્યના જગતમાં જીવન અને કાર્ય વૃદ્ધિની પ્રાપ્તિ વચ્ચે વિવેક કરી વેવો જોઈએ. તે પરિપૂર્ણતાના અને સત્યના જગતમાં સર્વ મર્યાદાઓ અને સામાન્ય અશક્તિઓને દૂર કરી દેવામાં આવી હોય છે.

જ્યારે માણસ યુવાન અને સુઅત અર્થાત અંદર સભાન ચૈત્ય અસ્તિત્વ સાથે જન્મેલો હોય છે, ત્યારે તે બાળકનાં સ્વભનેમાં એક પ્રકારની અભીષ્ટા હોય છે, જે તે બાળકની ચેતનામાં એક પ્રકારની મહત્વાકંક્ષા હોય છે, કદુપતા વગરની સુંદરતા માટે અન્યાય વગરના ન્યાય માટે, અમર્યાદ જદ્ગતા માટે, સભાન સતત વિજ્ય માટે સતત ચમત્કાર માટે મહત્વાકંક્ષા હોય છે. બાળક જ્યારે યુવાન થાય છે, ત્યારે તે ચમત્કારોનાં સ્વભનો સેવતો હોય છે, બધી દુષ્ટતા અદૃશ્ય બની જાય, બધું હંમેશાં તેજેમય, સુંદર, સુખમય હોય તેવાં સ્વભન સેવતો હોય છે, તેને સુખની કૃથાઓ ગમતી હોય છે. માણસે તેના પર આધાર રાખવો જોઈએ. જ્યારે શરીરને દુઃખોની, તેની મર્યાદાઓની માગણી અનુભવાતી હોય છે, ત્યારે માણસે તેમાં અમર્યાદ બળનું, કદ્વણાવિહેણી સુંદરતાનું, અને અદ્ભુત શક્તિઓનું સ્વભન સ્થાપી આપવું જોઈએ. સાચે જ જ્યારે માણસ યુવાન હોય છે, ત્યારે તે હવામાં

ઉડવાનાં, જરૂર હોય ત્યાં જવાના, વિકૃત બનતી વસ્તુઓને કીકળાક બનાવવાનાં, માંદાને સાજા કરવાનાં, સર્વ પ્રકારનાં સ્વખનો સેવતો હોય છે. મોટે ભાગે માતાપિતા અથવા શિક્ષકે તેના પર ઠંડું પાણી રહેવામાં સમય ગાળતાં હોય છે. તેઓ કહેતા હોય છે કે ઓહ, આ તો સ્વખન છે, વાસ્તવિકતા નથી. તેમણે તેથી ઊલટી જ વાત કહેવી જોઈએ! બાળકોને શિખવાડવું જોઈએ કે, “હા, તમારે આ જ વસ્તુ સિદ્ધ કરવા પ્રયત્ન કરવો જોઈએ, જો તમે તમારામાં રહેલા તે ભાગ સાથે સંપર્કમાં આવો કે જે આ વસ્તુઓ સિદ્ધ કરવા શક્તિમાન છે, તો તમે જરૂર તે સિદ્ધ કરી શકો. આ વસ્તુઓએ તમારા જીવનને માર્ગદર્શન આપવું જોઈએ સામાન્ય જગત જેને ભ્રાન્ત કહે છે તેને સત્ય, વાસ્તવિકતા બનાવવાની દિશામાં તમારે વિકાસ સાધવો જોઈએ.”

બાળકોને સામાન્ય અને જડ બનાવવાને બદલે, ગ્રામ્ય, સામાન્ય બુદ્ધિવાળાં બનાવવાને બદલે, તેમને એ પ્રકારનાં બનાવવાં જોઈએ. તે જડતા, ગ્રામ્યતા એક બળવાન ટેવ બની જાય છે. તે ટેવ જ્યારે કાંઈક સારું બનતું હોય છે, ત્યારે તે એવો વિશાર ઊભો કરે છે કે આ લાંબો સમય ટકી નહિ રહે! જ્યારે કોઈ માણસ ભલમનસાઈ આચરતો હોય છે, ત્યારે તે કહે છે કે, ઓહ, તેનામાં પરિવર્તન થઈ જશે! જ્યારે કોઈ અમુક વસ્તુ કરવા સમર્થ બને છે ત્યારે તે કહે છે કે ઓહ, આપતી ઢાલે તે આવી સુંદર રીતે તે વસ્તુ નહિ કરી શકે. આ અસ્તિત્વમાં એક પ્રકારના વિનાશક તેજાબ જેવો ચીજ છે, જે આશાનો, અને ભાવ થક્યતાઓમાં શક્કાનો વિનાશ કરે છે.

જ્યારે બાળકમાં ઉત્સાહ તરવરતો હોય, ત્યારે કદી તેના પર ઠંડું પાણી ન રેખો. તેને એમ ન કહેશો કે, તું જાણે છે કે જીવન એ પ્રકારનું નથી હોનું. તમારે હંમેશાં તેને પ્રોત્સાહન આપતાં કહેવું જોઈએ કે, “હા, અત્યારે વસ્તુઓ તે પ્રકારની નથી, વરચી છે, પણ તેની પાછળ બહાર પ્રગટ થવા મથતું સૌનદર્ય છે. તારે તેને ચાહવું જોઈએ, આકર્ષવું જોઈએ, તેને તારા સ્વખનોનો, મહત્વાકંશાઓનો વિષય બનાવી દેવો જોઈએ.”

જે બાલ્યાવસ્થામાં એ ન બને, તો મોટા થયા પછી ખરાબ કેળવણીની ખરાબ અસરોને નાખું કરવામાં, જીવન પાસેથી કથી જ સારી આશા ન રાખ-નારી કુદ્ર સામાન્ય બુદ્ધિને ઉઘેડી નાંખવામાં કે જે કુદ્ર સામન્ય બુદ્ધિ જીવનને

સહીન, કંટાળાભરેલું બનાવે છે અને સવ આશાઓનો, સૌન્દર્યની કહેવાતી ભ્રમ-  
જુઓનો વિરોધ કરે છે. તેથી ઊંઘટું, તમારે બાળકને અથવા તમારી જાતને કહેલું  
જોઈએ કે તારામાં જે અવાસ્તવિક, અશક્ય, ભ્રાન્તિમય દેખાય છે, તે જ સાચું  
છે; તારે તે જ બિલવવનું જોઈએ. જ્યારે તમારામાં અભીષ્ટા હોય છે કે કેટલીક  
અશક્યિતાઓથી હું મર્યાદિત નહિ બનું, કોઈ અસત્ત સંકુલ્પ વડે હું હંમેશને માટે  
રોકાઈ નહિ જાઉ, ત્યારે તમારે તમારામાં આ શક્ષા બિલવવી જોઈએ કે એ જ  
વસ્તુ તાત્ત્વક રીતે સત્ય છે, તેને હું સિદ્ધ કરીને જ જંપીશ.

ત્યારે શરીરનાં કોશાણુઓમાં શક્ષા જગૃત થાય છે, ત્યારે તમારા શરીરમાં જ  
તમને પ્રત્યુત્તર પ્રામ થશે, ત્યારે શરીરને પોતાને લાગશે કે જે મારો આંતર  
સંકુલ્પ મદદ કરશે, બળ પૂરશે, દોરવાળી આપશે, તો ધીમે ધીમે મારી બધી  
મર્યાદાઓ અદૃશ્ય બની જશે.

જ્યારે પ્રથમ અનુભૂતિ આવે છે, કે કેટલીક વાર બાલ્યાપસ્થામાં આવતી  
હોય છે, ત્યારે આંતર આનંદનો, આંતર સૌન્દર્યનો, આંતર પ્રકાશનો. પ્રથમ સંપર્ક  
એકદમ તમારામાં એવી લાગણી પેદા કરે છે કે, ઓહ, હું આ જ વસ્તુ મારું  
છું. તમારે તેને બિલવવી જોઈએ, તેને કદ્દી ભુલી જવી ન જોઈએ, હંમેશાં સતત  
તમારી સમજ જ રાખવી જોઈએ, અને તમારી જાતને કહેલું જોઈએ કે, “એકવાર  
મં તેનો અનુભવ કર્યો છે, એટલે બીજી વાર પણ હું તેનો અનુભવ કરી શકીશ.  
આ મારે માટે એક કાશ માટે પણ વાસ્તવિક બની છે; હું તેને મારી જાતમાં  
ફરી પુનર્જીવિત કરીશ.” તમારા શરીરને તેની જોજ કરવાનું પ્રોત્સાહન આપો.  
ખાતરી રાખો કે, “શરીરમાં જ તે શક્યતા રહેલી છે. જે શરીર તેને ફરી બોલાવશે,  
તો તે ફરી આવશે જ, ફરી તેને સિદ્ધ કરી શકાશે.”

જ્યારે માણસ નાનો હોય, ત્યારે જ આ વસ્તુ થવી જોઈએ. જ્યારે જ્યારે  
પોતાની જાતને યાદ કરવાની, પોતાની જાત સાથે સંબંધ જોડવાની, પોતાની જાતને  
જોન્જવાની તક મળે, ત્યારે ત્યારે, દર વખતે, આ જ કરાણું જોઈએ.

જ્યારે માણસ સાધારણ હોય છે અર્થાત્ ખરાબ કેળવણીથી, ઉપદેશથી અને,  
હૃદાતથી બગડી ગયો હોતો નથી, જ્યારે તે એક આરોગ્યમય, સમતોલ પરિસ્થિતિમાં

જન્મયો અને ઉછ્વો હોય છે, ત્યારે ભાનસિક અથવા પ્રાણિક રીતે તેમાં દખ્લગીરી કરવાની જરૂર સિવાય જે, શરીરને એવી ખાતરી હોય છે કે, જો કોઈક ખોટી વસ્તુ બની હોય, તો તેને સુધારી શકશે, શરીરમાંજ એવી ખાતરી હોય છે કે; માંદળી અથવા જેરવ્યવસ્થા ચોક્કસ અદશ્ય થઈ જવાની છે, હું સાજું બની જ જવાનું છું. વાતાવરણમાંથી મળેલી ખોટી કેળવણીને કારણે, ધીમે ધીમે શરીરને એમ શિખાડવામાં આવતું હોય છે કે, કેટલાક અસાધ્ય રોગો હોય છે, જેમને દૂર ન કરી શકાય તેવા અક્સમાતો હોય છે. શરીર વૃદ્ધ બને છે; આ બધું શરીરમાં રહેલી શક્કાનો અને વિશ્વાસનો નાશ કરે છે. સામાન્ય બાળકના શરીરને જે, જો કોઈક ગરબદ તેમાં પેદા થઈ હોય તો, એમ લાગે છે કે, હું સાજું થઈ જઈશ. જો તેમના હોય, તો સમજાનું કે તેમાં વિકૃતિ આવી ગઈ છે. આરોગ્યમય હોણું તો શરીરને સ્વાભાવિક લાગતું હોય છે. જો તે માંડું પડે, તો તે તેને કંઈક અસર્દ્ભાવિક લાગતું હોય છે. પોતાની સાહજિક વૃત્તિ વડે જે શરીર જાણી બેનું હોય છે કે, બધું ઢીકઠીક થઈ જશે. માત્ર વિચારની વિકૃતિ જે આ વસ્તુનો નાશ કરેતી હોય છે. માળસ જેમજેમ મેટો થતો જાય છે, તેમ તેમ વિચાર વધારેને વધારે વિકૃત બનતો જાય છે, સામૂહિક સૂચનની અસર તેના પર પડતી હોય છે; અને પરિણામે ધીમેધીમે શરીર પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દે છે, અને પોતાની સમતુલ્યાનો ભંગ થાય ત્યારે તેને ફરી પાછી પોતામાં સ્વધ્યાત્મક શક્તિ શરીર ગુમાવી બેસે છે.

પણ જે નાનપણથી જે તમને અનેક પ્રકારનો નિરાશાજનક, અવસાદકારી વસ્તુઓ શિખવવામાં આવી હોય કે જે શરીરનું વિધટન કરે છે, તો આ શરીર વિકૃત બની ગયેલું, અવ્યવસ્થિત બની ગયેલું હોવાને કારણે, તેનામાં આંતર બળનું અને પ્રતિકાર્ય કરવાની શક્તિનું ભાન ગુમાઈ ગયેલું હોવાને કારણે, શરીર ખૂબ પ્રયત્ન કરે છતાં પણ તે રોગને કે અવ્યવસ્થાને દૂર કરી શકતું નથો.

જો શરીર વિકૃત ન બને તેવી દરકાર માળસ રખે, તો શરીરમાં પોતામાં જે વિજ્ઞયની ખાતરી હોય છે. વિચારનો જોટો ઉપયોગ અને શરીર પર પડતી તેની અસર જે શરીરમાં રહેલી વિજ્ઞયની ખાતરી દૂર કરી દે છે. માટે પહેલી વસ્તુ એ જે કરવાની છે કે, એ પ્રકારની ખાતરી કેળવવી, તેનો નાશ ન કર્યો. જો તે હશે, તો પ્રયત્ન કરવાની જરૂર નહિ રહે, અલ્લોપ્સા કરવાની જરૂર નહિ રહે, પણ વિજ્ઞયની આંતર ખાતરીને માત્ર જિલ્લવાનું રહેશે.

શરીરમાં પોતાની દિવ્યતાનું ભાન છે. એ તમે તેને ગુમાવી દીધું હોય, તો તમારે તેને ફરી શોધી કાઢવા પ્રયત્ન કરવો જોઈએ.

જ્યારે ભાળક તમને કહે કે. મને એક સુંદર સ્વરૂપ આવ્યું હતું, જેમાં મારામાં ખૂબ શક્તિઓ હતી, બધી વસ્તુઓ સુંદર હતી, ત્યારે તમે ડાખા થઈને તેને કદી એમ ન કહેશો કે, ઓહ, જીવન તે પ્રકારનું નથી હોનું, કારણ કે તેથી તમે એક ભરાબ વસ્તુ કરી રહ્યા છો. ઉદ્દું તમારે તો, તેને એમ કહેવું જોઈએ કે, જીવન તે પ્રકારનું જ હોવું જોઈએ અને તે જરૂર પ્રકારનું બનશે.

\*

## ૭ એપ્રિલ ૧૯૫૭

કી અરવિંદે વખ્યું છે કે “અતિમનસ્તુ” અવતરણ તેને સ્વીકારનાર અને બળ ચેતનામાં પરિપૂર્ણ બનેલા માણસમાં દિવ્ય જીવનની સર્વ શક્યતાઓને સ્થાપણે તે માત્ર આધ્યાત્મિક જીવનની સમગ્ર લાક્ષણિક અનુભૂતિને જ નહિ, પણ અત્યારે આપણે જેને જિન-આધ્યાત્મિક કહીએ છીએ તેને પણ આવરી વેશે.”

( અતિ-મનસ્તો આવિભાવ, પૃષ્ઠ ૪૭ )

તો પછી તમે પૂછો છો? કયી વસ્તુ તેમાંથી બાકાત રહેશે તે?

આપણે જેને બાકાત રાખીએ તે તો તે માણસ પર આધાર રાખે છે. પણ એ સાચી રીતે શું પૂછો છો?

આપણે કોઈ પણ વસ્તુ બાકાત રાખી શકતા નથી.

ઓહ, તે તો બહુ ડલાપણ ભરેલી વાત છે. અહીં આપણે કહીએ છીએ કે આપણે કોઈ પણ વસ્તુને બાકાત રાખતા નથી. તેનું તે જ કારણ છે. આપણે જીવી જ માત્રવીય પ્રવૃત્તિઓને ઓછામાં ઓછી આધ્યાત્મિક ગણાતી પ્રવૃત્તિઓને પણ લઈ લીધેલી છે. પણ મારે કહેવું જોઈએ કે તેમનો સ્વભાવ બદલવો એ બહુ કઠિન છે; છતાં આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે તેમાં સર્વ શક્ય સદ્ગુરુના મુક્તીએ છીએ.

એમ પણ કહેવામાં આવ્યું છે કે અતિમનસુનું અપતરણ રૂપાંતરને વધારે સહેલું બનાવશે? તેમાં એ વસ્તુઓ બળપૂર્વક પ્રતિરોધ કરે છે: એક રાજકારણ, અને બીજું અર્થકારણ. આ બે બાબતોમાં માનવીય વલસનું પરિવર્તન કરવું તે સૌથી વધારે કહિન છે.

સિદ્ધાંતરૂપે એમ કહ્યું છે કે રાજકારણ સાથે આપણને કોઈ નિસ્બત નથી. તે વાત સાચી છે કે અત્યારે જે પ્રકારે રાજકારણ આચરાય છે તેની સાથે આપણને કોઈ નિસ્બત નથી. પણ જે રાજકારણને તેની સાચી ભાવનાપૂર્વક સ્વીકારવામાં આવે, માનવસમૂહોના સંગઠનના રૂપમાં, સરકારી તંત્રની સર્વ વિગતોમાં, સામૂહિક જીવનના નિયત્રણમાં, બીજા સમૂહો, રાષ્ટ્રો, દેશો સાથેના સંબંધોમાં, તો રાજકારણ જરૂર અતિમાનસિક રૂપાંતરમાં પ્રવેશી શકે, કારણ કે જ્યાં સુધી રાષ્ટ્રજીવન અને રાષ્ટ્રો વચ્ચેના સંબંધો જેવા અત્યારે છે તેવા રહે, ત્યાં સુધી પૃથ્વી પર અતિમાનસિક જીવન જીવું તે તદ્દન અશક્ય છે. એટલે આપણે રાજકારણમાં પણ પરિવર્તન લાવવું પડશે, આપણે તેની સાથે પણ કામ વેનું પડશે.

અર્થકારણી બાબતોમાં, વિનિમયનું અને ઉત્પાદનનું સાધન શેખી કાઢવું તે સરળ છે. પ્રાથમિક જમાનામાં બોકો એક વસ્તુ આપીને બદલામાં બીજી વસ્તુ બેતા હતા. તેના કરતાં આપણે વિનિમયને વધારે સરળ બનાવી શકીએ. સિદ્ધાંતની દૃષ્ટિએ પ્રાચીન સમયની વિનિમય પદ્ધતિ સર્વત્ર લાગુ પાડી શકાય. જીવનના સરળીકરણ માટે તે અનિવાર્ય છે. પણ માનવ પ્રકૃતિમાં તેથી વિરુદ્ધનું જ બનતું હોય છે! ત્યાં પરિસ્થિતિ લગભગ અસહ્ય બની ગઈ છે. બીજા દેશો સાથે જરા પણ સંબંધ રાખવો એ લગભગ અશક્ય બની ગયું છે. જેને વિષે ખૂબ બડાણો મારવામાં આવી હતી તે વિનિમયનાં સાધનો સરળીકરણ કરવાને બદલે ખૂબ જટિલ બની ગયાં છે, કદાચ તેમાં વ્યવહારબંધી નજીકના ભાવિમાં થાય તેવા સંભય છે. પછી આપણે કાંઈ ન કરી શકીએ. દરેક વસ્તુમાં બધું થઈ જઈએ એવી દહેશન છે. જે માણસને બીજા દેશમાંથી એક નાનામાં નાની વસ્તુ મંગાવવી હોય, તો તેને ખૂબ ગુંચવાડાભરેલી અને પરિશામયુક્ત પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હોય છે. પરિણામે કદાચ તે માણસને પોતાના નાનકડા ખૂલ્ખામાં જ રહેવું પડે, પોતાના જેતરમાં ઊગડેલા બરાકાથી જ સતોષ માનવો પડે; બીજા દેશોમાં શું બની રહ્યું છે તે જાણવાની આશા તેણે છોડી દેવી પડે.

આ બે વસ્તુઓ : રાજકારણ અને અર્થકારણ ખૂબ પ્રતિરોધક છે. માનવ ચેતનામાં આ બે વસ્તુઓ અશાનનાં, અચેતનતાનાં, અસદ્ભાવનાનાં બળોને પરાધીન છે. આ બે સત્ય પ્રત્યેતી પ્રગતિનો, આગેકૂચનો ખૂબ- ખૂબ વિરોધ કરતી હોય છે. કમનસીબે, દરેક માનવ વ્યક્તિમાં પણ એ બે વસ્તુઓ જ વિરોધ કરતી હોય છે, જે વસ્તુઓ મુજાહીબરેલી છે અને જે પરિથિત વસ્તુઓને સમજવાનો ઈન્કાર કરતી હોય છે. આ વસ્તુઓને લઈ તેમનું ઝ્યાંતર કરવું એ એક વીરતાભર્યું કાર્ય છે, આપણે તે માટે પણ પ્રયત્ન કરીએ છીએ. તે સિદ્ધ ન થાય ત્યાં સુધી પૃથ્વીની પરિસ્થિતિમાં પરિવર્તન આવવું તે અશક્ય છે.

સામાજિક અને અર્થકારણી સ્થિતિઓને બદલવી તે રાજકારણી નાસુંકીય સ્થિતિઓને બદલવા કરતાં વધારે સહેલું છે. અર્થકારણી અને સામાજિક દ્વારાબંદુથી જોતાં, અમુક સામાન્ય વિશ્વવ્યાપી વિચારે છે, જેમની પાસે માનવવિચાર જઈ શકે તેમ છે. અમુક મુક્તિઓ, અમુક વિશ્વાસા, અમુક સામૂહિક સંગઠન, કે જે તદ્દન અર્થહીન અને સિદ્ધ ન થઈ શકે તેવાં નથી દેખાતાં. પણ જ્યારે તમે બીજી બે મહત્વના પ્રશ્નોને સ્પર્શ કરો છો, ખાસ કરીને રાજકારણી પ્રશ્નને, ત્યારે સ્થિતિ તદ્દન જુદા જ પ્રકારની લાગે છે. નાસુંકીય ગુંચવણે વગરના જીવનની કલ્પના થઈ શકે છે જો કે તે સાચી દરીદ્રતા હોય. નાસુંકીય શક્યતાઓ અને

---

૧. “હિન્દુ જીવન- પૃથ્વી પરનું” હિન્દુ જીવન એક અલગ અને ભાડાત રાખનારી વસ્તુ નહિ હોય, કે જેને સામાન્ય પાર્થિવ અસ્તિત્વ સાથે કશી લેવા-હેવા નથી, તે માનવીય જીવનને અને માનવીય અસ્તિત્વને હાથમાં લેશો, શક્ય હોશે તેનું ઝ્યાંતર કરશો, શક્ય હોશે તેનું આધ્યાત્મિકરણ કરશો, ખાડીની વસ્તુઓ પર પોતાની અસર પાડશો, તેમાં જૌતિક અથવા તો ઉદ્ઘાત બનાવે તેથું પરિવર્તન લાવશો, વૈશ્વિક અને વર્ષે ગંગનાર આપદેનો સંખ્યાપણો, આધ્યાત્મિક સત્યનો જે તેનેમય પડછાયો. હોશે તે આદર્શ ઉપર આકાશાં કરશો, જે અતિમનસ્ર આવશો, અને અત્યારે જેમ મન એ અગ્રણી તત્ત્વ છે તેમ પાર્થિવ પ્રકૃતિમાં અતિમાનસ અસ્તિત્વને અગ્રણી તત્ત્વ તરીકે સ્થાપણો અને તે પણ પૂરી ખાતરીપૂર્વક, પાર્થિવ અસ્તિત્વના સાંપુર્ણ નિયમનપૂર્વક, તો મન પોતાની અભૂષ્ણતાને કારણે જે કરી શક્યું ન હતું તે ઝ્યાંતરની શક્તિ, જેમની સ્વા-ભાવિક ભર્યાદીએમાં અને તેમની ભૂમિકા ઉપર, માનવજીવનનું મહાન પરિવર્તન થશે. પણ જાણે તે હિન્દુ ઝ્યાંતર સુધી ન પહોંચે, પણ તે અનિવાર્ય બનશે.

(અતિમનસનો આવિજ્ઞાન, પૃષ્ઠ ૪૭-૪૮)

પ્રક્રિયાઓ જે વસ્તુ લાવે છે તેમાં શક્યતાઓની ખૂબ સમૃદ્ધિ છે, કારણ કે જો તેમનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે, સાચી ભાવનાપૂર્વક ઉપયોગ કરવામાં આવે, તો ખૂબ પ્રમાણમાં બધા માનવીય સંબંધો અને કાર્યો સરળ બની જાય અને જીવનની એવી એક જટિલતાને શક્ય બનાવે કે જે બીજી પરિસ્થિતિઓમાં ખૂબ કહિન બની જાય. પણ મને સમજાતું નથી, સિવાય કે શ્રોષ ઘટના પહેલાં કનિષ્ઠ ઘટના બનતી હોય છે, કે સરળીકરણનો માર્ગ અપનાવવાને બદલે માણસો જટિલી-કરણનો માર્ગ શા માટે પસંદ કરતા હોય છે, અને તે પણ એટલી હદ સુધી કે વિમાનો તમને બે દિવસમાં જગતના એક ખૂલ્યેથી બીજે છેડે લઈ જઈ શકે છે. આધુનિક સંશોધનોએ જીવનને એટલું બધું નાનકડું અને નજીકનું બનાવી દીધું છે કે ૮૦ દિવસને બદલે અત્યારે આપણે થોડા જ દિવસોમાં પૃથ્વીની પરિકમા કરી શકીએ; અને છતાં પણ દા. ત. વિનિમયના ગુંચવાડાઓ એટલા બધા મોટા છે કે માણસો પોતાને ઘેરથી બીજે જઈ શકતા નથી, પોતાના દેશમાંથી બહાર જઈ શકતા નથી, કારણકે તેમની પાસે બોજા દેશમાં જવા માટે તાંત્રાં ચલણી નાણાં નથી હોતાં. જો તેઓ તે નાણાંની માગણી કરે, તો તેમને પૂર્ણવામાં આવે છે કે, “તમારે તે દેશમાં જવું એ શું ખૂબ મહત્વનું છે? તમે થોડાક સમય રાહ જુઓ, કારણ કે અત્યારે અમે તે નાણાં તમને આપી શકીએ તેમ નથી.” હું મશકરી નથી કરતી, આ હું ગંભીરતાપૂર્વક કહી રહી છું, આનું બનતું હોય છે. તેનો અર્થ એ થયો કે આપણે આપણા જન્મસ્થાનમાં કેદી બનતા જઈએ છીએ, જ્યારે સર્વ વૈજ્ઞાનિક સંશોધનો દેશો વર્ષે એટલી બધી નિકટતા લાવી રહ્યાં છે કે આપણે બહું સહેલાઈથી વિશ્વના, કમથી કમ સમગ્ર જગતના રહેવાસી બની શકીએ.

પરિસ્થિતિ આવી છે. ગયા મહાયુદ્ધ પછી તે વધારે ખરાબ બની ગઈ છે. વષે વષે તે વધારે ને વધારે ખરાબ બનતી ચાવે છે. માણસ પોતાની જતને એવી હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાયેલા જુઓ છે કે તમ નસીબે જે સરળ વસ્તુને જટિલ બનાવી દેવામાં આવી છે તેનો છેડો દેખાતો નથી, અને પાર્થિવ ચેતનામાં એક એવો વિચાર પેઢા થઈ રહ્યો છે, જેને આપણે બેખુદો ગણી શકીએ. પણ તે બેખુદો હોવા કુટાં પણ વધારે ખરાબ બની રહ્યો છે, તેને સંકટ રૂપ કહી શકાય. તે વિચાર એ છે કે જો કોઈ મોટી ઉથલપાથલ થાય, તો પછી બધું હીક ઠાક થઈ રહે. માણસ નિષેધેની, અશક્યતાઓની, અવરોધેની, નિયમોની, લરજણે આવી પડતી જટિલતાઓની વર્ષે એવો તો લીંસાઈ ગયો છે કે માણસ ગુંગળાઈ જાય

છે અને એવો વિચાર કરતો બની જાય છે કે જો આ બધાને સંપૂર્ણ વિનાશ કરી દેવામાં આવે, તો પછી અધું વધારે સાતું બની જાય ! તે વિચાર હવામાં ફેલાઈ રહ્યો છે. બધી સરકારોએ પોતાની જાતને એવી અથકય સિથિતિમાં મુકી દીધો છે. તે એટલી બધી બંધનમાં સપદાઈ ગઈ છે કે તેમને એમ લાગે છે કે આગળ બધી શક્વા માટે બધી વસ્તુઓને ભાંગી-નોડી નાંખવી પડશે. (મૌન) કમનસીબે, આ શક્વાયા કરતાં કાંઈક વધારે છે. એ એક ખૂબ ગંભીર ધમકી છે. અને જીવન હજુ પણ વધારે અથકય બને તેવો સંભવ છે, કારણ કે એ જટિલતાઓની અંધાધુંધીમાંથી બહાર નીકળી આવવા માટે માલુમ અસમર્થ બની ગયો છે, કે જે અધાધુંધીમાં માનવ-જાતાએ પોતાની જાતને મુકી દીધી છે. માનવ ચેતનામાં જ એક નવીન આશા ઉગ્રી છે તેનો જે એક સંક્રિય પડછાયો છે તે આશા અને જરૂરિયાત કાંઈક વધારે સંવાદમય વસ્તુની છે. જેમ જેમ આધુનિક જીવનનું સંગરુન તેથી વધારે ને વધારે વિરુદ્ધ બનતું જાય છે, તેમ તેમ તે જરૂરિયાત વધુ ને વધુ તીવ્ર બનતી જાય છે. એ બે વિરુદ્ધ વસ્તુઓ એવી ઉત્કટતાથી એકબીજાની સામે આવીને ઉભી રહી છે કે તેમાંથી બડાકા જેવું કાંઈક પ્રગટે.

(મૌન)

પૃથ્વીની આ સિથિત છે, તે અધું તેજસ્વી, આશાપ્રદ નથી. પણ આપણે માટે એક શક્વા રહે છે, મેં તે વિષે તમને અનેક પાર વાત કરી છે, લલે બહારની વસ્તુઓ પૂરેપૂરી ખરાબ બનતી ચાલે, અને સંકટને કદાચ દૂર ન રાખી શકાય, તો પછી જે બોકેને માટે અતિમાનસિક જીવન એક વ્યર્થ સ્વર્ણરૂપ નથી રહ્યું, જેમ તે તેની વાસ્તવિકતામાં શ્રદ્ધા છે અને તેનો સાક્ષાત્કાર કરવા માટેની અભીસા છે, હું અહીં ચોડીયેરીમાં આકામમાં આવેલા બોકેની વાત નથી કરતી, પણ તે બોકેની વાત કરું છું કે જેમની વર્ષે કી અરવિદે આપેલા જ્ઞાનની કરી (જેડનારી કરી.) છે અને તે જ્ઞાન અનુસાર જીવવાનો સંકલ્પ છે. તેમણે પોતાની અભીસાને, સંકલ્પને. પ્રયાસને વધારે ઉત્કટ બનાવવાં પડશે, પોતાની શક્તિઓને એકત્રીત કરવી પડશે, અને સાક્ષાત્કાર માટેના સમયને ટૂંકો બનાવવો પડશે. તેમણે ત્યક્તિગત રીતે અને થોડાક પ્રમાણમાં સામુહિક રીતે, આ સાક્ષાત્કાર માટે જરૂરી અવકાશ, ગાળા, અને સમય પર વિજ્ય પ્રામ કરવાનો ચમત્કાર બનાવવો પડશે. તેમણે સમયને સ્થાને પ્રયાસની ઉત્કટતા મુકી આપવી પડશે, અને જગતની વર્તમાન પરિસિથિતિનાં પરિણામોમાંથી પોતાની જાતને મુક્ત કરવા માટે ખૂબ જરૂરી,

ખૂબ દૂર તે સાક્ષાત્કાર પ્રત્યે આગળ વધું પડ્યો. તેમણે શક્તિને, ભળને, પ્રકાશને, સત્ત્યને એવાં એકાગ્ર બનાવવાં પડ્યો કે આ સાક્ષાત્કાર દ્વારા તેઓ આ પરિણામોથી પર અને સલામત રહી શકે, આંતર ઝ્યાંતર દ્વારા તેમને પ્રામ થપેલા, પ્રકાશ, સત્ત્ય, હિંય વિશુદ્ધિએ આપેલા રક્ષણને માસ્ટી શકે. જેથી નિકટના ભાવિની આ મહાન આશાનો નાથ કર્યા સિવાય આ જંગાવાત જગત પરથી પસાર થઈ જાય, તે જંગાવાત આ સાક્ષાત્કારના પ્રારંભને ઘસડી ન જાય.

આરામમય શાંતિમાં ઊંઘી જવાને બદલે, વસ્તુઓને પોતાની છંદોમયતા અનુસાર બનવા દેવાને બદલે, જે માસુસ પોતાના સંકલ્પને અભીપ્સાને ખૂબ વધારે અને પ્રકાશમાં કૂદી પડે. તો તે પોતાના મસ્તકને ઉચ્ચયતર રાખી શકે, પોતાની ચેતનાના ઉચ્ચયતર પ્રદેશમાં જીવવા માટે, શ્વાસોચ્છ્વાસ લેવા માટે, વહી જતા જંગાવાતથી પર રહીને વિકાસ સાધવા માટે મોકણાશ મેળવી શકે.

આ શક્ય છે. જયારે ક્રી અરવિંદ અહીં હતા ત્યારે છેલ્લા મહાયુદ્ધ વખતે, ઘણાથોડા પ્રમાણમાં આ વસ્તુ કરવામાં આવી હતી. તે જ ફરીથી પણ કરી શકાય, પણ માલસને તેની ઈચ્છા હોવી જોઈએ, દરેક જસે પોતાનું કાર્ય કરવું જોઈએ, વધારાં વધારાં દિલની સંચાઈપૂર્વક અને પરિપૂર્ણ રીતે.

\*

## ૧૪ એપ્રિલ ૧૯૫૭

આજ સન્ને પ્રશ્નોના ઉત્તર આપવાને બદલે, આપણે ક્રી અરવિંદની સમૃતિપર ધ્યાન કરીશું, તે સમૃતિને આપણામાં કેવી રીતે જીવંત રાખી શકાય તેના પર, તેમનો આપણે ને આભાર માનવો જોઈએ તેના ધ્યાન કરીશું. કારણકે ક્રી અરવિંદે આપણે માટે ધાર્યાંધાર્યાં કર્યું હતું, અને હજુ પણ કરતા રહે છે. તે આ મહાન સાક્ષાત્કાર માટે પોતાની તેજોમય, જીવંત, સક્રિય ચેતનામાં તેમણે ધાર્યાંધાર્યાં કર્યું હતું અને હજુ પણ કરતા રહે છે. તે આ મહાન સાક્ષાત્કારની પૃથ્વીને જાહેરાત કરવા માટે જ માત્ર ન હતા આવ્યા, પણ તેને સિદ્ધ કરવા પણ આવ્યા હતા. હજુ પણ તે સાક્ષાત્કારને તેઓ સિદ્ધ કરી રહ્યા છે.

આપતી કાલે તેમના જન્મથતાબ્દી દિન છે. વિશ્વના લિતિહાસમાં તે સનાતન જન્મ છે.

માતાજી, થોડાક સમયથી આપણો પ્રવૃત્તિઓમાં સામાન્ય ચેતના નીચે ઉત્તે ગઈ છે. ખાસ કરીને આક્રમ ખૂબ વિશાળ બની ગયો ત્યારથી એમ લાગે છે. તેનું કારણ શું છે અને તે સિથનિને આપણે કેવી રીતે સુધારી શકીએ?

તમે આક્રમની બધી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરો છો કે માત્ર રમતગમતોનો? આક્રમની બધી પ્રવૃત્તિઓમાં?

માતાજી, બધી પ્રવૃત્તિઓને હું જાણતો નથી. હું જેમને જોઈ શકું છું, તેમની હું વાત કરું છું.

(ખૂબ લાંબા સમયના મૌન પછી) આ ખૂબ ગુંચવાડાભરેલો પ્રશ્ન છે. હું તેને સમજાવવા પ્રયત્ન કરીશ.

ઘણાઈસમય સુધી આક્રમ માત્ર વ્યક્તિઓનું મિલન સ્થાન હતું, દરેક જણ કાંઈક વસ્તુનું પ્રતિનિધિત્વ કરતો હતો, પણ તે વ્યક્તિ તરીકે. તેમાં સામૂહિક સંગઠન ન હતું. તેઓ શેરરંજના પટ પરનાં લિભનલિબન્ન મહોરાં હતાં. તેઓ માત્ર દેખાવમાં જ સંયુક્ત હતાં. તેઓ કેવળ એક જ જગ્યાએ રહેવાને કારણે, કેટલીક સામાન્ય ટેવો હોવાને કારણે અને તે પણ થોડી જ ટેવોમાં સમાન હતા, આ કેવળ બાંધ હકીકતને કારણે તેઓ કાંઈક સંગઠિત કહી શકાય. દરેક જણ પોતાની શક્તિ અનુસાર પ્રગતિ કરતો હતો અથવા કરતો ન હતો. એકને બીજા સાથે ઓછામાં ઓછા સંબંધો હતા. જે વ્યક્તિઓ આ વિચિત્ર સમૂહનું નિર્માણ કરતી હતી, તેમના મૂલ્ય અનુસાર એક સામાન્ય (સર્વસાધારણ) મૂલ્યવત્તા હતી. પણ તે મૂલ્યવત્તા ખૂબ અસ્થિર, પ્રાથમિક પ્રકારની હતી. તેમાં સામૂહિક વાસ્તવિકતાની જરૂર દેખાવા લાગી છે. તે જરૂરિયાત આક્રમ પૂરી જ મર્યાદિત નથી, પણ તોંદેવા બોકેને પણ આલિંગી લે છે કે જેમણે, ભૌતિક રીતે નહિ પણ પોતાની ચેતનામાં, પોતાને શ્રી અરવિંદના શિષ્યો તરીકે જહેર કર્યા છે અને જેમણે શ્રી અરવિંદના ઉપદેશને જીવનમાં ઊતારવા પ્રયાસ કર્યો છે. અતિમાનસિક ચેતનાનું અને શક્તિતનું પ્રાગટ્ય થયું ત્યારથી, તે બધા બોકેમાં એક સાચા સાંધિક જીવનની જરૂરિયાત જગૃત થઈ છે. જે સંધ માત્ર કેવળ બાહ્ય ભૌતિક સંબેદ્ધ પર આધા-

રિત નથી, પણ ને ગહનતર સત્યનું પ્રતિનિધિત્વ કરી શકે, જેને કી અરવિંદ અતિમાનસ અથવા જ્ઞાનમય સંધ કહે તેવો બની શકે. અલબત્ત, કી અરવિંદે કષ્ટું છે કે તે સંધમાંની વ્યક્તિત્વોએ પોતે અતિમાનસ ચેતનાને પ્રામ કરેલી હોવી જોઈએ. પણ વ્યક્તિતગત પરિપૂર્ણતા પ્રામ કર્યા સિવાય પણ, તેમાં આ સામૂહિક વ્યક્તિત્વનું સર્જન કરવાનો આંતર પ્રયાસ હતો. સાચી એકતા ગહનતર ગ્રંથિ માટેની જરૂરિયાત વરતાઈ છે, અને તેને સિદ્ધ કરવા માટેના પ્રયાસો ચાલુ થયા છે.

તેથી કાંઈક વિક્રેષ થયો છે. પહેલાં વલસુ ખૂબ વ્યક્તિતગત હતું, જેથી કેટલીક ટેવો ઉજળી પડી છે ભૌતિક રીતે નહિ, કારણ કે વસ્તુઓ પહેલાં હતી તેના કરતાં અત્યારે બહુ લિન્ન નથી, પણ વધારે ગહન ચેતના આવી છે, હું એ વાત પર ભાર મુક્કવા માગું છું કે આસે અમુક આંતર પરસ્પર આધારનું સંજન્ન કર્યું છે, જેથી વ્યક્તિતગત ધોરણ થોડુંક નીચે આવી ગયું છે, સિવાય તે બોકોમાં કે જેમણે આ બધાને સમાન સ્તર પર લાવવાની ગતિનો પ્રતીકાર કરી શકે તેવા બળવાન આંતર સાક્ષાત્કારને પ્રાપ્ત કર્યો હતો. તે વસ્તુ એવી છાપ ઉલ્લો કરે છે કે સર્વસાધારણ સ્તર નીચે ઉત્તી ગયું છે, પણ આ વાત સાચી નથી. પહેલાં હતું તેના કરતાં સર્વસાધારણ સ્તર ઉચ્ચતર ભૂમિકા પર ગયું છે, પણ વ્યક્તિતગત સ્તર, ઘણા માણસોમાં, પહેલાંના કરતાં નીચે ગયું છે, જે વ્યક્તિત્વો એક યા બીજો સાક્ષાત્કાર પ્રાપ્ત કરવા સમર્થ હતી, તેમને લાગ્યું છે કે અમારે પહેલાં ને ભાર પહુંન કરવો પડો ન હતો. તે હવે પહુંન કરવો પડે છે જો કે તેનું કારણ તેઓ સમજતા હોતા નથી, તે આ પરસ્પર આધારનું પરિણામ છે. ઉષ્ણાં, તે એક અસ્થાયી (થોડા સમય માટેની) અસર છે, ને સુધ્યારા પ્રત્યે, ખૂબ અનુભવી શકાય તેવી સર્વસાધારણ પ્રગતિ પ્રત્યે દોરી જશે.

અલબત્ત, જે દરેક વ્યક્તિ સચેતન હોત, જે તેણે આ સમાન સ્તર પર બધાને લાવવાની અસરને તાબે થવાને બદલે, સમૂહમાંથી આચન્નો તત્ત્વોને, અસરોને, પ્રવાહોને ઉત્તી બનાવવા માટે, તેમનું રૂપાંતર કરવા માટે, તેમનો પ્રતીકાર કર્યો હોત, તો સમગ્ર સમૂહે પહેલાંના કરતાં ઉચ્ચતર ચેતનામાં આરોહણ કર્યું હોત.

હું તે જ લક્ષ્ય સિદ્ધ કરવા માગું છુ. તમને તે વિસ્તારપૂર્વક સમજવતી નથી. જ્યારે મેં તમને પ્રયાસ કરવાની ઉંકટ જરૂરિયાત વિષે વાત કરી હતી,

ત્યારે હકીકતમાં હું તમને સમજવવા માગતી હતી કે તમે જે વ્યક્તિત્વથી શીતે પ્રયાસ કર્યો તે માત્ર વ્યક્તિત્વથી પ્રગતિ માટેનો નહિ બની રહે, પણ તે પ્રસરણ અને ખૂબ મહત્વનાં સામૂહિક પરિણામો નીપદ્ધતિશી પણ મહીનામો સુધી મેં કાઈ જ કલ્યાં નહિ, કારણ કે હું વ્યક્તિત્વથી ચેતનાને આ સામૂહિક વ્યક્તિત્વ માટેની આ જરૂરિયાત સ્વીકારવા માટે નૈયાર કરવા માગતી હતી. હવે મારે તે તમને સમજવવું જોઈએ. આ દેખીતા પતન માટે બીજું કોઈ જ કારણ નથી. તે પ્રગતિની ધીરે ધીરે ઊર્ધ્વમાં આરોહણ કરતી ગતિ છે, જે અમૃત સાક્ષાત્કારને વધારે વિશ્વાસ અને ઉચ્ચતર બનાવવા માટે તેનો ત્યાગ કરવાની જરૂરિયાત ઉલ્લે કરે છે. જે દરેક જણ નેમાં સચેતન શીતે અને સદ્બાવનાથી સહકાર આપે, તો તે બહુ જલ્દી સિદ્ધ થાય.

જે આ આશમના જીવનને ગતિશીલ બનાવવું હોય, તો તે જરૂરિયાત અનિવાર્ય હતી. જે વસ્તુ પ્રગતિ નથી કરતી, તે ચોક્કસ અવનતિ કરે છે, નાશ પામે છે. આશમે ટકી રહેવા માટે ચોનાની ચેતનામાં પ્રગતિ સાધવાની હતી, એક જીવંત તત્ત્વ બનવાનું હતું. આપણે ઊર્ધ્વ ગતિમાં, ડેટલાંડ વર્ષ પહેલાંના સાક્ષાત્કારની રેખાથી ખૂબ આગળ વધ્યા છીએ; પણ ઉચ્ચતર સતર પર આપણે ત્યાં પાછા આવીશું.

તે તમારા પ્રશ્નનો જવાબ છે.

મેં તમને હમણાં જે કલ્યાં છે તેનો વિરોધ કરતી લાગે એવી ગતિઓ દેખાય, પણ હંમેશાં તેવું જ ભનતું હોય છે. કારણ કે જ્યારે જ્યારે માલુસ અમૃત વસ્તુને સિદ્ધ કરવા માગે છે, ત્યારે ત્યારે તેને પહેલી મુશ્કેલી એ જણાય કે જે પહેલાં નિષ્ઠિક્ય હતું તે હવે પ્રતિરોધ કરવા ઊભું થઈ જાય છે. જે વસ્તુ આ પરિવર્તન સ્વીકારવાની ઈચ્છા રાખતી નથી, તે સ્વાભાવિક શીતે જ જગીને બળવા પોકારે છે, પણ તે મહારતું નથી. તે વાત વ્યક્તિમાં બને છે તે તે જ પ્રકારની છે, જ્યારે તમે પ્રગતિ કરવા માગો છો, ત્યારે તમારી ચેતનામાં, તમે જે મુશ્કેલીને જીવા માગતા હો છો તે તરત જ મહત્વની અને ઉત્કટતાની હૃદિએ દશગણી વધી જાય છે. પણ છતો ખંતપૂર્વક આગળ વધ્યે જ જવાનું હોય છે, તો મુશ્કેલી ચાલી જશે.

માતાજી, અહીં શી અરવિંદ કહે છે, “ અતિમાનસિક અસરનો સ્પર્શ ક્ષમગ્ર માનવજલિને થશે કે તે પરિવર્તન માટે તૈયાર થયેલા અમૃક ભાગને જી, તેનો આધાર વિશ્વના ચાલુ કર્મમાં જે વસ્તુનો ઈરાદો હતો અથવા જે શક્ય હતું તેના પર રહે છે. ”

( અતિમનસ્નો આવિલ્લાવ, પૃષ્ઠ ૬૫. )

“ જે વસ્તુનો ઈરાદો હતો અથવા જે શક્ય હતું ” તેનો અર્થ શો છે ? જે વસ્તુઓ બિન છે. અત્યાર સુધી તમે કણું છે કે જો માનવજલિ પરિવર્તિત બને, જો તે નવીન જન્મમાં ભાગીદાર બનવા દુલ્હા .....

તે એક જ વસ્તુ છે. જ્યારે તમે કોઈ પદાર્થને અમૃક સ્તર પર જુઓ, ત્યારે તમે તેને વિસ્તૃત રીતે, ચારે બાજુઓ પ્રસરતી રીતે જુઓ છો, જ્યારે તમે તે જ પદાર્થને બોળ સ્તર પર જુઓ છો, ત્યારે તમે તેને ઉલ્લી રેખામાં જુઓ છો, ( માતાજી પોતાના પુસ્તકનું પૂરું અને તેની પાછલી બાજુ બતાવે છે ). એટલે જો માણસ ઉધ્વર્માંથી જુઓ, તો તે કહેશે કે જેનો ઈરાદો હતો તે, જો માણસ નીચેથી જુઓ તો તે કહેશે જે શક્ય હતું તે. પણ તે બંને એક જ વસ્તુ છે, માત્ર દૃષ્ટિબિન્દુ બિનન-બિનન છે.

તો તો પછી, આપણી અશક્તિ અથવા પરિવર્તન કરવા માટે સંકલ્પનો અભાવ કોઈ બેદ પેદા કરતો નથી.

અમે ધર્માવાર આ વસ્તુ કહી છે. જો તમે માનસિક રીતે કાર્ય કરતી ચેતનામાં રહો પછી ભલે તે ઉચ્ચતમ મન હોય, તો તમારામાં કાર્ય કારણ સંબંધી કેવળ અવિતબ્યતાવાદનો ઘ્યાલ હોય છે, તમને એમ લાગતું હોય છે કે વસ્તુઓ અમૃક પ્રકારની છે, એટલે જ તે અમૃક પ્રકારની હોઈ જ ન શકે.

જ્યારે તમે સંપૂર્ણપણે માનસિક ચેતનામાંથી બહાર આવો છો, અને વસ્તુઓના ઉચ્ચતર, આધ્યાત્મિક અથવા દિવ્ય દર્શનમાં પ્રવેશ કરો છો, ત્યારે જ તમે પરિપૂર્ણ સ્વતંત્રતાની સ્થિતિને એકદમ પ્રાપ્ત કરો છો, જેમાં સર્વ વસ્તુ શક્ય બનતી હોય છે.

(મૌન)

જે બોકોએ તે સ્થિતિનો સંપર્ક સાધ્યો હોય છે અથવા એક કશ માટે પણ તેમાં જીવા હોય છે, તેઓ તેને કાર્યાન્વિત પરમ સંકલ્પના ભાવરુંપે વર્ણવે છે, કે જે ભાવ માનવીય માનસેકતાને એકદમ યથેચું વર્તનારો લાગતો હોય છે. તે વિકૃતિને પરિણામે એવો વિચાર ઉદ્ભબે છે જે વિચાર છું પરંપરાપ્રાભ કહું છું કે ભગવાન પરમ યથેચું રીતે વર્તે છે, જે વાત કોઈ પણ પ્રકાશપુકૃત મનને સ્વીકાર્ય નથી. છું ધારું છું કે ખરાબ રીતે વ્યક્ત કરાયેલો એ અનુભવ આ ઘાલના મૂળમાં છે. હકીકતમાં, તેને સ્વેચ્છાવત્તો સંકલ્પ કહેવો તે જોડું છે; તે સંકલ્પ તો તદ્દન, તદ્દન, તદ્દન, જુદા જ પ્રકારનો હોય છે. માણસ એમ સમજો હોય છે કે સંકલ્પ એટલે બેવાયેલો અને અમલમાં મૂકાયેલો નિર્ણય, આપણને સંકલ્પ શબ્દ નો ઉપયોગ કરવાની ફરજ પડે છે, પણ સાચી રીતે જોતાં વિશ્વમાં કાર્ય કરી રહેલો સંકલ્પ એ પસંદગી પણ નથી. મને તેને એટે ‘દર્શના’ શબ્દ યોગ્ય લાગે છે. વસ્તુઓ છે, કારણુંકે તે દૃષ્ટિગોચર છે. પણ તે જોવાનો અર્થ આપણી આંખો વડે આપણે જોઈએ છીએ તેવો નથી માતાજી પોતાની આંખો નો સ્પર્શ કરે છે. છતાં પણ તે પોતાની જતને પ્રગટ કરતી દર્શના હોય છે.

જેમ જેમ વિશ્વને પ્રગતિશીલ રીતે જોવામાં આવે છે, તેમ તેમ તે દૃષ્ય બનતું ચાલે છે.

તેથી શ્રી અરચિદે કહું છે કે જેનો ઈરાદો રથાયો હતો તે અથવા જે થક્ય હતું તે! તે બેમાંથી તે એકદેય નથી. જે કાંઈ કહી શકાય તે વિકૃતિ છે.

(મૌન)

લોચિક દૃશ્યોકરણ એ દેશ કાળમાં વિસર્ગ જેવી ચીજ છે, જે શાશ્વત કાળથી છે, તેનું જીવંત પ્રતિબિંబ છે. જેમ જેમ દેશકાળના પડા ઉપર તે પ્રતિબિંબનો ધીમે ધીમે વિસર્ગ થતો જાય છે, તેમ તેમ તે દૃષ્ય બનતું ચાલે છે. પરમાત્મા પોતાના પ્રતિબિંબનું ધ્યાન કરે છે.

\*

## ૪ સાચેભાર ૧૯૫૭

શ્રી અરવિંદના જન્મ દિનને આગલે દિવસે, ૧૪મી ઓગસ્ટે, મે કે શબ્દ ગુચ્છનો પ્રયોગ કર્યો હતો તે વિષે મને એક પ્રેશન પુછુવામાં આવ્યો છે, તે પ્રેશન મને રસપ્રદ વાળ્યો, કારણકે તે એક એવો ગૂડ શબ્દજુચ્છ વિષે હતો, કે કે ખૂબ સરળીકરણને કારણે વગભગ ન સમજી શકાય તેવો બની જતો હોય છે. તેનો હેતુપૂર્વક તે રીતે પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેથી દરેક જલુ, ચોતઘોતાની ચેતનાની ભૂમિકા અનુસાર તે સમજે. એક જ શબ્દને લિન્ન-લિન્ન ભૂમિકાઓ ઉપર સમજવાની શક્યતા બાબત મેં તમને ધારી વાર કહ્યું છે. તે શબ્દો ઈરાદાપૂર્વક સરળીકરણ સાથે, વ્યક્ત કરવામાં આવ્યા હતા, હેતુપૂર્વકની અનિશ્ચિતતા તેમાં ચાખવામાં આવી હતી, જેથી તેમને અર્થની કે જટિલતા વ્યક્ત કરવાની હતી તેનું તે વાહન બની શકે.

લિન લિન ભૂમિકાઓ પર આ અર્થ જરાક લિન હોય છે, પણ તે એકબીજાના પૂરક છે. જ્યારે, એકી સાથે, આ ધારી જ ભૂમિકાઓ પર તેને સમજવા માટે માલુસ સમર્થ બને છે, ત્યારે જ તે વાસ્તવિક રીતે પરિપૂર્ણ બને છે. સાચી સમજ એ એકી વખતે થતી સમજ હોય છે, જેનાં બધા અર્થો ગ્રહણ થતા હોય છે, એકી સાથે જ પકડતા, સમજતા હોય છે. પણ તેમને આપણી ગરીબી ભાવવામાં વ્યક્તત કરવા માટે આપણને તેમને એક પઢી એક, ધારા શબ્દોમાં, અને ધારી સમજૂતિઓ સાથે, કહેવાની ફરજ પડે છે. હવે છું તેમ જ કરવા માગું છું.

શ્રી અરવિંદના જન્મ દિનને આગલે દિવસે મે' કે શબ્દગુચ્છનો પ્રયોગ કર્યો હતો તે આ હતો, 'શાશ્વત જન્મ.' મને પુછુવામાં આવ્યું છે કે, શાશ્વત એટલે શું?

અલબત્ત, જો શબ્દોનો અક્ષરાર્થ કરવામાં આવે, તો 'શાશ્વત જન્મ' શબ્દ કાઈ વધારે સુચવી શકે તેમ નથી. પણ છું તમને એ વાત સમજવવા માગું છું કે એ અંગે ભૌતિક (શારીરિક) સમજ હોઈ શકે, માનસિક, રૌત્યિક અને આધ્યાત્મિક સમજ હોઈ શકે.

ભૌતિક રીતે, તે શબ્દ ગુચ્છનો અર્થ એ છે કે જ્યો સુધી પૃથ્વી ટકી રહેશે, ત્યાં સુધી આ જન્મનાં પરિસ્થિતિમાં ટકી રહેશે. શ્રી અરવિંદના જન્મનાં

પરિણામો પુઢવીના સમગ્ર અસ્તિત્વમાં અનુભવાશે. તેથી આવ્યમય રીતે મેં તે જન્મને 'શાશ્વત' કહ્યો હતો.

માનસિક રીતે, તે એવો જન્મ છે કે જેની સમૃતિ સનાતન કાલ માટે ટકી રહેશે. યુંગો સુધી શ્રી અરવિંદના જન્મને તથા તેના સર્વ પરિણામોને બોકો સમૃતિમાં રાખ્યે.

ચીતસિક રીતે, તે એવો જન્મ છે, કે જે સનાતન કાળ માટે, એક યુગથી બીજા યુગમાં, વિશ્વના ઈતિહાસમાં વારંવાર બનતો રહેશે. આ જન્મ પુઢવીના ઈતિહાસમાં અવાર નવાર, એક યુગથી બીજા યુગમાં, પ્રગટ થતો રહે છે. તે જન્મનું જ પુનરાપર્તન થન્ય હોય છે, તે દરેક વખતે કાંઈક નવીન વધારેની વસ્તુ લઈ આવતો હોય છે, વધારે પરિપૂર્ણ વસ્તુ લઈ આવતો હોય છે, પણ તે એ જ અપતરલુણી ગતિ હોય છે, પાર્વિવ શરીરમાં જન્મનાં, આવિભાવની ગતિ હોય છે.

શુદ્ધ આધ્યાત્મિક દૃષ્ટિબિન્દુથી જોતાં, એમ કહી શકાય કે પુઢવી પર તે સનાતનનો જન્મ છે. જ્યારે દરેક વખતે અવતાર ભૌતિક રૂપ ધારણ કરે છે, ત્યારે તે પુઢવી પર સનાતનનો પોતાનો જન્મ હોય છે.

આ બધાનો સમાવેશ મેં બે શબ્દોમાં કર્યો હતો : 'સનાતન જન્મ.'

છેવટે હું તમને સલાહ આપું છું કે ભવિષ્યમાં શા માટે ? આનો અર્થ શો ? મને તે બિલકુલ સમજાતું નથી. કદાચ તેને યોગ્ય રીતે વ્યક્ત કરવામાં 'આલ્યુ' નથી." તમારે તમારી જતને ઉહેવું જોઈએ કે "કદાચ હું સમજું શકું તેવી ભૂમિકા પર હું નથી," અને માત્ર શબ્દો કરતાં કાંઈક વધારે, શબ્દોની પીઠમાં રહેલી વસ્તુને ખોણી કાઢવા તમારે પ્રયત્ન કરવો જોઈએ.

મને લાગે છે કે આપણા ધ્યાન માટે આ સારો વિષય બની રહેશે.

(ધ્યાન)

## ૧૧ સપ્ટેમ્બર ૧૯૫૭

મધુર માતાજી, કેટલાક લોકોને જોતાં પ્રથમ દૃષ્ટિએ તેમના પ્રન્યે આકર્ષણી કેમ થતું હોય છે, અને બીજાઓને જોઈને અણગમાની વાગણી મોટે ભાગે આને આધાર પ્રાણીક સમાનતાઓ પર રહેલો હોય છે, બીજા કશા પર નહિ. કેટલાંક પ્રાણીક આકંપનો સંવાદી બની રહેતાં હોય છે, જ્યારે કેટલાંક નહિ. તે એક પ્રાણીક રસાયનશાસ્ત્ર છે.

તેમ ન બને તેટલા માટે, માણસે ખૂબ ગહનતર અને વધારે સ્પષ્ટદર્શી ચેતનામાં હોવું જોઈએ. ચૈત્યિક ચેતના પર આધાર રાખતું એક આંતર દર્શન હોય છે, ને તમને બતાવી આપે છે કે કૃત્યા માણસોમાં તમારા જેવી જ અભીષ્ટા છે, તમારા જેવું જ લક્ષ્ય છે, અને કૃત્યા માણસો માર્ગમાં તમારા સાથીદારો બની શકે તેમ છે. તે જ દર્શન તમને એ પણ સ્પષ્ટ બતાવી આપે છે કે કૃત્યા માણસોનો માર્ગ લિન્ન છે, કૃત્યા માણસોમાં એવાં બણો છે કે ને તમારો વિરોધી છે અને તમારા વિકાસમાં તમને હાનિકારક છે. પણ તે દર્શન પ્રાપ્ત કરવા માટે, માણસે પોતે માત્ર પોતાની જ આધ્યાત્મિક પ્રગતિમાં અને સમગ્ર સાક્ષાત્કારમાં મશગૂલ રહેવું જોઈએ. મોટે ભાગે તેમ હોતું નથી.

જ્યારે માણસે આ આંતર સ્પષ્ટ દર્શન પ્રાપ્ત કર્યું હોય છે, ત્યારે મોટે ભાગે તે આકર્ષણના અને અણગમાના રૂપમાં વ્યક્ત થતું હોતું નથી, પણ ખૂબ દૃશ્યગત જ્ઞાન વડે, તમને શાન્તિપૂર્વક અને તર્કયુક્ત રીતે કાર્ય કરવે તેવી આંતરિક ખાતરી વડે, આકર્ષણો અને અણગમાઓ વગર જ, વ્યક્ત થતું હોય છે.

એટલે સામાન્ય રીતે ખાતરીપૂર્વક કહી શકાય કે ને લોકો નિશ્ચિત અને આવેગમય ગમાઓ અતે અણગમાઓ હોય છે, તેઓ પ્રાણીક ચેતનામાં જીવતા હોય છે. આની સાથે માનસિક સમાનતાઓ મિશ્રિત થઈ જાય, અર્થાત् કેટલાંક મુનને એકસરખાં કાર્યોમાં સંબંધિયા રાખવા ગમતા હોય છે, પણ આ લોકો બૌધ્ધિક શરીરે બહુ ઊંચા સ્તર પર હોય છે. તે સંબંધોમાં, પ્રાણીક સંબંધો સાથેની સરખામણીમાં, વધારે સરખતા સહેલાઈ હોય છે, કોઈક વધારે શાન્ત અને અનાસ્કાન તરવ હોય છે, કેટલાક માણસો સાથે વાતચીત કરવામાં મજા આવતી હોય છે, બીજાઓ માટે આકર્ષણ નથી હોતું, માણસને તેમાંથી કર્યું પ્રામ થતું હોતું નથી. તે જરાક

વધારે દૂરનું અને શાન્ત હોય છે. તે વધારે તર્કબુદ્ધિના કેત્રનું હોય છે. પણ ગમાઓ તથા અલુગમાઓ સ્પષ્ટ રીતે પ્રાણિક જગતની વસ્તુઓ છે, ભૌતિક રસાયનશાસ્કીની પેઢે, પ્રાણિક રસાયનશાસ્ક હોય છે, કેટલાંક શરીરો એકબીજા પ્રત્યે અલુગમો સેવતાં હોય છે, પ્રાણિક રસાયનશાસ્ક કરતાં હોય છે, જ્યારે બીજા શરીરો આકર્ષણાં હોય છે. કેટલાક પદાર્થો સંયુક્ત બની જતા હોય છે, જ્યારે કેટલાક પદાર્થો ભડકો કરતા હોય છે. કેટલાંક પ્રાણિક આકંખનો એટલાં બધાં સંવાદમય બની જતાં હોય છે કે તેમાંની ૮૮ ટકા સહાનુભૂતિઓ પ્રેમ બની જતી હોય છે; અને માલુસ એકદમ બોલી ઉઠો હોય છે કે હું તેની જ રાહ જોઈ રહ્યો હતો; હું તે નારીની જ જોજમાં હતો! (હસાહસ) પછી તથો એક બીજા પ્રત્યે પસો જય છે, પણ છેવટે તેમને જણાય છે કે એ બધું માત્ર ઉપરછલું હતું; આ વસ્તુ ટકી શકે તેમ નથી. તેથી યોગ કરવા ઈચ્છતા બોકેને પ્રથમ સલાહ આપવામાં આવે છે કે ગમાઓથી તથા અલુગમાઓથી પર બની જાઓ. આ વસ્તુમાં કોઈ વધારે ઊરી વાસ્તવિકતા હોતી નથી; તે તમને એવી મુશ્કેલીઓ પ્રત્યે દોરી જય છે, કે જેનાથી બહાર આપવું બહુ કઠિન પડે છે. આ વસ્તુઓ વડે તમે તમારા જીવનનો વિનાશ કરી શકો છો. કોઈ વસ્તુ એ છે કે તેમના તરફ ધ્યાન જ ન આપવું, તમારી જતમાં થોડાક ડૂબી જઈને તમારી જતને પૂછું આ કરી બહુ રહસ્યમય વાત નથી કે, “તને આ માલુસને મળવું કેમ ગમે છે, અને એવા માલુસને મળવું કેમ નથી ગમતું?”

પણ એક કાલ એવી આવે છે કે જ્યારે માલુસ પોતાની સાધનામાં જ મશગૂલ બની જય છે, અને તેને ખૂબ ધોંતિપૂર્વક અને સૂક્ષ્મ રીતે લાગતું હોય છે કે અમૃક સંપર્ક મારી સાધનાને અનુકૂળ બની રહેશે અને અમૃક સંપર્ક મારી સાધનાને પ્રતિકૂળ બની રહેશે. પણ તે હંમેશાં એક વધારે અનાસક્ત રૂપ ધારણ કરે છે, અને ઘણીવાર પ્રાણિક આકર્ષણોનો અને અલુગમાઓનો વિરોધ કરે છે; ઘણીવાર તેને તે ગમા-અલુગમાઓ સાથે કોઈ નિસબ્ધત હોતી નથી.

એટલે કોઈ વસ્તુ એ છે કે બધી વસ્તુઓ પ્રત્યે થોડાક દૂરથી જોવું, અને એ વસ્તુઓની નિર્ધર્થકતા વિષે તમારી જતને પ્રવચન આપવું.

સ્પષ્ટ છે કે કેટલાંક સ્વભાવો પાથાભૂત રીતે ખરાબ હોય છે; તે સર્વોદ્દાર જ જન્મેલાં હોય છે; જો તેમને બીજાને હાનિ પહોંચાડવી એ ગમતું હોય છે. જો

માણસ તદ્દન સ્વાભાવિક હોય, વિકૃત ન હોય, પરંચૂઓ એઠે સ્વાભાવિક હોય - પશુઓ આ ફિટબિંગથી તેમાં, માણસ કરતાં વધારે સારાં હોય છે, વિકૃતિની થડુઆત તો માનવ જીતિથી થતી હોય છે તો તેવાં સત્ત્વોથી તે માણસ દૂર રહે છે - જેમ પાયાબૂત રીતે નુકશાનકારક વસ્તુથી માણસ દૂર ભાગતો હોય છે તેમ; પણ સદ્-ભાગ્યે આવા કેઈસો બધું નથી હોતા. મોટે ભાગે જીવનમાં આપણને મળતા લોકો મિશ્રા સ્વભાવવાળા હોય છે, જેમનામાં સારા નરસા વર્ચ્યે એક પ્રકારની સમતુલ્ય હોય છે, અને સારા તથા નરસા બંને પ્રકારના સંબંધોની આશા રાખી શકાય. ખરાબ લોકો પ્રત્યે ખૂબ અણગમો રાખવાનું કોઈ ઝરણ નથી, ઝરણ કે દરેક જાણ પોતે પણ સારા નરસાનું મિશ્રાજ હોય છે. (હસાહસ), અને સરખી વસ્તુ પોતાના જેવી વસ્તુને મળે છે!

કેટલાક લોકો પ્રાણ ચૂસી લેનારાં સત્ત્વો જેવા હોય છે. જ્યારે તેઓ બીજ કોઈની પાસે આવે છે, ત્યારે તેઓ તે માણસની પ્રાણશક્તિને ચૂસી લેતા હોય છે. માણસે, ગંભીર જેખમની એઠે, તેમનાથી સાવધ રહેવાની જરૂર છે. તેવાં સત્ત્વો નથી એમ નથી, પણ તેઓ વિરલ હોય છે. તે સંપૂર્ણ રીતે પ્રાણશોષક સત્ત્વ નથી એટલે જ્યારે એવો માણસ મળે, ત્યારે તેનાથી દૂર ભાગી જવાની જરૂર નથી..

એટલે તત્ત્વિક રીતે, માણસ જો આધ્યાત્મિક રીતે વિકાસ સાધવા માખતો હોય, તો પ્રથમ તો તેણે પોતાના ગમા, અણગમાઓ ઉપર વિજય મેળવવો જેઈએ. તેમની બધાની સામે સિમતપૂર્વક જુઓ.

( મૌન )

“ નવી માનવ જીતિ, પૃથ્વી પર અને પાર્થીં શરીરમાં, માનસિક પ્રાણીઓની જીતિ હશે. પણ તે વૈશ્રિક અજ્ઞાનના સામ્રાજ્યમાં તેની અત્યારની સ્થિતિમાંથી એટલી બધી મુક્ત બનેલો હશે કે તેમનું મન પરિપૂર્ણ હશે, પ્રકાશમય હશે, જે મન અતિમનસાનું અથવા ઝીંક ચેતનાનું ગૌણ કાર્ય બની શકે તેનું હશે, તે સત્યને સ્વીકારનાર મનની પરિપૂર્ણ શક્યતાઓ માટે સમર્થ હશે, વિચારમાં તથા જીવનમાં તે સત્યના ગૌણ કાર્યરૂપ હશે. તે પૃથ્વી પરના દિવ્ય જીવનનો એક ભાગ હશે, જ્ઞાનની ઉત્કાતિનો પ્રારંભ હશે, સંપૂર્ણ પણે અથવા પ્રધાનપણે તે અવિદ્યાને વશ નહિ હોય. તે સમગ્ર માનવ જીતિને આલિંગી લેણે કે તેના માત્ર વિકસિત ભાગને,

તેનો આધાર ઉત્કાંતિના ઈરાદા પર, વિશ્વની ગતિઓને દોરવણી આપનાર વૈશ્વિક અથવા પરાતપર સંકલ્પના ઈરાદા પર રહેશે”

(અતિમનસનો આવિલાંબ, પૃષ્ઠ ૯૦)

શું આ ઈરાદો અજ્ઞાત છે ?

શું તમે એ જાણો છો ?

એ વાત તો સ્પષ્ટ છે કે ઉત્કાંતિને હેતુ છે, લક્ષ્ય છે; અને તેથી તે હવે વચ્ચે અટકી ન શકે.

આ વાત તમે જાણો છો, કારણે તમે શ્રી અરવિંદનાં પુસ્તકો વાંચ્યાં છો, પણ માર્ગમાં મળતા ગમે તે માણસને પૂछો કે વિશ્વનો અને ઉત્કાંતિનો ઈરાદો શો છે ? તે જવાબ આપશે કે મને તેને વિશે કથી ખબર નથી. રૂવાભાવિક રીતે જે, જેમણે શ્રી અરવિંદનાં પુસ્તકો વાંચ્યાં છે, તેઓ તે વિશે કંઈક જાણતા હોય છે, જ્યારે શ્રી અરવિંદે આ લખ્યું, ત્યારે જે લોકોને યોગમાં રસ ન હતો અને જેમણે તેમના પુસ્તકો વાંચ્યાં ન હતાં, તેમને માટે તેમણે આ લખ્યું હતું. શારીરિક વ્યાયામ સાથે નિસબ્ધ ધરાવનાર લોકો માટે તેમણે તે લખ્યું હતું; એટલે તેમણે યોતાની જતને તેમની જગ્યાએ મૂકી હતી, તેમના વિચારોને વ્યક્ત કર્યા હતા, અને તેમને થોડાક આગળ દોરી જવા પ્રયત્ન કર્યો હતો, તેમણે તેમના પુસ્તકો જેમણે વાંચ્યાં હતાં તેમનું દૃષ્ટિબંધુ અપનાયું હતું.

પણ તમે કેવું કે એ વાત યોતે જાતે જ સ્પષ્ટ છે. અહીં એવા સેંકડો લોકો છે, જેમને તમે કહો કે “તમે જે વાંચ્યું છે તેનું પુનરાવર્તન ન કરશો, પણ વૈશ્વિક ઉત્કાંતિના ઈરાદા વિશે તમે શું વિચારો છો, તમને શું માગો છો તે કહો; વૈશ્વિક ઉત્કાંતમાં કોઈ ઈરાદો છે કે નહીં ?” તો મને લાગે છે કે, કોઈ તમને દિલની સચ્ચાઈપૂર્વક આવો જવાબ નહિ આપી શકે કે, તે ઈરાદો આવો છે, તે ઈરાદો તેવો છે, તેમાંના કેટલાક લોકો શ્રી અરવિંદના ફકરાઓ બોલી જશે, પણ બાકી તો.....

તમે જે વાંચ્યું છે તેની મદદ વડે વિચારવાનું જો તમે બંધ કરી દો, અને તમારી અંગત અનુભૂતિ વ્યક્ત કરવાનો પ્રયત્ન કરો, તો તમારામાં કોઈ ખાતરી છે ખરી ?

તમે જે વાંચ્યુ છે અથવા શીખ્યા છો તેના પરિણામ વિષે હું વાત નથી કરતી. હું તમારી અંગત અનુભૂતિના પરિણામ, તમને જે સ્પષ્ટ રીતે અનુભવાયું છે તેને વિષે વાત કરું છું, કારણકે તે તમારું પોતાનું જીવન છે, તમારી પોતાની અનુભૂતિ છે. તમે તેનું વર્ણન કરી શક્શો?

હા.

કીક, હું તમને અલિનંદન આપું છું.

હું ઈચ્છાતો હોઉ કે નહિ, પણ તે બનતું હોય છે,

બહુ સરસ. હું આશા રાખું છું કે તમારા જેવા ધર્મા હોય.

મારામાં ધર્માં પરસ્પર વિરોધી તત્ત્વો છે, છનાં ય મારામાં કાંઈક છે.

હા, બહું સુંદર, બહું સુંદર.

એટબે હું તમને કહી શકું કે અહીં આવ્યા પછી તમે તમારું જીવન વેડફી નથી નાંખ્યું!

(હસાહસ)

કીક, આપણે આ વાતને આપણી અંદર જેવા પ્રયત્ન કરીશું,

(ધ્યાન)

\*

## ૧૮ સંપૂર્ણાભર રહેણ

માતાજી, અતિમાનસ જીવનમાં રહસ્યવાદને શું સ્થાન હશે?

ખાસ રહસ્યવાદને જ શા માટે?

કારણકે, બધું જીત બની ગયું હશે, નહિ વારું?

રહસ્યવાદ જ શા માટે? અતિમાનસિક જીવનમાં દરેક વસ્તુને સ્થાન હશે તમને તેમાં ખાસ રહે છે?

ગૂઢવાદ વિષે આપણે ને કાઈ જાણીએ છીએ, તે અનુસાર તે એક એવું વિજ્ઞાન છે કે જેના રડે અદૃશ્ય વસ્તુઓ જોઈ શકાય. અદૃશ્ય જગત, અદૃશ્ય શક્તિઓ. પણ અતિમાનસ જગતમાં આ બધી વસ્તુઓ જ્ઞાત હશે.

તમે ગૂઢવાદ એટલે શું સમજે છો ?

અદૃશ્ય જગતનું અને અદૃશ્ય શક્તિઓનું જ્ઞાન.

હું બરાબર સમજી શકતી નથી. અતિમાનસમાં માણસને કોઈ જ્ઞાન નહિ હાય, અથવા શું હશે ?

સંકલ્પને જ્ઞાન પ્રાપ્ત થયેલું જ હશે એટલે.....

પણ તેથી શું ? તે ગૂઢવાદી જ્ઞાન હશે ! હું બરાબર સમજી શકતી નથી. ગૂઢવાદ એ એ વસ્તુઓ સાથે કામ પાડવાની એક ખાસ પદ્ધતિ છે. ‘દિવ્ય જીવન’ માં શ્રી અરવિંદે આને વિષે વિસ્તારપૂર્વક લખ્યું છે. જ્ઞાન તથા કાર્ય પ્રત્યે તે એક ખાસ અભિગમ છે, અને તે અદૃશ્ય બની જાય તે માટે કોઈ કારણ નથી.

તે સ્વાભાવિક ચેતના બની જશે. પછી આ ગૂઢવાદી જ્ઞાન શ્રીખવાની માણસને કોઈ જરૂર નહિ રહે.

ઓહ, તમે એમ માનો છો કે, માણસ જેમ પિયાનો વગાડતા શીખી શકે છે, તેમ ગૂઢવાદ શીખી શકાય. (હસાહસ) પણ તદ્દન તેમ બનતું હોતું નથી તે ચીતે વસ્તુઓ બનતી હોતી નથી. હકીકતમાં, જે માણસને તે માટે વલખું છે, તે ગૂઢવાદ પરનાં પુસ્તકો વાંચી શકે છે, અને છતાં તેનો અમલ કેમ કરવો તે તે જાણી શકતો હોતો નથી. તે માટે ખાસ શક્તિની જરૂર હોય છે.

તે વાત પણ સાચી છે કે, પિયાનો કેમ વગાડવો તે વિષે તમે જગતમાંનાં બધાં પુસ્તકો વાંચી હો, પણ જો તમે તે વગાડો નહિ, તો તમને પિયાનો વગાડતાં કદી ન આવડે. પણ કેટલાંક લોકો જન્મથી જ સંગીતકારો હોય છે, કલાકારો હોય છે; છતાં પણ તે આખો જન્મ તેમાં માથાકૂટ કરે અને પરિણામ શૂન્ય આવે. ગૂઢવાદની વાત પણ તેવી જ છે. જો તમે એમ માનતા હો કે, અતિમાનસ તત્ત્વને પ્રાપ્ત કરેલો માણસ બધું જ કરી શકશો, તો તે બરાબર નથી, તેનામાં

ગૂઢવાદનું જ્ઞાન આપોઆપ આવી જતું હોતું નથી. શક્ય છે કે, તમારે તમારા વિષય ઉપર ચિત્તને એકાગ્ર બનાવવું પડશે અને તે કાર્ય શીખવું પડશે. તે પણ શક્ય છે કે, માણસ બધું જ કરી શકવા સમર્થ હોય; પણ બધાં જ કાર્યો કરવાની જરૂર નથી હોતી! માણસો અનુસાર અને તેમના વ્યક્તિત્વના રૂપો અનુસાર, ખાસ કામો થતાં રહેવાનાં, તેમાં બેદો અને વળ્ણો કરશે. રહેવાનાં. અતિ-માનસિક જગતમાં ગૂઢવાદ ન હોવો જોઈએ એમ માનવાને કોઈ કારણ નથી.

અતિ-માનસિક જીવન વિષે તમારો શો ઘ્યાલ છે? શું તમે તેને એવું એક સ્વર્ગ માનો છો કે જેમાં દરેક જણ ઓક્સરખું જ કામ, ઓક્સરખી રીતે જ કરશે? શું તમે સ્વર્ગ વિષેના પ્રાચીન ઘ્યાલમાં માનો છો કે જેમાં દરેક જણ વીલું વગડતો દેવદૂત હોય? હકીકિતમાં તેમ નથી. ત્યાં દરેક પ્રકારના બેદો હશે, અનેક પ્રકારની કિયાઓ હશે; પણ માનવીય અજ્ઞાતમાં કાર્ય કરવાને બદ્લે દિવ્ય જીવનમાં માણસ જ્ઞાન પૂર્વક કાર્ય કરતો હશે, તે મોટો તફાવત હશે.

અતિ-માનસિક જીવનમાં શક્તિત્વોમાં પણ વૃદ્ધિ થશે, નહિ વારું?

શક્તિત્વો? તમે ગૂઢવાદને અર્થ જીવનભર અને વસ્તુઓ પર કાર્ય કરવાની શક્તિત્વી પ્રક્રિયા માનો છો પણ તે ગૂઢવાદ નથી, તે તો જદૂ છે.

ગૂઢવાદ એટલે ચેતનાનો ખાસ ઉપયોગ. અત્યારે જે રીતે ગૂઢવાદનો પ્રયોગ થાય છે તે આભાસોની પીઠમાં રહેલી શક્તિત્વોનું, બજોની લીલાની પીઠમાં રહેલી શક્તિત્વોનું સીધે સીધું અને સચેતન દર્શન છે. તે દર્શન કારણે, તે માણસ તે શક્તિત્વો ઉપર કાર્ય કરી શકે છે. આ શક્તિત્વોની લીલામાં કોઈ ઉચ્ચતર સંકલ્પનો પ્રવેશ કરાવી શકે છે, જેથી ઈચ્છિત પરિણામ આવે.

અતિમાનસિક જીવનમાં માણસને આપોઆપ આ શક્તિત્વો પ્રાપ્ત થશે?

આપોઆપ? પોતે શું કરે છે તે જાણ્યા સિવાય જ, માણસ ગૂઢવાદનો અભ્યાસ કરતો હોય છે. દરેક જણમાં સ્વયંભૂ રીતે જ આ શક્તિ હોય છે, પણ પોતાનામાં તે શક્તિ છે એમ તે જાણતો હોતો નથી. તે શક્તિ ટાંકસુના માથા જેવી નાનકડી હોય; તે પૃથ્વી જેટલી વિશ્વાસ હોય, વિશ્વ જેટલી પણ વિશ્વાસ હોય. પણ ગૂઢવાદ આચર્યા સિવાય તમે જીવી જ ન શકો; એટલું જ કે તમે તે

જાણતા હોતા નથી. એટલે તમે એટલો જ તકાપત કરી શકો કે અતિમાનસિક ચેતનાવાળો માણુસ તે વાત જાણતો હશે. એટલે તમારો પ્રશ્ન ઉદ્દી જાય છે.

મેં તમને આ વાત અનેક વાર સમજવી છે. જ્યારે તમે વિચાર કરો છો, ત્યારે તમે ગૂઢવાદ આચરો છો. માત્ર તે વાત તમે જાણતા હોતા નથી. જ્યારે તમે મેઈ વ્યક્તિ વિષે વિચાર કરો છો, ત્યારે તમારો અમૃત ભાગ સ્વયંભૂ રીતે જ તે વ્યક્તિ સાથે સંપર્કમાં આવતો હોય છે. અને તમારા તેને વિષેના વિચારમાં તમે તમારાં સંકલ્પને ઉમેરો કે તે વ્યક્તિ આવી હશે કે તેવી હશે, તેણે આમ કરવું જોઈએ કે તેમ કરવું જોઈએ, તેણે આ સમજવું કે પેલું સમજવું જોઈએ, તો તમે ગૂઢવાદ આચરી રહ્યા હો છો; માત્ર તે વાત તમે જાણતા નથી હોતા. કેટલાક લોકો આ કામ શક્તિપૂર્વક કરતા હોય છે; અને જો તેમનાં બળવાન વિચાર હોય, તો તે પ્રગટ થાય છે, સિદ્ધ થાય છે. કેટલાક લોકોમાં તે સંકલ્પ નભણો હોય છે; તેમને બહુ પરિણામો મળતાં હોતાં નથી. તેનો આધાર તમારા વિચાર ઉપર તથા તમારી એકાગ્રતાની શક્તિ ઉપર રહે છે. પણ આ પ્રકારનો ગૂઢવાદ, જાણ્યા સિવાય, દરેક જાણ આચરતો હોય છે. એટલે સાચી રીતે ગૂઢવાદ આચરનાર માણુસ તે જાણતો હોય છે અને કઈ રીતે તે કરવું તે પણ જાણતો હોય છે.

ક્રી એકસ વિષે તમે અમને ધણીવાર કર્યું છે કે તે એક મહાન ગૂઢવાદી હતો. હું એમ ધારતો હતો કે અતિમાનસિક જગતમાં તે સ્વાભાવિક બની જતો હશે. બધા જ માણસો ક્રી એકસ કેટલા શક્તિશાળી બની જતા હશે.

પણ હું સમજતી નથી કે, તમે માત્ર ગૂઢવાદની જ વાત શા માટે કરો છો?

કારણ કે હું માનતો હતો કે, ગૂઢવાદના ક્ષેત્રમાં અદૃશ્ય જગતના સર્વ જ્ઞાનનો સમાવેશ થઈ જતો હશે.

સામાન્ય જીવનમાં માણુસ અચેતન હોય છે, અર્ધચેતન હોય છે. પણ પરિપૂર્ણ ચેતનામાં, તેને ગૂઢવાદની પરિપૂર્ણ ચેતના પણ પ્રાપ્ત થતી હોવી જોઈએ.

ના, શું તમે એમ માનો છો કે, અતિમાનસિક જીવનમાં કાર્યોનું કેઈ વગ્યો-કરણ નહિ હોય? શું ત્યારે બધું જ એક સામાન્ય, સ્વયંભૂ શક્તિમાં મિશ્રિત બની ગયું હશે?

ના, તેમાં પણ ચઢતી ઉત્તરતી કક્ષા હશે.

ત્યારે પણ વસ્તુઓ સાથે કામ બેવાના ભિન્ન ભિન્ન પ્રકારો હશે. કદાચ ગૂઢવાદી વધારે ઉપરોગમાં બેવાની હશે. પણ જે તમે એવી જગતની કહ્યપના કરતા હો કે જ્યાં દરેક જણમાં એક જ પ્રકારની ગૂઢવાદી શક્તિ હશે, તો તો પછી કોઈ લેદ નહિ રહે. સમજ્યાં? એવા બેંકો છે કે જેમનામાં ગૂઢવાદી શક્તિ છે, અને જેમનામાં તે શક્તિ નથી હોતી તેમના પર તેઓ કાર્ય કરે છે. પણ જે દરેક જણમાં સરખી જ ગૂઢવાદી શક્તિ હોય, તો પછી તે ગૂઢવાદ જ નહિ રહે! શું તમે તે હીતે સમજો છો?

મને ખાતરી છે કે ખૂબ પરિપૂર્ણ અતિમાનસ સાક્ષાત્કારમાં પણ, દરેક જણની શક્તિઓમાં અને કાર્યોમાં લેદ રહેવાનો. પણ યોગ્ય સ્થાને હોવું અથવા ન હોવું, કરવા યોગ્ય કાર્ય કરવું કે ન કરવું, તે અયેતનતાપૂર્વક કરવાને બદલે દરેક જણ પોતાના યોગ્ય સ્થાને જ હશે, અને પોતાને કરવા યોગ્ય કાર્ય સભાનતા-પૂર્વક કરતો હશે. અર્થાત, હંમેશાં અંધકારમાં ફાંઝાં મારવાને બદલે, જણવાનો પ્રયત્ન કરવાને બદલે, દરેક જણ એ શું કરવું તે અને આ રીતે તે કેમ કરવું, તે જણતો હશે. તે જ સમગ્ર તફાવત છે, લેદો તો ત્યાં પણ હોવાના જ, દરેક જણને પોતે જણવાનો ભાગ હોવાનો જ, પોતાનું સ્થાન, પોતાનું કાર્ય હોવાનું જ. એમ ન માની હોવું કે બધા એક સરખા દેખાતા હશે, એક જ રીતે એકજ પ્રકારનું કામ કરતા હશે! એતો ખૂબ લીધણ જગત બની જાય.

આપણે એમ કહી શકીએ કે, અતિમાનસ જગતની તથા વર્તમાન જગતની વચ્ચે આ તફાવત હશે: તમે જે નહિ જાણતા હો, તે ત્યાં તમે જાણતા હશો, તમે જે નહિ કરી શકતા હો તે ત્યાં કરવા સમર્થ બનશો, તમે જે નહિ સમજતા હો તે ત્યાં સમજ શકશો, અને જેનાથી તમે સભાન છો તેનાથી તમે સભાન બનશો. પણ પાયાની રીતે નવી સુષ્પિનો આ પાયો છે. અણાની જગ્યાએ શાન સ્થાપી આપવું અયેતનતાની જગ્યાએ ચેતના મુકી આપવી, નબળાઈની જગ્યાએ બળ મુકી આપવું. પણ તેનો અર્થ એવો નથી કે દરેક વસ્તુ એટલી બધી મિક્રોત થઈ જશે કે તેને એળખી ન શકાય!

(લાંબા સમય માટે મૌન)

શ્રી અરવિંદ આપણને કહ્યું છે કે, અતિમનસ્માં પોતામાં સાક્ષાત્કારની લિન્ન લિન્ન ભૂમિકાઓ કુમથઃ પ્રગટ થશે, જેમાં તે જ પ્રગતિશીલ ગતિ હશે કે જે હંમેશાં વૈશ્વક વિકાસની અધિકારી છે. અત્યાર સુધી તે જગત માનવ અતિના મોટા ભાગ માટે બંધ છે અથવા કેટલાક જણ માટે અર્થ ખુલ્લું છે, અને તેથી અતિમાનસ જીવનમાં આ પ્રગતિનો અધાલ બાંધવો તે કહિન છે. પણ તે છે જ ; જે ક્ષણે પ્રગતિ થતી હોય છે, તે ક્ષણે આરોહણ થતું હોય છે; પોતાના નિયમ અનુસાર પરિપૂર્ણતા વિકસતી ચાલે છે, જે નિયમ ચેતના આગળ ધીમે ધીમે પ્રગટ થતો ચાલે છે, પરિપૂર્ણ રીતે પ્રકાશમય ચેતના આગળ પણ, અને જે અજ્ઞાનને બદલે જ્ઞાનમાં કાર્ય કરતો હોય છે. આ કંઈક વસ્તુ, જે અત્યારે પરિપૂર્ણ રીતે, સમગ્ર રીતે, સામૂહિક રીતે આવિભાવિમાં નથી, પણ પ્રગતિશીલ છે, તે આપણે જે જગતમાં રહીએ છીએ તે જગતના વિકાસના નિયમને અનુસરશે ; પણ આપણે ક્યાં જઈ રહ્યા છીએ તે ન જાણવાને બદલે આપણે માર્ગને જાણીશું અને સભા-નતાપૂર્વક તેને અનુસરીશું. શું જનવાનું છે તેને વિષે કલ્પનાઓ, અનુમાનો કરવાને બદલે, આપણે ક્યાં જઈ રહ્યા છીએ તે, અને ત્યાં કેવી રીતે જવું તે જાણીશું. તે તત્ત્વક તફાવત હશે. એ વાત ચોક્કસ કે તે એક નીરસ અસ્તિત્વ નહિ હોય, જેમાં દરેક વસ્તુ, પરિવર્તન કર્યા સિવાય, અનિશ્ચિત રીતે ચાલ્યા કરતી હોય છે.

હું માનું છું કે, માનવ ચેતનામાં એવું એક વલણ હોય છે કે મારે ક્યાંક જવું જોઈએ, ઠરીને ઠેકાણ બેસનું જોઈએ અને આખરે એવી માગણીનો અનુભવ કરવો જોઈએ કે “હવે હું આવી પહોંચ્યો, અહીં દરીને ઠેકાણ બેસીશ, હવે હું હેરફેર નહિ કરું!” એ તો અતિમનસનો ક્ષુદ્ર પ્રકાર હોય.

પણ વૃદ્ધ પામવી પરિપૂર્ણતા પ્રત્યે આ આરોહણ કરતી, પ્રગતિશીલ ગતિ જરૂર વધારે આગળ પડતો ભાગ ભજવતી હશે. જ્યાં દરેક જણ આંધળા ભીંત છે અને ફાંઝા મારે છે તેવો અંધકારમાં પોતાની જતને પ્રગટ કરવાને બદલે, તે પ્રકાશમાં પોતાની જતને પ્રગટ કરશે, અને પોતે ક્યાં જઈ રહ્યો છે, પોતે શું કરી રહ્યો છે તે જાણવાનો આનંદ માણસને પ્રાપ્ત થશે. એટલે માણસે આવીને એમ ન પૂછણું જોઈએ કે, આ વસ્તુ સિદ્ધ થશે કે નહિ થાય ? અત્યારે આપણી પાસે છે તેના કરતાં ત્યારે આપણી પાસે ઘણી વસ્તુઓ હશે, દરેક શક્ય વસ્તુ ત્યાં હશે.

“આપણે માટે નવીન માનવ જતિ એટલે માનસિક પ્રાણીઓની જતિનું અથવા ટાઈપનું એવું પ્રાગટય અને વિકાસ, કે જેમની માનસિકતાનું તત્ત્વજ્ઞાનની ખોજ કરતું, અવિદ્યામાં રહેલું મન નહિ હોય, પણ જે પ્રકાશનું શોધક હોય પણ તેનો સ્વાભાવિક સ્વામી નહિ હોય, જે પ્રકાશ પ્રત્યે ખુલ્લું હોય પણ પ્રકાશનો નિવાસી નહિ હોય, જે પરિપૂર્ણ બનેલું કરણ નહિ હોય, જૈત્રચેતના નહિ હોય, અજ્ઞાનમાંથી મુક્ત નહિ બન્યું હોય, તેને બદલે તે મન એવું હોય કે જે પ્રકાશનું મન બન્યું હોય, સત્યમાં જીવી શક્વા સમર્થ હોય, સત્યથી સભાન હોય, પોતાના જીવનમાં આડકતરી રીતે નહિ પણ સીધી રીતે જ્ઞાનને પ્રગટ કરવા સમર્થ હોય. તેની માનસિકતા અજ્ઞાનનું નહિ પણ પ્રકાશનું કરણ હોય. ઉચ્ચતમ સ્થિતિમાં, તે અતિમનસુમાં પહોંચવા સમર્થ હોય. તે નવી જતિમાંથી અતિમાનસ પ્રાણીઓની જતિની ભરતી કરવામાં આવશે, જે લોકો પાર્થિવ પ્રકૃતિની ઉત્કાનિતમાં અગ્રણીઓ બનશે.

( અતિમનસનો આવિભાવ, પૃષ્ઠ ૬૭ )

શ્રી અરવિંદ આપણી પાસેથી આવી અપેક્ષા રાખતા હતા. તેમની અતિ-માનવની કલ્પના એવી હતી કે તે વર્તમાન માનવજતિ અને અતિમાનસ રીતે જૂઝાયેલો અતિમાનસ પ્રાણી વચ્ચે દુઃખાધિયો દૂન બને. તે અતિમાનસ પ્રાણીમાં પશુતા બિલ્કુલ નહિ હોય, તે સર્વ પણ જરૂરિયાતોથી મુક્ત હોય.

આપણે અત્યારે છીએ તેવા આપણું સર્જન સામાન્ય પણ રીતે થયેલું છે. તેથી આપણે લવે આપણું રૂપાંતર કરીએ, પણ આપણા પશુતુલ્ય ઉદ્ગમસ્થાનનો કંઈક અંશ તેમાં રહી જવાનો. શ્રી અરવિંદના જ્યાલ મુજબ, અતિમાનસ પ્રાણી સામાન્ય પણ રીતે નહિ જન્મ્યો હોય, પણ તેનું સર્જન સીધી રીતે, જે અત્યારે આપણને ગૃહ્ણાદી લાગે છે તેવી રીતે થયું હોય. તેમાં શક્તિઓ અને પદાર્થ-તત્ત્વ સાથે એવી રીતે કામ લેવામાં આવ્યું હોય કે જેમાં શરીર એક ભૌતિકી-કરણ હોય, તેનું નિર્માણ સામાન્ય પશુતત્ત્વ અનુસાર નહિ થયું હોય.

એ સ્પષ્ટ છે કે વયગાળાનાં સત્ત્વોની જરૂર છે. તે વયગાળાનાં સત્ત્વોએ અતિમનસનાં પ્રાણીઓનું સર્જન કરવાનાં સાધનો ખોજી લેવાનાં રહેશે. જ્યારે

શી અરવિંદે આ લખ્યું, ત્યારે તેમને ખાતરી થઈ ચૂકી હતી કે આપણે આ જ કરવાનું છે.

હવે મને ખાતરી થઈ ચૂકી છે કે શી અરવિંદ ને અપેક્ષા રાખે છે તે આપણે સિદ્ધ કરી શકીશું, તે હવે આશા રહી નથી, પણ ખાતરી બની ચૂકી છે. આપણા વ્યક્તિગત પ્રયાસ ઉપર, આપણી એકાગ્રતા ઉપર, આપણી સફળાવના ઉપર તે આધાર રાખે છે, અને તે અનુસાર તે સિદ્ધ વહેલી કે મોઢી પ્રાપ્ત થશે. આપણે તે સિદ્ધિને મહત્વ આપીએ તો તે જલ્દી સિદ્ધ થાય. બેધ્યાન રીતે જેનારને વસ્તુઓ પહેલાં હતી તેવી જ લાગે. પણ જેને જેતાં આવડે છે, જે દેખાવો વડે ઠગાતો નથી, તેને તો એમ જ લાગવાનું કે વસ્તુઓ બરાબર ચાલે છે.

જો દરેક જલ્દી શોષ્ઠ પ્રયત્ન કરે, તો થોડાં જ વિરોધી પ્રથમ દૃષ્ટિગોચર થાય તેવાં પરિણામે આવે.

જગતમાં બીજી કોઈ વસ્તુ કરતાં આમાં તમને વધારે રસ છે કે કેમ તે મારે જાણી વેવાનું છે. એવી એક કાણ આવે છે કે જ્યારે શરીરને પોતાને લાગે છે કે આ રૂપાંતર સિદ્ધ કરવા માટે જીવન કરતાં જગતની બીજી કોઈ વસ્તુ વધારે મહત્વની નથી; આ રૂપાંતરમાં ઉત્કટ રસ લેવા કરતાં વધારે રસ બીજા કથામાં નથી. શરીરનાં બધાં કોશાષ્ટાઓને પ્રગટ થવા માગતા પ્રકાશ માટે ખૂબ તરસ લાગતી હોય છે, તેઓ તેને માટે માગ પોકારી રહ્યાં હોય છે, તેમને તેમાં ખૂબ આનંદ પડતો હોય છે, વિજય માટે તેમને ખાતરી હોય છે.

હું આ અભીષ્ટા તમારામાં લાવવા માગું છું. તે સિવાયનું જીવનમાં બધું જ નીરસ છે, શુષ્ક છે, પ્રકાશમાં રૂપાંતરની સરખામણીમાં ગુચ્છ છે.

## ૨ એપ્રૈલ ૧૯૪૭

“અતિમનસનું તાત્ત્વક લક્ષ્ય છે ગ્રહ ચેતના પોતાના સ્વભાવના સાહજિક અધિકાર વડે, પોતાના પ્રકાશ વડે જાણતી હોય છે. તેને શાન ગ્રામ કરવાનું હોનું નથી, તે શાનની સ્વામિની છે. ખાસ કરીને પોતાના ઉત્કાંતિના કાર્યમાં, તે શાનને

પોતાની દેખીતી ચેતનાની પીઠમાં રાખે છે, અને આવરણની પાછળથી જ્ઞાનને લાવતી હોય તેમ દેખાય છે. પણ ત્યારે પણ તે આવરણ આજાસ માત્ર હોય છે, તે સાચી રીતે અસ્તિત્વ ધરાવતું હોતું નથી, જ્ઞાન હંમેશાં ત્યાં હોય છે જે; ચેતના તેની સ્વામિની છે અને જ્ઞાનને પ્રગટ કરતી હોય છે. પરિપૂર્ણ બનેલા પ્રકાશના મનમાં, સત્યનું આ લક્ષણ પારદર્શક રૂપમાં પોતાની જતને પ્રગટ કરતું હોય છે, જ્યારે તે આવરણ નાંખતું હોય છે ત્યારે પણ, કરણકે તે પણ ઝ્રત ચેતના અને જ્ઞાનની આત્મશક્તિ હોય છે. તે પણ અતિમનસમાંથી આવે છે અને તે ગૌણ અને મર્યાદિત હોવા છતાં, તે અતિમનસ્ય પર આધાર રાખતું હોય છે. અમે જેને ખાસ પ્રકાશનું મન કર્યું છે, તે ખરેખર ચેતનાની નીચે ઉત્તરતી ભૂમિકાઓમાંની છેલ્લી ભૂમિકા છે, જેના પર અતિમનસ્ય જતે પસંદ કરાયેલી મર્યાદા વડે અથવા આત્મપ્રાગટ્ય કરતી પોતાનાં કાર્યોના પરિવર્તન વડે, પોતાની જતને આવૃત કરતું હોય છે; પણ તેનું તાત્ત્વિક લક્ષણ તેનું તે જ રહે છે, તેમાં પ્રકાશનું, સત્યનું, જ્ઞાનનું કર્યું હોય છે, જેમાં અચેતનતાને, અજ્ઞાનને, ભૂલને કોઈ સ્થાન હોતું નથી. તે જ્ઞાનમાંથી જ્ઞાન પ્રયોગ ગતિ કરતું હોય છે. હજુ સુધી આપણે ઝ્રત ચેતનાની હંમેશાંથી અજ્ઞાનમાં પ્રવેશ કર્યો હોતો નથી.

( અતિમનસ્યનો આવિર્ભાવ, પૃષ્ઠ ૭૦-૭૧ )

મધુર, માતાજી, આ ફરીરો હું સમજી શક્યો નથી. “પરિપૂર્ણ બનેલા પ્રકાશના મનમાં સત્યનું આ લક્ષણ પોતાની જતને પ્રગટ કરે છે, જ્યારે તે આવરણ કરતું લાગે છે ત્યારે તે આવરણ પારદર્શક હોય છે.

તેમાં તમને શું નથી સમજતું?

પારદર્શક આવરણ...

આ એક પ્રતીક છે.

૧. જ્યારે આ વાર્તાલાય પ્રથમ વાર છપાયો, ત્યારે માતાજીએ આ ‘કંઈક’ ની વ્યાખ્યા આ પ્રમાણે આપી હતી: “અપ્રગટ વસ્તુ, જે પ્રગટ થવા માટે અતિમાનસ જગતનો ઉપયોગ કરે.”

તે કાંઈક આ પ્રકારનું છે. અતિમાનસ દર્શનામાં, માણસ વસ્તુઓના જ્ઞાનને સીધી રીતે, સમગ્ર રીતે, તરત પ્રાપ્ત કરે છે. અર્થાતું માણસ એકી સમયે દરેક વસ્તુને સમગ્ર રીતે જોતો હોય છે. જ્યારે તે તેને સમજવવા કે વર્ણિન કરવા માગે છે, ત્યારે તેને પ્રકાશના મનની ભૂમિકા પર નીચે આવવાની ફરજ પાડે છે, જ્યાં વસ્તુઓને એક પછી બીજી એ રીતે, અમુક કુમમાં, એક બીજા સાથેના અમુક સંબંધોમાં કહેવી પડે છે, વિચારવી પડે છે, અથવા વ્યક્ત કરવી પડે છે. એકી સાથે હોવાપણું અહૃદય બની જાય છે, કારણકે વ્યક્ત કરવાની આપણી અત્યારની સ્થિતિમાં, બધી વસ્તુઓને એકદમ એકી સાથે કહેવી તે અશક્ય છે. એટલે આપણે જોતા અથવા જાણતા હોઈએ છીએ. તેના અમુક ભાગને આપણે આવૃત રાખવો પડે છે અને એક પછી બીજી વસ્તુનું કથન કરવું પડે છે. આને કી અરવિદ પારદર્શક આવરણ કરે છે, કારણકે માણસ દરેક વસ્તુ એકી જ વખતે જોતો જાણતો હોય છે, તેને વસ્તુનું પરિપૂર્ણ જ્ઞાન છે, પણ તે તેને પૂર્ણ રીતે એકી સમયે વ્યક્ત કરી શકતો નથી. આપણે જેવા છીએ તેવા રહીએ, ત્યાં સુધી તેમ કરવા માટે શર્ષ્ટો હોતા નથી, અભિવ્યક્તિની શક્યતા નથી. આપણી જતને વ્યક્ત કરવા માટે આપણે અનિવાર્ય રીતે નિકૃષ્ટ પ્રક્રિયાનો આશ્રય લેવો પડે છે. અને છતાં તેજ વખતે આપણી પાસે પૂર્ણ જ્ઞાન હોય છે. તે જ્ઞાનને શર્ષ્ટોમાં સંકાન્ત કરવાની જરૂરિયાત જ આપણને તે જ્ઞાનના અમુક ભાગને આવૃત કરવાની, અને તે જ્ઞાનને કુમશ: પ્રગટ કરવાની ફરજ પાડે છે. પણ તે આવરણ પારદર્શક હોય છે, કારણકે આપણે તે વસ્તુને પરિપૂર્ણ રીતે જાણતા હોઈએ છીએ, જોતાં હોઈએ છીએ, સમજતાં હોઈએ છીએ, પણ આપણે એકી વખતે તે સર્વને વ્યક્ત કરી શકતા હોતા નથી. આપણા કુમશ: તેને કહેવું પડે છે. તે વ્યક્ત કરવાના કાર્ય પરના આવરણને, આપણા કથનને તથા સમજને અનુરૂપ બનાવવાની જરૂર પડે છે. જ્ઞાન તો વાસ્તવિક રીતે ત્યાં હોય જ છે. માણસને તેની જોજ કરવાની હોતી નથી; પણ અભિવ્યક્તિની માંગ એવી હોય છે કે આપણે કુમશ: તેનું કથન કરવું પડે, અને પરિણામે સ્વાભાવિક રીતે જ તે કથનની સર્વશક્તિમતા ઘટી જાય છે, કારણ કે સર્વ શક્તિમતા એટલે વસ્તુની સમગ્ર દર્શના અને સમગ્ર અભિવ્યક્તિ. સર્વજ્ઞતા પણ સિદ્ધાંત હૃદિએ ત્યાં હોય છે, પણ સર્વજ્ઞતાની સમગ્ર શક્તિ કાર્ય કરી શકતી નથી. કારણકે પોતાની જતને વ્યક્ત કરવા માટે તેણે એક ભૂમિકા નીચે આવવું પડતું હોય છે.

કું કે કહું છું તે તમને સમજાય છે ?

અતિમાનસ જ્ઞાનમાં પરિપૂર્ણ રીતે જીવી શક્વા માટે, અત્યારે આપણી પાસે અભિવ્યક્તિનાં જે સાધનો છે તેમના કરતાં જિન્ન પ્રકારના સાધનોની જરૂર છે. અતિમાનસ જ્ઞાનને અતિમાનસ રીતે વ્યક્ત કરવા માટે, અભિવ્યક્તિનાં નવીન સાધનોનું નિર્માણ કરવું પડશે. આપણે આપણી માનસિક શક્તિને બને તેટલી ઊર્ધ્વમાં લઈ જવી પડશે, જેથી તેની અને અતિમનસની વર્ચયે નહિ જેવો જ સીમાડો રહે; છતાં થોડોક લેદ તો રહે છે જ, કારણકે હજુ સુધી અભિવ્યક્તિનાં સર્વ સાધનો આ માનસિક જગતનાં હોય છે, તેમનામાં અતિમાનસ શક્તિ આવી હોતી નથી. તેને માટે જરૂરી અંગો આપણી પાસે નથી. અતિમાનસ જ્ઞાનને અતિમાનસ રીતે વ્યક્ત કરવા માટે, આપણે અતિમનસનાં પ્રાપ્તી બનવું જોઈએ, અતિમાનસ પદાર્થતત્ત્વ હોવું જોઈએ, અતિમાનસ આંતર સંગઠન હોવું જોઈએ. હજુ સુધી તો આપણે અદ્યે જ આવ્યા છીએ; આપણી ચેતનામાં કયાંક, આપણે સમગ્રપણે અતિમાનસ દર્શનમાં અને જ્ઞાનમાં આરોહણ કરી શકીએ, પણ આપણે તેને અભિવ્યક્ત ન કરી શકીએ. આપણી જતને અભિવ્યક્ત કરવા માટે, ફરી આપણે એક લૂભિકા નીચે આવવું પડે છે.

એટલે આવૃત કરતું દેખાતું આ આવરણ ચેતના માટે અતિદર્શક છે, કારણકે ચેતનાં અતિમાનસ રીતે વસ્તુઓને જોતી જાણતી હોય છે; પણ એક ભાગ આવૃત હોય છે અને તે પ્રગતિશીલ રીતે પ્રગટ થતો હોય છે, કારણકે તેમ કરવાનો બીજો કોઈ માર્ગ નથી. પણ ચેતના માટે તે પારદર્શક હોય છે જે કે દેખીતી રીતે આવૃત હોય છે.

(મૌન)

ગઈ કાલે આપણે જે ફિલ્મ જોઈ હતી, તે વિષે મને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા છે. પહેલો પ્રેરણ તદ્દન ગ્રામ્ય છે! તે પ્રેરણ આ છે.

“તમે પ્રાર્થના અને ધ્યાનો’ નામના તમારા પુસ્તકમાં જેમનું કથન કર્યું છે તે બધું તે જ છે કે જેમની મૂર્તિઓની પૂજા થાય છે?”

બુદ્ધની તો હજારો મૂર્તિઓ છે. ભારતમાં ઓળખાતા બુદ્ધ, સિલોનમાં ઓળખાતા બુદ્ધ, મિલેટમાં ઓળખાતા બુદ્ધ, ચીનમાં, કબોડિયામાં, થાઈલેનમાં,

જાપાનમાં અને બીજા દેશોમાં ઓળખાતા બુદ્ધ. જો તમે ઔતિહાસિક હકીકત વિષે પૂછતા હો, તો બધા જ લોકો તમને કહેશે કે, અમે ભારતના ગૌતમ બુદ્ધની પ્રાર્થના કરીએ છીએ. પણ હકીકતમાં, બોદ્ધ ધર્મની દરેક શાખાને બુદ્ધ વિષે પોતાનો આગવો જ્યાબ હોય છે; તેમને એક હિવ્ય સત્ત્વ માનવા કરતાં, એક દેવ તરીકે તેમની મૂર્તિની પૂજા થતી હોય છે. જો તમે મને એક મૂર્તિ બતાવીને પૂછો કે, આ મૂર્તિમાં તમને તમે જેમને જાણો છો તે બુદ્ધની અસર અથવા હાજરી દેખાય છે? તો હું તમારા પ્રશ્નનો ઉત્તર ‘હા’ માટે ‘ના’ માં આપી શકું. પણ જ્યારે તમે કહો છો કે ‘જેમની મૂર્તિઓની પૂજા થાય છે,’ ત્યારે હું તમને જવાબ ન આપી શકું, કારણકે તેનો આધાર, પૂજાની મૂર્તિમાં તેઓ જે કાઈ લાવી શક્યા હોય તેના પર છે. ઔતિહાસિક દૃષ્ટિએ, તે જ નામનો વ્યવહાર થાય છે, પણ તે તે જ આધ્યાત્મિક મહાપુરુષ છે કે કેમ તે હું જાણતી નથી! એટલે હું તમારા સવાલનો જવાબ આપી શકતી નથી.

જો તમે મને આપણે ગઈ કાલે જોઈ તે મૂર્તિઓ વિષે પૂછતા હો, તો તમે જાણો છો કે આપણે ઘણી ઘણી મૂર્તિઓ જોઈ હતી; તેમાંથી ઘણી બિન્નબિન્ન હતી, દરેક બુદ્ધ બિન્નબિન્ન હતા. આપણને એક બુદ્ધ બતાવવામાં આવ્યા હતા, જે ખૂબ પ્રમાણભૂન હતા; પણ બીજી મૂર્તિઓ બુદ્ધના વ્યક્તિત્વનું ઓછામાં ઓછું પ્રતિનિધિત્વ કરતી હતી. તેનો આધાર નમારા અર્થ ઉપર છે. જો તમે ઔતિહાસિક દૃષ્ટિનું પૂછતા હો, તો લોકો હંમેશાં કહે છે કે, તે બુદ્ધ છે. પણ દરેક મૂર્તિ બિન્નબિન્ન હોય છે.

હવે આપણે બીજા પ્રશ્ન પર આવીએ, કે જે તદ્દન જુદા પ્રકારનો છે.

“ અતિમાનસ કરણના માર્ગમાં બુદ્ધના ઉપદેશો માનવ જાતિને કઈ રીતે મદદરૂપ અથવા હાનિકારક બની શકે? ”

પ્રગતિ કરવામાં માનવ જાતિને જે જે વસ્તુ મદદ કરે છે તે મદદરૂપ છે, અને તેને પ્રગતિમાં રુક્ષવટ હાલે છે તે વિરોધી રૂપ છે.

હકીકતમાં, તમે આ પ્રશ્ન પૂછો છો, કારણ કે આપણે ધર્મપદનું અધ્યયન કરીએ છીએ અને તેના પર ધ્યાન કરીએ છીએ. (કેટલાક મહીનાઓ સુધી, દર શુક્રવાર, માતાજી બાળકોના વર્ગમાં બુદ્ધ ધર્મના પવિત્ર, ‘ધર્મપદ’ નામના પુસ્તક-

માંથી થોડાક શ્વેકોનું વાચન કરતાં હતાં.) સ્વાભાવિક રીતે જ મેં તે પુસ્તક પસંદ કર્યું હતું, કારણે વિકાસના અમૃત તબક્કામાં તે બહુ ઉપયોગી બની શકે તેવું છે. તેમાં તે કેટલીક ફોર્મ્યુલાઓ બહુ સુંદર રીતે સંક્ષેપમાં કહેવામાં આવી છે. જે માણસ તે ફોર્મ્યુલાઓનો ઉપયોગ લાભદાયી રીતે કરી શકે, તો તે બહુ મદદરૂપ બની શકે તેમ છે. નહિ તો મેં તે પુસ્તક પસંદ ન કર્યું હોત. કેટલું ઉપયોગી બનશે તેનો આધાર તે વ્યક્તિ ઉપર છે. પોતાને તેમાંથી લાલ ઉઠાવતાં આવ્યે છે કે નહિ, તેના પર તેનો આધાર છે.

હવે છેલ્લો પ્રશ્ન :

“શ્રી અરવિંદે કહ્યું છે કે, બુદ્ધ એક અવતાર હતા.

આપણે ધર્મશાસ્ત્ર તેમ કહ્યું છે. પણ પછી એક વધારે રહસ્યમય વાત આવે છે.

“બુદ્ધના ઉપદેશોથી અલગ જગતમાં તેમનાં વ્યક્તિત્વનું શું રહ્યું છે !”  
(પ્રશ્ન પુછ્યાનાર શિષ્યને) તમે આવો બેદ કેમ પાડો છો ?

જ્યારે તે નિર્વાણમાં ચાલ્યા ગયા, ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે, હવે તેમના ઉપદેશો સમૃતિભંડારમાં રહેશે.

સમૃતિગુહમાં ! તેનો અર્થ તો એવો થયો કે, તે બે વસ્તુઓ સાથે સાથે રહેલી છે. તમે તેમને (તેમના ઉપદેશોને અને વ્યક્તિત્વને) જુદા કેમ પાડો છો, તે મને સમજાતું નથી. સ્વાભાવિક રીતે જ, તેમના ઉપદેશોમાં તેમના પ્રભાવનું કાંઈક રહેલું છે ! તેમના ઉપદેશો જ માનસિક ક્ષેત્રમાં તેમની અસરને સંકાન્ત કરે છે.

તેમના ઉપદેશોથી અલગ, તેમનું સીધેસીધું કાર્ય તો ખૂબ થોડા લોકોમાં મર્યાદિત છે, કે જે લોકો તેમના ખૂબ ઉત્કટ અનુયાયીઓ છે અને જે લોકોમાં તેમના પ્રભાવને પોતામાં જગૃત કરવાની શક્તિ છે. બાકી તેમના કાર્યનો સૌથી મહત્વનો ભાગ, લગભગ તેમનું સમગ્ર કાર્ય તેમના ઉપદેશો સાથે જ સંલગ્ન છે. તે બેની વચ્ચે બેદ પાડવો એ કઠિન છે.

(મૌન પછી) ભિન્ન ભિન્ન વ્યક્તિઓમાં અવતરિત થયેલી દિવ્ય શક્તિનાં રૂપો, દૈશ્વિક વિકાસથી અમૃત ખાસ કાણે, અમૃત હેતુ તથા કાર્ય માટે જ અવતાર

ધારણ કરતાં હોય છે, પણ તત્ત્વિક રીતે તે બધી એક જ સત્ત્બી, ભગવાનની લિલન લિલન બાજુઓ હોય છે; એટલે તેમના કર્પણા અમુક ખાસ હેતુમાં જ તેમનો તફાવત રહેલો છે. બાકી તો, તે જ સત્ય, તે જ શક્તિ, તે જ સનાતન જીવન આ રૂપોમાં પ્રગટ થતાં હોય છે, અને અમુક નિયત ક્ષણે, અમુક કારણ અને હેતુ માટે, આ રૂપોનું સર્જન કરતાં હોય છે એ વાત ઈતિહાસમાં સચ્ચવાઈ રહે છે, પણ સનાતન રીતે તે નવીન રૂપો હોય છે, જેમનો ઉપયોગ નવીન પ્રગતિ માટે થતો હોય છે. જેમ આકંપન ટકી રહે છે તેમ, જૂના રૂપો ટકી રહી શકે છે; પણ ઔતિહાસિક દૃષ્ટિથી જોતાં, તેમનો હેતુ તે સમય પૂરતો જ હતો; અને એક નવીન ડગલું આગળ ભરી શકાય તે માટે, એક રૂપની જગ્યાએ બીજું રૂપ આવે છે. માનવજાતિએ ભૂલ કરતી હોય છે કે, લોકો તેની પીઠમાં રહેલી વસ્તુ પર ટીંગતા હોય છે, અને ભૂતકાળની વસ્તુને અનિબિત્ત મુદ્દત સુધી ચાલુ રાખવા માગતા હોય છે. જ્યાં સુધી આ વસ્તુઓ ઉપયોગી હોય, ત્યાં સુધી જ તેમનો ઉપયોગ કરવો જોઈએ. કારણું દરેક વ્યક્તિગત વિકાસનો ઈતિહાસ હોય છે. તમે એની અવસ્થાઓમાંથી પસાર થઈ શકો, કે જેમાં આ નિયમોના અભ્યાસના થોડાક સમય માટે ઉપયોગિતા હોય; પણ તે સમય પસાર કરી દીધા પછી તમારે બીજા કોઈ અભ્યાસમાં પ્રવેશ કરવો જોઈએ, અને જોઈ દેવું જોઈએ કે, ઔતિહાસિક દૃષ્ટિએ જોતાં, તે અભ્યાસ ઉપયોગી હતો, પણ હવે તે ઉપયોગી રહ્યો નથી. જે લોકો વિકાસની અમુક ભૂમિકાએ પહોંચ્યા છે અને અમુક માનસિક સંયમ જેમને પ્રાપ્ત કર્યો છે, તેમને હું જરૂર એમ તો નહિ જ કહું કે, ધર્મપદ વાંચો અને તેના પર ધ્યાન કરો; તે તો વખતનો બગાડ થાય. જે લોકો ધર્મપદની જરૂરિયાની પર સ્થિતિમાં ગયા નથી, તેમને જ હું તે પુસ્તક વાંચવા માટે, ધ્યાન કરવા માટે આપું છું. પણ માલસ હમેશાં પોતાના ખલા ઉપર જેનો અંત જ ન આવે તેવો બોઝો ઉપાડતો હોય છે. તેને ભૂતકાળની કોઈ વસ્તુ છોડી દેવાનું ગમનું હોતું નથી. તે નિરૂપયોગી બોજના ભાર નીચે વધારે ને વધારે નીચો નમી જતો હોય છે.

તમારા માર્ગના અમુક ભાગ સુધી તમારે બોમિયાની જરૂર પડે છે. પણ જ્યારે તમે તે ભાગને વટાવી જાઓ છો, ત્યારે તમે તે માર્ગના ભાગને અને બોમિયાને, બનેને પાછળ મુક્કીને આગળ ચાલ્યા જાઓ છો! માલસેને એ વાત કરવી કઠિન લાગતી હોય છે, જ્યારે તેઓ તેમને મદદરૂપ કાંઈક વસ્તુને પકડે છે ત્યારે તેઓ તેને શીટકી રહે છે, પછી તેઓ આગળ વધવાની ઈરદી કરતા નથી. ખુસ્તી

ધર્મની મદદથી પ્રગતિ કરેલા બોકો તેને છોડી દેવા માગતા હોતા નથી અને તેને ખલા પર લઈને ફરતા હોય છે. જે બોકોએ બૌદ્ધ ધર્મની મદદથી પ્રગતિ કરી છે, તેઓ તેને છોડવા માગતા નથી; તેઓ પોતાના ખલા પર તે બોજાનું વહન કરતા હોય છે. આ તમારી પ્રગતિમાં અવરોધ ઉભે કરે છે, અને તમારે અચોક્કસ મુદ્દા સુધી વિલંબમાં રહેણું પડે છે.

એક વાર અમૃત સિથિતિમાંથી પસાર થઈ ગયા પછી, તમારે તેને છોડી દેવી જોઈએ. તમે આગળ જાઓ.

માતાજી, બૌદ્ધ ધર્મને પુનર્જીવિત કરવા માટેની, અત્યારની ધાર્મિક રાજકરણીય ચલાયા .....\*

શું? હું રાજકારણમાં ભાગ લેતી નથી. તે તદ્દન નિર્ધિક છે. બોકો રાજકારણી હેતુઓ માટે વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે, પણ તે જરા પણ રસપ્રદ નથી.

\*

## ૬ એપ્રેલ ૧૯૫૭

શ્રીમાતાજી 'અતિમનસ'નો આવિર્ભાવનાં છેલ્લા ચુંદ વાંચે છે.

"જે ભૌતિક જગત આપણને અજ્ઞાનનું જગત લાગે છે, અયેતનતામાંથી શરૂ થતી, કોઈ અંધ શક્તિનાં કાર્યોનું જગત લાગે છે, અને અજ્ઞાનમાંથી પસાર થઈને અપૂર્ણ પ્રકાશ અને જ્ઞાન પ્રત્યે મુશ્કેલીથી પહોંચતું લાગે છે, તેમાં પણ વસ્તુઓમાં એક નિગૂઢ સત્ય રહેણું હોય છે, જે બધી વસ્તુઓની જોઠવણી કરે છે, અસ્તિત્વની અનેક વિરોધી શક્તિઓને આત્મા પ્રત્યે દોરી જાય છે, અને

---

૧. ગૌતમ ચુંદ વિષે એક અંગેજ વિળમ ૨. 'માર્યાનાચો અને ધ્યાનો' ૨૦-૨૧  
ડિસેમ્બર, ૧૯૫૬.

પોતાની એવી ઊંચાઈઓ પર ઉદ્વિગ્નિ કરે છે, જ્યાં તે પોતાના ઉચ્ચતમ સત્યને પ્રગટ કરી શકે અને વિશ્વનો નિગૂઢ હેતુ સિદ્ધ કરી શકે. અસ્તિત્વના ભૌતિક જગતનું પણ નિર્માણ વસ્તુઓમાં રહેલા સત્યના નમૂના પર જેને આપણે પ્રકૃતિનો નિયમ કહીએ છીએ તેના પર, થતું હોય છે. આપણે એક સત્યમાંથી બીજા મહત્ત્ર સત્યમાં આરોહણ કરીએ છીએ, અને આખરે આપણે પરમાત્માના પ્રકાશને પ્રાપ્ત કરીએ છીએ. સાચી રીતે જોતાં, પ્રકૃતિની કોઈ અંધ શક્તિએ આ જગતનું સર્જન નથી કર્યું; અચેતનતામાં પણ પરમ સત્યની હાજરી કાર્ય કરી રહેલી હોય છે; તેની પીઠમાં એક દર્શન કરતી શક્તિ છે, જે ભૂબ વગર કાર્ય કરતી હોય છે, હોકર ખાતાં, દેખાતાં, અશાનનાં ડગલાં પણ તે જ દોરતી હોય છે. કારણે આપણે જેને અશાન કહીએ છીએ તે આવૃત જ્ઞાન છે, જે પોતાનું નહિ એવા શરીરમાં કાર્ય કરી રહેલું છે, પણ જે પોતાના પરમ આત્માની શોધમાં ગતિ કરી રહેલું છે. આ જ્ઞાન એ નિગૂઢ અતિમનસ છે, જે સૂધિનો આધાર છે, સર્વને પોતાની પ્રત્યે દોરી રહેલું છે, અને પોતપોતાની પ્રકૃતિના નિયમને અનુસરતાં, સર્વ મનોને, પ્રાણીએને પદાર્થેનિ પોતાની પ્રત્યે દોરી રહ્યું છે. અસ્તિત્વના આ વિશ્વાણ અને દેખીતી રીતે ગુંચવાડા ભરેલા સમૂહમાં એક નિયમ છે, અસ્તિત્વનું એક સત્ય છે, જગતના અસ્તિત્વના હેતુને સિદ્ધ કરતી એક દોરવણી છે. અતિમનસ અહીં આવૃત છે, પોતાના લાક્ષણિક નિયમ અનુસાર તે કાર્ય કરી રહ્યું હોનું નથી, પણ તેના સિવાય કોઈ પણ વસ્તુ પોતાના લક્ષ્યને પહોંચી શકે નહિ. અશાની મન વડે નિયમિત થતું જગત થોડા જ સમયમાં અંધાણુંધામાં જઈને પડે. હકીકતમાં, તે પોતે જેનું આવરણ છે તે નિગૂઢ સર્વજ્ઞતા જે તેને ટકાવી ન રહે, તો તેનું અસ્તિત્વ જ ન રહે. અંધ અચેતન શક્તિ વડે નિયમિત થયેલું જગત તેનાં તે જ યાંત્રિક કાર્યોની મુનરાવૃત્તિ કર્યા કરે પણ તેનો કશો અર્થ નથી, તે કયાંય પહોંચી ન શકે. આ એવી ઉત્કાનિતનું કારણ ન બની શકે, કે જે પદાર્થતત્ત્વમાંથી પ્રાણનું સર્જન કરે છે, પ્રાણમાંથી મનનું સર્જન કરે છે, અને પદાર્થતત્ત્વ, પણ, મનની લૂભિકાએનો કુમ છેવટે અતિમનસના ઉદ્યમાં પરિણિમે છે. અતિમનસમાં પ્રગટ થતું નિગૂઢ સત્ય બધો સમય ત્યાં હતું જ, પણ હવે તે પોતાની જાતને પ્રગટ કરે છે, વસ્તુઓમાં રહેલા સત્યને પ્રગટ કરે છે, આપણા અસ્તિત્વના અર્થને પ્રગટ કરે છે.”

હકીકતતમાં આ વાચન પૂરું થયું. ન હતું તે ત્યાં જ અટકી ગયું. બીજા સાધકો આવવાના બાકી હતા. ....

( મૌન )

ત્યારે આજે આપણે પ્રશ્નો વગર જ પૂર્ણાંદુત્ત કરવાની છે ?

માતાજી, આમાંના છેલ્લા ભાગ વિષે એક પ્રશ્ન છે. જે અતિમનસ વસ્તુઓની પીડમાં નિગૂઢ હોય, તો પછી તેને શોધવું તે આટલું બધું કહિન કેમ લાગે છે ?

કારણકે તે નિગૂઢ છે ! ( હસાહસ )

અજ્ઞાનમાં પણ તે કાર્ય કરી રહેલું છે, તે સત્ય પ્રત્યે દોરી જાય છે. ....

શ્રીઅરવિંદ સમજવે છે કે જે વસ્તુઓની પીડમાં અતિમાનસ સત્ય રહેલું ન હોત, તો જગત અત્યારે જેટલું સંગઠિત છે નેટલું પણ સંગઠિત ન બન્યું હોત. આપણને એમ લાગે છે કે ખૂબ પ્રકાશમય સંકલ્પ સાથે એક ચેતના છે કે જેણે ખૂબ નિશ્ચિત યોજનાપૂર્વક સર્વ વસ્તુઓનું સંગઠન કર્યું છે, જે અજ્ઞાનનું અથવા અચેતનતાનું પરિણામ ન હોઈ શકે. હકીકતમાં, વસ્તુઓની પીડમાં રહેલા અતિમનસને અથવા જીતચેતનાને જોવાની તમારી મુશ્કેલી તમારા અંગત અજ્ઞાનની અને અચેતનતાની ચોકચસ માત્રા બનાવી આપે છે, કારણકે જે લોકો આ અજ્ઞાનમાંથી અને અચેતન તરફમાંથી બહાર આવેલા છે, તેઓ તો બહુ સ્પષ્ટ રીતે અતિમનસને જોતા હોય છે. મુશ્કેલી માણુસની અચેતનતાની સ્થિતિ ઉપર આધાર રાખે છે. પણ જે માણુસ અચેતનતાની આ સ્થિતિથી પર ચાલ્યો ગયેલો હોય છે, તેને અતિમનસ શોધી કાઢવામાં કશી જ મુશ્કેલી નડતી હોતી નથી, તે તો મૂળ દૃષ્ટિગોચર હોય છે.

( મૌન )

જે માણુસ થોડી ધારી આધ્યાત્મિક અને શૈતસિક ચેતનામાં પ્રવેશ કરે, તો તે સહેલાઈથી વસ્તુઓની કાંઈક વિષયગત અવાસ્તવિકતાથી સભાન બને; અને સામાન્ય ચેતનાને જે વસ્તુ વાસ્તવિક, દૃષ્ટિગોચર, મુધન, અને માપી શકાય તેવી લાગતી

હોય, તે એટલી બધી પ્રવાહી, અપદાર્થમય બની જાય કે જે ચેતના તેને જોતી હોય તેને માટે જ તે વાસ્તવિકતા બની રહે, તદ્દન પરિવર્તનશીલ વાસ્તવિકતા બની રહે અને કેટલીક વાર તો ચેતનાના દર્શનને અનુસાર તદ્દન વિરોધી બની જાય, જે આપણે જગત વિષે જે લિન્ન લિન્ન સમજૂતિઓ આપવામાં આવી છે તેમનો જે લિન્ન લિન્ન રીતે જગત અભિવ્યક્ત થયું છે તેમનો વિચાર કરીએ, તો આપણું ખ્યાલોની એવી એક પરંપરા પ્રાપ્ત થશે, જે કેટલીકવાર તદ્દન વિરોધી હોય છે, અને છતાં જે લિન્ન લિન્ન ચેતનાઓ વડે થતું એક જ વસ્તુનું દર્શન હોય છે. હકીકતમાં આ છેલ્લા ફૂરામાં એવા એક આખરી મુદ્રો રજૂ કરવામાં આવ્યો છે કે જે કાઈ છે તે ભગવાનના અંગત સંકલ્પની પરિપૂર્ણ અને સમગ્ર અભિવ્યક્તિ છે, વિચારકેની અમૃક શાખા, અનુભૂતિના પાયા પર, કહે છે કે દરેક વસ્તુ ભગવાનના સંકલ્પની પરિપૂર્ણ રીતે કરાયેલી અભિવ્યક્તિ છે તેથી પિલુલ, કેટલાક લોકો કહે છે કે જગત એ તર્કવિષેષી એક પ્રકારની અંધાધુંધી છે; તે કેવી રીતે અને શા માટે અસ્તિત્વમાં આવ્યું છે તે કહી શકાય તેમ નથી, તે કયાં જઈ રહ્યું છે તે પણ કહી શકાય તેમ નથી; તેમાં કોઈ તર્ક? કારણું કે સંગઠન નથી; તે કેવળ અંધાધુંધી છે; તે આ પ્રમાણે બનતું ચાલે છે; પણ તેના કારણો જાણી શકતાં નથી. જો તેમે આ બે છેડાનાં દૃષ્ટિબિંદુઓને બેા અને જગત વિષે જે કાઈ કહેવામાં આવ્યું છે, વખાયું છે, વિચારાયું છે તેના પર વિચાર કરો, અને તે બધાં દૃષ્ટિબિંદુઓનું એકત્રિત દર્શન કરો તો એમ જાણશે કે જગત એક જ છે અને તેને વિષે આટલી બધી લિન્ન લિન્ન સમજૂતિઓ આપવામાં આવી છે, એટલે આ જગત માત્ર દ્રષ્ટાની ચેતનામાં જ અસ્તિત્વ ધરાવે છે. સાચે જ, તેમાં કાઈક તો હોવું જ જોઈએ, પણ તે 'કાઈક' માણસો તેને વિષે વિચારે છે તેના કરતાં તદ્દન પર, લિન્ન હોવું જોઈએ, પરિણામે જગત એક ભાનિતમય અવાસ્તવિકતા છે એવી લાગણી પેદા થાય છે.

હકીકતમાં, જગતની વાસ્તવિકતા દરેક જાણું ચેતના માટે સંપૂર્ણપણે વિષયીગત છે. જગતમાં વિષયીગત વાસ્તવિકતા નથી, કારણું એક દૃષ્ટિબિંદુથી એમ કહી શકાય કે જગત પરમાત્માના એક સચેતન સંકલ્પનું પરિણામ છે, જે સંકલ્પ સર્વનું શાસન કરે છે; જ્યારે બીજા દૃષ્ટિબિંદુથી એમ કહી શકાય કે જગતના અસ્તિત્વ માટે કોઈ કારણ નથી. સિવાય કે ભાનિતમય અક્ષમાત, અને છતાં આ બે ખ્યાલો એક જ વસ્તુને લાગુ પડે છે.

તેમે અને માટે કહી પણ વિચાર કર્યો નથી?

દરેક જાણને પોતાનો વિચાર હોય છે, ઓછા વતો સ્પષ્ટ હોય છે, ઓછા વતો સંગઠિત હોય છે, ઓછા વતો નિશ્ચિત હોય છે : તે વિચારને તે માણસ જગત કહેતો હોય છે. દરેક જાણ પોતાની રીતે જોતો હોય છે, પોતાની રીતે અનુભવ કરતો હોય છે, બીજી દરેક વસ્તુ સાથે પોતાનો ખાસ સંબંધ રાખતો હોય છે ; અને આ ને તે જગત કહેતો હોય છે. સ્વાભાવિક રીતે જ, તે પોતાની જતને કેન્દ્રમાં મુક્તો હોય છે, અને પછી પોતાની આસપાસ બધી વસ્તુઓને સંગઠિત કરતો હોય છે, તે જે રીતે તેમને જોતો હોય, અનુભવતો હોય છે સમજતો હોય છે, ઈચ્છાતો હોય છે તે અનુસાર પોતાના પ્રતિકાર્ય અનુસાર. 'પણ દરેક ચેતના માટે તે લિન્ન લિન્ન હોય છે. તેનો અર્થ એ થયો કે આપણે જેને જગત કહીએ છીએ તે વાસ્તવિક વસ્તુ આપણા દર્શનમાંથી સંપૂર્ણપણે 'છટકી' જાય છે, તે કાંઈક 'બીજું હોવું' જોઈએ, તે શું છે તે સમજવા માટે આપણે આપણી વ્યક્તિત્વ ચેતનામાંથી બહાર આવવું જોઈએ એને જ શ્રી અરવિંદ "નિભન્તર ગોળાર્ધમાંથી ઉચ્ચયતર ગોળાર્ધમાં જવું" કહે છે. નિભન્તર ગોળાર્ધમાં જેટલી વ્યક્તિત્વો હોય છે, તેટલાં વિશ્વો હોય છે. ઉચ્ચયતર ગોળાર્ધમાં એવું 'કાંઈક' છે, જે છે તે છે, જેમાં બધી ચેતનાઓએ મળવું જોઈએ. આને શ્રી અરવિંદ ત્રણ ચેતના કહે છે.

નેમ નેમ માનવ ચેતના પ્રગતિ કરે છે, તેમ તેમ તેને આ પરસ્પર સંબંધિતતાનો વધારે ને વધારે જ્યાંબ આવતો જાય છે, અને સાથે સાથે એવી અસ્પષ્ટ માગણી પ્રગટતી હોય છે કે, એક સંત્ય છે જેનું દર્શન સામાન્ય સાધનો વડે થઈ શકતું નથી, પણ જે એક યા બીજી રીતે દાખિયોયર બને તેવું હોવું જોઈએ.

આજે બસ. હવે આપણે 'દિવ્ય જીવન' માંથી વાચન કરીશું. મને આશા છે : કે તેમાં આપણુને આ સમર્થ્યાની ચાવી જડશે.

## ૧૬ એપ્રીલ ૧૯૫૭

મારી પાસે ચાર પ્રશ્નો આવ્યા છે. સ્વાભાવિક રીતે જ, મેં જે, હમણાં વાચન કર્યું તેને વિશે તે નથી. તે ત્રણ જુદા જુદા વિશ્વો પરત્વે છે. દરેક

પ્રશ્નનો બહુ લાંબો જવાબ આપવો પડે તેવા તે છે. પણ પહેલા બે સવાલો એક બીજા સાથે સંબંધ છે, એટલે તેમને હું ભેગા લઈશ, તે આત્માની અવકાંતિ વિષે છે.

### પહેલો પ્રશ્ન :

જે પ્રગટ થનાર બધી વસ્તુ પદાર્થતત્ત્વમાં અવકાંત છે જી, તો પછી અતિ-મનસથી અન્ય તત્ત્વો તેમાં નિગૂઢ છે ખરાં કે જે, અતિમનસનો પૂર્ણ આવિ-ર્ભાવ થતાં પ્રગટ થશે ?”

તાર્કિંક રીતે કહીએ તો, હા. કારસુકે તાત્ત્વક રીતે પદાર્થતત્ત્વ અને પરમ તત્ત્વ એક જ છે, પણ... અહીં બીજા પ્રશ્નનો આવીને ઉલ્લેખ રહે છે.

“ અવકાંતિ સમયમાં ( કાળમાં ) થઈ હતી ? જેમ ઉત્કાંતિનો ઈતિહાસ છે તેમ તેનો ઈતિહાસ છે ખરો ? ”

એમ કહી શકાય કે આનો જવાબ પૂછનારના માનસિક વિવિધ પર આધાર રાખે છે. વિદ્વાનો તમને કહેશે કે ભિન્ન ભિન્ન શાખાઓએ આ વસ્તુઓ વિષે ભિન્ન ભિન્ન કથનો કર્યાં છે. તત્ત્વચિંતકો ઈતિહાસનો ઈન્કાર કરે છે, તત્ત્વ-ચિંતકો, વિચારકો કહે છે કે, ઈતિહાસ તો માત્ર બાળકો માટે છે. માનસશાખીઓ દરેક વસ્તુનો ચેતનાની ગતિઓમાં અનુયાદ કરે છે. છેવટે, કેટલાક બોકેને પ્રતીકો બહુ ગમતાં હોય છે, કેમને મન વૈશ્વિક ઈતિહાસ એક મહાન, સિનેમેટોગ્રાફ જેવો વિકાસ છે. તેઓ આ ચિત્રમય વિકાસને ખૂબ જીવંત અને સ્પર્શગમ્ય માને છે, કારસુકે પ્રતીકો વસ્તુઓને વધારે સધન અને વાસ્તવિક રીતે સમજવી શકતાં હોય છે.

એ વાત સ્પષ્ટ છે કે, આ ગ્રસેય સમજૂતિઓ સમાન રીતે સત્ત્ય છે; અગત્યની વાત એ છે કે માસુસે પોતાના વિચારમાં તેમનો સમન્વય કરવો જોઈએ, તેમનામાં સંવાદિતા સ્થાપવી જોઈએ. આપણે તત્ત્વચિંતનની શુષ્કતાઓને બાળુ પર રાખીશું, કારસુકે વિદ્વાનોનાં પુસ્તકોમાં તેમને વિષે વાચવું એ વધારે સારું છે. એ તો વસ્તુઓનું કથન ખૂબ નિશ્ચિત, ચોક્કસ અને શુષ્ક રીતે કરતા હોય છે। માનસશાખીય દૃષ્ટિબિંદુનું કથન કરવું તેના કરતાં તેને જીવનમાં ઉતારવું એ

વધારે સારું છે. એટલે આપણે માટે બાળકો માટેની કથાઓ જ બાકી રહે છે. હંમેશાં બાળક બની રહેણું તે સરસ છે. જે આપણે તે કથાને અપરિવર્તનીય સિદ્ધાંત ન માની વેવા જેટલી દરકાર રાખીએ, તો આપણે આ કથાઓના સાધન દ્વારા, બાળક સમાન ચેતના માટે, કોઈક વસ્તુને જીવંત બનાવી શકીએ, જે 'કાઈક' કથાઓ સિવાય આપણાથી ખૂબ ખૂબ દૂર રહે.

આપણે કહેવાયેલી કથાઓમાંથી વત્તીઓછી સત્ય, વત્તીઓછી પરિપૂર્ણ, વત્તીઓછી અભિવ્યંજક કથાઓને પસંદ કરીશું. પણ પોતાની જતને કથામાં ધુસાડી દીધા સિવાય અથવા તેનાથી બહાર રહ્યા સિવાય અમૃત દુંઘિબિંદુથી જેતાં, આ બે કિયાઓ એક જ છે, આપણે તે કથામાં, છેવટે આંશિક રીતે અને વિશાળ રેખા-ઓમાં, ફરી જીવિશું; તો તે આપણું સમજવામાં અને તેથી વસ્તુઓ કેવી રીતે અને શા માટે બની તેના સ્વામી બનવામાં મદદરૂપ થશે. કેટલાક લોકોએ તેમ કર્યું હતું. તેમને દીક્ષિતો, ગૂઢલાદીઓ, અને પદગંબરો એકી સાથે કહેવામાં આવે છે. ધણી સુંદર કથાઓ કહેવામાં આવી છે.

હું તમને ખૂબ સંસ્કૃતમાં કહીશ. તમે તેને ધર્મ સિદ્ધાંત ન માની વેતા, માત્ર કથા જ માનજો.

જ્યારે પરમાત્માએ, પોતાની જતનું દર્શન કરવા માટે, પોતાની જતનું બાધ્યોકરણ કરવાનો નિર્ણય કર્યો, ત્યારે પ્રથમ તેમણે પોતાની જતમાં જે વસ્તુને બાધ્યોકરણ કર્યું તે જગતનું જ્ઞાન અને તેનું સર્જન કરવાની શક્તિ હતાં. આ જ્ઞાન ચેતનાએ અને શક્તિએ પોતાનું કાર્ય શરૂ કર્યું. પરમાત્માના સંકલ્પમાં એક યોજના હતી, આ યોજનાનું પ્રથમ તરફ હતું તાત્ત્વક આનંદની અને તાત્ત્વક સ્વતંત્રતાની બંનેની અભિવ્યક્તિ, જે આ સુભિત્નું ખૂબ રસપ્રદ લક્ષણ હતું.

એટલે રૂપોમાં આનંદને તથા સ્વતંત્રતાને વ્યક્ત કરવા માટે વચ્ચોનામાં કાર્ય કરનાર તરવોની જરૂર હતી. પ્રથમ વૈશ્વિક વિકાસનો પ્રારંભ કરવા માટે ચાર સત્ત્વોનો વિસર્ગ કરવામાં આવ્યો. પરમાત્મામાં શક્યતા રૂપે જે કાઈ હતું તે સર્વનું પ્રગતિશીલ વિષયોકરણ કરવા માટે તે વૈશ્વિક વિકાસ તો પ્રારંભ હતો. તે સત્ત્વો તેમનાં અસ્તિત્વના તરવમાં હતાં. ચેતના અને પ્રકાશ, જીવન (પ્રાણ), આનંદ અને પ્રેમ, અને સત્ય.

તમે કહ્યો શક્ષો કે તે ચારેય સત્ત્વોમાં ખૂબ શક્તિ, ખૂબ બળ, કંઈક વિશ્વાળ તત્ત્વ હતાં, કારણ કે તે આ વસ્તુઓનાં તત્ત્વ હતાં. વધારામાં, તેમને પસંદગી કરવાની પૂરી સ્વતંત્રતા હતી, કારણ કે આ સૃષ્ટિ ખૂબ સ્વતંત્રતા બનવાની હતી. તે સત્ત્વો તદ્દન સ્વતંત્ર હતાં, કાર્ય તેવી રીતે કરવાનું છે તેનો તેમને જ્યાલ હતો, એટલે તેમણે કાર્ય કરવાની શરૂઆત કરી. તેમણે સ્વતંત્ર રીતે તે કાર્ય કરવાનું પસંદ કર્યું. મેં જે હમણાં તમારી સમકા વાંચ્યું, તેમાં શ્રી અરવિંદના કથન મુજબ, કરણનું વલસ અખત્યાર કરવાને બદલે, સ્વાભાવિક રીતે જ તેમણે સ્વામીનું વલસ અખત્યાર કર્યું. આ ભૂલ વિશ્વમાં સર્વ ગેરવ્યવસ્થાનું મૂળ કારણ બન્યું. પરમાત્મા અને પ્રગટ કરાયેલી વસ્તુ એ જેમા બેદ થતાં-વેંત જ, ચેતના અચેતનતામાં પરિવર્તિત થઈ ગઈ, પ્રકાશ અંધકાર બની ગયો, પ્રેમ દ્વેપમાં પલ્ટાઈ ગયો, આનંદ દુઃખમાં પરિવર્તિત બન્યો, જીવન મૃત્યુમાં પલ્ટાઈ ગયું, અને સત્ય અસત્યમાં પલ્ટાઈ ગયું. સ્વતંત્ર રીતે, એક બીજાથી લિન્ન રહ્યીને, ગેરવ્યવસ્થામાં તેમણે તેમની સૃષ્ટિઓનું કામ ચાલુ રાખ્યું.

પરિણામ રૂપે આપણે જોઈએ છીએ તેવું જગત બન્યું. તે કહે કરો, પ્રગતિશીલ રીતે બન્યું. તેનું વાર્ષિક કરતાં બહુ સમય લાગે. પણ તેનું આખરી સર્જન બન્યું જડ, અચેતન, દુઃખી પદાર્થતત્ત્વ. વિશ્વના સર્જન માટે જે ચાર સત્ત્વોને સર્જનાત્મક શક્તિએ પ્રગટ કર્યાં હતાં, તેમણે શું બની રહ્યું હન્યું તે જોયું; પરમાત્મા પ્રત્યે અભિમુખ બનીને તે સર્જનાત્મક શક્તિએ (પ્રકૃતિએ) તે દુરિતને (અનિષ્ટને) સુધારણા માટેના ઉપાયની પ્રાર્થના કરી.

પછી તે પ્રકૃતિને આશા થઈ, “અચેતનતામાં તારી ચેતના ઉતાર, આ દુઃખમાં તારો પ્રેમ ઉતાર, અને આ અસત્યમાં તારું સત્ય ઉતાર. પ્રથમ પ્રગટયા હતાં તેના કરતાં મહત્તર ચેતનાએ વધારે પરિપૂર્ણ પ્રેમે, વધારે પરિપૂર્ણ સત્યે પદાર્થતત્ત્વની ભીખણુંતામાં જ પલાયું”, જેથી તેનામાં ચેતના, પ્રેમ અને સત્ય જાગૃત થાય અને ઉદ્ઘારણા કાર્યનો પ્રારંભ થઈ શકે, કે જે ઉદ્ઘાર ભૌતિક વિશ્વને તેના પરમ ઉદ્ગમસ્થાનમાં લઈ આવવાનો હતો.

૧. શ્રી અરવિંદ આપણું કહે છે કે ઉત્કાંતિ એ અવકાંતિનું પરિણામ છે. આ રીતે, પ્રાણું જૌતિક તત્ત્વમાં અવકાંત છે, મન પ્રાણુમાં અવકાંત છે, અને અતિમનસ્કુ મનમાં અવકાંત છે. શક્ત્યમાંથી કશું જ પ્રગટ થઈ શકે નહિ. પરમતત્ત્વ પદાર્થતત્ત્વમાં અવકાંત છે, તેથી તે પદાર્થતત્ત્વમાંથી પ્રગટ થઈ શકે છે.

એટલે પદાર્થતત્ત્વમાં પરંપરાગત અવકાનિતઓ થઈ છે, અને તે અવકાનિતઓનો હિતિહાસ છે, આ અવકાનિતઓનું પરિણામ છે. અયેતનતામાંથી પ્રગટ થતું અતિમનસનું દર્શન પણ એવું કોઈ સૂચન પ્રાપ્ત થતું નથી કે આ અતિમનસના દર્શન પછી બીજો દર્શનો પ્રાપ્ત નહિ થાય. કારણું પરમાત્મા અખૂટ છે, તે હંમેશાં નવીન સૃષ્ટિઓ સર્જશે.

આ મારી કથા છે.

\*

## ૨૩ એકદોષર ૧૯૫૭

માતાજી, દિવ્ય જીવનનાં છેલ્લા છ પ્રકરણોનું વાચન શરૂ કરે છે.

“આધ્યાત્મિક ઉત્કાનિત, પદાર્થતત્ત્વમાં સતત વિકસતા આત્મનિર્માણમાં શેતનાની ઉત્કાનિત અને તે પણ અંદર રહેલા આત્માને રૂપ પ્રગટ કરી શકે ત્યાં સુધીની ઉત્કાનિત પાર્થિવ અસ્તિત્વની ચાવી છે, કેન્દ્રસ્થ, મહત્વનો હેતુ છે. પ્રારંભમાં આત્માની પરમ વાસ્તવિકતાની ગાડ ભૌતિક અયેતનતામાં અવકાનિત પડે એ અર્થવત્તા નિગૂઢ રહેલી છે. પદાર્થતત્ત્વના અયેતનતાનું આવરણ વૈશિષ્ટ શૈતન્ય આચળાદિત કરે છે, જે શૈતન્ય શક્તિ તેનામાં શક્તિને કાર્ય કરી રહેલી છે, જેથી ભૌતિક વિશ્વમાં સર્જનની શક્તિરૂપે પ્રગટ થયેલું પ્રથમ રૂપ પોતે પણ અયેતન બની ગયું હોય તેમ ભાસે છે, અને છતાં તે વિશાળ ગુઠવાદી બુદ્ધિનાં કાર્યો કરતું હોય છે.”

મધુર માતાજી, આ શૈતન્ય શક્તિ યું છે તે હું સમજી શક્યો નહિ, તેથી મને આમાં કશી સમજ ન પડી!

પ્રથમ વાક્યને જે સમજવાની પ્રથમ તે જરૂર છે. તે વૈશિષ્ટ અસ્તિત્વના મુખ્ય સિદ્ધાંતનું-તત્ત્વનું કથન કરે છે. આપણે આ ગ્રંથના છેલ્લા છ પ્રકરણોનો છેડાનો પ્રારંભ કરીએ છીએ. તે ગ્રંથના પ્રારંભમાં શ્રીઅરવિંદે એક પછી એક આ વિશ

અને અસ્તિત્વ થા માટે અને કેવી રીતે તેની સમજૂતિ આપી છે. તે વસ્તુઓને છેક છેલ્લી હદ સુધી તે બઈ ગયા છે, જેથી તેમનો અર્થ તે પૂરેપૂરી રીતે સમજવી શકે. અને અંતમાં તેમણે બતાયું છે કે કથી બાબતોમાં તે સમજૂતિઓ અપૂર્ણ હતી, અને પછી પોતે તેમનો સાચો ઉકેલ આપ્યો છે. તે બધું આપણે પૂરું કરી ગયા છીએ એમ માનવાનું છે, તે બધું આપણા વાચનનાં પ્રકરણોની પહેલાંનાં પ્રકરણોમાં આવી ગયું છે. તે બધું વાચતાં અને સમજવતાં આપણું દશ વર્ષ વાગ્યાં હોત ! લાભકારક રીતે તે બધું સમજવા માટે, તમને અનેક પ્રકારના જ્ઞાનની અને મહાન બૌધ્ધિક વિકાસની જરૂર પડી હોત. પણ આપણે ત્યાંથી પ્રારંભ કરીએ છીએ કે જ્યાં તેમણે શુદ્ધ બૌધ્ધિક દૃષ્ટિબિદ્ધથી, અસ્તિત્વનો હેતુ સમજવો છે. તે તેની રજૂઆત આ રીતે કરે છે.” પાર્થિવ અસ્તિત્વનો કેન્દ્રસ્થ, અર્થપૂર્ણ હેતુ. મને સમગ્ર વિશ્વ સાથે નિસ્ખાત નથી. તેમણે પાર્થિવ જીવનને અર્થાત્ પૃથ્વી પરના, આપણા જીવનને સમગ્ર વિશ્વના હેતુના પ્રનીકમય અને સધન પ્રતિનિધિઓ લીધું છે. હકીકતમાં, ખૂબ પ્રાચીન પરંપરાઓ અનુસાર, ગહનતર આધ્યાત્મિક દૃષ્ટિબિદ્ધથી, પૃથ્વી વૈશ્વિક જીવનની એક પ્રતીકમય સધનતારૂપે સર્જાઈ છે, જેથી રૂપાંતરનું કાર્ય એક મર્માદિત સધન અવકાશમાં વધારે સહેલાઈથી સિદ્ધ થઈ શકે. પૃથ્વીમાં બધી સમસ્યાઓ એકત્રિત થઈ છે, અને તેથી તે સધનતામાં પરિપૂર્ણ અને અસરકારક કાર્ય થઈ શકે. એટલે શ્રી અરવિંદ અહીં માત્ર પાર્થિવ અસ્તિત્વની વાત કરે છે, પણ આપણે સમજ શકીએ છીએ કે તે એક પ્રતીકમય, સધન પ્રતીક છે. શ્રી અરવિંદ કહે છે કે પાર્થિવ અસ્તિત્વનો કેન્દ્રસ્થ હેતુ સમગ્ર આવિભાવમાં આત્માને જગાડવાનો, વિકસાવવાનો, અને તેનો પરિપૂર્ણ આવિભાવ કરવાનો છે. જે આત્મા પદાર્થતત્ત્વના કેન્દ્રમાં નિગૂઢ છે અને અંદરથી તેને પ્રગતિશીળ વિકાસ પ્રત્યે ધક્કેલી રહ્યો છે, કે જે વિકાસ અંદર રહીને કાર્ય કરે રહેલા આત્માને મુક્ત કરે.

૧. યુદ્ધની લીલામાં તલવારને આનંદ આવે છે, સરરર... કરીને છૂટવામાં ખાણને આનંદ આવે છે, અવકાશમાં ચક્કર આવે ત્યાં સુધી ધૂળવામાં પૃથ્વીને આનંદ આવે છે, પોતાના તેલેમય પ્રકાશમાં અને સનાતન ગતિમાં સૂર્યને બાદસાહી આનંદ આવે છે, હંસ ચેતન, કરણ, તું પણ તારે માટે નિર્માણ થયેલાં કાર્યોમાં આનંદ માણું.”

(“અતિમાનવ,” શાતાખી અંધ ૧૬, પૃથ્ઘ રટ્ટમાંથી “કાર્યોનો આનંદ” નામનો ઉદ્ઘૂત કરેલો કિરેલા.)



એટલે, આપણાને જોઈએ છીએ તે બાધ દેખાવોમાં, પ્રથમ ખનિજ રાજ્ય નજરે પડે છે. જે તેમાં પત્થર, માર્ટી, ખનિજ, દ્રવ્યો છે આપણું બાધ ચેતનાને તદ્દન અચેતન દેખાય છે, છતાં આ અચેતનતાની પીઠમાં આત્માનું જીવન છે, આત્માની ચેતના છે, જે તદ્દન નિગૂઢ છે, જ્ઞાન કે નિદ્રાવસ્થામાં છે જે કે તે માત્ર દેખાવ જ છે અને જે આત્મા અંદરથી કાર્ય કરે છે, જેથી તે જડ દેખાતા આ પદ્ધાર્થતત્ત્વનું ધીમેધીમે રૂપાંતર કરી શકે, અને તેનું સંગઠન વધારે ને વધારે પ્રમાણમાં ચેતનાનો આવિભાવ કરી શકે. શ્રી અરવિંદ કહે છે કે આ જડ પદ્ધાર્થતત્ત્વનું આવરણ શરૂઆતમાં એટલું બધું પરિપૂર્ણ હોય છે કે ઉપરચોટિયા દૃષ્ટિને તે એવું દેખાય કે તેમાં જીવન કે ચેતના નથી. જ્યારે તમે એક પત્થરને ઉપાડીને તમારી સામાન્ય આંખો અને ચેતના વડે તેને જુઓ છો, ત્યારે તમે કહો છો કે આનામાં જીવન નથી, ચેતના નથી. જે માણસને દેખાવોની પીઠમાં જોતાં આવડતું હોય છે, તેને માટે આ પદ્ધાર્થતત્ત્વના તેના કેન્દ્રમાં દરેક કેશાણુંના કેન્દ્રમાં નિગૂઢ પરમ દિવ્ય વાસ્તવિકતા નજરે પડે છે, જે અંદરથી ધીમે ધીમે મુગો સુધી આ જડ પદ્ધાર્થતત્ત્વને તે અંદર રહેલા આત્માને પ્રગટ કરી શકે તેવું અભિવ્યંજક કાંઈક બનાવવા માટે કાર્ય કરી રહી હોય છે, ત્યારે તમને જીવનના ઈતિહાસની પ્રગતિ પ્રાપ્ત થાય છે. તે પત્થરમાંથી એકદમ પ્રાથમિક જીવન પ્રગટે છે, અને સંગઠનની ક્રમિક સ્થિતિઓ દ્વારા એક સંધારિત પદ્ધાર્થ પ્રગટે છે, જે જીવન પ્રગટ કરવા સમર્થ હોય છે, ખનિજ રાજ્ય અને વનસ્પતિ રાજ્યની વચ્ચે પરિવર્તનકારી તત્ત્વો હોય છે. તે ખનિજ પ્રદેશનાં કે વનસ્પતિ પ્રદેશનાં છે તેની ખબર આપણું પડતી હોતી નથી. જ્યારે કોઈ તેનું વિસરપૂર્વક અધ્યયન કરે છે, ત્યારે તેને કેટલીક વિચિત્ર જાતિઓ દેખાય છે કે જે તે બેમાંથી એકદે પ્રદેશની નથી હોતી. પછી વનસ્પતિ સુભિંનો વિકાસ આવે છે, જ્યાં સ્વા-ભાવિક રીતે જ જીવન પ્રગટ થાય છે, કારણકે છોડમાં વૃદ્ધિ થતી હોય છે, પરિ-વર્તન થતું હોય છે, અને જીવનના (પ્રાણના) પ્રથમ દૃશ્ય સાથે વિઘટનનાં ક્ષીણ-તાનાં દૃશ્યો પણ આવતાં હોય છે, જે પત્થર કરતાં ખૂબ ઝડપથી બનતાં હોય છે, જો પત્થરનું બાધ થકિતાના આવેગથી રક્ષણ કરવામાં આવે, તો તે અનિશ્ચિત મુદ્દ સુધી ટકી રહે છે, જ્યારે છોડ વૃદ્ધિના, આરોહણના, ક્ષીણતાના, અને વિઘ-ટનના વળાંકને અનુસરતો હોય છે, પણ તે બધું ખૂબ મર્યાદિત ચેતના સાથે થતું હોય છે, જે વોકેએ વિસરપૂર્વક વનસ્પતિ સુભિનું અધ્યયન કર્યું છે, તેઓ બરાબર જ્ઞાન છે કે, વનસ્પતિમાં પ્રાણ છે, ચેતના છે, દા. ત. જીવના માટે છોડોને

સૂર્ય પ્રકાશની જરૂર રહે છે સૂર્ય એ સડિય શક્તિનો પ્રતિનિધિ છે, જે છોડાને ઉગાડે છે, જે તમે છોડાને સૂર્યપ્રકાશ વગરની જગ્યાએ રાખો તો તમે જોશો કે તે ઊંચો ને ઊંચો ઉગવા, સૂર્યપ્રકાશને પહોંચવા પ્રયત્ન કરતો હોય છે. દા.ત. કુમારું જંગલમાં, જયાં માણસની દખલગિરી હોતી નથી ત્યાં, બધાં છોડો સૂર્ય-પ્રકાશને પહોંચવા માટેનો આ સંધર્ષ કરતા હોય છે. તે બહ રસપ્રદ છે. તમે જે કોઈ પુણ્યોના કુંડાને સૂર્યપ્રકાશવિહોલું, ભીજોવાળા, પ્રાંગણમાં મૂકો, તો જે છોડ આટલો જ (અભિનય) ઉગતો હોય છે તે ઊંચો બનવા માટે પ્રયત્ન કરે છે, તે સૂર્યપ્રકાશને પહોંચવા માટે પ્રયત્ન કરતો હોય છે. એટલે છોડામાં ચેતના છે, જીવા માટેનો સંકલ્પ છે કે જે પ્રગટ થઈ ચૂક્યો હોય છે. પછી ધોમે ધોમે, જેમ જેમ જતિઓ વધારે ને વધારે વિકાસ સાધતી જાય છે તેમ તેમ, તમે એ એવી વચ્ચગાળાની સ્થિતિઓ પહોંચો છો કે જે તદ્દન છોડ નથી હોતો અને હજુ પણ પણ નથી હોતું. એવી ધર્મી જતિઓ છે જે ખૂબ રસપ્રદ છે. કેટલાક છોડ માંસાહારી હોય છે, તેમનું મુખ ખુલ્લું હોય છે, તેમાં તમે આંખ મૂકો અને તેઓ તેને હડપ કરી જાય છે. તે છોડ નથી હોતો, અને પણ પણ નથી હોતો. આ પ્રકારના ધર્મા છોડ હોય છે.

પછી તમે પણ પ્રયે આવો છો. પ્રાથમિક પણઓનો છોડાથી બેદ પારખવે એ બહુ મુશ્કેલ હોય છે, તેમનામાં ચેતના નહિ જેવી હોય છે, પણ ઓમાં પણ ક્રમિક સ્થિતિઓ હોય છે. ઉચ્ચતર પણાઓમાં ચેતના જરૂર દેખાય છે. તેમનામાં તદ્દન સ્વતંત્ર સંકલ્પશક્તિ પણ હોય છે. તેઓ બહુ સચેતન અને બુદ્ધિશાળી હોય છે. દા.ત. હાથી. તમે હાથીઓ તથા તેમની અદ્ભુત બુદ્ધિ વિષે અનેક કથાઓ જાણો છો. એટલે ત્યાં મન ખૂબ પ્રમાણમાં દૃષ્ટિગોચર થતું હોય છે. આ મગનિ-શીલ વિકાસ દ્વારા આપણે ઓચિતા એક એવી જતિ પાસે આવી પહોંચીએ છીએ, જે ધર્માં કરીને લુસ થઈ ગઈ છે, પણ જેનાં ચિહ્ન જડયાં છે. પછી વાનર આવે છે અથવા વાનર જેવું કોઈક પ્રાણી, કે જે બે પગપર ચાલે છે. ત્યાંથી આપણે માણસ પર આવીએ છીએ. માણસની ઉત્કાનિતનો પરિપૂર્ણ પ્રારંભ ત્યાં છે. માણસ તેજસ્વી બુદ્ધિ બનાવી શકે છે એમ તો આપણે ન કહી શકીએ, પણ તેનામાં મનનું ઝાર્ય થરૂ થઈ ગયેલું હોય છે, સ્વતંત્રતાનો પ્રારંભ થઈ ચૂક્યો હોય છે, વાતાવરણ પ્રત્યે અને પ્રકૃતિનાં બણો પ્રત્યે તે સ્વતંત્ર પ્રતિકાર્ય કરી શકતો હોય છે. માણસમાં એવી ક્રમિક સ્થિતિઓ છે, જેથી તે આખરે આધ્યાત્મિક જીવન માટે સમર્પ એવો ઉચ્ચતર પ્રાણી બની શકે છે.

શ્રી અરવિંદ આ પૃષ્ઠ પર આપણને આ વાત કહે છે. હવે તમારે કોઈ પ્રેરણ પૂછવો છે?

મધુર માતાજી, શ્રી અરવિંદ અહીં કહે છે કે “આ ચેતના બુદ્ધિના પરમ શિખરને પહોંચે છે, અને માનવમાં તે પોતાની જાતને પણ ટપી જાય છે.”

હા, મેં તમને હમણાં તે જ વાત કરી. પોતાની ઉત્ત્યતમ અવસ્થામાં માણસ પ્રકૃતિથી લગભગ સ્વતંત્ર બની જાય છે, તદ્દન તો નહિ. ‘તદ્દન’ માં અતિશયોક્તિ છે, પણ તે તદ્દન સ્વતંત્ર બની જઈ શકે છે. જે માણસે પોતામાં આધ્યાત્મિક ચેતનાનો સાક્ષાત્કાર કર્યો છે, જેણે દિવ્ય ઉદ્ગમસ્થાન સાથે સીધેં સંબંધ સ્થાપ્યો છે, તે અક્ષરશઃ પ્રકૃતિથી અને તેની શક્તિથી સ્વતંત્ર બની જાય છે.

(વરસાદ પડવા માંડે છે.) આહ, તે આપણાં મનને શીતલ બનાવવા વરસે છે! (હસાહસ)

તેને શ્રી અરવિંદ કહે છે ‘પોતાની જાતને પણ ટપી જાય છે!’ અર્થાત् સતુ, આંતરદિવ્ય ચેતના, પરમ આધ્યાત્મિક વાસ્તવિકતા પોતાનો વિકાસ કરવાના પ્રયાસમાં..... (વધારે વરસાદ પડે છે.) ઓહ, હવે આપણે વાર્તાવાપ બંધ કરવો પડશે. પોતાની જાતને પ્રગટ કરવાનાં સચેતન સાધનોને વિકસાવવાના તેના પ્રયત્નમાં, તે માણસ પ્રકૃતિની સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થયા સિવાય જ તે પરમાત્મા સાથે સીધા સંપર્કમાં આવવા શક્તિમાન બને છે.

હવે આપણે અટકી જઈશું. આજે ધ્યાન નહિ, કારણ કે ...\*\*

જ્યારે વાનર અથવા માનવ પોતાની શક્યતાઓની ઊંચાઈને પહોંચે છે, અર્થાત् જ્યારે માનવ વ્યક્તિ માનવજાતિની શ્રોષ્ટ ટાઈપ બને છે, ત્યારે તે ખતમ થઈ જાય છે, તે વ્યક્તિ આગળ પ્રગતિથી કરી શકે. તે માનવ-જાતિનું પ્રાણી છે, તે તે જાતિનું રક્ષા કરશે. એટલે પાર્થિવ ઈતિહાસના દૃષ્ટિબિદ્ધુથી જોતાં, પ્રગતિ થતી હોય છે, કારણું દરેક જાતિ તેની આગળ થઈ ગયેલી જાતિઓ કરતાં વધારે પ્રગતિ સાધતી હોય છે. પણ વ્યક્તિના દૃષ્ટિબિદ્ધુથી જોતાં, પ્રગતિ થતી હોતી નથી, તે જન્મતો હોય છે, પોતાનો વિકાસ સાધતો હોય છે, મરી જાય છે, અને અદૃશ્ય બની જાય છે. એટલે વ્યક્તિની પ્રગતિ સિદ્ધ થાય તેટલા માટે, બીજું કોઈ સાધન શોધી કાઢવાની જરૂરત હતી, આ સાધન પર્યાપ્ત ન હતું. પણ દરેક રૂપ ધારણ કરતી વ્યક્તિમાં ચેતનાનું એવું એક સંગઠન હોય છે, જે દિવ્ય હાજરીની નજીક

હોય છે, અંદર રહેલા લગવાનની સીધી અસર નીચે હોય છે. આ અસર હેઠળ રહેલા રૂપમાં, શક્તિની આંતર એકાગ્રતાનો આ પ્રકારમાં ભૌતિક રૂપથી સ્વતંત્ર જીવન હોય છે, જેને આપણે જીવાત્મા અથવા ચૈત્ય સત્તા કહીએ છીએ. તે દિવ્ય કેન્દ્રની આસપાસ સંગઠિત થયેલું હોય છે, તેથી તે અમર અને સનાતન દિવ્ય સ્વભાવમાં ભાગીદાર બને છે. બાબુ શરીર પડી જાય છે, પણ એ જીવાત્મા દરેક જન્મમાં પ્રાપ્ત કરેલો અનુભવ સાથે જીવતો રહે છે, તેથી દરેક જન્મ પ્રગતિ ચાલુ રહે છે, તે પ્રગતિ તે જ વ્યક્તિની હોય છે. આ ગતિ બીજી ગતિની પૂર્ક બને છે, અથવા એક જાતિ બીજી જાતિઓના સંબંધમાં પ્રગતિ કરતી રહે તેને બદલે, વ્યક્તિ આ બધી જાતિઓની પ્રગતિના બધા તબક્કાઓમાંથી પસાર થાય છે અને પરમ સીમાએ પહોંચે, ત્યારે તે ત્યાં રહે અથવા અદૃશ્ય બની જાય છે. જે વાત તે તે કિસ્સા પર આધાર રાખતી હોય છે જ્યારે જાતિઓ પોતાની શક્યતાઓની અનિશ્ચિત મુદ્દત સુધી પોતાની પ્રગતિ ચાલુ રાખી શકે છે. તે દ્વિગુણ ગતિ છે, જે પોતાની જાતને પરિપૂર્ણ કરે છે. તેથી દરેક વ્યક્તિ, તે કષે તે જ રૂપમાં હોય તેનાથી સ્વતંત્ર બની તે, પોતાના શ્રીએ સાક્ષાત્કારને પહોંચવાની શક્યતા ધરાવે છે.

એવા લોકો હતા અને છે જેઓ એમ કહેના હોય છે કે અમને અમારા પૂર્વજન્મો યાદ છે, અને તેઓ પોતે કુતરા અથવા હાથીઓ અથવા વાંદરા હતા ત્યારની ઘટનાઓ વર્ણવતા હોય છે, પોતાની ઘટનાઓને તેઓ વીગતવાર વર્ણિત હોય છે. હું તેમની સાથે દલીલમાં ઉત્તરવા માગતી નથી, પણ આ હકીકત સિદ્ધ કરે છે કે માણુસ તરીકે જન્મતા પહેલાં તે વાંદરો પણ હોઈ શકે, માણુસમાં પૂર્વજન્મની વાત યાદ રાખવાની શક્તિ હોતી નથી તે અબગ વાત છે, પણ ચોક્કસ આ આંતર દિવ્ય સ્કુલ્લિંગ પોતાની જાતથી વધારે ને વધારે સચેતન બનવા માટે અનેક ક્રમિક રૂપોમાંથી પસાર થતો હોય છે. જે માણુસ અત્યારે માનવરૂપમાં જ દેખાતા પોતાના ચૈતસિક અસ્તિત્વના પ્રાગટ્ય પહેલાંનાં રૂપો યાદ કરી શકે, તો તે એ પણ યાદ કરી શકે કે તે વૃક્ષો પર ચક્કા હતો, નાળિયેર ખાતો હતો, નીચેથી પસાર તથા મુસાફરો ઉપર અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓ અજમાવતો હતો!

ગમે તેમ પણ તે હકીકત છે. માનસિક પ્રાણીને જેવી સમૃતિઓ છે તેની સમૃતિઓ ચૈતસિક સત્તવને પણ હોય છે. તેમને યાદ કરવા માટે આંતર સંગઠનની અમૃત સ્થિતિ

જરૂરની છે તે આપણે હવે પછી જોઈશું, જ્યારે આપણે આ પુસ્તકના તે ભાગ પર આવીશું ત્યારે પણ ગમે તેમ પણ આ હકીકત સ્થાપિત થઈ ચુકેલી છે. એક બીજાને પૂરક અને એક બીજામાં ભાગ લેતી આ દ્વિવિધ ગતિ દરેક માલુસમાં રહેલા દિવ્ય પ્રકાશનો સાક્ષાત્કાર કરવા માટેની ખૂબ શક્યતાઓ ઉલ્લિ કરે છે. શ્રી અરવિંદે એ વાત સમજાવી છે. ( બાળક તરફ વળીને ) આનો અર્થ એ થયો કે અતિમાનસિક જાતિ બનવાના કુમારાં તમે હજુ, તમારા બાધ્ય શરીરમાં, પણ જાતિના છો ! પણ તમારામાં ચૈતસિક સત્તા છે, જે પહેલાં અસંખ્ય જાતિઓનાં જીવન જીવી ચૂક્યું છે, અને તમારામાં હજારો વર્ષોના અનુભવનું વહન કરી રહ્યું છે, જે જ્યાં સુધી તમારું માનવ શરીર રહેશે અને આખરે નાશ પામશે ત્યાં સુધી ટકી રહેશે.

આપણે પાછળથી જોઈશું કે આ ચૈતસિક સત્તામાં પોતાના શરીરનું ઇપાંતર કરવાની શક્યતા છે કે નહિ, અને પણ, માનવ અને અતિમાનવ વચ્ચેની વચ્ચગાળાની જાતિનું સર્જન કરવાની શક્યતા તેનામાં છે કે નહિ. પણ અત્યારે તો અમર આત્મા માનવ શરીરમાં પોતાની જાતથી વધારે ને વધારે સભાન બની રહ્યો છે. તમને આ સમજયું ?

( બીજો બાળક ) માતાજી, પ્રકૃતિમાં આપણે ધર્મવાર એક સમગ્ર જાતિઓ અદૃશ્ય બનેલી જોઈ શકીએ છીએ, તેનું કારણ શું ?

કદાચ પ્રકૃતિને લાગ્યું હશે કે તે જાતિ સફળ બની ન હતી ! પ્રકૃતિ કુશળતાપૂર્વક, કરકસર કરવાની જરા પણ દરકાર રાખ્યા સિવાય, કાર્ય કરતી હોય છે. એ આપણે જોઈ શકીએ છીએ. તે બને તેટલું પ્રયત્નો, બને તેટલી રીતે, ખૂબ નોંધપાત્ર અનેક પ્રકારનાં સંશોધનો દારા કરતી હોય છે, પણ કેટલીક વાર... તે એક આંધળી ગલી જેવું હોય છે. પ્રગતિ કરવાને બદલે, તે દિશામાં ગમે તેમ આગળ ધક્કેલાવું તેનાથી તો માલુસ એવી સ્થિતિને પહોંચે કે જે તદ્દન અસ્વી-કાર્ય હોય. પ્રકૃતિ કોઈ ગણૂતરી કર્યા સિવાય, પ્રચુરતાપૂર્વક પોતાના સર્જનાત્મક આત્માને બહાર ફેંકતી હોય છે. જ્યારે તે સંચોગીકરણ બહુ સફળ નથી બનતું, ત્યારે તે આમ કરે છે ( અભિનય ) અને બધી વસ્તુઓને ફંઝેટી દે છે, તેને તેની દરકાર નથી હોતી. પ્રકૃતિમાં અમર્યાદ પ્રચુરતા છે. હું માનું છું કે ગમે તેવો પ્રયોગ કરતાં તે અચકાતી હોતી નથી. જે અમુક વસ્તુને કોઈ સફળ પરિણામ પ્રત્યે દ્વારી જવાની તક હોય તો તે પોતાનું કામ તે બાબત ચાલુ રાખે છે. વાનર અને માનવની વચ્ચે વચ્ચગાળાની જાતિઓ અથવા સમાંતર ઇપો જરૂર હતાં, તેમનાં

ચિહ્નો જડયાં છે. કદાચ ઈચ્છા મુજબ માની વેવાને કારણે! પણ ચિહ્નો જડયાં છે તે વાત ચોક્કસ. તે જતિઓ અદૃશ્ય બની ગઈ છે. એટલે આપણે કલપના કરી શકીએ કે હવે જે જતિ આવવાની છે, જે પશુમાનવ અને અતિમાનવ વચ્ચે વચગાળાની જતિ હોય, તે રહેશે કે પછી પ્રકૃતિ તેને રસહીન માનીને તેનો ઈન્કાર કરશે? તે આપણે પછી જોઈશું. જ્યારે આવતી વખતે આપણે ફરી મળીશું, ત્યારે આપણે ફરી તેને વિષે વાત કરીશું!

તે કેવળ મર્યાદારહિત પ્રચુરતાની હિયા છે. પ્રકૃતિમાં પૂરતું જ્ઞાન અને ચેતના છે, જેથી તે અસંખ્ય તરફો સાથે કામ પાડી શકે છે, જે તરફો મિશ્રિત કરી શકાય છે; ફરી વિઘટિત કરી શકાય છે, જેમને ફરી ઘાટ ઘડી શકાય છે, ફરી પાછાં જેમને તોડી ફૂંકી નાંખી શકાય છે, અને...એ એક મહાન ચ્છ છે, જેમ તમે હલાવો છો, તેમ એમાંથી કાંઈક બહાર આવે છે, તે સાચું ન લાગવાથી તમે તેને ફરી પાછું ચ્છુમાં ફેંકી દો છો, અને તેમાંથી બીજી કોઈક વસ્તુ લો છો. તેના માપની કલપના કરો. આ પૃથ્વીને જ લો. એક, બે, કે સૌ રૂપો પ્રકૃતિ માટે મહત્વનાં નથી. હજારો, હજારો રૂપો હોય છે. પછી થોડાક વર્ષ, સો, હજાર, લાખો વર્ષો; પ્રકૃતિને તેનું મહત્વ નથી. તમારી આગળ શાશ્વતી પડી છે!

માત્ર જ્યારે આપણે માનવીય માપ વડે વસ્તુઓ પ્રન્યે જોઈએ છીએ, ત્યારે તે ખૂબ વિશાળ લાગે છે, પણ પ્રકૃતિ માટે તે કાંઈ વિસાતમાં નથી. તેને મન તે એક મનોરંજનની રમત છે. ઝોઈને તે રમત ગમે કે ન ગમે, પણ છતાં તે રમત છે.

એ વાત સ્પષ્ટ છે કે પ્રકૃતિને તેમાં મજા પડે છે, તેને કશી ઉતાવળ હોતી નથી, જો તેને આગ્રહપૂર્વક, વચ્ચે અટક્યા સિવાય, પોતાનું કાર્ય પૂરું કરી દેવાનું કહેનામાં આવે, તો તે હંમેશાં એક જ જવાબ આપે છે કે “શા માટે? આ રમતમાં તમને શું મજા નથી પડતી?”

### ૧૩ નવેમ્બર ૧૯૫૭

પહેલા પુષ્ટ બાબત મારે એક પ્રશ્ન છે, જેમાં શ્રી અરવિંદ કહે છે, “આધ્યાત્મિક ઉત્કાંતિ, સતત વિકસતા આત્મનિર્માણ માટે પદાર્થતત્વમાં ચેતનાની

ઉત્કાંતિ, જ્યાં સુધી રૂપ અંદર રહેલા આત્માને પ્રગટ કરી શકે ત્યાં સુધી ચેતનાની ઉત્કાંતિ એ પાર્થિવ અસ્તિત્વની ચાવી છે, તેનો અર્થ “પૂર્ણ કેન્દ્રસ્થ હેતુ છે.”

(દિવ્ય જીવન, પૃષ્ઠ ૮૨૪)

એટલે, રૂપના દૃષ્ટિબિન્દુથી, માણસ કંધી રીતે બીજા પશુઓથી અધિક ઉચ્ચ છે ?  
મને લાગે છે કે તે શોચી કાઢલું તે બહુ સહેલું છે.

ક્રી અરવિંદ તે રૂપની વાત કરે છે, કે ને આત્માને પ્રગટ કરવા માટે સમર્થ છે. આત્માના આવિજ્ઞાનો સ્વભાવ જ ચેતના છે, જ્ઞાન છે, અને આખરે પ્રભુત્વ છે. એ વાત સ્પષ્ટ છે કે કેવળ કળાના અને શારીરિક દેખાવના દૃષ્ટિબિન્દુથી જોતાં, અમુક પશુઓનાં રૂપો સુંદર લાગે, કદાચ માનવની અત્યારની પતનની સ્થિતિમાં માનવના રૂપ કરતાં પાણ વધારે સુંદર લાગે. એવા સમયો હતા, કે જ્યારે માનવજીતિ વધારે સુંદર અને સંપાદમય હતી.

આત્માની અભિવ્યક્તિના સાધન તરીકે, માનવ રૂપની અધિકતા બાબતમાં જરા પણ શંકા નથી. માણસ ટટ્ટાર ઉભે રહી શકે છે તે હકીકત બતાવી આપે છે કે તેનામાં વસ્તુઓ પ્રત્યે ઊર્ધ્વમાંથી જેવાની શક્તિ છે. નાક જર્માન પ્રત્યે નીચું રાખીને ચાલવાને બદલે, તે ને કાંઈ જુઓ છે તેના પર તે પ્રભાવ પાડી શકે છે. અલભતા, એમ કહી શકાય કે, પંખીઓ ઉડી શકે છે; પણ પાંખો છે માટે બૌદ્ધિક આત્માભિવ્યક્તિનું સાધન પણ હેવું એ કઠિન છે.

આ ટટ્ટાર ઉભા રહી શકવાની સ્થિતિ એ પ્રતીકમય છે. આંખો તથા નાક નીચાં રાખીને ચાલતાં, મારામાં એવી લાગણી પેદા નથી થતી કે હું વસ્તુઓની બીજી અથવા ઊર્ધ્વ ભૂમિકા પરથી જોઉં છું. માનવ શરીરની રચના જ માનસિક જીવનને અભિવ્યક્ત કરવા માટે બનેલી હોય છે. દા.ત. મસ્તિષ્ક, કદ, માનવ-મસ્તકની રચના, હાથીની રચના આ બધું જ આત્માની અભિવ્યક્તિના દૃષ્ટિબિન્દુથી જોતાં ચોક્કસ અધિક છે; તે બધાની રચના બુદ્ધિને અભિવ્યક્ત કરવાના હેતુથી જ થયેલી હોય છે.

બળના, ચપળતાના દૃષ્ટિબિન્દુથી જોતાં, માણસ બીજા પશુઓથી અધિક છે એમ ન કહી શકાય; પણ આત્માને અભિવ્યક્ત કરી શકવાની બાબતમાં કોઈ પણ પશુ માનવની તોળે આવી ન શકે. દરેક વસ્તુ આ હેતુને જ્યાલમાં રાખીને રચવામાં

આવી હોય છે. આ શક્યતામાં બીજુ વસ્તુઓ ઉમેરી શક્ય ; પણ માનસિક જીવન ખાતર તે વસ્તુઓનો લોગ આપવામાં આવ્યો છે. માનસિક જીવનને અભિવ્યક્ત કરવાની શક્તિને લઈને જ માણુસ પોતામાં સુષુપ્ત રહેલી શક્તિઓને વિકસાવી શક્યો છે. માણુસમાં કેળવાવાની શક્તિ છે. તેમાં શરીરને પણ કેળવી શક્ય છે, તે કેટલીક શક્તિઓમાં વધારો કરી શકે છે. આપણે જેમને ખૂબ વખાળીએ છીએ તેવાં પશુઓમાંનું કોઈપણ પશુ શારીરિક વ્યાયામ કરી શકતું નથી. હું શાળામાં જઈને ભાણવાની વાત નથી કરતી, પણ માત્ર શારીરિક વ્યાયામની, સનાયુઓને પદ્ધતિપૂર્વક વિકસાવાની વાત કરું છું. પશુ જન્મે છે, અને પોતાની પાસે જે હોય છે તેનો સારો ઉપયોગ કરે છે, પોતાના નિયમ અનુસાર વૃદ્ધિ પામે છે, પણ તે પોતાની જાતને કેળવી શકતું નથી, અને કેળવે તો તદ્દન પ્રાથમિક રીતે ખૂબ મર્યાદિત ક્ષેત્રમાં કેળવી શકે છે, પણ સામાન્ય, પદ્ધતિપૂર્વકના વિકાસ વડે, માણુસ પોતાની ન્યુનતાઓને તથા ઝોડખાંપણેને દૂર કરી શકે છે. ચોક્કસ માણુસ સંગ-ઠનની દૃષ્ટિઓ, પ્રથમ પ્રગતિશીલ પ્રાણી છે. જે પોતાની શક્તિઓમાં, શક્યતાઓમાં વૃદ્ધિ કરી શકે છે, અને સ્વર્યાંભૂ રીતે જે વસ્તુઓ તેને થઈ ન હતી તેમને પ્રાપ્ત કરી શકે છે. કોઈ પણ પશુ તેમ ન કરી શકે.

હા, માણુસની અસર હેઠળ કેટલાંક પશુઓ પહેલાં તેઓ સ્વર્યાંભૂ રીતે કરી શકતાં ન હતાં તેવી ગતિઓ કરવાનું શીખ્યાં છે, પણ તે માણુસની અસર હેઠળ જ ચોક્કસ, માણુસો વગર કૂતરાં અને ઘોડા તે વસ્તુઓ કદી ન શીખ્યાં હોત, જે માણુસના સંપર્કથી તેઓ શીખ્યાં છે. એટલે એ વાત સ્પષ્ટ છે કે માનવીય લૌલિક રૂપ જ આત્માની અભિવ્યક્ત માટે ખૂબ યોગ્ય સાધન છે. તે શરીર આપણને ભલે અયોગ્ય લાગતું હોય, પણ આપણો અનુભવ છે કે એક કેળવલું આપનારા સંકલ્પ સિવાય, આપણાં શરીરોમાંથી જે કાંઈ જેંચી શકીએ છીએ તે સ્વર્યાંભૂ રીતે તેમણે ન આયું હોત. બુદ્ધિ, અવલોકન, સમજ, અનુમાન વગેરે માનસિક ગુણોને વ્યક્ત કરવાની શક્યતા વડે માણુસ પ્રકૃતિના નિયમોને ધીમે ધીમે સુમજી શક્યો છે, અને માત્ર તેમને સમજવાનો જ નહિ, પણ તેમના પર પ્રભુત્વ મેળવવાનો પણ તેણે પ્રયત્ન કર્યો છે.

જે આપણે માણુસ જે છે તેને જે સત્ય આપણે બનવા માગીએ છીએ તે સત્યમાં જીવતા ઉચ્ચતર સત્ત્વ સાથે સરખાવીશું તો આપણે માનવ વિષે સ્પષ્ટ રીતે કરી શકીશું કે તે હજી ખૂબ નિકૃષ્ટ સ્થિતિમાં છે, અને આપણે તેની અપુ-

શું તા વિષે ફરિયાદ કરીશું. પણ કો આપણે માનવને ઉત્કાન્તમાં તેની તરત જ પહેલાં આવેલાં પશુઓને સ્થાને મૂકીશું, તો આપણને જાણાશે કે માનવમાં એવી શક્યતાઓ અને શક્તિઓ છે, કે જેમને બીજાં પશુઓ વ્યક્ત કરવા તદ્દન અસમ્રથું છે. મહત્વાકાંક્ષા હોવી, પ્રકૃતિના નિયમો જાણવાનો સંકલ્પ હોવો, ઈચ્છા હોવી, અને તેમના પર તેમને પોતાની જરૂરિયાતોને અનુકૂળ બનાવવા જેટલું અને અમુક પ્રમાણમાં તેમને પરિવર્તિત કરવાનું પ્રભુન્વ પ્રામ કરવું આ બધું કોઈ પણ પશુ માટે અશક્ય છે, અવિચારણીય છે.

તમે મને કહેશો કે હું મોટે ભાગે માણસ વિષે બહુ સારું બોલતી નથી (હસાહસ) પણ તેનું કારણ એ છે કે મોટેભાગે તે પોતાને માટે બહું ઊંચું માનતો હોય છે!

જો આપણે માનવને પ્રકૃતિનાં બીજા સંતાનો કૃતિઓ, સાથે સરખાવીએ તો ચોક્કસ તે નીસરણીને સૌથી ઊંચે પગથિયે છે.

પણ માતાજી, તો પછી સવાલ ઉદ્દૂલવે છે, ચેતનાનું અવતરણ રૂપનો વિકાસ સાધનું હોય છે, કે પછી રૂપનો વિકાસ ઉચ્ચતર ચેતનાને અવતરણ કરવાની ફરજ પાડતો હોય છે?

ચેતનાના અવતરણ સિવાય વિશ્વ જ અસ્તિત્વમાં ન આવી શકે. પછી તમારું વિશ્વ કર્યાંથી શરૂ થાય, શેની સાથે?

માણસની બાબતમાં, પશુમાનવે મનને નીચે આણ્ણું હતું, કે પછી તે મનનું અવતરણ હતું?

શું તમે એમ પૂછ્યા માગો છો કે વચ્ચગાળાના પ્રાણીમાંના અથવા ઉચ્ચતર વાનરમાંના કશાકે, પોતાની અભીષ્ટા વડે, મનને નીચે આણ્ણું હતું? પણ અભીષ્ટા પોતે જ આગળ થઈ ચૂકેલા અવતરણનું પરિણામ હોય છે.

એ સ્પષ્ટ છે કે અસ્તિત્વ ધરાવતી વસ્તુમાં જે સમાવિષ્ટ ન હોય, તેને કોઈ પણ વસ્તુ પ્રગટ ન કરી શકે. માણસ શૂન્યમાંથી કોઈક વસ્તુને પ્રગટ ન કરી શકે. જે કાઈ હોય તેને માણસ બહાર લાવી શકે, વ્યક્ત કરી શકે, વિકસાવી શકે; પણ જો ત્યાં કંઈ જ ન હોય, તો કશું જ બહાર આવી શકે નહિ. સર્વ

પ્રગતિ, સર્વ પરિપૂર્ણતા જે કાંઈક અંદર છે અને બહાર આવવા મયે છે તેના આંતર પ્રયત્નનું પરિલાભ છે. તરફ પહેલું હોય છે, અભિવ્યક્તિ પણીથી ધતી હોય છે. જેમ જેમ આપણે દિવ્ય જીવન વાંચતા જઈશું, તેમ તેમ શી અરવિંદ દરેક શક્ય રીતે ઓ વાત તમને સિદ્ધ કરી બતાવશે. જે સનાતન તરફ ન હોત, પરિપૂર્ણ વાસ્તવિકતા ન હોત, આપણે તેને મરજી મુજબ ગમે તે નામ આપીએ, તો વિશ્વ કાસ્તિત્વમાં જ ન આવ્યું હોત, કારણે શૂન્યમાંથી કશું જ પેદા થઈ શકતું નથી.

આ ગ્રંથ આગળ વાંચીશું, તેમ નેમ તે વાત આપણે જોઈશું; ત્યારે તમારે તરફ ચિંતનની અનેક કસરતો કરવી પડશે. પણ તરફ ચિંતનની અને માનસિક કસરતો કર્યા સિવાય પણ, એટલું તો સ્પષ્ટ છે કે કોઈ પણ વસ્તુને બનાવવા માટે, તમારે જેણા વડે તેને બનાવી શકાય છે તેની તો જરૂર પડવાની જ.

માનવ મનના વિકાસમાં એવો એક ગાળો છે અથવા હતો, કે જેમાં માણસોએ ગંભીરતાપૂર્વક એમ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો હતો કે પદાર્થતત્ત્વને પરિપૂર્ણ બનાવવાથી તેમાંથી આત્મા પેદા થયો છે પણ તે અક્ષલખીન વાત છે! (માતાજી હસે છે.) તમારાં નાનામાં નાનાં કાર્યો સ્પષ્ટ રીતે સિદ્ધ કરે છે કે પ્રથમ તમે જ્યાલ બાંધતા હો છો, અને પછી, ખૂબ નાના પાયા ઉપર પણ, તે કરતા હો છો. જે જીવન સચેતન સંકલ્પનું પરિલાભ નથી, તે જીવન તદ્દન અસંગત જીવન બની રહે. જે પ્રકૃતિ સચેતન શક્તિ ન હોત, સચેતન સંકલ્પ ન હોત, તેને જે સચેતન હેતુ ન હોત, તો કોઈ પણ વસ્તુ સંગઠિત ન બની હોત. આપણા વ્યક્તિત્વનું જીવનમાં પ્રાપ્ત થતા અવલોકનના ખૂબ નાનકડા ક્ષેત્રમાં પણ થોડાક અવલોકનથી આપણને આ બાબતમાં પૂરી ખાતરી થઈ જશે.

શી અરવિંદ આ વિષયનું ખૂબ વિસ્તારપૂર્વક કથન કરે છે. એટલે આપણે વળી પાછા તેને વિષે વાત કરીશું.

( મૌન )

એમ કહી શકાય કે, અહિન ઉપર પ્રલૂટ્વ એ માનવની શોષ્ટતાની પ્રતીકમય સાબિતી છે. માણુસ જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં અહિન પ્રગટાવવામાં આવતો હોય છે.

પશુની કિયાઓ કરતાં બે વસ્તુઓ સ્પષ્ટ રીતે ચઢિયાતી છે. લખવાની શક્તિ અને સ્પષ્ટ વાણીની શક્યતા. આ એટલી બધી સ્પષ્ટ રીતે ચઢિયાતી છે. કે પૂરતા પ્રમાણમાં વિકાસ પામેલાં પશુઓ સ્પષ્ટ વાણી પ્રત્યે ખૂબ જ લાગણી ધરાવતાં હોય છે, તેનાથી તેઓ મુજબ બની જતાં હોય છે. બે તમે કોઈ જંગલી પશુ સમક્ષ સ્પષ્ટ, ખૂબ આરોહ અવરોહયુક્ત, શુદ્ધ રીતે ઉચ્ચરિત વાણી બોલશો, તો તે તરત તમારા પ્રત્યે આકર્ષણી, મુજબ બની જશો. હું જે પશુઓ માણસોની નિકટ રહ્યાં છે તેમની વાત નથી કરતી, પણ તે પશુઓની વાત કરું છું કે ને કહી પણ માણસને મળ્યાં હોતાં નથી. તે તરત જ ધ્યાનપૂર્વક સાંભળે છે, વ્યક્ત કરાતી અધિકતર શક્તિને તે અનુભવે છે.

\*

## ૨૭ નવેમ્બર ૧૯૫૭

“ એ પણ શંકાસ્પદ છે કે ઉત્કાનિત અત્યાર સુધીમાં પહોંચી છે તેના કરતાં વધારે આગળ જશે કે નહિ? પાણી પ્રકૃતિના પાયાના અજ્ઞાનમાં આધ્યાત્મિક ઉત્કાનિત, પરિપૂર્ણ બનેલી જગત ચેતનાનું પ્રાગટ્ય, જ્ઞાનમય પ્રાણી શક્ય છે કે નહિ?

કાળની શાશ્વતીમાં સનાતન કાળાતીતના આવિર્ભાવના સર્જનને, ચેતનાનાં સાત સ્તરોને, ભૌતિક અયેતનતા આત્માના મુનરારોહણ માટેનો પાયો છે એ વાતને, પાણી ક્રમમાં મુનર્જનમ એક હકીકત છે તે વાતને કબૂલ રાખીએ તો પણ, વ્યક્તિગત પ્રાણીની આધ્યાત્મિક ઉત્કાનિત તેના અનિવાર્ય પરિણામ રૂપે આવવી જ જોઈએ એમ ન કહી શકાય. જ્ઞાન ઉપર ગાણાવેલી બાબતોમાંથી એકને કબૂલ રાખો કે પછી બધીને. પાણી અસ્તિત્વની આધ્યાત્મિક અર્થવત્તાનો અને આંતર પ્રક્રિયાનો બીજો અર્થ પણ ઘટાલી શકાય. જે દરેક સર્જન કરાયેલી વસ્તુ પ્રગટ થયેલા દિવ્ય અસ્તિત્વનું એક રૂપ હોય, તો તેમાં રહેલી આધ્યાત્મિક હાજરીને કારણે દરેક વસ્તુ પોતે પણ દિવ્ય છે, પછી પ્રકૃતિમાં તેનો દેખાવ, પ્રતીક, કે લક્ષણ અમે તે હોય. આ આવિર્ભાવના દરેક રૂપમાં ભગવાન અસ્તિત્વનો આનંદ

લઈ રહ્યા છે; તેમાં કોઈ પરિવર્તનની કે પ્રગતિની જરૂર નથી. અનંત સત્તની સ્વભાવ વડે જે વ્યવસ્થિત આવિભાગની અથવા કાર્યાન્વિત બનેલી શક્યતાઓના ક્રમની જરૂર હોય છે, તેને અસંખ્ય પરિવર્તનો, રૂપોના અસંખ્ય સમૂહો, ચેતનાની ટાઇપો, આપણી આસપાસ દેખાતા સ્વભાવો પૂરા કરતાં હોય છે. સુષ્ટિમાં બીજી કોઈ વસ્તુ દ્વારા સિદ્ધ થઈ શકે તેવો હેતુ નથી, ન હેઈ શકે, કારણું અનંતમાં બધુંજ હાજરાહજૂર છે. ભગવાનને કોઈ વસ્તુ પ્રામ કરવાની જરૂર નથી, કે જે તેમની પાસે ન હોય. જો સુષ્ટિ અને આવિભાગ થયાં હોય, તો તે સુષ્ટિના અને આવિભાગના આનંદ માટે છે, કોઈ હેતુ માટે નહિ. તો પછી, જેમાં કોઈ શિખરને સર કરવાનું હોય, કોઈ હેતુ સિદ્ધ કરવાનો હોય, આખરી પરિપૂર્ણતા માટે આવેગ હોય તેથી ઉત્કાન્તિમય ગતિ માટે કોઈ કારણ રહેતું નથી. ”

( દિવ્ય જીવન, પૃષ્ઠ ૮૨૬-૮૭ )

શ્રી અરવિંદ આ દલીલ રજૂ કરે છે તે મુજબ, સમસ્યા પ્રત્યે જોવાનો અને તેનો ઉકેલ લાવવાનો એ એક પ્રકાર છે. પણ તેનો અર્થ એવો નથી કે આ તેમનું પોતાનું દૃષ્ટિબિન્દુ છે, તે હંમેશાં પોતાના ગ્રંથમાં તે પ્રમાણે જ કરતા આવ્યા છે. તે બિનન બિનન દલીલો, દૃષ્ટિબિન્દુઓ, જ્યાલો રજૂ કરતા હોય છે. તેમને આપણી સમક્ષ મૂકુંગ પછી, તે આપણને ઉકેલ આપતા હોય છે, તેથી આપણા વાચનની પદ્ધતિમાં એક ખામી આવી જાય છે, કારણું હું તમારી સમક્ષ એક ફૂકરો વાંચું અને ત્યાં અટકી જાઉં, તો એમ લાગે કે તેમણે તેમનું દૃષ્ટિબિન્દુ સિદ્ધ કર્યું છે. પછી જો અકસ્માત તમે તે યાદ ન રાખી શક્યા હો, અને બીજી વખત હું બીજો ફૂકરો વાંચું, જેમાં તે બીજા જ દૃષ્ટિબિન્દુને સમજવતા હોય છે. કેટલીક વાર તદ્દન બિજ્ઞ અને કેટલીક વાર તદ્દન વિરોધી, તો એવો નિષ્કર્ષ તારવવામાં આવે કે આ પણ તેમનું દૃષ્ટિબિન્દુ છે. પરિલામે તે તેમાં વિરોધ ભાસે છે. પછી જો આપણે આગળ વાંચવાનું ચાલુ રાખીએ, તો બે કે નાણ વિરોધી ઉભા થઈ જાય છે! આ હું તમને એટલા માટે કહું છું કે મેં એવા ઘણા લોકોને સાંભળ્યા છે, કે જેમણે તે ગ્રંથનું વાચન ઉપરચેટિયા રીતે કર્યું હોય અથવા પૂરતું ચાલુ વાચન ન કર્યું હોય, જે પોતાની જતને બહુ બુદ્ધિશાળી અને વિદ્વાન માનતા હોય, તેઓ કહેતા હોય છે કે “ શ્રી અરવિંદ પોતાના ગ્રંથમાં બધો સમય પુનરુક્તિ જ કરતા હોય છે! તે લગભગ દરેક ફૂકરામાં તેની તે જ વાત કહેતા હોય છે. ” ( માતાજી હસે છે. ) કારણું તેઓ બધાં બીજાં દૃષ્ટિબિન્દુઓ રજૂ કરતા

હોય છે, પછી તે પોતાનું દૃષ્ટિબિદુ રજૂ કરતા હોય છે, જે નિષ્કર્ષરૂપ હોય છે. પછી ફરી વળી તે દરેક દૃષ્ટિબિદુ રજૂ કરતા હોય છે, બધી સમસ્યાઓ રજૂ કરતા હોય છે, અને આખરે પોતે જે આપણને શ્રીભવાડવા માગતા હોય તે સત્ત્યને સિદ્ધ કરતા હોય છે, આમ તે પુનરુક્તિ કરતા હોય છે!

આ જગતમાં ફસાઈ ન જવાય તે માટે ભાણસે તે ગ્રંથને ખૂબ ધ્યાનપૂર્વક વાંચવો જોઈએ. વિષયની વચ્ચમાં નિષ્કર્ષ ન તારવવા માટે ભાણસે દરકાર બેવી જોઈએ, પોતાની જતને એમ ન કહેવું જોઈએ કે જૂઓ, ક્રી અરવિદ પોતે આ પ્રમાણે કહે છે. તે પોતે એમ નથી કહેતા હોતા, તે તેઓ એમ કહેતા હોય છે કે કેટલાક લોકો કહે છે કે આ વસ્તુ આમ છે. ધ્યાન લોકો જે રીતે સમસ્યાની રજૂઆત કરતા હોય છે, તે રીતે તે સમસ્યાને જતાવે છે. વળી પાછા બીજા લોકો તે સમસ્યાની જે રીતે રજૂઆત કરતા હોય છે તેને તે જતાવતા હોય છે. આમ બધાં દૃષ્ટિબિદુઓ સમજાવ્યા પછી તે પોતાનો નિષ્કર્ષ રજૂ કરતા હોય છે, ખૂબ રસપ્રદ વાત તો એ છે કે તેમનો નિષ્કર્ષ હંમેશાં સમન્વયરૂપ હોય છે. બીજાં બધાં દૃષ્ટિબિદુઓ જો બરાબર વ્યવસ્થિત હોય, તો તેમના નિષ્કર્ષમાં તેમને સ્થાન મળતું હોય છે. તેમાં કેંઠ વસ્તુ બાકી રહી જતી નથી. તે દરેક વસ્તુને મિશ્રિત કરે છે, અને બધાં દૃષ્ટિબિદુઓનો સમન્વય સાધ્ય છે.

પણ આપણો વર્ગ દર નાણ અછવાડિયે ચાલતો હોય છે; એટલે પહેલાં વાંચેલું ભુલી જવા માટે આપણને પૂરતો સમય મળી રહે છે! (હસાહસ) જે સમસ્યા ગઈ વખતે રજૂ કરવામાં આવી હતી તે તમને યાદ છે કે નહિ, તે હું જાણતી નથી. યાદ નથી ને?

વ્યક્તિત્વની ઉત્કાન્ત છે કે નથી? ક્રી અરવિદે જતાન્યું છે કે, વૈશ્વિક ઉત્કાન્ત છે. પણ આ વૈશ્વિક ઉત્કાન્તમાં વ્યક્તિત્વની ઉત્કાન્ત છે કે નહિ? આપણને તેમણે એક સિદ્ધાંત આપ્યો છે, જે પરિપૂર્ણ રીતે સંગઠિત છે, તદ્દન તર્કયુક્ત છે, પણ જેમાં વ્યક્તિત્વની ઉત્કાન્તમાં માનવું તદ્દન જરૂરી નથી. સર્વ વૈશ્વિક યોજના તર્કયુક્ત છે, તેને તર્કયુક્ત રીતે સિદ્ધ કરી શકાય તેમ છે અને તે પણ વ્યક્તિત્વની ઉત્કાન્તને દાખલ કરવાની જરૂરિયાત સિવાય.

પણ જે ધીરજપૂર્વક આગળ વાંચવાનું ચાલુ રાખીશું, તો થોડા જ સમયમાં તે આપણને સિદ્ધ કરી જતાવશે કે, શા માટે જે સમજૂતીની પદ્ધતિ પસાંદ કર-

વામાં આવી છે તેમાં વ્યક્તિગત ઉત્કાન્તિના ઘ્યાલને દાખલ કરવો જ પડ્યો. પણ હું એ જાણવા માણું છું કે, તમારે માટે આ સમસ્યામાં કોઈ વાસ્તવિકતા છે કે નહિ, તમે જે કાંઈ સમજો છો તેને તે સંગત છે કે નહિ. જો તમે તે સમજ્યા હોશો, તો પ્રગતિશીલ, ઉત્કાન્તિ થતા વિશ્વનો એવો ઘ્યાલ કરવો શક્ય છે, કે જેમાં વ્યક્તિ વ્યક્તિગત રીતે ઉત્કાન્ત થાય છે તેવી કોઈ જરૂરિયાત નથી.

મારે તો પ્રથમ તમને પ્રશ્નો પૂછીને જાણો લેવું જોઈએ કે વૈશ્વિક ઉત્કાન્તિ અને વ્યક્તિગત ઉત્કાન્ત વચ્ચેનો તફાવત તમે સમજો છો કે નહિ, અને તે બંને ઉત્કાન્તિઓ કેવી રીતે થતી હોય છે.

પ્રકૃતિ પોતાની વૈશ્વિક ઉત્કાન્તમાં કેવી રીતે આગળ વધે છે? હું માનું છું કે તમે આ સમજ લીધું છે, નહિ વારું?

માણુસ જન્મે છે અને મરી જય છે, શારીરિક રીતે. બરાબર ને?

હા, હું બાબુ જગત વિષે, આપણે તેને જોઈએ છીએ તે ભૌતિક જગત વિષે વાત કરી રહી છું.

માણુસ મરી જય છે અને ફરી જન્મે છિ.....

ના, એ બોલ વસ્તુ છે. તમે કહો છો કે, માણુસ મરે છે અને ફરી જન્મે છે, વળી પાછો મરે છે અને ફરી જન્મે છે એ વ્યક્તિગત ઉત્કાન્તિની પ્રક્રિયા છે; તો જન્મ-મરણમાં વ્યક્તિત્વનું કોઈક તત્ત્વ ચાલુ રહેનું હોય, કારણકે જો તે તદ્દન મરી જય, તેનું પૂરેપૂરું વિધટન થઈ જય, તો કયી વસ્તુ ફરી જન્મે? અવશ્ય અમુક વસ્તુએ મુનર્જિમોમાં ચાલુ રહેનું જ જોઈએ; નહિ તો તે તે જ વ્યક્તિ ન રહે. જો કાંઈક અવશ્યિક ચાલુ ન રહેનું હોય, તો વ્યક્તિ વિકાસ નથી કરતી, પણ પ્રકૃતિ વિકાસ કરે છે. પ્રકૃતિ પદાર્થ તત્ત્વનો ઉપયોગ કરે છે, તે પદાર્થ તત્ત્વ વડે તે રૂપોનું નિર્માણ કરે છે, હું તમને આ વાત ખૂબ સરળ રીતે કહી રહી છું, પણ દ્શાંયે તેની પાસે હજી પદાર્થ તત્ત્વનો મોટો સમૂહ પડી રહેલો હોય છે, અને પ્રકૃતિ તેમનાં સંમિક્ષાણો, સંયોગીકરણો કરે છે. તે એક રૂપનું નિર્માણ કરે છે, પછી તે રૂપ વિકાસ પામે છે, પણ તેનું વિધટન થાય છે, વ્યક્તિગત તત્ત્વ તરીકે તે ચાલુ રહેનું નથી. તે કેમ ચાલુ નથી રહેનું? કારણકે પ્રકૃતિ ને પદાર્થ-તત્ત્વની જરૂર હોય છે, બીજાં રૂપોનું નિર્માણ કરવા માટે જામગ્રીની જરૂર હોય છે.

તેથી તે નિર્માણ કરેલી વસ્તુનું વિધટન કરે છે, તેમાંથી તે બીજી વસ્તુનું નિર્માણ કરે છે, તે આ ચેતે પોતાનું કાર્ય ચાલુ રાખે છે, આમ અનિશ્ચિત મુદ્દત માટે તે ચાલુ રહી શકે. પણ તેમાં વ્યક્તિ પ્રગતિ નથી કરતી, સમગ્ર (વિશ્વ) પ્રગતિ કરી રહ્યું હોય છે.

ધારો કે તમારી પાસે ચોડુંક ખેસટીસીન છે. તમે મોઢેલ નમૂનો બનાવવા માટે ખેસટીસીનનો ઉપયોગ જાણો છો, નહિ વારુ? તમે એક રૂપ બનાવો છો. તે પૂરું કર્યા પછી, તમને તે રૂપ નથી ગમતું. એટબે તમે તેને ભાંગો નાખો છો, અને ખેસટીસીનનો ફરી રગડો બનાવો છો, અને બીજા કોઈ રૂપનું નિર્માણ કરો છો. તમે કાંઈક પ્રગતિ કરી છે, તમે પ્રયત્ન કરો છો, ગોઠવણી કરો છો. તમે કહો છો કે, તે બરાબર ન હતું, હવે હું આ રૂપનું નિર્માણ કરવા પ્રયત્ન કરીશ. બીજું રૂપ જરાક વધારે સારું બને છે, પણ તે તમને સંતોષ આપી શકતું નથી. એટબે ફરી વાર તમે તેને ભાંગો નાખો છો, તેમાં ચોડુંક પાણી રડો છો, તેનો રગડો બનાવો છો, અને બીજા રૂપનું નિર્માણ કરવાની શરૂઆત કરો છો. અનિશ્ચિત મુદ્દત સુધી તમે આમ કર્યા કરો છો. પદાર્થતત્ત્વ તેનું તે જ હોય છે, પણ તે સત્ત્વ એકનું એક નથી હોનું, કારણકે દરેક રૂપને તેનું પોતાનું ખાસ અસ્તિત્વ હોય છે; જ્યારે તમે તેને ભાંગો નાખો છો, ત્યારે કશું જ અવશિષ્ટ રહેતું નથી.

તમે તે જ રૂપને પરિપૂર્ણ બનાવવાનો પ્રયત્ન કરી શકો છો. અથવા બીજાં રૂપોનું નિર્માણ કરી શકો છો. દા. ત. તમે એક ઝૂતરો કે ઘોડો બનાવવાનો પ્રયત્ન કરો છો. જો તમે તેમાં સફળ ન થયા હો, તો તમે ફરી શરૂઆત કરીને બીજો ઘોડો કે ઝૂતરો બનાવી શકો છો. પણ તમે બીજું કાંઈક બનાવવાની શરૂઆત પણ કરી શકો છો. તમે ઘર બંધાવો અને જો તે તમને પસંદ ન આવે, તો તેને તોડી પાડીને તમે બીજા નમૂનાનું ઘર બંધાવી શકો છો. પણ પહેલા ઘરની સ્મૃતિ સિવાય, તેનું કંઈક અવશિષ્ટ રહેતું હોનું નથી અને તે સ્મૃતિ પણ જો તમે રાખવા માગતો હો તો. તે જ ચેતે પ્રકૃતિ તદ્દન અચૈતન અને ઘાટ વગરના પદાર્થતત્ત્વથી શરૂઆત કરે છે, પછી એક અને બીજું રૂપ નિર્માણ કરવાનો પ્રયત્ન કરે છે, આપણે તો એક સમયે એક રૂપનું નિર્માણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ પ્રકૃતિ એકી વખતે કરોડો રૂપોનું નિર્માણ કરતી હોય છે. પણ તે તો માત્ર સ્કેર્લની બાબત છે, કારણકે પ્રકૃતિ પાસે વિપુલ સાધનો છે, માત્ર એટલું જ. પણ તેથી એમ સૂચિત નથી થતું કે કાંઈક વસ્તુ સ્થાયી છે, પ્રાણતત્ત્વ

અથવા ચેતનાના તત્ત્વ જેવી કે જે રૂપમાં પ્રવેશે છે, અને જ્યારે રૂપ ભાગી જાય ત્યારે બીજા રૂપમાં પ્રવેશ કરે છે. તમે જેમ ખેસ્ટીસીન સાથે કરતા હો છો, તેના જેવું જ તે માત્ર બની રહે. તમે એક નમૂનો બનાવો છો, તેને ભાગી નાઓ છો. ફરી બીજો નમૂનો બનાવો છો અને વળી પાછો તેને ભાગી નાઓ છો. તેમાંનું કશું જ અવશિષ્ટ રહેતું નથી, સિવાય કે પહેલાં બનાવેલા નમૂનાની સમૃતિ પણ. જો આપણે વ્યક્તિત્વને કબૂલ રાખીએ, તો કેંદ્રિક સ્થાયી વસ્તુ એક રૂપમાંથી બીજા રૂપમાં સંકાન્ત થાય છે, દરેક રૂપ સાથે તે નવીન પ્રગતિ કરે છે, ઉચ્ચતર રૂપમાં પ્રવેશવા માટે સર્વાં બને છે, વધારે ને વધારે રૂપમાં પ્રવેશવા શક્તિમાન બને છે. અને તે ત્યાં સુધી કે જ્યારે આ 'કાંઈક' ઉત્કાન્તિના અંતમાં એક પરિપૂર્ણ રીતે સચેતન પ્રાણી બની રહે છે. ત્યારે આ પ્રાણીની અંગત ઉત્કાન્ત થતી હોય છે, કે જે દ્વિગુણિત બને છે. સ્વતંત્ર રીતે નહિ, પણ એકી જ વખતે અને પ્રકૃતિની ઉત્કાન્તિનું પૂર્ક બની જાય છે, અથવા પ્રકૃતિની ઉત્કાન્તિનો, પોતાની વ્યક્તિત્વ ઉત્કાન્તિના ક્ષેત્ર માટે, ઉપયોગ કરે છે. આ વખતે તમે આ વાત સમજ્યા ? સરસ.

અહીં કી અરવિદે એવા એક જગતની સમજૂતિ આપી છે કે જે એક રૂપમાંથી બીજા રૂપમાં જતી વ્યક્તિત્વની જરૂરિયાત સિવાય, સર્વ વિનાશમાંથી, મૃત્યુમાંથી મુક્ત એવા કેંદ્રિક સ્થાયી તત્ત્વ સિવાય પોતાનાં બધાં રૂપોમાં ચાલુ રહે અને પ્રકૃતિની ઉત્કાન્તિને સમાંતર એવી અંગત, વ્યક્તિત્વ પ્રગતિ કરે, અને જે જગત તદ્દન તર્કપુરુષ રીતે અને વિશાળતાપૂર્વક પોતાનું કાર્ય કરે તે વાત આના જેવી છે કે ખેસ્ટીસીનથી બનાવેલા રૂપની મધ્યમાં તમે એક ક્રીમતી હીરો મૂક્યો હોય અને તે હીરાને તમે કમિક રૂપોથી આદ્યાદિત કર્યો હોય. તમે તે ક્રીમતી હીરાને એક રૂપમાંથી બીજા રૂપમાં સંકાન્ત કરતા રહો છો. આ સરખામણી હજુ પણ અપૂર્ણ છે, કારણે આ હીરા તો જેમ જેમ તે એક રૂપમાંથી બીજા રૂપમાં સંકાન્ત થાય છે, તેમ તેમ વધારે ને વધારે ક્રીમતી બનતો જતો હોય છે, વધારે ને વધારે તેજસ્વી, વિશુદ્ધ અને રૂપમાં નિશ્ચિત બનતો જતો હોય છે.

તમે સમજો છો કે નહિ ?

થોડુંક.

થોડુંક ? ઠીક, તો તો કાંઈક પ્રાપ્તિ થઈ કહેવાય.

ઉપસંહારમાં હું પૂછું છું કે વ્યક્તિગત ઉત્કાંતિ થતી હોય છે કે નહિ? તમે શું ધારો છો? તમને તેનો કશો અનુભવ છે ખરો? તે અનુભવ તમને કેવી રીતે પ્રાપ્ત થયો? તે રસપ્રદ બની શકે તેમ છે. વ્યક્તિગત ઉત્કાંતિ, પ્રકૃતિની સામૂહિક ઉત્કાંતિથી અલગ, કેવી રીતે અનુભવી શકાય?

તમે જવાબ આપો શકશો?

જ્યાં સુધી માણસ પોતામાં રહેલા સનાતન તત્ત્વથી જ્ઞાન ન બને, ત્યાં સુધી...

સરસ, બહુ સરસ. એ તો બરાબર છે. પણ તો તો મારે પૂછવાનું રહે છે કે તમારા અસ્તિત્વમાં રહેલા આ સનાતન તત્ત્વથી તમે જ્ઞાન છો ખરા?

\*

## ૪ ડિસેમ્બર ૧૯૫૭

“હકીકતમાં આપણે જોઈએ છીએ કે સૂચિનાં તત્ત્વો આપી અને અપરિવર્તનશીલ હોય છે. અસ્તિત્વની દરેક ટાઈપ જેવી હોય છે તેવી જ રહે છે, પોતે છે તેના કરતાં બીજી ટાઈપ બનાનો તે પ્રયત્ન કરતી નથી, તેને તેમ કરવાની જરૂર નથી. એમ માની બઈએ કે અસ્તિત્વની અમુક ટાઈપો અદૃશ્ય થઈ જતી હોય છે અને તેમની જગ્યાએ બીજી અસ્તિત્વમાં આવતી હોય છે, તો તેનું કારણ એ છે કે વિશ્વમાં રહેલી ચેતના શક્તિ પોતાના જીવન આનંદને તે રૂપોમાંથી પાછો જેંચી બે છે. અને તેથી તે નાશ પામે છે; પણ તે ચેતના શક્તિ આનંદ માટે બીજાં રૂપોનું સર્જન કરવા તરફ વળે છે, પણ દરેક ટાઈપ જ્યાં સુધી ટકી રહે છે, ત્યાં સુધી તેને પોતાનો એક નમૂનો હોય છે, અને થોડાં ઘણાં ગૌણ પરિવર્તનો સાથે, તે પોતાના નમૂનાને વહ્ફાદાર રહે છે. તે પોતાની ચેતના વડે બંધાયેલી હોય છે, તે બીજાની ચેતનામાં જઈ શકતી નથી. પોતાના સ્વભાવથી મર્યાદિત હોવાને કારણે, તે આ મર્યાદાઓને વટાવી જઈ શકતી નથી, બીજનો સ્વભાવ ધારણ કરી શકતી નથી. જો અનંતની ચેતના શક્તિએ પદાર્થ તત્ત્વને પ્રગટ કર્યા પછી પ્રાણું પ્રગટ કર્યો છે, અને પ્રાણુને પ્રગટ કર્યા પછી મન પ્રગટ કર્યું છે, તો તે હવે પછીની

પાર્થિવ સુષ્ટિમાં અતિમનસુ પ્રગટ કરશે જ એવું નથી. કારણુકે મન અને અતિ-  
મનસુ ભિન્ન ભિન્ન ગોળાઈનું છે. મન અજ્ઞાનના નિમ્નના દરજાનું છે, અતિ-  
મનસુ દિવ્ય જ્ઞાનના ઉચ્ચતર દરજાનું છે. આ વિશ્વ અજ્ઞાનનું છે, અને તે તે  
પ્રકારનું જ રહે તેવો ઈરાદો રાખવામાં આવેલો છે. અસ્તિત્વના નિમ્નના ગોળાઈમાં  
ઉચ્ચતર ગોળાઈની શક્તિઓને નીચે લાવવાનો ઈરાદો હોવો જ જોઈએ એવું નથી,  
અથવા તેમની નિગૃદ્ધ હાજરી નિમ્નના ગોળાઈમાં પ્રગટ કરવાનો ઈરાદો હોવો  
જોઈએ એવું નથી. જે તે ઉચ્ચતર શક્તિઓ અહીં અસ્તિત્વમાં હોય તે પણ તે  
ગૂઢવાઈ, બીજમાં સંકાન્ત ન કરી શકાય તેવા અંતર્યામીપણા રૂપે છે, માત્ર પ્રાણ  
સુષ્ટિને ટકાવી રાખવા માટે છે, તેને પરિપૂર્ણ બનાવવા માટે નહિ. આ અજ્ઞાનમય  
સુષ્ટિનું માનવ એ શિખર છે. પોતે જેને માટે સર્વાંહનો હતો તેવી વધારેમાં વધારે  
ચેતનાને અને જ્ઞાનને તેણે પ્રાપ્ત કર્યા છે. જે તે આગળ જવા પ્રયત્ન કરશે, તો  
તે પોતાની માનસિકતાનાં વિશ્વાના વર્તુળોમાં ગોળ ગોળ ફર્યા કરશે. કારણુકે અહીં  
તેના અસ્તિત્વનો તે જ વળાંક છે, તે એક સીમિત ગોળ-ગોળ ફર્વાની કિયા છે  
જે મનને ગોળ ગોળ ફેરવે છે અને જ્યાંથી મને પ્રારંભ કર્યો હતો તે બિંદુએ  
જ લાવીને ફરી મનને મૂકો આપે છે. મન પોતાના વર્તુળથી બહાર જઈ શકે  
તેમ નથી. ગતિની સ્ત્રીધી રેખાનો, અનંત શીતે ઊર્ધ્વમાં પહોંચવાની પ્રગતિનો,  
અથવા બાજુએ ગતિ કરી અનંતતાને પ્રાપ્ત કરવાનો વિચાર એક ભ્રાન્તિ છે. જે  
માણસનો આત્મા માનવતાથી પર જવાનો હોય, અતિમાનસિક અથવા તેથી પણ  
ઉચ્ચતર સ્થિતિને પહોંચવાનો હોય, તો તેણે આ વૈશ્વિક અસ્તિત્વમાંથી આનંદની  
અને જ્ઞાનની ભૂમિકા પર અથવા અપ્રગટ સનાતન અનંતમાં ચાલ્યા જવું જોઈએ ”

( દિવ્ય જીવન, પૃષ્ઠ ૮૭-૮૮ )

હકીકતમાં તમારે થોડીક તૌધારી કરી લેવી જોઈએ, દરેક નવા ફકરામાં  
આવતા નવા વિચારની નોંધ કરી લેવી જોઈએ અને તેને પહેલાં આવી ગયેલા  
વિચારોમાં ઉમેરી દેવો જોઈએ, જેથી પ્રકરણને અંતે તમે સંપૂર્ણ ચિત્રને પ્રાપ્ત કરી  
શકો. કારણુકે મેં હમણાં જે વાંચ્યું તે વિષે તમે મને પ્રશ્ન પૂછ્યો તો કેટલીક  
વાર તે પ્રશ્નનો જવાબ આપો હોય કે જે આપણે પહેલાંના ફકરામાં જેણું હતું  
તેનાથી વિરુદ્ધ હોય. શ્રી અરવિંદની પ્રમાણ આપવાની પદ્ધતિ તેમાં કારણભૂત  
છે. તે એવું છે કે જાણે શ્રી અરવિંદ પોતાની જતને અમૃક ક્ષેત્રના કેન્દ્રમાં મૂકતા  
હોય છે, એગો એક ચકની નાભિમાં મૂકતા હોય છે કે જેના આરાઓનો અંત

પરિધમાં હોય છે. તે હંમેશાં પોતાના પ્રારંભ બિદુએ પાછા જતા હોય છે, પાછા આખી સપાદી પર જતા હોય છે, જેથી એવો ઘ્યાલ આવે છે કે તે અનેક વાર એક જ વસ્તુની મુનરાવૃત્તિ કરે છે; પણ તે માત્ર વાચક તે વિચારને સમજી શકે તે માટે તે વિચારની સમજૂતિ હોય છે. તે જે કહેતા હોય છે તે સાથી રીતે સમજવા માટે વાચકમાં ખૂબ સ્થળ સમૃતિ હોવી જરૂરી છે.

હું આ વાત પર ભાર મૂકું છું, કારણકે, જે તમે પદ્જતિપૂર્વક આગળ નહિ વધો તો વાચનમાંથી તમે બહુ લાભ પ્રાપ્ત નહિ કરી શકો. એ તમને લૂલાલૂલામણી જેવું લાગશે, જેમાં માણુસને પોતાનો રસ્તો જડતો હોતો નથી. સર્વ વિચારોને કેન્દ્રમાં સંયુક્ત કરવામાં આવે છે, અને પરિધમાં તે તદ્દન બિન્ન બિન્ન દિશાઓમાં જતા હોય છે.

તમારે કોઈ પ્રશ્ન પૂછવાનો છે? નથી.

આ અધારું છે, નહિ વારું? હું વાંચી ગઈ અને હું બરાબર જોઈ શકું છું કે પ્રશ્ન પૂછવો એ કઠિન છે, કારણકે જ્યાં સુધી તે પ્રમાણના અંતભાગ સુધી આવતા નથી, ત્યાં સુધી કી અરવિંદ કર્યાં દોરી રહ્યા છે અથવા શો બોધ આપવા ઈચ્છે છે તેની વાચકને બબર પડતો નથી. વળી જે વાચક આખી સમજૂતિ વાંચી જાય અને જે તેની સમૃતિ બહુ સારી ન હોય, તો તે બધા મુદ્દાઓને યાદ રાખી શકતો નથી. અંત ભાગ સુધી પહોંચવા પહેલાં વાચક પ્રારંભમાં વાંચ્યું હોય છે તેને તે ભૂલી ગયો હોય છે! ટૂંકી નોંધો વેવી, દરેક ફૂકરાનો સાર એક કે બે ચાવી રૂપ વિચારોમાં ટૈપ કરાવી વેવો, જેથી તેમની સરખામણી કરી શકાય, એ રસપ્રદ છે.

( મૌન )

અહીં કી અરવિંદ કહે છે કે દરેક જાતિ પોતાની જાતિનાં ખાસ લક્ષણોથી, પોતાના બંધારણનાં તરવેથી સંતોષ માનતી હોય છે, અને પોતાની જાતને કોઈ નવીન જાતિમાં પરિવર્તિત કરવી એ નેને ગમતું હોન્નું નથી. કૂતરો કૂતરો રહેવામાં જ સંતોષ માનતો હોય છે, ઘોડો ઘોડો રહેવામાં જ સંતોષ માનતો હોય છે, તે કટી હાથી બનવાનો પ્રયત્ન કરતો હોતો નથી! આનાથી શરૂઆત કરીને, કી અરવિંદ પૂછે છે કે માણુસ માણુસ રહેવામાં જ સંતોષ માનશે, કે પછી તે અતિ-માનવ બનવાની જરૂરિયાત પ્રયત્ને જગૃત થશે?

હકરાનો આ સાર છે.

પણ જ્યારે વાચક આ પ્રકારની સમજૂતિઓથી ટેવાઈ ગયો હોય છે, જે તેનામાં ચિંતનશીલ મન હોય છે, તો આ વાચ્યા પછી પોતાના અસ્તિત્વમાં રહેલા કોઈક તત્ત્વને સંતોષ થતો નથી. અર્થાત્, આ ખૂબ બાધ્યરૂપ સાથે સંબંધિત છે, અસ્તિત્વના ઉપલા કોચલા સાથે સંબંધિત છે, પણ માલુસ પોતાની અંદર એવી કોઈક ચીજ અનુભવતો હોય છે, જેનામાં તે રૂપથી પર જવાનું અનિવાર્ય પણ હોય છે. શ્રી અરવિંદ એ વસ્તુ આપણા મન પર ઠસાવવા માગે છે.

મેં એવાં પાળેલાં પશુઓ જેયાં છે, જેમનામાં પોતે છે તેના કરતાં બીજું કંઈક બનવાની એક પ્રકારની, આંતર જરૂરિયાત સાચી રીતે હતી. મેં તે પ્રકારનાં કૂતરાં, બિલાડીઓ, ઘોડા, અને પંખીઓને પણ જોયાં છે. બાબુ રૂપ તો અનિવાર્ય રીતે જે હતું તે જ હતું પણ તે પશુમાં એવું કંઈક જીવંત અને દ્વિટગોચર હતું, કે જે બીજી અભિવ્યક્તિ, બીજું રૂપ પ્રામ કરવા માટે સ્પષ્ટ પ્રયત્ન કરી રહ્યું હતું. જે માલુસ પશુ માનવની સ્થિતિશી પર બની ગયો છે, અને સાચી રીતે માનવ બન્યો છે, તેનામાં આ તદ્દન અસંતોષપ્રદ અધ્યપશુથી, અભિવ્યક્તિમાં, અભિવ્યક્તિનાં સાધનોમાં, અને જીવનનાં સાધનોમાં અસંતોષપ્રદ સ્થિતિમાંથી કંઈક બીજું બનવાની ખૂબ પ્રબળ, અનિવાર્ય જરૂરિયાત હોય છે. એટલે સમસ્યા રહ્યો છે; શું આ અતિ પ્રબળ જરૂરિયાત પોતાના રૂપ માટેની, જાત માટેની અભીષ્ટામાં, પોતાની જાતને વિકસાવીને પરિવર્તિત કરવા માટે પૂરતી અસરકારક નીવડશે? અથવા શું આ અસ્તિત્વમાં રહેલી અપર ચેતના, આ રૂપનો નાશ થતાં, કોઈ ઉચ્ચતર રૂપમાં પ્રવેશ કરી શકશે, કે જે રૂપ હજી અસ્તિત્વમાં આવ્યું નથી?

આપણી સમક્ષ આ સમસ્યા છે; આ ઉચ્ચતર રૂપનું સર્જન કેવી રીતે થશે?

જે આપણે આ સમસ્યાનો વિચાર કરીએ, તો તે ખૂબ રસપ્રદ બની રહેશે. જેની કલ્પના કરવી પડશે તેવી કોઈ પ્રક્રિયા વડે, શું આ રૂપ ધીમે ધીમે પોતાનું જાતનું રૂપાંતર કરશે જેથી નવરૂપનું સર્જન થઈ શકે, કે પછી હજી સુધી આપણને અજ્ઞાત એવાં કોઈ સાધનો વડે આ નવું રૂપ આ જગતમાં પ્રગટશે?

અર્થાત્ સાતથ્ય જ ચાલુ રહેશે કે પછી કોઈ નવીન વસ્તુ ઓચિતી પ્રગટ થશે? આપણે અત્યારે જે છીએ અને આપણે અંતરાત્મા ને બનવાની અભીષ્ટા

કરી રહ્યો છે તે વચ્ચે કોઈ પ્રગતિશીલ પરિવર્તન થશે, કે પછી આપણને આ અત્યારનું માનવ રૂપ છોડી દેવાની ફરજ પડશે, જે રૂપના પ્રાગટ્યની પ્રક્રિયા આપણે આગળથી જોઈ શકતા નથી અને નવીન રૂપના પ્રાગટ્ય માટે રાહ જોવી પડશે, અને જેને આપણે અત્યારે જે છીએ તેની સાથે કોઈ સંબંધ નહિ હોય? આપણે એવી આશા રાખી શકીએ કે પાઠ્ય આવિજ્ઞાવમાંના આપણા અત્યારના સાધનરૂપ આ શરીરમાં એવી શક્યતા આવશે કે જેથી પ્રગતિમય રીતે આ શરીર પોતાની જતનું એવા કોઈ રૂપમાં રૂપાંતર કરે કે જે રૂચ્યતર જીવનને અભિવ્યક્ત કરવા માટે સમર્થ બને? કે પછી આપણે હજુ જે પુષ્ટી પર નથી તેવા કોઈ બીજા રૂપમાં પ્રવેશ કરવા માટે આ રૂપને છોડી દેવાની આપણને જરૂર પડશે?

આ સમસ્યા છે. તે બધું રસપ્રદ સમસ્યા છે.

જો તમે તેના પર વિચાર કરશો, તો તે તમને કાંઈક વધારે પ્રકાશ પ્રત્યે દોરી જશે. આપણે અત્યારે જ તેના પર વિચાર કરીએ.

(ધ્યાન)

જ્યારે આ વાર્તાવાપ પહેલી વાર પ્રગટ કરવામાં આવ્યો હતો, ત્યારે માતા-જીએ નોચેનાં કથનો તેમાં ઉમેર્યા હતાં :

બંને શા માટે નહિ?

બંને એકી સમયે હશે; એક બીજાને બાકાત રાખતું નથી.

હા, પણ એક રૂપ બીજામાં રૂપાંતરિત થશે?

એક રૂપનું રૂપાંતર થશે, અને બે બીજા રૂપની અપૂર્ણ રેખા હશે. જ્યારે આ અસ્તિત્વમાં આવશે, ત્યારે પરિપૂર્ણ રૂપ પ્રગટ થશે. કારણકે બંને રૂપોમાં પોતાનું આગળું સૌંદર્ય છે, પોતાનો હેતુ છે. એટલે બંને રૂપો ત્યાં હશે.

મન હંમેશાં પસંદ કરવાનો પ્રયત્ન કરે છે, પણ તે તે પ્રકારનું નથી. જે જવાની આપણે કલપના કરી શકીએ છીએ તેના કરતાં જે આવશે તે ઘણું અધિક હશે. સાચી રીતે કહીએ તો, જેનામાં તીવ્ર અભીસા છે અને આંતર ખાતરી છે, તે દરેક જણને, તેના સાક્ષાત્કાર કરવા માટે, આહુવાન કરવામાં આવશે.

સર્વત્ર, સર્વ ક્ષેત્રોમાં, હર્મેશાં, સનાતન રીતે, દરેક વસ્તુ શક્ય છે. જે વસ્તુ શક્ય છે, તે નિયત સમયે અસ્તિત્વમાં આવશે જ. તે સમયમાં થોડો ધારો વિલંબ થાય, પણ તે અસ્તિત્વમાં આવવાની જરૂર છે.

જેવી રીતે પણુંઓની અને માનવની વચ્ચે અનેક પ્રકારની શક્યતાઓ જરૂર છે જે શક્યતાઓ રહેવા પામી નથી, તે જ રીતે સર્વ પ્રકારની શક્યતાઓ ઉભી થશે. દરેક વ્યક્તિ પોતાની રીતે પ્રયત્ન કરશે. આ બધું ભાવિ સાક્ષાત્કાર માટેની તૈયારીમાં મદદકર્તા બનશે.

એવો સવાલ પૂછી શકાપ કે માનવજાતિ પૃથ્વીમાંથી અદૃશ્ય બની ગયેલી કેટલીક જાતિઓ જેવી હશે, કેટલીક જાતિઓ અદૃશ્ય થઈ ગઈ છે, જે માનવ જાતિ જેટલી લાંબો કાળ ટકી રહ્યો થતી નથી. હું એમ નથી માનતી. જે જાતિઓમાં પ્રગતિનું આ બીજ હતું, પ્રગતિની શક્યતા હતી, તે લુમ થઈ ગઈ નથી. આપણને એમ લાગે છે કે ઉત્કાનિત એક વળાંક લેશે, કે જે ઉચ્ચતર જાતિ પ્રત્યે વધુ ને વધુ જતિ કરે, અને જે નિમનતર જાતિઓની નજીક છે તે બધું ખરી પડે, જેવી રીતે તે જાતિઓ લુમ થઈ ગઈ હતી તેમ.

આપણે ભુલી જઈએ છીએ કે દરેક વસ્તુ શક્ય છે, ખૂબ વિરોધી વસ્તુઓ પણ શક્ય છે; પણ દરેક શક્યતાને અસ્તિત્વની કમથી કમ એક ક્ષાળ તો મળતી જ હોય છે.

\*

## ૧૧ ડિસેમ્બર ૧૯૫૭

“ ભવિષ્યમાં એવી શોધ કરવામાં આવે કે, અમુક રાસાયણિક અથવા બીજી સ્થિતિઓમાં જીવન પ્રગટ થાય છે, તો તે સહ-ચરણ વડે એટલું જ સિદ્ધ થશે કે, અમુક ભૌતિક સંજોગોમાં પ્રાણ-જીવન પ્રગટ થાય છે, નહિ કે અમુક રાસાયણિક સ્થિતિઓ પ્રાણનાં ઘટક તત્ત્વો છે, અથવા જડ પદાર્થતત્ત્વોનું સચેતન પદાર્થ-તત્ત્વમાં દૃપાંતર કરવામાં ઉત્કાનિતમય કારણ છે. અહીં, બીજી ભૂમિકાઓની પેઠે,

અસ્થિત્વની દરેક ભૂમિ પોતામાં અને પોતા વડે રહેલી છે, પોતાના સ્વભાવ વડે, પોતાની યોગ્ય શક્તિ વડે પ્રગટ થતી હોય છે; તેની ઉપરની અથવા નીચેની ભૂમિકાઓ ઉદ્ગમ-સ્થાનો અને કમિક પરિણામો નથી હોતાં, પણ પાર્થિવ સ્વભાવના સતત સુદૂરભાગમાં માત્ર ડિશ્રીઓ-માત્રાઓ જ હોય છે.”

(દિવ્ય જીવન, પૃષ્ઠ ૮૮)

મધુર માતાજી, પ્રથમ માનવ કેવી રીતે પ્રગટ થયો?

૧.

અહીં શ્રી આરવિંદ તે જ વાત કહે છે કે, જે આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિબિદ્ધ લઈએ, તો આપણને જણાય છે કે, એક પછી બીજી સિદ્ધાંતો આવે છે અને ચાલ્યા જાય છે, તેમનામાં ખૂબ અસ્થિરતા હોય છે, તે સાબીત કરી શકાય તેવી વસ્તુઓ કરતાં વધારે અમુક પ્રકારની કલ્પનાઓ હોય છે. જે માણસ કેવળ ભૌતિકવાદી દૃષ્ટિબિદ્ધ સ્વીકારે તો પણ. માણસો માનતા હોય છે કે, તે ભૌતિક દૃષ્ટિબિદ્ધ હોવાને કારણે, તેને સિદ્ધ કરવું એ ખૂબ સહેલું છે; પણ સ્પષ્ટ રીતે તે વધારેમાં વધારે કઠિન હોય છે. જે આપણે ગૂઢવાદી દૃષ્ટિબિદ્ધ સ્વીકારીએ, તો તેમાં કદાચ અમુક સમૃતિઓ પર આધારિત પરંપરાઓ હોય છે; પણ તેને માટે કોઈ ભૌતિક પ્રમાણ આપી શકાતું નથી હોતું તે કારણે આ જ્ઞાન વૈજ્ઞાનિક કલ્પનાઓ અને અનુમાનો કરતાં પણ વધારે શંકાગ્રસ્ન મનાય છે. આંતર વિચારસરણને સમજવી અને કબૂલ રાખવી એ વધારે સહેલું છે, પણ તેમાંથે ભૌતિક સાબિતી કરતાં કોઈ અધિક સાબિતી નથી હોતી કે, પ્રથમ એક માનવ હતો, અથવા પ્રથમ ધ્યાન માનવો હતા, અથવા પ્રથમ એવું કાંઈક હતું કે જે માનવ ન હતો, પણ માનવ જેવું કાંઈક હતો. આ બધાં અનુમાનો છે, કલ્પનાઓ છે.

૧. “જે વિજ્ઞાન જેની સાથે કામ પાડે છે તે હકીકતો વિશ્વાસનીય હોય, તો તે જે સામાન્ય વિધાનો કરે છે તે અલ્યુમની હોય છે. તે વિધાનો તેમના ઉપર થોડાક દરશકાઓ સુધી, થોડીક સદીઓ સુધી પછે જમાવી રાખતાં હોય છે; પછી તેથી ખીલું સામાન્ય વિધાનો કરવા માંડે છે, વસ્તુઓનો ખીલે સિદ્ધાંત સ્થાને છે. આમ ભૌતિક વિજ્ઞાનમાં પણ ખાંડું હોય છે, જ્યાં હકીકતો વિષે સધન રીતે નિશ્ચય કરી શકાય તેમ છે, પ્રયોગો દ્વારા તેમને પુરવાર કરી શકાય તેમ છે....”

(દિવ્ય જીવન, પૃષ્ઠ ૮૮)

પરંપરાઓ મૌખિક હોય છે, વૈજ્ઞાનિક દૃષ્ટિબિન્દુથી તદ્દન શંકાસ્પદ હોય છે. પણ તે વ્યક્તિગત સમૃતિઓ પર આધ્યારિત હોય છે. કહે કે પ્રથમ માનવ, અથવા પ્રથમ માનવ-યુગથી, અથવા પ્રથમ માનવ વ્યક્તિઓ કોઈ ગુઢવાદી પદ્ધતિ અનુસાર ભૌતિક રૂપમાં લાવવામાં આવ્યાં હતાં, જે રીતની શ્રી અરવિંદ ભાવિ અતિમાનસિક પ્રક્રિયા માટે આગાહી કરે છે; અર્થાત् ઉચ્ચતર જગતોનાં પ્રાણીઓએ, એકાગ્રતાની અને ભૌતિકીકરણની પ્રક્રિયા દ્વારા, પોતાનાં ભૌતિક પદાર્થતત્ત્વનાં શરીરોનું નિર્માણ કર્યું છે. કદાચ નિમ્નતર જાતિઓએ પ્રગતિશીલ રીતે પ્રથમ માનવશરીરનું નિર્માણ કર્યું ન હતું.

આધ્યાત્મિક અને ગુઢવાદી જ્ઞાન અનુસાર, ચેતના રૂપથી આગળ હોય છે; ચેતના આત્મ-એકાગ્રતા વડે પોતાના રૂપનું નિર્માણ કરે છે. જ્યારે ભૌતિકવાદી વિચાર અનુસાર, રૂપ ચેતનાથી પહેલાં હોય છે અને ચેતના માટે પ્રગટ થવાનું શક્ય બનાવે છે. જે લોકોમાં અદૃશ્ય જગતોનું કોઈ જ્ઞાન છે અને શક્તિઓની લીલાનું સીધું દર્શાન છે, તેમને કોઈ શંકાનો અવસર નથી. ચેતના જ પોતાની જાતને પ્રગટ કરવા માટે રૂપનું નિર્માણ કરતી હોય છે. અત્યારે પૃથ્વી પર વસ્તુઓ જે રીતે જોડવાયેલી છે તે રીતે જોતાં, ચોક્કસ ઉચ્ચતર પ્રકારની ચેતના રૂપમાં પ્રવેશીને પોતાનું રૂપાંતર કરવામાં રૂપને મદદ કરતી હોય છે, જેથી, તરત જ અથવા તો કભિક પેઢીઓ દ્વારા, રૂપ તે ચેતનાને પ્રગટ કરવા સમર્થ બની શકે છે. જે લોકોમાં આંતર દર્શાના અને જ્ઞાન છે, તેમને માટે આ વસ્તુ નિઃશ્વંક છે. તે અન્યથા હોઈ જ ન શકે. પણ જે લોકો નીચલે છેઠેથી શરૂઆત કરે છે, તેઓ એ વાતને કંબૂલ નહિ કરે, પણ અજ્ઞાતને ડાખાપણને જ્ઞાન આપવાનો કોઈ અધિકાર નથી! અને છતાં અત્યારે અજ્ઞાત એમ જ કહી રહ્યું છે. જાણવા કરતાં શંકા કરવી તે વધારે સહેલું છે; એટલે માનવી મનને દરેક બાબતમાં શંકા કરવાની ટેવ પડી રહી છે. તે તેની પ્રથમ ગતિ છે, અને અલબંદ તેથી તે કશું જ જાણતું હોતું નથી.

એ તો નિશ્ચિત વાત છે કે વિચાર આવિલ્લાવથી અને અભિવ્યક્તિથી પહેલાં હોય છે. જે લોકોને ભૂતકાળ સાથે સીધો સંપર્ક છે તેઓને કોઈ માનવીય નમૂનાના પ્રકારની સમૃતિ હોય છે, જે વર્તમાન માનવ જાતિ કરતાં ધ્યાની કોઈ હોય છે. તે લોકો દૃષ્ટાંતરૂપે પૃથ્વી પર આવ્યા હતાં; તેઓ બતાવી આપતા હોય છે કે પરાકાણાં પહોંચેલી માનવ જાતિ કેવી હશે.

(મૌન)

જીવનમાં અનુકરણ કરવાનું એક વલલ હોય છે. પણ જીવનમાં આપણને ધ્યાન બેંચે તેવા દાખલા મળશે. વનસ્પતિ સુષ્પિતમાં પણ અનુકરણ કરવાનો પ્રારંભ થાય છે, પણ પણ જીવનમાં તે ધ્યાન બેંચે તેવું હોય છે. તેના ધણા દાખલા આંદોલન તે અર્થમાં આપણે એવો ધ્યાલ કરી શકીએ કે પણ જીવન આ આદર્શ ટાઈપ સાથે કાંઈક સામ્ય યેદા કરવાનો, તેનું અનુકરણ કરવાનો પ્રયાસ કરે છે, જે ટાઈપ ગૂઢવાદી સાધનો વડે પૃથ્વી પર પ્રગત થઈ શકે, અને કદાચ કંપિક પ્રથાસો દ્વારા, વધારે ને વધારે સહ્યોગ પ્રયત્ન દ્વારા, પ્રથમ માનવ ટાઈપોનું સર્જન થયું હતું.

\*

## ૧૮ ડિસેમ્બર ૧૯૫૭

માતાજી ‘દિવ્ય જીવન’ પૃષ્ઠ ૮૨૮ માંથી એક ફકરો વાંચે છે.

“આધુનિક વિજ્ઞાને એક સાચી મહત્વની વસ્તુની શૈખ કરી છે કે કેવળ બાબુ અને ભૌતિક દૃષ્ટિભિન્નુથી જોતાં, વસ્તુઓ જેવી હોવાનું હેખાય છે તેવી તે નથી હોતી. જ્યારે તમે કોઈ શરીર પ્રત્યે, માનવ પ્રાણી પ્રત્યે, પદ્ધર્ય પ્રત્યે, જમીનના સુંદર દૃશ્ય પ્રત્યે જુઓ છો, ત્યારે તમે આ વસ્તુઓને તમારી આંખો વડે, સ્પર્શ દ્વારા, અવસ્થાન્દ્રિય દ્વારા જોતા જાણતા હો છો. પણ તેમની વીગતો માટે, ગંધ માટે, રસ માટે, વિજ્ઞાન તમને કહે છે કે “તે બધું” ભ્રાન્તિ છે. વસ્તુઓ જેવી છે તેવી તમે જોતાં હોતા નથી. તેમની જેવી ગંધ છે તેવી તમે પ્રાપ્ત કરતા હોતા નથી, તેમનો જેવો સ્વાદ છે તેવો તમે પ્રાપ્ત કરતા નથી. તમારાં અંગોની રૂચના તમને અમુક ખાસ રીતે આ વસ્તુઓના સાંપર્કમાં મૂકી આપે છે; પણ તે તદ્દન ઉપરચોટિયા, બાબુ, ભ્રાન્તિપૂર્ણ, અને અવાસ્તવિક હોય છે.”

વિજ્ઞાનના દૃષ્ટિભિન્નુથી જોતાં, તમે અહૃતઓનો પણ સમૂહ નથી, પણ આહૃ કરતાંથી અનંતગણ્ય વધારે અદૃષ્ટગોચર એવા કશાકનો સમૂહ છો, જે સતત ગતિ કરતું હોય છે. સુખ, નાસિકા, આંખો, મ્હોં જેવું કઈ જ નથી; તે માત્ર હેખાવ છે. અને બુનકણના, જરૂર પણ બાંધછોડ ન કરનારા અધ્યાત્મમવાદીઓની પેઠે,

વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ષ પર આવે છે કે જગત એક ખૂનિત છે. આ એક મહાન શોધ છે. એક ડાયલું આગળ જાય, તો તેઓ સત્ત્યમાં પ્રવેશ કરે. એટલે જ્યારે કોઈ આવીને કહે કે હું આ જોઉં છું, આનો સર્વા કરું છું, મને આ વસ્તુ અનુભવય છે, મને આની ખાતરી છે, ત્યારે વૈજ્ઞાનિક વૃદ્ધિબિન્દુથી તે અર્થાતીન છે. જેણે વસ્તુઓ જેવી છે તે રીતે તેમનું વૈજ્ઞાનિક અધ્યયન કર્યું નથી, તે જ આમ કહી શકે. એટલે તદ્દન પિરુલ્લ માર્ગોએ તે બને (અધ્યાત્મમવાદીઓ અને વૈજ્ઞાનિકો) એક જ પરિસ્થાપન પર આવ્યા છે, અને તે એ કે તમે જે રીતે જુઓ છો તે જગત એક ખૂનિત છે.

આની પીઠમાં શું સત્ય છે? જે લોકોએ આધ્યાત્મિક જ્ઞાન કરી છે, તેઓ તમને કહેતા હોય છે કે અમે આ અનુભવયું છે. પણ અખલતા, તે એક વિષયિગત અનુભૂતિ છે. એવાં કોઈ કારણો નથી કે જેણા વડે કોઈ એમ કહી શકે કે દરેક જીવની અનુભૂતિ શંકાથી પર છે. દરેક જીવની અનુભૂતિ તેને પોતાને માટે શંકાથી પર હોય છે. જે માણસ તેને જરાક આગળ લઈ જાય....

હક્કીકતમાં, કોઈ પણ અનુભવનું કે શોધનું મૂલ્ય આ રીતે જ સાબિત કરી શકાય કે તે આ દેખાવોને પરિવર્તિત કરવાની શક્તિ આપે છે. વસ્તુઓનું, સંજોગનું અને જગતનું ઇપાંતર, તે અનુભવમાં પ્રગટ થતા સંકલ્પ અનુસાર, કરવાની શક્તિ આપે છે? મને એમ લાગે છે કે વ્યક્તિગત અથવા સામૂહિક અનુભવની પ્રામાણિકતાની ખૂબ વૈશ્વિક સાબિતી આ છે કે તે આપણે જે દેખાવોને જગત કહીએ છીએ તે અત્યારે છે તે પ્રકારમાંથી તેમનું જુદી રીતે ઇપાંતર કરવાની શક્તિ ધરાવે છે? વિષયિગત વૃદ્ધિબિન્દુથી જોતાં, અનુભૂતિનો પ્રભાવ તે વ્યક્તિનો ચેતના ઉપર ખૂબ પડો હોય છે. તે એક સાબિતી છે. માણસ આનંદ, શાનિત, અપરિવર્તનીય સુખ, વસ્તુઓનું ગણન જ્ઞાન પ્રાપ્ત કરે છે, તે તેને માટે તો સિદ્ધ થયા કરતાંથી વધારે છે. બાધ ઢ્રીપ પર થતી અસર અનુભવથી પોતાથી બીજી અનેક વસ્તુઓ પર આખાર રાખતી હોય છે, કદાચ તે આ અનુભૂતિઓના પ્રથમ કારણ ઉપર રાખતી હોય, પણ આ અખાંમાં એક સાબિતી એવી હોય છે કે જેણા બીજા લોકો તેમ જ અનુભવ કરનાર બંને પ્રામ કરી શકે તેમ છે. તે સાબિતી બીજા લોકો તથા વસ્તુઓ પર પ્રામ થતી શક્તિ છે, જે સામાન્ય ચેતન માટે વિષયિગત છે. દા. ત. જે હું જેણો વિષે વાત કરી રહી છું તે ચેતનાની સ્થિતિને માણસે પ્રામ કરી હોય, તે ચેતનાને બીજામાં સ્થાપી આપવાની શક્તિ

મેળવી હોય, તો તે તેની અનુભૂતિઓની વાસ્તવિકતાની એક આંશિક સાબિતી કહેવાય. પણ તેથી આગળ, જે તે જે ચેતનાની સ્થિતિમાં પોતે હોય દાખલા તરીકે સંપૂર્ણ સંવાદિતાની સ્થિતિ, તેને બાધ્ય જગતમાં સૂર્જ શકે કે જે જગતમાં સંવાદિતા નથી, તો તે એક થેવી સાબિતી કહેવાય કે જેને ભૌતિકવાદી વૈજ્ઞાનિક મન પણ ખૂબ સહેલાઈપૂર્વક કબૂલ રહે. જો આં બ્રાન્ટિમય દેખાવેને કાંઈક વધારે સુંદર, વધારે સંવાદમય, આપણે તેમાં જીવીએ છીએ તે જગત કરતાં વધારે સુખમય સ્થિતિમાં પરિવર્તિત કરી શકાય, તો તે એક અનિપેદ્ય. સાબિતી જણાય. શ્રી અરવિંદ આપણને વચન આપે છે તેમ જે આપણે તેને હજુ પણ વધારે આગળ વઠી જઈએ તો જે અતિમાનસ શક્તિ, ચેતના, અને પ્રકાશ આ જગતનું ડૃપાંતર કરે અને નવીન અતિનું સર્જન કરે, તો તેઓ માનવના અસ્તિત્વનો ઈન્ડાર ન કરી શકે તેમ, માનવ પણ આ નવીન પ્રાણીઓના અસ્તિત્વનો ઈન્ડાર ન કરી શકે; શરત એટલી કે તે જતિ માનવજાતથી એટલી બધી લિન્ન હોવી જોઈએ કે એ લેઉ માનવમાં ઠગારાં અંગોને પણ દૃષ્ટિજોયર થાય.

આ નિષ્કર્ષો પરથી, ખૂબ સાબિતી આપી શકે તેવી અને સ્પેટ બાળુ કે જેનો આવિજ્ઞાન કદાચ પ્રથમ થયો હોય. તે શક્તિની બાળુ હોય, આનંદની કે સત્યની નહિ. પૃથ્વી પર નવીન જતિ સ્થાપિત બને તે માટે તેનું બીજાં પાર્થી વ તત્વોથી રક્ષારુ કરવાની જરૂર રહેશે, જેથી તે જીવી શકે. શક્તિ એ રક્ષારુ છે: ફૂત્રિમ, બાધ્ય, અને જૂઠી શક્તિ નહિ, પણ સાચું બળ, વિજયી સંકલ્પ. એટલે એમ વિચારનું અશક્ય નથી કે અતિમાનસ કાર્ય સંવાદિતાનું, પ્રકાશમયનાનું, આનંદનું, અને સૌનંદર્યનું બને તે પહેલાં તેણે શક્તિનું કાર્ય બનવું પડશે, જેથી તે રક્ષા કરી શકે. સ્વાભાવિક રીતે જ, આ શક્તિનું કાર્ય સાચી રીતે અસરકારક બને તે માટે, તેને જ્ઞાનના, સત્યના, પ્રેમના, અને સંવાદિતાના પાયા પર સ્થાપિત કરવું પડશે, આ બધી વસ્તુઓ ધીમે ધીમે, જ્યારે સગ્રામ સંકલ્પનું અને શક્તિનું કાર્ય ભૂમિકા તૈયાર કરશે ત્યારે જ પ્રગટ થઈ શકશે.

આમાંની શોષ વસ્તુ શક્ય બને તે માટે, પ્રથમ તો પરિપૂર્ણ સમતુલ્યનો પાયો હોવો જોઈએ, તે સમતુલ્યને માત્ર અહંતાનો અભાવ, પરમાત્માને પરિપૂર્ણ સમર્પણ, સાચી વિશુદ્ધિ, અને પરમાત્મા સાથે તાદાત્મ્ય જ આપી શકે છે. આ પરિપૂર્ણ સમતાના પાયા સિવાય, અતિમાનસ શક્તિ જોગમરૂપ છે. સાથકે કોઈ પણ

કારણસર તે શક્તિના નાનામાં નાના આણુને પણ નીચે જેંચી લાવવાની ઈચ્છા ન કરવી જોઈએ. તેને નાનામાં નાના આણુમાં પણ એવું બળ અને ભયંકરતા હોય છે, કે જે સમગ્ર પદ્ધતિની (શરીર, પ્રાણ, મન, બૃહિની) સમતુલ્યમાં લંગ પાડે હે.

હું તમને તે વિષે વાત કરી રહી છું, એટલે માટે તમને યોગીક લખામણો કરવી જોઈએ. પ્રગતિ માટેની તમારી ઈચ્છામાં અને સાક્ષાત્કાર માટેની તમારી અભીષ્ટામાં તમે શક્તિઓને તમારી પ્રત્યે જેંચવાનો પ્રયત્ન ન કરતા, તે બાબત ખૂબ દરકાર રાખજો. તમારી જાતનું ચમર્પણ કરો દો; સતત આત્મવિસ્મૃતિ દ્વારા, પથાથકય ખૂબ નિઃસ્વાર્થ લાવે તમારી જાતને ખુલ્લી કરો; તમારી ગ્રહસુશક્તિમાં વૃદ્ધિ કરો, પણ કંઈક ગરબદ પેદા થાય છે, ત્યારે લોકો શક્તિનો દોષ કાઢતા હોય છે. પણ જેને માટે શક્તિ જવાબદાર નથી હોતી; મહત્વાકંલા, અહંતા, અજ્ઞાન અને આધારની (પાત્રની) નિર્બંધતા જવાબદાર હોય છે.

તમારી જાતનું ઉદારતાપૂર્વક, પરિપૂર્ણ નિઃસ્વાર્થતાપૂર્વક સમર્પણ કરો, અને ગાડનતર દૃષ્ટિબિન્દુથી જોતાં, તમને કોઈ હાનિ નહિ પહોંચે લેવાની કોશીશ કરો, અને તમે ખાઈના છેડા પર હશો (પતનનો ભય ઉલ્લેખ થશે).

### પ્રશ્નોત્તરી

૧૯૫૮

૧ જાન્યુઆરી ૧૯૫૮

હે પ્રકૃતિ, આધ્યાત્મિક માતા,

તે કલું છે કે હું સહકાર આપીશ

અને તારા સહકારના તેજને

કોઈ મર્યાદા નથી.

(નૂતન વર્ષનો સંદેશ, ૧ જાન્યુઆરી ૧૯૫૮)

મધુર માતાજી, તમે આ વર્ષના સંદેશને સમજાવશો?

તે લખેલો જ છે! તેની સમજૂતિ લખાઈ ચૂકી છે, તે ૨૧ મી ફેબ્રુઆરીના બુદેટિન માટે તૈપાર છે.

તેમાં સમજવાનું કંઈ બાકી રહ્યું નથી. તે એક અનુભૂતિ છે. કંઈક બનેલી વાત છે. જ્યારે તે બની હતી તારે મેં તેને નોંધી લીધી હતી. જ્યારે મને યાદ આવ્યું કે નૂતન વર્ષનો સંદેશ આપવાનો છે, ત્યારે તે બની હતી. તે સંદેશ આજના નવીન વર્ષ માટેનો છે. જ્યારે મને યાદ આવ્યું કે મારે કોઈ સંદેશ લખી કેવાનો છે ત્યારે તે વાત યાદ આવી તે જ વખતે આ અનુભૂતિ આવી હતી, જ્યારે તેને મેં નોંધી લીધી, ત્યારે મને ભાન થયું કે આ વર્ષનો આ જ સંદેશ છે!

(મૌન)

મારે તમને એક જ પ્રાત કહેવી જોઈએ. તમારે આ અનુભૂતિના અર્થ વિષે ગેરસમજ ન કરવી જોઈએ, અને એમ ન કહ્યો લેવું જોઈએ કે હવેથી કાઈ પણ મુશ્કેલી વગર આપણી અંગત ઈચ્છાઓ હંમેશાં બધું આપોઆપ બરાબર બની જશે, તે આ લૂમિકા પર શક્ય નથી. નેનો એવો અર્થ નથી કે જ્યારે આપણે ઈચ્છાએ કે વરસાદ ન આવવો જોઈએ, ત્યારે વરસાદ નહિ પડે! જ્યારે આપણે જગતમાં અમૃત વસ્તુ બને એવી ઈચ્છા કરીએ, કે તરત જ તે પ્રમાણે બનશે, બધી મુશ્કેલીઓ ચાલી જશે, અને દરેક વસ્તુ પરીક્ષાઓમાં બનતી હોય છે તેમ, બધું ઢીક ઢીક થઈ જશે. તે પ્રમાણે નહિ બને તે કંઈક વધારે ગહન છે. શક્તિઓની પોતાની લીલામાં, પ્રકૃતિએ આ નવીન શક્તિનો સ્વીકાર કર્યો છે કે જે શક્તિ પ્રગટ થઈ ચૂકી છે પ્રકૃતિએ પોતાની ગતિઓમાં તેનો સમાવેશ કર્યો છે. પ્રકૃતિની ગતિઓ માનવીય સ્કેરલથી પર એવા સ્કેરલ ઉપર હોય છે; સામાન્ય માનવીય ચેતનાને તે દૃષ્ટિગોચર નથી હોતી. તે એક આંતર, માનસશાસ્ત્રીય શક્યતા છે કે જે જગતમાં આવી ચૂકી છે. તે પાર્થિવ ઘટનાઓમાં દેખાઈ આવે એવું પરિવર્તન નથી.

(મૌન)

બટનાઓ કેવી રીતે બને છે તે સમજવા માટે, માણસમાં ખૂબ ધીરજ  
અને ખૂબ પરિચૂર્ણ, વિદ્યા, દર્શનાની જરૂર છે.

(મૌન)

જે ચમત્કરે થતા હોય છે તે કથાઓના પુસ્તકમાં આપતા ચમત્કરે નથી,  
અર્થાત્ કથાઓમાં તે બનતા હોય છે તે રીતે બનતા હોતા નથી. તે માત્ર વસ્તુ-  
ઓની ખૂબ ગહન, વિશાળ દર્શનાને જ હૃષિકોયર હોય છે.

(મૌન)

કૃપાના કાર્યથી સભાન બનવા માટે, માણસ તેની પ્રક્રિયાઓને અને પ્રકારોને  
સમજવા માટે શક્તિમાન બનેલો હોવો જોઈએ. વસ્તુઓના ગહનતર સત્યને  
જોવા માટે માણસ દેખાવેથી અંધયો ભીંત ન બની જાય તેવી શક્તિ તેણે પ્રાપ્ત  
કરેલી હોવી જોઈએ.

આજે સાંજે આપણે તે બાબત નિશ્ચય કરી લઈએ તે વધારે ઉપયોગી બનશે.  
આપણે આ વર્ષ દરમિયાન બને તેટલો શેષ પ્રયત્ન કરીએ, કે જેથી સમય નિર્ણયક  
પસાર ન થઈ જાય. આ નિશ્ચય આપણે કરવો જોઈએ.

પરિશિષ્ટ

૧૬૩ જાન્યુઆરી ૧૯૫૮ ના, નૂતન વર્ષના સંદેશની સમજૂતિ

આપણા એક વર્ગમાં<sup>૧</sup> મેં કદ્યું હતું કે અખૂટ સર્જન કરતા પ્રકૃતિ  
પાસે અમર્યાદિત વિપુળતા છે. પ્રકૃતિ વસ્તુઓના સમૂહોને હાથમાં બે છે, તેમને  
મિશ્રાત કરે છે, વળી પાછી તેમનું વિશ્વાસ કરે છે, તેમને ફરી નવો ઘાટ આપે  
છે. નેમનો સંહાર કરે છે જેણી તે નવીન મિશ્રણા, સંધટનો પ્રત્યે ગતિ કરી  
શકે. મેં કદ્યું હતું કે એ એક મોટો ચકું છે. પ્રકૃતિ તેમાં રહેલી વસ્તુઓને  
હવાવે છે, કંઈક બહાર લાવે છે, તે રૂપ તેને સારું લાગતું હોનું નથી, એટલે  
ફરી તેને તે ચકુમાં નાંબે છે, અને બીજી કોઈ વસ્તુને બહાર લાવે છે! એક, બે,  
કે સો રૂપો તેને મન મહત્વનાં નથી હોતા; હજરો, લાયો રૂપો હોય છે. સો, હજર,  
લાયો વર્ષો તેને મહત્વનાં નથી હોનાં; તેની પાસે તો શાશ્વતી પડી છે; એ વાત

તદ્દન સ્પષ્ટ છે કે પ્રકૃતિને તેમ કરવામાં મજા પડતી હોય છે, તે ઉત્તાપણમાં નથી હાની. જે તેને એમ કહેવામાં આવે કે તું જરૂર કરીને તારું કામ જલ્દી પૂરું કરી લે તો તે હંમેશાં એક જ જવાબ આપે છે કે મારે થા માટે તેમ કરવું જોઈએ? થું તમને આમાં મજા નથી પડતી?

આજે સાંજે મેં તમને આ વસ્તુઓ વિષે વાત કરી હતી. મેં મારી જતનું પ્રકૃતિ સાથે સંપૂર્ણ તાદાત્મ્ય કર્યું હતું, હું તેની રમતમાં જોડાઈ હતી. તે તાદાત્મ્યની ગતિનો એક પ્રત્યુત્તર મળ્યો હતો; પ્રકૃતિની અને મારી વચ્ચે એક પ્રકારનો નવીન, ગાડ પરિચય સધ્યાઓ હતો, વધતી જતી નિકટતાની તે એક લાંબા સમય સુધી ચાલેલી ગતિ હતી, જે એક અનુભૂતિમાં પરિણમી, જે ૮ મી નવેમ્બરે મને પ્રાપ્ત થઈ હતી.

પ્રકૃતિ એકદમ સમજી ગઈ કે હમણાં જ જન્મ પામેલી આ નવીન ચેતના મારો ઈન્કાર કરવા નથી માગતી, પણ સમગ્રપણે મને આલિંગન આપવા માગે છે. તે સમજી ગઈ કે આ નવીન આધ્યાત્મિકતા જીવનથી વિમુખ બનવા નથી માગતી, મારી ગતિની ભીધણ વિમુલતાથી ડરી જઈને દૂર ભાગી જવા નથી માગતી, પણ મારી બધી બાજુઓનો સમન્વય સાધવા માગે છે. તે સમજી ગઈ કે અતિમાનસ ચેતના મને ન્યૂન બનાવવા નથી માગતી, પણ મને પરિપૂર્ણ બનાવવા માગે છે.

પછી પરમ વાસ્તવિકતામાંથી આ આદેશ મળ્યો કે; હે પ્રકૃતિ, સહકારના આનંદ પ્રત્યે જાગૃત થા. પ્રકૃતિ આનંદના એક મહાન આવેજમાં આગળ પસી આવી અને બોલી કે હું તમારો આદેશ માથે ચઢાવું છું, હું સહકાર આપીશ. તેજ વખતે, એક પરિપૂર્ણ શાંતિ પથરાઈ ગઈ, જેથી શરીરનું પાત્ર, ભાગી ગયા સિવાય, કશું પણ ગુમાવી બેઠા સિવાય, પ્રકૃતિના આ આનંદના બળવાન પૂરને જીલી શકે, પોતામાં સમાવી શકે; તે આનંદ પ્રકૃતિમાં પેદા થયેલી આભારની લાગણીમાંથી જન્મ્યો હતો. પ્રકૃતિએ તે વાત સ્વીકારી લીધી. પોતાની આગળ પડેલી શાસ્ત્રવતી સાથે, તેણે જ્યેણું કે અતિમાનસ ચેતનામાં મને સંપૂર્ણપણે પરિપૂર્ણ બનાવવા માગે છે, મારી ગતિને વધારે બળ આપવા માગે છે, મારી લીલાને વધારે વિશાળતા અને શક્યતાઓ આપવા માગે છે.

પૃથ્વીના સર્વ ખૂસાઓમાંથી આવતા હોય તેમ, મેં એચિંતા તે મહાન સ્વરના સરોદો સાંભળા, જેનને ડોર્ડક વાર માણસ પોતાના સૂક્ષ્મ ભૌતિકમાં

સંભળે છે. તે સરોદો બીજોવનના ઝી મેઝેરમાં સંભળાતા સરોદો જેવા હતા, જે સરોદો પ્રગનિ સિલ્ફ થતાં સંભળાતા હોય છે. જણે કે પચાસ ઓફેસ્ટ્રોઓ એકી સાથે સંવાદિતામાં સંભળાતી ન હોય! તેમાં એક પણ સૂર જોટો ન હતો. પ્રકૃતિ અને આત્મા વચ્ચેના આ નવીન પારસ્પરિક સંબંધના આનંદને અભિવ્યક્ત કરવા તે સરોદો સંભળાતા હના. ખૂબ સમયથી વિખૂટા પડેલા બે મિત્રોના મિલનના આનંદને તે સરોદો વ્યક્ત કરતા હતા.

પછી આ શબ્દો આવ્યા; “હે પ્રકૃતિ, ભૌતિક માતા, તેં કહું છે કે, હું સહકાર આપીશ; આ સહકારના તેજને કંઈ મથ્યાદા નહિ હોય.”

આ રીતે નૂતન વર્ષનો સંદેશ જન્મ્યો હતો.

\*

## ૮ જાન્યુઆરી ૧૯૫૮

માતાજી ‘દિવ્ય જીવન’ માંથી એક ફકરો વાંચે છે.

આપણે એક પછી બીજો, એમ ફકરો વાંચવાનો નિર્ણય કર્યો છે, જેથી આપણે કંઈક વિગતવાર સમજૂતિ આપી શકીએ. પણ આ પદ્ધતિમાં એક દોષ છે, જે વિષે મેં તમને અગાઉ જણાવ્યું છે. શ્રી અરવિંદ બધા સિલ્ફાંતોને લઈને વિગતવાર તેમની દલીલિંગ સાથે, સમજૂતિ આપતા હોય છે, જેથી પાછળથી તે સિલ્ફાંતોની ન્યૂનનાઓએ સમજી શકાય, સમસ્યાના ઉકેલ માટે તે સિલ્ફાંતોની અશક્તિ તેઓ બતાવતા હોય છે, અને પછી પોતાનો ઉકેલ તે આપતા હોય છે. પણ (હસીને) જ્યારે આપણે એક દલીલની વચ્ચમાં અટકી જઈએ છીએ, એક ફકરાને અલગ વાંચીએ છીએ, જો આપણે તે ફકરાને છેક અંત સુધી ન વાંચીએ, તો આપણે એમ માની કેવાની ભુલ કરીએ છીએ કે શ્રી અરવિંદ પોતાનો અભિપ્રાય અહીં આપે છે.

હકીકતમાં, કેટલાક બેદરકાર લોકોએ એમ કર્યું છે, જ્યારે તેઓ પોતાના સિલ્ફાંતોને સાચા ડેરવા માટે શ્રી અરવિંદનાં બખાણોમાંથી ઉછરણો ટાંકતા હોય છે અને આગળ શું આવી ગયું અને પાછળથી શું આવ્યું તે વિષે ચુપકીદી કેવતા હોય છે ત્યારે તેઓ કહેતા હોય છે કે ‘દિવ્ય જીવન’ માં શ્રી અરવિંદે

આમ કહ્યું છે, તેમણે એમ કહ્યું છે એ વાત સાચી, પણ તેમનું પોતાનું એ દર્શન નથી. હવે એજ મુશ્કેલી આપણી આગળ આવીને ખડી થઈ છે, છેલ્લા બે વર્ગાથી હું જીવનના બે આધુનિક સિદ્ધાંતો વિષે વાચન કરી રહી હતી, ઉત્કાનિત અને અસ્તિત્વનો હેતુ અથવા તેની નિરર્થકતા. કી અરવિદ તેમની રજૂઆત બજુ નિર્ણયિક રીતે કરે છે, જ્ઞાને કે તે તેમનો પોતાનો અભિપ્રાય ન હોય, તેમનું પોતાનું દર્શન ન હોય. આપણે વચ્ચે અટકી જઈએ છીએ. આપણને એવી એક બેચેનીની લાગણી અનુભવવાની હોય છે કે, કી અરવિદ આપણને આમ કહ્યું ન હતું; હવે તે આપણને કેમ આની સમજૂતિ આપી રહ્યા છે? આ એક મોટો દોષ છે. પણ જો હું તમારી સમજ આખી દલીલ વાંચું, તો અંતભાગ આવતાં તમને પ્રારંભનો ભાગ યાદ ન રહ્યો હોય, અને તમે સમજી શકવા શક્તિમાન ન બનો! એટલે શ્રોષ રીત એ છે કે શાન્તિભૂર્વક એક વખતે એક ફરિયા બેંગા, તે શું કહેવા માગે છે તે સમજવા પ્રયત્ન કરવો, પણ એમ ન માની લેણું કે તેઓ એ વાતને સત્ય મિશ્ય કરવા માગે છે. તે સિદ્ધાંતોને ટેકો આપતી બધી દલીલો સાથે, તેમને સમજવા માગતા હોય છે; તે એમ કહે॥ હોતા નથી કે વસ્તુઓને જોવા માટે આ શ્રોષ પ્રકાર છે.

વાસ્તવિક રીતે, આ વાચનને તમારે એવી એક તક માનવી જોઈએ કે જ્યારે તમે તમારા તત્ત્વચિંતનીં મનને વિકસાવી શકો, તર્કયુક્ત કર્મમાં વિચારોને ગોઠવવાની અને દલીલને મજબૂત પાયા પર સ્થાપિત કરવાની શક્તિ કેળવી શકો. તમારે આ પ્રયત્નને સનાયુઓ વિકસાવવા માટેની ડમ્બેલસની કસરતો જેવો માનવો જોઈએ. જે પ્રયત્ન અહી મસ્તિષ્કને અને મનને કેળવે છે. તમારે ઉત્ત-વળિયાં નિષ્કર્ષો પર કૂદી પડવું ન જોઈએ. જે આપણે ધીરજભૂર્વક રાહ જોઈશું, તો પ્રકરણને અંતે તે આપણને અકાર્ય દલીલના પાયા ઉપર કહેશે કે તે શા માટે આ નિષ્કર્ષો પર આવ્યા છે.

હવે તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય, તો પૂછો.

માનાજી, તે પાઠ્ય મુસ્તકનો સવાલ નથી.

બીજે કોઈ સવાલ છે? તે શો છે?

માતાજી, કેટલીક વાર આપણને ઓચિતા વિચારો આપતા હોય છે. તે ક્યાંથી આવે છે? તે મસ્તિષ્કમાં કેવી રીતે કામ કરતા હોય છે?

તે ક્યાંથી આવે છે? માનસિક વાયુમંડલમાંથી.

તે શા માટે આપતા હોય છે? જેમ આપણને માર્ગમાં કોઈ માણસ સામે મળે, તેમ તે વિચારો. તમને મળતો હોય છે. મોટે ભાગે તેમ બનતું હોય છે. તમે માર્ગ પર જતા હો છો, જ્યાં વિચારો ભ્રમણ કરતા હોય છે. તમે કોઈક ખાસ વિચારને મળો છો અને તે તમારા મહિને આવી જાય છે. જે લોકોને ધ્યાન કરવાની એકાગ્રતા, કરવાની ટેવ છે, જેમને માટે બૌલ્ઝિક સમસ્યાઓમાં એક પ્રકારની સધન, સ્પર્શગમ્ય વાસ્તવિકતા છે, તેઓ પોતાના મનની એકાગ્રતા વડે સંબંધિત વિચારોને આકર્ષણ હોય છે. પરિણામે એક વિચારોનો સમૂહ એકત્રિત થાય છે. કોઈ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અથવા પોતે વિચારતા હોય તે પ્રશ્નને સ્પષ્ટ બનાવવા માટે, તેઓ તે વિચારોને સંગઠિત કરે છે. પણ આને માટે, માણસને માનસિક એકાગ્રતાની અને તત્ત્વચિન્તનીય મનની ટેવ હોવી જોઈએ, તેવા મન માટે વિચારો જીવંત તત્ત્વો છે. જેમને પોતાનું આગણું જીવન હોય છે, જે શૈનરંજની રમતના પાટિયા પરનાં મહોરાં જેવા હોય છે. માણસ તેમને વે છે. અમૃત સ્થાને મૂકે છે, તેમને સંગઠિત કરે છે, અને તે વિચારોમાંથી કોઈ સુસંગત વસ્તુ પેટા કરે છે. ને વિચારો વ્યક્તિત્વપ, સ્વતંત્ર વસ્તુઓ હોય છે, તેમનામાં પરસ્પર સામ્યતાના સંબંધો હોય છે; તે આંતર નિયમો અનુસાર પોતાની જાતને સંગઠિત કરતા હોય છે. પણ તેને માટે, માણસમાં ધ્યાનની, ચિંતનની, પૃથક્કરણની, નિષ્કર્ષ તારવવાની, માનસિક સંગઠનની ટેવ હોવી જોઈએ. નહિ તો, જો માણસ જેમે તેમ જીવતો હોય; તો વે જીહે ચોરા જેવું બની જાય છે. ચોરામાં ચારેપ બાજુ માર્ગો હોય છે, તેમના પર લોકો જતા આપતા હોય છે, તમે તે આડા અવળા રસ્તાઓના મિલન સ્થાને ખડા હો છો, તે વિચારોમાં કોઈ પરસ્પર સંબંધ હોનો નથી અને તે ત્યાં સુધી કે જો તમે એક નિરર્થકતાની પ્રશસ્ય દોરી રૂપ બની રહે!

આપણે એક વખત કલ્યાં હતું કે આપણે એક નાનકડી રમત ઉપયો-  
ગિતાપૂર્વક રમી શકીએ. કોઈને એચિતા પૂછો કે તમે શેનો વિચાર કરી રહ્યા છો? તે તમને સ્પષ્ટતાપૂર્વક કશો જવાબ નહિ આપી શકે. તે કહેશે કે ઓહ, હું ફ્લાણી વસ્તુનો વિચાર કરી રહ્યો હતો. જો તે તેવો જવાબ આપે, તો તમે અનુમાન કરો શકો કે તે વિચારશીલ માણસ છે. નહિ તો, મોટે ભાગે આ જવાબ મળતો હોય છે કે, ઓહ, હું શેનો વિચાર કરી રહ્યો હતો તેની મને ખુબર નથી.

જે લોકોએ વ્યવસ્થિત અને સંગઠિત રીતે શારીરિક કસરતો કરી હોય છે તેઓ અમૃક જનિ પ્રાપ્ત કરવા માટે :અમૃક સનાયુઓને હલાવવા જોઈએ તે, તેમને સારામાં સારી રીતે કેમ હલાવી શકાય તે અને ઓછામાં ઓછા પ્રયત્નથી વધારેમાં વધારે પરિણામો કેમ મેળવી શકાય તે જાણતા હોય છે. વિચારની બાબતમાં પણ તેવું જ છે, જ્યારે તમે પદ્ધતિપૂર્વક તમારી જતને તાલીમ આપો છો, ત્યારે તમે તદ્દન વિષયગત રીતે તર્કની પરંપરાને અનુસરી શકતા હો છો, જાણે તમે પડડા પર કોઈ મિત્રનો વિસર્ગ ન કરતા હો, ત્યારે તમે થોડામાં થોડા સમયમાં, એક પછી આવતા બીજી વિચારના તર્કયુક્ત નિષ્કર્ષને, સ્વાભાવિક, તર્કયુક્ત, સંગઠિત ગતિને, એક ક્ષયનમાણી ફ્લિંગ થતા નિષ્કર્ષને અનુસરી શકતા હો છો. જેમ તમે અમૃક પરિણામ પ્રાપ્ત કરવા માટે જરૂરી ઓવા સનાયુઓને પદ્ધતિપૂર્વક હલાવવાની ટેવ પાડો છો, તેમ તમે એક વાર વિચારોને ઉપર વર્ણવ્યા મુજબ સંગઠિત કરવાની ટેવ પાડો, તો તમારો વિચાર સ્પષ્ટ બને છે. નહિ તો, વિચારની ગતિઓ અને બૌલિક ગતિઓ અસ્પષ્ટ, અથોકકસે, અને લ્યાનિટપૂર્ખ હોય છે. ઓચિંતી એક વસ્તુ પેદા થાય છે, અને તરત જ તેનો વિરોધ કરતો બીજો વિચાર પેદા થાય છે; તમે તે બંનેનાં કારણો જાણતા હોતા નથી. જે માણસ આ વિચારોના ચોક્કસ પારસ્પરિક સંબંધ સમજવા માટે તે વિચારોને સ્પષ્ટતાપૂર્વક સંગઠિત કરવા પ્રયત્ન કરે, તો થોડા જ વખતમાં તેનું માથું દુખવા લાગે! તેને તે પ્રયત્ન એક ખૂબ અંધકારમય, કુમારિકા વનમાં માર્ગ શોધી કાઢવાના પ્રયત્ન જેવો મુશ્કેલીભર્યો લાગે.

વિચારશીલ મનને પોતાના વિકાસ માટે શિસ્તની અભ્યાસની જરૂર હોય છે. જે તે મનને પદ્ધતિપૂર્વક તાલીમ આપવામાં ન આવી હોય, તો માણસને પોતે એક પ્રકારના વાદળમાં ગુંચચાઈ ગયો હોય તેવું લાગે. ખૂબ મોટા ભાગને માણસો તદ્દન વિરોધી વિચારોને પોતાના મસ્તિષ્કમાં રાણતા હોય છે, અને તેથી તેમને જરા પણ હુંબુકે જેચેની લાગતી હોતી નથી.

જ્યાં સુધી તમે સ્પષ્ટતાપૂર્વક તમારા મનને સંગઠિત નહિ કરો, ત્યાં સુધી તમને તમારા વિચારો પર કાબૂ બિલકુલ નહિ આવે. ઘણ્ણીવાર તો, તમારા વિચારનું મૂલ્ય જાણ્યા કિવાય જ તમે કર્યાની શરૂઆત કરી દેતા હો છો! કર્યાની શરૂઆત નહિ, તો લાગણીની શરૂઆત તો કરી જ દેતા હો છો. એકદમ તમને લાગે છે કે આ લાગણીઓ મારે માટે ઈષ્ટ નથી. ત્યારે તમને ભાન થાય છે કે મેં મારા વિચાર ઉપર જરા પાણ કાબૂ મેળવ્યો નથી.

મધુર માતાજી, માણસોને પોતાના મન પર કાબૂ નથી હોતો, તેથી તેમને ખરાલ વિચારો આવતા હોય છે?

ખરાલ વિચારો? તેને માટે અનેક કારણો હોઈ શકે તે ખરાલ સ્વભાવને કારણે હોય; જે માણસોમાં ગંદી લાગણીઓ હોય, તો તે પણ ગંદા વિચારોનું કરતા બની શકે. તેનાથી વિડુલ્ય પણ હોઈ શકે, અર્થાત્ ગંદા વિચારો ગંદી લાગણીઓને પેદા કરે. કદાચ તેવા બોકો બહારથી આવતાં અનેક પ્રકારનાં સૂચનો પ્રત્યે ખુલ્લા હોય. તે સૂચનો તેમનામાં પ્રવેશ કરે છે અને ધીમે ધીમે ગંદી લાગણીઓ પેદા કરે છે. તે અવયેતન સંસ્કારો અસરોનું પરિણામ પણ હોય, જે સંસ્કારો, તેમના પર કાબૂ ન હોવાને કારણે, પરસ્પર વિરોધી હોય છે. જ્યારે કાબૂ ન રાખવાને કારણે આ અસરો સપાઠી પર આવે છે અને અનિષ્ટનીય અસરોનો ઈન્કાર કરવામાં આવતો નથી, ત્યારે ગમે તે વસ્તુને અંદર પ્રવેશવાની છૂટ મળી જાય છે, કારણે દૂર ખુલ્લાં હોય છે.

સારી, નરસી, તદ્દસ્થ, તેજેમય, અંધકારમય – અનેક અનેક પ્રકારની વસ્તુઓમાં તમે નહાતા હો છો. દરેક જણુની ચેતનાએ સૌદ્ધાનિક હૃષિએ, જગણીનું કામ કરવું જોઈએ. તમે જે સ્વીકારવા માગતા હો તે જે વસ્તુઓને તમારે સ્વીકારવી જોઈએ; તમે જે વિચારવા માગતા હો, તેનો જે વિચાર તમારે કરવો જોઈએ. ઓપચારિક સત્તા આપ્યા સિવાય, તમારે કોઈ પણ વિચારને લાગણીમાં અથવા કાર્યમાં પરિવર્તિત ન થવા દેવા જોઈએ.

હકીકતમાં, ભૌતિક અસ્તિત્વનો તે જે હેતુ છે. માણસ પોતાના અમુક કાર્યક્ષેત્રનું પ્રતિનિધિત્વ ધરાવનાર અમુક આંદોલનો પર કાબૂ રાખવાનું કરતા હો છો. જે આંદોલનો દિવ્ય યોજના સાથે સુસંગત હોય તેવાં આંદોલનોને જે માણસે સ્વીકારવાં જોઈએ, અને બીજાંને ના પાડી દેવી જોઈએ.

પણ હજારમાં એક માણસ જે તેમ કરી શકતો હોય છે, સંજોગોનો અને પરિસ્થિતિના ધર્ષણને કારણે, તમે અર્થ સચેતન રીતે, થોડા જે પ્રમાણમાં તેમ કરતા હો છો, પણ બહુ થોડા માણસો વિચારપૂર્વક તેમ કરતા હોય છે. પણ તેના કરતાંથી વધારે અપવાદરૂપ આ છે કે વિચારપૂર્વક તેમ કરવું, સાચી રીતે કરવું, અને સત્ય શાન પૂર્વક કરવું.

વિચારો પર સંયમ! કોણ વિચારો પર કાબૂ રાખો શકે છે? જેમણે ભાવ્યાવસ્થાથી જ કાબૂ રાખવાનો પ્રયત્ન કર્યો છે, તેની તાલીમ લીધી છે, તેઓ જ.

સંપૂર્ણ કાબૂના અભાવથી માંડીને તે કાબૂ રાખવા સુધીનો એક વિશાળ ક્રમ હોય છે. ધર્માભારા લોકોનું શાસન તેમના વિચારો કરતા હોય છે; તેઓ પોતાના વિચારો પર શાસન કરતા હોતા નથી. મોટા આગના લોકો વિચારોથી પીડાના હોય છે. તેઓ તેમને દૂર કરી શકતા હોતા નથી, તેમનામાં આ વિચારો પ્રત્યે પોતાની સહિત ચેતનાને બંધ કરવાની શક્તિ હોતી નથી. તેમના વિચારો તેમના પર રાજ્ય કરતા હોય છે. તમે લોકોની રોજ ફરિયાદ સાંભળશો કે આ વિચારો બધો સમય મારામાં ધુસી જતાં હોય છે, હું તેને દૂર કરી શકતો નથી. એટલે ચિત્તા, દુર્ભાવના, ભીતિ તેમના પર આકમણ કરતાં રહે છે. ભયને અભિલ્યકત કરતા વિચારો બહુ કષ્ટદાયી હોય છે. તમે તેમને દૂર કરવા પ્રયત્ન કરો, અને તે રબરની પટ્ટી ચેઠે તમારા તરફ પાછા આવશે. કોનામાં કાબૂ છે? તે તો વર્ષો સુધીની મહેનત મારી લે છે, પૂર્ણ નહિ તો થાડો ધર્મા પણ કાબૂ પ્રાપ્ત કરવા માટે, તમારે આમ કરવું પડશો (માતાજી પોતાની ભૂકુટિ પર હાથ ફેરવે છે), બધી ગતિઓને બંધ કરી દેવી પડશો, બધાં આંદોલનોને બંધ કરી દેવાં પડશો. તો માનસિક સપાટી સુંવાળી બને છે. કેમ તમે કોઈ પુસ્તકનું કોરું પાનું ઉધાડો અને કશું જ લખેલું ન જુઓ, તેમ મસ્તિષ્ક તદ્દન કોરું બની જવું જોઈએ!

દેર ગયા પછી થાડેક આવો પ્રયત્ન કરજો, તે બહુ રસપ્રદ છે. એટલે માણુસ પોતાના મસ્તિષ્કમાં જે એક નાનકડું બિનદુ નાચતું હોય છે, તે જ સ્થાનને અનુસરતો હોય છે. એક માણુસે શ્રી અરવિંદ આગળ ફરિયાદ કરી કે વિચારો મને સત્તાવતા હોય છે. શ્રી અરવિંદે તેના મસ્તક પર હાથ ફેરવતાં, તે નાનકડા કણા નાચતા બિનદુને પકડયું અને અપમ કર્યું (આંગળીના ટેરવાંથી અભિનય), આણે કે તે કોઈ જરૂરને ફેંકી ન હેતા હોય. પછી તરત તે માણુસનું મસ્તિષ્ક શાન્ત, તેજોમય બની ગયું. તે કિયા જોઈ શકાય તેવી રીતે તેમણે કરી હતી. કશું જ બોલ્યા વગર તેમણે તે સત્તાવતા બિનદુને પકડીને ફેંકી દીધું, અને બધું પત્તી ગયું.

વસ્તુઓ બહુ સધન રીતે પરસ્પર આધાર રાખતી હોય છે. એક માણુસ શ્રી અરવિંદ પાસે આવ્યો. તેને કયાંક તીવ્ર વેદના થતી હતી. તે બોલતો હતો

કે ઓછ, અહીં બધું હુંચે છે, બધું હુંચે છે! શ્રી અરવિંદ કોઈ બોલ્યા નહિ, તે શાંત રહ્યા. તેમણે તે માણસ સામે જોયું. તે પ્રત્યક્ષ જોયું કે જાણે કોઈ સૂક્ષ્મ જીતિક ખથે તે ગેરવ્યવસ્થામાં ગુંચવાડામાં નાચતા નાનકડા બિદુને પકડીને બાહર હેંકી દીધું (તેજ અલિનય) અને પીડ બંધ થઈ ગઈ. કે માણસ બોલ્યો કે ઓછ, ઓછ, મારી પીડ જતી રહી!

\*

## ૧૫ જાન્યુઆરી ૧૯૫૮

માતાજી ‘દિવ્ય જીવન’ માંથી એક ફકરો પંચે છે, જેમાં એવી દલીલ ચાલુ રાખવામાં આવી છે કે માણસ અને બીજી દરેક પ્રાણીની ટાર્ઝિય નિશ્ચિત થઈ ગયેલી હોય છે, અને તેથી પ્રગતિ કરતી હોતી નથી; જે નવીન સૃંખિનું નિર્માણ કરવાનો હિરાદો હોય, તો તે માણસમાંથી નિકાસ ન પામી થકે. (પૃષ્ઠ ૮૩૨)

જે આ બધી દલીલો સાચી હોય અને જે કોઈ ઉચ્ચતર સાક્ષાત્કાર ન થવાનો હોય, તો પછી કોઈ કરવાનું બાકી રહેનું નથી. પણ સદ્ગુરીએ આ વસ્તુ સાચી નથી.

શ્રી અરવિંદ ઘણી વાર કલ્યું છે કે જ્યાં સુધી મેં કહેલું સત્ય સિદ્ધ થયું નથી, ત્યાં સુધી તેની કોઈ અકાટ્ય સાભીતી આપી શકવાની નથી. જ્યારે દરેક વસ્તુ સિદ્ધ થશે, ત્યારે અત્યારે તે વસ્તુ ન માનનાર લોકોને તેમની ભૂલ સ્વીકારવાની ફરજ પડશે, પણ તેમ કરવા માટે તેઓ કદાચ જીવતા નહિ હોય!

એટલે એક જ વસ્તુ કરવાની રહે છે: શાખા અને ખાતરી રાખીને પોતાને માર્ગ આગળ વધ્યે જવું, અને વિરોધીની તથા ઈન્કરોની દરકાર ન કરવી.

કેટલાક લોકો એવા હોય છે કે જેમને ચેન પડવા માટે બીજાઓનો ટેકે, ખાતરી અને વિશ્વાસની જરૂર પડતી હોય છે. તેઓ દુઃખી હોય છે, કારણકે તેઓ હંમેશાં તેમનામાં ન માનનાર લોકોને મળતા હોય છે, અને તેથી તેઓ

વિકિપ્લન બની જતા હોય છે, દુઃખી થઈ જતા હોય છે. માણસે પોતામાં જ ખાતરી પ્રાપ્ત કરી લેવી જોઈએ, ગમે તે આવી પડે પણ તે ખાતરી ટકાવી રાખવી જોઈએ, અને ગમે તે કિંમત ચૂકવવી પડે પણ પોતાને માર્ગ આગળ ધર્યે જવું જોઈએ, ધ્યેયને પ્રાપ્ત કરવું જોઈએ. ખૂબ ટકી રહી શકે તેવા લોકોને જ વિજય સાંપડે છે.

બધા વિરોધી હોવા છતાં ટકી રહેવા માટે, આધાર હચ્ચમચી ન ઉઠે તેવો હોવો જોઈએ. તેવો આધાર એક જ છે, પરમાત્માનો, પરમ સત્યનો.

બીજા આધારની આશા રાખવી તે વ્યર્થ છે. આ એક જ એવો આધાર છે, કે જે કદી છેહ દેતો નથી.

\*

## ૨૨ જાન્યુઆરી ૧૯૫૮

માતાજી 'દિવ્ય જીવન' માંથી એક ફુકરો વાંચે છે, જેમાં ઉચ્ચતર જાતિના પ્રાગટ્ય સામે બૌધ્ધિક દલીલાની સમજૂતિનો ઉપસંહાર કરવામાં આવ્યો છે.

આત્મી વખતે આપણે દલીલની શરૂઆત કરીશું. આ દલીલો એવા કેત્તમાં બનતી હોય છે કે જ્યાં તમે મોટે ભાગે જતા હોતા નથી, નહિ વાકુ ? તે પ્રદેશ તમને અપરિચિત છે.

હકીકતમાં, તે એક ખૂબ ખાસ પ્રદેશ છે, જે કાર્યથી અથવા કોઈ વ્યવહારમાં સાક્ષાત્કારથી બહુ દૂર છે. મને હંમેશાં એમ લાંઘુ છે કે માણસ કોઈ પણ વિચાર લઈને દલીલ માટે તેનો પ્રારંભબિદ્ધ તરીકે ઉપયોગ કરી શકે, અને બૌધ્ધિક તર્ક દ્વારા એમ મિલ્ય કરી શકે કે આ વિચાર તદ્દન સાચો છે; પણ તે બધું માત્ર દલીલાની શક્તિ દ્વારા જ.

એ ખૂબ નોંધપાત્ર છે કે માનવ કિયાનાં આ બે ક્ષેત્રો છે કર્મ અને વિચાર. તે અને ચેતનામાં એકી વખતે સાથે સાથે હોય એ કઠિન છે. ખૂબ વિકાસ પામેલા

વિચારશીલ મનવાળો માણસ ભાગ્યે જ કિયાશીલ માણસ બની શકતો હોય છે, અને કિયાશીલ માણસમાં ભાગ્યે જ વિચારશીલ બુદ્ધિ હોય છે.

જ્યારે વસ્તુઓ સિદ્ધ કરવા માટે માણસમાં ખૂબ વ્યવહારું વલસ હોય છે, ત્યારે તેને હંમેશાં એમ લાગતું હોય છે કે વિચારો, દલીલો, નિષ્કર્ષો આપણસુ માણસો માટે વધતા ઓછા પ્રમાણમાં રસપ્રદ વ્યાપાર હોય છે. પણ હું આ મોટેથી કહેવાની ધૂષ્ટતા નથી કરતો, કારણકે બુદ્ધિશાળી માણસો તેની કદર કરતા હોતા નથી. મને હંમેશાં આ એક વ્યાયામ, કસરત સમાન લાગ્યું છે, જે વિકાસની દૃષ્ટિએ ખૂબ રસપ્રદ છે, પણ તેનું કોઈ વ્યવહારું પરિણામ આપતું હોતું નથી. જો તમે મનના વિચારશીલ વળાંકથી માણસોની વાત સાંભળશો, તો તેઓ તમને કહેશે કે “શારીરિક કસરતો એક તદ્દન નકારો વ્યાપાર છે, તેમનું કોઈ વ્યવહારું પરિણામ આપતું હોતું નથી. કસરતો કરવાથી શો ફાયદો? એ તો માત્ર તમારા સ્નાયુઓને વ્યાયામ આપવા માટે હોય છે. જેમ તમે તમારા શરીરના સ્નાયુઓને વ્યાયામ આપો છો, તેમ અમારે અમારા માનસિક સ્નાયુઓને શા માટે વ્યાયામ ન આપવો જોઈએ?” આ બંને દલીલોનું મૂલ્ય એક સરખું છે.

મારે માટે તેનો ઉકેલ અન્યત્ર છે.

( લાંબા વધત સુધી મૌન )

જ્યારે માણસને ખાતરી થઈ જાય કે એક જીવંત અને વાણિજિક સત્ય છે, જે વિવયગત વિશ્વમાં પોતાની જતને અભિવ્યક્ત કરવા માગે છે, ત્યારે એક જ વસ્તુ મહત્વની બની જાય છે કે, એ સત્યના સંપર્કમાં આવવું, યથાશક્ય પરિપૂર્ણ રીતે તેની સાથે તાદાત્મ્ય સાધારું, માત્ર તેને અભિવ્યક્ત થવાના કરણ રૂપ બની રહેવું, તેને વધારે ને વધારે જીવંત અને સ્પર્શિત્ય બનાવવું, જેથી તે વધારે ને વધારે પરિપૂર્ણ રીતે પ્રગટ થાય. સર્વ સિદ્ધાંતો, સર્વ પદ્ધતિઓ, તે સત્યને અભિવ્યક્ત કરવાની તેમની શક્તિના પ્રમાણમાં, ઓછાં વરાં સારાં છે. માણસ જેમ જેમ આ માર્ગમાં આગળ વધે છે, અજ્ઞાનની મર્યાદાઓથી પર બનતો જાય છે, તેમ તેમ ને સલાન બનતો જાય છે કે, તે સત્યની અભિવ્યક્તિ માટે આ આવિભાગની સમગ્રતા, સમન્વિતતા જરૂરની છે; કોઈ પણ વસ્તુ વસ્તુ બાકાત રાખો શકાય તેમ નથી; કદાચ તેમાં કોઈ વસ્તુ વધારે અગત્યની કે ઓછી અગત્યની નથી. એક જ વસ્તુ જરૂરી છે, અને તે દરેક વસ્તુનું સંવાહીકરણ, જે દરેક વસ્તુને

તેની યોગ્ય જગ્યાએ, બીજી બધી વસ્તુઓં સાથે યોગ્ય સંબંધમાં મૂકી આપે છે, જેથી સમગ્ર એકતા સંવાદમય રીતે પ્રગટ થાય.

જો માણસ તે લૂભિકામાંથી નીચે આવે, તો મારી દૃષ્ટિએ, તે કથું જ સ્તુતી શકતો નથી; સંકુચિતતામાં અને સર્વાદિતામાં બધી દલીલોનું મૂલ્ય એકસરખું હોય છે; તેમનું વાસ્તવિક મૂલ્ય ખામ થઈ જાય છે.

દરેક વસ્તુને યોગ્ય સ્થાને, બીજી વસ્તુઓં સાથેના સંવાદમાં મૂકી આપવાથી જ માણસ સમજવાનો અને જીવવાનો પ્રારંભ કરે છે.

( મૌન )

એમ લાગે છે કે એક જ ગતિ, તે ગમે તેટલી નાનકડી અને નિનમહત્વની દૈખ્યાય, પણ જો તે સત્ય સાથે સંવાદિતામાં હોય, તો ખૂબ આસ્કાર્નિનક દલીલો કરતાં તેનું મૂલ્ય વધારે હોય છે.

તમારામાં પ્રકાશના એક જ બિંદુને પ્રકાશવા દ્યો; તે વિશ્વમાં પ્રકાશ ઉપર અને પ્રકાશ શું કરી શકે તેમ છે તેના ઉપર અપાયેલાં ખૂબ સુંદર વ્યાખ્યાનો કરતાં, અંનકારનો નાશ કરવામાં વધારે અસરકારક બનશે.

\*

## ૨૮ જાત્યુચ્ચારી ૧૯૫૮

“ અચેતનમાં પણ, કમથી કમ, સાહજિક જરૂરિયાતનો એક એવો આવેગ દૈખ્ય છે જે રૂપોની ઉત્કાનિત પેદા કરે છે અને રૂપોમાં વિકસની ચેતના પ્રગટ કરે છે. એમ માની શકાય કે આ આવેગ એક નિગૂડ ચૈતન્ય સત્તનો ઉત્કાનિતમય સંકલ્પ છે, અને પ્રગતિમય આવિભાવનો આવેગ એ ઉત્કાનિતમાં સાહજિક ઈરાદાની સાબીતિ છે. પોતાની જતને અનિવાર્ય રીતે પરિપૂર્ણ કરતું તે સતતું સત્ય ઉત્કાનિતની પાયાની હકીકત છે. પણ તે સાધનોકરણના એક ભાગ તરીકે, કિયાશીલ સિદ્ધાંતના તરફ તરીકે, સંકલ્પ અને તેનો હેતુ હોવાં જોઈએ”.

( હિન્દુ જવન, ૫૪૮ ૧૩૪ )

મધુર માતાજી, આ વાક્યના છેલ્ખા ભાગને શું સમજું ન શક્યો.

તમને શું નથી સમજાતું? શ્રી અરવિદ કહે છે કે વિશ્વની તત્ત્વક વાસ્તવિકતાનું સત્તા સત્યની અનિવાર્ય પરિપૂર્તિ રૂપે ઉત્કાન્ત પરિષુમતી હોય છે. આ સત્યની પરિપૂર્તિ સત્તા સત્યની પરિપૂર્તિ એ ઉત્કાન્તનાં પાયાની હક્કીકત છે, અર્થાતું તે ઉત્કાન્તનું કારણ અને તત્ત્વ છે. પણ સ્વાભાવિક રીતે જી, જે આ સત્તનું સત્ય અનિવાર્ય રીતે પરિપૂર્ણ થાય, તો તે સંકલ્પ અને તેના હેતુ દ્વારા જ બની શકે. તે બધાને સિદ્ધ કરવા માટે લક્ષ્ય અને સંકલ્પ હોવાં જોઈએ.

પોતાની જાને પરિપૂર્ણ કરવા માટે આ સત્યમાં પરિપૂર્ણતા વાવવાનો સંકલ્પ અને જેને તે પરિપૂર્ણ કરવા માગે છે તે લક્ષ્ય, હેતુ, યોજના હોવાં જોઈએ. અમુક વસ્તુ સિદ્ધ કરવા માટે, માણસમાં તે કરવાનો સંકલ્પ હોવો જોઈએ; અને તે કરવા માટેનો સંકલ્પ હોવા માટે, પોતે શું કરવા માગે છે તેનું જ્ઞાન હાણું જોઈએ. પોતે શું કરવા માગે છે તે જે માણસ જાણતો ન હોય, તો તે તેને સિદ્ધ ન કરી શકે. પ્રથમ તો તેણે જાણવું જોઈએ, એક યોજના હોવી જોઈએ, હેતુ અને કાર્યક્રમ હોવા જોઈએ. પોતાને શું કરણું છે તે માણસે જાણવું જોઈએ. પછી તે કરવાનો પોતામાં સંકલ્પ હોવો જોઈએ, પછી જ તે કાર્ય સિદ્ધ કરી શકે.

શ્રી અરવિદ કહે છે કે વિશ્વ એ વૈશ્વક સત્તા સત્યની ઉત્કાન્તમય પરિપૂર્તિ છે. વિશ્વનું ગ્રાગટ્ય એ વૈશ્વિક સત્તા સત્યની પ્રગતિશીલ, ઉત્કાન્તમય પરિપૂર્તિ છે. પણ આ સત્યની પરિપૂર્તિ થાય તે માટે, આવશ્યક રીતે, તેનામાં એક યોજના હોવી જોઈએ, અર્થાતું પોતે શું કરવા માગે છે તે તેણે જાણવું જોઈએ અને તે સિદ્ધ કરવા માટેનો તેનામાં સંકલ્પ હોવો જોઈએ.

જ્યારે તમે કાંઈક કરવા માગો છો, ત્યારે તમે તે જાણતા હો છો. નહિ વારુ? પછી તમે તે કરવાને સંકલ્પ કરો છો; નહિ તો તમે તે કાર્ય કરી ન શકો. પણ તે એક જ વસ્તુ છે. શ્રી અરવિદ તે કહેવા માગે છે.

એ તો ચોક્કસ કબૂલ કરવું જ પડ્યે કે વિશ્વમાં એક યોજના છે, વિશ્વ કોઈ અક્ષમાત વડે બનેલું નથી, તે યોજના સિદ્ધ કરવા માટેનો સંકલ્પ છે; નહિ તો કશું જ બની શકે નહિ. જે લોકો એમ કહે છે કે વિશ્વમાં કોઈ યોજના અને

સંકલ્પ નથી, તેમનો શ્રી અરવિદ વિરોધ કરે છે. પણ જે ક્ષણે આપણે એમ કબૂલ કરીએ કે વિશ્વની પીઠમાં ચેતના છે, સચેતન અસ્તિત્વ છે, ત્યારે આપણે એ પણ સાથે સાથે કબૂલી લઈએ છીએ કે આ વિશ્વમાં કોઈ યોજના છે અને એ યોજનાને સિદ્ધ કરનાર સંકલ્પ છે. શ્રી અરવિદ એટલું જ કહેવા માગે છે. તે સરળ છે, નહિ વારુ?

તમારે માત્ર આને વ્યક્તિત્વના સ્કેર્લમાં નાનું બનાવવાનું રહે છે, જ્યારે કોઈ માલસ સચેતન હોય છે અને સભાનતાપૂર્વક અમૃત કાર્ય કરતા હોય છે ત્યારે પોતાને શું કરવું છે અને તે માટેની યોજના તે જાણુતો હોય છે. દા.ન. જ્યારે તમે તમારા છાત્રાલયના વાર્ષિક દિન માટે એક કાર્યક્રમ તૈયાર કરતા હો છો, ત્યારે તમારી પાસે એક હેતુ હોય છે, નહિ, વારુ? તમે વાર્ષિક દિન માટે એક કાર્યક્રમ ઘડવા માગતા હો છો, અને એટલે તમારી પાસે એક યોજના હોય છે. તમે શું કરવું તેની પસંદગી કરતા હો છો, કેવી રીતે કરવું તે નક્કી કરતા હો છો વળી સાથે સાથે તમે તે કરવા માગતા હો છો (તમારામાં તે પ્રકારનો સંકલ્પ હોય છે). નહિ તો તમે તે કરી જ ન શકો. શ્રી અરવિદ તે જ કહેવા માગે છે. જો વિશ્વ એક સચેતન વસ્તુ હોય, જો એક ચેતના હોય કે જે પોતાની જાતને તેમાં અભિવ્યક્ત કરી રહી છે, તો તે અનિવાર્ય રીતે પોતાની જાતને, એક યોજના અનુસાર અને પોતાની જાતને અભિવ્યક્ત કરવાના સંકલ્પપૂર્વક, વ્યક્ત કરતી હોય છે.

તમે સમજુ શક્યા? યોડુક!

તમે એટલું તો જણો છો ને કે, અમૃત કાર્ય કરવા માટે, માલસને પોતે શું કરવા માગે છે તેનું જ્ઞાન હોનું જોઈએ, અને પછી તેનામાં તે કાર્ય કરવાનો સંકલ્પ હોવો જોઈએ? જો તમારે અહીંથી પેલી જગ્યાએ ચાલીને જવું હોય, તો તમારે નક્કી કરવું જોઈએ કે, મારે અહીંથી ત્યાં જવું છે. અને પછી તમારામાં ચાલીને ત્યાં જવાનો સંકલ્પ હોવો જોઈએ. નહિ તો તમે ગતિ જ નહિ કરો. બરાબર?

હા.

આહ, તે એ જ વાત છે, તેના જેવી તહેન્સ સહેલી વાત છે.

(મૌન)

બોકો એટલો બધી સ્વર્ણભૂ રીતે અને આપોઆપ જ કાર્ય કરતા હોય છે, તે કાર્ય કરતાં તેઓ પોતાની જતનું બિલ્કુલ અવલોકન કરતા હોતા નથી, કે જો તેઓ પોતાની જતને પૂછે કે, આ કેમ બન્યું, તો તે પ્રક્રિયાનું તેમને ભાન થતાં કેટલોક સમય લાગે છે. તમે જીવાથી એટલા બધા ટેવાઈ ગયા હો છો, કે તે કેવી રીતે બને છે તે તમે જાણતાં પણ નથી હોતા. જીવનનાં સર્વ અલિન્યો અને ગતિઓ સાહજિક રીતે, આપોઆપ, અને સભાનતાપૂર્વક થતાં હોય છે, અર્ધ-સચેતન અવસ્થામાં થતાં હોય છે; અને માણસને આ સારી વસ્તુનો પણ ખ્યાલ આપતો નથી કે કાર્ય કરવામાં, પોતાને શું કરવું છે તે માણસે જાણું જોઈએ અને પછી તેનામાં તે કાર્ય કરવાનો સંકલ્પ હોવા જોઈએ. જ્યારે પોતાના મનમાં તે કાર્યની પોણના ઘડવામાં અને તેને કાર્યાન્વિત બનાવવાની પોતાની શક્તિમાં કંઈક ગરબડ ઉલ્લી થાય છે, ત્યારે તે માણસને ચિત્તા થતા લાગે છે કે, હું વ્યવસ્થિત તો છું ને! દા. ત. સવારમાં ઉદ્દીને જો તમને એ યાદ ન રહે કે, મારે મોં ધોવાનું છે, પોથાક પહેરવાનો છે, નાસ્તો આવાનો છે, આ કે તે કામ કરવાનું છે, તો તમે તમારી જતને કહેશો કે, કંઈક ગરબડ છે; મારે શું કરવું તેની મને ખબર પડતી નથી; કંઈક વસ્તુ અવ્યવસ્થિત બની ગઈ છે.

પછી વળી, તમે શું કરવું તે જાણતા હો કે તમારે ઊંઘવાનું છે, સનાન કરવાનું છે, પોથાક પહેરવાનો છે; પણ તમે તે કહી શકતા હોતા નથી, કારણ કે તમારામાં તે કરવાનો સંકલ્પ હોતો નથી, સંકલ્પનો આવેગ હોતો નથી. તે તમારા શરીર પર કાર્ય કરતો હોતો નથી. ત્યારે વળી પાછા તમે ચિંતિત બની જઈને તમારી જતને પૂછો છો કે, કોઈ અક્ષમાતને કારણે હું શું માંદો પડી ગયો છું?

બાકી તો, આખું જીવન આ પ્રકારે ચાલતું હોય છે તેનું તમને ભાન નથી હોતું. તે એમ જ હોય, તે તમને સ્વાભાવિક લાગે છે. તેનો અર્થ એ થયો કે, તમે અર્ધસચેતન રીતે કાર્ય કરતા હો છો. તે આપોઆપ બનતું હોય છે, તે એક સ્વર્ણભૂ ટેવ બની ગઈ છે. તમે શું કરો છો તેનું તમે બારીકાઈપૂર્વક અવલોકન કરતા હોતા નથી, એટલે જો તમારે તમારી ગતિઓ ઉપર થોડો ધ્યાન કાબુ લાવવો હોય તો પ્રથમ તો શું બની રહ્યું છે તે તમારે જાણવું જોઈએ.

હક્કીકતમાં, આ જ કારણને લીધે વસ્તુઓ ઢીકદાક ચાલતી હોતી નથી. જો તે સામાન્ય, દૈનિક છંદોમયતા અનુસાર ચાલે, તો પોતે શું કહી રહ્યો છે તેનું

ભાન માણસને કદી ન થાય. તે ટેવ વડે, આપોઆપ, સ્વયંભૂ રીતે, વિચાર કર્યા વિના, કાર્ય કરે. પોતે શું કરી રહ્યો છે તેનું તે અવલોકન ન કરે, અને તેથી તે કદી આત્મપ્રભુત્વ પ્રાપ્ત ન કરી શકે. તે ચીઠમાં રહ્યીને પોતાની જતને વ્યક્ત કરતી ચેતના જેવું કાંઈક બની રહે, તમે શું કહી રહ્યા છો તેનું તમે અવલોકન ન કરો, અને તે તમને કાર્યમાં ધક્કેલે પછી જો કોઈ વિચિત્ર અથવા અજ્ઞાન શક્તિનો પ્રવાહ આવે, તો તે તમારી પાસે ગમે તેવું કામ કરાવે, જે પ્રક્રિયા તમારી પાસે આમ કરાવી રહી છે તેનું તમે અવલોકન કર્યું જ ન હોય. હક્કીકતમાં, આમ જ બનતું હોય છે.

જ્યારે માણસ પ્રક્રિયાથી તદ્દન સભાન હોય છે, જીવન, જીવનની ગતિ, અને જીવનની પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરી રહ્યાં છે તે જાણતો હોય છે; ત્યારે જ કાબૂ આવવાનો પ્રારંભ થાય છે. નહિ તો, પ્રથમ તો તેને કાબૂ રાખવાનો વિચાર જ આવતો હોતો નથી. પણ જો અણગમતી વસ્તુઓ બને, જો કોઈ ખરાબ પરિણામો લાવી આપે તેવી ઘટનાઓ બને, તો તમે તમારી જતને કહા છો કે, ઓહ, મારે આમ કરતાં અટકી જલું જોઈએ. તે ક્ષણે તમને ભાન થાય છે કે, જીવનની પણ એક ખાસ ટેક્નોલોજી (કળા) હોય છે, જેની તમારા જીવન પર કાબૂ રાખવા માટે તમારે જરૂર પડે છે! બાકી તો માણસ કાર્યોના અને પ્રતિ-કાર્યોના, જગતયોના અને આવોગોના, વત્તાઓથી પ્રમાણમાં, સંગરિન સંમિશ્રણ જેવો, શંખુમેળા જેવો હોય છે. વસ્તુઓં કેવી રીતે બને છે તે તે જાણતો જ હોનો નથી. આ તો વિકાસ સાધનો વડે, ઘર્પણો વડે, જીવનની દેખીતી અવ્યવસ્થાઓ વડે, અને ખૂબ નાનાં બાળકોમાં જે વસ્તુ ચેતનાનું નિર્માણ કરે છે તેના વડે, થતો હોય છે. નાનું બાળક તદ્દન અચેતન હોય છે, ખૂબ ધીમે ધીમે તે વસ્તુઓથી સભાન બનવાની થરુથાત કરતું હોય છે. પણ જો ખાસ દરકાર બેચામાં ન આવે, તો માણસો પોતાનું સમગ્ર જીવન, પોતે કેવી રીતે જીવી રહ્યા છે તે જાણ્યા સિવાય જ, વીતાવતા હોય છે. તેનાથી તેઓ સભાન હોતા નથી.

એટલે ગમે તે વસ્તુ બની શકે.

પણ ભૌતિક જગતમાં પોતાની જતથી સભાન બનવા પ્રત્યેનું આ પ્રથમ, ખૂબ નાનકડું પગલું છે.

તમારામાં અસ્પષ્ટ વિચારો અને લાગણીઓ હોય છે, જે વત્તાઓણ પ્રમાણમાં તર્કુક્ત રીતે, વધારે તો તર્ક વગર જ વિકસતાં હોય છે. પછી તમને તેનું

અસ્પષ્ટ ભાન થાય છે. વળી પાછા જ્યારે તમે દાજોઓ છો, ત્યારે તમને ખ્યાલ આવે છે કે કંઈક ગરબડ ઉલ્લી થઈ; જ્યારે તમે પડી જાઓ છો અને તમને ઈજ થાય છે, ત્યારે તમને ખ્યાલ આવે છે કે કંઈક ગરબડ ઉલ્લી થઈ. તે તમને વિચારતા કરી મૂકે છે કે તમારે દાજોઓ નહિ અથવા પડી ન જાઓ તે બાબત દ્વારા રાખવું જોઈએ. બાલ અનુભવથી, બાલ સંપર્કથી ધીમે ધીમે તમારામાં તે ભાન ઉગે છે. બાંઝી તો, માણસ અર્થચેતન જણ્યો છે, જે જરૂર કરે છે, શા માટે અને કેવી રીતે તે જાણ્યા સિવાય જ.

અચેતનતાની પ્રાથમિક સ્થિતિમાંથી બહાર આવવાની આ ખૂબ નાનકડી શરૂઆત છે.

\*

## ૫ ઝીયુઆરી ૧૯૫૮

“હેતુપુરાઃસર બનાવેલી સૂછિત સામેનો તરત્વચિંતનીય વાંદ્યો વધારે ગંભીર છે, કારણ કે એ વાત સ્વર્પણ સ્પષ્ટ છે કે પરમાત્માને પોતાના આવિભાવ માટે, આવિભાવના આનંદ સિવાય બીજો કોઈ હેતુ ન હોઈ શકે. આવિભાવના ભાગ રૂપે, પદાર્થતત્ત્વમાં ઉત્કાંતિમય ગતિ આ વૈશ્વિક કથનમાં જ આવી જવી જોઈએ, તે માત્ર પ્રગટીકરણના, પ્રગતિશીલ કર્યાના, નિર્ઝેંતુક કમિક આત્મપ્રગટીકરણના આનંદ માટે જ હોઈ શકે, વૈશ્વિક સમગ્રતાને પણ પોતામાં કોઈક પરિપૂર્ણ વસ્તુ માની શકાય. સમગ્રતારૂપે તેને અસ્તિત્વની પરિપૂર્ણતામાં કોઈ વધારો ઘટાડો કરવાનો હાતો નથી. તેથી તે માત્ર અવિકસિત અભૌતિક તત્ત્વોની હાજરીનો જ અથવા પદાર્થતત્ત્વમાં સમાવિષ્ટ સમગ્રની શક્તિઓની જ હાજરીનો જ સ્વીકાર કરી શકે ઓટલું જ નહિ, પણ અહીં લૌટિક મર્યાદાની કડકાઈમાંથી ઉચ્ચતર શક્તિઓને, પદ્ધતિની ઉચ્ચતર કક્ષાઓમાંથી મુક્ત કરવા માટે, તે શક્તિઓના આવતરણનો પણ સ્વીકાર કરી શકે, અસ્તિત્વની મહત્તર શક્તિઓનો આવિભાવ જે જ્યાં સુધી તે સમગ્ર સત્તુ, લૌટિક જગતમાં ઉચ્ચતર આધ્યાત્મિક સૂછિત રૂપે, પોતાની જાતને પ્રગટ કરી શકે ત્યાં સુધી ઉત્કાંતિનો હેતુ માની શકાય. આ હેતુ એવા કોઈ અંશને નથી બર્દ આવતું કે જે સમગ્રમાં ન હોય. તે માત્ર અંશમાં સમગ્રના સાક્ષાત્કારનો

પ્રસ્તાવ રજૂ કરે છે. જો તે હેતુ માત્ર માનવીય અર્થવાળો ન હોય, પણ અંદર રહેલા આત્માના સંકલ્પમાં રહેલી ભૌતિક સ્થેતન ન્યૂટ-જરૂરિયાતનો આવેગ હોય, સમગ્ર ગનિમાં સાહિન્જક રીતે રહેલી સર્વ શક્યતાઓનું પરિપૂર્ણ પ્રગટીકરણ હોય, તો તે હેતુને સ્વીકારવામાં કોઈ વાધો ન હોઈ શકે. એ વાત નિઃશંક છે કે, અહીં બધું જ અસ્તિત્વના આનંદ માટે વિદ્યમાન છે, બધું જ લીલા-રૂપ છે. પણ લીલામાં ચે કોઈ હેતુ સિદ્ધ કરવાનો રહેલો હોય છે; તે હેતુ સિદ્ધ થયા સિવાય તે લીલાની અર્થવત્તા પરિપૂર્ણ ન બને. ઉપસંહાર વગરનું નાટક એક કલામય શક્યતા હોઈ શકે જેમાં પાત્રોનું અવલોકન કરવાનો જ આનંદ હેતુરૂપ હોય, અને જેમાં કોઈ ઉકેલ આખ્યા સિવાય સમસ્યાઓ ઉપરિથિત કરવામાં આવી હોય અથવા જેમાં ઉકેલની શંકાસ્પદ સમતુલાને હંમેશને માટે અધ્યર રાખવામાં આવી હોય. પાર્થીનું ઉક્કાનિતના નાટકને તે પ્રકારનું નાટક માની શકાય; પણ જેનો ઈરાદો રાખવામાં આવ્યો હોય અથવા જે સાહિન્જક રીતે પૂર્વનિશ્ચિત હોય તેવા ઉપસંહારની વધારે ખાતરી રાખી શકાય. આનંદ સર્વ સતતનું નિગૂઢ તત્ત્વ છે, સતતની અધી કિયાઓનો આધાર છે. પણ તે આનંદમાં સતતમાં રહેલા સત્યનું કાર્ય, સતતમાં રહેલી શક્તિનું તથા સંકલ્પનું કાર્ય, જે નિગૂઢ ચિત્તશક્તિની સભાનતા વડે ટકી રહ્યું છે, જે ચિત્તશક્તિ તેની સર્વ કિયાઓનો કાર્યરત એજન્ટ છે, તેમની અર્થવત્તાનો જ્ઞાતા છે તેને ભાડાત ન રાખી શકાય.”

જો આ સમસ્યાને સામાન્ય વિચારવાના માણસને સમજાવવી હોય, તો એમ માનવું જોઈએ કે બધું જ શાશ્વત કાળથી અસ્તિત્વ ધરાવે છે અને તેથી બધું જ એકી સાથે અસ્તિત્વ ધરાવે છે. પણ આ સમગ્ર, એકી વખતે શાશ્વત કાળથી વિદ્યમાન અસ્તિત્વ એ ચેતનાનો એક ધર્મગુણ છે, જે ચેતના પોતાના પ્રદેશોનાં પર્યટન કરવામાં આનંદ માણસી હોય છે, જે શાશ્વત કાળમાં રહેલી વસ્તુઓ એક પદ્ધતિ બીજા એવી શોધમાં નીકળતી હોય છે, પણ જે પ્રદેશોની મુલાકાત પરમાત્માએ કર્તા લીધી હોતી નથી. તે કષ્ટની પસંદગી અનુસાર કરાપેલા, ખૂબ અચિત્તિત, અદૃષ્ટપૂર્વ તદ્દન મુજલ માર્ગનું પરમાત્મા અનુસરણ કરતા હોય છે, જેથી તે શાશ્વત પ્રદેશની મુલાકાત ભગવાન, અચિત્ય રીતે, આગાહી ન કરી શકાય તે રીતે, બઈ શકે અને સર્વ શક્યતાઓનું તથા સંબંધાનું દ્વાર ખોલી શકે.

વળી તે શોધ આત્મશોધ છે. કારણું આ પ્રદેશ તે પોતે જ છે. તે શોધ તાત્કાલિક નિરૂપિણા, મન વડે વિચારી શકાય તેવી કોઈ ઘોણના સિવાય જ, સંપૂર્ણ

સ્વતંત્રતાના આનંદ સહિત, દરેક કારણની અચિત્યતા પૂર્વક થતી હોય છે. તે પોતાના અસ્તિત્વમાં જ એક સનાતન શાશ્વત મુસાફરી હોય છે.

દરેક વસ્તુ પરિપૂર્ણ રીતે પૂર્વનિશ્ચિત છે, કારણકે દરેક વસ્તુ શાશ્વત કાળથી વિદ્યમાન હોય છે; પણ જે માર્ગે તે મુસાફરી કરે છે તેમાં સ્વતંત્રતા અને અચિત્યતા હોય છે, કે જે બે વસ્તુઓ પણ પરિપૂર્ણ હોય છે.

આ રીતે એકી જ સમયે જગતો અસ્તિત્વમાં હોઈ શકે, જેમાં દેખીતી રીતે કોઈ પારસ્પરિક સંબંધ નથી હોતો અને છતાં જે એકી- સાથે વિદ્યમાન હોય છે, પણ તેમની શોધ ધોમેધીમે થતી હોય છે, અને તેથી તે એક નવીન સૃજિત હોય એવો ઘ્યાલ પેદા થાય છે. વસ્તુઓને આ રીતે જોવાથી, આપણને સહેલાઈં-પૂર્વક સમજશે કે, આપણે જાણીએ છોએ તેવા, અપૂર્ણતાઓવાળા, મર્યાદાઓવાળા, અજ્ઞાનપૂર્ણ, જૌતિક જગતની સાથે સાથે બીજાં પણ કેટલાંક જગતો છે, જેમનો સ્વભાવ આપણા જગતના સ્વભાવ કરતાં બિન્ન પ્રકારનો છે, જે પોતાના પ્રદેશોમાં વિદ્યમાન હોય છે. પણ બિન્ન સ્વભાવને અને પ્રદેશોને કારણે, આપણે માટે તે અસ્તિત્વ ન ધરાવતાં હોય તેવાં છે, કારણકે આપણને તેમની સાથે કોઈ સંબંધ હોતો નથી. પણ જે કારણે આ મહાન સનાતન યાત્રા આ જગતમાંથી તે જગતમાં જાય છે, આગળ વધે છે, ત્યારે સનાતન ચેતનારૂપ કરી અનિવાર્ય રીતે સર્જાશે, અને ધીમે ધીમે તે બે જગતો એકબીજા સાથે સંબંધમાં આવશે.

સાચી રીતે કહીએ તો, આ વસ્તુ બની રહી છે. આપણે ખાતરોપૂર્વક કહી શકીએ કે અનિમાનસ જગત કયારણુંએ અસ્તિત્વમાં છે જ, પરમ ચેતનાની મુસાફરીમાં તે લક્ષ્ય બને તે માટેનો સમય આવી પહોંચ્યો છે. પછી ધીમે ધીમે આ જગત વચ્ચે અને અનિમાનસ જગત વચ્ચે એક સયેતન કરીનું નિર્માણ થશે, અને આ મુસાફરીની નવીન દર્શનાના પરિણામે તે બે જગતો વચ્ચે એક નવીન સંબંધ સ્થપાશે.

આ સમજૂતિ બીજી કોઈ પણ સમજૂતિ જેટથી જ સરસ છે, અને તે કદાચ જે બોકે તરત્વચિંતકો નથી તેમના વડે સહેલાઈથી સમજ શકાય તેવી છે, કુમથી કમ, મને તો આ સમજૂતિ ગમે છે!

માતાજી, તમે કલ્યાં કે દરેક વસ્તુ પૂર્વનિશ્ચિત છે. તો પછી અંગત પ્રયાસ કર્યાંથી આવે છે?

મેં તમને એક કાળ પહેલાં જ કહ્યું હતું કે મહાન યાત્રી દરેક કાણે ચેતનાના માર્ગની પસંદગી કરતો હોય છે; તે પસંદગીની પૂરી સ્વતંત્રતા છે; તે વૈભિક પ્રગટીકરણ માટે આગાહી ન કરી શકાય તેવો આભાસ, પરિવર્તનની શક્યતા ઉત્પજ્ઞ કરે છે, કારણકે જે અગવાનને માર્ગ બદલવો હોય, તો તેમ કરવા માટે તે સંપૂર્ણ-પણે સ્વતંત્ર છે. પણ દરેક વસ્તુ વિદ્યમાન છે જ જ; તેથી તે સંપૂર્ણપણે પૂર્વનિશ્ચિત છે. તે હમેશાં હોય છે જ, પણ તેની શોધ ખૂબ અપૂર્વ ચિહ્નિત રીતે થતી હોય છે, આ શોધમાં જ સ્વતંત્રતા રહેલી છે.

તમે ફરવા નીકળ્યા હો છો, અને તમને ઓચિતું એક માર્ગને બદલે બીજો માર્ગ લેવાનું મન થાય છે. એટલે તમે જે માર્ગ દો છો, તે તદ્દન નવીન છે. પણ તમે જ્યાં જતા હો છો તે જગ્યાએ વસ્તુઓ પહેલેથી હતી જ, પૂર્વનિશ્ચિત હતી; પણ તમારી શોધ પૂર્વનિશ્ચિત ન હતી.

બેશક, પરમ ચેતના સાથે તાદાત્મ્ય પામેલી ચેતનાને જ અસંપૂર્ણ સ્વતંત્રતાની લાગળી હોઈ થકે. જ્યાં સુધી તમે પરમ ચેતના સાથે એકરૂપ બની ગયા હોતા નથી, ત્યાં સુધી તમને એમ લાગતું હોય છે કે હું ઉચ્ચતર સંકલ્યના નિયમને પરાધીન દ્યું. પણ જે કાણે તમે એ સંકલ્ય સાથે તાદાત્મ્ય કરો છો, તે જ કાણે તમે સંપૂર્ણપણે સ્વતંત્ર બની જાઓ છો.

શ્રી અરવિંદે જે હમેશાં કહ્યું છે તે જ આનંદ અર્થ નીકળે છે કે પરમાત્મા સાથેની એકતા દ્વારા જ સાચી સ્વતંત્રતા સિદ્ધ થાય છે.

\*

## ૧૨ ફેબ્રુઆરી ૧૯૫૮

માતાજી, દરેક નવા જીવનમાં નવું મન, નવો પ્રાણ, અને નવું શરીર મળતો હોય છે. તેમને માટે પૂર્વ જન્મનો અનુભવો કેવી રીતે ઉપયોગી બને? આપણે તે શું અનુભવોમાંથી ફરી પસાર થવું પડતું હોય છે?

તે વાત માણસો પર આધાર રાખે છે.

મન અને પ્રાણ એક જીવનમાંથી બીજા જીવન દ્વારા વિકાસ કે પ્રગતિ કરતાં હોતાં નથી, સિવાય કે અપવાદૃપ પ્રસંગેમાં અને ઉત્કાનિતની ખૂબ આગળ વધેલી અવસ્થામાં ચૈતસિક અસ્તિત્વ જ પ્રગતિ કરતું હોય છે. એટલે આમ બનતું હોય છે. ચૈત્યને કિયાના અને આરામના ગાળા વારાફરતી આવતા હોય છે. તેને ભૌતિક શરીરમાં કિયાશીલ જીવનના, પ્રાણના અને મનના અનુભવમાંથી પરિણામતી પ્રગતિ પ્રાપ્ત થતી હોય છે. પછી તે ચૈત્ય તે પ્રગતિને આત્મસાત્ત કરવા માટે આરામમાં જતું હોય છે. જ્યારે તે આત્મસાત્ત કરવાનું કામ પતી જાય છે, પૃથ્વી પરના સક્રિય જીવનમાં તેણે સાધેલી પ્રગતિને તે આત્મસાત્ત કરી લે છે, ત્યારે તે નવીન દુહને ધારણ કરે છે, તે પોતાની સાથે પ્રગતિનાં બધાં પરિણામો લઈ આવતું હોય છે. જો તે ખૂબ વિકસિત સ્થિતિને પ્રાપ્ત થયું હોય, તો તે પોતાને માટેના વાતાવરણની, શરીરની, પોતે જેમાં જીવન જવતું હોય છે, જેમાં તે પોતાના એક યા તો બીજા મુદ્દાના અનુભવને પરિપૂર્ણ જ્ઞાનાવી શકે. ખૂબ આગળ વધેલા પ્રસંગેમાં, શરીર છોડતાં પહેલાં ચૈત્ય નિર્ણય કરી લેતું હોય છે કે, હવેના જન્મમાં મારે ક્યા પ્રકારનું જીવન લેવું.

જ્યારે તે ચૈત્યનું પરિપૂર્ણ નિર્માણ લઈ ગયું છે, તે ખૂબ સંચેતન સત્ત બની ગયું હોય છે, ત્યારે તે નવીન શરીરના નિર્માણ પર અધિષ્ઠાતા બનતું હોય છે, મોટે ભાગે અંદરની અસરો વડે તે તે શરીરનું નિર્માણ કરનાર તત્ત્વોની અને પદાર્થના પદંદળી કરતું હોય છે, જેથી તે શરીર તેની નવીન અનુભૂતિઓને અનુરૂપ બની શકે. પણ તે ખૂબ આગળ વધેલી સ્થિતિમાં બનતું હોય છે. પછી જ્યારે તે સેવા માટે, સામુહિક મદદ કરવા માટે, દિવ્ય કાર્યમાં ભાગ લેવા માટે પૃથ્વી પર પાછું આવતું હોય છે, ત્યારે તે પૂર્વજન્મોમાંથી અમુક પ્રાણિક અને માનસિક તત્ત્વોને તે શરીરમાં લઈ આવતું હોય છે. તે તત્ત્વો પૂર્વજન્મોમાં ચૈતસિક શક્તિઓ વડે સંગઠિત બનેલાં હોય છે. તે શક્તિઓ તે તત્ત્વોના ગર્ભમાં રહેતી હોય છે. તે શક્તિઓને તે સાચવી રાખતું હોય છે, અને પરિણામે તે સર્વ-સાધારણ પ્રગતિમાં ભાગીદાર બની શકતું હોય છે. પણ આ તો ખૂબ ખૂબ આગળ વધેલી સ્થિતિમાં બનતું હોય છે.

જ્યારે ચૈત્ય ખૂબ વિકસિત અને સંચેતન બન્યું હોય છે, જ્યારે તે દિવ્ય સંકલ્પનું સંચેતન કરણ બને છે, ત્યારે તે પ્રાણને તથા મનને એવી રીતે સંગઠિત કરે છે, કે તે પણ સર્વ સાધારણ સંવાદિતામાં ભાગીદાર બની શકે અને તેમને પણ સાચવી રાખી શકાય.



પ્રેરણ અને ઉત્તરે

જો વિકાસ જૂબ સિદ્ધ થયો હોય, તો માનસિક અને પ્રાણિક અસ્તિત્વના કટલાક ભાગો, શરીરનું વિઘટન થતું હોબા છતાં, સાચવી રાખી રહતાય છે. જો માનવીય કિયાના માનસિક અને પ્રાણિક અમુક ભાગો આસ વિકસિત થયા હોય, તો આ માનસિક અને પ્રાણિક ભાગોને તેમના તે જ સ્વરૂપમાં પણ સાચવી રાખી શકાય. પરિપૂર્ણ રીતે સંગઠિત થયેલી કિયાના રૂપમાં પણ દા. ત. જે લોકોએ પોતાના મહિને આસ વિકાસ સાથેલો હોય છે તેવા જૂબ બુદ્ધિશાળી લોકોમાં તેમના અસ્તિત્વનો માનસિક ભાગ પોતાના બંધાયણને સાચવી રાખે છે. સંગઠિત મહિને રૂપમાં, જે મહિને પોતાનું આગામું જીવન હોય છે, જેને ભાવિ જન્મ માટે, કોઈ પરિવર્તન કર્યા સિવાય, સાચવી રાખેલું હોય છે, નેથી તે સર્વ બુઝે સાથે તે મહિને જીવનમાં ભાગ લઈ શકે.

જે કલાકારોએ અને સંગીતકારોએ પોતાના હાથનો ઉપયોગ ખાસ સચેતન રીતે કરેલો હોય છે, તેમનું માનસિક અને પ્રાણિક પદાર્થતત્ત્વ તેમના હાથોમાં સચ્ચવાઈ રહે છે; એ હાથો સંપૂર્ણ રીતે સચેતન રહે છે, જે સંબંધમાં કોઈ આસ સામ્ય હોય તો તેમના તે હાથો બીજા લોકોના શરીરનો પણ ઉપયોગ કરે છે.

બાકી સામાન્ય લોકો, જેમનામાં થૈન્ડરૂપ સંપૂર્ણપણે વિકસ્યું હોયાં નથી, સંગઠન થયું હોયાં નથી, તેઓ જ્યારે ટેહનો ત્યાગ કરે છે, ત્યારે જે તેમનું મરણ થાન્તરપૂર્વક અને એજાગ્રતાપૂર્વક થયું હોયારો તેમના માનસિક અને પ્રાણિક રૂપો અમુક સમગ્ર સુધી ચાલુ રહે. પગુ જે માણન ઓર્યિનો અને આવેગમય સ્થિતિમાં, ધર્મી આસક્તિનો સાથે, મરી ગયો હોય, તો તેના અસ્તિત્વના જુદા જુદા ભાગો વેરવિભેર થઈ જાય છે, પોતાના પ્રદેશમાં લાંબી કે ટ્રૂંકી મુદ્દત સુધી રહે છે, અને પછી અદૃશ્ય થઈ જાય છે.

શરીરમાં રહેલા થૈન્યની હજારી જ હંમેશાં સંગઠનનું અને ડ્રૂપાંતરનું કેન્દ્ર છે. તેથી એમ માનવું કે કે ભૌતિક જન્મોના વયગાળાના સમગ્રમાં પ્રગતિ ચાલુ રહે છે અથવા વધારે જડપથી અને પરિપૂર્ણ રીતે થાય છે એ એક મોટી લૂલ છે. હક્કીકતમાં, પ્રગતિ બિલકુલ થતી હોતી નથી. કારણકે થૈન્ય આરામની સ્થિતિમાં પ્રવેશતું હોય છે, અને બીજા ભાગો પોતે પોતાના પ્રદેશોમાં લાંબુ કે ટ્રૂંકું અસ્થિર જીવન જાળીને, વિઘટિત થઈ જતા હોય છે.

પાર્થિવ જીવન પ્રગતિ માટેનું સ્થાન છે. આ ખુલ્લી પર, પાર્થિવ અસ્તિત્વ દરમિયાન જ, પ્રગતિ શક્ય છે. થૈન્ય પોતાની ઉત્કાનિતને અને વિકાસને સંગઠિત કરવા વડે, પ્રગતિને એક જન્મ માંથી બીજા જન્મમાં લઈ જાય છે.

૩૭ ફેલ્યુઆરીએ માતાજીને અનુભૂતિ થઈ હતી તેના પરની નોંધ તે વાંચે છે. માસુસો અને પશુઓ વચ્ચે ને બિનનગ છે, લગભગ તેવી જ વિનનતા અતિમાનસ જગત અને માસુસો વચ્ચે છે, થોડાક સમય પહેલાં, મને પશુ જીવન સાથે તરદાતમ્યની અનુભૂતિ થઈ હતી. એ હકીકત છે કે પશુઓ આપણને સમજતાં હોતાં નથી. તેમની ચેતનાનું સંઘટન એવી રીતે થયેલું હોય છે કે પશુઓ આપણને સમજી શકતાં હોતાં નથી, અને છતાં મને એવાં પાલ્ય પશુઓની-કૂતરાં, બિલાડાંની ખબર છે, ને આપણને પહોંચવા માટે લગભગ યોગિક પ્રયાસ કરતાં હતાં. પણ મોટે ભાગે, જ્યારે તેઓ આપણે જેમ જીવોએ છીએ, કાર્ય કરીએ છીએ તેને જુદે છે, ત્યારે તેઓ તેને સમજતાં હોતાં નથી, આપણે જેવા છીએ તે રીતે આપણને જોતાં હોતાં નથી, અને તેથી તેઓ આપણે ઝરણે દુઃખી બનતાં હોય છે. આપણે તેમને માટે એક સમસ્યાઓ બની જઈએ છીએ, તેમની ચેતનાના ખૂબ નાનકડા ભાગને આપણી સાથે કડી હોય છે. જ્યારે આપણું અતિમાનસ જગત પ્રન્યે જોઈએ છીએ ત્યારે આપણી પણ ચેતના નેવી જ સિથિત હોય છે. જ્યારે આપણી અને અતિમાનસ જગત વચ્ચે કડી સ્થપાણો, ત્યારે જ આપણે તેને જોઈ શકીશું; ત્યારે પણ આપણા અસ્તિત્વનો ને ભાગ રૂપાંતર પામ્યો હોય, તે જ તે જગતને જોઈ શક્યો; નહિ તો તે બંને જગતો પશુઓનાં અને માનવોનાં જગતોની ગેઠે, એક બીજાથી દૂર રહેશે.

૩૭ ફેલ્યુઆરીએ મને ને અનુભૂતિ થઈ હતી તે આની સાબિતી છે. તે પહેલાં મને અતિમાનસ જગત સાથે વ્યક્તિગત, વિષયિગત સંપર્ક હતો. પણ ૩૭ ફેલ્યુઆરીએ હું તે જગતમાં એટલી સંઘનતાપૂર્વક ગઈ, કે એટલી સંઘનતા-પૂર્વક હું પેરિસમાં હરતીફરતી હતી, તે જગત કેવળ ચોતામાં જ અસ્તિત્વ ધરાવે છે, જર્વ વિષયિગતતાની બહાર.

તે બે જગતો વચ્ચે પુલ બાંધવા સમાન છે. મેં તે અનુભૂતિને તરત જ પાછળથી ટપકાવો લીધી હતી. તે અનુભૂતિ આવી હતી.

(મૌન)

અતિમાનસ જગત નિત્ય-રૂપે અસ્તિત્વમાં છે; હું તેમાં, અતિમાનસ શરીરમાં નિત્યરૂપે હતી. આજે પણ મારી પાસે તેની સાબિતી છે. મારી પાર્થિવ ચેતના, બપેરે બેધી ત્રાણ વાગ્યાની વચ્ચે, સચેતનતાપૂર્વક લ્યાં ગઈ હતી અને રહી હતી. હવે હું જાણું છું કે લોતિક જગત જત્યારે જેવું છે અને અતિ-

માનસ જગત જેવું છે તે બેની વચ્ચે એક એવા વચ્ચગાળાના પ્રદેશ . જે આ બે જગતોનું એક સતત અને સભાન સંબંધમાં મિલન થાય તેને અશક્ય બનાવી દે છે. આ પ્રદેશનું હજુ નિર્માણ કરવાનું છે. વ્યક્તિની ચેતનામાં અને વિષયગત જગતમાં તેનું નિર્માણ થઈ રહ્યું છે. હું તે વચ્ચગાળાના પ્રદેશની વાત કરી રહી હતી. તે જ રીતે, જ્યારે હું આ બાજુઓ આ ભૌતિક ચેતનાના ક્ષેત્રમાં છું, અને અતિમાનસ જગત પ્રત્યે જોઉં છું, ત્યારે મને દેખાય છે કે અતિમાનસ શક્તિ, અતિમાનસ પ્રકાશ અને પદાર્થતત્ત્વ સતત અહીના પદાર્થતત્ત્વને બેદીને અંદર પ્રવેશ કરી રહ્યાં છે. તે આ વચ્ચગાળાના પ્રદેશનું નિર્માણ છે, જેમાં હું ભાગ લઈ રહી છું.

હું એક મોટી હેડીમાં હતી, જે આ સ્થાનનું પ્રતીક હતું, જ્યાં આ કાર્ય ચાલી રહ્યું છે. તે હેડી એક નગર જેટલી વિશાળ છે. તેનું સંપૂર્ણપણે સંગઠન થયેલું છે. તે ચોક્કસ થોડા સમયથી કાર્ય કરી રહી હતી, કારણકે તેનું સંગઠન પરિપૂર્ણ હતું. તે એક એવું સ્થાન છે કે જ્યાં અતિમાનસ જીવન માટે નિર્મિત થયેલા લોકોને તાલીમ મળી રહી છે. આ લોકોનું અથવા તેમના અસ્તિત્વના અમૃત ભાગનું અતિમાનસ ઝ્યાંતર થઈ ચૂક્યું હતું, કારણકે તે નોકા પોતે અને તેના પરનું બધું જ ભૌતિક, સૂક્ષ્મ ભૌતિક, પ્રાણીક કે માનસ ન હતું; ને અતિમાનસ પદાર્થતત્ત્વ હતું. આ પદાર્થતત્ત્વ ખૂબ ભૌતિક અતિમાનસિક, અતિમાનસ હતું, જે ભૌતિક જગતની તદ્દન નજીક, સૌથી વધારે નજીક હતું; ત્યાં તે પ્રથમ પ્રગટ થતાનું હતું, પ્રકાશ સુવર્ણ રંગનું અને લાલ રંગનું મિશ્રણ હતું, જે તેજોમય નારંગી રંગના એક સરખા પદાર્થતત્ત્વને ઉત્પન્ન કરી રહ્યું હતું. દરેક વસ્તુ તે પ્રકારની હતી, પ્રકાશ, ત્યાંના લોકો, બધાનો રંગ તે પ્રકારનો હતો. પણ ને રંગમાં અનેક છાયાઓ હતી, જેથી બધી વસ્તુઓના બેદ પારખી શકાય. તેનો સામાન્ય સંસ્કાર મારા મન પર એવા પડો કે તે છાયાઓ હતી, પણ પડછાયા નહિ. વાયુમંડલ આનંદપૂર્ણ, શાન્ત, વ્યવસ્થિત હતું. દરેક વસ્તુ અને વ્યક્તિ નિયમિત રીતે, મૌનપૂર્વક કાર્ય કર્યે જતાં હતાં. સાથે સાથે, ત્યાં એક પ્રકારની કુણવણી, બધાં ક્ષેત્રોમાં તાલીમ નજરે પડતી હતી, જેના વડે તે નોકા પરના લોકોને તૈયાર કરવામાં આવતા હતા.

આ મોટું વહાણ અતિમાનસ જગતને કિનારે પણોચ્ચયું. આ અતિમાનસ જગતના જે ભાવિ નિવાસીઓ બનવા નિયત થયા હતા. તે લોકોના સમૂહને

ત્યા ઉત્તરાણું હતું. આ પ્રથમ ઉત્તરાણ માટે બધી વ્યવસ્થા કરવામાં આવી હતી. બંદરને કિનારે, જ્યાં વહાણો નાંગરે છે ત્યાં, કેટલાંક ખૂબ ઊંચાં સત્ત્વોને રાખવામાં આવ્યાં હતાં. તે મનુષ્યો ન હતા, તેઓ કદી પહેલાં મનુષ્યો બન્યા ન હતા. તેઓ અતિમાનસ જગતના સ્થાયી નિવાસીઓ પણ ન હતા. તેમને ઊર્ધ્વમાંથી મોકલવામાં આવ્યા હતા; તેમને ઉત્તરાણનું નિયમન કરવા માટે, તેની દેખભાગ કરવા માટે ત્યાં મૂકવામાં આવ્યા હના. શરૂઆતથી જ, બધી સમય, મને તે કામનો ચાર્જ (દેખભાગ) ચોપવામાં આવ્યો હતો. મેં પોતે જ તેમનાં જુથો ગોઠવ્યાં હતાં. હું વહાણમાં, મુખ્ય માર્ગ પર, ઉલ્લી રહી. હું જૂથવાર વહાણમાંના માણસોને બોલાવવા લાગી અને તેમને કિનારા પર મોકલવા લાગી. એવાં ઊંચાં સત્ત્વો ઉત્તરનાર માણસોનું નિરીક્ષણ કરતાં હતાં. જે માણસો તૈયાર હતા તેમને તે ઉત્તરાણી સત્તા આપતાં હતાં, અને જે બોકો હજુ તૈયાર ન હતા અને જેમને હજુ વહાણ પરની તાલીમ ચાલુ રાખવાની હતી તેમને તે પાછા વહાણમાં મોકલી આપતાં હતાં. જ્યારે હું આ બધું જોઈ રહી હતી, ત્યારે પૃથ્વી પરથી આવેલા, મારી ચેતનાના ભાગને તેમાં ખૂબ રસ પડ્યો. તે બધા બોકોને જોવા અને ઓળખવા માગતો હતો, તેમનામાં થયેલા પરિવર્તનને જોવા માગતો હતો, કયા બોકોને તરત બદ્ધ લેવામાં આવે છે અને કયા બોકોને તાલીમ માટે ફરી વહાણ ઉપર પાછા મોકલવામાં આવે છે તે ચેક કરવા માગતો હતો. થોડક સમય પછી, હું તે બધું જોતી જોતી ઉલ્લી હતી ત્યારે, મને એમ લાગવા માંડવું કે મને પાછળથી કોઈક જોંચી રહ્યું હતું, જેથી મારું શરીર કોઈ ચેતના અથવા વ્યક્તિ જગૃત થાય. મારી ચેતનામાં મેં વિરોધ કરતાં કહ્યું કે, “ના, ના. હજુ નહિ, હજુ નહિ! મારે બોકોને જોવા છે.” હું ખૂબ રસપૂર્વક દરેક વસ્તુને જોઈ રહી હતી. વસ્તુઓ આમ બનતી રહી, અને ઘડિયાળમાં ત્રણના ટકેરા પડ્યા. હું બળજબરીથી પાછી આવી. જ્યાં હું ઓચિતી મારા શરીરમાં પાછી પડી ગઈ હોઉં, એવી મને લાગણી થઈ. હું આધાતપૂર્વક પાછી આવી, કારણકે મને ખૂબ ઓચિતી પાછી બોલાવી લેવામાં આવી હતી. પણ મારી ત્યાંની રમૃતિ કાયમ રહી. હું શાન્ત, નિશ્ચેષ્ટ રહી. હું તે સમગ્ર અનુભૂતિને સ્મૃતિમાં રાખી શકી.

વહાણમાંના પદાર્થની પ્રકૃતિ આપણે પૃથ્વી પર જાતીએ છીએ તેવા પ્રકારની ન હતી. દા. ત. વસ્ત્રો કાપડનાં બનાવેલાં ન હતાં, જે કાપડ જેવું જણાનું હતું તે શાળ પર બનાવેલું ન હતું. તે શરીરના ભાગરૂપ હતું. તે એક જ

પદાર્થતત્ત્વનું બનાવેલું હતું, જે ભિન્ન ભિન્ન રૂપો ધારણ કરતું હતું. તેમાં એક પ્રકારની સ્થિતિસ્થાપકતા હતી. જ્યારે તેમાં પરિવર્તન કરવાની જરૂર પડતી, ત્યારે તે પરિવર્તન કૃત્રિમ અને બાધ્ય સાધનો વડે નહિ, પણ આંતર ચેતનાની કિયા દ્વારા કરવામાં આપતું હતું, જે કિયા પદાર્થતત્ત્વને રૂપ આપતી હતી. જીવન પોતાનાં જ રૂપોનું નિર્માણ કરતું હતું. બધી વસ્તુઓમાં એક જ પદાર્થતત્ત્વ હતું. જરૂરિયાત અને ઉપયોગ અનુસાર, તે આ કંપનોની ગુણવત્તામાં પરિવર્તન કરતું હતું.

જે લોકોને ફૂચી તાલીમ માટે પાછા મોકલવામાં આવ્યા હતા, તે એક જ રંગના ન હતા.. પાર્થિવ પદાર્થતત્ત્વ જેવા કોઈ પદાર્થતત્ત્વના જ્ઞાને તેમના શરીર ઉપર ભૂરાશ પડતા, અપારદર્શક ડાધા ન હોય. તેઓ જરૂર દેખાતા હતા, જ્ઞાને પ્રકાશ તેમનામાં પરિપૂર્ણ રીતે પ્રવેશ ન કરી શક્યો હોય તેવા, તેઓ પરિવર્તન પામ્યા ન હતા. સર્વત્ર નહિ, પણ કેટલાક ભાગોમાં તેઓ તે પ્રકાશના હતા.

કિનારા પરનાં ઊંચા સત્ત્વો એક જ નારંગી રંગનાં ન હતાં. તેઓ વધારે ધવળ, પારદર્શક હતાં. તેમના શરીરના એક ભાગ સિવાય, તેમના રૂપની માત્ર રેખા જ દેખાતી હતી. તે બહુ ઊંચાં હનાં, તેમનામાં કોઈ હાડકાં દેખાતાં ન હતાં, જરૂરિયાત મુજબ તેઓ ગમે તે રૂપને ધારણ કરી શકતાં હતાં. માત્ર કમ્મરથી નીચે તેમનામાં એક સ્થાયી ઘનતા હતી, જે તેમના શરીરના ભાકીના ભાગમાં દેખાતી ન હતી. તેમનો રંગ બહુ આછા હતો, થોડોક રાતો, વધારે પ્રમાણમાં સોનેરી અથવા ધવળ. ધવળ પ્રકાશના ભાગો પારદર્શક હતા. તેઓ તદ્દન પારદર્શક ન હતા, પણ ઓછા ઘડું હતા, નારંગી પદાર્થતત્ત્વ કરતાં વધારે સૂક્ષ્મ હતા.

જ્યારે મને પાછી બોલાવવામાં આવી, અને મેં 'જ્ઞાન નહિ' એમ કહ્યું, ત્યારે દર વખતે અતિમાનસ જગતમાં મારા રૂપનું મને આછું દર્શન થતું હતું. હું તે ઊંચાં સત્ત્વોનું અને વહાણ પરનાં પ્રાણીઓનું સંમિશ્રણ હતી, મારો ઉપલો ભાગ, ખાસ કરીને મારું મુખ માત્ર એક સિલ્હૂટ હતું, જેની અંદરના ભાગો ધવળ હના, અને તેમને નારંગી કિનાર હતી. પગ તરફના ભાગોનો રંગ વહાણ ઉપરના લોકો જેવો હતો, નારંગી હતો. ઉપરના ભાગોમાં તે પારદર્શક અને ધવળ હતો, તેમાંની લાલાશ ઓછી થઈ ગઈ હતી. મસ્તક માત્ર એક સિલ્હૂટ હતું, જેમાં સૂર્ય પ્રકાશતો હતો; તેમાંથી કિરણો બહાર આવતાં હતાં, જે સંકલપનું કાર્ય હતું.

વહાણ પર બધા લોકોને હું ઓળખી શકી. તેમાંના કેટલાક આ આશમમાંથી આવેલા હતા, કેટલાક બીજેથી આવેલા હતા, પણ તેમને પણ હું ઓળખતી હતી.

મેં દરેક જાણને જોયો, પણ પાછા આવ્યો પછી હું તેમને યાદ રાખી નહિં શકું, એટલે મેં કોઈ નામ ન આપવાં એવો નિર્ણય કર્યો. ત્રણ-ચાર મુખ બહુ સ્પષ્ટ રીતે દૃષ્ટિગેયર હતાં. મેં જ્યારે તેમને જોયા, ત્યારે મને તેમની આંખોમાં જોતાં આ પૃથ્વી પર જે લાગણી થતી હતી તે સમજાઈ. તે એક અસાધારણ આનંદ હતો. તે બોકો માટે આગે પુવાન હતા; તેમાં બોડાંક બાળમે પણ હતાં. જે ૧૪-૧૫ વર્ષનાં હતાં, ૧૦-૧૨ વર્ષથી નીચેનાં તો નહિં જી. બધી વીગતો જોઈ થકાય તેટલો લાંબો સમય હું ત્યાં રહી ન હતી. બોડાંક અપવાદ સિવાય, તેમાં બહુ વધુ બોકો ન હતા. આ અનુભૂતિ પહેલાં, જ્યાં અતિમાનસીકરણ માટે શક્તિશાલી બોકોની તપાસ કરવામાં આવી હતી, તે સ્થાનમાં તેમાંની કેટલીક વ્યક્તિત્વોની તપાસ કરવામાં આવી હતી. મને બોડાંક આશર્યો પણ પ્રામ થયાં, મેં તેમને જોઈ લીધાં. તે વિષે મેં કેટલાક બોકોને વાત પણ કરો. પણ જેમને મેં આજે કિનારા પર મૂક્યા તેમને મેં બહુ સ્પષ્ટતાપૂર્વક જોયા હતા. તે મધ્ય ઉમ્મરના હતા. નાનાં બાળકો પણ નહિં અને વૃદ્ધો પણ નહિં, સિવાય કે બોડાંક અપવાદો. મેં જે અપેક્ષા રાખી હતી તેની સાથે તે સુસંગત હતું. મેં કશું જ ન કહેવાનો, કોઈ નામો ન આપવાનો નિર્ણય કર્યો. હું ત્યાં અંત સુધી રહી ન હતી, એટલે મને ચોક્કસ ચિત્ર પ્રામ થયું નહિં. તે ચિત્ર પણ તર્દેન સ્પષ્ટ, પરિપૂર્ણ ન હતું. હું કેટલાક બોકોને વસ્તુઓ કહેવા નથી માગતી, અને બીજોઓને નહિં.

હું એમ કહી શકું છું કે દૃષ્ટિબિદ્ધ અથવા નિર્ણય કેવળ તે બોકો જે પદાર્થતત્ત્વના બનેલા હતા તેના પર આધ્યારિત હતો. અર્થાતું, તેઓ પરિપૂર્ણ રીતે અતિમાનસ જગતના હતા કે કેમ, તેઓ તે ખૂબ ખાસ પ્રકારના પદાર્થતત્ત્વના બનેલા હતા કે કેમ. તે દૃષ્ટિબિદ્ધ નોતિક પણ ન હતું અને માનસ ચાલ્યાય પણ ન હતું. ખૂબ સંભવ છે કે જે પદાર્થતત્ત્વનું તેમનું શરીર બનેલું હતું તે એક આંતર નિયમનું અથવા આંતર ગતિનું પરિણામ હતું; તે વખતે તે વાત નિઃશંક હતી. કમ થી કમ, એટલું તો તરદુન સ્પષ્ટ છે કે મૂલ્યો લિનન લિન હોય છે.

જ્યારે હું પાછી આવી, ત્યારે તે અનુભૂતિની સમૃતિ સાથે જ, મેં જાહ્યું કે અતિમાનસ જગત નિત્ય છે, ત્યાં મારી હાજરી પણ નિત્ય છે, ચેતનાની અને તે પદાર્થતત્ત્વની વચ્ચે સંબંધ સ્થાપવા માટે માત્ર ખૂબી કરીની જ જરૂરિયાત છે, અને અત્યારે તે કરીનું નિર્માણ થઈ રહ્યું છે. એક દિવસ સુધી ટકી રહ્યો એવો એક સંસ્કાર મારા પર પડ્યો. તે આ જગત અને તે બીજા જગત

વરચેના સંબંધ વિષે હતો. તેણે મારા દૃષ્ટિબિદ્ધને તદ્દન પદ્ધી નાખ્યું, જે દૃષ્ટિ-  
બિદ્ધથી વસ્તુઓનું મૂલ્યાંકન થવું જોઈએ. આ દૃષ્ટિબિદ્ધમાં કશ્યંય માનસિક ન  
હતું. તેણે મને એક વિચિત્ર અંતર લાગણી પેદા કરી કે ઘણી વસ્તુઓ, જેમને  
આપણે સારી કે નઠારી માનીએ તે ખરી શેતે તેવી નથી હોતી. એ વાત બહુ  
સ્પષ્ટ હતી કે દરેક વસ્તુ વસ્તુઓની શક્તિ પર, અતિમાનસ જગતને વ્યક્ત  
કરવાની યોગ્યતા પર, તેની સાથે સંબંધમાં હોવા પર, આધાર રાખે છે. આપણા  
સામાન્ય મૂલ્યાંકન કરતાં તે તદ્દન લિનન, કેટલીક વાર તો વિશુદ્ધ હતું. આપણે  
સામાન્ય રીતે જેને ખરાબ માનીએ છીએ તેવી એક નાનકડી વસ્તુ મને યાદ  
અવે છે. સાચી રીતે તે ખૂબ સરસ હતી તે જેવું એ કેટલું બધું વિચિત્ર કહેવાય !  
જે વસ્તુઓને આપણે મહત્વની ગણીએ છીએ તે બિલકુલ મહત્વની ન હતી,  
વસ્તુ આવી છે કે તેવી એ જરા પણ મહત્વનું નથી. શું દિવ્ય છે કે આદિવ્ય તે  
બાબતનું આપણું મૂલ્યાંકન બરાબર નથી. કેટલીક વસ્તુઓ જેના મને હસવું આવે  
છે. આપણે જેને આદિવ્ય માનીએ છીએ તે માન્યતા કૃત્રિમ, અસત્ય પર આધારિત  
હોય છે. અહીં આપણે જેને જીવન કહીએ છીએ, તે ત્યાંના જીવન સાથે સર-  
ખાવતાં મને જીવન નથી લાગતું. આ માન્યતાનો આધાર એ બે જગતનાં સંબંધ  
પર, તે સંબંધને વધારે રહેલો અથવા અધરો બનાવતી વસ્તુઓ પર પ્રતિષ્ઠિત  
થવો જોઈએ. આ દૃષ્ટિબિદ્ધને કારણે, ક્યો વસ્તુ આપણને ભગવાનની વધારે  
નશ્ક લઈ જાય છે અને ક્યો વસ્તુ આપણને તેમનાથી દૂર લઈ જાય છે તેના  
આપણા મૂલ્યાંકનમાં ખૂબ બેદ આવી જાય છે. ક્યો વસ્તુ માણસોને અતિમાનસ  
બનાવવામાં મદદ રૂપ છે તેનું મૂલ્યાંકન આપણી સામાન્ય નૈતિક કલ્પનાઓ કરતો  
ખૂબ લિનન હોય છે. મને લાગ્યું કે આપણે ખૂબ હાસ્યાસ્પદ છીએ.

### ( ૩ ઝેદ્ભુઆરીની અનુભૂતિનો અંત )

( માતાજી બાળકોને ઉદ્દીશીને કહે છે : ) ઝ ઝેદ્ભુઆરીની અનુભૂતિનાં પરિ-  
ણામો હજી મારી ચેતનામાં ચાલુ છે. પણ હમણાં તેમનું વાચન કરવું તે જરાક  
વહેલું છે એમ મને લાગ્યું. તે એપ્રિલનાર્થ અંકમાં પ્રગટ થશે. આના પછીનાં  
અંકમાં, મારે આ વાત ભારપૂર્વક કહેવી જોઈએ કે, મને આ જગતમાં અને અતિ-  
માનસ જગતમાં ખૂબ તાત્ત્વિક તફાવત દેખાયો છે. પૃથ્વી પર સામાન્ય રીતે  
કાર્ય કરતી ચેતના સાથે હું ત્યાં ગઈ ત્યાર પછી, તે તફાવતની વિશાળતા મને  
ખૂબ જણાય છે. અહીં જે બની રહ્યું છે, ખૂબ ખૂબ અંદર જે બની રહ્યું છે તેને

૧. ઝુલેટિન, એપ્રિલ ૧૯૫૮. આ વાર્તાલાયના અંતે, પરિશિષ્ટમાં તે આપવામાં આવ્યું છે.

બાદ કરતાં, તે મને તદ્દન કૃત્રિમ લાગ્યું છે. સામાન્ય ભૌતિક જીવનનાં એઈ મૂલ્યો સત્ય પર પ્રતિષ્ઠિત નથી. જેમ પોપક માટે આપણે કાપડ લાવવું પડે છે, તેને શીવવું પડે છે, અને તેને પહેરવાની જરૂર જણાય ત્યારે તેને પહેરવું પડે છે, તે જ રીતે, આપણા શરીરને પોષણ આપવા માટે આપણને બહારની વસ્તુઓ બઈ ઉદરમાં મૂક્યી પડે છે. દરેક બાજતમાં આપણું જીવન કૃત્રિમ હોય છે.

અતિ-માનનીય જગતમાં હોય છે તેણું, સાચું, સાચા દિલનું સ્વર્યાભૂત જીવન સચેતન સંકલ્પના કાર્ય વડે વસ્તુઓમાંથી પ્રગટનું હોય છે. તેમાં પદાર્થ-તત્ત્વ ઉપર એવી એક શક્તિ મુક્ષાય છે, જે આપણે જે જનાવવાનો નિર્ણય કર્યો હોય તેની સાથે તે પદાર્થ-તત્ત્વને સંવાદમય બનાવે છે જેનામાં શક્તિ અને જ્ઞાન છે, તે જે ઈચ્છાઓ હોય તે વસ્તુને પ્રાપ્ત કરી શકે છે. જેનામાં શક્તિ અને જ્ઞાન નથી હોતાં, તેની પાસે ઈચ્છિક વસ્તુ મેળવવાનાં કૃત્રિમ સાધનો નથી હોતાં.

સામાન્ય જીવનમાં બધું જ કૃત્રિમ હોય છે. જન્મ અથવા સંજોગોની તક અનુસાર, તમને ઉચ્ચયતર અથવા નિકૃષ્ટતર સ્થિતિ, વધારે અથવા ઓછું સગવડ બધું જીવન પ્રાપ્ત થતાં હોય છે. તેમાં તમારા અસ્તિત્વનું સ્વર્યાભૂત, સ્વાભાવિક, સાચા દિલનું પ્રગટીકરણ અને તમારી આંતર જરૂરિયાત કારણભૂત નથી હોતાં, પણ જીવનમાંના અકસ્માત્ સંજોગોએ તમને આ વસ્તુઓના સંપર્કમાં મૂકી આપ્યા હોય છે. તદ્દન કુદ્ર માણસ ખૂબ ઊંચા સ્થાને હોઈ શકે, અને સર્જન તથા સંગઠન કરવાની અદ્ભુત શક્તિવાળો માણસ તદ્દન મર્યાદિત અને નિકૃષ્ટ જગ્યાએ મળ્યારી કરતો હોય; જે જગત સાચા દિલનું હોત, તો તે ખૂબ ઉપયોગી વ્યક્તિ બની શક્યો હોત.

આ કૃત્રિમતા, દિલની સરચાઈનો અભાવ, સત્યનો સંપૂર્ણ અભાવ મને એટલી બધી આધાર-જનક રીતે દેખાયાં, કે મને થયું કે આવા અસત્યમય જગતમાં આપણે સાચાં મૂલ્યાંકનો કંવી રીતે કરી શકીએ?

પણ તમને દિવગીર, વિષણુ, બળવાખોર, અસંતુષ્ટ જનાવવાને બદલે, હું આંતમાં એમ કહેવા માગતી હતી, એવી વસ્તુની વાત કરવા માગતી હતી, કે જે ખૂબ હાસ્યાસ્પદ છે. જ્યારે મેં વસ્તુઓને અને લોકોને જોયાં, ત્યારે મને ખૂબ, કાબૂમાં ન રાખી શકાય તેણું, હસલું આવ્યું, જે તે માત્ર હું જ સમજ શકું દૂં. તે હાસ્યાસ્પદ કારણ વસ્તુઓની હાસ્યાસ્પદતા હતી.

જ્યારે મેં તમને અજ્ઞાતમાં, સાહસ-પૂર્ણ યાત્રા કરવા નિમંત્રયા, ત્યારે મને ખબર ન હતી કે, હું સત્યની આટલી બધી નજીક છું. જે લોકો તે સાહસ કરવા માટે તૈયાર છે, તેમને હું આતરી આપું છું કે, તેઓ ખૂબ રસપ્રદ શોધી કરી શકશે.

\*

### પરિશિષ્ટ

૩ ૪ ફેબ્રુઆરીની અનુભૂતિ પછી, ચોડાક દિવસો પછી માતાજીને બીજી અનુભૂતિઓ થઈ હતી, જેમાં પહેલાંની અનુભૂતિ ચાલુ રહી હતી.

દરેક માલુસ પોતાની સાથે, શ્રી અરવિંદ જેને સેન્સર્સ (ખરા-ઘોટાને બતાવી આપનાર) કહે છે, તેને પોતાની સાથે પોતાના વાયુ-મંડળમાં રાખતો હોય છે. તે મોટે ભાગે વિરોધી બળોના ડેલિગેટો (સોંપેલું કામ કરનાર) હોય છે. તેમનું કામ હોય છે દરેક કાર્યની, દરેક વિચારની, ચેતનાની દરેક ગતિની કડક સમાલોચના કરવાનું, અને તમારા કાર્યોના ખૂબ નિગૂડ ઉદ્ગમસ્થાનોની સંમુખ તમને લાવી આપવાનું, અને તમારા ખૂબ-ખૂબ વિશુદ્ધ અને ઉચ્ચતમ દેખાતા વિચારેમાં તથા કાર્યોમાં જે નિમન પ્રકારનું ચોડું કે પણ તત્ત્વ લાળી ગયેલું હોય છે તેને પ્રકારામાં લાવવાનું.

આ નીતિમયતાનો પ્રક્રિયના નથી. આ સહગૃહસ્થો નીતિ શિખવાડતા એજન્ટો નથી હોતા, જે કે તેઓ નીતિમયતાનો ઉપયોગ કરવાનું બહુ સારી રીતે જાણતાં હોય છે! જ્યારે તેઓ ખૂબ ચીવટવાળા અંતઃકરણ સાથે કામ પાડતા હોય છે, ત્યારે તેઓ તેને નિર્દ્દ્ય રીતે હેરાન, પરેશાન કરતા હોય છે, હર કણે તેના કાનમાં કહેતા હોય છે કે “તારે આ ન હતું કરવું જોઈનું, તારે પેલું કરવું જોઈનું ન હતું, તારે આમ કરવું જોઈનું હતું, તારે પેલી વસ્તુ કહેવી જોઈતી હતી. હવે તેં બધું બળાડી નાંખ્યું છે, સુધારી ન શકાય તેવી ભૂલ તેં કરી છે, જે તારા દ્વારાને કરણે સુધારી ન શકાય તેવી રીતે બાળ કેવી બગડી ગઈ છે!” તેઓ કટલાક લોકોની ચેતનાને ભૂતની યેઠે વળગતા હોય છે. તમે અમુક વિચારને મગજમાંથી બહાર કાઢી મૂકો છો, અને બે મિનિટ પછી તેંજ વિચાર તમારા મગજમાં ધૂસી આવતો હોય છે. તમે તેને ફરી ફરી કરો છો, અને ફરી પાછો તે

તમારા મગજમાં ધૂસી આવે છે, તમારા પર અથો સમય હયોગેના ઘા માર્વી કરતો હોય છે.

જ્યારે જ્યારે હું આ સહગુહસ્થોને મળું છું, ત્યારે ત્યારે હું તેમનું સ્વા-  
ગત કરું છું, કરણું તે તમને તદ્દન સાચા દિલના બનવાની ફરજ પાડતા હોય  
છે, તમારા ખૂબ સૂક્ષ્મ દંભને ખુલ્લો પાડતા હોય છે, અને હર કણે તમારાં  
ખૂબ નિગ્રંથ આકંપનોને તમારી સન્મુખ મૂકી આપતા હોય છે. તે બહુ બુદ્ધિશાળી  
હોય છે! તેમની બુદ્ધિ આપણી બુદ્ધિ કરતાં ખૂબ ચઢિયાતી હોય છે. તે બધું  
જાણતા હોય છે. નાનામાં નાના વિચારને, નાનામાં નાની દલીલને, નાનામાં નાના  
કાર્યને ખૂબ અદલુત સૂક્ષ્મતા પૂર્વક તમારી વિદુષ મૂકી આપવાનું તેમને આવ-  
ડતું હોય છે. કોઈ વસ્તુ તેમની પાસેથી છટકી જઈ શકતી નથી. પણ તેઓ  
તમારામાં નિરાશાવાદ પેદા કરે છે, તે તેમને વિરોધી બનાવી મૂકે છે. તે હંમેશાં  
ચિન્તને તમારી સમક્ષ વધારેમાં વધારે કણા રંગોથી ચીનચતા હોય છે. જરૂર પડે,  
તેઓ તમારા ઈરાદાઓને વિકૃત બનાવી મૂકે છે. સાચી રીતે જોતાં, તેઓ દિલની  
સુચ્ચાઈનાં કારણો હોય છે. પણ તે હંમેશાં એક વસ્તુ ઈરાદાપૂર્વક લુલી જતા  
હોય છે, તેને તેઓ પાછળ ફેંકી હેતા હોય છે જણે કે તે વસ્તુનું અસ્તિત્વ જ  
ન હોય; અને તે વસ્તુ છે જગતાનની કૃપા. તે પ્રાર્થનાને લુલી જાય છે, જે  
પ્રાર્થના એક ઉલ્લંઘ આહવાનની પેદું અસ્તિત્વનાં ઊંડાણેમાંથી ઓચિંતી પ્રગટી  
હોય છે, કૃપાને નીચે લઈ આપતી હોય છે, અને વસ્તુઓના કમને પલટી  
નાંખતી હોય છે.

જ્યારે જ્યારે તમે થોડીક પ્રગતિ કરી હોય છે, ઉચ્ચતર ભૂમિકા પર ગયા  
હો છો, ત્યારે ત્યારે તે તમારી સન્મુખ તમારા ભૂનકાળનાં બધાં કાયેની લાવીને  
ખડાં કરી દે છે, અને થોડાક મહીનાઓમાં, થોડાક દિવસોમાં, અથવા થોડીક  
મિનિટોમાં તે તમને, ઉચ્ચતર ભૂમિકા પર, ફરી તે જ પરીક્ષાઓમાંથી પસાર કરતા  
હોય છે. તે વિચારને બાજુ પર મૂકી દઈને આમ કહેવું તેટલું જ માત્ર પૂરણ  
નથી કે ઓહ, હું તને જાણું છું, અને જણે તમે નેને જોતાં ન હો તેમ તેના  
પર પડ્દો પાડી દેવો. તમારે તેનો સામનો કરી તેના પર વિજય પ્રાપ્ત કરવો  
જઈએ, તમારી ચેતનાને, જરા પણ કંપ અનુભવ્યા વગર, એક શબ્દ પણ બોલ્યા  
સિવાય, શરીરનાં કોશાણુઓમાં જરા પણ આકંપન પેદા થવા દીધા સિવાય, તેના  
પર વિજય પ્રાપ્ત કરવાનો હોય છે. પછી તેનું આકમણ ઓગળ્યો જશે.

પણ સારા અને ખરાબ બાબત આપણા વિચારો ખૂબ હાસ્યાસ્પદ હોય છે. ક્યો વસ્તુ ભગવાનની નજીક છે અને કથી દૂર તે બાબતના આપણા ઘ્યાલો પણ બહુ હાસ્યાસ્પદ હોય છે. તજી ફિલ્મ મારીની મારી અનુભૂતિએ મારી આંખો જોવી નાખી. હું તદ્દન પરિવર્તિત બનીને તેમાંથી બહાર આવી. મને મારાં ભૂત-કાળનાં ધણ્ણાં ફૃષ્ટ્યોની, નહિ સમજયેલા એવા મારા જીવનના ભાગોની એચિંતી સમજ પડી ગઈ. હકીકતમાં, એક બિંદુથી બીજા બિંદુએ જવાનો ટૂંકામાં ટૂંકો માર્ગ, માણસ ધારે છે તેમ, એક સીધી લીટીમાં નથી હોતો!

તે અનુભૂતિના એક કલાક સુધી, તે સમયનો એક કલાક બહુ લાંબો હોય છે, હું અસાધારણ આનંદની, લગભગ ઉન્માદની સ્થિતિમાં હતી. તે બે ચેતનાની સ્થિતિઓમાં એટલો બધો મોટો તફાવત હોય છે કે જ્યારે તમે એક સ્થિતિમાં હો છો ત્યારે બીજી સ્થિતિ તમને અવાસ્તવિક લાગતી હોય છે, સ્વચ્છની પેઢે. જ્યારે હું પાછી ભાનમાં આવી, ત્યારે પહેલી વાત મને એ સમજીઈ કે અહીંનું જીવન વ્યર્થ છે, અહીંના આપણા ઘ્યાલો ખૂબ હાસ્યાસ્પદ હોય છે. આપણે કહેતા હોઈએ છીએ કે કેટલાક લોકો પાગલ હોય. પણ અનિમાનસિક જગતના ઇષ્ટ-બિંદુથી જોતાં, તેમનું પાગલાણું એક પ્રકારનું ડાખાપણ હોય છે, અને તેમનું પર્યાત વસ્તુઓનાં સત્યની વધારે નજીક હોય છે. હું જેમનું મગજ ચસકી ગયું છે તેવા જડ, પાગલ લોકોની વાત નથી કરતી, પણ આપણને ન સમજાય તેવા, તેજેમય પાગલ લોકોની વાત કરું છું. તેઓ બહુ જલ્દી જરૂરદના પ્રદેશમાંથી પસાર થવા માગતા હતા, પણ ત્યાં પહોંચી શક્યા ન હતા.

જ્યારે આપણે અનિમાનસિક ચેતનામાંથી માનવીઓના આ જગત પર દૃષ્ટિ-પાત કરીએ છીએ, ત્યારે તેનું પ્રધાન લક્ષણ જાણાય છે વિચિત્રના, ફૂન્ઝિમતા, જગત ફૂન્ઝિમ છે અને તેથી તહુન વિચિત્ર છે. આ જગત અસત્યમય છે, કારણ કે તેનો ભૌતિક દેખાવ વસ્તુઓના જહનતર સત્યને અભિવ્યક્ત કરતો નથી. તે દેખાવની અસ્તિત્વમાં દિવ્ય શક્તિને ધારણ કરતો માણસ બાધ્ય ભૂમિકા પર ગુલા-મની સ્થિતિમાં પણ હોય. આ કેવું વિચિત્ર કહેવાય! તેથી તીવટું, અનિમાનસિક જગતમાં સંકલ્પ સીધી રીતે પદાર્થતત્ત્વ ઉપર કાર્ય કરતો હોય છે અને પદાર્થ-તત્ત્વ તે સંકલ્પને આજ્ઞાધીન રહેતું હોય છે. તમે તમારી જાતને વખત વડે આરથ્ઝા-દિત કરવા માગો છો, અને તમે જે પદાર્થતત્ત્વમાં રહેતા હો છો તે તરત જ વસ્તુનું રૂપ ધારણ કરી લે છો. તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માગો.

છે; કોઈ પણ વાહન વગર, કૃત્રિમ સાધન વગર, તમારે સંકલ્પ તમને તે જરૂરાં એ મૂર્ખી આપવા સમર્થ હોય છે. આમ, મારી અનુભૂતિના વહાણને ગતિ કરવા માટે કોઈ વંતની જરૂર ન હતી; સંકલ્પ જે, પોતાની જરૂરિયાતો અનુસાર, પદાર્થ-તત્ત્વમાં પરિવર્તન કરી હોતો હતો. જ્યારે ઉત્તરાણનો સમય થયો, ત્યારે ઉત્તરાણના ડિનારાએ પોતે જ તે રૂપ ધારણ કરી લીધું. જ્યારે હું અમુક માણસોનાં જૂયોને ડિનારા પર મોકલવા માગતી હતી, ત્યારે મારે એક પણ શબ્દ બોલવાની જરૂર ન પડી, સ્વર્ણભૂ રીતે જ જેમને ઉત્તરવાનું હતું તેમણે તે જાણી લીધું, અને પોતા-પોતાના વારા અનુસાર, તેઓ ઉત્તરવા લાગ્યા. બધું જ મૌનમાં બનતું હતું. પોતાને સમજાવવા માટે કોઈને શબ્દની જરૂર ન હતી. પણ વહાણ ઉપરનું મૌન અહીંના જેવું કૃત્રિમ ન હતું. અહીં જ્યારે માણસને મૌન શબ્દનું હોલ્સ છે ત્યારે તેને બોલવાનું બંધ કરવું પડતું હોય છે, મૌન અપાજનો વિરોધી છે. પણ ત્યાંનું મૌન આર્કિપથનમય, જીવંત, સક્રિય, સર્વ સમજ શક્તાય તેવું હતું.

અહીંની વિચિત્રતા એ છે કે માણસે કૃત્રિમ વસ્તુઓનો ઉપયોગ કરવો પડે છે. જરૂરી યુક્તિ પ્રયુક્તિઓ પ્રાપ્ત કરવાનાં સાધનો હોય, તો એક મૂર્ખ માણસ પણ સત્તાને પ્રાપ્ત કરી શકે છે. જ્યારે અતિમાનસિક જગતમાં, વધારે સચેનન અને વસ્તુઓના સત્ય સાથે વધારે સંપર્કવાળો માણસ પદાર્થ તત્ત્વ પર વધારે સંકલ્પ છાડવાની શક્તિવાળો હોય છે. તે સત્તા સાચી સત્તા હોય છે. જો તમારે વખ્ટ જોઈતું હોય, તો તે બનાવવા માટે તમારી પાસે સાચી શક્તિ હોવી જોઈએ. જો તમારી પાસે આ શક્તિ ન હોય, તો તમારે નગત રહેવું પડે. શક્તિના અભાવ માટે ત્યાં કોઈ યુક્તિ હોતી નથી. અહીં વાઝોમાં એક પણ માણસમાં સાચી શક્તિ હોતી નથી. બધું જ જરૂર રીતે મૂર્ખાઈ ભરેલું હોય છે.

જ્યારે હું પાછી નીચે આવી, ‘નીચે આવી’ તે તો બોલવાનો એક પ્રકાર છે; ત્યાં તો ઊંચે કે નીચે, અંદર કે બહાર એવું કશું જ હોતું નથી, ત્યારે મને મારી જાને વ્યવસ્થન કરનાં થોડોક જરૂર લાગ્યો. મને યાદ છે કે મેં કોઈને કશું હતું કે હવે આપણે ફરી પાછા આપણી મૂર્ખાઈમાં પડવાનો પ્રારંભ કરીએ છીએ. પણ હવે હું ઘણી વસ્તુઓ સમજ ગઈ છું. ત્યાંથી હું એક નિશ્ચિત પ્રકારની શક્તિ લઈને પાછી આવી છું. હવે મેં જાણી લીધું છે કે અહીં આપણે ને રીતે આપણી કુદ્ર નીચિમયતા પડે, વસ્તુઓનું મૂલ્યાંકન કરીએ છીએ, તેને અતિમાનસિક જગતનાં મૂલ્યો સાથે કોઈ સંબંધ નથી.

આ ઉપરછદ્વિ વસ્તુઓમાં કથું નાટ્યાભક્ત તર્ફ નથી. તે મને સાખુના પરપોટાઓ જેવી, વધુ ને વધુ પ્રમાણમાં, લાગે છે, ખાસ કરીને ઉજી ફિલ્મ આરીની અનુભૂતિ પછી.

કેટલાક લોકો મારી પાસે નિરાશ જનીને, રુદ્ધન કરતા કરતા આવે છે. તેઓ કહેતા હોય છે કે અમને ખૂબ માનસશાખીય કષ્ટ છે. જ્યારે હું તેમને તે સ્થિતિમાં જોઉં છું, ત્યારે હું તમારો બધાનો સમાવેશ કરી બેતી મારી ચેતનામાંની એક સોયને જરાક ફેરબું છું, અને તે પૂરું આશાસન પામીને જતા રહેતા હોય છે. તે એક કમ્પાસની સોય નેબું હોય છે. ચેતનામાંની તે સોયને જરાક ફેરવો, અને બધી મુશ્કેલીઓ ટળી જાય છે. અલબાત્ત, ટેવને કારણે તે ફરી પાછી આવતી હોય છે, પણ તે માત્ર સાખુના પરપોટા જ છે.

મને પણ કષ્ટો આવ્યાં છે, પણ મારામાં કોઈક ભાગ એવો હતો કે જેને અલગ, સાક્ષીભાવે રહેતાં 'આપડતુ' હતું.

મને હવે જગતમાં એક જ વસ્તુ અસલ્ય લાગે છે. અને તે ભૌતિક અવનની, ભૌતિક કષ્ટ, કદુપતા, દરેક વસ્તુમાં રહેલી સુંદરતા અભિવ્યક્ત કરવાની અર્થકિત. પણ એક દિવસ તેમના પર પણ વિજ્ઞ સ્થપાશે. ત્યાં પણ સોયને જરાક ફેરવનારી શક્તિ એક દિવસ આવશે. આપણે માત્ર ચેતનામાં વધારે ઊંચે આરોહણ કરવાનું છે. માણસ પદાર્થતત્વમાં જેમ જેમ વધારે ઊંચે જાય છે, તેમ તેમ તેને ચેતનામાં ઊંચે આરોહણ કરવાની વધારે જરૂર પડતી હોય છે. પણ તેમ થતાં સુભય લાગશે. જ્યારે કોઈ અરવિંદે કેટલીક સદીઓની વાત કરી હતી. ત્યારે તે સાચા હતા.

\*

## ૨૫ ફેલ્લુઅદી ૧૯૫૮

મધુર માતાજી, તમે ધર્માવાર સૂર્યની શક્તિઓ વિષે વાત કરી છે, પણ ચંદ્ર અથવા તારાઓ વિષે કઢી કથું પણ કહ્યું નથી.

ક્યા હૃષિબિંદુથી? ગ્રતીકમય રીતે?

હા, માતાજી.

તેનો આધાર તત્વચિતનની શાખાઓ પર, સમય પર, દેશો પર છે. સામાન્ય રીતે, ચંદ્ર આધ્યાત્મિક શક્તિ સાથે, આધ્યાત્મિક પ્રગતિ સાથે, આધ્યાત્મિક અલ્લી-પ્સા સાથે સંબંધિત છે.

વૃદ્ધ પામતો ચંદ્ર રૂપાંતર માટેની આધ્યાત્મિક અલ્લીપ્સાનું પ્રતીક મનાતો હતો, અને પૂર્વ ચંદ્ર આધ્યાત્મિક પરિપૂર્ણતાનું પ્રતીક મનાતો હતો. ચાંદની હંમેશાં દર્શનો માટે, કાવ્યમય પ્રેરણા માટે, અને સર્વ પારવૈકિક કર્મ માટે અનુકૂળ મનાય છે.

કોઈ દિવ્ય વિલૂપ્તિના જન્મ સમયે જે તારાઓ દેખાયા હતા, તેમને વિષે અનેક પ્રકારની કથાઓ, પૌરાણિક કથાઓ પ્રામ થાય છે. પણ તે બધું એક પ્રકારની સાહિત્યિક પ્રતિકમયતા હોય છે.

એક બહુ પ્રચલિત માન્યતા છે કે માનવોનો ભાવિ પર તારાઓની નક્ષત્રો ખાસ અરાર પડે છે. તે જ્ઞાનના પાયા પર જ્યોતિષશાસ્ત્રની રચના થઈ છે. આકાશમાં નક્ષત્રોની લિન્નલિન્ન સ્થિતિઓ પરથી, જ્યોતિષશાસ્ત્ર તમારા જીવનમાં શું બનશે તેની પરિપૂર્ણ આગાહીઓ, ભાવિ કથન કરી શકે છે.

વિચારની પ્રાથમિક અવસ્થામાં, અને એમ કહેવામાં આવતું કે, આપણા જીવન ઉપર તારાઓની, નક્ષત્રોની અસર પડે છે. એથી એ માનવું વધારે તર્ક-યુક્ત અને સારું લાગે છે કે, વ્યક્તિના ભાવિકથન માટે તે એક રેકોર્ડ છે, નોટેશન ( અક્ષર-વિધિ ) છે, કારણ કે વૈશ્વિક એકતામાં દરેક વસ્તુ એકબીજ સાથે સંકણાયેદી છે. જો તમને વ્યક્તિ અને વૈશ્વિક વચ્ચેના સંબંધો વાંચતાં આવડતું હોય, તો તમને નક્ષત્રોની વૈશ્વિક સ્થિતિઓમાં વ્યક્તિના જીવનનો પ્રતીકમય નકશો મળી શકે.

અનુભવ કરે છે કે, આવો જન્મકુંઠીમાં ભાખેલું ભવિષ્ય અનિવાર્ય નથી હાતું, કારણ કે, યોગ અને આધ્યાત્મિક વિકાસ દ્વારા માણસ આ કુંડલીઓનાં કંડક નિયમમાંથી છટકી જઈ શકતો હોય છે. વૈશ્વિક અને વ્યક્તિગત જીવનની વચ્ચેના સંબંધોનું, ભૌતિક ભૂમિ પર આ એક પ્રકારનું નોટેશન હોઈ શકે. ચેતનાની ભૌતિક

ભૂમિકમાં ચેતનાની ઉચ્ચતર બુમિકાને દાખલ કરવાથી આ સંબંધીમાં ફેરફારો થઈ શકે છે.

આ બધાને અર્ધ-જ્ઞાન કહી શકાય, જે વૈશિષ્ટક અને વ્યક્તિગત અસ્તિત્વની વચ્ચેની પરસ્પર, આધારની કાર્યાનો સમજવાનો એક પ્રકારનો બૂબ પ્રાથમિક પ્રયાસ છે. આ બધી વસ્તુઓ ભાષાઓ જેવી હોય છે, જે અ-ચર્ચાસ્પદ હક્કીકતોના નોટેશનને અથવા અકાટ્ય નિયમોને બદલે, વધારે પ્રમાણમાં, અર્ધ-જ્ઞાન નક્કી કરવામાં મદદગાર નીવડે છે. વસ્તુઓ જેવી છે તે રીતે તેમને સમજવાનો તે પ્રયાસ છે, પણ તે પ્રયાસો બૂબ અપૂર્ણ હોય છે. કેટલાંક મનને તેમનું બૂબ આપર્ણ હોય છે, પણ વસ્તુઓના સત્યને તે પૂરેપૂરી રીતે પ્રગટ કરી શકતાં હોતાં નથી.

જે આપણે માનસિક માનવીય જ્ઞાનમાં ડિંડા ઉત્તીર્ણે, તો આપણને જાણાય કે, બાધ્ય રીતે, માનસિક ચેતનામાં પ્રાપ્ત થતું, આ જ્ઞાન એક બૂબ જટિલ ભાષા કરતાં ભાગ્યે જ કાઈ વધારે હોય છે; તે આપણે એકબીજાને વધારે ગમજી શકીએ તે વાતને થક્કું બનાવે છે, પણ વસ્તુઓના સત્યથી તે ખૂબ દૂર હોય છે.

તાદાત્મ્ય વડે સીધો અભિગમ વધારે અસરકારક હોય છે, તે વસ્તુઓની ક્ષમત્ર મશીનરીની સધન ચાલી આપે છે, તે સીધો ચાલીને, પોતાને અભિવ્યક્તન કરવા માટે કેંઠી જટિલ વિજ્ઞાનની જરૂર પડતી હોતી નથી. તે ચેતનાની અને સંકળ્પની ગતિઓને કંઈક મળતું આવે છે, કેને પોતાની જતને અભિવ્યક્ત કરવા માટે માનસિક જટિલતાઓની જરૂર પડતી નથી. ત્યારે પોતાની સસગ્રનામાં વૈશિષ્ટક વાસ્તવિકતા એક પ્રતીક બની જાય છે, અને તેને સીધી રીતે કોઈ શકાય છે.

\*

## ૫ માર્ય ૧૯૮૫

માતાજી, તમે ધર્માધીર અમને ‘પાછા જવાની’ વાત કરી છે. તમે કદ્યું હતું કે, ભવીન ચેતના પ્રાપ્ત કરવા માટે ‘પાછા જવાની’ જરૂર છે.

પાછા જવાની?

અત્યારે આપણને કઈ જાતના 'પાછા જવાની' જરૂર છે? તમે ચેતનાની પાછા જવાની વાત કરી હતી.

તે બોલવાનો એક પ્રકાર છે. તેનો એવો અર્થ નથી કે, તમારે તમારા માથા ઉપર ચાલવાનું છે! તે એક પ્રતીક છે.

હા, કોઈ અર્થવિદે પણ તે જ કહ્યું છે. ૧

એટબે જે તે પ્રતીક તમને કોઈ દર્શના પ્રત્યે દોશી જાય, તો તો કીએ; પણ તમે આજા વડે (માતાજી પોતાનો મહિનેજ તરફ અંગુલિ નિર્દેશ કરે છે) સમજ શકતા હોતાં નથી. જે તે તમને વસ્તુઓ વધારે સારી રીતે સમજવી શકતું હોય, તો તો બચાબર પણ અનેક શબ્દો વડે, મહિનેજ વડે તમે વસ્તુઓને વધારે સારી રીતે સમજ શકતા નથી.

આ રીતે વસ્તુઓને તદ્દન જુદે પ્રકારે જોવાની લાગણીને 'પાછા જવું' કહેવામાં આવી છે. તેની સરખામળી હંમેશાં એક પ્રિઝમ સાથે કરવામાં આવી છે. જે તમે તેને એક બાજૂએથી જુઓ, તો તે વોળો પ્રકાશ હોય છે. જે તમે તેને ઊંઘો કરો, તો તે તેના બધાં તરફોમાં ફેલાઈ જાય છે. આ એના જેવી વાત છે.

૧. "સામાન્ય પણુમાંથી માનવમાં પારવર્તન પામવા માટે એક એવા શારીરિક સંગ્રહના વિકાસની જરૂર છે, જે એક અડોપી પ્રગતિ કરવાની શક્તિ આપે; ચેતનામાં જિયલ પાથલ લાવે, એક નવીન છિયાઈ પ્રાપ્ત કરવે, તેના પરથી નીચેની સ્થિતિઓનું અવલોકન થાય, શક્તિમાં ઉચ્ચયતા અને વિશાળતા લાવે જેથી માણુસ જૂની પણ શક્તિઓને વધારે વિશાળ અને સ્થિતિસ્થાપક બનાવી શકે, માનવી બુદ્ધિ પ્રાપ્ત થાય; પછી ધીમે ધીમે અસ્તિત્વની નવીન પ્રકારની, મહત્ત્વ અને સૂક્ષ્મતર શક્તિઓ વિકસે; તર્કબુદ્ધિ, વિચાર, જરૂરિય અવલોકન, સંગ્રહિત સંશોધન, રોધ વર્ગેની શક્તિઓ વિકસે. પ્રદૂતિના ફરેક મૌલિક પરિવર્તનમાં આવી 'પાછા જવાની' કિયા થતી હોય છે, પ્રગટ થતી પ્રાણુ-શક્તિ પહાર્થિતત્વ પર પાછી વળે છે, જૌતિક શક્તિની કિયાઓ ઉપર એક પ્રાણીક તત્ત્વ લાને છે અને સાથેસાથે પોતાની નવીન ગતિઓ અને કિયાઓ વિકસાવે છે, નવીન મહત્ત્વ પ્રાગટ્ય અને 'પાછા જવાની' કિયા માનવતાનું પ્રાગટ્ય પ્રકૃતિની પૂર્વ-ઘરનાની પરંપરા સાથે સુસંગત છે. તે સર્વ-સાધારણ સિર્જાન્તને નવી રીતે લાગુ પાડવાની વાત છે."

(દિવ્ય જીવન, પૃષ્ઠ ૩૮-૩૯)

શબ્દો બહુ સાર અને ઉપયોગી નથી હોતા, સિવાય કે ખાસ કૃપા વડે તે તમને સત્ય સાથેના સંપર્કમાં મુક્તી આપે; પણ શબ્દોમાં પોતાનામાં કોઈ મૂલ્ય નથી હોય.

હકીકતમાં, આદર્શી સ્થિતિ, કેટલાક લોકો આંશિક રીતે તેને પ્રાપ્ત કરી શક્યા હોય છે, એ છે કે તાત્ત્વિક વિચારને અને તેના કરતાં પણ કોઈક ઉચ્ચ વસ્તુને ચેતનાની, જ્ઞાનની, દર્શનની સ્થિતિમાં આકંપન દ્વારા મુક્તી આપવાં જ્યારે તમે વિચાર કરો છો, ત્યારે તમારી ચેતના તમારા વિચારને જે રૂપ આપતી હોય છે તે અનુસાર, માનસિક પદાર્થતત્ત્વ અમુક પ્રકરે આકંપન કરતું હોય છે; જો બીજું મન સારી રીતે સંગઠિત હોય, તો તેણે આ આકંપનને જોવું જોઈએ.

ખરેખર, શબ્દો તો માત્ર બીજી ચેતનાનું અથવા ચેતનાના બીજા કેન્દ્રનું ધ્યાન જેચ્યાનું જ કામ કરતા હોય છે, જેથી તે આકંપન પ્રત્યે ધ્યાન આપે અને તેને સ્વીકારે. પણ જો તે ધ્યાનમય ન હોય અને જો તેનામાં મૌનમાં વસ્તુને આકંપનને સ્વીકારવાની શક્તિ ન હોય, તો તમે માઈબો સુધી ખૂબ લાંબા શબ્દો બોલ્યા જ કરો, પણ તે તમને જરૂર પણ સમજું નહિ શકે. એવો સમય આવે છે કે જ્યારે અમુક આકંપનોને પ્રગટ કરવામાં ખૂબ શક્તિ મન માત્ર સ્પષ્ટ અને નિશ્ચિત આકંપનોને જ સ્વીકારી શક્તનું હોય છે; નહિ તો તે કોઈ ગુંચવાડાભરેલી વસ્તુનું અનિશ્ચિત મિશ્રાણું જેવું હોય છે, જે વાદળમય, રેશમી ગઢા જેવું અને કોઈ વિચારને પ્રગટ કરી શક્તનું હોય નથી. એટલે કોઈ માણસ બોલે, તેનો અવાજ બરાબર સંભળાય, પણ તેમાંનું કશું જ ગ્રહણ ન થઈ શકે. તેમાં અવાજનો પ્રશ્ન નથી, પણ તે આકંપનોમાં નિશ્ચિતતાની બાબત છે.

જો તમે તમારા વિચારને ખૂબ ચોક્કસ રીતે પ્રગટ કરો, જો તે તમારી ચેતનામાંથી પ્રગટ થતી, કોઈ જીવંત અને સચેતન વસ્તુ હોય કે જે બીજી ચેતનાને મળવા જાય છે, જો તમે જે કહેવા માગતા હો તેને બરાબર જાણતા હો, તો તે તે જ નિશ્ચિતતા સાથે બીજું ચેતનાને પહોંચે છે, પોતાના સાથેના સુસંગત આકંપનને જગાડે છે, અને તેથી સુસંગત વિચારને અથવા ચેતનાની સ્થિતિને જગૃત કરે છે, અને તમે એકબીજાને સમજું શકે છો. પણ જો પ્રગટ થતી વસ્તુ અનિશ્ચિત, પોચી રેશમ જેવી હોય, જો તમે શું કહેવા માગો છો તેને બરાબર ન જાણતા હો, જો તમે જે કહેવા માગતા હો તેને જ સમજવાની કોશીશ કરતા હો, અને જો સાંભળનારનું ધ્યાન પૂરતું સાવધાન ન હોય અથવા તેનું ધ્યાન બીજા કથામાં

પરોવાયેલું હોય, તો તમે બે જણુ કરાકો સુધી વાતો કર્યા કરો, અને છાં તમે એકબીજને જરા પણ સમજ નહિ થકો !

હકીકતમાં, ધર્મશાસ્ત્ર આમ જ બનતું હોય છે. જ્યારે તમે બીજાઓની ચેતનામાં તમે જે કષેવા ભાગતા હો તેનું પરિણામ જોઈ શકો, ત્યારે તમને વિકૃત બનાવતાં દર્શાવેલાં જેથા જેવી લાગણી થાય છે. તમે વિકૃત બનાવતાં દર્શાવે કદી નથી જેયાં ? તે દર્શાવો તમને વધારે ઊંચા અથવા વધારે જડા બતાવતાં હોય છે, તમારા એક ભાગને મોટો અને બીજા ભાગને નાનો બતાવતાં હોય છે. તમને તમારું કટાક્ષ ચિત્ર જેવાનું મળતું હોય છે. બરાબર આવું જ બનતું હોય છે. તમે કહ્યું હોય તેનું બેઝ્ડું કટાક્ષચિત્ર તમને બીજી વ્યક્તિની ચેતનામાં નજરે પડે છે. માણસો કદ્વી બેતા હોય છે કે અમે એકબીજને સમજ લીધા, કારણું તેમણે શબ્દાનો અવાજ સાંભળ્યો હોય છે; પણ તેઓ એકબીજા સાથે કણો વ્યવહાર આપણે કદી જોયો નથી.

એટલે, જે તમે માનસિક પદ્ધાર્થ તત્ત્વ ઉપર થોડી ધર્મા પણ અસર પાડવા માગતા હો, તો પ્રથમ તો તમારે સ્પષ્ટ રીતે વિચાર કરતાં શ્રીભી લેવું જોઈએ, એવા શબ્દમય વિચાર નહિ કે જે શબ્દો પર આધાર રાખતો હોય, પણ એવો વિચાર કે જે શબ્દો વિના ચૂલાવી શકે, જેને શબ્દો વિના સમજ શકાય, જે એક હકીકત સાથે સુસંગત હોય, ચેતનાની સ્થિતિ બાબતની હકીકત અથવા જ્ઞાનની હકીકત શબ્દો પગર વિચાર કરવાનો પ્રયત્ન કરો, તમે કયાં છો તે તમને સમજઈ જરો.

તમે તેમ કરવા કદી પ્રયત્ન નથી કર્યો ? તો પછી પ્રયત્ન કરો.

તમે બીજાને જે મોકલી આપવા ભાગો છો તેની તમને તદ્દન સ્પષ્ટ અને નિશ્ચિત સમજ છે, તે અમુક ખાસ રીતે આકંપન પેદા કરે છે, તેનામાં માનસિક પદ્ધાર્થતત્ત્વને રૂપ આપવાની શક્તિ છે, પછી માનવ ટેવોને માન આપવા ખાતર તમે તેની આસપાસ અમુક સંઘામાં શબ્દાને સંગઠિત કરો, ચેતનાના આકંપનને શાખિદક રૂપ આપો. પણ શાખિદક રૂપ તદ્દન ગૌણ છે. તે એક પ્રકારનું આચાદન છે, વિચારની શક્તિ માટે તે એક ગ્રામ્ય આચાદન છે.

શબ્દો કોણું પૂરા પાડતું હોય છે.

ઓહ, ના, સ્પષ્ટ રીતે વિચાર કરો. હું તમને સમજું શકતી નથી. તમારું શબ્દો રૂના જંગવાત જેવા આવતા લાગે છે ને મને અર્થ શૂન્ય લાગે છે.

હું સમજ્યો, વિચાર રૂપ ધારણ કરે ત્યારે પહેલાં શબ્દ આવતો હોય છે.

તદ્દન સાચું!

વિચારની આ શક્તિના દૃષ્ટાંતને ભાષા પરનું પ્રભુત્વ, ભાષાની દેખ કહેવામાં આવતી. હકીકતમાં, આ ઘટના બની છે, હજુ પણ તે બની શકે તેમ છે તમે શબ્દોથી સ્વતંત્ર રીતે વિચાર કરો તેને જ હું વિચાર કરું છું, વસ્તુઓનું સ્પષ્ટ દર્શાવ રાખો, તે દર્શાનને બીજા પ્રત્યે મેઝલી આપવાની શક્તિ પ્રાપ્ત કરો, ચેનનાની આ ઘટનાને બીજામાં મૂકી આપી શકાય છે. ધારે કે તમે બિન્નબિન્ન ભાષાઓ બોલતા માણુસોના નાના મોટા અમૃહમાં છો, પણ તે જ્યા એક જ ભાષામાં વિચાર કરવા ટેવાયેચા છે. કારણ કે તે સીટે જ તેમનો ઉચ્ચેર થયો હતો. પણ તમે તમારી દર્શાનાં, સમજનું, વસ્તુઓની અનુભૂતિના આડંપનનો વિસર્ગ કરો છો. શ્રો ||એનું ધ્યાન એંચવા માટે તમે યોડાક શબ્દો ઉચ્ચારો છો ગમે તે ભાષામાં, તમને પરિચિત હોય તે ભાષામાં; તે બહુ મહત્ત્વનું નથી, પણ તમારી દર્શાના અને પ્રગટીકરણ એટલાં નિશ્ચિત છે કે તે સીધી રીતે બીજાઓના મહિનાંકમાં મોકદી શકાય, અને તેમના મહિનાંકમાં તે દર્શાનાનો, પ્રગટીકરણનો તેમની ભાષામાં અનુવાદ થઈ જાય. એટલે બાબ્ય સીટે તમે ફેન્ચ અંશવા અંગ્રેજમાં બોલતા હો, પણ દરેક શ્રોતા પોતાની ભાષામાં તે સમજું જતો હોય છે. લોકોને આ વાત પરીક્થા જેવી લાગે; પણ તે પરીક્થા નથી. જ્યારે માણુસ વિચારના પ્રદેશમાં જાય છે, ત્યારે આ વાત સહેલાઈથી સમજું શકાય તેવી છે, લગભગ પ્રાથમિક અવર્થાની છે. ધાર રાખો હું અનિમાનસિક વસ્તુઓની વાત નથી કરતી. તે અનિમાનસિક શક્તિ નથી. તે માત્ર વિચારનો સાચો પ્રદેશ છે. અર્થાત, તમે વિચારની શરૂઆત કરો છો.

જે નમારા શાતાએ પણ વિચાર કરતા હોય, તો તે ઘટના આપણાઓ બને, સાચી રીતે વિચાર કરનાર માણુસો બહુ યોડા હોય છે. પણ જ્યારે તેઓ ખૂબ શક્તિપૂર્વક વિચાર કરતા હોય છે, ત્યારે તે ઉપરછળી અને પાર્થિવ દર્શાનામાં આવાં વિધનોને તોડી ફેડી નાં ના હોય છે, તે વિચાર આમ ( વળાંક બતાવતો અભિનય ) ઉપર ચઢતો હોય છે. તે ઉચ્ચતર દર્શાના પ્રદેશમાં જાય છે અને પણી તે દરેક શ્રોતા પર, તેની પોતાની ભાષાના પ્રદેશમાં, પણો ઉત્તરો હોય છે. પણી

દરેક જણુ, પોતાની અનુભૂતિની દિલ સંચાઈપૂર્વક કહે છે કે મને માફ કરો, તે આ ભાષામાં બોલે છે; બીજે રહે છે કે ના, ના, તે આ બીજી ભાષામાં બોલે છે. હકીકતમાં, દરેક જણની વાત સાચી છે. તે વકતા તો તે હંમેશાં જેમાં બોલ તો લોય છે તે જ ભાષામાં બોલતો હતો. અથવા બીજી કોઈ એક યા બે ભાષા-ઓમાં બોલતો હતો. પણ તે વિચાર આમ કરતો લોય છે (તે જ અભિનય), અને તે વિચાર આમ, રેડિયોનાં મોજાની એઠે, આમ પડતો હોય છે.

આપણે તેને માટે પ્રયત્ન કરીશું. હું તમને કાંઈક કહેવા માગું છું, તમે તે સમજી શકો છો કે નહિ તે આપણે જોઈશું.

\*

## (ધ્યાન)

## ૧૨ માર્ચ ૧૯૪૮

“વૈશિક પ્રકૃતિમાં ઉત્કાન્તિને કારણે જે નિગૃહ ચેતનાનો ઉભરો આવ્યો, તેને કારણે નવીન માનવનો આવિભાવ થયો, એમ આપણે ચેતનાની દૃષ્ટિએ કારણું આપી શકીએં. પણ તેમ માનીએ તો, માનવના આવિભાવ માટે વાહન તરીકે કોઈ ભૌતિક રૂપ પહેલું હોય જ જોઈએ. તે વાહન નવીન આંતર સર્જનની જરૂરિયાતો માટે અનુકૂળ બને તે રીતે તે આવિભાવની શક્તિએ તેને પોતાને અનુકૂળ બનાવ્યું હોય જોઈએ. જો એમ ન બન્યું હોય, તો પહેલાંની ભૌતિક ટાઇપો-નમૂનાઓમાંથી એક ઝડપી બનેલાં ફેરફારે કોઈ નવીન સત્ત્વને અસ્તિત્વમાં લાવ્યું હોય જોઈએ. તે એમાંથી ગમે તે એક વાતને સ્વીકારીએ તો પણ, તેનો અર્થ ઉત્કાન્તિમય પ્રક્રિયા થાય છે; માત્ર ફેરફાર અથવા પરિવર્તનની પદ્ધતિમાં અને મશીનરીમાં તફાવત છે. અથવા તો આપણી ઉર્ધ્વમાંની માનસિક ભૂમિકામાંથી અવતરણ થયેલું હોય જોઈએ, ઉભરો નહિ. કદાચ પાણી પ્રકૃતિમાં આત્માનું અથવા માનસિક સત્ત્વનું અવતરણ થયું હોય જોઈએ. પણ તે વાત સ્વીકારીએ તો મુશ્કેલી એ આવે કે માનવ શરીરનું પ્રાગટ્ય, જે શરીરનું સર્જન બહુ જટિલ અને મુશ્કેલ છે તે એકદમ કેવી રીતે બની શકે? પ્રક્રિયાની તે પ્રકારની ચમત્કારિક ઝડપ અતિભૌતિક ભૂમિકા પર શક્ય હોઈ શકે, પણ ભૌતિક શક્તિની શક્યતા-

ઓથી તે બહારની વાત છે. તે માત્ર અતિભૌતિક શક્તિની, અથવા પ્રકૃતિના નિયમની, અથવા પદાર્થ તત્ત્વ પર સીધી રીતે, સમગ્ર શક્તિ પૂર્વક કાર્ય કરતા અર્થક મનની દરમિયાનગિરિ વડે જ શક્ય બને. પદાર્થ તત્ત્વમાં દરેક નવીન આવો-ભર્તી માટે, અતિભૌતિક શક્તિને અને સર્જકને માની શક્યાય. તેવો દરેક આવિ-ભર્તી પાયામાં એક ચમત્કર હોય છે, જેને નિગૂઢ પ્રાણ શક્તિ અથવા મન શક્તિ વડે ટેકો અપાયેલી નિગૂઢ ચેતના પેદા કરતી હોય છે. પણ તેનું કાર્ય ક્યાંય પણ સીધું; નિગૂઢ, અથવા સ્વપ્યાપ્ત દેખાતું હોતું નથી. તે પહેલાં સિદ્ધ થયેલા ભૌતિક પાયા પર મૂકવામાં આવે છે, અને તે પ્રકૃતિની કોઈ સ્થાપિત પ્રક્રિયાના વિસ્તૃતીકરણ વડે કાર્ય કરે છે. કોઈક વિદ્યમાન શરીર અતિભૌતિક ઘસારા પ્રત્યે ઝુલ્લું બન્યું હોય અને તેથી તે એક નવીન શરીર બની ગયું હોય એ માનવા જેવી વાત છે. પણ ભૌતિક પ્રકૃતિના ભૂતકાળના ઈતિહાસમાં તેવી કોઈ ઘટના બની હોય, એમ સહેલાઈથી ન માની લઈ શક્ય. તેને માટે એમ માનવું પડે કે કોઈક અદૃશ્ય માનસિક સત્ત્વે પોતાને રહેવા માટે તે શરીરનું નિર્માણ કર્યું હોય, અથવા ઝુદ પદાર્થતત્ત્વમાં માનસિક સત્ત્વનો પહેલાં તેવો કોઈ વિકાસ થયો હોય, જે સત્ત્વે અતિભૌતિક શક્તિને સંકુચિત ફેરફારાઓ ઉપર લાદી હોય. નહિ તો આપણે એમ માનવું પડ્યે કે પહેલાં જ એવું એક ઉત્કાનિત થયેલું શરીર હોવું જેઈએ, કે જેથી તે સ્વીકાર શક્ય બને. એ માની શક્યાય તેવી વાત છે કે પાણ્યિવ પ્રકૃતિમાં માનવના પ્રાગટ્યની બાબતમાં, નીચેથી ગોવી ઉત્કાનિત પણ થઈ હોય અને ઉપરથી એવું અપતરણ પણ થયું હોય. પણ ક્યારનાંયે રહેલા ચૈત્ય તત્ત્વે મનોમય પુરુષને જીવાંત પદાર્થ-તત્ત્વના પ્રદેશમાં બોવાન્યો હોય, જેથી કાર્ય કરતી પ્રાણીક, માનસિક શક્તિને લઈને તેને ઉચ્ચતર માનસિકનામાં સ્થાપી આયે. પણ જીવાંય આ ઉત્કાનિતની જ પ્રક્રિયા છે, જેમાં પાણ્યિવ પ્રકૃતિમાં પોતાના જ તત્ત્વના પ્રાગટ્યને અને વિસ્તૃતીકરણને સહાય દ્રુત થવા માટે ઉચ્ચતર ભૂમિકાએ દરમિયાનગિરિ કરી હોય.”

( દિવ્ય જીવન, પૃષ્ઠ ૮૩૮-૪૦ )

સમસ્યાની મુશ્કેલી એ છે કે માત્ર માનસિક સત્ત્વ જ રૂપાંતરની અને સર્જનની પ્રક્રિયામાં રસ બઈ થકે, અને પણ અતિમાં રહેલી માનસિક ચેતના આ પ્રક્રિયામાં રસ વેવા માટે પર્યામ ન હતી.

પણ એ ખાસે જે બનતું હતું તે જોવામાં, વિચારવાનાં અને યાદ રાખવાનાં સાધનો ન હતાં. તેથી પૃથ્વીના ઈતિહાસનો તે ભાગ લગભગ નષ્ટ થઈ ગયો છે. આ રૂપાંતરના ફરને અનુસરી શક્તિ અને તેનો સ્મૃતિ સંઘરી શક્તિ તે માટે માનવના જેવી માનસિક શક્તિએ દરમિયાનગિરી કરવી જોઈએ. હકીકતમાં, યાદ રાખવામાં આવતું હોય છે તેના કરતાં વધારે કદમ્બી વેવામાં આવતું હોય છે. એ વાત સ્પષ્ટ છે કે, ચૌત્ય સત્ત્વ તે બધામાંથી પસાર થયું છે, પણ તેણે તેની માનસિક સ્મૃતિ રાખી નથી. ચૌત્ય સત્ત્વની સ્મૃતિ ચૌત્યિક હોય છે, બિન્ન પ્રકારની હોય છે. તે માનસિક સ્મૃતિ જેવી ઔતિહાસિક નથી હોતી; માનસિક સ્મૃતિ બધી ઘટનાઓનું નિશ્ચિન રેકૉર્ડ રાખતી હોય છે.

પણ હવે આપણે નવીન રૂપાંતરના, નવીન પ્રાગટ્યના ઊભરે આવી ત્યાં ઉભા છીએ. માત્ર માનસિક સત્ત્વના અતિમાનસિક સત્ત્વમાં રૂપાંતરની પ્રક્રિયા આપણે જોવાના છીએ. એટલે, બધી ઘટનાઓને સમજતા અને તેમની નોંધ રાખતા, મનની આ ઔતિહાસિક શક્તિનો લાભ આપણે ઉઠાવી શકીશું, તે દૃષ્ટિબિદ્ધુથી જોતાં પણ, અત્યારે જે ઘટના બની રહી છે તે પૃથ્વીના ઈતિહાસમાં તદ્દન અજોડ છે. જ્યારે આપણે આ રૂપાંતરની પ્રક્રિયાને અંત સુધી સમજીશું, ત્યારે આપણને પહેલાં થઈ ગયેલાં રૂપાંતરોની ચાવી હાથ લાગી જશે. તે પ્રક્રિયાની અત્યારની મનનું અતિ-મનસ્સમાં રૂપાંતરની પુનરસૃતિ વખતે, આપણે અત્યારે જેને સમજવાની કોણીશ કરી રહ્યા છીએ, તે આપણે નિશ્ચિતત્વએ જણી લઈ શકીશું.

એટલે અવલોકનની ખાસ શક્તિના વિકાસ માટે તમને નિભંત્રવામાં આવ્યા છે, જેથી આ બધું અર્ધ-સ્વપ્નમાં ન બને વસ્તુઓ કેવી રીતે બની તે જાણ્યા સિવાય જ તમે નવીન અરનમાં જગૃત થાઓ.

માણસે સાવધાન, પૂરા જગૃત બનવું જોઈએ, નાનકડી માનસશાસ્ત્રીય ઘટનાં ઓમાં કોઈ નવીનતા રહી નથી, તેઓ માત્ર ઈતિહાસની ભૂતકાળની વાતો બની ગઈ છે, તેમનામાં રસ વેવાને બદલે, આપણે મહત્ત્વાળી વસ્તુઓ પ્રત્યે, વધારે સૂક્ષ્મ, બિન અંગત, ખૂબ ખાસ રસ પડે તેવી નવીન શોધાની મધ્યમાં તમને મૂકી આપે તેવી, વસ્તુઓ પ્રત્યે ધ્યાન આપવાનું છે.

સુક્રમ બુદ્ધિની આંખો ખોલી દો, અને પસંદગી કે પૂર્વગ્રહ રાખ્યા સિવાય, અહંતા કે આસક્તિ રાખ્યા સિવાય, રોજ રોજ જે બને છે તેના તરફું નજર રાખો.

\*

## ૧૯ માર્ચ ૧૯૮૮

“પણી એમ પણ માનવું જ રહ્યું કે, એકવાર એક શરીરમાં સ્થાપિત થયેલા ચેતનાની ટાઈપે (નમૂનાઓ) તે ટાઈપના સત્ત્વના કાયદાને વહાદાર રહેવું જોઈએ, તેની યોજનાને અને સ્વભાવના નિયમને વહાદાર રહેવું જોઈએ. પણ એમ પણ સારી રીતે માની શકાય કે, માનવીય પ્રકારનો નિયમ પોતાથી અધિક બનવા પ્રત્યેનો આવેશ હોય છે, માનવની આધ્યાત્મિક શક્તિઓમાં સચેતન રૂપાંતર માટેનાં સાધનો આપવામાં આવેલાં છે. સર્જક શક્તિએ જે યોજના પર માનવું નિર્માણ કર્યું છે, તેના ભાગ તરીકે તેને એવી શક્તિ પણ આપવામાં આવી છે. એમ પણ માની શકાય કે, માણસે અત્યાર સુધી મોટે ભાગે પોતાના સ્વભાવના વર્તુલમાં જ કાર્ય કર્યું છે, કેટલીક વાર તે નીચે ઉત્થો છે અને કેટલીક વાર ઉપર ચઢ્યો છે. આ તેની પ્રકૃતિ-ગતિની ચઢ-ઉત્તર છે, તેમાં પ્રગતિ સીધી રેખામાં થતી હોતી નથી, પોતાની ભૂતકાળની પ્રકૃતિથી નિઃશ્વક રીતે, આયાભૂત-મૌખિક રીતે તે પર જઈ શક્યો નથી. તેણે પોતાની શક્તિઓને તીક્ષ્ણ, સુક્રમ, વધારે જટિલ, અને મુલાયમ બનાવીને તેમનો ઉપયોગ કર્યો છે. એમ ન કહી શકાય કે, માનવે પોતાના ગ્રાગટ્ય પણી અથવા તો તાજેતરના નક્કી કરી શકાય તેવા ઈતિહાસમાં પ્રગતિ નથી કરી, કારણકે પ્રાચીનો ગમે તેટલા મહાન હાં, તેના સર્જનો અને સિદ્ધિ ગમે તેટલા મહાન હાં. તેમની આધ્યાત્મિક શક્તિનો, બુદ્ધિની નથી ચારિત્યની શક્તિનો ગમે તેટલી મહાન હતી; પણ પાછળના વિકાસમાં સુક્રમતા, જટિલના, જ્ઞાનનો અનેકવિધ વિકાસ, તેની સિદ્ધિઓની શક્યતા, રાજકારણ, સમાજકારણ, જીવન, વિજાન, તત્ત્વ ચિત્તન, કલા, સાહિત્ય, સર્વ પ્રકારનું જ્ઞાન આ બધામાં આપણને પ્રગતિ નજરે પડે છે. પ્રાચીનો કરનાં આધુનિક માનવમાં આધ્યાત્મિક પ્રયાસ થોડો, આધ્યાત્મિક શક્તિ થોડો હોય એ બનવાનો છે. પણ અત્યારે સુક્રમતા, મુલાયમતા, ઊંડાણનો ભાગ બેવાની શક્તિ, સંશોધનનો વિસ્તાર વધતાં ચાલ્યાં છે. ઉચ્ચ પ્રકારની સંસ્કૃતિમાંથી પતનો થયાં છે; અમુક પ્રકારની અસ્પષ્ટતામાં ઝડપી, થોડા સમય માટેનું પતન

થયું છે; આધ્યાત્મિક આવેગ મંદ પડી ગયો છે; જંગલી પ્રાકૃતિક ઔતિકવાદમાં ડૂબકી મારવામાં આવી છે; પણ આ બધા અલ્પસ્થાયી દૃશ્યો છે, પ્રગતિનો નીચાણી તરફ થોડાક સમય માટેનો વળાંક છે. આ પ્રગતિ માનવજાતિને પોતાનાથી પર લઈ જઈ શકી નથી. તેણે માનવિક સત્ત્વનું રૂપાંતર સાધી આપ્યું નથી. પણ તેની આશા પણ રાખી શકાય નહિ, કારણકે ઉત્કાન્નિતમય પ્રકૃતિનું પ્રયમ કાર્ય હોય છે, સત્ત્વની અને ટાઈપની ચેતનામાં તેની શક્તિનો યથાશક્ય વધારેમાં વધારે વિકસ સાધ્યો, અને તેમાં એવી સ્થિરતા અને વધતી જતી જટિલતા બાપવી, કે નેથી તે પોતાના કોચલાને ભાંગી દઈ શકે. પરિપક્વ નિશ્ચયાત્મક પ્રાગટ્ય થાય, ચેતના પોતાની જાન પ્રત્યે પછી વળે જે ઉત્કાન્નિતની નવીન સ્થિતિ-અવસ્થા હોય છે. જો એમ માનવામાં આવે કે હવે પછીનું માનવનું પગલું આધ્યાત્મિક અને અતિમાનવિક સત્ત્વ બનવા પ્રત્યે હોય, તો માનવજાતિમાં આધ્યાત્મિકતા પર મૂકાતો ભાર, પ્રકૃતિનો તે પ્રકારનો દીરાદો છે એની, સાભિતી ગણ્ય, માનવમાં પણ પોતાનામાં રૂપાંતર સાધવાની અથવા પ્રકૃતિના રૂપાંતર માટેના કાર્યમાં મદદ કરવાની શક્તિ છે એની સાભિતી ગણ્ય. જો પણુમાં વાનર જેવી ટાઈપનો જે ઘણી બાબતો માં માનવતે મળતો આવે છે, પ્રાદુર્ભાવ એ માનવીય ઉત્કાન્નિતની પદ્ધતિ હતી, તો એમ માની શકાય કે માનવિક પણ જેવો માનવ આધ્યાત્મિક ટાઈપનું સત્ત્વ બની શકે તેનામાં આધ્યાત્મિક અભીષ્ટા હોય; અને આધ્યાત્મિક અથવા અતિમાનવિક સત્ત્વના ઉત્કાન્નિતમય પ્રાગટ્ય માટે પ્રકૃતિની આ સ્પષ્ટ પદ્ધતિ છે એમ માની શકાય ”

( દિવ્ય જીવન, પૃષ્ઠ ૮૧-૮૨ )

એક વાત સ્પષ્ટ દેખાય છે કે માનવજાતિ એક સામાન્ય તનાવની સ્થિતિએ પહોંચી છે. તેના કાર્યમાં, પ્રયાસમાં, દૈનિક જીવનમાં તનાવ જ નજરે પડે છે. તે ખૂબ ખૂબ વધારે કાર્યમાં ગુંયાયેલી રહે છે, વિસ્તૃત ધ્રુવીમાં જીવે છે. તે એક એવે તબક્કે આવી પહોંચી છે કે કંતો તેણે પ્રતિરોધને તોડી ફોડી નાંખીને એક નવીન ચેતનામાં પહોંચી જવું જોઈએ, અને નહિ તો તેણે અંગરાની અને જડતાની ખાઈમાં ફેંકાઈ જવું જોઈએ.

આ તનાવ એટલો બધો પરિપૂર્ણ અને વિસ્તૃત છે કે કશાકે તો ભાંગી પડવું જ રહ્યું. આમ વધારે વખત ચાલી શકે નહિ. આપણે તેને એક ચોક્કસ

ચિહ્નિઓ માની શકીએ કે પદાર્થતત્ત્વમાં કોઈ નવીન શક્તિ, નવીન ચેતના પ્રવેશો રહી છે, જે પોતાના દશાશ વડે આ તીવ્ર સ્થિતિને પેદા કરી રહી છે. બાધ રીતે, આપણે એની અપેક્ષા રાખી શકીએ કે પ્રકૃતિ જ્યારે ઊથલ પાથલ લાવવા માટે છે, ત્યારે તે આવી કોઈ જૂની પદ્ધતિ અભિત્યાર કરતી હોય છે. પણ આમાં એક નવીન લક્ષણ છે, જે માત્ર થોડા આગળ વધેલા બોકેને જ દેખાતું હોય છે. પણ એવા આગળ વધેલા બોકે પણ એક જગ્યાએ રહેલા નથી; આખા જગતમાં, બધા દેશોમાં તેઓ ફેલાઈ ગયેલા છે. તેમનામાં એક નવીન, ઉત્ત્યનતર, પ્રગતિશીલ ઉકેલ લાવવાનો સંકલ્પ છે; વધારે વિજ્ઞાન, સર્વ-સમાવેશક પરિપૂર્ણતા લાવવાનો પ્રયાસ છે.

વધારે વિશાલ, સામુહિક પ્રકારના અમુક સામાન્ય વિચારો કાર્યાન્વિત કરવામાં આવે છે. જગતમાં તેઓ કાર્ય કરી રહ્યા છે. બંને વસ્તુઓ સાથે સાથે છે: મહત્તર અને વધારે સમગ્ર સંહારની શક્યતા, સંહારના સંકટની શક્યતાને વધારી મૂકે નેવી વળર વિચારી શોધખોળો જે સંહાર ભૂનકાળના કોઈ પણ સંહાર કરતાં વધારે ખતરનાક હશે. અથવા તો ઉત્ત્યતર અને વધારે વિશાળ વિચારોનો નથા સંકલ્પનાં કાર્યોનિા જન્મ અથવા પ્રાદુર્ભાવ, જે પહેંચાં કરતાં વધારે વિશાળ, વિસ્તૃત પરિપૂર્ણ ઉપાય બદ્ધ આવશે.

વધારે પરિપૂર્ણ અને દિવ્ય સાક્ષાત્કાર માટે આરોહણ કરતી ઉત્કાન્તિનાં આ રચનાત્મક બળો વચ્ચેનો અને વધારે સંહારક, કાબૂ બહારનાં, પાગલ બનેલાં બળોની વચ્ચેનો આ સંધર્ષ એટલો બધી સ્પષ્ટ અને દૃષ્ટિગોચર છે કે જાણે તે બળોની વચ્ચે, કોણ ધ્યેયને પહેલું પહેંચયશે તે બાબતની હરીજ્ઝાઈ ચાલી રહી હોય એમ લાગે છે. એમ લાગે છે કે પ્રાણિક જગતનાં બધાં વિરોધી, અદિવ્ય બળો પૃથ્વી પર નીચે ઉત્તરી આવ્યાં છે, તેમણે પૃથ્વીને પોતાનું કાર્યક્રોન બનાવી દીધું છે; અને તેની સાથે સાથે એક નવીન જીવન પ્રગટાવવા માટે, પૃથ્વી ઉપર એક નવીન, ઉત્ત્યતર, વધારે શક્તિશાળી આધ્યાત્મિક બળ પણ નીચે ઉત્તરી આવ્યું છે. એને લઈને સંધર્ષ વધારે તીવ્ર, વધારે બળ યુક્ત, વધારે દૃષ્ટિગોચર બન્યો છે; પણ તે વધારે નિશ્ચયાત્મક બન્યો છે, અને તેથી આપણે પહેલા ઉકેલને પ્રાપ્ત કરવાની આશા રાખી શકીએ.

થોડાક સમય પૂર્વે માનવની આધ્યાત્મિક અભીષ્ટા મૌન, નિષ્ઠિય શાન્ત તરફ વળી હતી. તે સર્વ જગતની વસ્તુઓથી વિમુખ, અનાસ્કત હતી. તે જીવન-માંથી ભાગી જવાની ભાગેડુ વૃત્તિ હતી, નેથી યુદ્ધમાંથી ઉગરી જવાય, પ્રયાસ-

માંથી છટકી જવાય. તેવી આધ્યાત્મિક એક શાન્તિ હતી, જેમાં બધા બનાવ, સંઘર્ષ, પ્રયાસ બંધ પડી જતાં હતાં, સર્વ પ્રકારનાં દુઃખોનો અંત આવી જતો હતો. આને જ આધ્યાત્મિક અને દિવ્ય જીવનની સાચી અને એક માત્ર અભિવ્યક્તિ માનવામાં આવતી હતી. તેને ભગવાનની કૃપા, ભગવાનની મદદ, ભગવાનની દરમિયાનગિરી માનવામાં આવતી હતી. અત્યારે પણ, આ વ્યથાના બનાવના સંઘર્ષના યુગમાં પણ, આ પરમ શાન્તિ ખૂબ મદદ રૂપ જની શકે, માસુસોને આશ્વાસન અને આશા આપી શકે. ધરૂ લેંકા હજી પણ તેને ભગવાનની કૃપા, ભગવાનની દરમિયાનગિરીનું ચિહ્ન માને છે.

હકીકતમાં, માસુસ જમે તે સિદ્ધ પ્રાપ્ત કરવા માગતો હોય, પણ આ પરિપૂર્ણ અને અપરિવર્તનીય શાન્તિની સ્થાપનાથી જ તેણે થતુભાત કરવી પડેશે; તે પણ ઉપર તેણે કાર્ય કરવું પડેશે. પણ જે માસુસ અંગત, અહંતાપૂર્ણ, બીજી વસ્તુઓને બાકાત રાખનારી મુક્તિનું સ્વભન સેવતો નહિ હોય, તો તે ત્યાં અટકી જઈ શકશે નહિ. ભગવાનની કૃપાની એક બીજી બાજૂ છે, જે સર્વ વિધનો ઉપર વિજ્ઞય પ્રાપ્ત કરશે, માનવ જાતિને નવીન સાક્ષાત્કાર માટે આવેગ આપશે, નવીન જગતનાં દ્વાર જોલી નાખશે, અને દિવ્ય સાક્ષાત્કારનો વાખ થોડા પસંદ કરાયેલા માસુસોને જ નહિ આપે, પણ તેમની અસર, તેમનું દૃષ્ટાંત, તેમની શક્તિ બાકીની માનવ જાતિને પણ નવીન, વધારે સારી સ્થિતિમાં લાવી મુકશે.

આ ભાવિમાં સાક્ષાત્કારના નવા માર્ગો જોલી આપે છે, જેમની શક્યતા-ઓની આગાહી થઈ ચૂકી છે. તેમાં નવીન શક્તિઓ પ્રત્યે, સભાનતાપૂર્વક અથવા અભાનતાપૂર્વક, ખુલ્લા બનેલા માનવ જાતિના સમગ્ર ભાગો ઉચ્ચનર, વધારે સંવાદમય, વધારે પરિપૂર્ણ જીવનમાં જીવંગનિ કરશે. જે વિકિતગત રૂપાંતર હુમેશાં શક્ય નહિ હોય, અથવા તેને મંજૂરી નહિ અપાની હોય, તો પણ એક પ્રકારનું જન સમૂહનું ઊધ્વીકરણ થશે, સમગ્રની સંવાદમયતા સખ્યાશે, જેથી નવીન વ્યવસ્થા, નવીન સંવાદિતા સર્જાશે, અત્યારનાં અવ્યવસ્થા અને સંઘર્ષ અદૃશ્ય થશે અને તેમની જગ્યાએ એવી વ્યવસ્થા આવશે, જે સમગ્રના સંવાદમય કાર્યને દૃષ્ટ આપશે.

એનાં બીજાં પરિણામો આવશે; જે જીવનમાં મનની દરમિયાનગિરીથી પેદા થયાં છે, તે વિકૃતિઓને, કદુપતાને, જે વિકૃતિઓએ દુઃખો, કાષ, નોટિક દરિદ્રતા, અધ્યમ જુગુપ્સાજનક કાટો પેદા કર્યા છે અને જીવનને આટલું બધું અધિકર

જનાવી દીધું છે તે બધાને તે દૂર કરશે. તેમણે અહૃથ થઈ જવું જ જોઈએ. આ વસ્તુઓ માનવ જીવનને પણ જીવન કરતાં પણ વધારે ખરાબ જનાવી મુકે છે. બધું હોવા છતાં, પણ ઓમાં સરળતા હોય છે, સ્વાભાવિક સ્વયંભૂપણું હોય છે, સંવાદિતા હોય છે. માનવ જીવનમાં જેટલું હોય છે, તેટલું દુઃખ પણ જીવનમાં કષ્ટમય અને શુદ્ધ નથી હોતું. માનવોમાં ખૂબ વિકૃતિ આવી ગયેલી છે, તેમણે પોતાની માનસિકતાનો ઉપયોગ માત્ર અહંતાપૂર્ણ જરૂરિયાતોની સેવામાં જ કર્યો હોય છે.

આપણે પ્રકાશમાં અને સંવાદિતામાં ઉપર ચઢવું જોઈએ, અને નહિ તો પણ જીવનની સરવતામાં, આરોગ્યપ્રદ અવિકૃતતામાં પાછા જવું જોઈએ.

(જ્યારે આ વાર્તાલાપો પહેલી વાર ૧૮૫૮માં પ્રગત થયો હતો, ત્યારે માતાજીએ “નવીન શક્તિઓના કાર્ય વડે માનવ જનિના સમગ્ર લાગને ઉચ્ચે લઈ જરાના કાર્ય” ઉપર નીચેની નોંધ ઉમેરો હતી.)

પણ જે લોકોને ઉચ્ચે લઈ શકાય તેમ નથી, તે એ પ્રગતિ કરવાની ના પાડે છે, તેઓ આપ્યોઆપ માનસિક ચેતનાનો ઉપયોગ ગુમાવી બેસશે, અને માનવ નીચેની પણ કોઈમાં સરી પડશે.

હું તમને મને થયેલી એક અનુભૂતિ વિષે કહીશ. તેથી તમે આ વાતને વધારે સારી રીતે સમજી શકશો. તે જી ફેઝુઆરીની, ૧ અતિમાનસિક અનુભૂતિ પછી થોડા જ સમયમાં મને આ અનુભૂતિ થઈ હતી. તે જી ફેઝુઆરીની અનુભૂતિ પછી, હું ભૌતિક જગતની વસ્તુઓથી બહુ દૂર ચાલી ગઈ હતી; જે વસ્તુઓ મને વિચિત્ર લાગતી હતી. મુલાકાતીઓના એક સમૂહે મારી પાસે આવવાની રજ માગી હતી. એક સાંજે તેઓ કીડાંગણુમાં આવ્યા. તે લોકો શ્રીમં હતા; જીવા માટે જરૂરી કરતાં તેમની પણે વધારે ગૈસા હતા. તેમાંની એક નારીએ સારે પહેરી હતી. તે ખુબ જરી હતી. તેની સાડી ને એવી રીતે ગોઠવવામાં આવી હતી, કે જેથી તેનું શરીર ન દેખાય. જ્યારે તેમને પ્રણામ કરવા નીચે નમી, ત્યારે તેની સારીનો એક છેડો ખસી ગયો. તેનું મોઢું, જાડું પેટ દેખાયું, મને સારે જ આધાત થયો. એવા જાડાં માણસો હોય છે, જેમને જોઈને આપણને તેમના પ્રત્યે આસુગમો થનો હોતો.

૧ જુઓ ૧૮૮૩ ફેઝુઆરીના વાર્તાલાપનું પરિશિષ્ટ.

નથી. પણ આ એટમાં છુપાયેલી વિકૃતિ, કોહવાણ મેં જોયું. તે એક એવું મોટું ગુમડા જેવું બાગતું હતું, જે દોખને, દુર્ગુણને, અધમ પાપમય વૃત્તિને, નાચ કામને, વિકૃતિને અભિવ્યક્ત કરતું હતું. મેં આરી મનની વિકૃતિ જોઈ, જે ખૂબ સધન વાસનાઓથી સેવા કરી રહી હતી. પછી ઓચિતું મારામાંથી કશુંક કૂદી પડ્યું—પ્રાર્થના જેવું, વેદ જેવું કે હે લગવાન, આ વસ્તુ ચાલી જવી જોઈએ!

**ભૌતિક દુઃખ.** આ જગતમાં અસમાન રીતે વહેચાયેલા પદાર્થો બહલી શકાય છે, એ સારી રીતે સમજી શકાય તેવી વાત છે; તેના ઉપાય તરીકે આધિક અને ચામાણક ઉકેલોની કલ્પના કરી શકાય છે. પણ માનવિક દુઃખમાં, પ્રાણીક વિકૃતિમાં ફેરફાર કરી શકતો નથી, તે બદલાવા માગતું હોનું નથી. આ પ્રકારના મનુષ્યોનું પહેલેથી જ વિઘ્નન નિશ્ચિત બની ચૂકેલું હોય છે.

‘મૂલના પાપ’ નો આ અર્થ છે, મનથી શરૂ થતી વિકૃતિ.

માનવ-ચેતનાનો જે ભાગ અતિમનસ્તુ સાથે જોડાવા સમર્થ છે, પોતાની જાતની મુક્તિ મેળવવા સમર્થ છે, તેનું તો પરિપૂર્ણ ઝ્યાંતર થઈ જશે. તે ભાવિ વાસ્તવિકતા પ્રન્યે પ્રગતિ કરી રહ્યો હોય છે, જે હજી બાબ્ય ઝ્યામાં અભિવ્યક્ત થયો હોતો નથી. જે ભાગ પ્રકૃતિની ખૂબ ખૂબ વધારે નજીક છે, પશુની સરખતાની ખૂબ પાસે છે, તે પ્રકૃતિમાં પાછો મળી જશે; પ્રકૃતિ તેનું પૂર્ણ આત્મસાન્કરણ કરી દેશે. પણ માનવચેતનાનો દુષ્પિત ભાગ, જે મનના દુરૂપ્યોગ દ્વારા વિકૃતિને આવવાની છૂટ આપે છે, તે તો દૂર થશે જ.

આ પ્રકારનો માનવ એક નિષ્ઠળ પ્રયાસ છે, જેને દૂર કરે જ છૂટકો, જેવી રીતે બીજી નિષ્ઠળ જાનિઓ વૈશિક ઇતિહાસના કભમાં અદૃશ્ય બની ગઈ છે તેમ.

ભૂતકાળના કેટલાક પયગંબરોમાં આ નિષ્ઠળ દર્શના હતી. પણ સામાન્ય રીતે બને છે તેમ, વસ્તુઓ સંમિક્ષિત હતી. તે પયગંબરોને પોતાની નિષ્ઠળ દર્શનાની સાથે સાથે અતિમાનસિક જગતનું દર્શન થયું ન હતું, જે સંમતિ આપનાર માનવોનું ઊર્ધ્વર્કરણ કરવા માટે અને આ ભૌતિક જગતનું ઝ્યાંતર કરવા માટે આવશે, એટથે માનવ ચેતનાના આ વિકૃત ભાગમાં જન્મેલા લોકોને આંશા આપવા માટે, તેમણે શ્રદ્ધા દ્વારા ઉદ્ધારનો માર્ગ બતાવ્યો. પદાર્થતત્ત્વમાં ભગવાનને પોતાનું જે બલિદાન આયું છે, તેમાં શ્રદ્ધા રાખનાર લોકોનો બીજો જગતમાં ઉદ્ધાર

થણે; પણ તે માત્ર શાલ્લા દ્વારા જ, સમજયા વગર બુલ્લિ વગર, તે પયંગંબરોએ અતિમાનસ જગત જેપું નથી. તેઓ એ પણ સમજયા નથી કે પદાર્થતત્ત્વમાં ભગવાને પોતાની જતનું આપેલું મહાન બલિદાન તે પોતાની અવકાનિત છે, જેની સિદ્ધ પદાર્થતત્ત્વમાં પોતામાં ભગવાનના સમગ્ર પ્રાગટ્યમાં થવી જોઈએ.

\*

## ૨૬ માર્ચ ૧૯૫૮

“એમ યોગ્ય રીતે સૂચવવામાં આવ્યું છે કે, જે એવા ઉત્કાનિતમય શિખરનો દ્વારાદી રાખવામાં આવ્યો હોય અને માનવ તેનું માધ્યમ બનવાનો હોય, તો થોડીકા ખાસ ઉત્કાનત થયેલી વ્યક્તિત્વો જ નવીન ટાઇપ બની શકે અને નવીન જીવન પ્રત્યે ગતિ કરી શકે. એક વાર તેમ બને, એટલે પછી બાકીની માનવજાતિ આધ્યાત્મિક અભીષ્ટામાંથી પાછી નીચે સરી પડે, કારણકે પ્રકૃતિના હેતુ માટે તે વધારે સમય જરૂરી નહિ હોય, અને તે અભીષ્ટા પોતાની સામાન્ય સિથિતમાં ચૂપકિદી પકડી પડી રહે, પણ એવો તર્ક પણ એક સરખી રીતે કરી શકાય કે, જે પુનર્જન્મ દ્વારા ઉત્કાનિતમય યાત્રાઓ વડે આત્માનું આરોહણ આધ્યાત્મિક શિખર પ્રત્યે થવાનું જ હોય, તો માનવ અવસ્થાક્રમ સચ્ચવાઈ રહેવો જોઈએ; નહિ તો ખૂબ જરૂરી એવાં વચ્ચગાળાનાં પગલાનો અભાવ આવી જશે. એ વાત તો તરત જ કબૂલ રાખવી પડશે કે, સમગ્ર માનવજાતિ, એક સમૂહમાં, અતિમાનસ ભૂમિકા પર આરોહણ કરે તેવી શક્યતા જરા પણ નથી. જે સૂચવવામાં આવ્યું છે તે એવું ક્રાન્નિતપૂર્ણ અને આશ્ર્યજનક નથી. પણ માનવીય માનસિકનામાં રહેલી શક્તિ જ્યારે અમૃત ભૂમિકાએ પહોંચશે અથવા ઉત્કાનિતમય આવેગમાં અમૃત આગ્રહયુક્ત બિદુએ પહોંચશે, ત્યારે તે ચેતનાની ઉચ્ચતર ભૂમિકા પ્રત્યે વેગપૂર્વક ગતિ કરશે અને અસ્તિત્વમાં તેને મૂર્તિમંત કરવા માટે પ્રયત્નશીલ થશે, એટલું જ સૂચિત કરવામાં આવ્યું છે. આ દેહધારણથી તે જાણી પોતાની પ્રકૃતિના સામાન્ય બંધારણમાં જરૂર પરિવર્તન લાવશે, તેનું માનસિક, લાંઘણીમય, અને ઈન્દ્રિય-વિષયક બંધારણ પલટાઈ જશે; ધારણ મોટા પ્રમાણમાં શરીરચેતના અને આપણા જીવનની તથા શક્તિત્વોની ભૌતિક સિથિતમાં ફેરફાર થશે. પણ ચેતનાનું પરિવર્તન પ્રધાન અંગ

બની રહેશે, પ્રારંભિક ગતિ બની રહેશે; શારીરિક પરિવર્તન જીણ અંગ, પરિણામરૂપ બની રહેશે. જ્યારે આત્માની જ્યોત, ચૈત્ય પ્રકાશ હૃદયમાં બળવાન બનશે અને પ્રકૃતિ તૈયાર થશે, ત્યારે માનવ માટે આ ચેતનાનું પરિવર્તન હંમેશાં શક્ય રહેશે. આધ્યાત્મિક અભીસા માણુસમાં સાહજિક છે, કારણે, પશુમાં જે જોવામાં નથી આવતું તેથી ઉલ્લંઘન, માણુસને પોતાની મર્યાદાનું અને અપૂર્ણતાનું ભાન હોય છે; તે જાણતો હોય છે કે, અત્યારે પોતે છે તેના કરતાં કાઈક અધિક તેને પ્રાપ્ત કરવાનું છે. આ આત્મભાષિક્યનો આવેગ માનવ-જતિમાં કદી મરી જાય તેવો સંલઘ નથી. માનવીય માનસિક દરજાને હંમેશાં ત્યાં રહેવાનો છે; પણ મુનર્જનમના સુદીલમાં માત્ર માત્રા તરીકે જ નહિ રહે, પણ આધ્યાત્મિક અને અતિ-માનસિક દરજા પ્રત્યે એક ખુલ્લા પગલા તરીકે રહેશે.”

( દિલ્ય જીવન, પૃષ્ઠ ૮૪૨-૪૩ )

એ વાત સ્પષ્ટ છે કે, માણુસનું ખાસ લક્ષણ પોતે જીવે છે તેનું અવલોકન કરવાની શક્તિ છે. પણ આપોઆપ, સ્વર્યાભૂ રીતે જીવનું હોય છે. પોતે જીવે છે તેનું અવલોકન તે ખૂબ થોડા પ્રમાણમાં, નગરાય પ્રમાણમાં કરતું હોય છે. તેથી તે શાન્તિપૂર્વક જીવે છે, ચિત્ત કરતું હોતું નથી. જો પણ માંદળીને અથવા અક્ષમાતને કારણે દુઃખ બોગવતું હોય છે, તો પણ તે તેનું અવલોકન કરી શકતું ન હોવાને કારણે તે દુઃખ ખૂબ ઓછું બની જાય છે. તે તે દુઃખનો વિસર્ગ પોતાની ચેતનામાં કે ભાવિમાં કરતું નથી, અક્ષમાત અથવા માંદળી વિષે કલ્પનાઓ કરતું હોતું નથી.

માણુસ શું બનશે તેની સતત ચિત્ત કરતો હોય છે. તે ચિત્તા જ તેના દુઃખનું એક માત્ર કારણ નહિ, તો પ્રધાન કારણ હોય છે. આ વિષયગત ચેતનાને લીધે, ચિત્તા, કષ્ટમય કલ્પનાઓ, દુઃખ, ભાવિ સંકટોનો લય વગેરેનો પ્રારંભ થતો હોય છે. તેનું પરિણામ એ આવે છે કે, ધાર્યાભરા માણુસો, થોડાક સચેતન નહિ, પણ ખૂબ ખૂબ સભાન માણુસો પણ સતત પીડામાં જીવતા હોય છે. માણુસ એટલો અધી સચેતન છે, કે તે બેપરવા રહી શકે જ નહિ. શું બનશે તે જાણવા જોટલો તે સચેતન હોતો નથી. ભુલ વગર એમ કહી શકાય કે, પૃથ્વીનાં સર્વ પ્રાણીઓમાં માનવ સૌથી વધારે દુઃખી પ્રાણી છે. માનવને તેવા જનવાની ટેવ પડી ગઈ છે, કારણ કે તે સ્થિતિ તેને તેના પૂર્વને પાસેથી વારસામાં મળી છે. તે સાચે જ દુઃખપૂર્ણ સ્થિતિ છે. માત્ર ઉચ્ચતર બૂમિકા પર ઉધર્વમાં જવાની આધ્યાત્મિક

શક્તિ વડે જી, પણ-ચેતનાને સ્વાને આધ્યાત્મિક પર-ચેતના સ્થાપિત કરવા વડે જી, અસ્તિત્વમાં તેનું લક્ષ્ય જોગાની શક્તિ આવે છે, એટલું જી નહિ, પણ પોતાના પ્રયાસની સિદ્ધિને અગાઉથી જાણી વેવાની શક્તિ પણ આવે છે; તેનામાં ઉચ્ચતર આધ્યાત્મિક શક્તિમાં સ્પષ્ટ દર્શનવાળો વિશ્વાસ પણ જાગે છે જે વિશ્વાસને તે પોતાનું સમગ્ર અસ્તિત્વ સમર્પિત કરી દઈ શકે છે, જેને તે પોતાના જીવનની જવાબદારી અને પોતાનું ભાવી સોંપી દઈ શકે છે, અને ચિત્તા-મુજલ બની શકે છે.

અલબત્ત, પર્યાની ભૂગિકામાં પાછા જવાનું અને પ્રાપુ કરેલી ચેતના ગુમાવી દેવાનું માણસ માટે અથક્ય છે. એટલે આ દુઃખમય સ્થિતિમાંથી છુટકારો મેળવ-વને તેને માટે એક જ ઉપાય છે, અને તે એક કે ઉચ્ચતર સ્થિતિને પ્રાપુ કરવી, જેમાં ચિત્તાને બદલે વિશ્વાસપૂર્ણ સમર્પણ અને તેજેમય સિદ્ધ બાબતની ખાતરી પ્રાપુ થાય શે, આ ચેતનાનું પરિવર્તન કરવાનો માર્ગ છે.

સાચી રીતે ઉહીએ તો, જે અસ્તિત્વ માટે પોતે જવાબદાર નથી, જેની ચાવી પોતાની પાસે નથી, જેની સમસ્યાઓનો ઉકેલ આપી શકે, તેમાં માર્ગદર્શન આપી શકે તેવાં તંતુઓ જેના પોતાના હાથમાં નથી, તેવા અસ્તિત્વ કરતાં વધારે દુઃખમય સ્થિતિ બીજી કોઈ ન હોઈ શકે. પણ પોતાની આગળ સમસ્યાઓ ખરી કરતું હોતું નથી; તે માત્ર જીવનું જ હોય છે. તેની સાહજિક વૃત્તિ તેને પ્રેરે છે; તે સામુહિક ચેતના પર આધાર-વિશ્વાસ રાખે છે, જે ચેતનામાં સાહજિક જ્ઞાન હોય છે અને જે ચેતના પોતાના કરતાં ઉચ્ચતર હોય છે. પણ તે બધું આપોઆપ, સ્વર્યંભૂ રીતે થતું હોય છે. તેને કોઈ બાતનનો સંકલ્પ કરવાની જરૂર પડતી હોતી નથી, તેને સિદ્ધ કરવા પ્રયત્ન કરવા પડતો હોતો નથી. તે પોતાના જીવન માટે જવાબદાર નથી, તેથી તે ચિત્તા કરતું હોતું નથી. માણસને, જન્મતાં-વેંત, પોતાના પર આધાર રાખવાની લાગણી જન્મતી હોય છે. પણ તેનું તેને જ્ઞાન ન હોવાથી, તે સતત ચિત્તામાં જીવનો હોય છે. પોતાની ચેતના કરતાં ઉચ્ચતર ચેતનાને સંપૂર્ણ કરવાથી જ તેના દુઃખનો અંત આવી શકે. તે ઉચ્ચતર ચેતનાને તે પોતાની જત સોંપી શકે છે, પોતાની ચિત્તાઓ તેને સોંપી દઈ શકે છે, પોતાના જીવનને દોરવાનું અને સર્વ વસ્તુઓનું સંગઠન કરવાની દરકાર તે તે ઉચ્ચતર ચેતનાને સોંપી દઈ શકે છે.

જે માણસમાં જરૂરી જ્ઞાન ન હોય, તો ને સમસ્યાનો ઉકેલ કેવી રીતે વાવી શકે? કમનસીબી ઓ છે કે માણસ એમ માનતાં હોય છે કે મારા જીવનની સમ-

સ્થાઓ મારે જ ઉકેલવાની છે. પણ તેમ કરવાનું જ્ઞાન તેની પાસે હોતું નથી.<sup>૩</sup> તેનાં બધાં દુઃખોનું તે મૂળ કારણ છે. તે અત્યત એમ પૂછતો હોય છે કે મારે શું કરવું જોઈએ? તે પછી તેના મનમાં બીજો વધારે તીવ્ર પ્રશ્ન ઉકેલો હોય છે કે ભવિષ્યમાં શું બનશે? તે પ્રશ્નોનો જવાબ આપવાની શક્તિ તેનામાં હોતી નથી.

તેથી બધા આધ્યાત્મિક અભ્યાસકો કહે છે, કે પ્રથમ જરૂર છે સર્વ જવાભ-  
દારીઓ ભગવાનને સોંપી દેવાની, તેમના પર વિશ્વાસ રાખવાની; તે સિવાય શાન્તિ-  
અશક્ય છે. અને છનાં માણુસને ચેતના આપવામાં આવી છે. જેથી તે વિકાસ  
સાધી શકે, પોતે નથી જાણતો તેને શ્યામી કાઢી શકે, પોતે હજી જે નથી બન્યો  
તેમાં વિકાસ કરી શકે. એટલે એમ કહી શકાય કે જરૂર નિશ્ચિંતન શાન્તિ કરતાં  
એક ઉચ્ચતર સ્થિતિ છે. તે પ્રગતિ કરવા માટેનો, પ્રગતિ માટે પ્રયાસ કરવા માટેનો  
સંકલ્પ ટકાવી રાખવા માટે ભગવાનમાં વિશ્વાસ હેવાની જરૂર છે. તેથી બધી ચિના-  
ઓથી માણુસ મુજબ બની જશે, શાન્તિપાદીઓની પદ્ધતિ કરતાં આમાં એક  
પગલું આગળ છે. શાન્તિપાદીઓ તો સર્વ કર્મનો સંન્યાસ કરીને સ્થિરતામાં,  
અંતર શાન્તિમાં (મૌનમાં) ચાલ્યા જવા માગતા હોય છે. તે લોકો જીવનનો ત્યાગ  
કરે છે, કારણકે તેમને લાગતું હોય છે કે તે સિવાય શાન્તિ શક્ય નથી અને  
શાન્તિ સિવાય કોઈ અંતર સાક્ષાત્કાર શક્ય નથી એટલે સ્વાભાવિક રીને જ, તેને  
લાગતું કે માણુસ બાબુ પરિસ્થિતિઓમાં જીવે, નાં સુધી શાન્ત તેને માટે દુર્લભ  
છે, કારણકે બાબુ પરિસ્થિતિઓમાં સમર્યાઓ ઉલ્લો થતી હોય છે અને તેમનો  
ઉકેલ લાવી શકતો હોતો નથી, કારણકે માણુસમાં ઉકેલ લાવવા માટે જરૂરી જ્ઞાન  
હોતું નથી.

પછીનું પગલું જો છે કે સમસ્યાનો સામનો કરવો, અને સાથે સાથે પરમા-  
ત્મામાં સંપૂર્ણ વિશ્વાસની ખાતરી રાખવી, કે જે પરમાત્મા બધું જાણે છે અને  
તમારી પાસે કાર્ય કરાવે છે. પછી કાર્યનો ત્યાગ ન કરતાં, માણુસ બલવાન અને  
સક્રિય, ઉચ્ચતર શાન્તિમાં કાર્ય કરી શકે છે.

આને જીવનમાં ભગવાનની દરમિયાનગિરીની નવીન બાજૂ કહી શકાય,  
અસ્તિત્વમાં દિવ્ય બણોની દરમિયાનગિરિનું નવીન રૂપ કહી શકાય, આધ્યાત્મિક  
સાક્ષાત્કારની નવીન બાજૂ કહી શકાય.

## ૨ એપ્રિલ ૧૯૪૮

માતાજી, તમે કહું કે સભાનતા પૂર્વક કરાયેલી ભૂલ અભાનતાપૂર્વક કરાયેલી ભૂલ કરતાં વધારે ગંભીર હોય છે.

જ્યારે તમે અભાનતાપૂર્વક, તે ભૂલ છે એમ ન જાણતાં, ભૂલ કરો છો, ત્યારે જ્યારે તમને તે ભૂલ સમજાય છે અને તમારું અજ્ઞાન ચાલ્યું ગયું હોય છે, ત્યારે તમારામાં સદ્ગ્ભાવના આવે છે અને પછી તમે ભૂલ કરતા હોતા નથી અને તે ભૂલ કરવાની સિથિતમાંથી તમે બહાર આવી જાઓ છો. પણ જો તમે તેને ભૂલ જાણવા છતાં તે ભૂલ કરો છો, ત્યારે તેનો અર્થ એ થયો કે તમે વિચાર પૂર્વક ગુંચવાડાની સિથિતિને, ખરાબ વસ્તુને, ભગવાન વિરોધી બળાને તાબે થવાનું પસંદ કર્યું છે.

એ વાત સ્પષ્ટ છે કે જ્યારે માણસ ભગવાન વિરોધી બળાને તાબે થવાનું પસંદ કરે છે, તે બળાને! પ્રતીકાર કરવાનું તમારામાં સામર્થ્ય નથી અને તેથી તમે તેમને તાબે થવાનું પસંદ કરો છો, ત્યારે તે માનસશાસ્ક્રીય દૃષ્ટિબિનદ્ધથી જોતાં અનંતગાણ્યું વધારે ગંભીર છે. એનો અર્થ એ થાય છે કે તમારામાં કયાંક કોઈક વસ્તુ દૂષિત છે. કાં તો તમારામાં કોઈ વિરોધી બળ સ્થાપિત થઈ ગયેલું હોય છે, અથવા તે બળો સાથે તમારામાં કોઈક ગાઢ સહાનુભૂતિ છે. અને તેને સુધારવાનું તે અજ્ઞાનને સુધારવા કરતાં ઘણ્યું વધારે કઠિન હોય છે.

અજ્ઞાનને સુધારવું એ અંધકારને દૂર કરવા જેવી બાબત છે. તમે દીવો સળગાવો, અને અંધકાર અદૃશ્ય થઈ જાય છે. પણ જાણ્યો જોઈને ભૂલ કરવી એ કોઈક દીવો કરે તેને હોલવી નાંખવા જેવી બાબત છે. તેનો અર્થ એ થયો કે તમે જાણ્યો જોઈને અંધકારને પાછો લાવવા માગો છો, કારણુકે એમાં તમારી નભળાઈની દલીલ લાગુ પડતી નથી. ને લોકો પોતાની જાતને સુધારવાનો નિશ્ચય કરે છે, તેમને લગવાનની કૃપા મળતી જ હોય છે. પછી તમે એમ ન કહી શકો કે મારામાં એટલી બધી નિર્બળતા છે કે હું મારી જાતને સુધારી શકતો નથી. તેઓ એમ કહી શકો કે “અમારી જાતને સુધારવાનો નિશ્ચય હજુ અમે કર્યો નથી. અમારા અસ્તિત્વમાં કાંઈક એવું છે, જેણે સુધરવાનો નિશ્ચય કર્યો નથી.” એ બહુ ગંભીર બાબત છે.

નબળાઈની દલીલ એ એક બહાનું છે. જે માણસ નિશ્ચય કરે છે, તેને મદદ કરવા માટે ભગવાનની કૃપા હોય છે જ.

એનો અર્થ તો દિલની સર્વાઈનો અભાવ થયો, તે નબળાઈ નથી. દિલની સર્વાઈનો અભાવ શરૂ માટે દ્વાર જોલી નાખે છે. એનો અર્થ એ થયો કે વિકૃતિ પ્રન્યે તમારામાં નિગૂઢ સહાનુભૂતિ છે. તે બાબત ગંભીર છે.

જેને જ્ઞાન આપવાનું છે તે અજ્ઞાનની બાબતમાં, માત્ર દીવો કરવો એ પૂરું છે. જાણી જોઈને બૂલ કરવાની બાબતમાં શબ્દકિયાની જરૂર પડતી હોય છે.

\*

## ૬ એપ્રિલ ૧૯૫૮

વહાલાં માતાજી, માનવ મન વડે બીજા માણસના આત્માનું ભાન થવું શક્ય છે?

આપણે બોલતા હોઈએ છીએ તે રીતે, વસ્તુઓ સુનિશ્ચિત અને ભિન્ન નથી હોતી. તેથી તો આપણા અસ્તિત્વમાંના લિન્ન લિન્ન ભાગોને આપણે તદ્દન સ્પષ્ટતાપૂર્વક જોઈ શકતા નથી સિવાય કે માણસે લાંબા સમય સુધી અભ્યાસ અને અપલોકન કર્યા હોય. આત્માની અને મનની વચ્ચે પ્રાણિક અને શારીરિકની વચ્ચે અલેદ્ય ખાનાં નથી એમનાં મનમાં પ્રવેશતો હોય છે. કેટલાક લોકોમાં તેવું ખૂબ પ્રમાણમાં, દૃષ્ટિગોચર બને તે રીતે થતું હોય છે. એટલે જે મનને એક પ્રકારની અનુભૂતિ, ક્ષમતા પ્રાપ્ત થઈ હોય, જે ચૈત્યમય અસ્તિત્વ સાથે સૂક્ષ્મ સંપર્કમાં હોય, તે બીજા લોકોના આત્માની હાજરીને અનુભવવા સમર્થ હોય છે.

જે લોકોમાં બીજાઓની ચેતનામાં તેટલી હદ સુધી પ્રવેશ કરવાની આવડત છે કે જેથી તેઓ સીધી રીતે બીજાઓના વિચારને, માનસિક કિયાને જોઈ અથવા અનુભવી શકે, જે લોકો, પોતાનો અર્થ સમજવવા માટે શબ્દોની મદદ સિવાય બીજાઓના માનસિક વાતાવરણમાં પ્રવેશ કરી શકે, તે લોકો સહેલાઈથી લેદ કરી શકે છે કે આ માણસનો આત્મા સક્રિય છે અને પેલા માણસનો આત્મા હજી ઉદ્ઘે છે. આત્માની કિયા માનસિક કિયાને અમુક ખાસ રંગ અર્પણે હોય છે તે

રંગ આછો, વધારે સમાવેશક અને તેજેમય હોય છે જેનો અનુભવ કરી શકાય તેમ છે. દા. ત. અમુક માણુસનો આંખોમાં જોઈને તમે કહી શકો કે આ માણુસનો આત્મા જીવંત છે અથવા તેની આંખોમાં મને તેનો આત્મા દેખાતો નથી. ઘણા ઉત્કાન્ત બનેલા બોકો તે કહી શકે છે પણ કોઈ માણુસનો આત્મા કેટલો જગૃત થયો છે, સહિય બન્યો છે, કેટલા પ્રમાણમાં તે તેના અસ્તિત્વનું શાસન કરે છે. તેનો પ્રભુ છે, તે ચોક્કસ રીતે જાળવા માટે માણુસમાં પોતામાં ચૈત્યક ચેતના હોવી જોઈએ, કારણુંકે તે જ લિશ્યપૂર્વક નિર્ણય કરી શકતી હોય છે, પણ એ પ્રકારનું આંતર આકંપન પ્રાપ્ત કરવું એ તદ્દન અશક્ય નથી, જે આકંપન તમને કહેવડાવી શકે કે ઓછ, આ માણુસને આત્મા છે!

જે બોકો દીક્ષિત નથી હોતા, તેવા ઘણા-ખરા બોકો પ્રાણિક કિયાને જ આત્મા કહેતા હોય છે. જો કોઈનામાં બળવાન, સહિય, જક્કી, શરીરની કિયાઓ પર શાસન કરતું, વસ્તુઓ, વ્યક્તિઓ, ઘટનાઓ સાથે જીવંત સંપર્ક ધરાવતું પ્રાણિક તત્ત્વ હોય, જો તેને કુલા માટે, સૌનાર્ધની સર્વ અલિયક્તિઓ માટે ખૂબ રસ હોય, તો માટે જ્ઞાગે આપણે તેમ કહેવા અને માનવા લબ્ધયાતા હોઈએ છીએ કે, ઓછ, તેનામાં જીવંત આત્મા છે. પણ તે તેનો આત્મા નથી હોતો. તે તેનું પ્રાણિક અસ્તિત્વ હોય છે, જે જીવંત હોય છે અને શરીરની કિયાઓ પર પ્રભુત્વ ધરાવતું હોય છે. આ વસ્તુ વિકાસનો પ્રારંભ કરતા બોકોની વચ્ચેનો અને કેવળ ભૌતિક જીવનના તમસમાં જીવતા બોકોની વચ્ચેનો પ્રથમ તફાવત છે. તે તે માણુસના દુખાવને અને કિયાને એક પ્રકારનું આકંપન, આકંપનની ઉત્કટતા આપતું હોય છે, જે એવી લાગણી ઘણી વાર પેદા કરે છે કે, આ માણુસમાં જીવંત આત્મા છે. પણ તે આત્મા નથી હોતો, તેનું પ્રાણિક વિકસિત થયેલું હોય છે, જેનામાં અમુક ખાલ શક્તિ હોય છે, જે શારીરિક તમસ્ય કરતાં વધારે બળવાન હોય છે, જે આકંપનની, જીવનની, કિયાની ઉત્કટતા પેદા કરતું હોય છે, જેમનું પ્રાણિક અસ્તિત્વ વિકસ્યું હોતું નથી તેમનામાં એવી શક્તિ નથી હોતી. પ્રાણિક કિયા અને આત્મા વચ્ચેનો આ ગુંચેવાડો ઘણી વાર જેવામાં આવે છે. માનવ-ચેતના આત્માના આકંપન કરતાં પ્રાણિક આકંપનને વધારે સહેલાઈથી જોઈ શકે છે.

માણુસના આત્માને જોઈ શકવા માટે મન ખૂબ શાન્ત બનેલું હોવું જોઈએ, કારણુંકે, જ્યારે મન સહિય હોય છે, ત્યારે આત્માનાં નહિ, પણ મનનાં આકંપનો દૃષ્ટિગોચર થતાં હોય છે,

જ્યારે તમે આત્મામાં જીવન ધારણ કરતા, આત્માથી સભાન માણસને જુઓ છો, ત્યારે તમને જ્ઞાને તમે ખૂબ-ખૂબ ઊંડા ઉત્તરના હો, તમે તેનામાં દૂર-દૂર સુધી જતા હો તેવી લાગણી અનુભવાય છે. પણ ચામાન્ય માણસની આંખોમાં જ્યારે તમે જુઓ છો, ત્યારે તમે એક એવી સપાટી પર પહોંચતા હો છો કે જે તમારી દૃષ્ટિને પ્રત્યુત્તર આપતી હોય, પણ તમને એવી લાગણી થતી હોતી નથી કે, હું ખૂબ-ખૂબ તેનામાં ઊંડે ઉત્તરી ગયો, ખૂબ-ખૂબ દૂર પહોંચી ગયો. જેમ કોઈ ઊંડા છિદ્રમાં જતી વખતે આપણને અનુભવાતું હોય છે તેમ, અને તેથી તમને ખૂબ નાનકડો, શાન્ત પ્રત્યુત્તર પ્રામ થાય છે. મોટે ભાગે, સામાન્ય લોકોની આંખો એવી હોય છે કે જેમાં તમે પ્રવેશ કરી શકતા નથી, તે આંખો બધ કરી દીધિબાં દ્વાર જેવી હોય છે. પણ કેટલીક આંખો ખુલ્લી હોય છે અને તેમાં તમે પ્રવેશ કરો છો, પણ પાછળથી તે આંખો બંધ થઈ ગવેલી હોય છે તમને ત્યાં કોઈ આકંપન અનુભવાય છે, કેટલીક વાર જગકારો અનુભવાય છે. પછી જો તમે ભૂલ કરો, તો જોલી ઊંડો છો કે, ઓહ, આનો આત્મા જીવંત છે. પણ તે આત્મા નથી હોતો, પ્રાણીક હોય છે.

આત્માને શોધી કાઢવા માટે તમારે આ શીને અંદર જવું જોઈએ (ખૂબ અંદર ઊંડે જવાનો અભિનય), સપાટી પરથી તમારી જતને પાછી જેંચી લેવી જોઈએ, ખૂબ-ખૂબ ઊંડે ઊંડ અંદર જવું જોઈએ. કોઈ છિદ્રમાં જતા હો તેમ, જે છિદ્ર શાન્ત અને સ્થિર છે. ત્યાં તમને કશુંક ઉષુ, શાન્ત, પદાર્થતત્વમાં સમૃદ્ધ, ખૂબ પરિપૂર્ણ દેખાયે, જે મધુરતા જવું હશે. આત્મા છે.

જો તમે આગ્રહ-થુક્ત અને સભાન હશો, તો તમને એક એવી પ્રચુરતા પ્રાપ્ત થશે કે જે તમને પૂર્ણતાની, અગાધ ઊંડાણેની લાગણી આપશે, જેમાં તમારે પ્રવેશ કરવાનો છે. ત્યાં તમારી આગળ રહસ્યો પ્રગટ થશે. સનાતન એવા કાંઈકના ખૂબ શાન્ત જીવોમાં પડનાં પ્રતિનિબંધ પેડે. પછી કાળની મર્યાદા નેને અનુભવાથી નથી.

ત્યારે માણસને હંમેશાં વિઘ્નમાન હોવાની, સનાતન હોવાની અનુભૂતિ થાય છે. તે આત્માના હાર્દિકો સ્પર્શ થતાં અનુભવાય છે.

જો તે સંપર્ક પરિપૂર્ણ અને સભાનપૂર્વકનો થશે, તો તમને બાધ રૂપથી મુક્તિ પ્રામ થશે. પછી તમને એમ નહિ ભાગે કે તમને શરીર છે, તેથી

તમે જીવી રહ્યા છો. સામાન્ય રીતે માણસ ભાવ્ય રૂપથી એટલો બધો બંધાઈ ગયો હોય છે કે જ્યારે તે પોતાની જતનો વિચાર કરતો હોય છે, ત્યારે તે શરીરનો જ વિચાર કરતો હોય છે, માટે ભાગે આમ જ બનતું હોય છે. અંગત વાસ્તવિકતા એ શરીરની વાસ્તવિકતા હોય છે. જે માણસે આંતર દિક્કાસ માટે પ્રયાસ કર્યો હોય, પોતાના અસ્તિત્વમાં રહેલા નિત્ય તરફનો શૈખ્ષી કાઢવાનો પ્રયાસ કર્યો હોય, તો જ તેને ભાન થાય કે સર્વ કાળમાં નિત્યરૂપે સચેતન એનું આ કાંઈક, સર્વ પરિવર્તનોમાં અપરિવર્તનીય રહેલું એવું આ કાંઈક એ મારો આત્મા છે. હું દું દું પણ તે બહુ ઊડા અભ્યાસને માગી લે છે. બાકી તો, જ્યારે તમે ઓમ વિચાર કરતા હો છો કે હું આ કરવા માગું દું, મારે પેલી વસ્તુની જરૂર છે, ત્યારે તમે માત્ર શરીરનો જ, લાગણ્ણીઓના સંમિક્ષાલઙ્ઘ નાનકડ સંકલ્પનો જ, ઓછા વત્તા પ્રમાણમાં જૂંચવાઓમાં પણ ગયેલાં માગણીમય પ્રતિકાર્યેનિ જ, આવેગમય, જૂંચવાઓમાં પડેલા, વિચારોના સંમિક્ષાલઙ્ઘનો જ, આકર્ષણુનો, કામનાનો, અમૃત પ્રકારના સંકલ્પનો જ વિચાર કરતા હો છો. તે જ તે બધું માટે તમારો આત્મા બની જતું હોય છે. મસ્તકથી, ઘઢથી, હાથોથી, પગોથી, સંચાલિત થનાં બધાં અંગોથી સ્વતંત્ર એવા આત્મા આમ એક બીજી સાથે નિકટના-પૂર્વક જોડાઈ ગયાં હોય છે.

ખૂબ વિચાર્યા પછી, ખૂબ જોવા પછી, ખૂબ અભ્યાસ (પ્રેક્ટીસ) કર્યા પછી, ખૂબ અવલોકન કર્યા પછી, તમને ભાન આવવા લગે છે કે આ બધું એક બીજોથી વત્તા-ઓછા પ્રમાણમાં સ્વતંત્ર છે, પીઠમાં રહેલો સંકલ્પ તેની પાસે કાર્ય કરાવે અથવા તો ન પણ કરાવે; પછી તમે ગનિ સાથે તાદાત્મ્ય કરતા અટકી જાઓ છો, કિયા કે અનુભૂતિ સાથે તાદાત્મ્ય કરતા અટકી જાઓ છો. તે બધામાં તમને 'કાંઈક' તરતું દેખાય છે. તેને જોવા માટે તમારે ખૂબ અવલોકન કરવાની જરૂર છે.

પછી તેથી પણ વધારે અવલોકન કરતાં તમને જણાશે કે બીજું કશુંક પીઠમાં રહેલું છે, આ સક્રિય સચેતન સંકલ્પને તે જ ગનિમાન બનાવતું હોય છે, તે 'કાંઈક' અવલોકન કરે છે, નિર્ણય કરે છે, નિશ્ચય કરે છે, જ્ઞાન ઉપર તેના નિશ્ચયોને સ્થાપી આપવાનો પ્રયત્ન કરે છે, આ તો બહુ પાછળાથી આવનો અનુભવ છે. જ્યારે તમે આ 'કાંઈક' તે જોવાની શરૂઆત કરો છો, ત્યારે તમને જણાય છે કે તેજ 'કાંઈક'માં સંકલ્પને ગનિમાન કરવાની શક્તિ છે; એટલું જ નહિ, પણ તે 'કાંઈક' સર્વ પ્રતિકાર્યો ઉપર, લાગણ્ણીઓ ઉપર, દીનિદ્રય જન્ય સંસકરણે

ઉપર સીધું અને મહત્વનું કાર્ય કરતું હોય છે, છેવટે તન અસ્તિત્વની સર્વ ગતિઓ ઉપર કાબૂ પ્રાપ્ત થઈ જતો હોય છે, આ બાગ કે કે અવલોકન કરે છે, નિર્ણય કરે છે, અને નિશ્ચય કરે છે.

આ કાબૂની શરૂઆત છે.

જ્યારે માલુમ તેનાથી સચેતન જને છે, તંતુરે પકડે છે, કાબૂની વાત કરે છે, ત્યારે તેને જણાય છે કે ઓછ, કાબૂની શક્તિ તે આનામાં છે.

## ૧૬ એપ્રિલ ૧૯૫૮

“ઉત્કાન્તિની પહેલાંની અવસ્થાઓમાં, પ્રકૃતિને ભૌતિક સંગઠનમાં પરિવર્તન કરવા પ્રત્યે વધારે ધ્યાન આપવું પડયું હતું અને પ્રયત્ન કરવો પડ્યો હતો, કારણકે તેમ કરે તો જ ચેતનામાં પરિવર્તન થઈ શકે. શરીરમાં પરિવર્તન લાવવા માટે પહેલાં રચાયેલી ચેતનાની શક્તિ અપર્યાપ્ત હતી, અને તેથી આ જરૂરિયાત ઉલ્લે થઈ હતી. પણ માનવાં પાછા જવું એ શક્ય છે, અનિવાર્ય છે, કારણકે તેની ચેતના દ્વારા, તેમાં કરાયેલા પરિવર્તન દ્વારા જ, નવીન શારીરિક સંગઠન પ્રાપ્ત કરણું તરીકે ઉપયોગ કરવા વડે જ ઉત્કાન્તિ થઈ શકે તેમ હતું. વસુઓની આંતર વાસ્તવિકતામાં ચેતનાનું પરિવર્તન એ જ હુમેશા મુખ્ય હકીકત હોય છે, ઉત્કાન્તિમાં હુમેશાં આધ્યાત્મિક અર્થપત્તા રહેલ્યી હોય છે, અને શારીરિક પરિવર્તન તો માત્ર કરણું જ હોય છે. પણ આ સંબંધ બે તર્ફોના પ્રથમના અસાધ્યારણ સમતુલ્ય વડે નિગૂઢ હનો. બાબ અચેતનતાનું શરીર, મહત્વની જિંદગી, આધ્યાત્મિક તત્ત્વ, કરતાં સચેતન અસ્તિત્વ કરતાં વધારે વળનદાર હતું, અને તેને આચાદિત કરી દેણું હતું પણ એક વાર તે સમતુલ્યને યોગ્ય રીતે સ્થાપિત કરવામાં આવે, તો પછી શારીરિક પરિવર્તન ચેતનાના પરિવર્તનથી પહેલું થવું જ જોઈએ એવી જરૂરિયાત ન રહે. ચેતનાનું પરિવર્તન જ શરીરમાં જરૂરી પરિવર્તન લાવી દેશે, તેમ કરવાની ફરજ પડ્યો. એ વાત જ્યાલમાં રાખવાની છે કે નવીન પ્રકારનાં વનસ્પતિને તથા પણુંને ઉત્કાન્ત કરવામાં, માનવ મને પ્રકૃતિને મદદ કરી છે. મદદ કરવામાં ચેતનાની શક્તિ બતાવી આપી છે.

તેણે તેનાં વાતાવરણનાં નવીન રૂપો સજ્વાર્યો છે, પોતાની માનસિકતામાં શાન અને સંયમ વડે, ખૂબ પરિવર્તનો વિકસાય્યા છે. પોતાની આધ્યાત્મિક અને શારીરિક ઉત્કાનિતમાં અને ઇપાંતરમાં, માણુસ સલ્લાનતાપૂર્વક પ્રકૃતિને મદદ કરે એ અશક્ય નથી. તેને માટેનો આવેગ તેનામાં કયારનોયે છે, આંશિક રીતે અસરકારક નીરહ્યો છે, જે કે ઉપરાધલી માનસિકતા તે વાતને પૂરી સમજ શકી નથી અને સ્વીકારી શકી નથી. પણ એક દિવસ તો તે તેને સમજશે, પોતામાં વધારે ઊંડી જઈ તેનો ઉપાય શોધી કાઢ્યો, નિગૂઢ શક્તિને અને ચિત્ત શક્તિના ઈરાદાપૂર્વક કરાતા કાર્યને સમજ શક્યો, જે ચિત્ત શક્તિ પ્રકૃતિની નિગૂઢ વાસ્તવિકતા છે.

જો પદાર્થતત્ત્વમાં આપણા જન્મનું નિગૂઢ સત્ય પુષ્ટ્વી પર આધ્યાત્મિક પ્રગટીકરણ હોય, જે પ્રકૃતિમાં થઈ રહેલી ઉત્કાનિત પાયાભૂત રીતે ચેતનાની ઉત્કાનિત હોય, તો અત્યારે માનવ જેવો છે તેવો ઉત્કાનિતનું પરમ ચરમ શિખર ન હોઈ શકે. તે હજુ આત્માની ખૂબ અપૂર્ણ અભિવ્યક્તિ છે, મન પોતે ખૂબ મર્યાદિત રૂપ અને કરણ છે. મન એ ચેતનાનું વચ્ચગાળાનું તત્ત્વ છે. માનસિક સત્ત્વ માત્ર પરિવર્તનમાં વચ્ચગાળાનું જ સત્ત્વ હોઈ શકે. જો માણુસ માનસિકતાથી પર જવા અશક્તત હોય, તો તેને સ્થાને અતિ મનસું અને અતિ માનવ પ્રગટ થવા જોઈએ, અને તેમણે સૃષ્ટિની આગેવાની પોતાના હાથમાં લેવી જોઈએ. પણ જે માનવનું મન પોતાના કરતાં અધિક તત્ત્વ પ્રત્યે ખુલ્લું બનવા શક્તિશાળી હોય, તો માનવ પોતે અતિ મનસું, અતિ માનવતામાં પહોંચી ન શકે તેમ માનવનું કારણ નથી; કમણી કમ, તે પોતાની માનસિકતાને, પ્રાણને, અને શરીરને પ્રકૃતિમાં આવિજ્ઞાવ પામતા આત્માની મહત્ત્ર માત્રાની ઉત્કાનિતને સોંપી દઈ શકે.”

( દિવ્ય જીવન, પૃષ્ઠ ૮૪૩-૪૪; ૮૪૬-૪૭ )

ગમે તેમ, પણ હવે આપણે ખાતરીને પ્રામ કરી શક્યા છીએ, કારણે ક્ષિદ્ધિની શરૂઆત કરારનીયે થઈ ચૂકી છે. આપણને સાબિતી પ્રામ થઈ રહ્યે કે અમૃક અવસ્થાઓમાં માનવતાની સામાન્ય સ્થિતિથી પર જઈ શકાય છે, નવીન ચેતનાની રિથતિ પ્રાપ્ત કરી શકાય છે, જે માનસિક અને માનવ વચ્ચે સલ્લાન સંબંધ સાધી શકે છે.

એમ ખાતરી પૂર્વક કહી શકાય કે માનસિક અને અતિ માનસિક પ્રાણીના વચ્ચગાળામાં એક એવો નમૂનો આવશે, જેનામાં હજુ પણ માનવના ગુણો અને સ્વભાવ અમૃક અંશમાં રહ્યા હશે, અર્થાત્ જે તેના પણ ઉદ્ઘામરથાન સાથે, તેના

આથ રૂપમાં માનવ પ્રાણી હો, પણ જેની ચેતનામાં એવું પરિવર્તન થઈ ચૂક્યું હો કે જેથી તે અતિ માનવોની જાતિનો, કોઈ નવીન જાતિની કિયાનો અને સિદ્ધિનો હો.

આ જાતિને વચ્ચગાળાની જતિ કહી શકાય, કારણું એવું પૂર્વ દર્શન થઈ શકે છે કે તે પશુ પદ્ધતિને અપનાવ્યા સિવાય નવીન પ્રાણીઓને પેદા કરવાના ઉપાયો શોધી કાઢ્યો, અને તે સાચી રીતે આધ્યાત્મિક જરૂર પામેલાં પ્રાણીઓ અની માનસિક જાતિનાં, નવીન જાતિનાં ઘટક તત્ત્વોથી બનેલા હો.

એટલે આપણે તે બોકેને અતિ માનવો કહી શકીએ કે જે ઉત્પત્તિની બાબતમાં જૂની પદ્ધતિ વડે જરૂર્યા હતા, પણ જે પોતાની સિદ્ધિમાં અતિ માનસિક સાક્ષાત્કારના નવીન જગત સાથે સલ્લાન અને સહિય સંપર્ક ધરાવતા હો.

એ વાત નિશ્ચિત છે કે આ વચ્ચગાળાના જગતનું જેણું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે પદાર્થતત્ત્વ વધારે સમૃદ્ધ, વધારે શક્તિશાળી, વધારે તેજોમય, વધારે પ્રતીકારક્ષમ હો, તેમાં અમૃત વધારે સૂક્ષ્મ, વધારે ભેદક, નવીન ગુણો હો, તેમાં વૈશ્વિકતાની સાહજિક શક્તિ હો, જેની માત્રા એવી સૂક્ષ્મ અને સંસ્કૃત હો કે તે વધારે વિસ્તૃત પ્રમાણમાં જે સમગ્ર પ્રમાણમાં નહિ તો, આકંપતોને દ્વિષિ-ગોચર કરી શક્યો, જૂના પદાર્થ તત્ત્વ સાથેના ભેદને પણ દૂર કરી શક્યો, સામાન્ય માનસિક પદાર્થતત્ત્વ સાથેના ભેદને પણ દૂર કરી શક્યો. તે પદાર્થ તત્ત્વ આવતાની સાથે જી, સર્વ ભેદવિયુક્તપણું સ્વયંભૂ રીતે, આપોઆપ અદૃશ્ય થઈ જાય છે. તે પદાર્થ તત્ત્વ અત્યારે પૃથ્વીના વાયુ મંડલમાં, લગભગ વૈશ્વિક રીતે, પ્રસ્તેલું છે. જરાક એકાગ્રતા કરવામાં આવે, ચેતનામાં ડૂબકી મારવામાં આવે, જે તે પદાર્થ તત્ત્વને સામાન્ય બાધીકરણમાંથી જે વધારે કૃત્રિમ અને અસત્ય લાગે છે પાછું જેંચી લેવામાં આવે, તો જાગ્રત અવસ્થામાં પણ તે પદાર્થ તત્ત્વને જોઈ શકાય તેમ છે. પહેલાં જે સ્વાભાવિક લાગતું હતું તે આ બાધીકરણ હવે અસત્ય, અવાસ્તવિક, અને નદન કૃત્રિમ લાગે છે. તે વસ્તુઓ જેવી છે તેમને પ્રત્યુત્તર આપી શકતું નથી. તે વાસ્તવિક રીતે કોઈ સાચી ગતિ સાથે સુસંગત નથી.

આ નવીન દર્શન વધારે ને વધારે પ્રભળ બનતું જાય છે, વધારે ને વધારે સ્વાભાવિક બનતું જાય છે. કેટલીક વાર તો અસ્તિત્વના જૂના પ્રકારને પકડવું એ કઠિન બની જતું હોય છે. જાણે કે તે કોઈ ધુંધળા ભૂતકાળમાં અદૃશ્ય ન થઈ જતું હોય, જાણે મરી પરવારતું ન હોય.

એક વાર જુની પશુપદ્ધતિથી પેદા થયેલું શરીર સ્વાભાવિક રીતે, સ્વયંબૂરીતે, કોઈ પ્રયાસ કર્યા સિવાય, પોતાની બહાર ગયા સિવાય, આ ચેતનામાં જીવી શક્તિશક્તિની બને, તો એમ સિદ્ધ થાય કે આ એક અપવાદૃપ કેરિસ નથી, પણ એક સિદ્ધિનો અગ્રહૂત છે, જે સિદ્ધ સામાન્ય ન બની ગઈ હોય તો પણ અમુક સંખ્યાના લોકો તેમાં ભાગીદાર બની શકે છે. પછી તે લોકો પેદાને બિનન વ્યક્તિઓ નહિ જુઓ, પણ એક જીવંત સમૂહ બની જશે.

આ નવીન સિદ્ધ વીજળી વેગે આગળ વધી રહી છે, કારણ કે જો આપણે સમયની ગણના સામાન્ય રીતે કરીએ, તો અતિમાનસ પદ્ધાર્યતત્ત્વે પૃથ્વીના વાયુમંડળને લેદીને માત્ર બે જ વર્ષ થયાં છે, અને પૃથ્વીના વાયુમંડળની ગુણ-વત્તામાં પરિવર્તન આવી ગયું છે.

જો વસ્તુઓ આ ઝડપથી પ્રગતિ કરે તો સ્પષ્ટ જણાય છે કે શ્રીઅરવિંદે જે પયગંબરી વાળીમાં, એક પત્રમાં, આગાહી<sup>૧</sup> કરી હતી કે “૧૯૬૭માં અનિ-માનવિક ચેતના સિદ્ધ પ્રાપ્ત શક્તિના એક તત્ત્વજ્ઞામાં પ્રવેશ કરશે,” તે સિદ્ધ થાય.

\*

## ૩૫ એપ્રિલ ૧૯૭૮

વહાલાં માતાજી, જ્યારે અમે વધારે સારું કામ કરવા માટે પ્રયાસ કરીએ છીએ, પણ તેમાં કંઈ પ્રગતિ નથી થતી, ત્યારે અમે નિરાશ કે, નાહિમત બની જઈએ છીએ. ત્યારે અમારે માટે કંધી વસ્તુ કરવી એ કોણ છે?

નિરાશ ન બનયું. નિરાશા કયાંય બઈ જતી હોતી નથી.

પ્રથમ તો તમારે તમારી જાતને એમ કહેલું જોઈએ કે હું પ્રગતિ કરું છું કે નહિ તે જાણવા માટે હું તદ્દન અશક્તિમાન છું; કારણ કે ધારી વખત, જ્યારે વાંબા સમય સુધી તુકાવટની સ્થિતિ આવે છે, પ્રગતિ થતી દેખાતી હોતી નથી, ત્યારે યાદ રાખો કે તે સમય વાંબા હોય, પણ અનંત નથી, અને તુકાવટની

૧. “૪-૫-૬૭ એ પરિપૂર્ણ સિદ્ધહૂં વર્ષી હરો.” (યોગ પર પત્રો, પૃષ્ઠ ૩૫)

સ્થિતિએ આગળ હૂદકો લેવાની નૈયારી હોય છે. આપણે કેટલીકવાર અઠવાડિયાં સુધી, મહીનાઓ સુધી કાઈ પ્રગતિ કરી શકતા હોતા નથી એમ લાગે છે, પછી ઓકદમ જેની નૈયારી ગર્ભમાં થઈ રહી હતી તે પ્રગટ થાય છે, આપણને માલમ પડે છે કે ધાર્ય પરિવર્તન થઈ ગયું છે, અને તે પણ એકી વખતે ઘણી બાબતોમાં.

યોગમાં દરેક બાબતમાં હોય છે નેમ, પ્રગતિ માટેના પ્રયાસ પ્રત્યે પ્રેમ હોવાને કારણે જ પ્રગતિ માટે પ્રયાસ કરવો જોઈએ. પ્રયાસ કર્યાના આનંદ પ્રગતિ માટેની અભીષ્ટા પોતે જ બસ છે; તેમાં પરિણામોની પરવા કરવાની જરૂર નથી. યોગમાં જે કાઈ કરવામાં આવે તે કરવાના આનંદ માટે કરાવું જોઈએ, પરિણામ કે ફળ માટે નહિ. સાચે જ, જીવનમાં વસ્તુઓમાં પરિણામ આપણા હાથની વાત નથી. જે આપણે સાચું વલાસ અપનાવવું હોય, તો આપણે સ્વયંભૂ રીતે કાર્ય કરવું જોઈએ, લાગણી અનુભવવી જોઈએ, વિચાર કરવો જોઈએ, પ્રયાસ કરવો જોઈએ, કારણ કે તે આપણે કરવાનું હોય છે, પણ ફળની આશા ન રાખવી જોઈએ.

જ્યારે આપણે ફળની ઈચ્છા રાખીએ છીએ, ત્યારે તે સોઢો બની જાય છે, અને તેથી પ્રયાસમાંથી દિલની સરચાઈ ચાલી જતી હોય છે. તમે પ્રગતિ માટે પ્રયત્ન કરો છો, કારણકે તમારામાં તમને પ્રગતિ કરવાનો, પ્રયાસ કરવાની અનિવાર્ય જરૂરિયાત અનુભવાય છે, તે પ્રયાસ તમે તમારામાં અને વિશ્વમાં રહેલી દિવ્ય ચેતનાને લેટ રૂપે અર્પણ કરો છો; તે આલાર પ્રદર્શિત કરવાનો એક પ્રકાર છે. તેનું પરિણામ પ્રગતિમાં આવે છે કે નહિ તે મહત્વનું નથી. નિયત સમયે તમે પ્રગતિ કરશો, તમે ઈચ્છા છો માટે નહિ.

જો તમે પ્રગતિ કરવા માગતા હો, તમારી જાત પર કાબુ મેળવવા પ્રયત્ન કરતા હો, અમૃત ન્યૂનતાઓને, નબળાઈઓને, અપૂર્ણતાઓને ફૂર કરવા માગતા હો, અને જો તમે તમારા પ્રયાસનું તત્કાળ ફળ મેળવવાની ઈચ્છા કરો, તો તમારા પ્રયાસમાંથી દિલની સરચાઈ ચાલી જાય છે, તે એક સોઢો બની જાય છે. તમે એમ કહેતા હો છો કે, જુઓ, હું પ્રયત્ન કરું છું, પણ તેના બદલામાં મને આ મળવું જોઈએ. ત્યારે તમે સ્વાભાવિક, સ્વયંભૂ નથી રહેતા.

એટલે એ વસ્તુઓ યાદ રાખવાની છે. એક, પરિણામ શું હોવું જોઈએ તેનો નિર્ણય કરવા આપણે અસર્મર્થ છીએ. જો આપણે ભગવાનમાં વિશ્વાસ રાખીએ અને કહીએ કે, “હવે હું બધું જ સમર્પિત કરવા માગું છું. સર્વ કાઈ, પ્રયાસ,

એકાગ્રતા, મને પરિણામરૂપે બદલામાં કાઈ આપવું કે નહિ તેનો નિર્ણય ભગવાન કરશે. પરિણામ બાબત હું કાઈ જ જાણતો નથી.” આપણે આપણામાં કાઈક રૂપાંતર કરીએ ત્યારે પહેલાં, તે રૂપાંતર ક્યો દિશા લેશે, ક્યો માર્ગ લેશે, ક્યું રૂપ ધારણ કરશે, તેની આપણને ખાતરી હોય છે જરી? જરા પણ નહિ. તે માત્ર આપણી કલ્પના હોય છે, અને તેથી આપને મળવાના પરિણામને આપણે મર્યાદિત કરી લેતા હોઈએ છીએ, તેને તદ્દન કુદ્ર, અધમ, કૃત્રિમ અને સ્બંધિત બનાવી મૂકીએ છીએ. પરિણામ સાચી રીતે કેવું હોઈ શકે તે આપણે જાણતા હોતા નથી. તે તો આપણે પાછળથી જાણીએ છીએ. જ્યારે તે આવે છે, જ્યારે પરિવર્તન આવે છે, યારે પાછળ દૂઢિત નાંખીને આપણે કહીએ છીએ કે, ઓહ, હું તેના પ્રત્યે જ ગતિ કરી રહ્યો હતો; પણ તે આપણે પાછળથી જાણીએ છીએ. તે પહેલાં આપણે માત્ર અસ્પષ્ટ, તદ્દન કૃત્રિમ, અને સાચી પ્રગતિની સરખામણીમાં, સાચા રૂપાંતરની ભરખામણીમાં બાલિશ કલ્પનાઓ કરતા હોઈએ છીએ.

એટલે પહેલો મુદ્રા : આપણે અભીપ્સા કરીએ છીએ, પણ તેનું સાચું પરિણામ આપણને શું મળવું જોઈએ તે આપણે જાણતા હોતા નથી. માત્ર ભગવાન જ તે જાણી શકે.

બીજો મુદ્રા : જે આપણે ભગવાનને કહીએ કે, “હું તમને મારો પ્રયાસ સમર્પું છું, પણ તમે જણો છો કે તેના બદલામાં મારી પ્રગતિ થતી જોઈએ; નહિ તો હું તમને કાઈ જ સમર્પિત નહિ કરું!” આ તો સોધો થયો.

( મૌન )

તે કર્યા સિવાય રહી શકાય તેમ નથી તેણું, સહભાવનાયુક્ત સમર્પણ ભાવે કરાયેલું, સ્વયંભૂ કાર્ય તે જ માત્ર એવું કાર્ય છે, કે લેનું કાઈક સાચું મૂલ્ય છે.

\*

### ૩૦ એપ્રિલ ૧૯૫૮

મેં અંગળથી જાણી લીધું હતું તેમ, ૩૪ ફેબ્રુઆરીની ૨ મારી અતિમાન-તિક અનુભૂતિને સમજવવા મને ફરજ પડે તેવા પ્રશ્નોનું જાપણું મારા પર વરસ્યું છે.

૧. જુન ૧૯ ફેબ્રુઆરી ૧૯૫૮ નો વાર્તાદાય.

તમે મને બોલાવવા માગો છો, તે અનુભૂતિ એક નવીન પદ્ધતિમાં સ્થાપિત થાય ત્યાં સુધી મારી પાસે તેનું માનસિકરણ કરવવા માગો છો, અને તેથી તમે સંગવડપૂર્વક તમારી નવીન માનસિક રચનામાં આરામથી બેસી શકો. તમને નિરાશ કરવા બદલ હું દિવગીર છું, પણ તમે માગો છો નેમ કરવું આશક્ય છે. જો મેં જે લખ્યું છે તે તમારે સમજવું હોય, તો અતિમાનસ ચેતના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો.

મારે તમને એટલું જ કહેવાનું છે.

જુના સિદ્ધાંતને સ્થાને નવો કદૂર સિદ્ધાંત મૂકવાનું પાગવપાણું ન કરતા, એમ ન કહેતા કે, “ઓહ, તે બધું અસત્ય હતું. પણ હવે અમે એક સુંદર વ્યવહારું માર્ગદર્શન હેઠળ કર્યું કરવા માગીએ છીએ, જે સાચું હશે.”

માનસિક રચના કોઈ દિવસ સાચી ન હોઈ શકે, હું માનસિક રચનાનું નિર્માણ કરવાની ના પાડું છું, માણસો સમજે તેવા શબ્દો વાપરવાની મને ફરજ પડી હતી, પણ મેં યથાશક્ય ખૂબ અસંગત રીતે કર્યું હતું! જેથી હું વધારે પડતી માનસિક ન બની જાઉં; હું માનસિક રીતે સુસંગત થવાનો ઈન્કાર કરું છું. અને તે પણ આ પ્રશ્નો જેમને હું લઈ આવી છું અથવા જે પ્રશ્નો મને પત્રોમાં પૂછવામાં આવ્યા છે તેમની બાબતમાં જ નહિં; પણ આ જ વિષ્ય ઉપર ભવિષ્યમાં જે પ્રશ્નો આવવાના છે તેમની બાબતમાં પણ. એટલે મને કોઈ પ્રશ્નો પૂછવા તે નિર્દ્દેશ હશે.

હું દરેક જણને એક જ સલાહ આપવા માગું છું: પ્રયત્ન કરો, કર્યું કરો, તમારી જતને ખુલ્લી કરો, તમારી સમગ્ર જતને સંપૂર્ણપણે તે નવીન શક્તિને સોંપી દો; અને એક દિવસ આવશે, જ્યારે તેમને તે અનુભૂતિ પ્રાપ્ત થશે.

તે અનુભૂતિ આવતાં તમને સમજશે કે, તમે જે પ્રશ્નો પૂછ્યા હતા, તે કેટલા બધા નિર્દ્દેશ હના.

“ ઉત્કાન્તિમય પ્રકૃતિની પહેલાંની અવસ્થાઓમાં આપણે પ્રકૃતિની અચેતન-તાની મૂંગી નિગૂઢના જોઈએ છીએ. તેનાં ક્રાર્યમાં કોઈ અર્થવત્તા કે હેતુ પ્રગટ થતાં હોતાં નથી, તેના તરતના વ્યાપાર રૂપ, પ્રથમના નિર્માણ કરતાં અસ્તિત્વના કોઈ બીજા તત્ત્વનું સૂચન મળતું હોય નથી, કારણકે પોતાના પ્રાથમિક કાર્યોમાં માત્ર પદાર્થતત્ત્વ જ એક માત્ર મૂંગી અને સ્થિર વૈશ્વિક વાસ્તવિકતા જ દેખાતી હોય છે. જે સૃષ્ટિનો કોઈ સચેતન સાક્ષી હોય, તો તેણે દેખીના અનસ્તિત્વની ઊડી ખીંખમાંથી પ્રગટઠી શકિત જોઈ હોત, જે શકિત પદાર્થતત્વના સર્જનમાં ગુંધાયેલી હોય છે, ભૌતિક જગતના અને ભૌતિક પદાર્થોના સર્જનમાં ગુંધાયેલી હોય છે; તે શકિત અચેતન અનંતતાનું સંગ્રહ અમર્યાદ વિશ્વની પોજનામાં અથવા અસંખ્ય વિશ્વોની પદ્ધતિમાં કરતી હોય છે; તે વિશ્વો કોઈ પણ નિશ્ચિત અંત અથવા મર્યાદા સિવાય, અવકાશમાં તેની આસપાસ વિસ્તરેલા હોય છે; તે સૃષ્ટિ પહેલાંની અવ્યવસ્થાના તારાઓના તથા નક્ષત્રોના સમૂહના, સૂર્યોના અને ગ્રહોના સર્જનમાં થાક્યા વગર વ્યાપ્ત રહે છે, પોતાની ખાતર જ અસ્તિત્વ ધરાવતી હોય છે. તેને કોઈ કારણ કે હેતુ હોતાં નથી. તે સાક્ષીને આ એક મહાન મશીનરી બિનઉપયોગી લાગી હોત; મહાન નિર્યક જનિ લાગી હોત; સાક્ષી વગરનું, મુખોથી ચાલ્યું આવતું દૃશ્ય લાગ્યું હોત; કોઈ નિવાસી વગરની વૈશ્વિક ઈમારત લાગી હોત; કારણકે તેને અંદર રહેતા આત્માનું ચિહ્નું નજરે ન પડ્યું હોત, એવું સનું નજરે પડ્યું હોત, જેના આનંદને માટે આ સર્જન થયું હોય. આ પ્રકારની સૃષ્ટિ માત્ર અચેતન શકિતમાંથી જ અથવા ભ્રાન્તિરૂપ સિનેમામાંથી જ પ્રગટી શકે; તે છાયા કીડા અથવા કણપુત્રી કીડા હોઈ શકે, જેમાં ઇયાનું પ્રનિભિબ અતિચેતન ઉદાસીન, કેવળ તત્ત્વ પર પડતું હોય છે. તેને આત્માની કોઈ સાબિતી નજરે ન પડે, આ પદાર્થતત્વના અમેય અને અનંત દૃશ્યમાં મન કે પ્રાણનું સૂચન પ્રાપ્ત ન થાય. આ સૂક્ષ્મ ભટ્ટ રણ જેવા વિશ્વમાં સદા અચેતન અને અમાન વિશ્વમાં વિપુલ પ્રાણ પ્રગટે, કોઈ ગુંધાદી અને ગણતરી ન કરી શકાય તેવું, અંત, અને સચેતન ‘કાંઈક’ નું પ્રથમ આકાંપન પ્રગટે, એક નિગૂઢ આધ્યાત્મિક તત્ત્વ સપાટી પર આવવા માટે મથતું દેખાય ને તેને શક્ય અથવા કલાનીય ન લાગ્યું હોત.

મધુર માતાજી, મને આ વાક્ય ન સમજ્યું કે “ઉત્કાન્તમય પ્રકૃતિની પહેલાંની અવસ્થાઓમાં આપણે પ્રકૃતિની અચેતનતાની મૂંગી નિગૂઢતા જોઈએ છીએ.” મધુર માતાજી, આ નિગૂઢતા શું છે?

પ્રકૃતિનો ઈરાદો? શરૂઆતથી જ શ્રી અર્થવિદે તે કષ્યો છે કે પદાર્થતત્ત્વના હાર્દિક્માં, ઊંડાણોમાં નિગૂઢ, પરમાત્માની હાજરી પહેલેથી જ રહેલી છે; સર્વ પાર્થિવ ઉત્કાન્ત, સૃષ્ટિ પોતાના મૂળ ઉદ્ગમસ્થાનમાં, પરમાત્મામાં પાંચી જાય તેટલા માટે, થતી હોય છે, જે પરમાત્મા દરેક વસ્તુના કેન્દ્રમાં રહેલા છે. પ્રકૃતિનો આ ઈરાદો છે.

વિશ્વ એ પરમાત્માનું દૃશ્યીકરણ છે; તે પોતાની જાતને દૃશ્ય બનાવતા હોય છે, જેથી તે પોતાની જાતને જોઈ શકે, જીવી શકે, જાણી શકે, જેથી એવું અસ્તિત્વ એવી ચેતના શક્ય બને જે પોતાના ઉદ્ગમસ્થાનને જાણવા અને સર્જનમાં તેનો સભાનપણે આવિભાવ કરી તેમાં એકરૂપ બની શકે. વિશ્વના સર્જન માટે બીજો કોઈ હેતુ નથી. પૃથ્વી વૈશ્રિક જીવનની એક પ્રતીકમય, હરી ગણેલી સ્થિતિ છે, ઓછાપણું છે, સધનીકરણ છે, જેથી ઉત્કાન્તનું કાર્ય સહેલાઈથી બની શકે, તેનું અનુસરણ વધારે સહેલું બની શકે. જેમ જેમ આપણે પૃથ્વીનો ઈતિહાસ જોઈશું, તેમ તેમ સૃષ્ટિનું સર્જન શા શાટે થયું છે તે આપણે સમજ શકીશું. ભગવાન સનાતન સર્જનમાં પોતાની જાતથી સભાન બનતા હોય છે. તેનો હેતું સૃષ્ટિની ચૂંટા સાથે એકરૂપતા બને તે છે તે એકરૂપતા સભાન, મરજીપૂર્વકની, અને આવિભાવમાં સ્વતંત્ર હોવી જોઈએ.

તે પ્રકૃતિનું રહસ્ય છે. પ્રકૃતિ એ કાર્ય કરનારી શક્તિ છે, તે આ કાર્ય કરી રહી છે.

તે આ સૃષ્ટિને પોતાના હાથમાં લે છે, જે સૃષ્ટિ તર્દન અચેતન દેખાય છે, પણ જેનામાં પરમ ચેતના અને પરમ વાસ્તવિકતા સમાવિષ્ટ છે. તે કાર્ય કરી રહી છે, જેથી આ બધાનો વિકાસ થઈ શકે, આત્મસભાન થઈ શકે, અને પોતાનો પરિપૂર્ણ સાક્ષાત્કાર સાધી શકે. પણ શરૂઆતથી જ તે વાત તે બનાવતી હોતી નથી. તે ધીમે ધીમે વિકાસ પામે છે, અને તેથી શરૂઆતમાં તે એક રહસ્ય હોય છે. જેનો લેદ, જેમ જેમ તે અંતની નજીક જશે તેમ તેમ, ઉકેલશે. માણસ ઉત્કાન્તની એવી ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યો છે, કે તે આ રહસ્ય પરના આવરણને દૂર કરી

શકે, જે વસ્તુ દેખીતી અચેતનતામાં કરવામાં આવી હતી, તેને તે સચેતનતાપૂર્વક કરી શકે, ભરજીપૂર્વક, ખૂબ જડપથી, અને સાક્ષાત્કારના સિદ્ધિના આનંદપૂર્વક કરી શકે.

માણસમાં જોઈ શકાય છે કે તેની આધ્યાત્મિક વાસ્તવિકતાનો વિકાસ થઈ રહ્યો છે, તે વાસ્તવિકતા પોતાની જતને સંપૂર્ણપણે અને મુક્ત રીતે વ્યક્ત કરી રહ્યી છે. પણ માણસમાં નથી વનસ્પતિમાં, તે જોવા માટેનું સ્પષ્ટ દર્શન જરૂરી હતું, પણ માણસ તો આ આધ્યાત્મિક વાસ્તવિકતાથી પોતે જતે જ સલાન છે. કમથી કમ, તેના અસ્તિત્વના ઉચ્ચતર ભાગમાં, તેનું પરમ ઉદ્ગમ સ્થાન તેની પાસે શું કરાવવા માગે છે. તે માનવ જાણતો હોય છે, તે કાર્ય કરવામાં તે સહકાર આપતો હોય છે.

પ્રકૃતિ માગે છે કે સૃષ્ટિ દૃશ્યીકરણમાં સર્જનહાર પોતે છે તે જાણે, પોતાની અને સર્જનહારની વર્ચ્યે ભેદ નથી તે જાણે, સચેતન અને સિદ્ધ થયેલી એકરૂપતા એ લક્ષ્ય છે તે જાણે. આ પ્રકૃતિનું રહસ્ય છે.

માતાજી, અહીં કી અરવિંદ લખે છે કે “આ સચેતનતાનું મુંગુ રહસ્ય ” તેની અચેતનતા શા માટે?

કેની અચેતનતા?

પ્રકૃતિની.

ના. પ્રકૃતિ અચેતન નથી, પણ તે અચેતન દેખાય છે. અચેતનતાથી તેણે શરૂઆત કરી, પણ અચેતનતાનાં ઊંડાણોમાં સચેતનતા હતી. આ ચેતના ધોમે ધીમે વિકસતી જાય છે. ૧ દાન. અનિજ પ્રકૃતિ, પત્થરો, પૃથ્વી, ધાતુઓ, જળ, વાયુ આ બધું અચેતન દેખાય છે. જે જોઈ વધારે જીણવટથી અવલોકન કરે, અને હવે તો વિજ્ઞાને સિદ્ધ કર્યું છે કે તે અચેતન નથી; અચેતનતા તો માત્ર દેખાર જ છે. તે બધું ઘનીભૂત શક્તિ છે. અલભત, સચેતન શક્તિએ આ બધાનું સર્જન કર્યું છે. પણ જ્યારે આપણે ખડકને જોઈએ છીએ, ત્યારે આપણે

૧. જ્યારે આ વાર્તાલાપ પહેલી વાર પ્રસિદ્ધ થયો, ત્યારે માતાજીએ આ નોંધ કરી હતી, “ચેતના વિકાસ નથી કરતી હોતી. ચેતનાનો આવિભાવ, તેની અભિન્યક્તિ વિકાસ કરતી હોય છે. તે વધારે ને વધારે પોતાની જતને અભિન્યક્ત કરતી જય છે.

એમ નથી માનતા કે તે સચેતન છે. સચેતન હોય તેવો તે દેખાતો હોતો નથી, તે તદ્દન જરૂર અચેતન દેખાય છે.

પણ તે દેખાવ જ અચેતન હોય છે. તે વધારે ને વધારે સચેતન બનતો ચાલે છે. ખનિજ જાતિમાં પણ એવું જોવામાં આવે છે કે તેમનામાં નિગૂઢ ચેતના પ્રગટ થતી હોય છે, દા. ત. અમુક કિસ્ટલો. તે કિસ્ટલો કરેલી બધી નિશ્ચિતતાથી અને સંવાદિતાથી રહ્યાતા હોય છે. તેનું જો તમે અવલોકન કરો, જો તમે ખુલ્લા હો, તો તમને ચોક્કસ જણાશે કે તેમની પીઠમાં ચેતના રહેલી છે, એ અચેતન અકૃસ્માતનું પરિણામ ન જ હોઈ શકે.

તમે ખડકના કિસ્ટલો જોયા છે? તમે કોઈ દિવસ તે નથી જોયા?

હા, જોયા છે.

સરસ, તે કિસ્ટલો સુંદર અને કલામય હોય છે.

સમુદ્રની ગતિ, વાયુની ગતિ, હવાની ગતિ આ બધું જોતાં આપણું લાગ્યા વગર રહેતું નથી કે આ બધાની પીઠમાં ચેતના કાર્ય કરી રહી છે. તેનો માત્ર ઉપરછળલો દેખાવ જ અચેતન હોય છે.

( મૌન )

હવે કોઈ પ્રેરણ છે?

સાચે જ, દરેક પ્રાણીમાં ઉત્કાન્તની થમગ્ર પ્રક્રિયા ફરી થતી હોય છે. જેમ કોઈ ખૂબ ઊંચાઈ પરથી, ચક્કર આવે તેવી ઊંચાઈ પરથી માણસ થઈ ગયેલી બધી વસ્તુઓ પર નજર ન નાંખતો હોય, હવે પછીનું પગલું ભરતા પહેલાં, જાણે તેને પહેલાંનું બધું ફરી જવાની જરૂર ન હોય.

( મૌન )

પ્રારંભ, અચેતનતામાં અંધકારમાં મહાન યાત્રા, વિસ્મૃતિ, અચેતનમયતા, જગૃતિ, અને પ્રકાશમાં પાછા આવવું તે.

“ જેમ વનસ્પતિ જીવનમાં સચેતન પણું સ્પષ્ટ છાયા છે ને પશુ મનમાં લાગણીની, દર્શનની ગતિઓ, વિચારક માનવ માટેની પ્રાથમિક ભૂમિકાના પ્રાથમિક જ્યાલો હલચલ કરતાં હોય છે, તેવી રીતે ઉત્કાન્તિતમય શક્તિનો પ્રયાસ માનસિક પ્રાણીઝીપુરુષ માનવને ઉદાહરણ બનાવે છે, જેને પરિણામે તેનામાંથી આધ્યાત્મિક માનવ પ્રગટે, સંપૂર્ણપણે સચેતન પ્રાણી પ્રગટે, માનવ પોતાની પ્રથમ ભૌતિક જાતથી પર જાય, અને પોતાની સાચી જાતને અને ઉચ્ચતમ પ્રકૃતિને શોધી કાઢે.

પણ જે આ વાતને પ્રકૃતિનો ઈરાદો છે એમ સ્વીકારવાનું હોય, તો તે પ્રશ્નો ઉભા થાય છે, જેનો જવાબ નિશ્ચયાત્મક રીતે મળવો જોઈએ. એક તો, માનસિક પ્રાણીમાંથી માનવ આધ્યાત્મિક પ્રાણી બને તે પરિવર્તનનું ચોક્કસ સ્વરૂપ ; અને બીજું માનસિક માનવમાંથી આધ્યાત્મિક માનવની ઉત્કાન્તિતની પ્રક્રિયા અને પદ્ધતિ. પ્રથમ દૃષ્ટિઓ જ એ સ્પષ્ટ લાગે છે કે દરેક કમ તેની પહેલાંના કમમાંથી જ નહિ, પણ તે કમમાં ઉત્કાન્તિત થાય છે. દા.ત. પ્રાણ પદાર્થતત્વમાં પ્રગટ થાય છે, અને પોતાની આત્મ અભિવ્યક્તિમાં મોટે ભાગે તે ભૌતિક પરિસ્થિતિઓ વડે મર્યાદિત અને નિશ્ચિત હોય છે. મન, પ્રાણ અને પદાર્થતત્વમાંથી પ્રગટ થાય છે ; અને તે પોતાની આત્મ અભિવ્યક્તિમાં મોટે ભાગે પ્રાણિક અને ભૌતિક પરિસ્થિતિઓથી અને નિશ્ચિત હોય છે. તે જે રીતે, આત્માએ મન પ્રાણ પદાર્થતત્વમાંથી પ્રગટવું જોઈએ, અને મોટે ભાગે તેણે પોતાના મૂળજીપુરુષ મનની, પ્રાણની, ભૌતિક પરિસ્થિતિઓથી મર્યાદિત બને નિશ્ચિત થવું જોઈએ.”

( દિવ્ય જીવન, પૃષ્ઠ ૮૫૧-૮૨ )

વિશ્વના પ્રગટીકરણમાં હવે પછી અતિમાનસ જીવન સિદ્ધ થવાનું છે. જેમ જેમ તેની શરૂઆત થાય, વધારે સ્પષ્ટ રીતે નહિ, પણ ચોક્કસપણે તેમ તેમ વધારે ને વધારે સ્પષ્ટ બનતું જાય છે કે આ અતિમાનસ જીવનને પ્રાત કરવામાં સૌથી વધારે કઠિન માર્ગ ભૌજિક કિયાનો છે.

જીવનમાં અમુક ચૈતસિક લાગણીમાંથી, જે પદાર્થતત્વમાં ભગવાનના પ્રતિબિંబ જેવું, તેજેમય પ્રાગટ્ય જેવું હોય છે, અતિમાનસ ચૈતનામાં જવું તેના કરતાં માનસિક જીવનમાંથી અતિમાનસ જીવનમાં જવું તે વધારે કઠિન છે. ઉચ્ચતમ

બૌધ્ધિક વિચારમાંથી અતિમાનસ આકંપન પ્રત્યે જવું તેના કરતાં શૈલમાંથી અતિમાનસ ચેતનામાં જવું તે વધારે સહેલું છે. કદાચ 'અતિમાનસ' શબ્દ આપણને ચેરમાર્ગે દોરી જય છે. તેમાં 'માનસ' શબ્દ હોવાને કારણે આપણે એમ માની લઈએ છીએ કે ઉચ્ચતર બૌધ્ધિક માનસિક કિયાથી અતિમનસમાં સહેલાઈથી જઈ શકતું હશે. પણ હકીકત તદ્દન જુદ્ધી જ છે. આ ખૂબ ઉચ્ચ, વિશુદ્ધ ઉદાત્ત બૌધ્ધિક કિયા વડે માણસ એક ઠંડાગાર શક્તિહીન ભાવવાચક તત્ત્વ પ્રત્યે, બરફ જેવા ઠંડાગાર, હરી ગયેલા પ્રકાશ પ્રત્યે ગતિ કરતો હેખાય છે; પણ તે પ્રકાશ ચોક્કસ જીવનથી દૂર હોય છે, પણ અતિમાનસ વાસ્તવિકતાથી તે તેના કરતાં પણ વધારે દૂર હોય છે.

જગતમાં પ્રસરતા અને કાર્ય કરતા આ પદાર્થતત્ત્વમાં એવી તો ઉત્કટ ઉભા છે, શક્તિ છે, આનંદ છે કે તેની આગળ સર્વ બૌધ્ધિક કિયા ઠંડીગાર અને શુષ્ક લાગે છે. તેથી આ વસ્તુઓની માણસ જેમ ઓછી વાત કરે તેમ વધારે સારું. સર્વ શક્ય સમજૂતિઓ કરતાં એક ક્ષણ ઊંડા અને સાચા પ્રેમના એક જ આવેગ, ભગવાનની કૃપામાં રહેલી સમાજની એક જ ક્ષણ તમને લક્ષ્ય તરફ વધારે નજીક લઈ જાય છે.

ખૂબ ખૂબ સૂક્ષ્મ સમજૂતિ કરતાં એક સંસ્કૃત, સૂક્ષ્મ, સ્પષ્ટ, તેજોમણ, તીવ્ર, ઊંડા, ખૂબ ઊંડી લાગણી તમારે માટે વધારે પ્રમાણમાં દ્વાર ખોલી નાંખતી હોય છે.

જો આપણે આ અનુભૂતિને વધારે આગળ લઈ જઈએ, તો એમ લાગે છે કે જ્યારે માણસ શરીરના રૂપાંતરનું કામ હાથમાં લે છે, જ્યારે શરીરનાં વધારે તૈયાર થયેલાં, વધારે સુસંસ્કૃત, વધારે સૂક્ષ્મ, વધારે મુલાયમ, કોશાણુઓ ભગવાનની કૃપાને, સંકલ્પને, શક્તિને, જ્ઞાનને, સધનતાપૂર્વક અનુભવવા સમર્થ બનતાં હોય છે, ત્યારે તે જ્ઞાન બૌધ્ધિક નથી હોતું, પણ તાદ્દત્યવાળું જ્ઞાન હોય છે. જ્યારે માણસ પોતાના શરીરના કોશાણુઓમાં તે જ્ઞાન અનુભવે છે, ત્યારે તે અનુભૂતિ એવી તો સમગ્ર, અનિવાર્ય, જીવંત, સધન, સ્પર્શગમ્ય, અને વાસ્તવિક હોય છે કે બીજું બધું એક નિર્દ્યક સ્વર્પન સમાન ભાસે છે.

એટલે આપણે કહી શકીએ કે જ્યારે વર્તું પરિપૂર્ણ બને છે. એ છેડાઓ મળે છે, જ્યારે ઉચ્ચતમ તત્ત્વ ખૂબ બૌતિકમાં પ્રગટ થાય છે, ત્યારે અનુભૂતિ પરિપૂર્ણ રીતે નિશ્ચયાત્મક બનશે.



એમ લાગે છે કે જ્યાં સુધી માણસ પોતાના શરીર વડે સમજતો હોતો નથી, ત્યાં સુધી તે કદી સાચી રીતે સમજ શકતો હોતો નથી.

\*

## ૨૧ મે ૧૯૫૮

વહાલાં માતાજી, માનસિક પ્રામાણિકતાનો ચોક્કસ અર્થ શો છે?

તે પોતાની જતને છેતરવા પ્રયત્ન ન કરતું મન છે. તે પ્રયત્ન નથી હોતો, કારણકે તે પોતાનું કાર્ય કરવામાં સારી સફળતા પ્રાપ્ત કરે જ છે!

એમ લાગે છે કે માણસના સામાન્ય માનસશાખીય બંધારણમાં મનનું બગભગ સતત કાર્ય આ હોય છે કે પ્રાણમાં (કામનામય સત્ત્વમાં) મનના ખૂબ ભૌતિક ભાગોમાં, શરીરના ખૂબ સૂક્ષ્મતમ ભાગોમાં જે કાઈ બની રહ્યું હોય છે તેની સ્વીકારી શક્કાય તેવી સમજૂતિ આપવી. આપણે જે કાઈ કરતા હોઈએ છીએ તેની સમજૂતિ આપવી, અગપદભરેલું કારણ આપવું, તેમાં અસ્તિત્વના બધા જ ભાગો એક બનાને ભાગીદાર બનતા હોય છે, જેથી આપણે જે ભૂલો કરીએ અને અનિષ્ટ ગતિઓ કરીએ તેના પીડાજનક સંસ્કારોથી યથાશક્ય દૂર રહી શકાય. દા. ત. જે માણસે ખાસ તાલીમ ન લીધી હોય તો તે જે કાઈ કરતો હોય છે તેને માટે મન પોતાને અનુકૂળ સમજૂતિ આપતું હોય છે, જેથી તેને કોઈ આંતર કચ્ચવાટ, પીડા ન થાય. જ્યારે બહારનાં પ્રતિકાર્યો, સંઝેગો, અથવા બીજા લોકોની ગતિઓ દૃબાદું કરતાં હોય છે, ત્યારે જ માણસ પોતે તે જેવો છે અને પોતે જે કરે છે તેનાં પર ઓછી અનુકૂળ દૃષ્ટિ સ્વીકારવા સંમત થતો હોય છે, અને પોતાની જતને પૂછતો હોય છે કે આના કરતાં વસ્તુઓ વધારે સારી રીતે ન કરી શકાય?

સ્વયંભૂ રીતે જ, પ્રથમ ગતિ તો આમ બચાવતી હોય છે. નાનામાં નાની, બહુ કુદ્ર વસ્તુઓની બાબતમાં પણ, માણસ તદ્દન સ્વયંભૂ રીતે કોઈ સમર્થક કારણ :માગતો હોય છે, પોતાનો બચાવ કરવા માગતો હોય છે, જીવનમાં આ એક સામાન્ય વલાય છે.

સમજૂતિઓ તો માણય પોતાની જતને જ આપતો હોય છે. સંજોગનું દાખાણ થાય, ત્યારે જ તે બીજોને સમજૂતિઓ આપવા માંડતો હોય છે. પણ પ્રથમ તો તે પોતાની જતને જ આરામ આપવા માગતો હોય છે. તે કહેતો હોય છે કે તે વસ્તુ આમ જ બનવાની હતી; આ કારણથી તે આમ બની. તે હેમેથાં સંજોગનો કે બીજી લોકોનો દોષ કાઢતો હોય છે. જો તે માણસે અભ્યાસ ન કર્યો હોય, સ્વયંભૂ રીતે કાર્ય કરવાની ટેવ ન પાડી હોય, તો તેને સમજવા માટે પ્રયાસ કરવો પડે છે કે કદાચ વસ્તુઓ એ પ્રકારની નથી, કદાચ મેં કર્યું તેમ મારે કર્યું જોઈતું ન હતું; મારે જે પ્રતિકાર્ય કર્યું જોઈતું હતું તે મેં નથી કર્યું. તે આ વસ્તુ જોઈ શકે, પણ તેનો અધિકાધિક રીતે સ્વીકાર કરવો, તે માટે તેથી પણ વધારે પ્રયત્નની જરૂર છે.

જ્યારે માણસ ભૂલ કરે છે, ત્યારે તેની પ્રથમ ગતિ હોય છે તે ભૂલને પાછળ નાંખી સંતાડી દેવાની, તેના ઉપર ઢાંકપિછોડો કરવાની, તે ઢાંકપિછોડો બહુ જ સુંદર નાનકડી સમજૂતિનો હોય છે. જ્યાં સુધી તેને ઉધાડો પાડવાની તેને ફરજ ન પડે, ત્યાં સુધી તે તેને સંતાડતો રહેલો હોય છે, આ માનસિક પ્રામાણિકતાનો અભાવ છે.

પ્રથમ તો માણસ, ટેવને કારણે, પોતાની જતને છેતરતો હોય છે. તે પોતાની જતને ન છેતરવાનો પ્રયત્ન કરતો હોય છે, ત્યારે પણ, સાહિજ રીતે જ, પોતે જેચેને ન બને તેટલા માટે તે પોતાની જતને છેતરવાનો પ્રયત્ન કરતો હોય છે. એક વાર તેને સમજ પડે કે હું મારી જતને છેતરી રવ્યો છું, કે તરત જ તેણે ખુલ્લા દિલથી કબૂલ કરી વેનું જોઈએ કે હા, હું મારી જતને છેતરી રવ્યો હતો.

આ બધી વસ્તુઓ એવી આપોઆપ બનતી હોય છે, તેમની એવી તો ટેવ પડી ગઈ હોય છે કે તમને તેનો જ્યાલ જ આપતો હોતો નથી. પણ જ્યારે તમે તમારી જત પર કોઈક શિસ્ત સ્થાપવા માગો છો, ત્યારે તમને ખૂબ રસપ્રદ, નવીન શૈધી પ્રામ થતી હોય છે. જ્યારે તમને તે જડે છે, ત્યારે તમને જ્યાલ આવે છે કે હું સતત આત્મપ્રતારણામાં જ જીવતો હતો, ઈચ્છાપૂર્વકની પ્રતારણામાં જીવતો હતો. અર્થાત તમે તમારી જતને સ્વયંભૂ રીતે છેતરતા હો છો. તેને માટે તમે વિચાર કરતા હોના નથી. સ્વયંભૂ રીતે જ તમે તમારા કાર્ય પર ઢાંક પિછોડો કરતા હો છો, કેથી તે તેના ભરા રૂપમાં બહાર પ્રગટ ન થાય. અને

આ બધું તમે તદ્દન નાનકડી, બિનમહાત્વની વસ્તુઓ માટે કરતા હો છો ! જે તે ભૂલ તમારા અસ્તિત્વ માટે જ જોગમ રૂપ હોય તો આત્મરક્ષણની સાહજિક વૃત્તિ તમારી પાસે તે ઢાંકપિણીાનું કાર્ય કરવે એ સમજી શકાય તેવી વસ્તુ છે. પણ તે તો તમે તદ્દન બિનમહાત્વની, કુદ્ર વસ્તુઓ માટે કરતા હો છો. તેમ કરવાનું કારણ માત્ર એટલું જ હોય છે કે તમે તમારી જતને કહી શકો કે મેં ભૂલ કરી નથી !

આનો અર્થ એ થયો કે માનસિક રીતે દિવની સરચાઈ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નની જરૂર છે. પ્રયત્ન કરવો જોઈએ, શિસ્તન સ્થાપવી જોઈએ. અખબત્ત, હું તેવા બોકોની વાત નથી કરતી કે જેઓ, પોતે ન પકડાઈ જાય તેટલા માટે, જુદું બોલતા હોય છે, કારણ કે તેમ ન કરવું જોઈએ તે તો બધા જ જાણતા હોય છે. વળી ખૂબ ખૂબ મૂર્ખાઈ ભરેલાં જુઠાંણા ખૂબ નિરર્થક હોય છે, કારણકે તે એટલાં બધાં દેખી શકાય તેવાં હોય છે કે કોઈ તેમનાથી છેતરાય નહિં, તેવા દાખલા સતત જનતા હોય છે. ખરાબ કામ કરતા કોઈ માસુસને તમે પકડી પાડો છો અને તેને કહો છો કે તું ખરાબ કામ કરી રહ્યો છે તો તે એવી મૂર્ખાઈભરેલી સમજૂતિ આપશે, કે જેનો સ્વીકાર કોઈ પણ માસુસ ન કરે. તે મૂર્ખાઈ ભરેલી હોય છે, પણ આત્મરક્ષણ માટે તે આપતો હોય છે. તે સ્વર્યાંભૂ હોય છે, પોતે તે કરી રહ્યો છે તેવો તેને જ્યાલ પણ હોતો નથી. પણ બીજા પ્રકારની પ્રતારણા તેના કરતાં પણ વધારે સ્વર્યાંભૂ હોય છે; તેને તેની એવી તો ટેવ પડી જઈ હોય છે કે તેનું તેને ભાન જ નથી હોતું. એટલે જ્યારે આપણે માનસિક પ્રામાણિકતાની વાત કરીએ છીએ કે જે ખૂબ સતત અને ટકાવી રાખેલા પ્રવાસ દ્વારા જ સિદ્ધ થઈ શકે તેમ છે.

તમે ભર્સિતખમાં અથવા રૂદ્ધમાં ( માતાજી રૂદ્ધ પર આંગળી મૂકે છે ) કોઈક જોટો વિચાર કરતાં કે લાગણી અનુભવતાં, તમારી જતને પકડી પાડો છો, તે બહુ ગંભીર બાબત છે. તમે તેને માટે કોઈ નાનકડી, અનુકૂળ સમજૂતિ આપો છો. પછી જ્યારે તમે તમારી જતને પકડમાં લાવો છો, તેને મજબૂત રીતે પકડી રાખો છો, તમારી જત સામે સ્પષ્ટતાપૂર્વક નજર કરો છો અને પૂछો છો કે તને આ સમજૂતિ ખરી લાગે છે ? ન્યારે જે તમે ખૂબ હિમતવાળા હશો, તમારી જત પર ખૂબ દબાણ મૂકશો, તો અંતે તમારી જતને કહેશો કે ના, હું જાણું છું કે તે સમજૂતિ સાચી નથી.

કટલીક વાર આ પ્રયત્નમાં વર્ષો વીતો જાય છે. સમય તો પસાર થતો જ રહે છે. માણસે પોતાની જતમાં ખૂબ પરિવર્તન લાવવું જોઈએ, વસ્તુઓનું દર્શન ખૂબ બિનન પ્રકારનું બની ગયેલું હોવું જોઈએ, પોતે જુદી રિથનિમાં હોવું જોઈએ, સંજોગો સાથે બિનન પ્રકારના સંબંધમાં આવવું જોઈએ, જેથી તમે સંપૂર્ણ પણ, સ્પષ્ટતાપૂર્વક જોઈ શકો કે તમે તમારી જતને કેટલી બધી છેનરતા હતા. તે ક્ષણે તમને ખાતરી થાય છે કે હવે હું સાચા દિલનો બન્યો.

(મૌન)

સંભવ છે કે જ્યારે માણસ આ પૃથ્વી પરના જીવનરૂપી અસત્યના ગોળાઈ-માંથી ઉદ્ધર્માં જાય, માનસિક જીવનથી અને ઉચ્ચતર માનસિક જીવનથી પણ ઉદ્ધર્માં જાય, ત્યારે જ પરિપૂર્ણ સુચ્યાઈ પ્રાપ્ત થઈ શકે.

જ્યારે માણસ સત્યના જગતમાં, ઉચ્ચતર ગોળાઈમાં જાય છે, ત્યારે જ તે વસ્તુઓને તેમના સાચા સ્વરૂપમાં જોઈ શકે છે. વસ્તુઓને સાચા સ્વરૂપમાં જોવા પછી, તે તે વસ્તુઓના સત્યમાં જીવન પારણ કરી શકે છે. ત્યારે સ્વાભાવિક રીતે જ, બધાં અસત્યો કરદ્યા ભૂસ દઈને ભાંગી પડે છે. પછી અનુકૂળ સમજૂનિઓનો જરૂર રહેલી નથી; એટલે તે અદૃશ્ય થઈ જાય છે, કારણકે પછી કોઈ સમજપવા માટેની વસ્તુ જ રહેતી નથી.

વસ્તુઓ ત્યારે પોતે જ સ્પષ્ટ બની જતી હોય છે. બધાં સ્વરૂપોમાં સત્ય પ્રકાશી ઉઠશે: ભૂલની શક્યતા અદૃશ્ય થઈ જશે.

\*

## ૨૮ મે ૧૯૫૮

“એ તદ્દન સાચી વાત છે કે, ઉપરછલ્લી દૃષ્ટિએ, જીવન માત્ર પદાર્થ-તત્ત્વની કિયા લાગે છે, મન જીવનની, પ્રાણની કિયા લાગે છે, અને આપણે જેને આત્મા કહીએ છીએ તે માનસિકતાની માત્ર એક શક્તિ લાગે છે, આત્મા મનનું એક સુંદર રૂપ લાગે છે, આધ્યાત્મિકતા દેહધારી માનસિક સત્ત્વની એક ઉચ્ચ કિયા લાગે છે. પણ આ દેખાવ અને કિયા પર કરેલી વિચારની એકાગ્રતાને

બઈને થતો, વસ્તુઓનો ઉપરછળલો જ્યાબ છે, તે પ્રક્રિયાની પીડમાં રહેલા તત્ત્વને ન જોવાથી ચેદા થતો જ્યાબ છે. તે જ રીતે આગળ વધતાં માણસ એવી તારથણી પણ કરી શકે કે, વીજળી એ જગની અને વાદળના પદાર્થતત્ત્વની કિયા અથવા પરિણામ છે, કારણકે તેવા ક્ષેત્રમાં વીજળી ઉત્પન્ન થતી હોય છે. પણ ઊરી તપાસને અંતે જણાયું છે કે, જગના તથા વાદળના પાયામાં વીજળીની શક્તિન રહેલી છે; વીજળી તેમની ઘટક-શક્તિ છે અથવા શક્તિનું પદાર્થતત્ત્વ છે. જે પરિણામ દેખાય છે, તે ઝુપમાં નહિ, પણ વાસ્તવિકતામાં ઉદ્ગમસ્થાન છે. દેખીતા કારણની પહેલા રહેલા સારતત્ત્વમાં અસર પ્રગટ થતી હોય છે, કિયાના વર્તમાન ક્ષેત્રની પહેલાં થયેલી કિયાનું તત્ત્વ છે. એટલે સર્વત્ર ઉત્કાન્તિમય પ્રકૃતિ જ છે. જે પ્રાણનું તત્ત્વ પદાર્થતત્ત્વના ઘટકુણે પહેલાં ન હોત, તો પદાર્થતત્ત્વ જીવન ન બન્યું હોત, જે પદાર્થતત્ત્વમાં પ્રાણુણે પ્રગટ થાય છે. જે મનનું તત્ત્વ પ્રાણ અને પદાર્થતત્ત્વની પીડમાં ન હોત, પદાર્થતત્ત્વમાં રહેલો પ્રાણ લાગણી ન અનુભતિ શક્યો હોત, જેએ ન શક્યો હોત, વિચાર કે તર્ક ન કરી શક્યો હોત; પ્રાણ અને શરીર મનના કાર્યાનું ક્ષેત્ર છે; તે જ શરીરમાં અને વિચાર કરતા પ્રાણમાં પ્રગટ થાય છે. તે જ રીતે, મનમાં પ્રગટ થતી આધ્યાત્મિકના એવી શક્તિનું ચિહ્ન છે, જેણે પ્રાણ, મન, શરીરના પાયાનું ઘટન કર્યું છે અને હવે જે જીવન અને વિચાર કરતા શરીરમાં આધ્યાત્મિક સત્ત્વ તરીકે પ્રગટ થાય છે. આ પ્રાગટય ક્રાંતિકાની સુધી જણે, તે પોતાના કરણ પર પ્રભુત્વ સ્થાપણે અને તેનું ઝ્યાંતર કરી શકશે કે નહિ, તે પછીનો પ્રશ્ન છે; પણ પ્રથમ તો આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરવાનો છે, મન જે કરતાં જિન્ન છે, મનથી મહત્ત્વ છે; આધ્યાત્મિકતા માનસિકતાથી જિન્ન વસ્તુ છે. આત્મા એ આખરી ઉત્કાન્તિમય પ્રાગટય છે, કારણકે તે મૌલિક અવકાન્ત બનેલું તત્ત્વ છે. ઉત્કાન્ત એ અવકાન્તથી ઊર્ધ્વ ગતિ છે. અવકાન્તમાં જે છેઢાની અને આખરી વસ્તુ હોય છે, તે ઉત્કાન્તમાં પહેલી દેખાય છે. અવકાન્તમાં જે મૂળનું અને પ્રથમ હતું, તે ઉત્કાન્તમાં ફેલ્બું અને પરમ પ્રાગટય હોય છે.”

( દિવ્ય જીવન, પૃષ્ઠ ૮૫૨-૮૩ )

આજે મને અવતાર વિષે કહેવાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે.

પહેલું તો મારે તમને કહેલું જોઈએ કે, શ્રી અરવિંદ આ વિષે લખ્યું છે. પ્રશ્ન પૂછનાર શ્રી અરવિંદનું તે વિષય પરનું લખાય પહેલાં વાંચી બે, તો તેને સમજવામાં સુશ્રમતા પડશે.

તમારે પોતે તે વાંચવું તે વધારે સારું છે; એટબે તે વિષે હું નહિ બોલ્યું.

પણ હું તમને એક ખૂબ પ્રાચીન પરંપરા વિષે કહીશ, કે આધ્યાત્મિક અને ગૂઢવાદી, બને પરંપરાઓ કરતાં પણ ખૂબ પ્રાચીન છે; વૈદિક પરંપરા અને કેવિયાની પરંપરા, તે પરંપરા આ બે પરંપરાઓના મૂળમાં છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે આસુરી શક્તિઓના કાર્યને પરિણામે, પ્રકાશના અને સાહનિક ચેતનાના નિયમ અનુસાર વિકાસ કરવાને બદલે, જગત અંધકારમાં ફેંકાઈ ગયું, અચેતનતામાં અને અજ્ઞાનમાં ફેંકાઈ ગયું, ત્યારે સર્જક શક્તિએ પરમ ઉદ્ગમ સ્થાનને (પરમાત્માને) પ્રાર્થના કરી કે, આ પતન પામેલા વિશ્વનો ઉદ્ઘાર કરવા માટે તમે દરમિયાનિશ્ચિ કરો. તે પ્રાર્થનાના પ્રત્યુત્તર રૂપે પરમાત્મામાંથી પ્રેમ અને ચેતનારૂપી ખાસ તત્ત્વનો પ્રાદુર્ભાવ થયો. તેણે સુધી રીતે પોતાની જતને ખૂબ અચેતન પદાર્થતત્ત્વમાં ફેંકી, જેથી તે તેનાં મૂળ ચેતનાને અને પ્રેમને જગૃત કરવાનું કાર્ય કરી શકે.

પ્રાચીન કથામાં આ પ્રાણીને એક ખૂબ અંધકારમય ચુફાને તળિયે સુષુપ્તિમાં પડેલું વર્ણિત્યું છે. તેની નિદ્રામાં, તેનામાંથી પ્રકાશના પ્રિયમ જેવાં કિરણો પ્રગરયાં, જે ધીમે ધીમે અચેતનતામાં ફેલાઈ ગયાં અને એ અચેતનતાનાં બધાં તત્ત્વોમાં પ્રવિષ્ટ થયાં, જેથી જગૃતિનું કાર્ય ત્યાં શરૂ કરી શકાય.

જો કોઈ આ અચેતનતામાં સચેતનતાપૂર્વક પ્રવેશ કરે, તો હજી પણ તે ત્યાં તે અદ્ભૂત પ્રાણીને ગાઢ નિદ્રામાં સૂંઠેલું, પ્રગટ થવાના કાર્યને કરતું, પ્રકાશ પાથરતું જોઈ શકે. જ્યાં સુધી અચેતન સચેતન નહિ બને, જગતમાંથી અંધકાર અદૃષ્ય નહિ થાય, સમગ્ર સુષ્ટિ અતિમાનસ ચેતના પ્રત્યે જગૃત નહિ થાય ત્યાં સુધી તે પોતાનું કાર્ય ચાલુ રાખશે.

એ નોંધપાત્ર છે કે આ અદ્ભૂત પ્રાણી મેં એક દિવસ સ્વપ્નમાં જેને જેણું હતું તેને ખૂબ મળતું આવે છે, જે પ્રાણી બીજે છેદે છે, રૂપ અને અરૂપની સરહદપર છે. પણ તે સ્વપ્નમાં દેખાયેલું સર્વ સૌનેરી અને નારંગી તેજવાળું હતું, જ્યારે પેલું નિદ્રાધીન પ્રાણી પારદર્શક કિરણોમાંથી પ્રગટ થતો, હીરા જેવી રમકતી પવલતાવાળું હતું.

હક્કીકતમાં, સર્વ અવતારોનું આ ઉદ્ગમ સ્થાન છે. તે પ્રથમ વૈશ્વિક અવતાર છે, જેણે કુમશઃ વધારે ને વધારે સચેતન દેખો ધારણ કર્યા છે, અને છેવટે

એક એવા સ્વીકૃત પ્રાણીઓની પરંપરામાં પ્રગટ થયા છે, જે પરમાત્મામાંથી સીધા, આ વિશ્વને તૈયાર કરવાના કાર્યને પરિપૂર્ણ બનાવવા માટે, અપતરિત થયા છે, નેથી ચાલુ રહેલી પ્રગતિ દ્વારા, વિશ્વ સમગ્રાસું અતિમાનસ પ્રકાશને સ્વીકારવા માટે અને પ્રગટ કરવા માટે તૈયાર બને.

દરેક દેશમાં, દરેક પરંપરામાં, આ ઘટનાને ભિન્ન ભિન્ન ભર્યાદાયોમાં, ભિન્ન ભિન્ન વીજોમાં, ખાસ પ્રકારે વર્ષ્ણવવામાં આવી છે. પણ સાચી રીતે કહીએ તો, આ સર્વ કથાઓનું ભૂળ એક જ છે. તેને આપણે ખૂબ અંધકારમય પદાર્થતત્ત્વમાં પરમાત્માની સીધી, સચેતન દરમિયાનજીવી કથી શકીએ. આ પદાર્થતત્ત્વને દિવ્ય શક્તિઓની સ્વીકૃતિ પ્રત્યે જાગૃત કરવા માટે, પરમાત્માને વચ્ચગાળાની અવસ્થાઓ-માંથી પસાર થવું પડતું હોતું નથી.

વિવિધ અવતારોના વચ્ચગાળાના સમયો વધારે ને વધારે ટૂંકા બનતા જતા દેખાય છે. જેમ જેમ પદાર્થતત્ત્વ વધારે ને વધારે તૈયાર બનતું જાય છે, તેમ તેમ કાર્ય જરૂરથી થતું જાય છે, ગતિ વધતી જાય છે, તે વધારે ને વધારે સચેતન, અસરકારક અને નિશ્ચયાત્મક બનતું જાય છે.

જ્યાં સુધી સમગ્ર વિશ્વ પરમાત્માનો સંપૂર્ણ અવતાર બનશે, ત્યાં સુધી આ કાર્ય વપનું જ જશે, વધારે ને ઉત્કટ બનતું જશે.

\*

#### ૫ જુન ૧૯૪૮

“ શરૂઆતમાં, આ આત્માનું સત્ય અને આધ્યાત્મિકતાનું સત્ય મનને પ્રગટ નથી હોતું. માણસ પોતાના આત્માનું ભાન, તે શરીરથી બીજ રૂપે, સામાન્ય ભન પ્રાણ કરતાં અભિક રૂપે, માનસિક રીતે પ્રામ કરે છે, પણ તેને તેનું સ્પષ્ટ ભાન થતું હોતું નથી; માત્ર તેના સ્વભાવમાં થતી કેટલીક અસરોની જ વાગણી તે અનુભવનો હોય છે. આ અસરો માનસિક અથવા પ્રાણિક રૂપ ધારણ કરતી હોય છે; એટલે તે દૃક્તાપૂર્વક અને સ્પષ્ટ રીતે તેમનો બેદ પારખી શકતો હોતો નથી; આત્મા દૃષ્ટિ નિશ્ચિન અને સ્પષ્ટ સ્વતંત્રતા પ્રામ કરતી હોતી નથી.

ઘરી વાર સામાન્ય રીતે, માનસિક અને પ્રાણિક ભાગો ઉપરના ચૈતસિક દબાણની અર્થ અસરોને, માનસિક અભીષ્ટાના અને પ્રાણિક કામનાઓના સંમિક્ષાણને તે આત્મા માની બેવાની ભૂલ કરતો હોય છે, જેવી રીતે લેદકારક અહેતાને આત્મા માની બેવામાં આવે છે તેમ, જે કે પોતાના સન્ય અસ્તિત્વમાં આત્મા સારદૃપ વૈશ્વિક તેમ જ વિકિતરણ હોય છે; જેવી રીતે માનસિક અભીષ્ટાના અને પ્રાણિક ઉત્સાહના તથા ઉત્કટતાના મિકાળને, જ્યારે તેને કોઈ બદવાન અથવા ઉચ્ચ માન્યતા અથવા આત્મ સમર્પણ અથવા પરોપકારી ઉત્કટતા ઉદાત્ત બનાવે ત્યારે, આધ્યાત્મિકતા માની બેવાની ભૂલ કરવામાં આવે છે તેમ. પણ ઉત્કાનિતની સ્વલ્પ-કાલીન અવસ્થામાં આ અનિશ્ચિતતા અને ગુંચવાડા અનિવાર્ય હોય છે, કારણે અજ્ઞાન તેનું આરંભબિંદુ હોય છે અને આપણે પ્રાથમિક સ્વભાવ અનિવાર્ય રીતે અપૂર્ણ આંતરદર્શનાથી અને સાહજિક આવેગથી, કોઈ અનુભૂતિ અથવા સ્પષ્ટ જ્ઞાન પ્રાપ્ત કર્યા સિવાય, આગળ વધતો હોય છે. આધ્યાત્મિક ઉત્કાનિતની દર્શાનાની પ્રથમ અસરો, અથવા આવેગ, અથવા પ્રથમ ચિહ્નનો અનિવાર્ય રીતે અપૂર્ણ અને કામચલાઉ હોય છે. પણ આ રીતે થયેલી ભૂલ સાચી સમજમાં રુકાવટ પેદા કરે છે; અને તથી એ વાત પર લાર મૂકવો જોઈએ કે આધ્યાત્મિકતા એ ઉચ્ચ બૌધિકતા નથી, આદર્શવાદ નથી, મનનો નીતિમય વળાંક નથી, નીતિમય વિશુદ્ધ અને તપસ્યા નથી, ધાર્મિકતા અથવા ઉત્કટ અને ઉદાત્ત લાગણીમય ઉભરો નથી, આ બધી સુંદર વસ્તુઓનું મિકાળ પણ નથી. માનસિક માન્યતા, સંપ્રદાય અથવા શાલા, લાગણીમય અભીષ્ટા, ધાર્મિક અથવા નીતિમય ઝેમ્યુલા અનુસાર નિયમિત થ્યેલું વર્તન એ આધ્યાત્મિક સિદ્ધ અને અનુભૂતિ નથી. આ વસ્તુઓ મનને અને પ્રાણને ખૂબ ઉપયોગી છે; સ્વભાવને યોગ્ય રૂપ આપનારી, વિશુદ્ધ કરનારી, શિસ્ત આપનારી, તૈયારી કરનાર ગતિઓ તરીકે, તે આધ્યાત્મિક ઉત્કાનિતમાં ખૂબ મદદગાર છે. પણ તે હજુ માનસિક ઉત્કાનિતની વસ્તુઓ છે, આધ્યાત્મિક સિદ્ધની શરૂઆત છે, અનુભૂતિ છે; પણ હજુ તેનાં પરિવર્તન નથી આવ્યું 'હોતુ'. તેના સાર ભાગમાં, આધ્યાત્મિકતા એ આપણા અસ્તિત્વની આંતર વાસ્તવિકતા પ્રત્યે જગૃતિ છે, આત્મા પ્રત્યે જગૃતિ છે, જે આત્મા મન, પ્રાણ, શરીર કરતાં બિનન છે. તે આત્માને જાણવાની, અનુભવવાની, ને એકરૂપ બનવાની પર રહેલી મહત્તર વાસ્તવિકતાના સંપર્કમાં પ્રવેશ કરવાની આંતર અભીષ્ટા જરૂરી છે. તે આત્મા વિશ્વમાં તેમ જ આપણાં અસ્તિત્વમાં સર્વ બ્યાપક છે. તેની સાથે એકતા સાધવી, તે અભીષ્ટાના પરિણામ રૂપે વળાંક લેવો, પરિવર્તન કરવું, આપણા

સમગ્ર અસ્તિત્વનું ઇપાંતર સિદ્ધ કરવું તે જરૂરી છે. નવીન આવિર્ભાવમાં, નવીન જતિમાં, નવીન સ્વભાવમાં જગૃત થનું, તેમાં વૃદ્ધ કરવી, તેની સાથે એકરૂપ બનવું તે જરૂરી છે.”

( દિવ્ય જીવન, પૃષ્ઠ ૮૫૬ - ૮૭ )

હુકીકતમાં, જ્યાં સુધી કોઈ શંકા કે આનાકાની રહે છે, જ્યાં સુધી માણસ પોતાની જતને પૂછતો હોય છે કે મેં મારામાં આ સનાતન આત્માનો સાક્ષાત્કાર કર્યો છે કે નહિ? ત્યાં સુધી એમ સિદ્ધ થાય છે કે હજુ સાચો સંપર્ક સધારો નથી. કારણુંકે જ્યારે તે ધરના બને છે, ત્યારે તેની સાથે સાથે એવું કંઈક અનિર્બચનીય, નવીન, અને નિશ્ચયાત્મક આવતું હોય છે કે પછી કોઈ શંકાને કે પ્રશ્નને સ્થાન જ રહેતું નથી. એ શબ્દના સાચા અર્થમાં તે ખરેખર એક નવીન જીવન હોય છે.

તમે એક નવીન વ્યક્તિ બની જાઓ છો. પછી માર્ગમાં ગમે તે મુશ્કેલીઓ આવે, પણ તે લાગણી તમને કદ્દી પણ ત્યજ જતી નથી. બીજા અનુભવોની ચેઠે, તે લાગણી પાછી ચાલી જતી હોતી નથી, પણાદ ભૂમિકામાં સરકી જતી નથી, તમને એવી અસ્પષ્ટ સ્મૃતિ આપીને ચાલી જતી નથી કે જે સ્મૃતિને ચીટકી રહેવું તે કઠિન હોય, જે સ્મૃતિ આંખી અને અસ્પષ્ટ બની જાય. તમે નવીન વ્યક્તિ છો, અને તે પણ નિશ્ચયાત્મક રીતે પછી ભવે ગમે તે ધરના બને, મનની સર્વ અશક્તિ, પ્રાણની સર્વ મુશ્કેલીઓ, શારીરિકની સર્વ જડતા તે નવીન સ્થિતિને બદલવા માટે અશક્તિતમાન હોય છે. તે નવીન સ્થિતિ ચેતનાના જીવનમાં એક નિશ્ચિયક પરિવર્તન લાવે છે. પહેલાં હતી તે વ્યક્તિ અને હવે પછીની વ્યક્તિ એક જ હોતી નથી. વિશ્વમાં તેની સ્થિતિ, વિશ્વ સત્યેનો તેનો સંબંધ, જીવનમાં સમાજમાં અને તેમના સંબંધમાં તેની સ્થિતિ, પહેલાંની સ્થિતિ જેવી, રહેલી હોતી નથી. તે એક એવું પ્રતિગમન છે કે જેનો નાશ ન કરી શકાય. તેથી જ્યારે લોકો મને પૂછે છે કે “હું મારા આત્મા સાથે સંપર્કમાં છું કે નહિ” ત્યારે હું કહું છું કે “તમે મને આ પ્રશ્ન પૂછો છો તે જ સિદ્ધ કરે છે કે તમે તમારા આત્મા સાથે સંપર્કમાં નથી. તમારે જવાબની કોઈ જરૂર નથી. તમે પોતે જ જવાબ આપી રહ્યા છો” જ્યારે વસ્તુસ્થિતિ એવી હોય છે, ત્યાર પછી કાઈ કહેવાનું જ રહેતું નથી; ત્યાં જ વાત પત્તી જાય છે.

આપણે તે વિશે વાત કરી રહ્યા છીએ. એટલે હું તમને કી અરવિદે જે વારંવાર કશું છે, લઘું છે, હોસપૂર્વક કથન કશું છે, તેની યાદ આપીશ કે મારો પૂર્ણયોગ ને અનુભૂતિ થયા પણી જ છે, ત્યાર પહેલાં નહિ.

એટલે કોઈએ ભ્રમણા ન સેવવી જોઈએ, કલપના ન કરવી જોઈએ તે અનુભૂતિ થોડાક પ્રમાણમાં પણ પ્રામ કર્યા સિવાય, અતિમનસ જસ્તી શકાય અથવા તેના વિષે કોઈ પણ પ્રકારનો જ્યાલ કરી શકાય.

એટલે, જે તમારે આ માર્ગમાં આગળ વધાવું હોય, તો તમારે ખૂબ નમૃતા-પૂર્વક પ્રથમ આ નવીન જન્મ પ્રામ કરવાની શરૂઆત કરવી જોઈએ અને અતિમાનસ અનુભૂતિઓ પ્રામ કરવાની ભ્રમણા સેવતાં પહેલાં નવીન જન્મને સિદ્ધ કરવો જોઈએ.

તમને આશ્વાસન આપવા માટે હું તમને કહીશ કે તમે વર્તમાન સમયમાં આ પૃથ્વી પર જન્મયા છો તે કારણે તમે તેથી સચેતન હો કે ન હો, તમારે તે વસ્તુ જોઈતી હોય કે ન જોઈતી હોય, તમે જે હવા શ્વાસમાં હો છો તેની સાથે સાથે આ પૃથ્વીના વાતાવરણમાં પ્રસરી રહેલા અતિમાનસ તત્ત્વને અંદર લેતા જ હો છો. તે તમારામાં વસ્તુઓ તૈયાર કરે છે, જે, તમે નિરૂપિક પગલું લેશો કે તરત જ, ઓચિયિતી તમારામાં પ્રગટ થશે.

( મૌન )

આ તમને નિરૂપિક પગલું લેવામાં મદદરૂપ થશે કે નહિ, તે બીજો સવાલ છે, કારણ કે જે અનુભૂતિઓ અત્યારે બની રહી છે અને વારંવાર બનતી રહેશે, તે મૌલિક રીતે એક નવા પ્રકારની છે અને તેથી શું બનવાનું છે તે આપણે પહેલથી જસ્તી શકતા હોતા નથી. આપણે ખૂબ અધ્યયન કરવું જોઈએ. તેમ કર્યા પણી જ આપણે ખાતરીપૂર્વક કહી શકીશું, આ અતિમાનસ તરફ તે નવીન જન્મના કર્યાને વધારે સહેલું બનાવશો કે નહિ. આ વાત હું તમને થોડીક વાર પછી કરીશ. અત્યારે તો, આ વસ્તુઓ પર બહુ આધાર ન રાખવો તે વધારે સારું છે. તમારે તો સીધાસટ આધ્યાત્મિક જીવનમાં જન્મવાળે પ્રારંભ કરી દેવો જોઈએ.

જ્યારે તમે આ વસ્તુને પ્રામ કરશો, ત્યારે તમારા બધા પ્રક્રણોનો નિકાશ આવી જશે.

ગમે તેમ, પણ જરન પ્રત્યે તમારું વલણ એટલું બધું બદલાઈ ગયું હોય કે આધ્યાત્મિક રીતે જીવનું એટલે શું તે તમે સમજ જશો. તે ખાસે તમે એક બીજી મહાન વસ્તુ પણ સમજ જશો કે અહેતા વગર કેવી રીતે જીવનું.

ત્યાં સુધી તમે તેને નહિ સમજ શકો. સમગ્ર જીવન અહેતા પર એટલું બધું પરતંત્ર છે કે, અહેતા વગર જીવનું કે કાર્ય કરવું તે તદ્દન અશક્ય લાગે છે. પણ આ નવીન જન્મ પછી, તમે અહેતા તરફ સિમતપૂર્વક નજર નાંખીને તેને કહી શકશો કે હે ભારા મિત્ર, હવે મને તારી કોઈ જરૂર રહ્યો નથી.

આ એક એવું પરિસ્થામ છે, કે ને તમને ખૂબ નિશ્ચયાત્મક મુક્તિની લાગણી આપશે.

\*

## ૧૧ જુન ૧૯૫૮

“જ્યારે તે નિશ્ચયાત્મક ઉદ્દ્ય થાય છે, નારે તેનું એક ચિહ્ન એ હોય છે કે, ત્યારે સાહજિક, મૂળની, આત્મપ્રગટ ચેતનાની સિથિત અથવા કાર્ય થવા લાગે છે કે, ને ચેતના પોતાના અસ્તિત્વ માન્ય બધું જાણતી હોય છે, તેની સાથે તાદાત્મ્ય થવાને કારણે પોતામાંનું બધું જ જાણતી હોય છે, તાદાત્મ્ય વડે આપણા મનમાં પણ ને કાંઈ હોય છે તેને યથાર્થ રીતે જાણતી હોય છે, ને પોતાના વિપ્યમાં ચાપો જઈને તે વિષયનો બરાબર વિવેક કરી બેતી હોય છે, તેનામાં એવી કાંઈક વસ્તુને પણ જાણી બેતી હોય છે, કે ને વસ્તુ મન પ્રાણ શરીર નથી. ત્યારે સ્પષ્ટ રીતે તે એક આધ્યાત્મિક ચેતના હોય છે, ને માનસિક કરતાં કાંઈક લિન્ન હોય છે, અને તે આપણામાં એક આધ્યાત્મિક સત્ત્વના અસ્તિત્વની ખાતરી આપતી હોય છે, ને સત્ત્વ આપણા ઉપરછળવા માનસિક વ્યક્તિત્વ કરતા લિન્ન હોય છે.”

(દિવ્ય જીવન, પૃષ્ઠ ૮૫૫)

મધુર માતાજી, શું દરેકમાં આધ્યાત્મિક સત્ત્વ હોય છે?

તેનો આધાર આપણે જેને સત્ત્વ કહીએ તેના પર છે. જો આપણે સત્ત્વ ને બદલે ‘હાજરી’ શરૂ મૂકીએ, તો હા, દરેક જાણમાં આધ્યાત્મિક હાજરી

છે. જો આપણે સત્તવનો એવો અર્થ કરીએ, કે તે એક પોતાની જાતથી સંપૂર્ણપણે સચેતન, સ્વતંત્ર, અધિકારપૂર્વક આપણા સ્વભાવના બાઝીના ભાગ પર શાસન કરતું, સંગઠિત તર્ફ છે, તો ના ! આ સ્વતંત્ર અને સર્વશક્તિમાન સત્તવની શક્યતા દરેક જાણમાં છે, પણ તેની સિદ્ધિ ધણાં જન્મેના જન્મેના પ્રયાસોનું પરિણામ હોય છે.

દરેક જાણમાં, શરૂઆતમાં પણ, આ આધ્યાત્મિક હાજરી, આ અંતર પ્રકાશ હોય છે જી. હકીકતમાં, તે સર્વત્ર છે. ધર્માધ્યાત્મક અમૃત પણ ઓમાં પણ મેં ને હાજરી જોઈ છે. તે એક પ્રકાશમાન બિંદુ હોય છે, જે અમૃત કાબૂનો અને રક્ષણનો પાયો હોય છે, કે અર્થ ચેતનામાં પણ બાઝીની સૂચિટ સાથે અમૃત સંવાદમયતાને શક્ય બનાવે છે, જેથી દૂર ન કરી શકાય. તેવું કષ્ટ સતત ન આપતું રહે. જો તે હાજરી ન હોય, તો પ્રાણુક વડે સર્જાયેલી, તેનાં તોકાન અને આવેગો વડે સર્જાયેલી જોરદરવસ્તા એટલી બધી મોટી બની જાય કે જમે તે કણે તે એક સર્વ-સાધારણ વિપત્તિ, પ્રકૃતિની પ્રગતિમાં તુકાપટ ડાલનારો સર્વ સંહાર લાવી મૂકે. તે હાજરી, તે આધ્યાત્મિક પ્રકાશ, તે આધ્યાત્મિક ચેતના બધી વસ્તુઓમાં અને પ્રાણીઓમાં હોય છે. તેને કારણે, સર્વ વિસંવાદિતા, સર્વ આવેગ, સર્વ હિસાખીયી હોવા છાં પણ થોડીક તો સર્વ સાધારણ સંવાદિતા રહેતી હોય છે, જે પ્રકૃતિના કાર્યને સિદ્ધ થવા દેતી હોય છે.

આ હાજરી નદ્દન પ્રાથમિક અવસ્થાના માનવમાં પણ નદ્દન સ્પષ્ટ બને છે. રાક્ષસ જેવા, શયનાના અવતાર જેવા પણ માનવમાં એવું ડાઈક છે કે અપ્રતિરોધ્ય કાબૂ રખાવતું હોય છે. સૌથી વધારે દુષ્ટ માસુસ પણ અમૃત વસ્તુઓ કરી શકતો હેતો નથી. જો આ હાજરી ન હોય અને માસુસ પર વિરોધી બળો જી પ્રાણુકનાં બળો જી કાબૂ ધરાવતાં હોય, તો આ અશક્યતા અસ્તિત્વ ન ધરાવે.

જ્યારે જ્યારે આ વિરોધી રાક્ષસી બળો જગતમાં ભળવાન બની જાય છે, ત્યારે એમ લાગે છે કે કોઈ પણ વસ્તુ આ ત્રાસને, લીધણનાને અટકાવી નહિ શકે; ત્યારે ઓચિતો એક કાબૂ દરમ્યાનગીરી કરે છે, અને તે રાક્ષસી કૃત્યોનું મોણું અટકી જાય છે, પૂરો વિનાશ થતો હેતો નથી. તેનું કારણ પદાર્થતત્ત્વમાં રહેલી આ પરમ હાજરી છે.

પણ થોડીક અપવાદ્ય વ્યક્તિઓમાં, અનેક જન્મોમાં કરાયેલી લાંબી નૈયારી પછી, આ હાજરી એક પરિપૂર્ણ રીતે સચેતન, સ્વતંત્ર સંપૂર્ણપણે સંગઠિત સત્તવમાં

પરિવર્તિત થાય છે, જે સત્ત્વ પોતાના નિવાસસ્થાનનો સર્વ શક્તિનમાન સ્વામી હોય છે, જે માત્ર પોતાના નિવાસસ્થાન પર જ નહિ પણે આસપાસની સર્વ વસ્તુઓ પર કાબૂ રાખવા સમર્થ હોય છે, તેનું વિસ્તરતું જતું કાર્ય વધારે ને વધારે વિસ્તૃત અને અસરકારક બનતું જાય છે.

\*

## ૧૮ જુન ૧૯૫૮

“આંતર અસ્લિન્ટ્ઝને ખુલ્લુ” કરવાના પ્રયત્નમાં પ્રકૃતિ ચાર મુખ્ય માળેનિ અપનાવતી હોય છે. ધર્મ, ગૂઢવાદ, આધ્યાત્મિક ચિંતન, અને આંતર આધ્યાત્મિક અનુભૂતિ. પહેલા ત્રણ અભિગમે હોય છે, છેલ્દો નિર્સિયાત્મક પ્રવેશનો માર્ગ છે. આ ચારેય શક્તિઓએ એક સાથે કાર્ય કર્યું છે, તે કાર્ય વત્તા ઓછા પ્રમાણમાં પરસ્પર સંબંધ ધરાવતું હોય છે. કેટલીકવાર પરિવર્તન પામતા સહકારપૂર્વક, કેટલીકવાર પરસ્પર વિરોધપૂર્વક, કેટલીકવાર સ્વતંત્રતાપૂર્વક ધર્મ, પોતાના વિધિમાં ગૂઢવાદી તત્ત્વને પ્રવેશ આપ્યો છે, તે આધ્યાત્મિક ચિંતન પર એક રાખતો હોય છે; તેમાંથી તે કેટલીકવાર કોઈ સંપ્રદાય અથવા ધર્મ સિદ્ધાંત ઉભો કરતો હોય છે. કેટલીકવાર તે આધાર આપનાર, આધ્યાત્મિક તત્ત્વ ચિંતન ઉભું કરતો હોય છે. સંપ્રદાય અને વિધિ એ આકસ્મિક પદ્ધતિ છે. તત્ત્વ ચિંતન મુખ્ય, દર્શન રૂપ પદ્ધતિ છે. પણ આધ્યાત્મિક અનુભૂતિ ધર્મની આખરી સિદ્ધિ છે, તેનું લક્ષ્ય છે, ચાચી અને શિખર છે. પણ ધર્મ કેટલીકવાર ગૂઢવાદને પ્રવેશ આપતો હોતો નથી. અથવા તો તેને ઓછામાં ઓછા જનાવી મૂકે છે. તત્ત્વ ચિંતનીય મનને તેણે, કોઈ શુષ્ણ બૌધિક પરદેશીની પેઢે, ફગાવી દીધું હોય છે. ધર્મ માત્ર પોતાના સંપ્રદાય તથા સિદ્ધાંત પર જ એક રાખ્યો હોય છે; મુલાયમ માગણી ઉપર, ઉત્કટા ઉપર, અને નીતિમય આચાર ઉપર એક મૂક્યો હોય છે. તેણે આધ્યાત્મિક અનુભૂતિને નહિવત્ત સ્થાન આપ્યું હોય છે, ફગાવી દીધી હોય છે. ગૂઢવાદે કેટલીકવાર આધ્યાત્મિક લક્ષ્ય રાખ્યું હોય છે, ગૂઢવાદી જ્ઞાનને અને અનુભૂતિને આધ્યાત્મિક સાક્ષાત્કાર પ્રત્યેના અભિગમ તરીકે સ્વીકાર્ય હોય છે, એક પ્રકારનું ગૂઢવાદી, રહસ્યમય તત્ત્વ ચિંતન રચ્યું હોય છે. પણ ધર્મી વર તો તેણે ગૂઢવાદી જ્ઞાનનું અને આચારોનું અનુસરણ કર્યું હોય છે. જેમાં કોઈ આધ્યાત્મિક વસ્તુઓ હોતી નથી; કેટલીકવાર તે જાહુમાં અથવા આસુરી આચારોમાં સરી રહેતા હોય

છે. આધ્યાત્મિક તત્ત્વચિંતન, ટેકા માટે, મોટે લાગે ધર્મ પર જોક મૂકતું હોય છે. તે સાક્ષાત્કારનું અથવા અનુભૂતિનું પરિણામ હોય છે અથવા તેણે પોતાની દીમારત, તેના અભિગમ રૂપે, ચલ્લો હોય છે. પણ તેણે સર્વ ધર્મનો એક વિધિ તરીકે, ઈન્કાર પણ કેટલીકવાર કર્યો હોય છે. તેમ કરવામાં તેણે પોતાનું બજ ઉપર જ આધ્યાત્મિક રાખ્યો હોય છે, કંતો તે માનસિક જ્ઞાનની સંતોષ માની બે છે અથવા અનુભૂતિનો અને અસરકારક સંયમનો માર્ગ જોવી કાઢવા માટે તેને પોતામાં શક્ષા હોય છે. આધ્યાત્મિક અનુભૂતિઓ તે ત્રણેય વસ્તુઓનો આરંભ બિંદુ તરીકે ઉપયોગ કર્યો છે, પણ પોતાના બજ પર વિશ્વાસ રાખીને તેણે તે ત્રણેયને ફળવી દીધાં પણ હોય છે. તેણે ગુદ્ધવાદી જ્ઞાનને અને સિદ્ધિઓને જોખમકારક બોલનો ગણ્યાવ્યાં છે, ગુચ્છવાડામાં નાંખી હે તેવા વિધનો ગણ્યાવ્યાં છે. તેણે માત્ર આત્માના વિશુદ્ધ સત્યની જ જોજ કરી છે. તત્ત્વ ચિંતનને બાજૂએ રાખીને, હદ્યની ઉંકટતા દ્વારા અથવા આંતર રહસ્યમય આધ્યાત્મોકરણ દ્વારા તેણે સાક્ષાત્કારને પ્રામ કર્યો છે. તેણે સર્વ ધાર્મિક સંપ્રદાયોને, પૂજાને, વિધિને ઉત્તરતી અવસ્થાના અથવા પ્રાથમિક અભિગમરૂપ ગણ્યાવ્યાં છે અને બાજૂએ રાખી દીધાં છે. આ બધી ટેકાઓને, સામગ્રીઓને બાજૂએ મૂકીને, તે માત્ર આધ્યાત્મિક વાસ્તવિકનાના સંપર્ક પ્રત્યે જ સીધું ગમ્યું છે. આ બધાં પરિવર્તનનો આવશ્યક હતો. પ્રકૃતિના ઉત્કાંતિમય પ્રયાસે આ બધા પ્રયોગો કર્યા હતા, જેથી તે સાચા માર્ગને શોધી શકે, પરમ ચેતનાના અને સમગ્ર જ્ઞાનના માર્ગને પ્રાપ્ત કરી શકે.

આ ચારેય અભિગમો સાથે સુસંગત અદેવું કાંઈક આપણા સમગ્ર અસ્તિત્વમાં રહેવું છે. પ્રકૃતિની ઉત્કાંતિના સમગ્ર હેતુમાં એ ‘કાંઈક’ જરૂરી છે. જો માલસે ઉપરછલા અજ્ઞાતનું પ્રાણી ન રહેવું હોય, વસ્તુઓના સત્યની જોજ અસ્પષ્ટપણે ન કરવી હોય, જ્ઞાનના દૂરકાઢો જ એકત્રિત કરીને તેમને પરદતિમાં ગોઠવા ન હોય, અત્યારે જેમ ને વીજેવક શક્તિતનું એક નાનકડું, મર્યાદિત, અર્થ શક્તિશાળી પ્રાણી છે તેવા ન બની રહેવું હોય, તો આત્મવિકાસ કરવા માટે તેને ચાર જરૂરિયાતો છે. તેણે પોતાની જાતને જાણવી જોઈએ અને પોતાની સર્વશક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ. પણ પોતાની જાતને તથા વિશ્વને પરિપૂર્ણ રીતે જાણવા માટે, તેણે પોતાની તેમજ વિશ્વની બાધ્ય સપાટીની ભૌતરમાં પ્રવેશવું જોઈએ; તેણે પોતાની માનસિક સપાટીની નીચે અને પ્રકૃતિની ભૌતિક સપાટીની નીચે જીડી ઝૂખકી મારવી જોઈએ. તેમ કરવા માટે, તેણે પોતાના આંતર માનસિક, પ્રાણિક, શારીરિક અને ચૌતસિક અસ્તિત્વનું જ્ઞાન, પ્રામ કરવું જોઈએ; તેમની શક્તિઓનું અને ગતિઓનું જ્ઞાન

પ્રામ કરવું જોઈએ. વળી તેણે વૈશ્વિક નિયમોનું અને ગૂઢવાદી મન-પ્રાણની પ્રક્રિયા ઓનું શાન મેળવવું જોઈએ જે પ્રક્રિયાઓ વિશ્વના બૌતિક અગ્રભાગની પીઠમાં રહેલી છે. જો આપણે ગૂઢવાદને તેના વ્યાપક અર્થમાં લઈએ, તો એ ગૂઢવાદનું કોન્ન છે. તેણે જગતનું નિયમન કરતી શક્તિનું અથવા શક્તિઓનું શાન પણ મેળવવું જોઈએ, જો વૈશ્વિક આત્મા અથવા સ્પષ્ટ હોય, તો તેણે તેની સાથે સંબંધમાં પ્રવેશવું જોઈએ. તેની સાથે યથાશક્ય સંપર્કમાં રહેવું જોઈએ, વિશ્વનાં પ્રલુસત્ત્વાં સાથે સંવાદિતામાં રહેવું જોઈએ. વૈશ્વિક સત અને તેના પરમ સંકલ્પ સાથે એક પ્રકારની સંવાદમયતા સાધવી જોઈએ. તે તેને જે નિયમ આપે તેનું અનુસરણ કરવું જોઈએ, તે પોતાના જીવનનો જે હેતુ આપે તેને અનુસરવું જોઈએ તે માગે તેવી ઉચ્ચતમ ઊંચાઈ પર પોતાની જતને લઈ જવી જોઈએ આ જીવનમાં અને હવે પદ્ધતીના જન્મમાં પણ જે તેવા એઈ વૈશ્વિક પરમાત્માન હોય, તો તે જે હોય તે સત્ત્વને જાણીને તેણે પોતાની અત્યારની અપૂર્ણતાને તથા અશક્તિને તેનામાં ઊંઘ્વીકૃત કરવી જોઈએ. આ અભિગમ ધર્મનો ઉદ્દેશ છે. તેનો હેતુ છે, માનવને ભગવાન સાથે જોડી આપવાનો. તેમ કરવામાં ધર્મે માનવના વિચારનું, પ્રાણનું અને શરીરનું ઉદાત્તિકરણ કરવાનું છે, જેથી તે બધાં આત્માનું શાસન કબૂલ રાપે. પણ આ શાન સંપ્રદાય કરતાં, ગૂઢ પ્રગટીકરણ કરતાં કાંઈક અધિક હોવું જોઈએ. તેના વિચારક મને તેનો સ્વીકાર કરવો જોઈએ, વસ્તુઓના તત્ત્વ સાથે તથા વિશ્વના જોવાયેલા સત્ય સાથે તેને સુસંગત બનાવવું જોઈએ. આ તત્ત્વચિત્તનું કાર્ય છે. આત્માના સત્ત્વના કોન્નમાં તે કાર્ય માત્ર આધ્યાત્મિક તત્ત્વચિત્તન જ કરી શકે પણી તેની પદ્ધતિ બૌધ્ધિક હોય કે આંતર પ્રેરણાયુક્ત હોય. પણ જે શાનને અને પ્રાણનું અનુભૂતિમાં પરિવર્તન કરાય, ચેતનાના એક ભાગ દ્વારા બનાવી દેવાય, ચેતનાની ડિયાઓમાં તેમને સ્થાપી શકાય, તો જ તે બંને સફળ બને. આધ્યાત્મિક કોન્નમાં આ સર્વ ધાર્મિક, ગૂઢવાદી, અથવા તત્ત્વચિત્તનીય જ્ઞાને અને પ્રયાસે છેવટે આધ્યાત્મિક ચેતના પ્રત્યે ખુલ્લા થવું જોઈએ; તો જ ફળદાયી અને છેવટે તે બંનેને એવી અનુભૂતિઓ પ્રામ થવી જોઈએ. કે જે ચેતનાને પાપાદ્રુપ બને, ચેતનાને સતત વિકસાવે, ઊંઘ્વીકૃત બનાવે, સમૃદ્ધ બનાવે, અને આત્માના સત્ય સાથે સુસંગત જીવનનું તથા કાર્યનું નિર્માણ કરે. આધ્યાત્મિ સાક્ષાત્કારનું અને અનુભૂતિનું આ કાર્ય છે.”

( દિવ્ય જરૂર, પૃષ્ઠ ૮૫૦-૬૨ )

એક વાત બહુ નોંધપાત્ર છે. પાછળથી ક્રી અરવિદ તેને વિષે કહે છે, કે, નહિ, તેમને યાદ નથી. તે ચાર કિયાઓનું અથવા સિલ્વિઓનું કથન કરે છે ધર્મ ગુઢવાદ, આધ્યાત્મિક તત્ત્વચિતન, અને આધ્યાત્મિક અનુભૂતિ, માનવના વિકાસ અને રૂપાંતર માટે આ ચારેય વસ્તુઓ જરૂરી છે. તે બધી માનવ અતિ માટે સુખભ નથી.

તેમાં ધર્મને બોકો આચરી શકે તેમ છે, સમજ શકે તેમ છે, જે કે કેવળ ભૌતિક ચેતનામાં જીવતા, માનવોમાંના મોટા ભાગના બોકો તેને સમજ શકતા હોતા નથી. બોકો તેને સમજ શકે તેમ છે, કારણકે ધર્મના પાયામાં નિશ્ચિત સંપ્રદાયો અને વિધિઓ હોય છે. જે બોકો હજુ આંતર વિકાસને ખૂબ પ્રામ કરી શક્યા નથી તેઓ પણ માત્ર શક્યા દ્વારા, સામૃહિક સૂચન દ્વારા, ધર્મનો માર્ગ બદ્ધ શકે તેમ છે.

ગુઢવાદ માટે આપણે વિકાસની બીજી અવસ્થાએ પહોંચેલા હોવા જોઈએ, પ્રાણિક જગતમાં વધારે સચેતન બનેલા હોવા જોઈએ, જેથી આપણે શક્તિઓની, બળોની લીધાનો સંપર્ક સાથી શકીએ, કારણકે તે બળો સાથે કામ પાડવા માટે તે સંપર્ક અનિવાર્ય છે.

આધ્યાત્મિક તત્ત્વ ચિતનની પદ્ધતિ ઉપયોગિતાપૂર્વક તે બોકો જ અપનાવી શકે કે નેણે પ્રમાણમાં સંપૂર્ણ માનસિક વિકાસ સાધ્યો હોય, અને જેઓ જૌલ્દિક લૂભિકા પર પરિપૂર્ણ રીતે સચેતન હોય. જે બોકો માનસિક કસરત કરી શકે તેમ નથી હોતા. મનની નાચકૂદને અનુસરી શકતા નથી હોતા, તેમને માટે આધ્યાત્મિક તત્ત્વચિતન એક મરી ગયેલી પોથી જેવું છે.

છેવટે ક્રી અરવિદે તેમના ‘દિવ્ય જીવન’ માં કયાંક કહું છે કે આધ્યાત્મિક અનુભૂતિના માર્ગને અનુસરવા માટે, માણસમાં “આધ્યાત્મિક સત્ત્વ” હોવું જોઈએ, ને દ્રુજ બનેલા હોવા જોઈએ, કારણકે જો માણસમાં આત્મસભાન બનતું જતું આધ્યાત્મિક સત્ત્વ ન હોય, તો તે અનુભૂતિઓનું અનુકરણ કરવાનો પ્રયત્ન તે કરી શકે, પણ તે ગ્રામ્ય અનુકરણ અથવા દંબ માત્ર હશે, વાસ્તવિકતા નહિ.

એટલે, આ ચાર માર્ગેનું એકી સાથે અનુકરણ કરવા માટે, અને અસ્તિત્વને સમગ્ર લાલ મળે તેટલા માણસે પરિપૂર્ણ વ્યક્તિ બનેલા હોવું

જોઈએ, માનવીએ અને આધ્યાત્મિક સ્વભાવના ચાર મુખ્ય તત્ત્વોથી સભર, સચેતન જીવન પ્રાપ્ત કરવાનું સમર્થ તેનામાં હોવું જોઈએ.

અલબત્ત, આ આંતર વિકાસ હંમેશાં જોઈ શકાય તેવો નથી હોતો, એટલે આપણે એવા કોઈ માણસને જોઈ શકીએ, જેનામાં અતિશય સુંદર અનુભૂતિઓ માટે તૈયાર, સચેતન, આધ્યાત્મિક તત્ત્વ હોય, અને છતાં બહારથી તે તદ્દન ગ્રામ્ય અને અપૂર્વ દેખાતો હોય.

આ ચાર પદ્ધતિઓને જે કુમમાં વર્ણવામાં આવી છે તે કુમનું અનુસરણ થવું જ જોઈએ, એમ પણ નથી. જો આપણે સંપૂર્ણ સાક્ષાત્કાર માગતા હોઈએ, આપણા અસ્તિત્વનું સમગ્ર રૂપાંતર હોઈએ, તો આપણે આ દરેક પદ્ધતિના સાર તત્ત્વનો ઉપયોગ કરવા માટે સમર્થ હોવું જોઈએ.

શૈત્યમય અથવા આધ્યાત્મિક ચેતના તમને ઊંડા આંતર સાક્ષાત્કાર, ભગવાન સાથે સંપર્ક, બાધ્ય બંધનોમાંથી મુક્તિન આપે છે. પણ આ મુક્તિન અસરકારક બને તેટલા માટે, તે અસ્તિત્વના બીજા ભાગો પર કાર્ય કરી શકે તેટલા માટે, મન જ્ઞાનના આધ્યાત્મિક પ્રકાશને ધારણ કરવા સમર્થ અને ખુલ્લું હોવું જોઈએ, પ્રાણીક દેખાવોની પીઠમાં રહેલાં બ્રહ્મ સાથે કામ લેવા માટે અને તેમના પર પ્રભુત્વ સ્થાપવા માટે શક્તિશાલી હોવું જોઈએ, અને શારીરિક ને ગહન અનુભૂતિને વ્યક્ત કરી શકે, દરેક દિવસની અને જ્ઞાનની ગતિઓમાં વ્યક્ત કરી શકે તેટલું સંગઠિત અને શિસ્તબદ્ધ હોવું જોઈએ, જેથી તે સમગ્રનાપૂર્વક તે આધ્યાત્મિક અનુભૂતિમાં જીવન ધારણ કરી શકે.

જો આમાંની એક પણ વસ્તુ નહિ હોય, તો પરિણામ પૂરેપૂરું નહિ આવે. આ વસ્તુ સૌથી મહત્વની નથી, કેન્દ્રસ્થ વસ્તુ નથી એવું બહાનું કાઢીને, માણસ એમાંની કોઈ એક વસ્તુની અવગણના કરી શકે, બાધ્ય વસ્તુઓની અવગણના. તમને પરમાત્મા સાથે આધ્યાત્મિક સંપર્ક સાપ્તાં અટકાવી શકતી નથી, પણ તે તો જીવનમાંથી ભાગી જવા માટેનું બહાનું છે.

જો આપણે સમગ્ર, પરિપૂર્ણ પ્રાણી બનવું હોય, સમગ્ર સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય, તો આપણામાં આપણી આધ્યાત્મિક અનુભૂતિને માનસિક રીતે, પ્રાણીક રીતે, અને શારીરિક રીતે અભિવ્યક્ત કરવાની શક્તિ હોવી જોઈએ. જેમ જેમ આપણો

અભિવૃક્તિ પરિપૂર્ણ હશે, પરિપૂર્ણ અસ્તિત્વ વડે સિદ્ધ કષેળો હશે, તેમ નેમ આપણે આધ્યાત્મિક વખતે સમગ્ર એ પરિપૂર્ણ બનશે.

ખૂબં યોગનું અનુસરણ કરવા ભાગ્યના માલિક માટે કોઈ પણ પસ્તુ વિર્યંક નથી, તેણે કોઈ પણ વસ્તુની ઉપેક્ષા ન કરવી જોઈએ મુજ્ય વસ્તુ એ છે કે આ ચારમાંથી દરેક પદ્ધતિને તેના યોગ્ય સ્થાને મૂળી આપવી, તે જાગતની આવડનું કાવ હોયાનું, એ કેવે થાસન ચવાવવાનો સારો અધિકાર છે તેને શાશ્વત ચોંચી દેયું.

\*

## ૨૫ જુન ૧૯૪૮

“વસ્તુઓનો સ્વભાવ જ એવો છે કે ઉત્કાન્ત પ્રથમ ધીમા પ્રગટીકરણ વડે આગામ વધે કારણે દરેક ઉત્કાન્ત ક્રતા, વચ્ચીન તત્ત્વે તત્ત્વ તેની શક્તિઓએ અવયેતનમાં અને અજ્ઞાનમાં અયેલો અધકાન્તમાંથી પોતાનો માર્ગ કાઢપાણો હોય છે. અવકાન્તમાંથી, મૂળના માધ્યમની જડતાની પકડમાંથી, અચેતનતાના સાહિત્યક વિરોધની અને કુસ્વાટની સામે થઈને, અવરોધ કરતા અજ્ઞાનની જરૂરી રૂક્ષવાદીની સામે થઈને પોતાની જતને બહાર લાવવી એ કઠીન કામ હોય છે. પ્રથમ તો પ્રકૃતિ એક અસ્પષ્ટ આવેગ અને વલસુ પ્રગટ કરે છે, કે નિગૂઢ અવયેતન વાસ્તવિકતાના સપાદી પ્રત્યેના ધ્રુવાનું વિહનું હોય છે. પછી પ્રગટ થતી વસ્તુનાં નાનકડાં અર્થદિષ્ટ સૂચનો દેખાય છે. તે અપૂર્ણ પ્રારંભો હોય છે, પ્રાથમિક સિથિતિનાં તત્ત્વો અને દેખાવો હોય છે. તે નાનકડાં, અર્થવિહીન, લાગ્યે જ ઓળખી શકાય તેવાં તત્ત્વો હોય છે. પછી નાની કે મોદી રચનાઓ થાય છે, વધારે વાક્ય-સિક અને ઓળખી શકાય તેવાં ગુણવત્તા પોતાની જતને પ્રગટ કરે છે. પ્રારંભમાં તે આંશિક રીતે, અલ્લી અને તહીં, ઓછી ઉત્કટનાપૂર્વક પ્રગટ થાય છે. પછી તે વધારે છુંટાં અને રચનાત્મક બને છે. આખરે એક નિર્ણયાત્મક પ્રગટીકરણ થાય છે, ચેતનાની જીથિયાથી થાય છે, મૌલિક પરિવર્તનની શક્યતાનો ગ્રાન્થ થાય છે. છતાં હજી દરેક દિશામાં ધારું ધારું કરવાનું બાકી હોય છે; ઉત્કાન્તમય પ્રયાસની સમશ પરિપૂર્ણતા પ્રત્યેની લાભો સમગ્ર માર્ગી કે તેવી, કઠીન વૃદ્ધિ

ખરી ઉલેલી હોય છે. જે વસ્તુ કરી છે તેને સ્થિર કરવાની હોય છે, તે પછી મૂળ સિથિતમાં ન જઈ પડે નીચે જેંચા ગુરુત્વાર્થસુનો ભોગ ન થઈ પડે તે જોવાનું હોય છે, તે નિષ્ઠળ ન બને અને વિનાશ ન પામે તે જોવાનું હોય છે. એટલું જ નહિ, પણ તેને શક્યતાઓનાં સર્વ જોત્રોમાં ખુલ્ખું 'કરવાનું' હોય છે, તેની સમગ્ર આત્મ સિદ્ધિ, વધારેમાં વધારે જીંચાઈ, સૂક્ષ્મતા, સમૃદ્ધિ, વિશાળતા પ્રાપ્ત કરવાની હોય છે. તેણે પ્રભાવશાસ્ત્રી, સર્વ સમાવેશક, વિશાળ બનવાનું હોય છે. પ્રકૃતિની આ પ્રક્રિયા સર્વત્ર જોવામાં આવે છે. તે પ્રક્રિયાની ઉપેક્ષા કર્ત્વી ને પ્રકૃતિના આશયને ગુમાવી બેસવા જેવું છે, તેની પ્રક્રિયાની બૂલબૂલામણ્ણીમાં ભુલા પડવા જેવું છે."

( દિવ્ય શ્વાન, પૃષ્ઠ ૮૬૨-૬૩ )

આ વ્યક્તિ વિકાસનું ખૂબ નિશ્ચિત વર્ણન છે. બરાબર તેવું જ, બનતું હોય છે. તેથી તમે ધીરજ અને હિંમત ગુમાવી દેતા હો છો, કારણકે તમને એમ લાગતું હોય છે કે હું પ્રગતિ કરતો નથી. પણ જ્યારે તમે શરીરનો ભૌતિક વિકાસ શરૂ કરો છો, જ્યારે તમે શરીર પાસે સાથના કરાવવા માંણો છો, ત્યારે આમ જ બનતું હોય છે. નિશ્ચિતતા વગર, ક્યે છેરેથી શરૂઆત કરવી તે જાણ્યા વગર, તમે અનેક વસ્તુઓના પ્રયત્નથી શરૂઆત કરો છો. તમને એમ લાગતું હોય છે કે હું હાંદ્દું મારી રહ્યો છું, એજ કરી રહ્યો છું, જોળ-જોળ ચક્કરમાં ફરી રહ્યો છું, પણ કયાંય પહોંચતો હોતો નથી. પછી ધીમે ધીમે ઓક વસ્તુ દેખાવા માડે છે, પછી બીજી વસ્તુ દેખાવા માડે છે, અને ખૂબ સમય પછી તમે કાર્યક્રમ પાર પાડવાની શરૂઆત કરતા હો છો. તેનું વર્ણન શ્રી અરવિંદ ફરસાના અંત લાગમાં કરે છે. ત્યારે ઉત્કાનિતનું લક્ષ્ય પ્રગટ થાય છે, દૃષ્ટિગોચર થાય છે, તે ફરીથી મૂળ અજ્ઞાનમાં ચાલ્યું ન જાય તેને માટે કેટલી દરકાર બેવાની હોય છે તેની તમને ખબર પડી જાય છે.

તેથી આ કાર્ય અનંત દેખાય છે. પણ તે સિદ્ધ કરવાનો બીજો કોઈ માર્ગ નથી. શરીરની રોળિદ્વી સિથિત, સંપૂર્ણ અચેતનતાથી આપણે ટેવાઈ જયા છીએ તે હતીકત અની વચ્ચે અને ચેતનાની પરિપૂર્ણ જગૃતિ, સર્વ ડોપાણુઓના પ્રત્યુત્તર, સર્વ અંગોના પ્રત્યુત્તર, સર્વ કામગીરીઓ અની વચ્ચે, એ બેની વચ્ચે સદીઓ સુધી કરવો પડે તેવો પરિશ્રમ પડેવો છે. પણ જે માણસ ખુલ્ખોથતાં, અલ્ભીપ્રસા

કરતાં, સમર્પણ કરતાં શીખ્યો હશે, એ તે આ શરીરની ગતિઓનો ઉપયોગ કરતાં શીખ્યો હશે, કોષાણુઓને તે જ વસ્તુ, તેણે શિખવાહી હશે, તો વસ્તુઓ ખૂબ જડપલેર ગતિ કરશે. છતાં પણ તે કાર્ય ધીમું અને લાંબા સમય માળી બે તેવું હોય છે? દર વખતે, જ્યારે રૂપાંતરની ગતિમાં હજી સુધી નહિ પ્રવેશેલું તત્ત્વ તેમાં પ્રવેશ કરવા માટે જાગૃત થાય છે, ત્યારે સાધકને લાગતું હોય છે કે બધાની શરૂઆત ફરીથી કરવી પડ્યો, મેં કે કામ સિદ્ધ થઈ ગયેલું માન્યું હતું તેની શરૂઆત ફરી કરવી પડ્યો. પણ તે વાત સાચી નથી. તેવું તે જ કામ ફરી કરવાનું હોતું નથી. કોઈ નવીન તત્ત્વમાં, પહેલાં ભુલી જવાયેલું અથવા બાજૂએ મૂકાયેલું કામ કરવાનું હોય છે, કારણકે તે તત્ત્વ તે વખતે નૈયાર ન હતું, પણ હવે તે નૈયાર થઈ ગયું છે, જાગૃત બન્યું છે, તે સાધનામાં પોતાનું સ્થાન માળી રહ્યું છે. એવાં ઘણાં તત્ત્વો છે.

શરીર તમને એક બહુ સાદી વસ્તુ લાગે છે, નહિ વારું? તમે માનો ક્રિએ કે તે શરીર છે, ‘મારું’ શરીર છે, આખરે તો તેને એક જ રૂપ છે. પણ હકી-કન્તમાં તેમ નથી હોતું? શરીરમાં સેંકડો સંયુક્ત એકમો હોય છે. તે એક બીજાને જાળુનાં હોતાં નથી, કે કાઈક ગણનતર વસ્તુ તેમનામાં સંવાદમયતા સ્થાપી આપે છે તેને તે જાળતાં હોતાં નથી; તમને માત્ર એકનાં જ દેખાય છે, કારણકે તત્ત્વોની અનેકતાનું અને તેમના બેદનું તેમને ભાન હોતું નથી.

હકીકતમાં, આ અનેકતા અને બેદ ઘણીખરી અવ્યવસ્થાઓનું અને રોગોનું કારણ હોય છે. કોઈક વસ્તુ બરાબર કામ કરી રહી છે, તમે તેનો દ્વારવણીનો તંત્ર પણ હકી શક્યા છો, તમે તમારા માર્ગને અનુસરતા હો છો, તમને આશા છે કે છું પરિણામ જરૂર પ્રાપ્ત કરીશ; અને ત્યાં તો ઓચિનું કંઈક બને છે, તે ત્યાં છે તે તમે જાળુના ન હતા, તે જાગૃત થઈ જાય છે અને તમારી સાથે યાત્રામાં જોડવાનો આગ્રહ સેવે છે. પણ તે ભયંકર ગેરવ્યવસ્થા ઉભી કરે છે, અને તમારે દરેક વસ્તુની ફરીથી શરૂઆત કરવી પડે છે.

આંતર અસ્તિત્વોની, આંતર પ્રદેશોની સાધના ઘણા લોકોએ કરી છે, તેને વિસ્તારપૂર્વક સમજવવામાં આવો છે, કેટલાક લોકોએ તેની પદ્ધતિની રૂચના કરી છે, તેના માર્ગો અને અવસ્થાઓ શોધી કાઢવામાં આવ્યાં છે, અને તમે એક અવસ્થામાં બીજી અવસ્થા જાઓ છો, તમને એમ લાગતું હોય છે કે એ એમ

જ હેવું જોઈએ. પણ જ્યારે તમે શરીરમાં નીચે ઉત્તરે છો, ત્યારે તે એક કુમારી વન જેવું હોય છે. દરેક વસ્તુ નવેસરથી કરવાની લેધ છે, દરેક વસ્તુનું નિર્માણ કરવાનું હોય છે. એટલે તમારે ખૂબ ધોરજ ધારજ કરવી જોઈએ. તમને સાધિના કરતાં ખૂબ સમય વાગે છે, તેથી તમારે તમારી જાતને નકારી ન માનવી જોઈએ. તમારે કદી નિરદશ ન બનવું જોઈએ, એમ કે ઓહ; હું યોગ કરી શકું તેમ ન કહેવું જોઈએ. જો માણસ હોગમાં જરૂરી સમય ગાળે, હિમન રાખે, જરૂરિયું અને અંત રાખે, તો દરેક જણ યોગ કરી શકે. કદી હિમન ન ગુમાવે, નિરાશ ન બનો, એની એ જ વસ્તુ દશપાર, વીસવાર, સ્થા વાર કરવા માટે નોયારી રાખે, કાસ્તવિક એઠે તે સિલ્ડ થાય ત્યાં સુધી મંદ્યા જ રહો.

ધર્મીયાર માણસને એમ લાગતું હોય છે કે જો જ્યું જ ન થાય, કામ જુદું ન થાય, તો તે માણસે કશું જ કર્યું નથી એમ મનમાં.

\*

## ૬ જુલાઈ ૧૯૪૮

ધર્મ એવો દાવો કરે છે કે ભગવનની સત્તા વડે, પ્રેરણા વડે, પરમાત્માએ આપેલી કદી ભૂત ન કરી સર્વ સત્તા વડે સત્તનો નિર્ણય કરવાનો મને અધિકાર મળ્યો છે. ચર્ચા કે પ્રશ્ન કર્યા સિવાય, ધર્મ માનવના વિચાર પર, લાગણી પર, આચાર પર પોતાની જાતને હોકી બેસાધ્વાનો પ્રયત્ન કર્યો છે. પ્રેરણાએના પ્રયાસોનો અનિવાર્ય લક્ષ્ય વડે તે પોતાના અધિકારને પ્રમાણિત કરવા માટે છે; મનની અજ્ઞાન સ્થિતિમાં, શાંકાચેમાં, નબળાઈમાં, અનિશ્ચિતતાઓમાં આત્મામાંથી આવેલા શૂદ્ધવાદી પ્રકાશમાં અને શક્તિમાં શક્તા રાખવાની તે માગણી કરે છે, શક્તાની જરૂરિયાત સમજવે છે. શક્તા માણસ માટે અનિવાર્ય છે, કરણકે શક્તા સિવાય તે અજ્ઞાન પ્રત્યેની પોતાની યાત્રામાં આગળ જઈ શકતો નથી. પણ શક્તા ઉપરથી કદાવી ન જોઈએ; તે મુક્ત દર્શના તરીકે અથવા અંતરાત્માની અનિવાર્ય આશા તરીકે આવવી જોઈએ. જો માણસનો આધ્યાત્મિક પ્રયાસ ઉચ્ચતમ ઋતચેતના પ્રયોગ પરિપૂર્ણ અને અજ્ઞાની માનવિક તથા ગ્રાલિક સંમિશ્રાસ્થી તદ્દન મુક્ત

પ્રગતિ સિદ્ધ ફરે, તો જ પ્રશ્ન કર્યા સિવાય ધર્મનો તે દાવો સ્વીકાર્યે શકાય. આ આપણી સમજ આખરી ધ્યેય છે, પણ તે હજુ સિદ્ધ વધું નથી, અને ધર્મના તે સમય પહેલાં કરાયેલા દાવાઓ મારુસમાં રહેલી સાહિત્યક ધાર્મિક વૃત્તિના સાચા કાર્યને અસ્પષ્ટ બનાવી દીધું છે. તે ધાર્મિક વૃત્તિએ માનવને દિવ્ય વાસ્તવિકતા પ્રત્યે દોડી જરૂરનો છે, અત્યાર ચુંચી માલસે જે ઝાંઢ સિદ્ધ કર્યું છે તેને તે દિવ્ય વળાંક આપવાનો છે, અને દરેક માનવ પ્રાણીને આધ્યાત્મિક શિસ્તનો ઘાટ આપવાનો છે, દિવ્ય સત્યની નજીક જવાનો તેનો સંપર્ક કરવાનો જોખ કરવાનો માર્ગ બનાવવાનો છે, જે માર્ગ માનવના સ્વભાવની શક્યતાઓ મોટે હોય હોય."

( દિવ્ય જીવન, પૃષ્ઠ ૮૬૩-૬૪ )

મધુર માતાજી, અંગત પ્રેરન વડે કાલ્યામાં વુદ્ધિ કર્યે શકાય.

શ્રદ્ધા એ ભગવાનની કૃપાએ આપણું આપેલી દેણ છે. તે સનાતન સત્ય પ્રત્યે દોડી જતું, ઓચિતું ખુલ્લી જતું દ્વાર છે, જેની દ્વારા આપણે સત્યને જોઈ શકીએ, તેનો સંસ્પર્શ પ્રામ કરી શકીએ.

જેમ દરેક વસ્તુમાં હોય છે તેમ, માનવજાતના આરોહણમાં ખાસ કરીને શરૂઆતમાં અંગત પ્રયત્નની જરૂર છે. કેટલાક અપવાદૃપ સંજોગોમાં, આપણી બુદ્ધિને બિલકુલ ન સમજાય તેવાં કારણોસર, શ્રદ્ધા એકદમ ઓચિતી, આપણે ન માગી હોય તો પણ, અનયેકિત રીતે આવતી હોય છે. પણ ધર્મી વાર તો, તે એક આરંભોનો, જરૂરિયાતનો, અભીષ્ટાનો, અસ્તિત્વમાં કોઈક તત્ત્વની શોધનો, ઉત્કાંઠાનો પ્રત્યુત્તર હોય છે જો કે તે ખૂબ સચેતન રીતે અને પદ્ધતિપૂર્વક આપતો હોતો નથી. તે ગમે નેમ હોય પણ જ્યારે કાલ્યા આવે છે, જ્યારે સાધકમાં ઓચિતો પ્રકાશ પ્રામ થાય છે, ત્યારે તેને સક્રિય ચેતનામાં સતત સાચવી રાખવા માટે, અંગત પ્રયત્ન અનિવાર્ય હોય છે. માણસે પોતાની કાલ્યાને પકડી રાખવી જોઈએ, સંકલ્પપૂર્વક તેને બોલાવવી જોઈએ, તેની જોખ કરવી જોઈએ, કેળવવી જોઈએ, તેનું રક્ષણ કરવું જોઈએ.

માનવ મનમાં એક રોગિષ્ઠ, શોચનીય ટેવ હોય છે, અને તે શંકા કરવાની, દલીલ કરવાની, નાસ્તિકતાની. ત્યાં જ માનવ પ્રયાસને મૂકી આપવાનો હોય છે. તે પ્રયાસ આ રીતનો હોવો જોઈએ, શંકાને, દલીલને, નાસ્તિકતાને સ્વીકારવાનો

ઈન્કાર કરવો, તેમની વાતો ન સાંભળવી, તેમને ન અનુસરવું. શંકા અને નાસ્તિકતા સાથે માનસિક રીતે રમત કરવી તેના કરતાં બીજી કોઈ રમત વધારે જેખમકારક નથી. તે ગ્રહ વસ્તુઓ માત્ર શત્રુઓ જ નથી, તેઓ ભયંકર પતનના ખાડાઓ છે. એકવાર માણસ તેમાં પડે, પછી તેને માટે બહાર નીકળવું એ ઘણું મુશ્કેલ બની જાય છે.

કેટલાક બોકો માને છે કે વિચારો સાથે રમત કરવી, તેમની ચર્ચા કરવી, તેમની શક્તાનો અસ્વીકાર કરવો એ એક ખૂબ મહાન માનસિક સુંદરતા છે. તેઓ એમ માનતા હોય છે કે આથી અને અમારું ખૂબ ચઢિયાતું વલાલ પ્રાપ્ત કરીએ છીએ, આ રીતે અમે અતાવીએ છીએ કે અમે વહેમાથી અને અજ્ઞાનથી પર છીએ. પણ જે તમે શંકાનાં અને નાસ્તિકતાનાં સૂચનાં સાંભળ્યો, તો તમે ખૂબ સ્થૂલ અજ્ઞાનમાં ગંભીર પડ્યો અને સાચા માર્ગથી દૂર ચાલ્યા જશો, તો તમે ગુંચવાડામાં પ્રવેશશો, ભૂલમાં, વિરોધિની લુલભુલામહૂરીમાં ફસાઈ જશો. તેમાંથી તમે બહાર આવી શકશો એમ તમે ખાતરીપૂર્વક નહિ કહી શકો. આંતર સત્યથી તમે એટલા બધા દૂર ચાલ્યા જશો કે તમને તે દેખાતું જંધ થઈ જશો, અને કેટલીક વાર તો તમારા આત્મા સાથેના શક્ય સંપર્કને પણ ગુમાવી દેશો.

બેશક, પોતાની શક્તાને જાળવા રાખવા માટે, શક્તા અંદર વૃદ્ધિ પામે તેટલા માટે, અંગત પ્રયાસ જરૂરી છે. ઘણા લાંબા સમય પછી, જ્યારે આપણે એક દિવસ ખાણ નજર નાંખીશું, ત્યારે આપણું જણાયે કે કાઈ બન્યું હતું જે આપણું ખરાબમાં ખરાબ લાગ્યું હતું તે પણ ભગવાનની કૃપા હતી, જે આપણું માર્ગ પર પ્રગતિ કરવા માગતી હતી. ત્યારે આપણું સમજાય છે કે અંગત પ્રયાસ પણ ભગવાનની કૃપા હતી. પણ તે સિદ્ધતિઓ પહોંચતા પહેલાં, માણસે ખૂબ પ્રગતિ કરવી પડે છે, ખૂબ સંધર્ષ કરવો પડે છે, કેટલીક વાર ખૂબ સહન પણ કરવું પડે છે.

જડ નિષ્ઠિતામાં બેસવું અને કહેવું કે “જો મને શક્તાની જરૂર હશે, તો તે મને મળી રહેશે. ભગવાનની કૃપા મને તે આપશે,” એ આગસતું વલાલ છે; અચેતનતાનું અસદ લાવનું વલાલ છે.

આંતર જ્યોત પ્રજ્વલિત થાય તે માટે માણસે તેને પોષણ આપવું જોઈએ માણસે અર્જિનનું નિરીક્ષણ કરવું જોઈએ; પોતે લેમને દૂર કરવા માગતો હોય તે

બધી ભૂલેનો તેમાં હોમ કરવો જોઈએ; પ્રગતિમાં આવતા વિવિદોની, માર્ગને અંધકારમય બનાવતાર બધી વસ્તુઓની આહૂતિ આપવી જોઈએ. જો સાધક અભિનને પોષણ ન આપે, તો તે પોતાની અચૈતનતાની અને જડતાની રાખ નીચે હોલવાઈ જાય; અને પછી તો લક્ષણે પહોંચતા પહેલાં તેણે વર્ષે, જન્મો, સદીઓ ગાળવી પડે.

માણસ જેમ કોઈ ખૂબ-ખૂબ મૂલ્યવાન વસ્તુના જન્મની દેખભાગ કરતો હોય છે, તેમ તેણે પોતાની શક્યાની દેખભાગ કરવી જોઈએ, તેને નુકસાન પહોંચાડે નેવી બધી વસ્તુઓથી તેની કાળજીપૂર્વક રક્ખા કરવી જોઈએ.

પ્રારંભના અશ્વાનમાં અને અંધકારમાં, શક્યા ભગવાનની શક્તિની ખૂબ સીધી અભિવ્યક્તિ છે, જે યુદ્ધ કરવા અને વિજય પ્રાપ્ત કરવા આવતી હોય છે.

\*

## ૧૯ જુલાઈ ૧૯૫૮

વર્ષનું ચાચું કામ માણસના મનને, પ્રાણને, અને શારીરિક અસ્તિત્વને આધ્યાત્મિક ચેતનાનો સ્વીકાર કરવા માટે તૈયાર કરવાનું છે. તેણે માનવને તે બિદ્ધુએ વર્ષ જ્વાનો છે, જ્યાં આંતર આધ્યાત્મિક પ્રકાશ પરિપૂર્ણ રીતે ઉદ્ય પામવાની શરૂઆત કરે છે. તે બિદ્ધુએ ધર્મ પોતાની જતને ગૌણ બનાવતો બનાવતાં શિખવાનું છે, તેણે બાધ લક્ષણો પર ત્યાં આગ્રહ રાખવાનો નથી, પણ આંતરાત્માને પોતાનું સત્ય અને વાસ્તવિકતા વિકસાવવા માટે પૂરો અવકાશ આપવાનો છે. તે દરમિયાન, તેણે માણસની માનસિકતાને, પ્રાણિકતાને, અને શારીરિકતાને હાથમાં લઈને, માણસની સર્વ કિયાઓને આધ્યાત્મિક દિશામાં વળાક આપવાનો છે, તેમાં આધ્યાત્મિક અર્થનું 'પ્રગટીકરણ' કરવાનું છે, આધ્યાત્મિક સંસ્કૃતિની છાપ આપવાની છે, આધ્યાત્મિક ચારિત્યની શરૂઆત કરવાની છે. આ પ્રયાસમાં ધાર્મિક ભૂલો આવી પડતી હોય છે, કારણકે ધર્મ જેની સથે કામ પડે છે તે વસ્તુનો સ્વભાવ જ તે ભૂલો પેદા કરતો હોય છે. તે નિમ્ન કોટિનું તરબ તે રૂપો પર આક્રમણ કરે છે, જે રૂપોએ આધ્યાત્મિક ચેતના અને માનસિક, પ્રાણિક, શારીરિક

ચેતનાની વચ્ચે વરગાળાનાં તરવો તરીકે સેવા બજાવવાની છે. ધર્મિવાર તે નિમ્ના ક્રોટિનું તત્ત્વ તે ગ્રણેયને અવનત, દુષ્પિત બનાવી મૂકે છે. પણ આ પ્રયત્નમાં જ, આત્મા અને પ્રકૃતિ વચ્ચેની કહી રૂપે, ધર્મનો મોટામાં મોટો ઉપયોગ હોય છે. માનવ ઉત્કાન્નિતમાં સત્ય અને ભૂલ હમેશાં સાથે સાથે જ રહેણાં હોય છે. તેની સાથે ભૂલો છે એટલા માટે અત્યનો ઈન્ડાર ઉત્ત્વાનો નથી, જો કે તે ભૂલોને દૂર તો કરવાની જ હોય છે. જો ગ્રામ્ય રીતે તેમ કલ્યામાં આવે, તો ભૂલોને દૂર કરવી એ કઠિન કામ હોય છે; તે ઘણી વાર ધર્મના દેહને શર્ખાંકિયા કરતાં થતી ઈજા પહોંચાડે છે, કારણકે આપણે જેને ભૂલ રૂપે જેતા હોઈએ છીએ તે ઘણી વાર કઠોર શર્ખાંકિયા કરતી વખતે ગુમાવી દેવાયેલા સત્યનું ચિહ્ન અથવા ઢાક પિછોએ અથવા દૂષિતતા અથવા ખોટી રૂપના હોય છે ભૂલની સાથે સત્યને પણ કાઢી નાખવામાં આવ્યું હોય છે. પ્રકૃતિ લાંબા સમય સુધી, સામાન્ય રીતે, સારા અનાજના દાસ્તાની સાથે સાથે કાંટાને અને નિંદામણને ઉગવા દેતી હોય છે, કારણકે તે રીતે જ પ્રકૃતિની ઉત્કાન્નિત વૃદ્ધિ થક્ય હોય છે.”

(દિવ્ય જીવન, પૃષ્ઠ ૮૬૪-૬૫)

મધુર માતાછ, સામાન્ય માનવીના જીવનમાં ધર્મ શું જરૂરની વસ્તુ હોય છે?

એક રીતે જેનાં જીવનમાં તે એક જરૂરિયાત છે, કારણકે તે સામુહિક અહેંતા પર અંકુશ મૂકે છે. તે અંકુશ વગર સામુહિક અહેંતા ખૂબ વધ્યો જાય.

સામુહિક ચેતનાનો સ્તર હમેશાં વ્યક્તિગત ચેતનાના સ્તર કરતાં નીચું હોય છે. દા.ત. જ્યારે માણુસો મોટી રાંખ્યામાં એકદા મળતો હોય છે, ત્યારે ચેતનાનું સ્તર બધું નીચે જતું હોય છે. ટોળાંગી ચેતના વ્યક્તિત્વની ચેતના કરતાં ઘણી નિમ્ન પ્રકારની હોય છે. સમાજની સામુહિક ચેતના તેનાં ઘટક વ્યક્તિઓની ચેતના કરતો ઘણી નિમ્ન હોય છે.

યાં ધર્મની જરૂર છે. સામાન્ય જીવનમાં, માણુસ જાણતો હોય કે ન જાણતો હોય, પણ માણુસને ધર્મ હોય છે, પણ તેના ધર્મનો હેઠું નિમ્ન પ્રકારનો હોય છે, તે જે દેવની પૂજા કરતો હોય છે. તે સફળતાનો અથવા પૈસાનો દેવ હોય, સત્તાનો દેવ હોય, અથવા માત્ર કુટુંબનો, બાળકોનો, પૂર્વજીનો દેવ હોય છે. પણ હમેશાં ધર્મ હોય છે ખરો, બહિત અનુસાર, ધર્મની ગુણવત્તા બિનન બિનન

હોય છે. જીવન જીવવા માટે, તેમાં ટકી રહેવા માટે, માણસને એવા કોઈ ગ્રારં-  
ભિક આદર્શની જરૂર પડતી હોય છે, જે તેના અસ્તિત્વનું કેન્દ્ર બની શકે. ધર્મની  
વાર તો તે પોતે તે વાત જાણતો હોતો નથી. જો તેને પૂછ્યામાં આવે કે તમારો  
આદર્શ શો છે? તો તે તેનું સ્પષ્ટ વર્ણન નહિ કરી શકે. પણ તેને કોઈ અસ્પષ્ટ  
આદર્શ હોય છે જરૂર, જે તેને જીવનમાં ખૂબ પરિપૂર્ણ વસ્તુ માગતી હોય છે.

ધર્મા વોકેની જાણતમાં તે સવામની માટે સ્વીકારયેવા હોય છે, જેથી તે જીવનમાં  
ટકી શકે. તે એક સૌથી મહાન હેતુ હોય છે, બસ્ત્ય હોય છે, જેને માટે તે પ્રયત્ન  
કરી રહ્યો હોય છે. કેટલાક વોકેને આજીવાસન મહત્વની વસ્તુ વાગતી હોય  
છે, જ્યારે કેટલાક વોકે ધર્મને એક મજા પડે તેવી વસ્તુ માનતા હોય છે.

તે બધું બહુ નિમ્ન કેટિનું હોય છે; તેને 'આદર્શ' એવું નામ આપવાનું  
મળ ન થાય. પણ તે સાચી સીતે જેતાં ધર્મ એક ઇપ હોય છે, એવું કાઈક હોય છે  
જેને પોતાનું જીવન સમર્પિત કરી દેવાનું યોગ્ય મનાય એવી ધર્મની અસરો હોય છે, જે  
ધર્મના નામે માનવો ઉપર પોતાની જતને વાદદારી હોય છે. રાજકારણી અથવા ધાર્મિક  
જૂયો માણસો પર અસર પોદા કરવા માટે અસલામતીની અનિશ્ચિતતાની માળણીને  
સામન તરીકે ઉપરોગ કરતાં હોય છે. તે જૂયો આ વિચારોને સામન જનત્વાને  
રમત જેવતાં હોય છે.

દરેક રાજકારણી અથવા સામાજિક વિચાર કોઈ આદર્શની એક પ્રકારની  
નિમ્ન અભિવ્યક્તિ હોય છે, જે આદર્શ પ્રાથમિક અવસ્થાનો ધર્મ છે. વિચાર-  
શક્તિનો ઉદ્ય થતાં જે, માણસ રોજિરા પાશની જીવન કરતાં હર કષે કોઈક ઉચ્ચતર  
વસ્તુ પ્રત્યે જરૂર અલીપ્સા સેવવા લાગે છે; તેથી જે તેને જીવવા માટે શક્તિ  
અને શક્યતા મળતાં હોય છે.

અવભાસ, એમ કોઈ કહી શકે કે સમુદ્રો માટે જે છે તે વાત વ્યક્તિઓને  
પણ વાગુ પડે છે; તેમના આદર્શનું, ધર્મનું જેટલું મૂલ્ય હોય છે, તેટલું જે  
તેમનું મૂલ્ય હોય છે, અર્થાતું જે ધર્મને કે આદર્શને તેઓ પોતાના અસ્તિત્વનું  
શિખર બનાવતા હોય છે.

અવભાસ, જ્યારે આપણે ધર્મની વાત કરીએ છીએ, ત્યારે એમ જણાય છે  
કે દરેક માણસને પોતાનો ધર્મ હોય છે ( સ્વીકારયેવા ધર્મોમાંનો કોઈક એક )

ધર્મ) પછી ભલે તે માસુસ ને જાણતો હોય કે નહિ, પછી ભલે તે ઈતિહાસના મહાન ધર્મથી માનતો હોય. ભલે તે પોતાના ધર્મના સિદ્ધાંતોને જોગ્યો વે અને તેની વિધિ પ્રમાણે આચરણ કરે, પણ દરેક જાણ પોતાની રીતે જ તે સમજતો હોય છે અને કાર્ય કરતો હોય છે, પછી ભલે તે ધર્મનું નામ એક જ હોય, પણ તે બધાં વ્યક્તિત્વો માટે એક જ ધર્મ નથી હોતો.

આપણે કહી શકીએ કે આ અજ્ઞાત અને ઉચ્ચતમ પરમાત્મા પ્રત્યેની અભીષ્ટાની અભિવ્યક્તિ સિવાય માનવ જીવન બહુ કઠિન બની જાય. જો માનવ હદ્દ્યમાં કાંઈક વધારે સારી વસ્તુની આશા ન હોય, તો તેનામાં જીવાની શક્તિ ન આવે.

( મૌન )

પણ મુજલ રીતે વિચાર કરવાની શક્તિ બહુ થોડા લોકોમાં હોય છે, એટલે કોઈ ધર્મમાં જોહાનું એ વધારે સહેલું થઈ પડે છે. તેનો સ્વીકાર કરવો, તે ધાર્મિક સમુદ્દરયાના એક સભ્ય બનવું તે વધારે સહેલું હોય છે; પોતાને માટે અવગ સંપ્રદાય રચવો તેના કરતાં તે વધારે સહેલું હોય છે. એટલે માસુસ આ ધર્મનો હોય કે પેલા ધર્મનો, પણ તે માત્ર દેખાવ જ હોય છે.

\*

## ૨૩ જુલાઈ ૧૯૫૮

માતાજી, આ આંતર દર્શનાની શક્તિ કેવી રીતે વિકસાવી શકાય ?

આંતર દર્શનનો અનેક પ્રકારો હોય છે. તે માટેની શક્તિઓ આપણામાં રહેલી છે. તે હેમેશાં અમૃક પ્રમાણમાં સક્રિય હોય છે, પણ આપણે આપણામાં થઈ રહેલી વસ્તુઓ પર ધ્યાન આપતા નથી અને તેથી આપણે તેને જોઈ શકતા હોતા નથી.

બાળધૂંઘીઓની પીઠમાં, અસ્તિત્વના ઊંડાણમાં, સૂર્ય ચકની નજીક આવેલી ચેતનામાં એક પ્રકારની પૂર્વદર્શનની શક્તિ રહેલી છે; પણ તે વિચારોના રૂપમાં નથી

હોતી, પણ તે બાગસ્થીઓના રૂપમાં ઈન્ડ્રિયજન્ય સંસ્કરોની દર્શનામાં રહેલી હોય છે. દા. ત. જ્યારે કોઈ માલસ અમુક કામ કરવાનો નિશ્ચય કરે છે, ત્યારે તેનામાં એક પ્રકારની બેગેની થતી હોય છે, જે તે કાર્ય કરવાની ના પાડતી હોય છે. જો માલસ આ ગહનતર સૂચન પ્રત્યે ધ્યાન આપે, તો તે સાચું હોવાનું ભાન તેને થાય છે,

કું આવેગોની, પ્રાલિકમાંથી અને તેના કરતાં પણ વધારે નિમન ભાગોમાંથી આવતી ગતિઓની વાત નથી કરતી. પણ કેટલાક લોકોમાં એવું કાંઈક હોય છે, કે જે તેને વેગ આપે છે, સૂચન કરે છે, આગ્રહ કરે છે. જે વસ્તુઓ માગસ્થીઓની પીઠમાં રહેલાં સૂચનો હોય છે, જે અસ્તિત્વના બાગસ્થીમય ભાગમાંથી આવતાં હોય છે, તાં કરવાના કાર્યના નિશ્ચિન સૂચનો મળતાં હોય છે. આ આંતર દર્શનાના પ્રકારો છે, ઉચ્ચતર વૃત્તિના પ્રકારો છે, જેમને અવલોકન વડે અને તેમનાં પરિણામોનું અધ્યયન કરવા વડે, કેળવી શકાય છે, સ્વાભાવિક રીતે જ, તે કામ દિલની સરચાઈપૂર્વક, વિષયગત રીતે, પૂર્વગ્રહ વિના કરવું જોઈએ. જો માલસ વસ્તુઓને અમુક જ રીતે જેવા માગતો હોય, અને સાથે સાથે આવું અવલોકન કરતો હોય, તો તે બધું વ્યર્થ છે. જો તે વસ્તુ પોતાથી બહાર બનતી હોય, બીજી કોઈ વ્યક્તિમાં બનતી હોય, તે રીતે તેણે તે વસ્તુ જેવી જોઈએ.

આ આંતર દર્શનાનું એક રૂપ છે. મોટે ભાગે તે પ્રથમ પ્રગટ થતું હોય છે.

આંતર દર્શનાનું બીજું રૂપ પણ છે. પણ તેનું અવલોકન કરવું તે વધારે કઠિન છે, કારણકે જે લોકોને આવેગપૂર્વક નહિ, પણ તર્કખુલ્દ વડે વિચાર કરવોની ટેવ છે, જોઈ પણ કામ કરતા પહેલાં ડિડો વિચાર કરવાની ટેવ છે, તેમનામાં, અર્ધ અચેતન વિચારમાં; કારણમાંથી કાર્ય પ્રત્યે જવાની એક ખૂબ ઝડપી પ્રક્રિયા હોય છે, જે તમને તર્કની સમગ્ર રેખા જેવા દેતી હોતી નથી અને તેથી તે તર્કની પરંપરા છે એમ તમને બાળતું હોતું નથી; તે તદ્દન ઠણારી હોય છે. તે આંતર દર્શના છે એવો તમને જ્યાલ આવે છે, પણ તે આંતર દર્શના નથી હોતી. તે ખૂબ ઝડપી, અવચેતન, તર્ક વિચારણા હોય છે, જે સમસ્યાને ઉપાયી વધીને સીધી નિગમનો પર જતી હોય છે. આને આંતર દર્શના માની વેવાની ભૂલ ન કરવી જોઈએ.

મસ્તિષ્ણની સામાન્ય કામગીરીમાં, આંતર દર્શના, પ્રકાશના કિરણ એટે, ઓચિંથી જળકી આવતી હોય છે. જો માલસમાં માનસિક દર્શનાની શક્તિ થાકી

ધર્મી પણ હોય, તો તેને ભક્તિષ્ઠમાં પ્રકાશના કિરણના આવેજ પેઢે, કોઈક વસ્તુ બહારથી અયવા ઊર્ધ્વમાંથી આવતી લાગે છે, ને તર્ફબુદ્ધિથી તદ્દન સ્વતંત્ર હોય છે.

જ્યારે માણસ પોતાના મનને તદ્દન શાન્ત કરી શકતો હોય છે, તેને એકાગ્ર અને શાન્ત બનાવી શકતો હોય છે, તેનાં સામાન્ય કાર્યોને બંધ કરી શકતો હોય છે, મનને એક પ્રકારનું દર્પણ બનાવી શકતો હોય છે, જે દર્પણને, ટકાવી રાખેલો અને શાન્ત એકાગ્રતામાં, એક ઉચ્ચતર શક્તિ પ્રત્યે ધરવામાં આવેલું હોય છે, ત્યારે આ આંતરદર્શના સહેલાઈથી જોઈ શકાય છે. માણસ તેમ કરતાં પણ શીખી થકે છે. તેણે તે શીખવું જોઈએ, તે એક જરૂરી સાધના છે.

જ્યારે તમારે કોઈ પ્રશ્નનો ઉકેલ કરવાનો હોય, ત્યારે તમે મોટે ભાગે અહો (માતાજી પોતાની ભૂકુટિના મધ્યભાગનો અંગુલિનિર્દેશ કરે છે), સચેતન સંક દ્યના ફેન્ડમાં ધ્યાનને કેન્દ્રિત કરતા હો છો. પણ જો તમે તેમ કરો, તો તમે આંતર દર્શના સાથે સંપર્ક સાધી ન શકો. તમે તેમ કરવાથી સંકલ્પના, પ્રયાસના, અમૃત પ્રકારના શાન્તના ઉદ્ગમ સ્થાન સાથે સંપર્ક સાધી શકો અને તે પણ બાબુ લોનિક લેન્ટમાં. પણ જો તમારે આંતર દર્શનનો સંપર્ક સાધવો હોય, તો તમારે આને (માતાજી કિયાળ તરફ અંગુલિનિર્દેશ કરે છે) તદ્દન સ્થિર રાખવું જોઈએ. યથાશક્ય સહિત વિચારને બંધ પાડી દેવો જોઈએ, અને સમગ્ર માનસિક શક્તિને, મસ્તકના ગિરોભાગ આગળ અને બને તો તેથી પણ ઊર્ધ્વમાં, એક ખૂબ શાન્ત, ઊર્ધ્વમાં એકાગ્ર દર્પણ સમાન બનાવી દેવો જોઈએ. જો તમે તેમ કરવામાં સહૃદ થશો, કદાચ તેમાં થોડોક સમય પણ લાગે તો તમને હજી પણ કોઈ અજ્ઞાન પ્રદેશમાંથી તે દર્પણ પર પડાના પ્રકારના કિરણો દેખશો. તે કિરણો પોતાની જાતને એવા એક સચેતન વિચારમાં અભિન્યક્ત કરતાં હશે, કે જેને તમારા વિચારના બાકીના કોઈ પણ ભાગ સાથે કશે સંબંધ નથો, કારણકે તમે તેને શાન્ત બનાવી દ્યો હોય છે. તે બૌધ્ધિક આંતર દર્શનાની સાચી શરૂઆત છે.

તે સાધના છે, જેને તમારે અનુસરવાનું છે. લાંબા સમય સુધી પ્રયત્ન કરવા છતાં, માણસને તેમાં સહૃદતા ન પણ મળે. પણ જ્યારે માણસ પોતાના મનને શાંત અને એકાગ્ર દર્પણ બનાવવામાં સહૃદ થાય છે, ત્યારે તેને પરિણામ ચોક્કસ પ્રાપ્ત થતું હોય છે. વિચારના નિશ્ચિત રૂપમાં નહિ, પણ ઊર્ધ્વમાંથી આવતા પ્રકારના અનુભવના રૂપમાં, પછી જો માણસ તરત જ કિયાના જંજાવાનમાં ઝૂદી પડા વિવાય, ઊર્ધ્વમાંથી આવતા તે પ્રકારને ર્વીકારી શકે, શાન્તિપૂર્વક સ્વીકારી

શકે, અને તેને અસ્તિત્વમાં ડિંડે વ્યાપી જવા દે, તો થોડાક સમય પછી તે પ્રકાશ પોતાની જતને એક તેજોમય વિચારના રૂપમાં અથવા આહી (માતાજી હદ્દ્ય તરફ ઊંગુલિનિર્દેશ કરે છે) એક ખૂબ નિશ્ચિન સૂચના રૂપમાં અભિવ્યક્ત કરે છે.

સ્વાભાવિક રીતે જી, પ્રથમ તો આ શક્તિનો વિકસાવવી જોઈએ. પછી પરિણામ આવે તેનું તેણે અવલોકન કરવું જોઈએ, પરિણામો વચ્ચેનો સંબંધ જોવો જોઈએ; કથી પરસ્તુ આવી છે, કયી વસ્તુઓ વિકૃતિ પેદા કરી છે, સચેતન તર્ક વિચારણા વડે ચોતે તેમાં શું ઉમેર્યું છે, નિમનતર ઓછા વત્તા સચેતન સંકલ્પની દરમિયાનગીરીથી શું ઉમેરાયું છે તે બધાંતું અવલોકન કરવું જોઈએ. તેવો હર કાણે, રોજ રોજ, વારંવાર અભ્યાસ કરવાથી માણસે પોતાની આંતર દર્શનાને વિકસાવી શકે છે. તે વાંચા સમય માળી બે છે, તેમાં પ્રતારણાઓ હોય છે, ધૂપે સ્થાનેથી આકમણે થવાનો સંભાવ છે. માણસ પોતાની જતને છિન્ની શકે છે; પ્રગટ થવા ઈચ્છતા અવચેતન સંકલ્પોને આંતર દર્શના માની બે છે; ખુલ્લી રીતે જેમની સ્વોકૃતિ કરવામાં આવી ન હતી તે આવેણો સૂચના આપતા હોય છે; આમ અનેક પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય છે. માણસે તેમને માટે તૈયારી રાખવી જોઈએ. પણ જે તે ખંતપૂર્વક તેમાં મંદ્યો રહે, તો તે જરૂર સફળ બને છે.

પછી એવો એક સમય આવે છે, કે જયારે માણસને આંતર દોરવણી મળતી હોય છે, તેને દરેક કાર્યમાં માર્ગદર્શન આપતું કાંઈક દેખાવા લાગે છે. પણ તે દોરવણીને વધારેમાં વધારે બળ મળે તે માટે, માણસે સ્વાભાવિક રીતે જી તેમાં સચેતન સમપર્યાને ઉમેરવું જોઈએ; ઉચ્ચતર શક્તિ જે સૂચન આપે તેને દિલની સચ્ચાઈપૂર્વક અનુસ્તરપાનો તેણે નિશ્ચય કરવો જોઈએ. જો માણસ તેમ કરે, તો તેને વર્ષો સુધી અભ્યાસ કરવો પડતો હોતો નથી, તેને જરૂરી પરિણામ પ્રાપ્ત થાય છે. જાણે તે દિલની સચ્ચાઈપૂર્વક કરવું જોઈએ, એક પ્રકારના આંતર સ્વયંભૂપ્રાણાથી કરવું જોઈએ. જેવી રીતે માણસ, સમપર્યા કર્યા સિવાય, પોતાના અંગત સંકલ્પને વિકસાવી શકે છે અને તેને એક ખૂબ સમર્થ શક્તિ બનાવી શકે છે, તેમ સમપર્યા ભાવ વિના, જે માણસ આ કરવા પ્રયત્ન કરે, તો તે કદાચ સફળ થાય, પણ તેનાં ખૂબ સમય લાગે છે, તેમાં ઘણા વિધનો આવે છે, અને પરિણામ બધું અચોક્કસ હોય છે. માણસે આગ્રહી, જરૂરી, ખંતિલા બનવું જોઈએ; તો તે જરૂર સફળ થશો, પણ ઘણા વાંચા પરિણામ પછી.

તમે સાચા દિલનું, પરિપૂર્ણ સમર્પણ કરો; તો તમે ખૂબ જરૂરી પ્રગતિ સાધી શકશો; પણ તમારે તે જ્ઞાનતરીજાળથી ન કરવું જોઈએ, કારણકે તેથી સધળી બાજુ બગડી જાય છે!

(મૌન)

તમે જીવનમાં ગમે તે વસ્તુ કરવા માગતા હો, પણ પાયામાં એક વસ્તુ અનિવાર્ય છે, અને તે ધ્યાનને એકાગ્ર કરવાની શક્તિ. જે તમે એક બિંદુ ઉપર તમારા ધ્યાનનાં અને ચેતનાનાં કિરણેને એકાગ્ર કરી શકો, તે એકાગ્રતાને આગ્રહી સંકલ્પ વડે ટકાવી રાખી શકો, તો ખૂબ ભૌતિક શારીરિક વિકાસથી માંડીને તે ઉચ્ચતમ આધ્યાત્મિક વિકાસ સુધીમાં, કોઈ તમને તુકાવટ ડાલી નહિ શકે. પણ આ સાધના સતત અને અનિકિષ્ણ રીતે કરવી જોઈએ. હું એમ કહેયા નથી માગતી કે તમારે એક જ વસ્તુ પર હંમેશાં એકાગ્ર થવું જોઈએ; હું એકાગ્રા શિખવાની વાત કરું છું.

અભ્યાસમાં, રમતરમતોમાં, સર્વ શારીરિક અથવા માનસિક વિકાસમાં એકાગ્રતા ખૂબ અનિવાર્ય છે. માસુસની એકાગ્રતા ઉપરથી તેની કિમત અંકાય છે.

આધ્યાત્મિક દૃષ્ટિબિંદુથી જોતાં, એકાગ્રતા તેનાથી પણ વધારે મહત્વની છે. એકાગ્રતાની વૈધક શક્તિનો પ્રતીકાર કોઈ પણ આધ્યાત્મિક વિધન કરી શકતું નથી. દા.ત. એકાગ્રતાની ઉત્કટ, જરૂરી શક્તિ વડે યૈત્યમય અસ્તિત્વ શોધી શકાય છે, આંતર ભગવાનને સાથે એકતા સાધી શકાય છે; પણ તે કેમ કરવું તે માસુસે શીખવું જોઈએ.

માનવીય અથવા અતિમાનવીય ક્ષેત્રમાં એવું કશું જ નથી, કે હેઠળી ચાવી એકાગ્રતાની શક્તિ ન હોય.

તે શક્તિ વડે, તમે શ્રોષ કસરતબાળ, શ્રોષ વિદ્યાર્થી, શ્રોષ કલાકાર, શ્રોષ સાહિત્યકાર, અથવા શ્રોષ વૈજ્ઞાનિક બની શકો છો. દરેક જ્ઞાનમાં તે શક્તિનો નાનકડો પ્રારંભ તો હોય જ છે; પણ વોકો તે એકાગ્રતાની શક્તિને ખિલવતા હોતા નથી.

મધુર માતાજી, રહેન્ચેટનો ઉપયોગ કરવાથી કણ પ્રકારનાં બયોબે બોલાવો શકાય છે; તે તેવી રીતે કરવામાં આવે છે?

ઓહ, ઓહ! તમે સ્વરંભૂ બેખનની વાત કરો છો?

હા, માતાજી.

તેનો અધિક જે બોકો તે કરતા હોય છે તેમના ઉપર છે. કેટલીકવાર એહી બણો આવતાં જ હોતા નથી! તે રહેન્ચેટનો ઉપયોગ કરતાર બોકોનાં માનસિક અને પ્રાણીક આકંપનો હોય છે; સોમાંથી ૬૮ કિસ્સાઓમાં તો તે બોકોનો પોતાના અવચેતન વિચારો જ બહાર આવતા હોય છે. ૧ જે તે બોકો અદૃશ્ય સત્ત્વો સાથે સંપર્કમાં હોય, તો તે અનેક પ્રકારનાં હોય છે; તે કામ બહુ સલાહ ભરેલું નથી!

ખાતરીપૂર્વક એમ કહી શકાય કે, માણસો માને છે, તેવું તે નથી હોન્તું. માટે ભાગે માણસો મરી ગયેલા માણસના પ્રેતને બોલાવવા પ્રયત્ન કરતા હોય છે, પોતે જેમને ચાહતા હતા અને જેમની સાથે સંસ્પર્શ રાખવો તેમને જમતો હોય છે તેવાં સગાંવડાલાંને અથવા મિત્રને; તેમને તે બોકો ખૂબ મુખ્યાઈભરેલા પ્રશ્નો પૂછતા હોય છે. સદ્ગ્લાઙ્મે તેઓ પ્રેરોના વિશેપ કરવામાં સહનતા મેળવતા હોતા નથી.

આ દૃષ્ટિબિદ્ધથી, આપણે એમ કહી શકીએ કે જે મરી ગયેલી વ્યક્તિ સાથે તમારે જાડ અને સાચા દિલનો પ્રેમ હોય, અને જે તમે પૂર્ણા પ્રમાણમાં શાન્ત અને બળવાન હો, તો થોડા અથવા લાંબા સમય માટે તે પ્રેરન તમારા વાપુમંડળમાં પ્રાણીક રીતે આકાય લેવાનું પસંદ કરે. અને અર્થ એ થાય કે તમારી અને તેની વચ્ચે બહુ નિકટનો, સધન સંબંધ હતો; અને જે તમે એટલા બધા ભૌતિક્યાદી ન હો કે સ્વીધી માનસિક દર્શના પ્રાપ્ત ન કરી શકો, તો તમે તે વ્યક્તિ સાથે માનસિક સંપર્કમાં રહી શકો. પણ તે અપવાદનૃપ ગણાય, કારણુકે જે તમારું વાપુ મંડળ એટલું બધું શાન્ત અને બળવાન હોય કે જે સારી રીતે તમને રહાનું આપી શકે,

૧. પાછળથી માતાજીએ આ કથન ઉમેધ્યું હતું: “હું સોમાંથી ૬૦ ની વાત કરું છું, કારણુકે તેમાં અપવાહો હોય છે; હું કેટલાક અપવાહો નથ્યું છું; પણ તે એટલા બધા વિરસ હોય છે, કે તેમને વિષે ન જોખાવું તે બધારે સારું છે.”

તો મરી ગયેલા માણસનું પ્રેત તેમાં જાડ આરામ બેનું હોય છે, અને તેને વિક્ષેપ પમાડવો એ શારું નથી. તમારે માટે સારામાં સારી વાત તો એ છે કે તમારે તેને પ્રેમ વડે આવરી બેનું જોઈએ અને તેને શાન્તિમાં રહેવા દેનું જોઈએ.

એટલે, જો આ ગ્રામ્ય સાધન દ્વારા, તેની સાથે સંદેશાઓનો વ્યવહાર કરવો શક્ય હોય, તો પણ તે કરવો એ અયોગ્ય છે. પણ સદ્ગ્રાહી, જે બોકોમાં પ્રેતનું આકાય સ્થાન બનવાની શક્તિ હોય છે, તેમને આરામ કરતા તે પ્રેતને વિક્ષેપ કરવાનો હાસ્યાસ્પદ વિચાર આપતો હોતો નથી!

પણ આ આરોગ્યને હાનિકારક કુનૂહલનો પ્રયોગ કરતા હોય છે, તેમને તેનું યોગ્ય ફળ મળી રહે છે, કારણકે આપણી આસપાસના વાતાવરણમાં અનેક નાના-કડાં પ્રાણિક તત્ત્વો રહેલાં હોય છે, જે અનુભૂત વાસનાને કારણે, નિમ્ન પ્રકારની પ્રાણિક જતિઓને કારણે, પ્રાણિક જગતનાં મહત્ત્વર સત્ત્વોના વિઘટનને કારણે, પ્રેત બન્યાં હોય છે; સાચે જી, વાતાવરણ તેવાં પ્રેતોથી ખદબદ્ધનું હોય છે. ઘણાખરા બેસ્કો આ પ્રાણિક વાતાવરણમાં શું બની રહ્યું છે તે જાણતા નથી, તે એમનું ચોક્કસ એક રક્ષણ છે, કારણકે તે ખાસ આર્નાઇલ્સ નથી હોનું. પણ જો તેમને તેના સંસર્ગમાં આવવાની ધૂષ્ટતા હોય, અને તેઓ ખેન્ચેટનો અથવા ટેબલ-લિમનનો પ્રયોગ કરે, ખરાબ કુનૂહલ દ્વારા, તો એનું કોઈ પ્રેત અથવા તો પ્રેતનું જ્ઞાય તેમને બાગે મજા લુંટે છે, તે બોકોના અવચેતન મનમાંથી અનેક જરૂરી સૂચના એકત્રિત કરે છે, અને તેમને સ્પષ્ટ સાબિતી તરીકે રજૂ કરે છે કે તમે જે માણસને બોલાવ્યો હતો તે અમે છીએ!

આવી વાતો પર હું એક પુસ્લાક લખી શકું તેમ છું, એટલા બધા દ્વારા લાખ-લા હું જાણું છું, કારણકે બોકો આવી વસ્તુઓ કરવામાં ખૂબ અભિમાન બેના હોય છે, અને તેમને તરત લખી બેના હોય છે, એવા હાસ્યાસ્પદ અનુભવોને સત્યની સાબિતી તરીકે રજૂ કરતા હોય છે કે તરત જાણાઈ આવે કે કાંઈક સત્ત્વ તેમની મજાક કરી રહ્યું હતું! એક ખૂબ તાજેતરનો જી દાખલો આપું, એક માણસે એવી કલપના કરી લીધી હતી કે હું કી અર્વિંદ સાથે સંપર્કમાં પ્રવેશયો છું, અને તેમના તરફથી મને ખૂબ આશ્રમનક પ્રગટીકરણો પ્રાપ્ત થાય છે. તે વાત ખૂબ હાસ્યાસ્પદ હતી.

પણ મોટે ભાગે તો તે તમારાં જી બળો હોય છે, તમારાં અવચેતન માનસિક અને પ્રાણિક બળો હોય છે, જેમને તમે ખેન્ચેટમાં મૂકી આપતા હો છો,

અને તમારી જત સમકાં આશ્ર્યકારક પ્રગટીકરણો કરતા હો છો! આ માર્ગ માણસ ઘણી વસ્તુઓ કરી શકે છે. એક વાર મેં માણસો આગળ સાબીન કરવા ઈરદ્ધા કરી કે તમે તમારી જતને જ બોલાવતા હો છો. એટલે મેં જરાક ગમ્મત કરી. માત્ર સંકલપની એકાગ્રતા વડે ફર્નિચર પર ખડક કર્યા, ટેબલોને ચલાવ્યાં. અને સ્વર્ણ બેખન માટે તો તમારે માત્ર તમારા સચેતન સંકલપને તમારામાં બોલાવી બેબાનો હોય છે, આમ (અભિનય કરીને) તમારા હાજરે છુંદો દીર આપવાનો હોય છે, એટલે હાથ ગતિઓ કરવાનો પ્રારંભ કરશે. પણ તેમાં તમારામાંના કોઈક નાનકડા ભાગને રસ પડતો હોય છે, આ ગતિઓનો કોઈક અર્થ નીકળો એવું તેને ગમતું હોય છે, તે નાનકડો ભાગ અવચેતન મનને અપીલ કરતો હોય છે, અને તે મન આશ્ર્યજનક પ્રગટીકરણો પેદા કરતું હોય છે. સાચે જ, તે એક ભાગકોને છેતરવાનું પાંજરું છે. સિવાય કે માણસ તેને વૈજ્ઞાનિક રીતે કરે; પણ ત્યારે તો તેને વૈજ્ઞાનિક રીતે ખબર પડી જાય છે કે એ વસ્તુમાં કાંઈ માલ નથી. તે તો રસપ્રદ રીતે સમય પસાર કરવાની વાત માત્ર છે.

કેટલાક કિસ્સાઓમાં પ્રાણિક તત્ત્વો સાચે જ તમારા પર પકડ જમાવે છે, અને તે બધું જોગમકારક છે. પણ સદ્ગુરીએ આવા કિસ્સાઓ વિરલ હોય છે. પણ તે બધું જોગમકારક હોય છે.

ખૂબ સમય પહેલાં, જ્યારે હું ફ્રાન્સમાં હતી ત્યારે, હું એક માણસને ઓળખતી હતી, જેણે આ પ્રકારના પ્રયોગો દ્વારા પોતાની જતને એક પ્રાણિક સત્ત્વને હવાબે સોંપી દીધી હતી. તે માણસ જુગારી હતો. તે સંદૂ જેલતો હતો અને જુગાર રમતો હતો. વર્ષનો અમુક ભાગ તે મોનટે કાલેંદ્રમાં ગાળતો હતો. ત્યાં તે જુગાર રમતો હતો. વર્ષનો બાકીનો ભાગ તે દક્ષિણ ફ્રાન્સમાં ગાળતો હતો. ત્યાં તે સ્ટોક એક્સિયેન્જ પર સંદૂ જેલતો હતો. કોઈક સત્ત્વ તેનો ઉપયોગ કરી રહ્યું હતું. તે સ્વર્ણ બેખન દ્વારા તેનો ઉપયોગ કરતું હતું. વર્ષો સુધી તેણે તેને નિશ્ચિન્ત સૂચનો આપ્યા. જ્યારે તે જુગાર રમતો, ત્યારે તે તેને કહેતું કે આ નંબર પર અથવા આ સ્થાન પર રમ; અને તે માણસ જતી જતો. સ્વાભાવિક રીતે જ, આરાં આશ્ર્યકારક પ્રગટીકરણો આપનાર તે સત્ત્વને તે પૂજવા લાગ્યો. એક્સિયેન્જ આગળ તેણે તેને કહ્યું કે આના પર સંદૂ જેલ. તેણે તે માણસને બધાં સૂચનો આપ્યાં. તે માણસ ખૂબ શ્રીમંત બની ગયો. જે રીતે પોતે શ્રીમત બન્યો હતો તે બાબત તે પોતાના મિન્નો આગળ આત્મશલાઘા કરતો હતો.

કોઈકે તેને ચેતવ્યો કે સાવધાન રહેજો, આ બહુ પ્રામાણિક લાગતું નથી; આ સત્ત્વ ઉપર તરે વિશ્વાસ ન મુકવો જોઈએ. તે માણસ તેની સાથે જધડી પડ્યો. થોડાક દિવસ પછી તે મોન્ટે કાલેમાં ગયો. તે ખૂબ મોટી રૂમો પર સાઢો જેલતો હતો, કારણકે તે હંમેશાં બાળ મારી જતો હતો. લોકોને લાગ્યું કે તે બેન્ક તોડી નાંખશો. બધા તેનાથી ડરતા હતા. પછી યેવા સત્ત્વે તેને કલ્યું કે તમારી પાસે જે કાઈ છે તેને હોડમાં મૂડી સાઢો જેલ. તેણે તેમ કર્યું, અને એકી ઘડકે તે બધું ગુમાવી બેઠો! પણ સ્ટોક એકચેન્ઝના સંટુના થોડાક પેસા તેની પાસે હજુ રહ્યા હતા. તેણે મનમાં કલ્યું કે આ મારું કમનસીબ છે. ઇથી તેને નિશ્ચિત સૂચન મળ્યું કે આમ કર. તેણે તેમ કર્યું, અને તે તદ્દન સાફ થઈ ગયો. કામ પૂરું પાતાવવા માટે, તે સત્ત્વે તેને મજાકમાં કલ્યું કે હવે તું આત્મહત્યા કરવાનો છે, તારા માથામાં પિસ્ટોલની ગોળી છોડ. તે સત્ત્વની અસર તેના પર ખૂબ હતી. તેણે તેમ કર્યું. આ વાતની આ રીતે કગુણ અંજામ આવ્યો. આ એક સત્ય ઘટના છે. એટલે ઓછામાં ઓછું એમ તો કલી થકાય કે એ બહુ જોખમકારક છે, આ પ્રકારનાં કામોમાં ન પડણું તે વધારે સારું છે.

આવાં કામ કાં તો બુદ્ધિહીન મનોરંજનો છે અથવા તો અતરનાક વ્યાપારો છે.

માતાજી શ્રી અરવિંદે ‘યોગિક સાધન’ નામનું પુસ્તક આ રીતે લખ્યું હતું.

ના, ના, તે બોટી વાત છે. તમારે વસ્તુઓમાં ગુંચવાડો પેદા ન કર્યો જોઈએ, તો તે તદ્દન જુદી જ વાત હતી. શ્રી અરવિંદ જાણતા હતા કે પોતે કોની સાથે સંપર્કમાં છે. તે તેમણે વિચારપૂર્વક કર્યું હતું. તેમણે પણ દર્શી કરીને તે માણસનો સંપર્ક સાધ્યો હતો. તે માણસને આ પ્રાણિક સત્ત્વે, જેમને વિપે છું વાત કરી છું તેમની સાથે કંઈ જ બેવાટેવા ન હતી. તે હકીકત તો સીધી રીતે માનસિક જગતમાં બની હતી. તમારે વસ્તુઓમાં ગોટાળો ન કરવો જોઈએ. આ જેને કાઈ જ સંબંધ નથી.

(મૌન)

જે માણસમાં નિષ્ક્રિતાની અમૃત સ્થિતિમાં જવાની શક્તિ હોય, આવડત હોય, જ્ઞાન હોય, કાબૂ હોય, તો તે બહુ સહેલાઈથી પોતાના હાથને, બહુ વિચારપૂર્વક, બીજાને સોંપી દઈ શકે છે. તે જાણતો હોય છે કે તે બીજો માણસ કોણું

છે, ને ઉચ્ચતર ભૂમિકા પર આર્થિક રહેલા હોય છે. પણ તેને માટે ખૂબ ચેતના અને ખૂબ આત્મપ્રભુત્વ જોઈએ, ને દરેક માણસને સુવલલ નથી હેઠાં. અમુક ભૂમિકા પર, પોતે કોણી સાચે કામ પાડી રહ્યો છે તે જોઈ શકવા માટે, માણસમાં ખૂબખૂબ આંતર વિકાસ થયેલા હેવા જોઈએ. તે જાણ્યા પછી, પોતે શું કરી રહ્યો છે તેના મૂર્ખ જ્ઞાન સાચે, કાબૂ ગુમાવ્યા સિવાય, તેણે રાજ્યપુણીશી પોતાની જત તે પ્રયોગ માટે તે બીજી વ્યક્તને સોંપવી જોઈએ. દરેક જણ તેની સાચે રમત ન કરી શકે, પણ ખેન્ચેટમાં તો માણસે આત્મપ્રતારણ જ કરવાની હોય છે અને ખેન્ચેટ શરૂ કરવાનું હોય છે.

માતાજી, તમે અત્યારે ને કહી રહ્યા હો, તે ગુઢ વિદ્યાઓનો એક ભાગ છે?

એ તો માત્ર પ્રયોગ કરવા માટે હતું. બસ,

(મૌન)

સામાન્ય નિયમ તરીકે, તે અભિગમનો સારો માર્ગ નથી, કારણકે આંતર કોનમાં, આંતર વિકાસના પ્રદેશમાં તે નવલકૃથાઓ વાંચવાની જરૂરિયાત જેવી વાત છે. ને બોકોનાં મન પૂરો વિકાસ પામેલાં હોતાં નથી, જેમનાં મન હજુ તમોગુણમાં હોય છે, અર્થાત્ હોય છે, તેમને જગૃત થવા માટે નવલકૃથાઓ વાંચવાની જરૂર લાગે છે. તે કોઈ પ્રશંસનીય સ્થિતિનું, કોઈ ઉચ્ચ સ્થિતિનું ચિહ્ન નથી. આંતર વિકાસના કોનમાં, આ વાત નવલકૃથાના વાચન જેવી છે. જ્યારે માણસ બહુ પ્રાથમિક સ્થિતિમાં હોય છે, જ્યારે તેને ઉત્કટ આંતર જીવન નથી હોતું, ત્યારે તેને નવલકૃથાઓ વાંચવાની અથવા નવલકૃથાઓનું સર્જન જરૂર પડે છે, ત્યારે તે આ પ્રકારના પ્રયોગોમાં પડે છે, અને માને છે કે હું બહુ રસપ્રદ વસ્તુઓ કરી રહ્યો છું. આમાં નવલકૃથાઓ જેવો જ રસ હોય છે. સાહિત્યક નવલકૃથાઓ નહિ, પણ સોંધી પ્રશ્નાય કથાઓ, ને સમાચાર પત્રોના છેલ્લે પાંને છિપાતી હોય છે.

ક્રી અરવિંદે મને કહું હતું કે કેટલાંક બોકોને આની જરૂર હોય છે, કારણકે તેમનાં મન બહુ જરૂર હોય છે, અને આ તેમને જરાક જગૃત કરે છે! તે એ જ વસ્તુ છે. કેટલાંક બોકોને, પોતાના ઊંઘતા, જરૂર પ્રાણીકને જરાક જગાડવા માટે, આ પ્રકારની કસરતોની જરૂર હોય છે. આ તેમને જીવનમાં જરા રસ પેદા કરે છે; પણ એમ તો ન જ કહી શકાય કે આ બહુ મૂલ્યવાન વ્યાપારો છે, તે માત્ર મનોરંજન છે.

આણે કોઈ પણ માણસ આગળ કોઈ પણ વસ્તુ સિદ્ધ કરી નથી. કોઈક એમ કહે કે “ઓછ, આ તો આંતર જીવન છે, અહૃષ્ટિગોચર જીવન છે; તે તમને અહૃષ્ય વસ્તુઓ ચાચે સર્વક્રમાં મૂકી આપે છે, અને તમારી સમક્ષ સાખીત કરી આપે છે કે, તે અસ્તિત્વ ધરાવે છે.” પણ તે સાચું નથી.

જ્યાં સુધી તમારામાં આધ્યાત્મિક સત્ત્વ ન હોય, જે જગૃત થવા અને પોતાનું જીવન જીવા સર્વથી છે, ત્યાં સુધી આ બધી વસ્તુઓ તમને કર્શું જ શિખવાડતી હોતી નથી. હું કેટવાક માણસોને ઓળખું છું. તેમાં ખાસ કરીને એક વૈજ્ઞાનિક હતો. તે બુદ્ધિશાળી હતો. તેનામાં સાચી આવડત હતી. તેણે ઉચ્ચતર વિજ્ઞાનોનું અધ્યયન કર્યું હતું. તે એન્જિનિયર બન્યો હતો. તેને સારી નોકરી મળી હતી. તે એક પ્રેતવાદી સંસ્થાનો સભ્ય હતો. તે સંસ્થામાં માણસ એવું માધ્યમ હતો, કે જેનામાં ખૂબ અસાંધારણ શક્તિઓ હતી. તે એન્જિનિયર શિખવા માટે, અહૃષ્ય જગત છે અને તેને સિદ્ધ કરવા માટે પ્રમાણભૂત સાખીતિઓ છે એની પોતાની જાતને ખાનરી કરવી આપવા માટે બધી પ્રયોગોની બેઠકમાં હાજરી આપતો. તેણે બધું જ ખૂબ કદક સંયમપૂર્વક, ખૂબ વૈજ્ઞાનિક ઢબથી જેણું હતું. બધા પ્રયોગો, નાનામાં નાની વીગતપૂર્વક, કરવામાં આવ્યા હનાં. તેણે મને ખૂબ અસાંધારણ વસ્તુઓ વિષે વાત કરી, જે નેણે પોતે જોઈ હતી. મારા હાથમાં એક ખાસિટકના કપડાં જેવો કટકો હતો જે વણવામાં આવ્યો ન હતો. તે સમયે ખાસિટકની શોધ થઈ ન હતી. મારા હાથમાં મેં તે કટકો આમ પકડ્યો. તે ફાટેવો હતો. તેના પર એક સુંદર ડિઝાઇન હતી. તેણે મને આ કેવી રીતે બન્યું તે કર્યું. જયારે માધ્યમને મૂર્ખાઈમાં મૂકી દેવામાં આવ્યો, ત્યારે આ કપડાનો જલ્દીએ પહેરેવો એક માણસ તેની સમક્ષ આવ્યો. એ એક ભૌતિકીકરણ હતું. તે જડ જેવો માણસ તેની આગળથી પસાર થયો. એવા એન્જિનિયરે સાખીતી તરીકે તે કપડાનો કટકો ફૂઝી લીધો હતો. તેણે તે પોતાની પાસે રાખ્યો હતો. માધ્યમે ચીસ પાડી, અને બધું જ તરન અહૃષ્ય થઈ ગયું. પણ કટકો તેના હાથમાં રહ્યો. તેણે તે મને આપ્યો. મેં તે કટકો તેને પાછો આપ્યો. તેણે તે મને માત્ર બતાવ્યો હતો. મેં તેને મારા હાથમાં પકડ્યો હતો.

તે વસ્તુ તદ્દન સધન હતી, કારણકે કટકો હજ તેની પાસે હતો. તેને તે ભ્રાન્ત કણી શકે તેમ ન હતું. આવી અનેક વાતો, કે જેમનું એક પુસ્તક જની શકે, હોવા છાંં, તે કર્શું જ માનતો ન હતો! તે કર્શું જ સુમજાવી શકતો ન

હતો. તેને આક્રમ્ય થતું કે હું પાગવ છું કે પછી આ બધા બીજા બોકો આ વસ્તુઓને તેના જ્ઞાનમાં કશી મદદ કરી ન હતી, પ્રગતિમાં એક ડગલું પણ આગળ વધ્યો ન હતો.

જ્યાં સુધી માસુસ પોતામાં આ વસ્તુઓનું વહન ન કરે, ત્યાં સુધી તે તેમને માની ન શકે.

બાબુ સાબીતીઓ કદ્દી કશું જ જ્ઞાન આપી શકતી નથી. જ્યારે તમે પોતે જ અંદરથી વિકિતિત થયા હો છો, આ વસ્તુઓ સાથે સીધો આંતર સંપર્ક સાધવા સમર્થ બન્યા હો છો, ત્યારે તમને એ વસ્તુઓ પથાર્ય રીતે સમજાય છે. પણ ભૌતિક સાબીતીઓ તમને જ્ઞાન આપી શકતી હોતી નથી સિવાય, કે આ જ્ઞાન પ્રાપ્ત થવા માટે તમારું સત્ત સમર્થ બન્યું હોય.

એટલે, નિષ્કર્ષ એ છે કે આ પ્રકારનો પ્રયોગ તદ્દન વ્યર્થ છે. નેમનામાં આંતર સત્ત છે, તેમને છુવન એક દિવસ જગાડશે, અને જ્ઞાન માટે, જરૂરી તત્ત્વ સાથે તેમને સંપર્ક સધાવો આપશે.

હું આ વસ્તુઓને એક રોગિન કુતૂહલ ગણું છું.

\*

## ૬ એપ્રિલ ૧૯૫૮

વહાલાં માતાજી, સામૂહિક પ્રાર્થનાનું મૂલ્ય, અસર શી હોય છે ?

સામૂહિક પ્રાર્થનાઓ માટે આપણે બોલી ગયા છીએ, તેમનો શો ઉપયોગ છે તે કહી ગયા છીએ. બુલેટિનમાં પ્રગટ પણ થઈ ગયું છે.

જેમ સમૂહો બિન્ન બિન્ન હોય છે, તેમ સામૂહિક પ્રાર્થનાઓ પણ બિન્ન બિન્ન હોય છે. કેટલાક અનામી સમૂહો, ટોળાં હોય છે, જે અક્સમાત સંયોગોથી એકઠાં થયાં હોય છે. તેમનામાં કોઈ આંતર સંગઠન નથી હોતું, સંયોગોના બળથી તે એકત્રિત થતાં હોય છે. દા. ત. જ્યારે કોઈ રાજ અથવા માસુસ, જે જાહેર જનતાનું ધ્યાન જેંચે તેવો હોય, તે માંદો પડે, કોઈ કટોકટીની સ્થિતિમાં આવી પડ્યો

હોય, તેને કોઈ અક્ષમાત થયો હોય, ત્વારે બોકો તેના સમાચાર જાણવા એકદા ભજ્યા હોય અને પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માગતા હોય તેમનામાં પોતાની લાગણીઓ વ્યક્ત કરવા સિવાય બીજી કોઈ કરી કે રસ હોતાં નથી. જેનામાં પોતાને રસ હોય તે માણસ સાજે થઈ જાય તે માટે, તેઓ એકદા મળીને પ્રાર્થના કરે છે. અવભાત, આ ટોળાં બીજા કોઈ હેતુ માટે પણ એકઠાં મળતાં હોય છે, દ્વેષને વર્દિને, અને તેમની બૂમ્યે પણ એક પ્રકારની વિરોધી અને સહંકાર બળોની પ્રાર્થના હોય છે.

આ ગતિઓ સ્વર્યંબૂ હોય છે, અચિત હોય છે, સંગઠિત નથી હોતી.

કેટલીક વ્યક્તિઓ કોઈ એક વિચારની, ઉપદેશની, અથવા પોતે અમૃત કામ કરવા માગતા હોય તેની આસપાસ એકેકી મળવી હોય છે. તેમનામાં એક જ સંગઠન કારક હેતુની કરી હોય છે, તેમનામાં એક જ પ્રકારનો સંકલ્પ અથવા શક્તા હોય છે. આ બોકો પણે સામૂહિક પ્રાર્થના અને ધ્યાન કરવાની પદ્ધતિ હોય છે. જે તેમનું લક્ષ્ય ઉચ્ચ હોય, સંગઠન સારું હોય, આદર્શ શક્તિશાળી હોય, તો પ્રાર્થના અને ધ્યાન દ્વારા તે બોકો જગતની ઘટના ઉપર, પોતાના આંતર વિકાસ ઉપર, અને સામૂહિક પ્રગતિ ઉપર ધંથી અસર ઉપજવી શકે છે. આ જૂથો બીજા સમૂહો કરતાં અધિક હોય છે. પણ તેમનામાં ટોળાંનું અંધ બળ નથી હેતું, સામૂહિક કાર્ય નથી હેતું, તે ઉન્કટતાને સ્થાને તેઓ વિચારના અને સ્વેતન સંગઠનના બળને મૂડી આપતા હોય છે.

પુષ્ટ્યી પર, સર્વ સમયોમાં, આ રીને સંગઠિત થયેલા સમૂહો હોય છે. તેમાંના કેટલાંક જૂથોને ઐતિહાસિક જીવન હતું, જગતમાં ઐતિહાસિક કાર્ય હતું; પણ અપવાદરૂપ વ્યક્તિઓ કરતાં તેઓ જન મેદની સાથે વધારે સફળ બની શક્યા નથી. તેમના પર શોકાઓ ઉલ્લી થઈ હતી, આકમણો થયાં હતાં, અત્યાચારો કરવામાં આવ્યા હતા; અને ધાર્યોવાર તેમને પાથવી શીંગે, અસપણ શીંગે અખ્યાન ભરી શીંગે વિઝેશી નાંખવામાં આવ્યા હતા. કેટલાંક અર્ધ ધાર્મિક, અર્ધ વીરતાવાળાં જૂથો હતાં, જે એક માન્યતા અથવા સંપ્રદાયની આસપાસ એકત્રિત થયાં હતાં, અને જેમને એક નિશ્ચિત લક્ષ્ય હતું; જગતમાં તેમનો ઈતિહાસ ખૂબ રસપ્રદ હતો. તેમણે, પોતાના વ્યક્તિગત પ્રયાસ દ્વારા, સામૂહિક પ્રગતિ માટે ચોક્કસ ધારું કામ કર્યું છે,

એક આદર્શ સંગઠન છે. જો તેને પરિપૂર્ણ ચીતે સિલ્ડ કરવામાં આવે, તો ને એક શક્તિશાળી ઓક્તાનું સર્જન કરી શકે, જેમાં એક જ વિક્ષ્યવાળાં બધાં થટક તર્ફને સમાવેશ થયો હોય, જેમનામાં એક જ સંકલ્પ હોય, હેતુની, અભી-પ્રાણી, કાર્યની આ આંતર એકતરાને ખૂબ સુસંભત દેહ આપવા માટે પૂરા આંતર વિકાસવાળું હોય.

સર્વ સમયોમાં, દીક્ષાનાં કેન્દ્રોએ વત્તાઓછા પ્રમાણમાં આને માટે પ્રયત્નો કર્યો છે; સર્વ ખૂબલાદી પરંપરાઓમાં તેમને કાર્ય માટેના ખૂબ શક્તિશાળી સાધન તરીકે વસ્તુવવામાં આવ્યાં છે.

જે સમૂહ વિકિત જેટલી એકરૂપતા પ્રાપ્ત કરી શકે, તો તે વિકિતનાં જગતમાં અને કાર્યમાં વૃદ્ધિ કરી શકે.

મોટે ભાગે, વિકિતથોણો સમૂહ એકદો થાય છે, ત્યારે તેની ગુણવત્તા વિકિતની ગુણવત્તા કરતાં વધારે નિમ્ન લાય છે; પણ તેમનામાં પૂરતું અચેતન સંગઠન કરવામાં આવે, તો તેનું કાર્ય વિકિતના કાર્ય કરતાં અનેકગણ્ણું વધારે હોય.

\*

## ૧૩ એપ્રિલ ૧૯૪૮

વહાલાં માતાજી, ૧૯૪૩ ના જુલાઈ માસમાં તમે અમને કહ્યું હતું કે પોચ વર્ષ પછી હું તમને આધ્યાત્મિક જરૂર ૧ ઉપર પાછો આપીશ. તમે જે કહ્યું હતું તે હું બચી આપ્યો છું.

ખરેખર! તે રસપ્રદ છે!

(માતાજી બાળકનું આપેલું લખાણ વાંચે છે.) તે છિપાઈ ગયું છે?

માતાજી, ના, નથી છિપાયું.

૧. ૧૯૪૩ ના જુલાઈની ૧૫ મી તારીખની પ્રક્રિયાની જુલ્દી.

૨. અત્યારે તેનું નામ છે ‘પ્રભો અને હિતરો’ ૧૯૨૬.

ઓહ, મને આમાંનું છેલ્લું વાક્ય બહુ ગમે છે!

(થોડીકા વારના મૌન પછી) તમે મારી પાસેથી શી આશા રાખો છો?  
શરૂઆત કરવાની?

હા, માતાજી.

પણ મેં ક્યારનીએ શરૂઆત કરી દીધી છે, નહિ વારુ? અને તે પણ પાંચ  
વર્ષ પૂરાં થઈ ગયા પહેલાં! તે દિવસે મેં અહીં કાંઈક વર્ષયું હતું.

મધુર માતાજી, તે વાર્તાલાપોમાં લખેલું છે.

તેમાં તપસ્યા અને આધ્યાત્મિક જીવન વિષે જે ગૂંઘવાડો કરવામાં આવે છે  
તેને મેં લખેલું છે. ત્યારે મેં વચન આપ્યું હતું કે બોકો જેને ભગવાન કહે છે  
અને હું જેને દિવ્ય કહું છું તે બે વચ્ચેના ગૂંઘવાડા ઉપર હું બોલીશ.

પણ તેને વિષે તો હું ધસુદીવાર બોલી ચુકી છું, નહિ વારુ?

મને મારું આપેલું વચન યાદ રહ્યું ન હતું, પણ યાદ રાખ્યા સિવાય પણ  
મેં તે વચન પાળ્યું છે, અને તે પણ તે દિવસ આવતા પહેલાં!

હવે તમે મને જે કાંઈ નિશ્ચિત સવાલ પૂછ્યો, તો હું યથાશક્તિ તેનો  
જવાબ આપવા પ્રયત્ન કરીશ. તમે આધ્યાત્મિક જીવન વિષે શું જાણવા માગો છો?  
તમારે કોઈ ખાસ પ્રશ્ન પૂછવાનો છે?

માતાજી, તમે એવો અર્થ કરો છો કે તમે ધ્યાનોની શરૂઆત કરી દીધી છે?

હા, જે વાચન થાય છે તેની સમજૂતિઓ પણ હું આપતી રહી છું. વર્ગો-  
માં આધ્યાત્મિક જીવન જીવવા માટે, જરૂરી સાધના માટે, નાનકડા વર્ગમાં, આપણે  
ધ્યાનની પણ શરૂઆત કરી દીધી છે. જ્યારે મેં ધર્મપદ વાંચવાની શરૂઆત કરી,  
ત્યારે આધ્યાત્મિક જીવનના જ્ઞાન માટે આપણે ધસુદી વસ્તુઓ વાંચી હતી. પણ જે  
તમારે કોઈ મુદ્દા ઉપર કોઈ ચોક્કસ પ્રશ્ન પૂછવાનો હોય, તો પૂછો. હું જવાબ  
આપીશ.

મધુર માતાજી, આ આકામમાં રહેવાથી અમને જે લાલ થવો જોઈએ, તે  
કેમ નથી થતો?

આહ, તે ને બહુ સરળ વાત છે. તેનું કરાણ એ છે કે આશ્રમમાં રહેણું હોનું એ બહુ સહેલી બાજન છે. જ્યારે તમારે ગુરુની શોધમાં આખા જગતમાં પરિભ્રમણ કરવું પડતું હોય છે, જ્યારે બોધના પ્રથમ શબ્દો સાંભળવા માટે તમારે સર્વસ્વનો ત્યાર કરવો પડતો હોય છે, ત્યારે, જેમ કોઈ વસ્તુને પ્રામ કરવી કઠિન હોય છે ત્યારે તેનું મૂલ્ય સમજાય છે તેમ, એ બોધ અને આધ્યાત્મિક મદદ બહુ મૂલ્યવાન બની રહે છે; તમે તેને માટે યોગ્ય અધિકારી બનવા ખૂબ પ્રયત્ન કરો છો.

તમારામાંના ધ્યાનચરા એવી નાની ઉમરે અહીં આવ્યા હતા, કે જ્યારે આધ્યાત્મિક જીવનના અથવા આધ્યાત્મિક બોધના કોઈ સવાલ જ ઉપસ્થિત થઈ શકે તેથ ન હતું. તે વખતે તમે બહુ નાના હતા. તમે અહીંના વાતાવરણમાં રહ્યા છો, પણ તેની સભાનતા વિના જ. તમે મને જેવાથી, મારી વાતો સાંભળવાથી ટેવાઈ જ્યા છો. હું જેમ કોઈ બાળકો સાથે વાતો કરે તેમ, તમારી સપક્ષ બોલું છું. જેમ કોઈ બાળકો સાથે જેલે તેમ, હું તમારી સાથે જેલી છું, તમારે માત્ર અહીં આવીને જેસવાનું જ હોય છે, અને તમે મારી વાતો સાંભળના હો છો. તમારે માત્ર સવાલ પૂછવાનો હોય છે, અને હું તેનો જવાબ આપતી હોઈ છું, મં કોઈને કોઈ સવાલનો જવાબ આપવાની ના પાડી નથી. આ બધું બહુ સહેલું છે. તમારે માત્ર જીવવાનું, ઊંઘવાનું, ખાવાનું, વ્યાયામ કરવાનું, અને શાળામાં ભણવાનું જ હોય છે. તમે બીજે કયાંય પણ રહી શક્યા હોતું તેમ, અહીં રહે છો. તેથી તમે ટેવાઈ ગગા છો.

જે મેં કંડક નિયમો બનાવ્યા હોત, જે મેં એમ કહ્યું હોત કે “જ્યાં સુધી તમે જીવું માટે સાચો પ્રયાસ કર્યો નહિ હોય, ત્યાં સુધી હું તમને કાંઈ જ કહેવાની નથી,” તો તમે કદાચ કાંઈક પ્રયાસો કર્યા હોત; પણ હું તે વિચારની નથી. હું કંડક ઉપદેશની શક્તિન કરતાં વાતાવરણની અને હૃદાંતની શક્તિમાં વધારે માનું છું. પદ્ધતિસરના, અભ્યાસપૂર્વકના પ્રયાસ કરતાં હું સંપર્ક દ્વારા અસ્તિત્વમાં જગૃતિ આવે, તેમાં વધારે માનું છું.

કદાચ કોઈક વસ્તુની તૈયારી થઈ રહી છે, એક દિવસ તે સપાઠી પર બહાર દેખાયો. હું તેવી આથા રાખ્યું છું.

એક દિવસ તમે તમારી જતને કહેયો કે “જુવો તો ખરા. હું આટલા બધા વખતથી અહીં રહું છું. હું ધાણું ધાણું શીખી શક્યો હોત, ખૂબ સાધા-

તકાર કરી શક્યો હોન, પણ મને તેનો વિચાર જ ન આવ્યો! અવાર નવાર એવા વિચારો મને આવ્યા કરે છે.” તે દિવસે ઓચિતા તમે જગૃત થશો. જે વસ્તુ તમારામાં ઉડે ઉડે છે. પણ જેને તમે જોઈ ન હતી, તે સત્ય માટે તમારામાં તૃપ્તા જગશે. તે રૂપાંતર માટે તમારામાં તૃપ્તા જગશે, અને તે સિદ્ધ કરવા માટે તમે પ્રયત્ન કરશો; તે દિવસે તમે ભૂમાં ભડપી પ્રગતિ કરશો. હું ધારું છું કે કદાચ પાંચ વર્ષ પછી તે દિવસ આજે આવ્યો છે! મેં કહું હતું કે હું તમને પાંચ વર્ષ આપું છું. તે પાંચ વર્ષ લીતી ગાં છે. એટલે કદાચ તે દિવસ આવ્યો હોય એમ મને લાગે છે! કદાચ તમને ઓચિતું એમ લાગશે કે હવે મારે અચેતનતામાં, અજ્ઞાનમાં ન જીવનું જોઈએ. તે સિદ્ધિમાં તો તમે કારણ જાણ્યા સિવાય વસ્તુઓ કરતા હો છો, કારણ જાણ્યા સિવાય લાગણીઓ અનુભવતા હો છો; તમારામાં જિરેખી સંકલ્પો ઉક્તા લોય છે, કોઈ વસ્તુને તમે સમજતા હોતા નથી, માત્ર ટેન વડે, રોજિદા કાર્યક્રમ અનુસાર, પ્રતિક્રિયા વડે જીવતા હો છો. તમે જીવનને એક રમત લેવી સહીલી વાત ગણુંતા હો છો. પણ એક દિવસે તમને તેનાથી સંતોષ પ્રાપ્ત થતો હોતો નથી.

તે વાત દરેક જલ્દી માટે બિનન હોય છે. મોટે ભાગે તો તે જાણવાની, ચમજાવાની જરૂરિયાત હોય છે. કેટલાક લોકો માટે તે કરવા યોગ્ય વસ્તુ કરવાની જરૂરિયાત હોય છે. બીજા કેટલાક લોકોને એવી અસ્પષ્ટ લાગણી અનુભવાતી હોય છે કે આ અચેતન, વ્યર્થ, અર્થશૂન્ય જીવનની પીડમાં જોઈ એવી વાસ્તવિકતા છે, જેની શોધ કરવામાં ગણેલું જીવન ભાર્થક કરેવાય; આ અસત્યોની અને બ્રાનિતોની પીડમાં જોઈ સત્ય, વાસ્તવિકતા રહેલી છે.

માણસને ઓચિતું અનુભવાતું હોય છે કે “હું જે કંઈ કરી રહ્યો છું, જોઈ રહ્યો છું, તેનો કશો અર્થ નથી, હેતુ નથી, પણ એવી કોઈક વસ્તુ છે, જે અર્થયુક્ત છે. માણસ તે કોઈક વસ્તુ માટે આ પૃથ્વી પર આવ્યો હોય છે. આ ગતિઓ, આ પિણોલો, આ શક્તિનો બગાડ, આ બધાની પાઇળ કોઈક હેતુ લોવો જોઈએ, કોઈક લલા હોય જોઈએ.” આ અંદર અનુભવાતી જેણેની, આ સતોષનો અભાવ, આ જરૂરિયાત, કશાક માટેની આ તૃપ્તા માણસને બીજા કશાક પ્રાણે દોરી જ જવી જોઈએ.

એક દિવસ તમે તમારો જાતને પુછો છો કે “માણસ થા માટે જરૂર્યો છે? માણસ થા માટે ભરી જાય છે? માણસને થા માટે હુંબું આવતાં હોય છે? માણસ થા માટે કાર્ય કરે છે?”

પછી તમે અર્થચેતન ભિંનની પેઠે જીવના નથી. તમે સાચી રીતે લાગણી અનુભવવા, સાચી રીતે કાર્ય કરવા, સાચી રીતે જાણવા માગો છો. પછી સામાન્ય જીવનમાં, માણસ પુસ્તકોની શોધ કરવા માગો છે, પોતાનાથી વધારે જાણવા માણસની શોધ કરવા માગો છે, જે માણસ આ પ્રશ્નોનું સમાધાન કરી શકે, અજ્ઞાતનો પડ્દો હટાવી શકે તેવા કોઈક માણસની તે શોધ કરવા લાગે છે. અહીં આકાશમાં તે વાત બહું સહેલી હોય છે. તમે રોજ જે કામ કરતા હો છો, તે તમારે ક્યો જવાનું હોય છે, પણ તે હેતુપૂર્વક.

તમે સમાધિ પર જાઓ છો, શ્રી અરવિંદનો હોટો જુઓ છો, મારી પસેથી પુષ્પો વેવા આવો છો, પાઠ સાંભળવા બેસો છો. પણ આ બધું શા માટે? તે પ્રશ્ન મનમાં રાખીને તમે આ બધું કરતા હો શો.

પછી તમે પ્રશ્ન પૂછો, તો તમને જવાબ મળતો હોય છે. શા માટે?

કારણકે જીવન જે પ્રકારનું છે તેવું હવે આપણે માગતા હોતા નથી, આપણે હવે જુદાછું અને અજ્ઞાત ચલાવી વેવા માગતા નથી, આપણે હવે દુઃખ અને અચેતનતા માગતા નથી, હવે આપણે ગેરન્યુવસ્થા અને અસહ્યભાવ ચલાવી વેવા માગતા નથી, કારણકે શ્રી અરવિંદ આપણને કહેવા આવ્યા છે કે “ સત્યને શોધવા માટે પુષ્પવીનો ત્યાગ કરવાની જરૂર નથી, આત્માને જાણવા માટે જીવનનો ત્યાગ કરવાનો જરૂર નથી, ભગવાન સાથે સંપર્કમાં પ્રવેશવા માટે જગતનો ત્યાગ કરવાની અથવા મર્ગાદિત માન્યતાઓ રાજવાની જરૂર નથી. ભગવાન સર્વત્ર સર્વ વસ્તુઓમાં છે. જે તે નિગૂઢ હોય, તો તેનું કારણ એ છે કે આપણે તેમનો સાક્ષાત્કાર કરવાની જહેમત ઉઠાવતા નથી.”

માત્ર સાચા દિલની અભીષ્ટાથી આપણે આપણાનું બંધ બારણું જોવી દઈ શકીએ છીએ, અને એવી કોઈક વસ્તુ જોણી કાઢી શકીએ છીએ, કે જે જીવનનો સમગ્ર અર્થ પલટી નાંખશે, આપણા બધા સવાલોના જવાબ આપશે, આપણી બધી સમસ્યાઓનો ઉકેલ લાવશે, જાણ્યા સિવાય આપણે જે પરિપૂર્ણતાની અભીષ્ટા સેવીએ છીએ તેના પ્રત્યે આપણને દોરી જશે, જે એક જ આપણને સત્તોષ આપી શકે એમ છે, નિત્ય આનંદ, સમતા, બળ અને જીવન આપી શકે તેમ છે ને પરમ વાસ્તવિકતા પ્રત્યે દોરી જશે.

તમે આ બધું અનેક વાર સાંભળ્યું છે. અહીં કેટલાક એવા પણ છે, જેમણે તે વાત એટલી બધી વાર સાંભળી છે, તેનાથી તે એટલા બધા ટેવાઈ ગયા છે કે તમને તે પાણીનો ખાલો પીવા નેલું, પ્રકાશ અંદર આવે તે માટે બારી ખોલવા નેલું, સામાન્ય લાગે છે.

પણ મેં તમને વચ્ચન આપ્યું હતું કે પાંચ વર્ષમાં તમે આ વસ્તુઓ જીવી શકશો, તમને તેમની સંઘન, સાચી, આત્મિ આપે તેવી અનુભૂતિ થશે. પણ તેનો અર્થ એ થાય છે કે તમારે તૈયાર થચાનું છે, આપણે તેની શરૂઆત કરવાની છે.

આપણે થોડોક પ્રયત્ન કર્યો છે, પણ હવે આપણે ગંભીરતાપૂર્વક પ્રયત્ન કરવાના છીએ!

તેનું આરંભ બિંદુ આ છે કે તમારામાં તેની સાચી માંગ હોવી જોઈએ, તમને તેની જરૂરિયાત લાગવી જોઈએ. પછીનું પગલું આ છે કે બધી બીજી વસ્તુઓ કરતાં તમારે આનો જ જ્યારે વિચાર કરવો જોઈએ. એવો દિવસ જલ્દી આવે છે કે જ્યારે માણસ તેના સિવાય બીજો કોઈ વિચાર કરી શકતા જ નથી.

તે બંધુ મહત્વની વસ્તુ છે.

પછી માણસ પોતાની અભીષ્ટાને એક રૂપ આપે છે, પોતાના હૃદયમાંથી સાચી પ્રાર્થનાને ઉચ્ચવા દે છે, જે પ્રાર્થના તે જરૂરિયાતની દિલ સર્વચાઈ અભિવ્યક્ત કરતી હોય. પછી શું બનશે તે તે માણસ પોતે જ જોઈ શકશે. દરેક જીસુ માટે, તે જિન્ન જિન્ન રૂપ ધારણ કરશે.

બસ, તમે મને આ બોલવાનો અવસર આપ્યો તેથી હું રાજુ થઈ છું.

\*

## ૧૫ એપ્રિલ ૧૯૫૮

આ ટૂંકી વાર્તાવાપ શુફ્કવારે આપવામાં આવ્યો હતો, જ્યારે સામાન્ય રીતે ધૂમપદનું વાચત થતું હતું.

આજે શ્રી અરવિદનો જન્મ દિવસ છે. એટલે મને એમ વાગ્યું કે આજે ધર્મપદમાંથી વાયન કરવાને ભદ્રલે, મારે એવું કાંઈક વાંચવું, કે જે તમને રસપ્રદ થઈ પડે, અને દેવો સાથેના આપણા સંબંધનું શ્રી અરવિદ કેવી રીતે દર્શાન કરતા હતા તે તમને બતાવે.

તમે જાહોં છો કે ખાસ કરીને ભારતમાં દેવોના અસંખ્ય પ્રકારો હોય છે, જે બિનન બિનન ભૂમિકાઓ પર હોય છે. કેટલાક દેવો માનવની ખૂબ નિકટના હોય છે; બીજા દેવો પરમાત્માની ખૂબ નજીકના હોય છે. તેમાં વચ્ચગાળાની ભૂમિકા-ઓમાં પણ કેટલાક દેવો હોય છે.

જે હું પુરાણાના દેવોની વાત કરીશ, તો તમે તે બધું સહેલાઈથી સમજી શકશો. તે દેવો આપણે પહેલાં જે ફ્રિલ્મ જેઈ હતી તેમાં બતાવેલા દેવો જેવા છે, જે અમૃત બાબરોમાં માનવથી પણ નિમન ડોટિના છે, જે કે તેમનામાં માનવ કરતાં અર્નંતરગણી વધારે શક્તિ હોય!

અતિમનસના દેવો, અત્યાર સુધી, પૃથ્વીના મહાન સ્થાનો છે. વેદોમાંના દેવોનું કથન ઝાંખિઓએ કરેલું છે. અતિ મનસના દેવો હવે પૃથ્વી પર પ્રગટ થવાના છે જે કે યોતાની ભૂમિકાપર તેઓ શાશ્વત કાળથી અસ્તિત્વ ધરાવે છે.

અહીં શ્રી અરવિદ મોટે ભાગે વૈદિક દેવો વિષે કથન કરે છે. પણ તે ખૂબ નિશ્ચિત રીતે નહિ અથવા તો માત્ર તેમને જ વિષે નહિ. તે ગમે તેમ હોય, પણ તે દેવો પુરાણાના દેવો કરતાં ઉચ્ચતર છે.

શ્રી અરવિદ કહે છે તે આ છે. હકીકતમાં, તે એક પ્રાર્થના છે.

હે વરુણ, મારામાં વિશાળ બનો. હે ઈન્દ્ર, મારામાં શક્તિશાળી બનો. હે સૂર્ય, મારામાં ખૂબ પ્રકાશમય, તેજેમય બનો. હે ચંદ્ર, સુંદરતાથી અને મધુરતાથી પરિપૂર્ણ બનો. હે કુરુ, ભયંકર અને ભીષણ બનો. હે મદુતો, વેગવાળા અને જડપવાળા બનો. હે અર્યમા, બળવાન અને હિમતવાન બનો. હે અગ, ઉપભોક્તા અને આનંદદાયી બનો. હે મિત્ર, કોમળ, ભલા, પ્રેરુણ અને આવેગમય બનો. હે ઉધા, પ્રકાશયુક્ત અને પ્રગટ કરનારી બન. હે રાત્રિ, ગંભોર અને ગર્ભવતી બન. હે જ્ઞાન, પરિપૂર્ણ, તૈયાર અને ખુશમિજાળ બન. હે મૃત્યુ, મારાં પગલાંને એક ભવનમાંથી બીજા ભવન પ્રત્યે દોશી જ. હે બૃહસ્પતિ, આ બધામાં સંવાદ સ્થાપી આપો. હે કાલી, હું આ દેવોને પરાધીન ન બન્યું કરો.

એટલે શ્રી અરવિંદ કાવીને મહાન સુકિતદાયક શક્તિ માને છે, જે તમને પ્રગતિ પ્રત્યે ધક્કેલે છે, અને તમારામાં કોઈ બંધનો રહેવા દેતી નથી, જે બંધનો તમને પ્રગતિ કરવામાં બાધા પેદા કરે.

મને લાગે છે કે ધ્યાન માટે આ ચરસ વિષય છે.

( ધ્યાન )

\*

## ૨૭ એપ્રિલ ૧૯૫૮

મધુર માતાજી, જ્યારે તમે અમને ધ્યાન કરવાનું કહો છો, ત્યારે અમે પ્રકાશ પ્રત્યે ખુલ્લા થવા પર ધ્યાન કરવાનું પસંદ કરીએ છીએ. ત્યારે અમે અનેક પ્રકારની વિચિત્ર વસ્તુઓની કલ્પના કરતા હોઈએ છીએ, દા. ત. અમે ખુલ્લી જતા દ્વારની કલ્પના કરીએ છીએ. પણ તે હંમેશાં માનવિક રૂપ ધારણ કરતું હોય છે.

તે વ્યક્તિ પર આધાર રાખે છે. દરેક જાતની તેની ખાસ પ્રક્રિયા હોય છે. તે તદ્દન તે વ્યક્તિ પર આધાર રાખતી હોય છે. કેટલાક લોકોને કોઈક પ્રતીક મદદરૂપ બનાનું હોય છે. તેથી ઊંબરું, બીજાઓનું મન વધારે ભાવવાયક હોય છે; તે માત્ર વિચારોને જ જોઈ થકતું હોય છે. બીજા, લાગણીઓમાં જીવતા લોકોને માનવશાસ્ત્રીય જગતોએ, અંતર લાગણીઓનો, સંસ્કરોની જગતોએ પ્રાપ્ત થતી હોય છે. તે વ્યક્તિ પર આધાર રાખે છે જે લોકોનું મન સંક્રિય, રચનાત્મક, અને ભૌતિક હોય છે, તેઓ પ્રનિભિબો જોતા હોય છે; પણ દરેક જાતની અનુભૂતિ જુદી હોય છે. દા. ત. તમે તમારી જોડે બેઠેલા માલુસને પૂછો.... ( પાસે બેઠેલા બાળકને ) જ્યારે હું તમને કોઈ વિષય આપું દ્યું, ત્યારે તમે તે પ્રકારનાં મૂતોકરણો જોતા હો છો?

કેટલીક વાર.

કેટલીક વાર?

ધણી વાર મને કાંઈક અનુભવાય છે.

ધર્માવાર તે અનુભવાતી વસ્તુ શી હોય છે?

કોઈક લાગણી.

બરાબર માટે લાગે તો લાગણી જ અનુભવાતી હોય છે, મૂર્તીકરણ તો બહુ થોડી વાર, કેમનામાં રચનાત્મક માનસિક શક્તિ હોય છે, સક્રિય લૌઠિક મન હોય છે, તેમને હુમેશાં કોઈ મૂર્તીકરણ દેખાતું હોય છે, તે એમ સૂચવે છે કે તે માણસ પોતાની માનસિક ચેતનામાં સક્રિય છે.

(જેણે પહેલો પ્રશ્ન પૂછ્યો હતો તે બાળક) પણ તે બરાબર છે?

જેણું પરિણામ આવે, તે દરેક વસ્તુ બરાબર જ કહેવાય! કોઈ પણ સાધન સારું છે. તે શા માટે બરાબર ન હોઈ શકે? તે પ્રકારના મૂર્તીકરણો હાસ્યાસપદ નથી હોતાં. તે માનસિક મૂર્તીકરણો હોય છે. જે તેઓ કોઈ પરિણામ લાવી આપતાં હોય, તો તે તદ્દન યોગ્ય કહેવાય. જે તે તેમને અનુભૂતિ આપતાં હોય, તો તે યોગ્ય છે એમ કહેવાય.

દા. ત. જ્યારે હું તમને તમારામાં ખૂબ ઊંડે જવાનું કહું હું, ત્યારે તમારામાંના કેટલાક એક લાગણી પર એકાગ્રતા કરશે, પણ બીજા કેટલાકને એમ લાગણી કે જાણે અમે કોઈ ઊડા કૂવામાં, અંધારા કૂવામાં નીચે ને નીચે જઈ રહ્યા છીએ, અને દૂર દૂર, ઊંડે ઊંડે જતાં તેઓ છેવટે એક દ્વાર આગળ આવી પહોંચતા હોય છે. તેઓ અંદર પ્રવેશ કરવાના સંકલ્પ સાચે, તે દ્વાર આગળ નીચે બેસતા હોય છે. કેટલીક વાર દ્વાર ખુલ્લી જાય છે, અને તેઓ અંદર પ્રવેશ કરે છે. ત્યાં તેઓ કોઈ હોલ, અથવા રૂમ, અથવા ખુફા જુએ છે. જે તેઓ ત્યાંથી આગળ જાય, તો તેઓ બીજાં એક દ્વાર જુએ છે. તેઓ ફરી વળી ત્યાં બેસે છે. પ્રયત્ન-પૂર્વક દ્વાર ખુલ્લી જાય છે અને તેઓ આગળ વધે છે. જે આ ખંતપૂર્વક કરવામાં આવે, આગ્રહપૂર્વક કરવામાં આવે, અને જે તે માણસ તે અનુભૂતિને ચાલુ રાખી શકે, તો એક એવો સમય આવે છે, જ્યારે તે માણસ પોતાને એક પ્રકારના સધન, અથવા ગંભીર દ્વાર આગળ ઉલ્લિંબો જુએ છે. એકાગ્રતાના મહાન પ્રયાસ પછી તે દ્વાર ખુલ્લી જાય છે, અને તે માણસ ઓથિતો પોતાની જતને એક સ્પષ્ટતાપાળા, પ્રકારશમય હોલમાં પ્રવેશ કરતી જુએ છે. ત્યારે તેને આત્માનો સંપર્ક

૧. 'વિચારો અને સુતો' શાતાબ્દી અંથ ૧૭, પૃષ્ઠ ૮૫.

પ્રાપ્ત થયાની અનુભૂતિ થાય છે. પણ મને મૂર્તીકરણો જોવામાં, તે આવતાં હોવા-માં કશું ખરાબ લાગતું નથી.

પણ માતાજી, તે માત્ર કલ્પના હોય છે, નહિ વારુ ?

કલ્પના ? પણ કલ્પના શું છે ? તમે વિશ્વમાં જે વસ્તુ અસ્તિત્વમાં જ ન હોય, તેની કલ્પના કરી શકતા નથી ! કયાંય પણ ન હોય તેવી વસ્તુની કલ્પના કરવી અશક્ય છે. શક્યતા માત્ર એટલી જ છે કે, તે સ્થાને માલુસ પોતાની મૂર્તિ ન મૂર્તી આપે. માલુસ ડાં તો તેમાં એવા સદૃગુણો મૂર્તી આપે કે જે તેમાં નથી હોના. અથવા સાચી સમજૂતિથી જુદી જ ડોર્ઠ સમજૂતિ વડે તેને સમજાવે. પણ માલુસ જેની કલ્પના કરતો હોય છે, તે કયાંક તો અસ્તિત્વ ધરાવતું જ હોય છે. મુખ્ય વાત આ છે કે તે વસ્તુ કયાં છે તે જાણવું, અને તેને યોગ્ય સ્થાને મૂર્તી આપવી.

અલગત, તમે ઉધારા દ્વાર આગળ ઉભા છો એવી કલ્પના કર્યા પદ્ધતિ, જે તમે એવું માનો કે આ ઓક, તમારા શરીરમાં રહેલું, સાચું ભૌતિક દ્વાર છે, તો તે ભૂલ છે ! પણ જે તમે એમ માનો કે તે તમારી એકાગ્રતાના પ્રયત્ન વડે ઉત્પન્ન થયેલું માનસિક રૂપ છે, તો તે વાત તદ્દન સાચી છે. જે તમે માનસિક જગતમાં પરિભ્રમણ કરશો. તો તમને એવાં ખૂબ ખૂબ રૂપો દેખાશે, જેમને ભૌતિક વાસ્તવિકતા નથી હોતી, પણ જે માનસિક જગતમાં સાચું અસ્તિત્વ ધરાવતાં હોય છે.

જે તમારા વિચાર અમુક વસ્તુનું રૂપ ધારણ ન કરે, તો તમે તે વસ્તુ નિષે શક્તિપૂર્વક વિચાર કરી શકતા નથી. પણ જે તમે એમ માનો કે આ રૂપ શારીરિક હતું, તો તે સ્પષ્ટ રીતે ઓક ભૂલ છે; પણ માનસિક જગતમાં તે સાચે જ અસ્તિત્વ ધરાવતું હોય છે.

કલ્પના એ રચનાની શક્તિ છે. હકીકતમાં, કલ્પનાલીન માલુસો માનસિક દૃષ્ટિબિદ્ધિથી જેતાં, રચનાત્મક નથી હોતા; તેઓ પોતાના વિચારને સધન રૂપ આપી શકતા નથી. કલ્પના કર્યાનું ઓક ખૂબ પ્રબળ જાધવન છે. દા. ત. જે તમને શરીરમાં કથાંક પીડા થતી હોય, અને જે તમે કલ્પના કરો કે આ પાડાને હું

દૂર કરી દઉં છું, અદૃશ્ય બનાવી દઉં છું, તેનો નાશ કરી દઉં છું, આ પ્રકારનાં મૂત્રીકરણો કરો, તો તમે સંપૂર્ણપણે સફળ થઈ શકો છો.

એક વારી છે. એક લીના વાળ ખૂબ જડપથી ખરવા માંડ્યા હતા. યોડાંક અહવાદિયામાં તેને માથે ટાલ પડી જશે એમ લાગતું હતું. કોઈકે તેને કહ્યું કે જ્યારે તમે વાળ પર બ્રશ ફેરવો, ત્યારે એવી કલ્પના કરતાં રહે કે મારા વાળ ખૂબ જદ્દી ઉગી રહ્યા છે. રેણ્ઝ વાળ હોળતી વખતે તે બોલતી કે મારા વાળ ઉગી રહ્યા છે, તે ખૂબ જડપથી ઉગશે. અને તેમ જ બન્યું! પણ મોટે ભાગે માણસો એમ જ કહેતા હોય છે કે આહ, મારા વાળ ખરતા જાય છે; મારે માથે જરૂર ટાલ પહોંચો; એમ જ બનશે. અને તેમ બને જ છે!

માતાજી, શુક્રવારના વર્ગેમાં તમે ઘણી વાર એક વાક્ય વાંચો છો, અને પછી અમને તેના પર ધ્યાન કરવાનું કહો છો. પણ અમારે વાક્ય પર ધ્યાન કેવી રીતે કરવું? અમારે તેમાંના વિચાર પર ચિંતન કરવું, ધ્યાન કરવું? અમારે શું કરવું?

વાક્ય ઉપર ધ્યાન કરવું?

હા.

એ સ્પષ્ટ છે કે તમારે તેના અર્થ પર ધ્યાન કરવાનું છે.

અર્થાત, અમારે ચિંતન કરવું જોઈએ, વિચાર કરવો જોઈએ.

હા. પછી?

માતાજી, એ એક માનસિક કિયા થઈ જાય છે કે બીજું કાંઈક?

વાક્ય એ એક માનસિક રચના છે. માનસિક રચના કરવામાં આવતી હોય છે. વાક્ય માનસિક રચનાની અભિવ્યક્તિ છે. એટલે જ્યારે તમે વાક્ય પર ધ્યાન કરો, ત્યારે બે પદ્ધતિઓ છે. વાક્યમાંના શબ્દોનો જે અર્થ હોય તે તે બૌલ્ફિક રીતે સમજવાનો તેના પર ચિંતન કરવાનો પ્રયત્ન એ સક્રિય, સામાન્ય, બાબુ પદ્ધતિ છે. આ સક્રિય ધ્યાન છે. તમે આ યોડાંક શબ્દો પર એકાગ્રતા કરો છો, તે જે વિચારને અભિવ્યક્ત કરતા હોય તે વિચારને બોલો છો, અને તર્ક દ્વારા, નિગમન દ્વારા, પુષ્ટકરણ દ્વારા તેના અર્થને સમજવાનો પ્રયત્ન કરો છો.



## મન્દો અને ઉત્તરે

એક બીજુ પદ્ધતિ પણ છે, જે વધારે સીંહી અને ગહન છે. તેમાં તમારે આ માનસિક રચનાને, શબ્દોના સમૂહને તેમના અર્થે સાથે લો છો, તેના ઉપર તમે તમારી એકાગ્રતાની સર્વ શક્તિ કેન્દ્રિત કરો છો, તે રચના ઉપર એકાગ્રતા કરવા માટે તમારા સર્વ બળને ફરજ પાડો છો. દા. ત. શારીરિક રીતે તમે કોઈ દેખેલી વસ્તુ પર તમારી શક્તિઓને એકાગ્ર કરવાને બદલે, તમે તે વિચારને લો છો અને તમારા મનમાં તે વિચાર ઉપર તમારી સર્વ શક્તિઓ એકાગ્ર કરો છો.

પછી જે તમે વિચારને એકાગ્ર કરી શકો, તેને વિચલિત થવા ન દો, તો તમે શબ્દો વડે વ્યક્ત થયેલા વિચારની પીઠમાં રહેલા ‘વિચાર’ માં તદ્દન સ્વા-ભાવિક રીતે જ જાઓ છો, જે ‘વિચાર’ ને શબ્દોમાં પણ વ્યક્ત કરી શકાયો હોત, બીજા રૂપોમાં વ્યક્ત કરી શકયો હોત. તે ‘વિચાર’ નું લક્ષણ હોય છે પોતાની જાતને અનેક બિન્ન વિચારોમાં વ્યક્ત કરવાની શક્તિ. જ્યારે તમે આ સિદ્ધ કરો છો, ત્યારે તમે માત્ર શબ્દોને સમજવા કરતાં વધારે ઊડાણુમાં ચાલ્યા, ગયા હો છો, સ્વભાવિક રીતે જ, જે તમે એકાગ્રતા ચાલુ રહો અને તમને તેમ કરતાં આવડતું હોય, તમે તે ‘વિચાર’ માંથી તેની પીઠમાં રહેલી તેજીમય શક્તિ પ્રત્યે ચાલ્યા જઈ શકો છો. પછી તમે વધારે વિશાળ અને ગહન પ્રદેશમાં પ્રવેશ કરો છો. પણ તે અભ્યાસ માગી લો છો. પણ છતાંથે તે ધ્યાનનું મુખ્ય તત્ત્વ છે.

જે તમે ખૂબ ઊંડા જઈ શકો, તો તમે વિચારની પીઠમાં રહેલા તત્ત્વને અને શક્તિને જોઈ શકો; તે તમને સાક્ષાત્કારની શક્તિ આપે છે. જે લોકો ધ્યાનને આધ્યાત્મિક વિકાસના સાધન તરીકે આપનાવે છે, તે લોકો આ રીતે સર્વ વસ્તુ-ઓની પીઠમાં રહેલા તત્ત્વ સાથે એકતા સિદ્ધ કરી શકતા હોય છે, અને ઊર્ધ્વ-માંથી આ વસ્તુઓ પર કાર્ય કરવાની શક્તિ પ્રાપ્ત કરતા હોય છે.

આને માટે ખૂબ અભ્યાસની, લાંબા સમયની ટેવની જરૂર હોય છે. તમે તેટબે દૂર સુધી ન જઈ શકો, તો પણ વિચારમાંથી તમે ‘વિચાર’ પ્રત્યે તો સહેલાઈથી જઈ શકો છો. જે તમને મનમાં પ્રકાશ અને સમજ આપે છે, તમને તે વિચારને જમે તે રૂપમાં વ્યક્ત કરવાની શક્તિ આપે છે. ‘વિચારને’ અનેક રૂપોમાં, અનેક બિન્ન બિન્ન વિચારોમાં વ્યક્ત કરી શકાય છે, જેવી રીતે જ્યારે તમે વધારે ભૌતિક ભૂમિકા પર નીચે આવો છો. ત્યારે તમે વિચારને અનેક બિન્ન શબ્દોમાં વ્યક્ત કરી શકો છો. તેમ, બોલાયેલી અથવા લેખિત અભિ-

વ્યક્તિમાં, અનેક બિનન શબ્દો અને ફોર્મ્યુલાઓ હોય છે, જે વિચારને વ્યક્ત કરી શકે છે. પણ આ વિચાર વિચારનું એનું એક જ રૂપ હોય છે, જે, ‘વિચાર’ ને પીડમાં રહેલા ‘વિચાર’ ને વ્યક્ત કરી શકે. જે તે ‘વિચાર’ નું ઊંડાળુપૂર્વક અનુસરણ કરવામાં આવે, તો તેની પીડમાં આધ્યાત્મિક જ્ઞાનનું અને થકિતનું તરફ હોય છે, જે પ્રસારિત થઈને આવિજ્ઞાવ પર કાર્ય કરી શકે છે.

જ્યારે તમારી પાસે વિચાર હોય છે, ત્યારે તમે શબ્દોની શોધ કરતા હો છો અને પછી તમે તમારા વિચારને વ્યક્ત કરવા શબ્દોની ગોઠવણી કરવા માટે પ્રવત્ન કરો છો. તમે વિચારને વ્યક્ત કરવા ઘણા શબ્દોનો ઉપયોગ કરી શકો છો. તમે કહેના હો છો કે જે હું આ શબ્દને બદલે રહેલા શબ્દ મૂકું, તો તે મારા વિચારને વધારે સારી રીતે વ્યક્ત કરી શકે. તમને જ્યારે લેખનશીલી શિખ-વાહવામાં આવતી હોય છે, ત્યારે તમે તે શીખતા હો છો.

પણ જ્યારે હું તમને એક લેખિત વાક્ય આપું છું, જેનામાં વિચારને વ્યક્ત કરવાની થકિત હોય છે, અને તમને તેના પર એકાગ્રતા કરવાનું કહું છું, ત્યારે તમે આ વિચારરૂપમાંથી તેની પીડમાં રહેલા ‘વિચાર’ પ્રત્યે જરૂર શકો છો, જે ‘વિચાર’ ને અનેક બિનનિભિન્ન વિચારોમાં વ્યક્ત કરી શકાય. એ એક મોટી, ઉપર ને ઉપર ચઢતી જતી, નીસરણી જેવો કુમ હોય છે. સૌથી ઉંચે, શિખર પર, એક તરફ હોય છે; તમે તેનાથી પણ ઉંચે જરૂર શકો છો. તે તરફને ‘વિચારો’ માં વ્યક્ત કરી શકાય છે. તે ‘વિચારો’ ને અનેક વિચારોમાં વ્યક્ત કરી શકાય છું. તે વિચારો અનેક ભાષાઓનો અને શબ્દોનો ઉપયોગ કરી શકે છે.

જ્યારે હું તમને વિચાર આપું છું, ત્યારે તે માત્ર તમને એકાગ્રતામાં મદદરૂપ થવા માટે હોય છે. કેટલીક ધ્યાનની શાળાઓમાં, તે બોકો તમારી સામે મુખ્ય, પદ્ધત કે એવો કોઈ પદાર્થ મૂકતા હોય છે. તમે તેની આસપાસ બેસી જાઓ છો. અને તેના પર એકાગ્રતા કરવા માંડો છો. તમારી આંખો આવી બની જતી જોય છે. (માતાજી ગ્રાંસી આંખ કરે છે.) પછી તમે તે પદાર્થરૂપ બની જાઓ છો. તે પણ એક ધ્યાનની પદ્ધતિ છે. હલન ચલન કર્યા સિવાય, એકી ટસે તે પદાર્થને જોઈ રહેવાથી તમે તે વસ્તુરૂપ બની જાઓ છો. પણ તમારે બીજી બધી વસ્તુઓને ન જોવી જોઈએ, માત્ર સ્થિરતાપૂર્વક તે જ વસ્તુને જોવા કરવી જોઈએ. તે તમને એક દૃષ્ટિ આપે છે, તમે ગ્રાંસી આંખે જોતા હો છો.

આ બધું એકાગ્રતા શિખવા માટે છે.

કેટલીક વાર આણું કોઈ વાક્ય એક ખૂબ ગફન સત્યને વ્યક્ત કરતું હોય છે. તે એવાં સુખમય વાક્યોમાંનું એક હોય છે, જે ખૂબ અભિવંજક હોય છે. તે તમને તેની પીડિમાં રહેલા સત્યને શોધી કાઢવામાં મદદ કરે છે.

ધર્મપદનું વાચન પતી ગયા પછી, હું એ કરવાનો ઈરાહો રાખું છું. આપણે શ્રી અરવિંદનાં જે પુસ્તકો પ્રગટ કર્યા છે તેમાંના છેલ્લા પુસ્તક 'વિચારે અને સૂત્રો' નો અનુવાદ હું કરી રહી છું. હવેથી દર શુક્રવારે તેમાંથી હું એક વાક્ય કે સૂત્ર આપવાનો ઈરાહો રાખું છું. ધ્યાનના વિષય તરીકે જરૂરિયાત મુજબ તેના પર ટીકા કે ભાષ્ય અપાશે અથવા નહિ અપાય. આપણે કથી રીતે આગળ વધવું તે હજી વિચારવાનું છે. આપણે બે લિન્ન લિન્ન રીતો અપનાવી શક્યોએ. હું તે વિચારેને અથવા સૂત્રોને ક્રમપૂર્વક લેવાની છું. એટલે આવતે અઠવાડિયે ક્ર્યું વાક્ય કે સૂત્ર આપશે તે તમે પહેલેથી જાણ્યી શક્યો અને તેના પર પ્રશ્નો નૈયાર કરી શક્યો. એક વાક્ય લેવું, તેના ઉપર ધ્યાન કરવું, અને આવતે અઠવાડિયે તે પહેલાંના વાક્ય ઉપર તમારે પ્રશ્નો પૂછવા, એ વધારે રસપ્રદ બનશો. મને પૂછવામાં આવેલા પ્રશ્નોમાંથી હું સૌથી વધારે બુદ્ધિશાળી પ્રશ્નો પસંદ કરીશ. અને તેના જવાબો આપીશ. પછી હું નવું વાક્ય લઈશ, આપણે તેના પર ધ્યાન કરીશું, અને પછી તે અઠવાડિયે તેના પર સવાલ જવાબો થશે. આ હું એક યોગ્યકસ, નિશ્ચિત હેતુપૂર્વક કરવા માગું છું. હું તમારી માનસિક તંત્રામાંથી તમને જગાડવા માગું છું, હું કહું છું જે તેના પર વિચાર કરવાની અને સમજવા માટે પ્રયત્ન કરવાની તમને ફરજ પાડવા માગું છું. કશણુંકે, તે તમારા કાનમાં થોડોક અવાજ કરતું હોય છે, તમારા મસ્તિષ્કમાં તેથી પણ વધારે મૃદુ અવાજ કરતું હોય છે, અને પછી તે બીજી બાજૂથી પસાર થઈ જતું હોય છે. આ રીતે બધું પતી જતું હોય છે! કેટલીક વાર બહુ જ વિરબ, ખાસ કૃપા વડે, અહીં થોડોક અસર થતી હોય છે, આમ (અભિનય), જે જંખવાની જતી જ્યોતની ચેઠે થોડોક વાર જલતી રહે છે, અને પછી ફૂપ કરીને હોલાઈ જતી હોય છે! કશુંક તેના પર વાય છે, જ્યોત હોલવાઈ જાય છે, અને બધું પતી જાય છે.

મધુર માતાજી, અમારે પાછોની જરૂર છે.

જયારે તમે મને પહેલાં કશું હતું કે, મેં તમને પાછો આપવાનું વચન આપ્યું છે, ત્યારે મેં તે વાત ગંભીરતાપૂર્વક મન પર લીધી હતી. હું માગું વચન આપીશ,

## ૩ સપ્ટેમ્બર ૧૯૫૮

મધુર માતાજી, તમે મને એક દિવસ કલું હતું કે કલ્પનાને કેવી રીતે  
સંયમિત કરવી તે શીખવું જરૂરી છે

છ.

તે કેવી રીતે કરી શકાય ?

કલ્પના એક જટિલ અને અનેકવિધ વસ્તુ છે જેને અત્યારે અસ્પષ્ટતાપૂર્વક  
કલ્પના કહેવામાં આવે છે તે.

કોઈ માનસિક અથવા બીજા પ્રદેશમાં ડુપોને જેવાની, રેકોર્ડ કરવાની, અને  
નોંધવાની તે શક્તિ છે. કલામય, સાહિત્યક, કાર્યમય કાર્યનાં, વૈજ્ઞાનિક, આ બધા પ્રદેશો  
મનના હોય છે. તે મન બહુ ઉચ્ચ અને ભાવવાચક મન નથી હોતું, શરીરિક  
મનથી બહુ ઉચ્ચ નથી હોતું, જે વ્યક્તિગત અને સામૂહિક મન દ્વારા, કિયામાં  
અભિવ્યક્ત થવા માટે સતત પોતાની જતને રેખાવતું હોય છે.

કેટલાક લોકો, એક ખાસ શક્તિ દ્વારા, આ પ્રદેશો સાથે સંપર્કમાં હોય છે,  
ત્યાં રહેલી એક યા તો બીજી ર્યાનાને ઉપાડી બેના હોય છે, તેને પોતાની પ્રત્યે  
આકષે છે, અને તેમને અભિવ્યક્ત કરે છે. જુદા જુદા લોકોમાં આ અભિવ્યક્તિની  
શક્તિ જિન્ન જિન્ન હોય છે. પણ જે લોકો આ પ્રદેશો પ્રત્યે પોતાની જતને  
ખુલ્લી કરી શકે છે, ત્યાંની વસ્તુઓને જોઈ શકે છે; આ ડુપોને પોતાના પ્રત્યે  
આકષે શકે છે અને તેમને વ્યક્ત કરી શકે છે, સાહિત્યમાં, ચિત્રકણમાં, સંગીતમાં,  
કાર્યમાં અથવા વિજ્ઞાનમાં તેઓ પોતાની અભિવ્યક્તિની શક્તિની માન્ય અનુસાર,  
ખૂન બુદ્ધિશાળી પ્રાણીઓ અથવા પ્રતિભાશાલી વ્યક્તિઓ હોય છે.

તેમના કરતાં પણ અધિક પ્રતિભાશાલી વ્યક્તિઓ હોય છે. તે લોકો ઉચ્ચતર  
પ્રદેશ પ્રત્યે, ઉચ્ચતર શક્તિ પ્રત્યે ખુલ્લા બની શકતા હોય છે. જે શક્તિ માનસિક  
સતરોમાંથી પસાર થઈને માનવમનમાં અમૃત રૂપ ધારણ કરે છે, અને જનતમાં  
પોતાની જતને નવીન સત્યો તરીકે, નવીન તત્ત્વચિંતનીએ પદ્ધતિઓ તરીકે, નવીન  
આધ્યાત્મિક ઉપદેશો તરીકે પ્રગત કરે છે, જે પૃથ્વી પર જન્મ બેનાર મહાન  
સત્ત્વોનાં કાર્યો હોય છે, આ કલ્પનાને સત્ય કલ્પના કહી શકાય.

જ્યારે આ ઉચ્ચતર બણો પૃથ્વીના વાતાવરણમાં નીચે આવે છે, ન્યારે તેઓ જીવંત, સહિત, શક્તિશાલી રૂપો ધારણ કરે છે, જગતમાં અવે પ્રસરી જાય છે, અને એક નવીન પુગનું સર્જન કરે છે.

આ બે પ્રકારની કલ્પનાઓને ઉચ્ચતર કલ્પનાઓ કહી શકાય.

હવે આપણે વધારે સામાન્ય ભૂમિકા પર નીચે આવીએ. દરેક જણમાં પોતાની માનસિક કિયાને રૂપ આપવાની શક્તિ એકાં વતા પ્રમાણમાં હોય છે. તે રૂપને ઉપયોગ તે પોતાની સામાન્ય કિયામાં કરે અથવા અમૃત વસ્તુનું સર્જન કરવામાં કરે. આપણે હંમેશાં, બધી સમય, રૂપોનું નિર્માણ કરતા જ હોઈએ છીએ. જાણ્યા સિવાય આપણે તેમને વાયુમંડળમાં મોકલતા હોઈએ છીએ. તે રૂપો પરિભ્રમણ કરતાં રહે છે, એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે જતાં હોય છે, સહસ્રાશીદારોને મજાતાં હોય છે, કેટલીક વાર એકંઠાં મળીને તે મોજ માણનાં હોય છે, કેટલીક વાર સંઘર્ષ પેદા કરતાં હોય છે, યુછો થતાં હોય છે. કારણુંકે આ માનસિક કલ્પનાઓમાં સંકલપનું થોડુંક તત્ત્વ હોય છે, જે પોતાને સિદ્ધ કરવા પ્રયાસ કરતું હોય છે. દરેક જણ પોતાની રચનાને બહાર મોકલતું હોય છે, જેથી તે કાર્ય કરી શકે, પોતે ઈચ્છાનો હોય તેવી વસ્તુઓ બની શકે. દરેક જણ આમ કરતું હોય છે, અને તેથી ગુંચવાડો પેદા થાય છે. જે આપણું આપો વાતાવરણમાં રહેવાં આ બધાં રૂપેને જેઈ શકે, તો આપણું બહુ આશ્ર્યકારક વસ્તુઓ નજરે પડે, યુદ્ધ મેદાનો મોજાંઓ, આક્રમણા, નાનકડાં માનસિક એકમોનાં ટોળાંની પીછેહઠ જે એકમો સનત હવામાં ફેંસતાં હોય છે અને પોતાને સિદ્ધ કરવા હંમેશાં પ્રયત્ન કરતાં હોય છે. આ બધી રચનાઓમાં એક સર્વસાધારણ વલણ હોય છે અને તે ભૌતિક રીતે પ્રગટ થવાનું અને શારીરિક રીતે પોતાની જતને સિદ્ધ કરવાનું. તે એકમો અસંખ્ય હોય છે, તેમને બધાંને પ્રગટ થવા માટે પૃથ્વી પર પૂરતી જગ્યા નથી. એટલે તેઓ એક બીજાને ધક્કો મારી હડસેલી મૂકતાં હોય છે, પોતાની સાથે સંમત ન થનાર એકમોને તેઓ ફુગાવી દેવા માગતાં હોય છે સમયમાં અને અવકાશમાં જગ્યા રોકવા માટે, તેઓ સૌન્યો રચનાં હોય છે અને વ્યવસ્થિત રીતે કૂચ કરતાં હોય છે. સર્જનોની અસંખ્ય સંખ્યાના પ્રમાણમાં અહીંની જગ્યા બહુ થોડી પડે તેવી હોય છે.

એટલે વ્યક્તિગત રીતે આમ બનતું હોય છે. કેટલાક લોકો જાણ્યા સિવાય તેમ કરતા હોય છે, કદાચ દરેક જણ તેમ કરતું હોય છે. તેઓ એક વસ્તુમાંથી

બીજી વસ્તુ તરફ સતત ફેંકતા હોય છે, તેઓ આશા રાખતા હોય છે, ઈચ્છા કરતા હોય છે, આમના કરતા હોય છે, નિરાશ બનતા હોય છે, કેટલીક વાર સુખ અનુભવતા હોય છે, કારણકે તેમનામાં આ વસ્તુઓ પર કિંબૂ કે પ્રભુત્વ હોતાં નથી. પણ ડાપણુંની શરૂઆત અહીંથી થાય છે. આપણું વિચાર કરતી જત પ્રત્યે આપણે જેવું જોઈએ, આ દૃષ્ટિને જેવું જોઈએ, આવિભવ પામવા મથનાં, આ નાનકડાં જીવનું એકમોનો વાતાવરણમાં થતા સતત વિસર્ગથી આપણે સભાન બનવું જોઈએ. આ બધું આપણા માનસિક વાતાવરણમાંથી બહાર આવતું હોય છે, જે વાતાવરણને આપણે આપણું સાથે જ રાખતા હોઈએ છીએ. એકવાર આપણે જેતા અને અવલોકન કરતા થઈ જઈએ, પછી આપણે આપણા ઉર્ચયતમ સંકલપની અથવા અભીસાની વિરુદ્ધની વસ્તુઓને પાછી હડ્સેલી દઈ શકીએ છીએ, અને આપણને વિકાસમાં મદદરૂપ થાય તેવી રચનાઓને જ પ્રગટ થવા માટે ગતિ કરવા દ્યુટ આપી શકીએ છીએ.

આ સંકિય વિચાર પરનો કાબૂ છે. હું તે દિવસે આ વસ્તુ કહેવા માગતી હતી.

તમે કેટલીક વાર બેસીને સભાન બનો છો કે હવે વિચારે પોતાને માટે રૂપો ઘડવાનો પ્રારંભ કર્યો છે, પોતાની કથા કહેવાની શરૂઆત કરી છે. તમે આ બાબતમાં જરાક કુશળ બની જાઓ ત્યારે તમારા જીવનમાં શું બને એવી તમે ઈચ્છા રાખો છો તેનો ઈતિહાસ તમારી સમક્ષ પ્રગટ થવા માંડણે એટલું જ નહિ, પણ તેમાંથી તમે કોઈક વસ્તુ દૂર કરી શકશો, કોઈક વિગત ઉમેરી શકશો, તમારા કાર્યને પરિપૂર્ણ બનાવી શકશો, એવી એક સુંદર કથા રચી શકશો કે જેમાં બધું જ તમારી અભીસા સાથે સુસંગત હોય. એકવાર તમે યથાશક્ય પરિપૂર્ણ, સંવાદમય રચનાનું નિર્માણ કરશો, એટલે પછી તમે તમારા હાથ દુદ્રા કરી દઈને પંખીને ઉડવા દઈ શકશો.

જો તે રચના સારી રીતે થઈ હો, તો અંતે તે જરૂર સિદ્ધ થવાની માણસ તે જ વસ્તુ જાણતો હોતો નથી.

પણ વસ્તુ સમયના કંમમાં સિદ્ધ થાય છે, કેટલીક વાર તો એટલા બધા અમય પછી કે તમે તમારી કથા ભૂલી ગયા હો છો; પછી તો તમે બધું બદલાઈ ગયા હો છો, બીજી વસ્તુઓનો વિચાર કરતા બની ગયા હો છો, બીજી કથાઓ રચ્યા હો છો; પહેલી કથામાં હવે તમને કંઈ રસ રહ્યો હોતો નથી. જો તમે બધું

ધ્યાનયુક્ત ન હો, તો જ્યારે પહેલો કથાનું પરિણામ આવે છે ત્યારે તમે ત્યાંથી ખૂબ ખૂબ દૂર ચાલ્યા ગયા હો છો, તમને યાદ જ આપતું હોતું નથી કે આ મારી જ કથાનું પરિણામ છે. તેથી જ તમારી જાન પર કાબુ રાખવો એ બહુ મહાત્વની વાત છે, કારણકે જે તમારામાં અનેક પરસ્પર વિરોધી સંકલણો, વલણો, અને જીવનનાં સ્તરો હોય, તો તે તમારા જીવનમાં યુદ્ધ જગતમાં હોય. દા. ત. તમારી ઉચ્ચતમ ભૂમિકા પર તમે એક સુંદર કથાની રચના કરી હોય, જેને તમે જગતમાં બહાર મોકલો છો. પણ પછી, બીજે જ દિવસે, કદાચ તેને તે જ દિવસે, થોડીક વાર પછી, તમે ખૂબ ભૌતિક ભૂમિકા પર નીચે આવી ગયા હો છો, અને આ ઉદ્ઘર્ભમાંની વસ્તુઓ તમને પરીઓ જેવી અવાસ્તવિક લાગતી હોય છે, અને તમે ખૂબ સધન ઉપયોગી રચનાઓ કરવા માંડો છો, જે બહુ સુંદર નથી હોતી; અને તે પણ બહાર જગતના વાતાવરણમાં જાય છે.

‘હું જેવા માણસોને ઓળખું છું, જેમના સ્વભાવમાં આવી જે પરસ્પર વિરોધી બાજૂઓ છે, જે એક દિવસ કોઈ ભવ્ય તેજોમય, શક્તિશાલી રચનાનું નિર્માણ કરે, અને બીજે જ દિવસે નિરાશાવાદી, અંધકારમય રચનાનું નિર્માણ કરે. તે બંને રચનાઓ બહારના વાતાવરણમાં જાય છે. મેં જોયું હતું કે પેલી સુંદર રચના સિદ્ધ થઈ હતી, અને પેલી અંધકારમય રચનાએ પહેલી રચનાના કાર્યનો નાશ કર્યો હતો. આમ જીવનની વિશાળતર રેખાઓમાં તેમજ નાનકડી વીગતોમાં બનતું હોય છે. આનું કારણ એક જ છે કે માણસ વિચાર કરતી પોતાની જાતનું નિરીક્ષણ કરતો હોતો નથી, તે પોતાને આ પરસ્પર વિરોધી ગતિઓનો ગુલામ માનતો હોય છે. માણસ કહેતો હોય છે કે ઓછ, આજે મને કીક લાગતું નથી; આજે વસ્તુઓ મને શોકદારી ભાસે છે. તે આમ કહેતો હોય છે, કારણકે તે એમ માનતો હોય છે કે નસીબની આગળ કોઈનું કશું ચાલતું નથી. પણ જે માણસ એક ડગલું પાછળ જઈ વિચાર કરે અથવા એક પગલું ઉદ્ઘર્ભમાં આરોહણ કરે, તો તે બધી વસ્તુઓને બરાબર જોઈ શકે, તેમને યથાસ્થાને મુક્રી શકે, કેટલીક વસ્તુઓને રાખી શકે અને અલુગમતી વસ્તુઓનો નાશ કરી શકે, ઈરિછત વસ્તુઓમાં જ પોતાની ઉચ્ચતમ અભીષ્ટા સાથે સુસંગત વસ્તુઓમાં જ પોતાની કલ્પના શક્તિને મુક્રી શકે. આને હું કલ્પના પરનો કાબુ કહું છું.

તે બહુ રસપ્રદ છે. જ્યારે તેને કરતાં માણસ શીખો જાય છે અને નિયમિત શીતે તે કરવા માડે છે, ત્યારે તેને કંટણો લાગવાનો સમય જ નથી રહેતો.

પછી તો સમુક્રનાં મોજ પર તરતો શીથીનો બુચ દરેક મોજ વડે આમથી તેમ, રસૂ પામ્યા વિના, અથડાય તેમ થવાને બદ્દલે, તે માણસ એક પંખી બની જાય છે, જે પોતાની પાંઝો જોલીને મોજાં ઉપર ઉત્તું હોય છે, જ્યાં જું હોય, ત્યાં જું હોય છે. જસ.

\*

## ૧૦ સપ્ટેમ્બર ૧૯૭૮

આધુનિક સમયમાં એમ એમ ભૌતિક વિજાને તેની શોધો વધારી અને પ્રકૃતિની ગૂઢ શક્તિઓને, માનવ ઉપયોગ માટે, માનવ જ્ઞાન વડે નિર્યંત્રિત થતા કાર્યમાં મુક્ત કર્યું તેમ તેમ ગુફવાદ પાછો હશ્યો અને “ભૌતિક વસ્તુ એકલી જ વાસ્તવિક છે, મન અને પ્રાણ તો માત્ર પદાર્થ તત્ત્વનાં ખાનાંની કિયાઓ છે” એ દલીલ આગળ ધરીને, ગુફવાદને બાજુ પર મૂકી હેવામાં આવ્યો. ભૌતિક શક્તિની વસ્તુઓની ચાવી છે, એ ભૌતિક શક્તિની માન્યતાના પાયા પર, વિજ્ઞાને આપણાં સાધારણ અને અસાધારણ મન પ્રાણની ભૌતિક કિયાઓ અને સાધનીકરણના જ્ઞાન વડે, મન, પ્રાણ ઉપર કાબૂ સ્થાપવાનો પ્રયત્ન કર્યો; આધ્યાત્મિકતાને માનસિકતાનું જ એક રૂપ માનીને તેની ઉપેક્ષા કરવામાં આવી. એમ કહેવું જોઈએ કે જો આ પ્રયત્ન સફળ થાય, તો માનવ જતિના અસ્તિત્વ માટે એક જોખમ પેદા થાય, કારણકે અમુક વૈજ્ઞાનિક શોધિનો ઉપયોગ અથવા જેર ઉપયોગ માનવજતિ કરી રહી છે. જે માનવજતિ હજુ, માનસિક અને નૈતિક રીતે, આવી સહાન અને જોખમકારક શક્તિઓ સાથે કામ પાડવા માટે તોયાર નથી, કારણ કે આપણા અસ્તિત્વની પીઠમાં રહેલી અને તેને ટકાવી રાખતી, ગૂડ શક્તિઓના જ્ઞાન વગર, તેમના પર કૃત્રિમ કાબૂ હોકી બેમાદવાનો તેમાં પ્રયત્ન હોય છે. પદ્ધતિમાં ગુફવાદને આ રીતે સહેલાઈથી બાજુએ હડસેલી શકાય તેમ છે, કારણકે તે અપરિપક્વ દશામાં છે, તેણે હજુ ત્યાં પદ્ધતિસરનો, મજબૂત, તત્ત્વ-ચિત્તનીય પાયો પામ કર્યો નથી. તેણે અતિભૌતિકની આશ્રૂર્યજનક બાબતોમાં જ વધારે રસ લીધો છે અથવા અસાધારણ શક્તિઓને ઉપયોગ કરવા માટેની અસરકારક પદ્ધતિઓની તથા ફોર્મ્યુલાઓની શોધ કરવામાં વધારે પ્રયત્ન કર્યો છે. તે કણા

અથવા પોળા જદુને રસ્તે ચાલી ગયો છે, ગૂઢવાદની રહસ્યમય, આનંદદાયક બાબતોમાં જ તરી પડ્યો છે, તેણે મર્યાદિત અને થોડાક જ્ઞાનની અતિશયોક્તિ કરી લીધી છે. માનસિક પાયાઓનાં આ વદાણે અને અસવામતીને કરાણે, ત્યાંના ગૂઢવાદનો બચાવ કરવો એ કઠિન બની ગયું છે, તેની અવગણના કખી તે સહેલું બની ગયું છે ઈજ્ઞામાં અને 'પૂર્વમાં' આ જ્ઞાન વધારે પરિપક્વ અને વિશાળ બન્યું હતું. તંત્રોની નોંધપાત્ર પદ્ધતિમાં આપણને તે પરિપક્વતાનાં હજી પણ દર્શન થાય છે. તે માત્ર અતિસાધારણ તત્ત્વનું માત્ર બહુમુખી વિજ્ઞાન જ ન હતું. પણ તેમાં ધર્મનાં સર્વ ગૂઢવાદી તત્ત્વોને પાયો રચવામાં આવ્યો હતો. તેણે આધ્યાત્મિક સાધનાની અને આત્મસાક્ષાત્કારની એક મહાન અને શક્તિશાલી પ્રદૂતિ વિકસાવી હતી. તે ઉચ્ચતમ ગૂઢવાદ છે, જે મન, પ્રાણ આત્માની ગૂઢવાદ છે, જે મન, પ્રાણ, આત્માની ગૂડગતિઓને અને અતિસાધારણ શક્યતાઓને થોધી કાઢે, અને આપણાં માનસિક, પ્રાણિક, અને આધ્યાત્મિક અસ્તિત્વની વધારે અસરકારકતા માટે એક વ્યવહારમય પ્રક્રિયાનો અથવા તેમની મૂળભૂત શક્તિનો ઉપયોગ કરે.

સામાન્ય લોકો ગૂઢવાદને માત્ર જદુ અને જદુઈ ફોર્મ્યુલાઓ માનતા હોય છે, અતિ પ્રાકૃતિકની એક મયોનરી માનતા હોય છે. પણ તે ગૂઢવાદની માત્ર એક બાજુ જ છે. તે એક વહેમ માત્ર નથી. જે લોકોએ આ ગૂડ પ્રકૃતિ શક્તિની આચળાદિત બાજૂ પર ઊંડી નજર હેંકી નથી હોતી અથવા તેની શક્યતાઓનો જેમણે પ્રયોગ કર્યો નથી હોતો તેઓ જ તેને વહેમ માનતા હોય છે. જેમ લૌનિક વિજ્ઞાનમાં બને છે તેમ, આ મનશક્તિના તથા પ્રાણશક્તિના ગૂઢવાદી ઉપયોગમાં, નિગૂઢ શક્તિની આ ફોર્મ્યુલાઓ અને યંત્રો આશ્રયકારક રીતે અસરકારક બની શકે છે, પણ આ પ્રદૂત ગોળ અને મર્યાદિત ડિશામાં હોય છે. કારણકે મન પ્રાણની શક્તિઓ મુલાયમ, સૂક્ષ્મ, અને પોતાના કાર્યમાં પરિવર્તનશીલ હોય છે; તેમનામાં લૌનિક કંડકાઈ નથી હોતી. તેમના જ્ઞાન માટે, તેમના કાર્યની અને પ્રક્રિયાની સમજ માટે, તેમને લાગુ પાઠવા માટે, તેમની સ્થાપિત ફોર્મ્યુલાઓની સમજમાં નથા કાર્યમાં પણ, સૂક્ષ્મ અને મુલાયમ આંતર દર્શનાની જરૂર છે. મંત્ર ઉપર અને કંડક ફોર્મ્યુલાઓ ઉપર વધારે પડતો ભાર મૂડવાથી જ્ઞાન વંધ્ય અથવા મર્યાદિત બની જાય તેવા સંભવ છે; તેથી વ્યવહારમાં ઘણ્ણો ભૂલો થવાનો સંભવ છે; અજ્ઞાતમય ઝંદાઓ, દુરુપયોગ, અને નિષ્ફળતા આવવાનો સંભવ છે. હવે આપણે 'પદાર્થ-તત્ત્વ જ માત્ર સત્ય છે' એ વહેમને દૂર કરી શક્યા છીએ એટલે હવે આપણે જૂના ગૂઢવાદને વૈજ્ઞાનિક દૃષ્ટિથી તપાસી શકીએ એમ છીએ; મનની ગૂડ શક્તિઓને

અને તેનાં રહસ્યોને તપાસી શકીએ તેમ છીએ; ચૈત્યમય, અસાધારણ, માનસ શાલીય દૃષ્ટ્યોનું જીણવટભરેલું અધ્યયન કરી શકીએ તેમ છીએ. થોડા પ્રમાણમાં તે થઈ રહ્યું દેખાય છે, પણ જે તેણે પરિપૂર્ણ બનવું હો, તો સાચા પાયાને, સાચા લક્ષ્યને, સાચી દિશાને, જરૂરી એવી સાપચેતીને આપણે ઇર્દી શોધી કાઢવાં પડ્યે. નેનું સૌથી વધારે મહત્વનું લક્ષ્ય આ હોય જોઈએ, મનની તથા પ્રાણની શક્તિનાં ખૂબ નિગૂઢ સંયોગની તથા બળોની શોધ, નિગૂઢ આત્માની મહત્તર શક્તિઓની શોધ, ગૂઢવાદનું વિજ્ઞાન, તાન્ત્રિક રીતે, આપણામાં તેમ જ જગતના સ્વભાવમાં રહેલા ગૂઢ તેજોમય તરફનું વિજ્ઞાન છે, તે ગૂઢ તેજોમય તત્ત્વ સાથે સંબંધ પરાપત્રી બધી વસ્તુઓનું વિજ્ઞાન છે, જેમાં અવચેતનનો તથા અતિચેતનનો બંનેનો સમાવેશ થઈ જાય છે; તેનો ઉપયોગ આપણે આત્મજ્ઞાન માટે તથા વિજ્ઞાન માટે કરવાનો છે; અને તે જ્ઞાનને યોગ્ય હિતે સહી બનાવવાનું છે.”

( દિવ્ય જીવન, પૃષ્ઠ ૮૭૫-૭૭ )

મધુર માતાજી, ધોળું જાહુ શું છે?

તે કલ્યાણકારી જાહુ છે; કાળું જાહુ એ નુકસાનકારક જાહુ છે. પણ હકીકતમાં, તે માત્ર શબ્દો જ છે, તેમનામાં જાણો અર્થ નથી.

જાહુ એટલે કેવળ ભૌતિક ફોર્મ્યુલાઓનું રૂપ જેને આપવામાં આવ્યું છે એવાં જ્ઞાન. તે એક પ્રકારના શબ્દો, અથવા શબ્દોનાં સંમિક્ષાણો, શબ્દોના તથા સંખ્યાઓના સમૂહો છે. જેમને માત્ર બોલવાથી અથવા લખવાથી, આંતર શક્તિ વળરના માણસ પર પણ અમુક કાર્ય નીખને છે. વિજ્ઞાનમાં જેમ રાસાયનિક ફોર્મ્યુલાઓ હોય છે, તેમ ગૂઢવાદમાં આ ફોર્મ્યુલાઓ હોય છે. વિજ્ઞાનમાં તમારી પાસે અમુક તત્ત્વોને સંમિક્ષિત કરવાની અને તેમાંથી બીજી તત્ત્વો પેદા કરવાની ફોર્મ્યુલાઓ હોય છે. તમારામાં ભવે મોઈ માનસિક, પ્રાણિક, અથવા શારીરિક શક્તિ ન હોય, પણ જે તમે અક્ષરશ: તે ફોર્મ્યુલાને અનુસરો, તો તમે ઈચ્છિત પરિણામને પ્રાપ્ત કરી શકો છો. તેમાં માત્ર સ્મૃતિ હોવાની જ જરૂર છે. ગૂઢવાદમાં તે જ વસ્તુનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેમાં ધ્વનિઓનાં, અક્ષરોનાં, સંખ્યાઓનાં, શબ્દોનાં સંમિક્ષાણો કરવામાં આવ્યા છે, જે પોતાની સાહજીક શક્તિ વડે અમુક પરિણામો લાવી આપે છે. તે ફોર્મ્યુલાને જે મૂર્ખ માણસ શિખ્યો હોય, અને બરાબર કલ્યા પ્રમાણે તે કરે, તો તે ઈચ્છિત પરિણામને મેળવી શકે છે, અથવા તેમના તો

હોય છે કે મને મારું ઈરિછત પરિસૂપ્ત મળશે. આપણે એક મંત્રનો દાખલો લઈએ જે એક પ્રકારનું ગુફવાદનું રૂપ જ છે. જે તે મંત્ર ગુરુ પાસેથી લેવામાં ન આવ્યો હોય, અને તે ગુરુએ મંત્રદીકા વખતે પોતાની આધ્યાત્મિક અથવા ગુફવાદી શક્તિન તમારામાં સ્થાપી આપી ન હોય તો તમે ભવે હજારો વાર તે મંત્રનો જરૂર કરો, પણ કાઈ પરિસૂપ્ત નહિ આવે.

અર્થાતું, સાચા ગુફવાદમાં માસુસની પાસે આ ગુફશક્તિ આંતરદેશી હોવાં જોઈએ તો જ તે મંત્રનો ઉપયોગ કરી શકે; તે તેનું એક પ્રકારનું રક્ષણ છે. કોઈ પણ મૂર્ખ માનવી સાચા ગુફવાદનો અમલ ન કરી શકે. આ કોઈ ધ્વલ, કાળું, કે સોનેરી જાડુ નથી રહેણું; અને તો એક આધ્યાત્મિક શક્તિ હોય છે, જે લાંબા અભ્યાસ પછી પ્રાપ્ત થઈ શકે છે; તે તમને ભગવાનનાં ફૂપાથી જ મળતી હોય છે.

આનો અર્થ એ થયો કે જ્યારે માસુસ સત્ત્યની નજીક જાય છે, તારે તે સર્વ પ્રકારની ઉપરછલ્લી જાડુ વિદ્યાથી, દંભથી, અને અસત્યથી મુક્ત બની જાય છે. આની મારી પાસે અનેક નિશ્ચિત સાબિતીઓ છે. એટલે, જેનામાં સાચી ગુફવાદી શક્તિ છે તેવા માસુસમાં, આ આંતર સત્ત્યના બંધ વડે, ધોળા, કાળા, કે શરીરે તે રંગના જાડુને નાકામિયાબ બનાવી દેવાની શક્તિ હોય છે અને તે પણ તે સત્ત્યના એક કિરણ માત્રને ત્યાં લાગુ કરવા વડે તે શક્તિનો પ્રતીકાર કોઈ વસ્તુ કરી શકતી નથી. જાડુ કરનારા લોકો આ વાત બરાબર જાણુતા હોય છે. બધા દેશોમાં, ખાસ કરીને ભારતમાં તે લોકો યોગીઓ અને સંતો સામે પોતાની ફોર્મ્યુલાઓનો પ્રયોગ કરી પણ કરતા હેતા નથી, કરાણું તેઓ સારી રીતે જાણતા હોય છે કે વાંચિક, ઉપરછલ્લી શક્તિ વડે મેડિલાયેલી આ ફોર્મ્યુલાઓ, ભીંત સાથે અફ્લાઇને જેમ દરો પાછી ફરી છે તેમ, આધ્યાત્મિક જીવન જીવનાર માસુસનું રક્ષણ કરતી શક્તિ સાથે અફ્લાઇને પાછી અમારા ઉપર, જ આવશે અને અમને હેરાન પરેશાન કરી મૂકશે.

યોગીને અથવા સંતને કાઈ જ કરવાનું હોતું નથી; તેને પોતાની જાતનું રક્ષણ પણ કરવાનું હોતું નથી. તે આપોઆપ બનનું હોય છે. તે એવી એક ચેતનાની અને આંતર શક્તિની સ્થિતિમાં હોય છે, જે દરેક નિમ્ન કોટિની વસ્તુથી તેનું રક્ષણ કરતી હોય છે. સ્વાભાવિક રીતે જ, બીજામોનું રક્ષણ કરવા માટે તે વિચારપૂર્વક પોતાની શક્તિનો ઉપયોગ કરી શકે છે. તેના વાતાવરણમાંથી એ દુષ્ટ રચના આપોઆપ પાછી ફરી જાય છે, અને તેનું રક્ષણ કરે છે. પણ જો આ દુષ્ટ

રચના તેવા માણસ પ્રત્યે હેંકવામાં આવી હોય કે જેનું તે રક્ષણ કરતો હોય અથવા જે તેની મદદ માગતો હોય, તો તે, પોતાના વાતાવરણની ગતિ વડે, પોતાના તેજેમંડળ વડે, તે માણસને આવરી વે છે, જેની સામે દુષ્ટ જદુનો પ્રયોગ કરવામાં આવ્યો હોય. તે પાછી ફરતી પ્રક્રિયા, તે જદુનો પ્રયોગ કરનાર માણસ પ્રત્યે જઈને તેને જ ઈજ પહોંચાડતી હોય છે. પણ, આમાં તે યોગ્યિના, સંતના, અથવા સાધુના સચેતન સંકલ્પની જરૂર હોય છે. તેને જે વાત બની હોય તેની અભર આપવી પડતી હોય છે, અને તેણે તેમાં દરમિયાનગીરી કરવાનો નિર્ણય બેબો પડતો હોય છે.

સાચા જ્ઞાનની અને જદુની વચ્ચે આ તફાવત હોય છે. બીજું કાંઈ પૂછ્યું છે?

માતાજી, પોતાની પ્રગતિ વડે ભૌતિક વિજ્ઞાન ગુદ્ધવાદ પ્રત્યે ખુલ્લું થઈ શકે?

- તે પોતાને ગુદ્ધવાદ કહેનું હોતું નથી. તે માત્ર શબ્દોનો જ સવાલ છે. - વૈજ્ઞાનિકો એવી શોધી કરતા હોય છે, જેમને ગુદ્ધવાદી જ્ઞાનવાળા બેઠો હજરો વર્ષ પહેલાં જાણુતા હતા! લાંબી જોગાકાર ગતિ કરીને, વૈજ્ઞાનિકો તે જ વાત પર આવતા હોય છે.

દા. ત. દાક્ષણ્ય વિજ્ઞાનમાં, વ્યવહારમય વિજ્ઞાનમાં એવી ધર્શની શોધી થઈ રહી છે. પોતાની રીતે, આશ્રમચક્રિત બનેવા, રસપૂર્વક તેઓ એવી વસ્તુઓના સંપર્કમાં આવતા જાય છે, જેમને યોગ્યિઓ ધ્યાનાં વર્ષો પહેલાં જાણુતા હતા. વૈજ્ઞાનિકો તે વસ્તુઓને તમારી સમક્ષ નવીન ચમત્કરણ પેઢે રજૂ કરતા હોય છે. પણ તે ચમત્કરણ બહુ જૂના છે!

વૈજ્ઞાનિકો છેવટે ગુદ્ધવાદનું જ આચરણ કરશે, પણ તે જાણ્યા વગર જ ! જ્યારે માણસ વસ્તુઓના સત્યની નજીક જાય છે, પોતાની શોધમાં તે સાચા દિલનો હોય છે, માત્ર દેખાવોથી જ સંતોષ માનતો નથી, તે કાંઈક વસ્તુ શોધવા અને જાણવા સારી રીતે માગતો હોય છે, દેખાવોને લેટીને તેની પીઠમાં ઊંડો ઉત્તરે છે, ત્યારે તે વસ્તુઓના સત્ય પ્રત્યે આગેકૂચ કરે છે અને છેવટે તે જ જ્ઞાનને પ્રાપ્ત કરે છે, જેને આંતર શોધ વડે ઋખિઓએ વર્ષો પહેલાં જાણ્યું હતું.

માત્ર પદ્ધતિ અને માર્ગ લિન્ન લિન્ન છે, પણ શોધી કઠાયેલી વસ્તુ તે જ હોવાની. કારણ કે જે વસ્તુઓ નહિ, પણ એક જ વસ્તુ છે, જેની શોધ કરવાની

હોય છે. તેનો આવાર અનુસરણ કરતા માર્ગ પર હોય છે. કેટલાક લોકો જડપથી જતા હોય છે, કેટલાક ધોમેથી જતા હોય છે. કેટલાક લોકો સીધી ગતિમાં જતા હોય છે, કેટલાક લોકો વર્તુળની જોગાકાર ગતિમાં જતા હોય છે પણ તેમને કેટલો બધો પરિશ્રમ કરવો પડતો હોય છે! વળી ને ખૂબ માનનીય વાપર છે!

(મૌન)

હવે તેમણે શોધી આઢ્યું છે કે, બેભાન બનાવવાની દ્વારે અદ્વે હિનો-ટિઝનોનો પ્રયોગ કરવાથી અનંતગણાં સરાં પરિણામ આવે છે. હિનોટિઝન (પ્રાણ વિનિમય) એ ગૂઢવાદનું આધુનિક રૂપ છે. પણ ગૂઢવાદી શક્તિની સરખામણુંમાં તે એક તદ્દન મર્યાદિત, નાનકડી શક્તિ છે, તેને માત્ર આધુનિક શબ્દો વડે મફવામાં આવી છે. તમે આ વસ્તુઓ વિષે સાંભળ્યું છે કે નહિ, તે કું જાણતી નથી, પણ અમુક દુર્ઘિબિન્દુથી જોતાં, તે બહુ રસપ્રદ હોય છે. દા. ત. ધા પડેલી ચામડીની જગ્યાએ નવી ચામડી બેસાડવા માટે હિનોટિઝનો પ્રયોગ કોઈક માણસ પર કરવામાં આવ્યો હતો. અત્યારે મને તેની બધી વીગતો યાદ નથી; પણ તેના હાથ ને તેના પગ સાથે પંદર દિવસ સુધી જોડી દેવામાં આવ્યો હતો, જો તે માણસને પ્લાસ્ટર અને પાટા કરવામાં આવ્યા હોત, તો પંદર દિવસ પણી તે જરાપણ હવન ચલન ન કરી શક્યો હોત; બધાં અંગો જરૂરાઈ ગયાં હોત; પોતાના હાથને તે મુક્ત રીતે હવાવી હવાવી શકે તે માટે તેને અઠવાડિયાં સુધી દાઢતરી સારવાર બેબી પડી હોત. પણ આ કેઈસમાં, કોઈ પણ અંગને બાંધી દેવામાં આવ્યું ન હતું, કોઈ અંગને શારીરિક રીતે જરૂર, બહેરં બનાવી દેવામાં આવ્યું ન હતું, પ્લાસ્ટર-પાટા કરવામાં આવ્યા ન હતા. માત્ર તે માણસને હિનોટાઈઝ કરવામાં આવ્યો હતો, તેને પોતાના હાથ અમુક સ્થિતિમાં જ રાખવાનું કહેવામાં આવ્યું હતું. કશી જ મુશ્કેલી વગર, કશા જ પ્રયાસ વગર, તેના સંકલ્પની કોઈ પણ જાતની દરમિયાનગીરી વગર, તેણે પોતાના હાથને તે જ સ્થિતિમાં રાખ્યો હતો. તેમાં હિનોટિઝ કરનાર વ્યક્તિના સંકલ્પે જ માત્ર દરમિયાનગીરી કરી હતી. તે કિયા પરિપૂર્ણ રીતે સહૃદ્ય બની હતી. હાથ જરૂરી સ્થિતિમાં જ રહ્યો હો. પંદર દિવસ પછી હિનોટિઝ ઉઠાવી લેવામાં આવ્યું, અને દરદીને કહેવામાં આવ્યું કે હવે તમે હરી ફરી શકો છો. તે માણસ હરવા ફરવા લાગ્યો! તે એક પગણું આગળ છે.

જો વિજ્ઞાન અને ગુફવાદ ખૂબ જક્કી ન રહે, તો તે બંને એક બીજાને મળી શકશે, જલ્દી મળી શકશે. તેમનો તફાવત તે તો માત્ર શબ્દોની રમત છે; શબ્દોના મૂલ્ય ઉપર તે બને એક બીજા સાથે સંમત થશે!

મધુર માતાજી, એમ કહેવાયે છે કે જેના પર હિન્દોટિઝમ કરવામાં આવે છે, તેના ઉપર હિન્દોટિઝમની પાછળથી ખરાબ અસર થાય છે. તે અર્થી વાત છે?

ના, ના જો પોતાનો સંકલ્પ બીજા માસુસ પર લાંબવા માટે હિન્દોટિઝમ કરવામાં આવે, તો તેની ખરાબ અસર નીપણે છે. પણ આપણે તો માનવતા ભરી રીતે કરતા હિન્દોટિઝમની વાત કરીએ છીએ, અમૃત ચોક્કન હેતુઓ માટે કરતા હિન્દોટિઝમની વાત કરીએ છીએ.

જો હિન્દોટિઝમ કરતારમાં કોઈ ખરાબ આશય ન હોય, તો તેની ખરાબ અસરોને દૂર રાખી શકાય છે.

જો તમે રસાયનિક ફોર્મ્યુલાઓનો ઉપયોગ અશાનપૂર્વક કરો, તો મેટો ધડકો થાય (હસાહસ), અને તે બધું જોખમકારક નીવડે! જો તમે ગુફવાદી ફોર્મ્યુલાનો ઉપયોગ અશાનપૂર્વક કરો, અહંતાપૂર્વક કરો કે જે અશાનતાપૂર્વક કરતા ઉપયોગ કરતાં વધારે જોખમકારક હોય છે, તો તમને નુકસાનકારક પરિણામો પ્રાપ્ત થાય. પણ તેનો અર્થ એ નથી કે ગુફવાદ અથવા હિન્દોટિઝમ ખરાબ છે, અથવા રસાયણ-શાસ્ત્રી ખરાબ છે: કેટલાક લોકો ધડકા કરતા હોય છે, તેથી તમે રસાયણ વિદ્યાનો બહિષ્કાર ન કરી શકો! (હસાહસ)

ગુફવાદ શિખવા માટે અમૃત ખાસ ગુણેની જરૂર હોય છે, જ્યારે વિજ્ઞાન શિખવા માટે.....

પણ દરેક વસ્તુ શિખવા માટે અમૃત ખાસ ગુણેની જરૂર હોય છે.

વૈજ્ઞાનિક જ્ઞાનને દરેક જાણ મેળવી શકે છે.

સાંભળો. જો તમે, કલાકાર નહિ હો, તો તમે વષો સુધી પૌંશીઓ સાથે, રંગો સાથે, કપડાં કે કાગળો સાથે કામ કરો, ખૂબ પેસા ખરયો, ખૂબ પ્રયત્ન કરો, અને છતાં તમારાં ચિન્તા ભર્યકર જ હોવાનાં. જો તમે સંગીતકાર નહિ હો, તો તમે પિયાનો વગાડવા માટે કલાકો સુધી માથાકૂટ કરો અને છતાં તમે કશું જ મૂલ્યવાન

સંગીત પ્રગટ નહિ કરી શકો. ખાસ ગુણોની તો જરૂર હુમેથાં રહેવાની, જે તમે જન્મથી જ કસરતભાજ નહિ હો, તો તમે ગમે તેટલો મહેનત કરશો તો પણ તદ્દન સામાન્ય પરિણામ જ પ્રામ કરી શકવાના. જોણે તેવો પ્રયત્ન જરા પણ કર્યો નથી હોતો તેના કરતાં તમે કંઈક સારું પરિણામ લાવી શક્યા હશો, પણ તેનો અર્દ્ધ એવો નથી કે તમે આપોઆપ જ સહ્ય થઈ જવાના. વળી દરેક જાણમાં અસંખ્ય શક્યતાઓ પડી હોય છે, જેનું તેને જ્ઞાન નથી હોતું. પણ જે માણસ યોગ્ય રીતે જે કરવાનું છે તે કરે, તો તે તેમને વિકસાવો શકે છે, પણ પ્રગતિ બે પ્રકારની હોય છે, એક પ્રકારની નહિ. એક તો, તમારામાં જે શક્તિઓ હોય, શક્યતાઓ હોય, ગુણો હોય તેમને વધારે ને વધારે પરિપૂર્ણ કરવાનો એક પ્રકાર છે. જે કેળવણી દ્વારા સામાન્ય રીતે પ્રામ થઈ શકે છે. પણ જે તમે ગણનતર સત્યની પાસે જઈને 'પરિપૂર્ણ' વિકાસ સાધવા માટે વધારે પ્રયત્ન કરો, તો તમે તમારા ગુણોમાં બીજા નવીન ગુણોનો ઉમેરો કરી શકો છો, જે તમારા અસ્તિત્વમાં સુધુભત હતા.

તમે તમારી શક્યતાઓમાં વૃદ્ધ કરી શકો છો, તેમને વધારે વિશાળ બનાવી શકો છો. તમે જેણી કલ્પના પણ કરી ન હતી તેવી કોઈક વસ્તુને ઓચિતી પ્રગટ કરી શકો છો. આ વાત મેં તમને અનેક વાર સમજાવી છે. જ્યારે માણસ પોતામાં રહેવા ચૈતસિક સત્તને શોધી કાઢે છે, ત્યારે તે જ સમયે, ઓચિતી એવી વસ્તુઓ તેનામાં વિકસે છે અને પ્રગટે છે, કે જે પહેલાં તે કરી શકતો ન હતો, જે પહેલાં તેના સ્વભાવમાં ન હતી. આ બાબતના પણ અનેક દાખલા મારી પાસે છે. પણ તમે સમજ શકો તેથી હું તેની પુનરુક્તિનું કરીશ.

હું એક છોકરીને, જુવાન છોકરીને ઓળાખતી હતી. તે બહુ સામાન્ય પરિસ્થિતિમાં જન્મી હતી. તેને બહુ કેળવણી પ્રાપ્ત થઈ ન હતી. તે ફેન્ચ બહુ કંદળી રીતે લખતી. તેણે પોતાની કલ્પનાનો વિકાસ કર્યો ન હતો. તેનામાં કોઈ સાહિત્યિક સમજ ન હતી. તેવી કાઈ શક્યતા તેનામાં દેખાતી ન હતી, જ્યારે તેને પોતાના ચૈતસિક સત્ત સાથે સંપર્કની આંતર અનુભૂતિ થઈ, અને જ્યાં સુધી તે સંપર્ક જીવંત અને ચાલુ રહેતો ત્યાં સુધી, તે બહુ પ્રશંસનીય વસ્તુઓ લખી શકતી હતી. જ્યારે તે સિયાતિમાંથી તે સામાન્ય સિયાતિમાં આવી પડતી, ત્યારે તે ભૂલ વગર બે વાક્યો પણ લખી શકતી નહિ! મેં તેનાં બંને પ્રકારનાં લખાણો જોયાં હનાં.

આપણામાં દરેકમાં પ્રતિલા રહેલી છે, માત્ર આપણે તે જાળતા નથી. આપણે તેને બહાર આવતાનો માર્ગ ખુલ્લો કરવો જોઈએ. તે પ્રતિલા તો ત્યાં સુષુપ્ત અવસ્થામાં છે, તેને તો પ્રગઢ થવું જ હોય છે. આપણે તેને માટે દ્વાર જોલી આપવું જોઈએ.

\*

## ૧૭ સપ્ટેમ્બર ૧૯૪૮

“માનવ પ્રાણીમાં પ્રકૃતિની આ ગતિમાં, ઉચ્ચતમ જ્ઞાન પ્રત્યે અને મન તે જ્ઞાનને પ્રાપ્ત કરે તેવો બૌધિક અભિગમ એક અનિવાર્ય મદદરૂપ છે. સામાન્ય રીતે, આપણી સપાઠી ઉપર, તર્કબુદ્ધિ અવલોકન કરતી, સમજ પ્રાપ્ત કરતી વસ્તુઓની જોદાશ કરતી બુદ્ધિએ, વિચાર અને કિયા માટે, માનવનું મુખ્ય સાધન છે. આત્માના સમગ્ર વિકાસમાં અથવા ઉત્કાન્તિમાં માત્ર આંતર પ્રેરણા, અંતર્દ્વિદ્યા, આંતર ભાવના, હદ્યની અક્ષર, આત્માની વસ્તુઓની સીધી જીવન અનુભૂતિ આ બધાના વિકાસ કરવાની તો છે એટલું જ નહિ, પણ બુદ્ધિને પણ પ્રકાશિત અને સંતુષ્ટ કરવાની છે. આપણા વિચારક મનને સમજ પ્રાપ્ત કરવામાં મદદ કરવાની છે, આપણી પ્રકૃતિની અને તેની પીઠમાં રહેલા સત્યની ઉચ્ચતમ કિયાના તથા વિકાસનાં ધ્યેય પદ્ધતિ અને તત્ત્વોનો તર્કયુક્ત, પદ્ધતિસરનો ઘ્યાલ બાંધવામાં મનને મદદ કરવાની છે. આધ્યાત્મિક સિદ્ધિ અને અનુભૂતિ, આંતરદર્શના યુક્ત અને સિદ્ધું જ્ઞાન, આંતર ચેતનાની વૃદ્ધિ, આત્માની અને સધન આત્મા દર્શનાની વૃદ્ધિ, આ બધાં આ ઉત્કાન્તિનાં યોગ્ય સાધનો છે. પણ વિચારશીખ, સમાલોચક તર્કબુદ્ધિનો ટેકો પણ ખૂબ મહત્વનો છે. આંતર વાસ્તવિકતાઓ સાથે સીધા સંપર્કવાળા વોડો, અનુભૂતિ અને અંતર્દ્વિદ્યા વડે સંતુષ્ટ બનેલ. વોડો તે તર્ક બુદ્ધિ વળર ચલાવી શકે; પણ સમગ્ર ગતિમાં તે અનિવાર્ય છે. જે ધર્મ સત્ય એ આધ્યાત્મિક વાસ્તવિકતા હોય, તો માણસની બુદ્ધિએ જાણવું જોઈએ કે તે મૂળ સત્યનો સ્વભાવ કરો છે, અસ્તિત્વના બીજી આગો સાથે, આપણી સાથે, અને વિશ્વસાથે તે સત્યને કયા પ્રકારના સંબંધો હોય છે. સધન આધ્યાત્મિક વાસ્તવિકતા સાથે આપણને સંસ્પર્શમાં મૂકી આપવા માટે બુદ્ધિ પોતે જાતે સમર્થ નથી, પણ તે આત્માના સત્યનું માનસિક મૂર્તી કરણ કરીને તેમાં મદદ કરી શકે છે, જે મનને

તે સમજાવી શકતું હોય છે, અને જે વધારે સીધી સંશોધનાને લાગુ પાડી શકાય છે. આ મદદ બહુ જ મહત્વની હોય છે.”

(દિવ્ય જીવન, પૃષ્ઠ ૮૭૭-૭૮)

મધુર માતાજી, અહીં શ્રી અરવિંદ લખે છે, “જ્ઞાન પ્રત્યે બૌધ્ધિક અભિજનમ, મન તે જ્ઞાનને પોતાનું બનાવી લે તે...” આ કેવી રીતે શકથ છે?

આધ્યાત્મિક જગતમાં આપણને જે કાંઈ બનતું હોય છે તેનો માનસિક રીતે અનુવાદ કરવાનું આપણામાં હુમેશાં વલસુ હોય છે. તેમાંથી નિષ્કર્ષો તારયતા હોઈએ છીએ, તે અનુભૂતિને કાર્યનો નિયમ બનાવી દઈએ છીએ, માનસિક રીતે જે બન્યું હોય છે તેનો લાભ ઉઠાવી લેતા હોઈએ છીએ, જેથી તે અનુભૂતિને વ્યવહારુ શરેત ઉપયોગી બને તેવું રૂપાંતર આપી શકાય. તેને શ્રી અરવિંદ મનને કહે છે, “જ્ઞાનને પોતાનું બનાવી લે, ” તે આપોઆપ કરાનું હોય છે. કમનસીને, અનુભૂતિનો શોષ ભાગ તેમાંથી છટકી જતો હોય છે. માણસ તે અનુભૂતિને યથાવત સાચવી રાખવા માગે, તો તેને એવી સ્થિતિમાં રહેવું પડે કે જેમાં અનુભૂતિનું માનસીકરણ થઈ શકતું નથી. જો માણસ બાધ્ય જગતમાં જીવતો હોય, તો તો આ અશક્ય જ છે. તેથી મનની દરમિયાનળીરિ વિના, પોતાની આધ્યાત્મિક અનુભૂતિનો આનંદ માણસનાની ઈચ્છાવાળા વોકો સમાધિમાં રહેતા અને કાર્યની લૂપિકા પર આવવાનું દસ્કારપૂર્વક દૂર રાખતા. પણ જે સાધકને જીવનનું રૂપાંતર સાધવું હોય, જો તે ઈચ્છાતો હોય કે આધ્યાત્મિક અનુભૂતિએ મન, પ્રાણ, શરીર પર અને શૈલ્જિદા કાર્યો પર અસર પાડવી જોઈએ, તો માનસિક રીતે તેને વ્યક્ત કરવા પ્રયત્ન કરવો તે અનિવાર્ય છે; તેમ કરતાં તેમાં જે ન્યૂનતા આવે તેને સ્વીકારી વેવાની તેણે તેવારી સાખવી જોઈએ. છેવટે મનનું પોતાનું જ રૂપાંતર થઈ જાય છે, અને અનુભૂતિને વિકૃત બનાવ્યા સિવાય મન તે અનુભૂતિમાં ભાગીદાર બનવા સમર્થ બને છે.

આપણે જે કરવા માગીએ છીએ તે આનાથી પણ વધારે મુશ્કેલ છે, કારણ કે આપણે પ્રાણિકનું પણ રૂપાંતર કરવા માગીએ છીએ, અનુભૂતિને વિકૃત કર્યા ભિનાય તે પણ અનુભૂતિમાં ભાગીદાર બને તેવું સમર્થ બનાવવા માગીએ છીએ; છેવટે આપણે આધ્યાત્મિક કાર્ય વડે શરીરનું પણ રૂપાંતર કરવા માગીએ છીએ, તે અનુભૂતિમાં વિધનરૂપ ન બને તેવું તેને કરવા માગીએ છીએ.

સામાન્ય વિચાર આ રૂપાંતરને જ સ્વાક્ષરવાની વાત બહુ કઠિન માને છે, કારણકે તેમાં વિચારશક્તિનું જ રૂપાંતર કરવાનું હોય છે. એ રૂપાંતર શક્ય બને તે માટે, વિચારની સમગ્ર કામગીરીનું પરિવર્તન કરવાનું છે. આપણે શક્તિનું તેના કાર્ય સાથે તાદાત્મ્ય કરવાથી એટલા બધા ટેવાઈ ગયા છીએ કે આપણે વિચારતા હોઈએ છીએ તેનાથી બિનન રીતે વિચારવાની વાતને આપણે અશક્ય કહીએ છીએ.

જ્યારે માનસિક પ્રદેશમાં સંપૂર્ણ શાન્તિની અનુભૂતિ થાય છે, અને જ્યારે, પ્રકાશ અને બળ સાથે, આધ્યાત્મિક શક્તિ મનમાં નીચે ઉત્તરે છે, અને પૃથક્કરણની, નિષ્કર્ષની, અને તર્કબુદ્ધિની તેની રોજિંદી પદ્ધતિ અનુસર્યા વગર મન પાસે તે સીધી રીતે કાર્ય કરાને છે, ત્યારે જ તે શક્ય બને છે. આ સામાન્ય રીતે સાધારણ ગણાત્મી, મનની બધી શક્તિઓને બંધ કરી હેવી પડે છે, અને છતાં આધ્યાત્મિક જ્ઞાન, પ્રકાશ અને શક્તિએ, તેમને વ્યક્ત કરવા માટે આ સામનોનો ઉપયોગ કર્યા સિવાય, સીધી અભિવ્યક્તિની નીકમાં તેમનું પરિવર્તન કરવા માટે પ્રમર્ય બનવાં જોઈએ.

તેના તદ્દન બાબ્ય સ્વરૂપમાં, મન એ કાર્યનું, સંગઠનનું, અને અમલીકરણનું સાધન છે. તે જ્યાબોને વ્યવસ્થિત ગોઠવે છે, તેમને એકબીજા સાથે સંબંધિત કરે છે, તેમનામાંથી કાર્ય માટે નિષ્કર્ષો તારવે છે, અને આ કાર્યને વેગ આપે છે. પૃથક્કરણ, નિષ્કર્ષ, અને તર્કબુદ્ધિની જરૂરિયાતની પ્રક્રિયાઓ વગર, માનસિક ચેતનાનો ડબજો હેતી આધ્યાત્મિક શક્તિ વડે, સીધી રીતે જ, આ સંગઠનની અને કાર્ય માટેના આવેગની શક્તિ પેદા કરી શકાય છે. આંતરદર્શનામાં વસ્તુઓ મેટે ભાગે આ રીતે જ બનતી હોય છે. પણ આધ્યાત્મિક દરમિયાનગીરી એ એક અતિઆંતરદર્શના છે. તાદાત્મ્ય વડે દર્શનની અનુભૂતિની, જ્ઞાનની સીધી અભિવ્યક્તિ છે.

( મૌન )

રૂપાંતરમાં ઘણી કંબિક અવસ્થાઓ હોય છે; તેમાંની પ્રથમ અવસ્થાઓ ગતિના માનસિક અનુકરણ હેવી હોય છે. માનસિક પશ્ચાદભૂમાં પૃથક્કરણની, તર્કબુદ્ધિની, નિષ્કર્ષની સમગ્ર પ્રક્રિયા વગભગ એકી સાથે થતી હોય છે, અને આપણુને એવું પરિણામ આપતી હોય છે કે જે આપણુને આંતર દર્શના એવું

દેખાય, પણ તે ખૂબ જડપૂર્વક કરાયેલી કિયાઓનું પરિણામ હોય છે; તેની પશ્ચાદ-ભૂથી આપણે પૂરા સભાન હોતા નથી; નેથી આપણે આરંભ બિંદુને અને પરિણામને જ જોઈએ છીએ, વીજનવાર સમગ્ર પ્રક્રિયાને જોતા હોતા નથી, માનસિક કિયાના સમગ્ર વિકાસને જોતા હોતા નથી. જે લોકોનું મન જડપી હોય છે અને વસ્તુઓને ખૂબ જડપથી પડકી વેનું હોય છે, જેમની માનસિક કિયા બહુ જ જડપી અને તાત્કાલિક હોય છે, ને લોકો એવી છાપ પાડે કે તેમને આંતર દર્શના હોય. પણ તે માગ બાધ રૂપ હોય છે, સાચી આંતર દર્શનાનું માત્ર અનુકરણ હોય છે. આંતર દર્શના એ સીધી દર્શના હોય; તેને તર્કબુદ્ધિની અને નિગમનની જરૂર પડતી નથી. આંતર દર્શના દ્વારા સીધા જ્ઞાનની અભિવ્યક્તિ થયેલી જ હોય છે.

પણ આ સ્થિતિઓ પહોંચતા પહેલાં, માણસનો સર્વ અનુભૂતિઓને અવલોકનની, પૃથક્કરણની, અને નિગમનની સામાન્ય માનસિક પદ્ધતિમાંથી પસાર થવું પડતું હોય છે, જેથી તે બાધ ચેતનાને પહોંચી શકે. અનુભૂતિનો સાર ભાગ અદૃશ્ય થઈ જોય છે, અને માત્ર સૂક્ષ્મ શીતરાં જ રહેતાં હોય છે, જેમણે પોતાની સિદ્ધિની સર્વશક્તિ ગુમાવી દીવેલી હોય છે.

પણ જે લોકોની બૌદ્ધિક કિયા બહુ પ્રભાવશાળી હોય છે, તેમને દરેક વસ્તુને, દરેક અનુભૂતિને પકડમાં લેવાની જરૂર પડતી હોય છે. અને તેમને મૂર્તિ-રૂપ આપવાની જરૂર પડતી હોય છે. જે વધારામાં તેમનામાં અભિવ્યક્તિની શક્તિ હોય, તો તેઓ તેમને શબ્દોમાં અને વાક્યોમાં મૂર્તિરૂપ આપવાનો પ્રયત્ન કરે છે. જ્યારે માણસ તે અનુભૂતિઓને જીત્યો હોય છે અને ઉત્તરતા વળાંકથી સભાન બનનો હોય છે, ત્યારે તેને દરેક અવસ્થામાં, અનુભૂતિની ગહન વાસ્તવિકતા સંકોચાઈ જતી, પશ્ચાદ ભૂમાં અદૃશ્ય બનતી જતી દેખાય છે; તે આગળ આવતી હોતી નથી, સમગ્ર અસ્તિત્વ પર પ્રલુબ્દ સ્થાપતી નથી. તે ખીમે ખીમે આમ (અભિનય) પાણી ચાલી જતી હોય છે. અને બહાર તો એક પ્રકારનું શુષ્ક અને ઠંડુગાર અનુકરણ માત્ર બાકી રહે છે. તેને બહુ ઉત્સાહપૂર્ણ શબ્દોમાં વ્યક્ત કરી શકાય, પણ મૂળ વસ્તુની સરખામહૂરીમાં તેના ગહન સત્યની સરખામહૂરીમાં, તે સંકોચાઈ ગયેલી, ન્યૂન બની ગયેલી હોય છે. સર્વ સાચો આનંદ, સાચી સુંદરતા, આંતર ઉત્સાહ, અનુભૂતિને અદૃશુત ઉઘા આ બધું ખૂબ પાછળ રહ્યી ગયું હોય છે. તમે તેના પર પકડ ચાલુ રાખવા પ્રયત્ન કરો, પણ તે તમારી

પકડમાંથી છટકી જાય છે. આ મૂર્તીકરણની શક્તિની તમારે ભારે કિમત ચૂકવવી પડે છે.

માતાજી, અહીંના આપણા જીવનમાં આપણે 'મનના વિકાસ' નો શો અર્થ કરીએ છીએ? તે કેવી રીતે ઉપયોગે છે?

હું માનું છું કે મેં આ તમને એક વાર સમજાયું હતું. કેળવણી પરના લેખોમાં મેં તેને વીગતવાર સમજાયું હતું. તે શરીર માટેની શારીરિક કેળવણીનાં પરિણામો જેવું જ હોય છે.

આપણે તે અંગો, સ્નાયુઓ, શાનતરંતુઓ, શરીરનાં બધાં જ ઘટક તરવો હોય છે. જો આપણે નેમનો ખાસ વિકાસ ન કરીએ, ખાસ કેળવણી ન આપીએ, તો તે બધી વસ્તુઓ શરીરમાં શક્તિ વ્યક્ત કરવા માટે પોતાથી થઈ શકે તે બધું કરે છે; પણ તે અભિવ્યક્ત બહુ બેદૂઢી અને અપૂર્ણ હોય છે. એ વાત નિઃશ્વાસ છે કે શારીરિક વ્યાયામની ખૂબ પરિપૂર્ણ અને તર્કયુક્ત પદ્ધતિઓ અનુસાર તાલીમ પામેલું શરીર એવાં કર્યો કરવા સર્મર્ય હોય છે, નેમને તે તે તાલીમ વિના ન કરી શક્યું હોત. હું માનું છું કે બધા આમાં સંમન થયે જ. મન માટે પણ તેમ જ છે. તમારી પાસે ધસ્તી શક્યતાઓ અને શક્તિઓવાળું મન છે. પણ તે શક્તિઓ સુધુમ છે. તેમને ખાસ કેળવણીની, તાલીમની જરૂર છે, નેથી તેઓ પ્રકાશને અભિવ્યક્ત કરી શકે. એ વાત તો નિશ્ચિત છે કે સામાન્ય જીવનમાં, મસ્તિષ્ક એ માનસિક ચેતનાની બાબુ અભિવ્યક્તિનું સ્થાન છે. જો આ મસ્તિષ્કનો વિકાસ કરવામાં ન આવે, જો તે ગ્રામ્ય હોય, તો એવી અસંખ્ય વસ્તુઓ છે નેમને તે વ્યક્ત ન કરી શકે, કારણકે પોતાની જાતને પ્રગટ, વ્યક્ત કરવા માટે જરૂરી કરણ તેમની પાસે નથી હોતું. તે એક સંગીત વાદ જેવું છે, જેના સૂરની ધસ્તી ચાલીઓ નથી હોતી અને તેથી જે સ્થૂલ સંગીત પેદા કરી શકે છે, નિશ્ચિત સંગીત નહિ.

માનસિક સંસ્કૃતિ, બૌધ્ધિક કેળવણી તમારા મસ્તિષ્કના બધારણને બદલી નાખે છે, તેને ખૂબ વિશાળ બનાવે છે, અને પરિણામે અભિવ્યક્ત વધારે પરિપૂર્ણ અને નિશ્ચિત બને છે.

જો તમે જીવનમાંથી છટકી જવા માગતા હો, અનિર્વચનીય ઊંચાઈઓ પર ચાલ્યા જવા માગતા હો, તો તેની જરૂર નથી. પણ જો તમે તમારી અનુભૂતિને બાબુ જીવનમાં વ્યક્ત કરવા માગતા હો, તો તે અનિવાર્ય છે.

માતાજી, તમે કહ્યું કે જે માણસ પૃથક્કરણની, નિગમનની વળેરે શક્તિઓ વધારે પડતી વિકસાવે છે, તો તે આધ્યાત્મિક અનુભૂતિઓમાં વિઘનરૂપ બને છે, નહિ વારુ?

જે તેમના પર કાબૂ રાખવામાં ન આવે, પ્રભુત્વ સ્થાપનામાં ન આવે, તો હા. પણ તેમ બને જ એવું નથી. તે કાબૂને વધારે મુશ્કેલ બનાવે, કરાસકે અસંગઠિત સત્ત કરતાં વ્યક્તિરૂપે સંગઠિત થયેલા સત્ત પર પ્રભુત્વ સ્થાપનું એ વધારે મુશ્કેલ છે. વધારે પરિયૂર્ણ વ્યક્તિતસંગઠન થતાં અહેતા વધારે સથન અને સ્વસંતુષ્ટ બને છે, નહિ વારુ? પણ માની લો કે તે મુશ્કેલી પર નિયમ મેળવવામાં આવ્યો છે; તેવી જૂબ વિકાસ પાસેલી વ્યક્તિતનામાં ને પરિણામ આવે છે તે ગ્રામ્ય અને બિનકેળવાયેલા સ્વભાવવાળી વ્યક્તિતના પરિણામ કરતાં અનંતગણું ઉત્કૃષ્ટ હોય છે. હું એમ નથી કહેની કે રૂપાંતરની અથવા સમર્પણની પ્રક્રિયા વધારે મુશ્કેલ નથી, પણ એકવાર તે સિદ્ધ થાય, તો પરિણામ બહુ ઉત્કૃષ્ટ હોય છે:

આને એવાં સંગીત વાદ્યો સાથે સરખાવી શકાય, જેમાં એક વાદને અમુક સંખ્યાના જ સૂરો હોય છે અને બીજા વાદને દશગણા સૂરો હોય છે. ચાર પાંચ સૂરોવાળા વાદને વગાડવું તે વધારે સહેલું હોય છે, પણ બધી સૂરોની ચાવીઓ-વાળા વાદને વગાડવાથી જે સંગીત પેદા થાય છે તે સ્પષ્ટ રીતે વધારે ઉત્કૃષ્ટ હોય છે.

આને સાટા વાદ કરતાં ઓરકેસ્ટ્રા સાથે વધારે સારી રીતે સરખાવી શકાય. પરિયૂર્ણ વિકાસ પાસેલી માનવ વ્યક્તિત એક મહાન, ભવ્ય ઓરકેસ્ટ્રા સમાન હોય છે, જેને સેંકડો વાદ વગાડનારો વગાડતા હોય છે. સ્પષ્ટ રીતે જ, તે બધા પર કાબૂ રાખવો અને તેમને દોષવણી આપવી તે વધારે મુશ્કેલ છે, પણ તેનું પરિણામ આશ્વર્યજનક હોય છે.

\*

## ૧૪ સપ્ટેમ્બર ૧૯૫૮

“આપણું” વિચારક મન મુખ્યત્વે સામાન્ય આધ્યાત્મિક કથન સાથે, તેની કેવળતાના તથા પારસ્પરિક સંબંધીના તર્ક સાથે, કેવી રીતે તે એકબીજા પ્રત્યે દોષી જાય છે તેની સાથે, અને અસ્તિત્વના આધ્યાત્મિક પ્રમેયોમાં થાં માનસિક પરિણામો હોય છે તેની સાથે સંબંધ રાખતું હોય છે.

આ બૌધ્ધિક સમજની જરૂરિયાતને સંતોષવા માટે, આપણા મનના સ્વભાવે આપણને તત્ત્વચિતનરૂપી સાધન આપેલું છે; અને આ કોત્રમાં તે આધ્યાત્મિક તત્ત્વચિતન હોવું જોઈએ. પૂર્વમાં એવી પદ્ધતિઓ અનેક સંખ્યામાં ઉદ્ય પાલ્યો છે. જ્યાં જ્યાં ખૂબ આધ્યાત્મિક વિકસ સધાર્યો છે, ત્યાં ત્યાં ખૂબ સમજ તે વિકસને પ્રમાણિત કરવા માટે એક તત્ત્વચિતનનો ઉદ્ય થયો હોય છે. ઉપનિષદના ગહન વિચારમાં અને વિશ્વાણ ભાષામાં કહીએ તો, તે પદ્ધતિ પ્રથમ આંતર દર્શના હતી, આંતર દર્શનાની અભિવ્યક્તિ હતી. પણ પાછળથી એક સમાવોચન પદ્ધતિ વિકસાવવામાં આવી, તર્કની એક દૃઢ પદ્ધતિ વિકસાવવામાં આવી, તાર્કિક સંગ્રહન રચવામાં આવ્યું. પાછળનાં તત્ત્વચિતનો એડ બૌધ્ધિક વૃત્તાંતરૂપ ૧ હતાં અથવા આંતર વડે શોધી કઢાયેલું તર્કયુક્ત પ્રમાણ હતું; અથવા તો તે પોતાની જાતને એક માનસિક ભૂમિ અથવા સાક્ષાત્કાર તથા અનુભૂતિ માટે એક પદ્ધતિ પૂરી પાડતાં હતાં. ૨ પદ્ધતિમાં સમન્વયી વલસુની જગ્યાએ વિશ્વેષણાત્મક અને પુષ્ટકં કરસીય વલસુ આવ્યું હતું. એટલે આધ્યાત્મિક આવેગે અને બૌધ્ધિક તર્કશક્તિન એ એક બીજાથી પ્રારંભમાં જ વિદ્યાય લીધી. તત્ત્વચિતને પ્રથમથી જ વસ્તુઓની કેવળ બૌધ્ધિક અને તાર્કિક સમજૂતિ બની રહ્યું. છતાં સ્ટોર્ક, એપીક્યુરિયન, અને પાઈએગોરિયન જેવી પદ્ધતિઓ હતી, જે માત્ર વિચાર માટે જ નહિ, પણ જીવનના આચરણ માટે પણ કિયાશીલ હતી, અને જેમણે એવી એક સાધના, સત્તની આંતર પરિપૂર્ણતા માટેનો પ્રયાસ વિકસાવ્યાં હનાં, પાછળની ખ્રિસ્તી અને નિયોગેગન વિચાર રચનાઓમાં આ જ્ઞાનની ઉચ્ચતાર આધ્યાત્મિક લૂભિકાને પ્રાપ થઈ, જ્યાં પૂર્વ અને પદ્ધતિમનું મિલન થયું. પણ પાછળથી બૌધ્ધિકીરણ પરિપૂર્ણ બની ગયું, અને તત્ત્વચિતનનો જીવન સાથે અને તેની શક્તિઓ સાથે અથવા એક આત્માનો તેની કિયાશીલતા સાથેનો સંબંધ કર્પાઈ ગયો, અથવા તો એટલો બધા ઓછો થઈ ગયો કે, તત્ત્વચિતનીય વિચાર, ભાવવાચક અને ગોળુ અસર દ્વારા, જીવન અને કિયા ઉચ્ચર પ્રભાવ પાડી શકે. પદ્ધતિમાં ધર્મતત્ત્વચિતનનો ટેકો નથી લીધો, પણ સાંપ્રદાયિક આસ્તકતાનો ટેકો લીધો છે. કેટલીક વાર આધ્યાત્મિક તત્ત્વચિતન માત્ર વ્યક્તિની પ્રતિલાના બળ વડે ઉદ્ય પાએ છે; પણ પૂર્વમાં બન્યું છે તેમ, ત્યાં તે આધ્યાત્મિક અનુભૂતિના અને પ્રયાસના અનિવાર્ય સાથીદાર તરીકે ઉદ્ય નથી પામ્યું. એ વાત સાચી છે કે આધ્યાત્મિક વિચારનો તત્ત્વચિતનીય વિકસ તદ્દન અનિવાર્ય નથી હોતો, કારણે આત્માનાં સત્યો આંતર દર્શના વડે અને સધન આંતર સંપર્ક વડે સીધી રીતે અને પરિપૂર્ણ રીતે, પ્રાપ્ત કરી શકાય છે. એમ

પણ કહેવું જોઈએ કે, આધ્યાત્મિક અનુભૂતિ પર બુદ્ધિનો સમાવેચક કાણું અવરોધરૂપ અને અવિશેષસનીય બની શકે છે, કારણકે તે ઉચ્ચતર પ્રકાશના ક્ષેત્ર ઉપર ફેંકતો નિર્માટ પ્રકાશ છે. ચાચી નિયામક શક્તિ આંતર વિવેક, યોગસિક જ્ઞાનના અને સમૃદ્ધસૂચકના, બૈર્ધ્વમાંથી જ્ઞાનની દોરવણી, ઉત્કૃષ્ટ દરમિયાનગીરી અથવા સાહજીક પ્રકાશયુક્ત આંતર દોરવણી, હોય છે. પણ જ્ઞાનાંય આ વિકાસ પણ જરૂરી છે, કારણકે આત્માની અને બૌધ્ધિક તર્કની વચ્ચે પુલ હોવો જોઈએ. આપણું પરિપૂર્ણ આંતર ઉત્કાન્ત માટે, આધ્યાત્મિક બુદ્ધિનો પ્રકાશ આવશ્યક છે. જે તે ન હોય, અને બીજુ ગણનતર દોરવણી હજુ પ્રાપ્ત ન થઈ હોય, તો આંતર ગતિ સ્વર્ચાંદી, શિસ્તહીન, મલીન, મિનગ્રાધ્યાત્મિક તત્ત્વોથી અથવા એકાંગી અથવા અપૂર્ણ દૃષ્ટિથી સંમિક્ષાન બની જાય. અજ્ઞાન સમગ્ર જ્ઞાનમાં રૂપાંતર પામે તે માટે, આપણામાં આધ્યાત્મિક બુદ્ધિની વૃદ્ધિની જરૂર છે, જે બુદ્ધિ ઉચ્ચતર પ્રકાશને જીવીને આપણા સ્વભાવના બધા જ્ઞાનોમાં તેને વહેવરાવી શકે તે એક ખૂબ મહત્વની વચ્ચગાળાની જરૂરિયાત છે.”

( દિવ્ય જીવન, પૃષ્ઠ ૮૯૮-૮૯ )

આમાં તમે મને બાર પ્રશ્નો પૂછી શકો એટલી સામગ્રી છે! ( એક બુણકને ) તે બારમાંને પ્રથમ પ્રશ્ન તું પૂછ.

( મૌન )

મારે અહીં એક પ્રશ્ન છે, પણ તે શાખિક પ્રશ્ન છે, અર્થાત્ તે બહુ રસપ્રદ નથી. તે ફકરાના આરંભ વિષે છે. “ અસ્તિત્વના આધ્યાત્મિક પ્રમેયની માનસિક ચેતના ” નો શો અર્થ છે?

તે અવા માણસનો પ્રશ્ન છે કે જે ‘પ્રમેય’ નો અર્થ જાણુતો નથી!

પ્રમેય એટલે સત્યનું એવું કથન કે જે તર્ક બુદ્ધિ દ્વારા પ્રાપ્ત થયેલું હોય છે. અસ્તિત્વશાસ્ત્રમાં તે શબ્દ તદ્દન સધન રીતે વાપરવામાં આવતો હોય છે, અને બીજાં જાત્વ વિજ્ઞાનોમાં પણ. તત્ત્વચિંતનીય દૃષ્ટિબિનદ્દી જોતાં, તે એ જ વસ્તુ છે. આ દ્વારા આત્મામાં, અસ્તિત્વના આધ્યાત્મિક પ્રમેયને આ રીતે મૂડી શકાય, અનેકતામાં એક અથવા સંબંધોમાં પરાતપર. પણ માનસિક પરિણામોને સમજાવવા માટે આપણે તત્ત્વચિનનમાં જરૂર જોઈશે; હું માનું છું કે તે માટે તમે હજુ તૈયાર

નથી. તેનો અર્થ સાચી રીતે સમજવા માટે, એમ લાગે છે કે તત્ત્વચિત્તન હુમેશાં સત્યને કિનારે ભ્રમણ કરતું હોય છે. ટેન્જન્ટની પેઠે, જે વ્યારે ને વ્યારે નજીક આવતું જતું હોય છે, પણ કરી રૂપર્થી કરી શકતું નથી, કંઈક તેમાંથી છટકી જતું હોય છે. અને આ ‘કંઈક’ તે હડીકતમાં, સત્યમાં રહેલું સત્ય છે.

આ વસ્તુઓ સમજવા માટે માત્ર અનુભૂતિ જ, સત્યમાં જીવનું એ જરૂરી છે, જેમ સામાન્ય ઈન્દ્રિયો તેને અનુભવે છે તેમ નહિ, પણ પોતામાં સત્યનો સાચાત્કાર કરવો, બંને વિનુદ્ધ સ્થિતિઓ એકો વખતે એકી સાથે જ રહેતી હોય છે તે સધન અસ્તિત્વનો અનુભવ કરવો. શબ્દો તો માત્ર ગ્રંચવાડો જ પેદા કરે, માત્ર અનુભૂતિ જ વસ્તુની સધન વાસ્તવિકતા આપી શકે. પરાત્પરતું અને સંબંધિનું, એકનું અને અનેકતાનું બંનેનું એક સાથે હોયનું, એક પણી બીજી સ્થિતિ આવે એમ નહિ, પણ એક જ સ્થિતિ બેનું બે વિનુદ્ધ પ્રકારે વાસ્તવિકતા સાથેના સંબંધમાં જે દૃષ્ટિબિન્દુ બેવામાં આવે તેના પર આધાર રાખતું દર્શાવ થાય,

શબ્દો પોતે તો અનુભૂતિને જોઈ રીતે રણ્ણ કરતા હોય છે. શબ્દોમાં કથન કરવા માટે, માસુસ એક ડગલું પાછો નથી જતો હતો, પણ એક ડગલું નીચે ઉત્તરતો હોય છે; અને તેથી તાત્ત્વિક સત્ય છટકી જતું હોય છે. અનિર્વચનીય સત્યને પહોંચવાના માર્ગને ઓછા પત્તા પ્રમાણમાં સુયમ બનાવવા માટે શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. આ દૃષ્ટિબિન્દુથી જેતાં, બધાં જ કથનો એક સરખાં હોય છે. દરેક કથન કોઈ છે, જે બીજા કથનને યાદ રાખવામાં મદદ રૂપ બનતું હોય, અર્થાત જે રીતે કૃપાની દરમિયાનગોરી વિચારમાં સ્થાપિત થતો હોય.

ધાર્યાં કરીને કોઈ બે પ્રકારો તદ્દન એક સરખાં નથી હોતા. દરેક જરૂરી પોતાનો માર્ગ શેખાં કાઢવો જોઈએ. પણ માસુસે ભૂલ ન કરવી જોઈએ. માર્ગને તર્કબુદ્ધિ વડે જોલી કાઢવાનો હોતો નથી, તેને અલોચસા વડે જોલી કાઢવાનો હોય છે. તે અધ્યયન અને પૃથકુરસુ વડે પ્રામ નથી હતો, પણ અલોચસાની ઉત્કટતા વડે અને આંતર ખુલ્લાપણુંની, દિલની સરચાઈ વડે પ્રામ થાય છે.

જ્યારે માસુસ સાચી રીતે, સંપૂર્ણપણે માત્ર સત્ય પ્રાન્યે જ, પણી તે સત્યને તમે જરૂર તે નામ આપો વળેદો હોય છે, જ્યારે ગ્રીજા બધી વસ્તુઓ ગોણું બની ગઈ હોય છે, જ્યારે તે એક જ વસ્તુ અનિવાર્ય અને આશાકારક બની ગઈ હોય છે, ત્યારે જવાબ પ્રામ કરવા માટે, ઉત્કટ, કેવળ, સમગ્ર એકાગ્રતાની એક જ કાણ પૂરતી હોય છે.

આ બાબતમાં અનુભૂતિ પ્રથમ આવે છે; તેના પરિસ્થિતિ રૂપે, સમૃતિ રૂપે કથન પાછળથી સ્પષ્ટ બનતું હોય છે. આ રીતે માલુસ ચેક્સ ભૂલ કરતો હોતો નથી. કથન વત્તા ઓછા પ્રમાણે નિશ્ચિત હોઈ શકે. જ્યાં સુધી માલુસ તેનો એક કટૂર સિલ્ફાન બનાવી લેનો નથી, ત્યાં સુધી તે કથન બહું મહત્વનું નથી.

તમારે માટે તે સારું છે, માત્ર તેની જ જરૂર છે. જે તમે તેને પણી તે ગમે તે હોય બીજા પર ઠોકી બેસાડવા માગો છો, તો તે વસ્તુ પરિપૂર્ણ હોય છતાં પણ તે અસત્ય બની જાય છે.

તેથી ધર્મા હમેશાં ભૂલ ભરેલા હોય છે, કારસુકે તેમો અનુભૂતિની અભિવ્યક્તિને એક ધોરણું બનાવી દેવા માગતા હોય છે અને તેને દરેક જણ પર, એક અકાટ્ય સત્ય તરીકે, ઠોકી બેસાડવા માગતા હોય છે. જેને અનુભૂતિ થઈ હતી તેને માટે, તે સત્ય હતી, પરિપૂર્ણ હતી, ખાતરી આપી શકે તેવી હતી, તેણે તેનું જે કથન કર્યું તે તેને મારે સરસ હતું, પણ તેને બીજાઓ પર ઠોકી બેસાડનું તે પાયાની ભૂલ છે, જેનાં પરિસ્થિતિ બહુ ખતરનાક આવતો હોય છે, જે સત્યથી બહુ વેગેજે દૂર દોશી જતાં હોય છે.

તેથી ધર્મ ગમે તેવા સુંદર હોય, પણ તેણે માલુસોને ખરાબ અતિશયતાઓ પ્રત્યે દોર્યા છે. ધર્મને નામે જે ગુનનાઓ થયા છે, જે ભયંકરતાઓ આચયરાઈ છે તે માનવ ઈતિહાસ પર સૌથી વધારે કાળાં કલ્પાંડી છે, અને તે પણ માત્ર શરૂઆતની નાનકડી ભૂલને પરિસ્થિતિ એક વ્યક્તિને માટે જે સાચું છે તેને સમૂહ માટે પણ સાચું બનાવવાની માનવાની ઈચ્છા.

(મૌન)

માર્ગ બતાવવો જોઈએ, દ્વાર જોલવું જોઈએ; પણ દરેક જણે પોતાના માર્ગને અનુસરવું જોઈએ, દ્વારમાંથી પસાર થવું જોઈએ, અને પોતાના અંગત સાક્ષાત્કાર પ્રત્યે પ્રગતિ કરવી જોઈએ.

માત્ર કૃપાની જ મદદ મળતી હોય છે, તેની જ મદદ લેવી જોઈએ, જે કૃપા, દરેક જણની જરૂરિયાત અનુસાર, તેને માટે સચના કરતી હોય છે.

\*

## ૨ ઓક્ટોબર ૧૯૫૮

મધુર માનાજી, નૈતિક પરિપૂર્ણતાનો આદર્શ હોય છે?

હજરો પ્રકારની નૈતિક પુરિપૂર્ણતાઓ હોય છે. દરેક જગ્યને નૈતિક પરિપૂર્ણતાનો પોતાનો આદર્શ હોય છે.

મોટે ભાજે, નૈતિક મનાતા બધા સદગૃષેને પ્રામન કરવા તેને નૈતિક પરિપૂર્ણતા કહેવામાં આવે છે. દ્વાષો ન હોવા, કદી ભૂલ ન કરવી, કદી જોટી વસ્તુ ન કરવી, બધા સદગૃષો હોવા, ઉચ્ચતમ માનસિક જ્યાબોને સિદ્ધ કરવા, માણસો એ જે સૌથી વધારે સુંદર, સૌથી વધારે ઉદાત્ત, સૌથી વધારે સત્ય કલાયું છે તેને પ્રામન કરવું અને તેને સમગ્રપણે જીવનમાં ઉતારવું, પોતાનાં બધાં કાયેને અને ગતિઓને તેના વડે નિયમિત કરવાં; બધી વાગ્યોઓને, પ્રતિકાર્યેને તેના વડે નિયમિત કરવાં, આને પરિપૂર્ણતાનો નૈતિક આદર્શ કહેવામાં આવે છે. તે માણસની માનસિક ઉત્કાંતિનું શિખર છે.

ઘણા બોકો તે કરતા હોતા નથી; છતાં કેટલાક બોકોએ તે કર્યું હતું અને હજી પણ કરે છે. સામાન્ય રીતે, બોકે, આને આધ્યાત્મિક જીવન માની બેતા હોય છે. જ્યારે તેઓ આ પ્રકારનાં માણસને મળે છે, ત્યારે તેઓ કહે છે કે, એહાં, આ તો મહાન આધ્યાત્મિક વ્યક્તિત્વ છે. તે મહાન સંત હોય, મહાન સાધુ હોય; પણ તે આધ્યાત્મિક વ્યક્તિત્વ નથી.

અને છતાં આને સિદ્ધ કરવું તે ખૂબ સરસ હોય છે, ખૂબ મુશ્કેલ હોય છે. પછી અંતર ઉત્કાંતિમાં એવો એક સમય આવે છે, જ્યારે આને સિદ્ધ કરવું એ ખૂબ જરૂરી હોય છે. પોતાના આવેંગો વડે અને અશાનમય બાબ્દે પ્રતિકાર્યો વડે ખડકેલાપા કરતાં તે અનંતગાયું ઉચ્ચતર છે. તે પોતાની પ્રકૃતિના સ્વામી બનવાના માર્ગ પર આવી ગયાની નિશ્ચાની છે. તે સ્થિતિમાંથી માણસો પસર થવું જ મડતું હોય છે, કારણ કે તે સ્થિતિમાં માણસ પોતાની અહંકાર પર પ્રભુત્વ સ્થાપવાનો પ્રારંભ કરી દેતો હોય છે, અહંતાને ફિયાવી દેવાની શરૂઆત કરી દેતો હોય છે; હજી અહંકાર રહી હોય છે ખરી, પણ તે બધું જ નબળી બની ગઈ હોય છે. બીજી બાજૂને પ્રામન કરવામાં, આ છેલ્લી સ્થિતિ છે. એ સ્થિતિ જે પ્રામન કરી હોય, તો માણસ મોટી ભૂલ કરી બેસે, પરિપૂર્ણ નબળાઈને પરિપૂર્ણ સ્વતંત્રતા માનવાની ભૂલ કરી બેસે.

અમૃક સમય સુધી પછી ભલે તે ટૂંકો જાળો હોય, આ નૈતિક પરિપૂર્ણતાના આદર્શને સિદ્ધ કરવામાંથી માસુસ જે પસાર ન થાય, તો ખૂબ પરિપૂર્ણ અને નોંધપાત્ર માનસિક સતતમાંથી સાચા આધ્યાત્મિક જીવનમાં પ્રવેશવું તે લગભગ અશક્ય છે. ઘણા વેકો ટૂંકો માર્ગ હેવા માગતા હોય છે, તેમના બાબ્દે સ્વભાવની સર્વ નભળાઈઓ પર વિજય પ્રાપ્ત કર્યા પહેલાં પોતાની આંતર સ્વતંત્રતાને મેઝબાન માર્ગ આપવા માગતા હોય છે, તેઓ પોતાની જતને છેતરવાનું મહાન જેખમ વહેરી રહ્યા હોય છે. સાચું આધ્યાત્મિક જીવન, પરિપૂર્ણ સ્વતંત્રતાએ ઉચ્ચતમ નૈતિક પરિપૂર્ણતા કરતાં ખૂબ ઉચ્ચતર વસ્તુ છે; પણ માસુસે ખૂબ સાવધાનતા હશવી જોઈએ કે એ કહેવાતી સ્વતંત્રતા એ વિષય લેખા નથી, સર્વ નિયમોની અવગણુના નથી.

માસુસે હંમેશાં ઊંચે, વધારે ઊંચે જવાનું છે, ઉચ્ચતમ માનવતાએ જે સિદ્ધ કર્યું છે તેનાથી જરા પણ ઓછું નહિ.

માનવતાએ જેને ઉચ્ચતમ, સૌથી વધારે સુંદર, સૌથી વધારે પરિપૂર્ણ, સૌથી વધારે નિરુસ્વાર્ય, સૌથી વધારે વિશાળ, કોઈ ગણ્યું છે, તેને સિદ્ધ કરવા માટે માસુસે આપોઆપ સમર્થ જન્મનું જોઈએ. પછી જ તે પોતાની આધ્યાત્મિક પાંચો જોખવી જોઈએ, જીર્દવમાંથી તે બધી વસ્તુઓ પર નજર કરવી જોઈએ, જેથી તે સાચી, અમર્યાદિત આધ્યાત્મિકતામાં પ્રવેશી શકે, જે આધ્યાત્મિકતા સમગ્ર રીતે અનંતનામાં અને શાશ્વતીમાં જીવન ધારણ કરે છે.

\*

## ૮ એાક્ટોયર દિનાંક

મધુર માતાજી, માનવ અને અતિમાનવ વચ્ચે કોઈ વચ્ચગાળાની સ્થિતિએ નહિ હોય?

ઘણું કરીને વચ્ચગાળાની ઘણી સ્થિતિએ હો.

માનવ અને અતિમાનવ ? તમે નવીન અતિમાનસ જાતિની વાત નથી કરના, નહિ વારુ ? તમે આપણે જેને વાસ્તવિક રીતે અતિમાનવ કહીએ છીએ, જે

માનવીય રીતે જન્મયો હશે અને તે રીતે પ્રામ થયેલા શારીરિક અસ્તિત્વનું જે રૂપાંતર કરવા માટે પ્રયત્ન કરતો હશે, તેની વાત કરો છે? ત્યાં હોઈ કંપિક સ્થિતિઓ હોય છે? ચેક્કસ, તેમાં અસંખ્ય આંશિક સાક્ષાતકારો હશે. દરેક જણની શક્તિ અનુસાર, રૂપાંતરની માત્રા લિનન લિનન હશે. તે વાત ચેક્કસ છે કે તેમાં ઘણા પ્રયાસો હશે, જે ઓછા વત્તા પ્રમાણમાં સહૃદી અથવા નિષ્ફળ નૌકડા હશે. પછી જ આપણે કાંઈક અતિમાનવ પણે જઈ શકીયું, અને તે પણ ઓછા વત્તા 'પ્રમાણમાં થયેલા પ્રયાસો' જ હશે.

જે બોઝો પોતાની સામાન્ય પ્રકૃતિ પર વિજય મેળવવા માગે છે; દિવ્ય સંય સાથે તેમનો સંપર્ક સાથી આપનાર, ગણનતર અનુભૂતિને ભૌતિક રીતે સિદ્ધ કરવા માટે પ્રયાસ કરે છે, પરાત્પરમાં અથવા ઉત્ત્યતમમાં વળવાને બદલે જેઓ પોતામાં સિદ્ધ થયેલા ચેતનાના પરિવર્તનને શારીરિક રીતે, બાધ રીતે સિદ્ધ કરવા પ્રયાસ કરે છે તે બધા ઉમેદવાર અતિમાનવો છે. તેમના પ્રયાસોની સહૃદ્યતામાં અસંખ્ય લેદો હોય છે. જ્યારે જ્યારે આપણે સામાન્ય માનવી મટી જઈને, સામાન્ય જીવન ન જીવતાં, આપણી જગતઓમાં, કર્યોમાં, પ્રતિકર્યોમાં દિવ્ય સત્યને અલિવ્યકૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, સામાન્ય અજ્ઞાન વડે શાસ્ત્રિત થવાને બદલે આપણે જ્યારે તે ગ્રત્ય વડે શાસ્ત્રિત થવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણે ઉમેદવાર અતિમાનવો હોઈએ છીએ; આપણા પ્રયાસોની સહૃદ્યતા અનુસાર, આપણે વધારે કે ઓછા ઉમેદવારો હોઈએ છીએ, માર્ગ પર વધારે કે ઓછા આગળ વધ્યા હોઈએ છીએ.

એટલે આ બધી કંપિક અવસ્થાઓ છે. હકીકતમાં, રૂપાંતર પ્રત્યેની આ દોડની શરતમાં પ્રશ્ન એ છે કે બેમાંથી પહેલો કોણ લક્ષ્યને પહોંચશે, દિવ્ય સત્યના પ્રતિબિંબમાં પોતાના શરીરનું જે રૂપાંતર કરવા માગે છે તે, કે પછી શરીરની જૂની ટેવ, જેમાં શરીર ધીમે ધીમે વિકૃત બનતું જાય છે અને છેવટે બાધ સમગ્રતામાં જીવાનું ચાલુ રાખી શકતું નથી તે રૂપાંતર અને કીણતા વચ્ચે દોડની હરીકાઈ છે. કારણકે તેમાં બે જ વિરામસ્થાનો હોય છે, માણસ ક્યાં સુધી સહૃદી થયો છે તે બતાવનારી બે વસ્તુઓ હોય છે, કાંતો અતિમાનવ બન્યાની સહૃદ્યતા કે જ્યારે માણસ કહી શકે કે હવે હું લક્ષ્યને પહોંચ્યો છું, અથવા તો મૃત્યુ. ત્યાં સુધી માણસ માર્ગ પર આગળ વધતો હોય છે.

લક્ષ્યની પ્રાપ્તિ અથવા મૃત્યુ, આ બેમાંથી એક આગેકુચને અટકાવી દે છે. માર્ગ પર તેમાનો દરેક જણ વત્તાઓછા પ્રમાણમાં આગળ વધ્યો હોય છે, પણ

જ્યાં સુધી માણસ અંતને પહોંચ્યો હોતો નથી, ત્યાં સુધી તે કથી સ્થિતિમાં છે તે ન કહી શકાય. તેમાં આજરી પગલું નિર્ણયિક મહત્વનું હોય છે. એટલે સો અથવા હજર વર્ષો પછી આવનાર માણસ, પાછળ દૃષ્ટિપાત કરીને, કહી શકે કે આ સ્થિતિ અથવા પેલી સ્થિતિ હતી, આ સાક્ષાત્કાર અથવા પેલો સાક્ષાત્કાર સિદ્ધ થયો હતો. તે ઈતિહાસ છે, તે ઘટનાનું ઔતિહાસિક દર્શન હશે. ત્યાં સુધી આપણે બધા જ ગતિની, કાર્યની મંદ્યમાં હીંઓ.

આપણે ક્યાં સુંચી આગળ ગયા હીંઓ, અને ક્યાં સુધી આગળ જઈશું? તેને વિષે બહુ વિચાર ન કરવો એ વધારે સારું છે, કારણકે તે તમને અપંગ બનાવી દું છે, તમે સારી રીતે દોડો શકતા નથી. માત્ર દોડવાની બાબતનો જ વિચાર કરવો તે વધારે સારું છે, બીજું કથાનો નહિ. તે જ સારી રીતે દોડવાનો માર્ગ છે. તમે લક્ષ્ય પ્રત્યે જુઓ છો અને આગળ વધવાની ગતિમાં જ તમારો સર્વ પ્રયત્ન મૂકી આપતા હો છો. તમે કેટલે દૂર આગળ પહોંચ્યા છો, તે તમારી ચિંતાનો વિષય નથી. હું આને ઈતિહાસ કહું છું, તે પાછળથી આપશે. આપણા પ્રયાસના ઈતિહાસકારો કહેશે કે, કારણકે આપણે કદાય તે વખતે જીવતા હોઈશું, આપણે શું કર્યું અને કેવી રીતે કર્યું. અત્યારે તે કાર્ય કરવાની જ જરૂર છે, આ જ મહત્વની વસ્તુ છે.

\*

## ૨૨ એકટોબર ૧૯૫૮

“પણ આ દૃષ્ટિબિન્દુથી માનવમાં થયેલી આધ્યાત્મિક ઉત્કૌંતિની સાચી અર્થવતાનું અથવા આધ્યાત્મિકતાનું મૂલ્ય ન આંકી શકાય. કારણકે તેનું સારું કાર્ય, ભૂતકાળના અથવા અત્યારના માનસિક પાયા પર માનવીય સમસ્યાઓનો ઉકેલ લાવવાનું નથી, પણ આપણા અસ્તિત્વનો, જીવનનો, અને જીબનનો એક નવીન પાયો સર્જવાનું છે. રહસ્યવાદીનું તપસ્યામય અથવા પારદીકિક વલણ એ ભૌતિક પ્રકૃતિ વડે લદાયેલી મર્યાદાઓ સ્વીકારવાના ઈન્કારનું, છેલ્લી હદનું, કથન છે, કારણકે તેના અસ્તિત્વનો હેતુ જ પ્રકૃતિથી પર જવાનો હોય સે, જો તે તેનું દૃપોતર ન જીવી શકતો હોય, તો તેણે પ્રકૃતિનો ત્યાગ કરવો જ રહ્યો. પણ સાથે

સાથે, આધ્યાત્મિક માનવે માનવ જાતિના જીવનમાંથી તદ્દન પાછો હકી ગયો નથી, કારણ કે સર્વ પ્રાણીઓ સાથે એકતાની ભાવના, વૈશ્વિક પ્રેમ અને કરુણા પર મૂકાતો લાર, બધાં પ્રાણીઓના કલ્યાણ માટે પોતાની શક્તિઓને ખર્ચવાનો સંકલ્પ આ બધું આત્માની સક્રિય જિવવણી માટે કેન્દ્રસ્થ હોય છે. તેથી તે બીજાઓને મદદ કરવા તરફ વળ્યો છે. પ્રાચીન ઋષિઓ અથવા પયળબારો એઠે તેણે માનવ જાતિને દેસવણી આપી છે, અને નવીન સર્જનો કરવા માટે નીચે નમ્યો છે. પણ જ્યારે તેણે આત્માની સીધી શક્તિ સાથે, તેમ કર્યું છે, ત્યારે પરિશ્શામો ખૂબ મહાન આવ્યાં છે. પણ આધ્યાત્મિકના સમસ્યાનો જે ઉકેલ આપે છે તે બાબ્દ સાધનો વડે તો નથી હોતો કે કે તે સાધનોનો પણ ઉપયોગ તો કરવાનો હોય છે જ, પણ તે ઉકેલ આંતર પરિવર્તન વડે, ચેતનાના અને સ્વભાવના રૂપાંતર વડે લાવવાનો હોય છે.

જે તે પરિશ્શામ નિશ્ચયાત્મક ન હોય, માત્ર સહાયક જ હોય, ચેતનામાં કેટલાક નવીન, બધારે સૂક્ષ્મ તત્ત્વોનો ઉદ્દેશો જ હોય, તો તે પરિશ્શામ સામાન્ય પ્રકારનું હોય છે, તેમાં જીવનનું રૂપાંતર થયું હોતું નથી. તેનું કારણ એ હોય છે કે સમૂહમાં તો માનવી હંમેશાં આધ્યાત્મિક આવેગને આડમાર્ગ ઇંટાવી હોતો હોય છે, આધ્યાત્મિક આદર્થમાંથી પાછો પડી ગયો હોય છે, અથવા તેના બાબ્દ રૂપને જ વળગી રહ્યો હોય છે અને આંતર પરિવર્તનનો તેણે ઈન્કાર કર્યો હોય છે. આધ્યાત્મિકતાને જીવન સાથે કામ પાડવા માટે, બિનઆધ્યાત્મિક પદ્ધતિથી ન બોલવી શકાય; રાજકારણી, સામાજિક, અથવા યાંત્રિક સાધનો વડે બધાં અનિષ્ટો મિટાવી દેવાનો પ્રયત્ન કરવા આધ્યાત્મિકતાને ન બોલવી શકાય, જે સાધનોનો પ્રયાસ મન સતત કરતું હોય છે, અને જે હંમેશાં નિષ્ફળ નીવડ્યાં છે અને કોઈ પણ વસ્તુનો ઉકેલ લાવવામાં નિષ્ફળ જવાનાં જ છે. આ સાધનો જે તળિયા જાટક પરિવર્તનો લાયે છે તે કથાનું પરિવર્તન કરી શકતાં હોતાં નથી, કારણકે જૂનાં અનિષ્ટો નવાં રૂપોમાં અસ્તિત્વ ધરાવે છે. બાબ્દ પરિસ્થિતિઓમાં ફેરફાર થાય છે, પણ માણસ જેવો હોતો તેવો જ રહે છે, તે હજુ પણ અજ્ઞાનમય, માનભિક પ્રાણી છે, જે તેના જ્ઞાનનો હુકુમપ્રોગ કરે છે અથવા તેનો ઉપયોગ અસરકારક કરતો નથી; તે અહેતા વડે સંચાલિત થાય છે, પ્રાણિક આવેગો અને કામનાઓ વડે શાસિત થાય છે, શરીરની જરૂરિયાતો વડે શાસિત થાય છે, તેનું દૃષ્ટિબિનદુ બિન આધ્યાત્મિક અને ઉપર્યોગિયું હોય છે, તે પોતાની જતને જાણતો હોતો નથી, અને જે બજો તેને ધક્કેવતાં હોય છે, તેનો ઉપયોગ કરતાં હોય છે.

તેમને તે જાણુતો હોતો નથી. માત્ર આધ્યાત્મિક પરિવર્તન જે, ઉપરચોટિયા માનસિકમાંથી જહનતર આધ્યાત્મિક ચેતનામાં તેના સતતની ઉત્કાનિત જ સાચો અને અસરકારક તફાવત લાવો શકે. આધ્યાત્મિક માનવનું મુખ્ય કાર્ય છે પોતામાં રહેલા આધ્યાત્મિક સત્તને શોધી કાઢવું તે; માનવ જતિને તેની સાચી સેવા છે તે જ ઉત્કાનિત પ્રત્યે જવામાં બીજાઓને મદદ કરવી તે. જ્યાં સુધી તે નહિ થાય, ત્યાં સુધી બાબ્ય મદદ રાહત આપી શકે, દુઃખ થોડું ઘણું મટાડી શકે; પણ તેથી વધારે કાંઈ ન થઈ શકે."

(દિવ્ય જીવન, પૃષ્ઠ ૮૮૩-૮૪)

મધુર માતાજી, જેનામાં વધારે આધ્યાત્મિક શક્તિ નથી તેવો માણુસ આ કામમાં કેવી રીતે વધારેમાં વધારે મદદ કરી શકે?

માણુસમાં વધારે આધ્યાત્મિક શક્તિ છી કે ઓછી, તે કેવી રીતે કહી શકાય તે હું જાણતી નથી. તે તે પ્રકારની બાબત નથી.

આધ્યાત્મિક જીવન જીવવા માટે, ચેતનાને ઊલટાવી દેવાની જરૂર છે. માણુસમાં માનસિક ક્ષેત્રમાં જે બિનન બિન શક્તિઓ અથવા શક્તયતાઓ હોય છે તેની સાથે આને કોઈ પણ રીતે સરખાવી શકાય નહિ. કોઈ માણુસ માટે એમ કહી શકાય કે તેનામાં જાગ્રી માનસિક, પ્રાણિક, કે શારીરિક શક્તિ નથી, તેની શક્તયતાઓ બહુ મર્યાદિત છે; તેવા માણુસની બાબતમાં એમ પૂછી શકાય કે તેની શક્તિઓનો વિકાસ કેવી રીતે થાય? અર્થાતું તે કેવી રીતે નવીન શક્તિઓને પ્રાપ્ત કરી શકે? તે જરાક અધરું છે. પણ આધ્યાત્મિક જીવન જીવવા માટે, પોતામાં જ એક બીજી જગત પ્રત્યે ખુલ્લા થવાનું હોય છે; જાણે કે પોતાની ચેતનાને ઊલટાવી દેવાની હોય છે. સામાન્ય માનવ ચેતના ખૂબ વિકાસ પામેલા, બુદ્ધિશાળી, મહાન સિદ્ધિ પ્રાપ્ત કરેલા લોકોમાં પણ બહાર કરાતી ગતિ હોય છે; બધી શક્તિઓને બહારની દિશામાં મોકલ્લાતી હોય છે; સમગ્ર ચેતના બહાર વીભરાઈ ગ્રહેલી હોય છે, જે કાંઈ અંતર્મુખ બનાવેલી હોય છે તે બહુ જ થોડી, વિરલ, અને આંશિક હોય છે; તે ખાસ પરિસ્થિતિના દ્વારાને બદ્ધિને બનનું હોય છે; જીવન આવા આધાતો, ચેતનાની બાધીકરણની ગતિને જરાક ઊલટાવવા માટેના આશ્યથી, આપત્તનું હોય છે.

પણ જે બોડે આધ્યાત્મિક જીવન જીવા છે, તે બધાને તેવા જ અનુભવે જ્યા હતા, ઓચિનું તેમના અસ્તિત્વમાંના કંઈકને ઉલટાવી દેવામાં આવ્યું હતું, અંતર્મુખ જનાવી દેવામાં આવ્યું હતું, સાથે સાથે ઊર્ધ્વકૃત કરવામાં આવ્યું હતું, અંદરથી ઊર્ધ્વમાં, પણ તે બાબુ ઊર્ધ્વ નથી હોતું, તે અંદરનું, ગાળ ઊર્ધ્વ હોય છે, જે શાયીરિક, જોતિક જીવાઈઓથી લિનન હોય છે. અસરશે: કશાકને ઉલટાવી દેવામાં આવ્યું હોય છે. એક નિર્સ્યાતમક અનુભૂતિ થઈ હોય છે, અને જીવનનું હસ્તિબિદુ, જીવન પ્રત્યે જોવાની રીત, તેના સંબંધમાં બેવાતું વલસ ઓચિતા બદલાઈ જતાં હોય છે; કેટલાક માસુસોની બાબતમાં તો તદ્દન નિશ્ચયાતમક રીતે, પાછાં ન બોલાવી શકાય તેવી રીતે.

જ્યારે માસુસ આધ્યાત્મિક જીવન અને વાસ્તવિકતા તરફ વળે છે, ત્યારે તે અનંતનો, શાશ્વતનો સંસ્પર્શ કરે છે, અને પછી વધારે સંખ્યાની કે ઓછી સંખ્યાની શક્તિઓનો અથવા શક્તિતાઓનો સવાલ જ રહેતો નથી. તે આધ્યાત્મિક જીવનનો એક માનસિક જ્યાબ હોય છે કે જે એમ કહી શકે કે આ માસુસમાં આધ્યાત્મિક રીતે જીવાની વધારે કે ઓછી શક્તિ છે; પણ તે કથન બિલ્કુલ બરાબર નથી. એમ કહી શકાય કે આ માસુસ સંપૂર્ણ અને નિશ્ચયાતમક રીતે ચેતનાને ઉલટાવી દેવામાં વધારે કે એંઝ્રો રૈપાર છે. હક્કીકાતમાં, સામાન્ય કિયાઓમાંથી નિવૃત્ત થવાની અને આધ્યાત્મિક જીવનની શોધમાં ચાલી નીકળવાની માનસિક શક્તિને જ આપી શકાય છે.

પણ જ્યાં સુધી માસુસ માનસિક સ્થિતિમાં, અર્થાતું અત્યારેની સ્થિતિમાં હોય છે, ચેતનાની આ ભૂમિકા પર હોય છે, ત્યાં સુધી તે બીજાઓને માટે, સામાન્ય જીવન અથવા ખાસ વ્યક્તિત્વો માટે, જાજું કરી શકતો નથી, કારણકે તેને ચોતાને જ તે કશી શકવા બાબત ખાતરી હોતી નથી, તેને નિશ્ચયાતમક અનુભૂતિ હોતી નથી, તેની ચેતના આધ્યાત્મિક જગતમાં સ્થાપિત થઈ હોતી નથી. માત્ર એટલું જ કહી શકાય કે તે માનસિક કિયાઓ હોય છે, જેમને સારી તેમજ નરસી બંને બાજુઓ હોય છે, પણ જેમનામાં જાજી શક્તિ હોતી નથી, ખાસ કરીને સાચી રીતે અસરકારક શક્તિવાળા આધ્યાત્મિક સંપર્કની શક્તિ હોતી નથી.

એક જ વસ્તુ સાચી રીતે અસરકારક હોય છે, અને તે ચોતે જેમાં જીવે છે તે ચેતનાની સ્થિતિને બીજામાં સુંકાત કરવાની શક્તિના. પણ આ શક્તિને નવીન રીતે શોધી કાઢી શકતી નથી, કેંઠી પણ તેનું અનુકરણ ન કરી શકે, તે

પોતાની પાસે છે એવો દેખાડો ન કરી શકે. જ્યારે માણસ પોતે તે રિથેટિમાં સુસ્થિત થયો હોય છે, જ્યારે તે તેમાં જીવનો હોય છે, જીવન માટે પ્રયત્ન કરતો નહિ, ત્યારે તે શક્તિ આપોઆપ પ્રગટ થાય છે. તેથી સાચા આધ્યાત્મિક જીવનવાળા બોકો કદી છેતરાતા હોતા નથી.

જે બોકો મનમાં જીવે છે તેમને આધ્યાત્મિક જીવનનું અનુકરણ હગી શકે, પણ જે બોકોએ પોતામાં આ ચેતનાને ઊલટાવી દીધી છે, બાબ્ધ જીવન સાથે જેમનો સંબંધ તદ્દન ભિન્ન પ્રકારનો હોય છે, તેઓ કદી છેતરાતા હોતા નથી, ભૂલ કરતા હોતા નથી.

માનસિક સત્ત આવા બોકોને સમજ શક્તું હોયનું નથી. જ્યાં સુધી માણસ માનસિક ચેતનામાં છે, પછી ભબે તે ઉચ્ચતમ હોય, અને આધ્યાત્મિક જીવનને બહારથી જુઓ છે, ત્યાં સુધી તે પોતાની માનસિક શક્તિઓ વડે નિર્ણય કરતો હોય છે; તે જોગવાની, ભૂલ કરવાની, સુધારવાની, પ્રગતિ કરવાની, ફરી જોલ કરવાની ટેવ વડે નિર્ણય કરતો હોય છે. તેવો માણસ માને છે કે આધ્યાત્મિક જીવનવાળા બોકોમાં પણ તે જ પ્રકારની અશક્તિ હોય છે; પણ તે એક બણુ મોટી ભૂલ છે!

જ્યારે અસ્તિત્વ ઊલટી ગ્રયું હોય છે, ત્યારે બધું પતી જાય છે. પછી તે માણસ જોજતો હોતો નથી, પણ જોતો હોય છે. તે નિગમન તારવતો હોતો નથી પણ જીવતો હોય છે. તે ફાંફાં મારતો હોતો નથી, પણ સીધી લક્ષ્ય પ્રત્યે ચાલતો હોય છે. જ્યારે માણસ જરાક આગળ વધેલો હોય છે. ત્યારે તે પરમ સત્યને જાણે છે, અનુભવે છે, જીવે છે, એ પરમ સત્યને કે, માત્ર પરમ સત્ય એકલું જ કાર્ય કરતું હોય છે, પરમાત્મા એકલા જ માનવ પ્રાણીઓ દ્વારા સંકલ્પ કરતા હોય છે, જાણતા હોય છે, અને કાર્ય કરતા હોય છે. પછી ભૂલ થવાની શક્યતા રહે જ કયાંથી? પરમાત્મા જે કરે છે, તે પોતાનો સંકલ્પ હોવાથી કરતા હોય છે.

આપણી ભૂલ ભરેલી દૃષ્ટિ માટે, તે કદાચ ન સમજ શકાય તેવાં કાર્યો હોય, પણ તે કાર્યોમાં અથી હોય છે, લક્ષ્ય હોય છે, જ્યાં માણસને દોરી જવાનો હોય છે ત્યાં તે દોરી જતાં હોય છે.

જે માણસ સાચા દિલથી બીજોને તથા જગતને મદદ કરવા માગતા હોય, તો સૌથી શોષ વસ્તુ એ છે કે બીજોનો જેવા બને તેમ તે ઈચ્છાનો હોય તેવા પ્રથમ પોતે બનવું, માત્ર દૃષ્ટાંત તરીકે જ નહિ, પણ એટલા માટે કે પછી પોતે એક કિરણો બહાર હેંકું શકિતનું કેન્દ્ર બની જાય છે, જે શકિત, પોતે અસ્તિત્વ ધરાવે છે તે ઉકીકત વડે જ, બાકીના જગતને પોતાનું રૂપાંતર સિદ્ધ કરવાની ફરજ પાડે છે.

\*

## ૨૩ ઓક્ટોબર ૧૯૫૮

“એ વાત સાચી છે કે આધ્યાત્મિક વલાણ જીવન પ્રત્યે જોતું હોય છે તેના કરતાં વધારે જીવનથી પર જોતું હોય છે, એ પણ સાચી વાત છે કે અંધ્યાત્મિક પરિવર્તન વ્યક્તિત્વન હોય છે, સામૂહિક નહિ. તેનું પરિણામ માનવમાં સફળ બનવું હોય છે, પણ માનવ સમૂહમાં નહિ, અથવા તો માત્ર આદકતરી રીતે જ કાર્યાન્વિત પ્રકૃતિની આધ્યાત્મિક ઉત્કાનિત હજી ચાલુ છે, અપૂર્ણ છે એમ પણ કહી શકાય કે તેના હજી પ્રારંભ જ થયો છે. તેનું મુખ્ય કાર્ય છે આધ્યાત્મિક ચેતનાનો અને જીનાનો પાયો વિકસાપવાનું, આત્માના સત્યમાં જે સનાતન છે તેના દર્શન માટે વધારે ને વધારે રચનાનું સર્જન કરવાનું. જ્યારે પ્રકૃતિ, વ્યક્તિ દ્વારા, આ ઉત્કટ ઉત્કાનિતમાં અને રચનામાં પરિપૂર્ણ રીતે સ્થાપિત બને, ત્યારે જ કાંઈક મૌલિક વિસ્તારશીલ, સક્રિય રીતે પ્રસરણશીલ વસ્તુની આશા રાખી શકાય અથવા સામૂહિક આધ્યાત્મિક જીવન એક સફળ, સ્થાયી રૂપ પ્રાપ્ત કરે. એવા પ્રયાસો થયા છે, પણ તે મોટે ભાગે વ્યક્તિની આધ્યાત્મિકતાની વૃદ્ધિ માટે, તેના સંરક્ષણના કેન્દ્ર તરીકે. ત્યાં સુધી વ્યક્તિએ પોતાનાં મન, પ્રાણને આત્માના સત્ય સાથે સુસંગત રીતે, સંપૂર્ણ પણ પરિવર્તિત કરવાની અમસ્ત્યામાં ગુંઘાયેલી રહેવું જોઈએ, જે આત્માના સત્યને તેણે પોતાના આંતર અસ્તિત્વમાં અને જીનામાં પ્રાપ્ત કર્યું છે અથવા કરી રહ્યો છે. સામૂહિક આધ્યાત્મિક જીવન માટે કસમયે, વહેલો કરાયેલો પ્રયાસ, તેની કિયાશીલ બાળુમાં, આધ્યાત્મિક જીનની કોઈ અપૂર્ણતાથી, વ્યક્તિત્વન સાધકોની અપૂર્ણતાઓથી, સામાન્ય માનસિક, પ્રાણિક, શારીરિક ચેતનાનાં આકમણીથી ને સત્યનો કબજો લઈ બે, તેને યાંત્રિક અનાવી હે, તેને અસ્પષ્ટ બનાવી

મૂકે, દૂષિત બની જવાનો સંભવ છે. માનસિક બુદ્ધિ અને તેની મુખ્ય તર્કશક્તિ માનવ જીવનના તત્ત્વને અને જક્કી લક્ષ્યને બદલી ન શકે; તે તો માત્ર અનેક પ્રકારની યાંત્રિકતાઓ, વિકાસો, રચનાઓ સર્જ શકે. પણ સમગ્ર મનનું હજુ આધ્યાત્મિકરણ થયું નથી, તેમાં પરિવર્તન કરવા સમર્થ નથી. આધ્યાત્મિકતા આંતર સત્તને મુક્ત કરે છે, પ્રકાશન કરે છે, તે મનને પોતા કરતાં ઉચ્ચતર તત્ત્વ સાથે સંબંધ બાંધવામાં મદદ કરે છે, પોતાની જતથી ભાગી જવામાં પણ મદદ કરે છે, તે આંતર અસર વડે માનવ વ્યક્તિત્વોના બાધ સ્વભાવને વિશુદ્ધ કરે છે, ઊઠવી-કૃત કરે છે. પણ જ્યાં સુધી તેને માનવ સમૃહમાં મનરૂપી કરણ દ્વારા, કાર્ય કરવાનું છે, ત્યાં સુધી તે પૃથ્વી જીવન પર અસર પાડી શકે, પણ તે જીવનનું રૂપાંતર સિદ્ધ ન કરી શકે. આ કારણે, આધ્યાત્મિક મન તેવી અસર પાડવાથી સંતોષ માની બન્યું હોય છે, અને બીજે કરાંક, અનિદીક્ષિક જીવનમાં મુખ્યત્વે પોતાની સિદ્ધ શોધતું હોય છે અથવા તો બહિમુંબું પ્રયત્નને બિલકુલ ત્યજી દેતું હોય છે અને માત્ર વ્યક્તિત્વન આધ્યાત્મિક ઉદ્ધાર અથવા પરિપૂર્ણના પર ધ્યાન કેન્દ્રિત કરતું હોય છે. અજ્ઞાન વડે સર્જયેલા સ્વભાવનું સંપૂર્ણ રૂપાંતર કરવા માટે, મન કરતાં ઉચ્ચતર, કિયાણીચ કરણની જરૂર છે.”

( હિન્દુ જીવન, પૃષ્ઠ ૮૮૫-૮૬ )

મધુર માતાજી, “આધ્યાત્મિકતા મનને પોતામાંથી છદ્રકી જવામાં મદદ કરે છે?

જ્યાં સુધી મનને એવી ખાતરી હોય છે કે, હું માનવ ચેતનાનું શિખર છું, મારાથી પર ઊર્ધ્વમાં બીજી કોઈ વસ્તુ નથી, ત્યાં સુધી તે પોતાની કામગીરીને પરિપૂર્ણ માનનું હોય છે, અને તે કામગીરીની મર્યાદામાં પોતે જે પ્રગતિ કરી શકે તેનાથી સંતોષ માનનું હોય છે; સ્પષ્ટતામાં, નિશ્ચિતતામાં, જટિલતામાં, ચપળતામાં, અને પોતાની ગતિઓની મુલાયમતામાં તે સંતોષ માનનું હોય છે.

પોતાને માટે, પોતે જે કરી શકે છે તેને માટે પૂર્ણ સંતોષ માનવાનું વલણ મનમાં હંમેશાં રહેલું છે. જો મન કરતાં ઉચ્ચતર શક્તિ, અકાટય રીતે, મનને તેની મર્યાદાઓ ન બતાવે, તેની દરિદ્રતા ન બતાવે, તો સાચા દ્વર મારફતે તે બધી વસ્તુઓમાંથી બહાર નીકળવાના માર્ગને શોધવાનો તે કદી પ્રયત્ન ન કરે, ઉચ્ચતર અને વધારે સાચા અસ્તિત્વમાં તે મુક્તિ માટે પ્રયત્ન ન કરે.

જ્યારે આધ્યાત્મિક શક્તિ કાર્ય કરવા સમર્થ બને છે, જ્યારે તે પ્રભાવ અલ્લાનો પ્રારંભ કરે છે, ત્યારે તે જનના આત્મસંતોષને આંગંકો આપે છે, અને સતત દબાણ વડે મન પાસે એવું મનાવે છે કે મારા કરતાં વધારે ઉચ્ચ અને સત્ય કોઈક ચીજ છે. પછી તે પ્રભાવને બઈને નેનું થોડું કિશ્યાળિમાન ઓળણી જાય છે. જ્યારે મનને ખ્યાલ આવે છે કે હું મર્યાદિત હું, અજ્ઞાન હું, સાચા સત્યને પ્રાપ્ત કરવા અશક્ત હું, ત્યારે કોઈક પર વસ્તુ પ્રત્યે ખુલ્લાપણા વડે મુક્તિની શરૂઆત થાય છે. પણ તે પરત્તવને તે સમર્પણ કરી શકે તેટલા માટે, તેને તેની શક્તિનો, સૌનાર્યનો, બળનો અનુભવ થવો જોઈએ. પોતાના કરતાં ઉચ્ચતર વસ્તુની હાજરીમાં, તેને પોતાની અશક્તિ, મર્યાદાઓ દેખાવી જોઈએ; નહિ તો તેને પોતાની નબળાઈનો ખ્યાલ જ કેવી રીતે આવી શકે?

કેટલીક વાર એક જ સંસ્પર્ધી બસ હોય છે, જે તેના આત્મસંતોષમાં એક નાનકડી ચીરાડ પાડે. પછી પર જવાની ઝંખના, વિશુદ્ધતર પ્રકાશની જરૂરિયાત મનમાં જગૃત થાય છે, તે જગૃત સાથે, તેમને પ્રાપ્ત કરવાની અભીષ્ટા આવે છે. અભીષ્ટા સાથે મુક્તિની શરૂઆત થાય છે. પછી એક દિવસ, બધી મર્યાદા-ઓને ભાંગી નાખીને, તે માસુસ અનંત પ્રકાશમાં ખિલ્લી ઉઠે છે.

જે બહારથી તેમ જ અંદરથી, આ સતત દબાણ ન હોય, ગહનતમ ઊંડા-સ્થોમાંથી ઉપર અને નીચે, એકી સાથે, આ સતત દબાણ ન હોય, તો કશું જ કાઈ દિવસ પરિવર્તિત ન થાય:

તે દબાણ હોવા છતાં, વસ્તુઓને બદલવા માટે કેટલો બધો સમય લાગે છે! આ નિમ્નતર સ્વભાવમાં ખૂબ જરૂરી પ્રતીકાર હોય છે, અસ્તિત્વના પાશવી પ્રકારોમાં કેટલી બધી અંધ અને મૂર્ખાઈ જરેલી આસક્તિ હોય છે? પોતાની જાતને મુક્ત કરવા માટે કેવો મોટો ઈન્કાર હોય છે!

(મૌન)

સમગ્ર આવિભાવમાં, જગતને દુઃખમાંથી, જડતામાંથી, તેની મુર્જતામાંથી બહાર લાવવા માટે અનંત કૃપા સતત કાર્ય કરી રહેલી છે. થાયત કાળજી આ કૃપા કાર્ય કરી જ રહી છે. પોતાના કાર્યમાં તે ગૈલાશ લાવતી નથી. આ જગતને

કોઈક મહત્તર, વધારે સત્ય, વધારે સુંદર તરજી માટેની જરૂરિયાત પ્રત્યે જગૃત થતાં કેટલાં હજરો વર્ષોની જરૂર પડી છે!

યોતાના અસ્તિત્વમાં માણુસને જે પ્રતિકાર પ્રાપ્ત થતો હોય છે તે ખરચી, જગત કૃપાના કાર્યોનો જે ભીષણ વિચેદ કરી રહ્યું છે તેનો નેને જ્યાલું અખાંયો.

જ્યારે માણુસ સમજે છે કે બધી બાધ્ય વસ્તુઓ, સર્વ માનસિક રૂચનાઓ, સર્વ ભૌતિક ધ્ર્યાસોં નિર્યંત્ર છે, વ્યર્થ છે, જે તે ઊર્ધ્વમાંથી આવતા પ્રકાશને અને શક્તિને સમગ્રપણે સમર્પિત ન થાય, યોતાની જતને અભિવ્યક્ત કરવા મથતા સત્યને સમર્પિત ન થાય તો, ત્યારે જ તે નિશ્ચયાત્મક પ્રગતિ કરવા તૈયાર થાય છે. એટલે એક જ સાચી રીતે અસરકારક વલસુ છે, અને તે આપણાથી ઊર્ધ્વમાં રહેલા, જેનામાં એકવામાં દરેક વસ્તુમાં પરિવર્તન કરવાની શક્તિ છે એવા પરમાત્માને પરિપૂર્ણ, સમગ્ર, ઉત્કટ આત્મસમર્પણ કરનું તે.

જ્યારે તમે તમારામાં રહેલા આત્મા પ્રત્યે ખુલ્લા બનો છો, ત્યારે તમને જે એકમાત્ર જીવવા યોગ્ય છે તેવો ઉચ્ચતર જીવનો પ્રથમ સ્વાદ પ્રાપ્ત થાય છે. પછી તેને પ્રાપ્ત કરવાનો સંકલ્પ જાગે છે, તેને પ્રાપ્ત કરવાની આશા જાગે છે, તે શક્ય છે એવી ખાતરી જાગે છે, અને આખરે લક્ષ્ય સુધી પહોંચવાનો જરૂરી પ્રયત્ન અને નિશ્ચય આવે છે.

પ્રથમ માણુસે જગૃત થયું જોઈએ, પછી તે વિજ્ઞય પ્રાપ્ત કર્યે શકે છે.

\*

#### ૫ નવેમ્બર ૧૯૫૮

“આધ્યાત્મિક સત્ય એ આત્માનું સત્ય છે, બુદ્ધિનું સત્ય નહિ, ગાણુત શાસ્ત્રીય પ્રયોગ નહિ, અથવા તાર્કિક ઝોડ્યુલા નહિ. તે અનંતનું સત્ય છે, અનંત વિવિધતામાં એકનું સત્ય છે, તે અનંત પ્રકારની બાળુઓ અને રૂચનાઓ ધારણ કરી શકે છે. આધ્યાત્મિક ઉત્કાનિતમાં એક સત્યને પહોંચતો બહુમુખી માર્ગ અનિવાર્ય છે, તેનું બહુમુખી ગ્રહણ અનિવાર્ય છે. આ બહુમુખિતા એ આત્માના જીવનું

વાસ્તવિકતા પ્રણે અભિગમની નિશાની છે, નહિ કે કોઈ આવવાચકતા અથવા વસ્તુઓની રચાયેલી આકૃતિ પ્રણેનો અભિગમ, જે મુત્ત અથવા પત્થરમય ફોર્મ્યુલામાં નિર્જીવ, નિષ્પ્રાણ બની જાય. સત્ય બધા જેને સ્વીકારે તેવો એક વિચાર છે એવો કહોર, તાર્કિક, બોલ્ડિક ખ્યાલ, બોજ બધા વિચારોને અથવા પદ્ધતિઓને હરાવી શકે તેવો વિચાર અથવા વિચારોની પદ્ધતિ, એક મર્યાદિત હક્કીકત અથવા હક્કીકતોની એક ફોર્મ્યુલા કે જેનો બધા લેખોએ સ્વીકાર કર્યો જ જોઈએ. તે એક ભૌતિક ક્ષેત્રના મર્યાદિત સત્યમાંથી પ્રાણ, મન, આત્માના ખૂબ બધારે જરૂર અને મુલાયમ ક્ષેત્રમાં કરાતી અન્યાયી સંકાનિત છે.

આધ્યાત્મિક માનવની ઉત્કાન્તિતમાં ઘણી કમિક અવસ્થાઓ હોવી જ જોઈએ, અને દરેક અવસ્થામાં અસ્તિત્વની, ચેતનાની, જીવનની, મિજાજની, વિચારોની, ચારિત્રણની વ્યક્તિત્વાની રચનાઓની મહાન વિવિધતા હોવી જોઈએ. સાધનરૂપ મનના સ્વભાવે, જીવન સાથે કામ પાડવાની જરૂરિયાતે, વિકાસની અવસ્થા અનુસાર અને ચોલકના વ્યક્તિત્વ અનુસાર, અનંત વિવિધતાનું સર્જન કરલું જ જોઈએ. પણ તેને બાળુએ રાખીએ તો પણ, કેવળ આધ્યાત્મિક આત્મસાક્ષાત્કારના અને આત્મ અભિવ્યક્તિના પ્રદેશે પણ માત્ર એક ધ્વળ, કંટાળનાક વસ્તુ બનવાની જરૂર નથી; તેમાં પાયાની એકતાની મહાન વિવિધતા હોઈ શકે. પરમાત્મા એક છે, પણ તેના જીવાત્માઓ અનેક છે. જીવાત્માના સ્વભાવની જેવી રચના, તેવી તેની આધ્યાત્મિક આત્મ અભિવ્યક્તિ. એકતામાં અનેકતા એ આવિર્ભાવનો નિયમ છે. અતિમનસ એકીકરણે અને સમન્વયે આ વિવિધતાઓને સંવાદમય બનાવવી જોઈએ; પણ તેમને ફરજાવી દેવી એ પ્રકૃતિમાં આત્માનો ઈરાદા નથી.”

( દિવ્ય જીવન, પૃષ્ઠ ૮૮૬-૮૮ )

વ્યક્તિત્વના દ્વિટિનિન્દુથી જોતાં, જે બોકે હજ માર્ગની થરૂઆતમાં છે, તેમણે પોતે ન સમજુ શકે તેવી વસ્તુઓ આગળ શાન્ત રહેલું, એ પ્રગતિમાં ખૂબ મદદરૂપ છે. બાધ શીતે, એક શબ્દ પણ બોલ્યા સિવાય શાન્ત રહેવાની તે વાત નથી, પણ આંદર પણ શાન્ત રહેવાની તે વાત છે, જેથી મન ધૂષ્ટતાપૂર્વક પોતાના અજ્ઞાનને ચીટકી ન રહે, સમજવા માટે સમર્થ કરણ વડે સમજવાનો પ્રયત્ન ન કરે, પોતાની નબળાઈ જાયે, અને શાન્તિપૂર્વક પ્રકાશ આવે ત્યાં સુધી રાહ જુયે, કારાકુકે પ્રકાશ જ તેને સમજ આપી શકે તેમ છે. મને જે બધું શ્રીમ્યું હોય છે, અવલોકન કર્યું હોય છે, જીવનનો કહેવાતો અનુભવ મેળવ્યો હોય

છે, તે પ્રકાશ નથી; પ્રકાશ તેનાથી તદ્દન પર છે. જ્યાં સુધી આ બીજું કાંઈક જે કૃપાની અભિવ્યક્તિ છે, તે મનમાં પ્રગટ થાય, ત્યાં સુધી જે મન ખૂબ શાન્તિ-પૂર્વક, ખૂબ નમૃતાપૂર્વક મૌન રહે, અને સમજવા, ખાસ કરીને નિર્ણય કરવા પ્રયત્ન ન કરે, તો પ્રગતિ જલ્દી થાય.

તમારા મસ્તિષ્કમાં થબદો અને વિચારો જે અવાજ ધાંધલ પેદા કરે છે તે માણસને એટલો બધી અધીર બનાવી મૂકે તેવો હોય છે કે તે પ્રગટ થવા માગતા સત્યને સાંભળવા દેતો નથી.

શાન્ત અને મૌન રહેતાં શીંગવું.... જ્યારે તમારે કોઈ સમસ્યાનો ઉકેલ લાવવાનો હોય, ત્યારે તમારા મસ્તિષ્કમાં બધી શક્યતાઓને, બધાં પરિણામોને, આ કામ કરવું કે નહિ એમ સર્વ શક્ય વસ્તુઓને પરિભ્રમણ ન કરવા દેતાં, જે તમે સહ્યાપ માટેની અભીપ્સા સાથે શાન્ત રહો, તો સમસ્યાનો ઉકેલ જલ્દી આવે છે. તમે શાન્ત, મૌન હો છો, એટલે તમે તેને સાંભળ્યો શકો છો.

જ્યારે તમારા પર કોઈ મુશ્કેલી આવી પડી હોય, ત્યારે આ પદ્ધતિને અજ્ઞાવો. વિકુલ્ય થવાને બદલે, વિચારને પરિભ્રમણ કરવા દેતાને બદલે, સક્રિય રીતે ઉકેલ શોધવાને બદલે, ચિત્ત કરવાને બદલે, ગુસ્સો કરવાને બદલે, તમારા મસ્તિષ્કમાં આમતેમ દોડાડોડી કરવાને બદલે બાદ્ય રીતે દોડાડોડી ન કરવા નેટલી સામાન્ય લુલ્હા તો તમારામાં છે જ્ય, પણ તમારા મસ્તિષ્કમાં દોડાડોડી કરવાને બદલે, તમે શાન્ત રહો, તમારા સ્વભાવ અનુસાર, ઉત્કટતા અથવા શાન્તિ અનુસાર, વિશાળતા અનુસાર, અથવા આ બધી વસ્તુઓની સાથે, પ્રકાશને પ્રાર્થના કરો અને તેના આવવાની રાહ જુઓ.

આ રીતે માગની ખૂબ ટૂંકો બનાવી શકાય છે.

\*

## ૧૨ નવેમ્બર ૧૯૫૮

“ જો ઉત્કાન્તિ પ્રકૃતિનો આશય આધ્યાત્મિક માનવને પરમ વાસ્તવિકતા પ્રત્યે જગૃત કરવાનો હોય, અને પોતામાંથી અથવા સનાતન શક્તિ તરીકે પોતે જે અજ્ઞાનમાં પ્રગટ થઈ છે, તેમાંથી બીજે પોતાના ઉચ્ચતર દરજામાં મુક્ત કર-

વાનો હોય, જો આ પગલું ઉત્કાન્તિમાં છેલ્લું વિદાયનું પગલું હોય, તો તેનું કાર્ય તાત્ત્વક રીતે પૂરું થયું ગણાય અને પણી બીજું કાઈ વધારે કરવાનું બાકી ન રહે. તેના માર્ગેનું નિર્માણ થઈ ગયું છે, તે માર્ગેનું અનુકરણ કરવાની શક્તિનો વિકાસ થઈ ચૂડ્યો છે, સુભિત્નું લક્ષ્ય અથવા તેની ઊંચાઈ પ્રગટ થઈ ચૂકી છે; પછી દરેક જીવાત્માએ વ્યક્તિગત રીતે સાચી અવસ્થાને પહોંચવાનું અને પોતે પસંદ કરેલા માર્ગ આ નિર્ણય અસ્તિત્વમાંથી આધ્યાત્મિક માર્ગેમાં પ્રવેશ કરવાનું બાકી રહે છે. પણ આપણે એવી કલ્પના કરી છે કે હજુ પ્રકૃતિનો એક બીજો આગળનો આશ્ય છે. માત્ર આત્માનો આવિજ્ઞાવ જ નહિ, પણ પ્રકૃતિના સમગ્ર અને ભૌવિક રૂપાંતરનો. આત્માના દેહધારી જીવનનું સાચું પ્રગટીકરણ સિદ્ધ કરવાનો પ્રકૃતિમાં સંકલ્પ છે; પોતે જે અજ્ઞાનમાંથી જ્ઞાનમાં જવાની શરૂઆત કરી છે તેને પૂર્ણ કરવાની છે, તેણે પોતાના બુરખાને ફંજેટો દઈને પ્રકાશમય ચિહ્નશક્તિમાં પોતાની જાતને પ્રગટ કરવાની છે, પોતામાં તેણે સનાતન અસ્તિત્વનું અને સત્તના વૈશ્વિક આનંદનું વહન કરવાનું છે. ત્યારે સ્પષ્ટ થાય છે કે હજુ કાઈક વસ્તુ સિદ્ધ થઈ નથી, હજુ ધારું કરવાનું બાકી છે, મૂર્ખ અસ્પષ્ઠ કર્ત્વમ् ( વેદ ), હજુ એક ઊંચાઈને પહોંચવાની બાકી છે, દર્શનાની આંખને એક વિશ્વાણતા આવરી બેવાની છે, સંકલ્પની પાંખને આવરી બેવાની છે, ભૌતિક વિશ્વમાં આત્માના અધિકારને સ્થાપિત કરવાનો છે. ઉત્કાન્તિઅને, તેની શક્તિએ થોડાક જીવાને તેમના આત્માથી અને પોતાની જાતથી સચેતન બનાવ્યા છે, પોતે જે છે તે સનાતન સત્થી સભાન બનાવ્યા છે, જે દિવ્ય વાસ્તવિકતાને પ્રકૃતિએ પોતાના દેખાવો વડે આચ્છાદિત કરી છે તેની સાથે સંપર્ક સધાર્યો છે, સ્વભાવમાં થોડું ક પરિવર્તન નેયાર થયું છે જે આ પ્રકાશને અનુસરે છે, પણ તેણે પરિપૂર્ણ અને ભૌતિક રૂપાંતર સિદ્ધ નથી કર્યું, જે નવીન તત્ત્વને સલામત રીતે સ્થાપિત કરે છે, પાર્થિવ પ્રકૃતિના કોન્ટ્રાન નવીન સુભિત્ને અને નવીન વ્યવસ્થાને સ્થાપિત કરે છે. આધ્યાત્મિક માનવ ઉત્કાન્ત થયો છે, પણ અતિમનસ સત્ત નહિ, જે ત્યાર પછી પ્રકૃતિનો નેતા બનવાનું છે.”

( દિવ્ય જીવન પૃષ્ઠ ૮૮૯-૯૦ )

મધુર માતાજી, માલુમ કેવી રીતે સાચી અવસ્થાને અને પોતાના વિકાસના વળાંકને શેધી કાઢી શકે ?

તમે તે કેવી રીતે શોધી શકો ! તમારે તેને માટે શોધ કરવી જોઈએ, તમારે આગ્રહપૂર્વક તેની માગણી કરવી જોઈએ. તે તમારે માટે મહત્વની વસ્તુ બંની જવી જોઈએ.

( મૌન )

જ્યારે માલુસ પોતાના આત્માને શોધી કાઢવા માટે જરૂરી પ્રયત્ન કરે છે, તેની સાથે એકતા પ્રામ કરી તેને પોતાના જીવનનું નિયમન કરવા દેવા પ્રયત્ન કરે છે, ત્યારે ઘણીવાર તે એક અદભુત, મનોહર શોધ બની રહેલી હોય છે, જેને પરિણામે પ્રથમ વૃત્તિ માલુસને પોતાની જતને એવું કહેવાની થવી હોય છે કે મારે જે જોઈતું હતું તે હવે મને જરૂર ગમ્યું, મને અનંત આનંદ પ્રામ થયો ! પછી તે માલુસ બીજા કશાની પરવા કરતો હોતો નથી.

હુક્કીકતમાં, જેમણે આ શોધ કરી છે તે બધાને આવી લાગણી પેદા થઈ છે. કેટલાક લોકોએ તો આ અનુભૂનિને સાક્ષાત્કારના એક સિદ્ધાંત તરીકે સ્થાપિત કરી છે અને કલ્યું છે કે જ્યારે તમે આ વસ્તુ સિદ્ધ કરો છો, ત્યારે બધું જ કાર્ય પતી જતું હોય છે; હવે કાંઈ કરવાનું બાકી રહ્યું નથી; તમે લક્ષ્યને પ્રામ કરી લીધું છો; માર્ગના અંત આવી ગયો છે.

સાચે જ તેથી આગળ જવા માટે બહુ જ હિમતની જરૂર છે. આ શોધી કઢાડેલો આત્મા એક શોધવીર આત્મા હોવો જોઈએ, જે પોતે પ્રામ કરેલા આંતર આનંદથી સંતોષ માની હોતો નથી, જે બીજા દુઃખી જીવોને આશાસન આપવામાં જ રાચતો નથી, પોતાની જતને એમ કહેતો નથી કે મોડા વહેલા તે બધા બોકો આ સિથિતિને પ્રામ કરશે, તેમણે મારી પેઠે પ્રયત્ન કરવો જોઈએ. વધારેમાં વધારે તે બોકો, મહાન કરુણા અને કલ્યાણકારિતા વડે બીજોને તે સિથિત પ્રામ કરવામાં મદદ કરતા હોય છે. જ્યારે દરેક જાળ તે સિથિતિને પ્રામ કરશે, ત્યારે જગતનો અંત આવી જશે, અને જે બોકોને દુઃખ ગમતું હોતું નથી તેમને માટે તે બહુ સારી વાત હશે !

પણ અહીં ‘પણ’ છે, જ્યારે પરમાત્માએ આ પ્રગટીકરણ કર્યું, ત્યારે તેમનો આશય આ હતો તે વાતની તમને ખાતરી છે ?

( મૌન )

જો આખરો અંત આ જ હોય, તો સમગ્ર સૃષ્ટિ, સમગ્ર વૈશિક આવિજ્ઞાવ એક કૂર મશકરી ભાસે. જો સૃષ્ટિમાંથી છેવટે ભાગી જ જવાનું હોય, તો તેનું સર્જન જ શા માટે? જો છેવટે સૃષ્ટિ આપણુને તેમાંથી છટકી જવાનું જ શિખ-વાડવા માટે થઈ હોય, તો આટલું બધું દુઃખ શા માટે, આટલો બધો સંધર્ષ શા માટે, સૃષ્ટિનો બાધ્ય દેખાવ આટલો બધો કરુણ અને નાટકીય શા માટે? તો તો પછી સૃષ્ટિ કરવામાં જ ન આવી હોત, તો વધારે સારું થત.

પણ જો માણસ વસ્તુઓના ઊંડાણમાં જાય, જો અહંતાને પૂરેપૂરી ફળાવી દઈને, પરિપૂર્ણ રીતે, નિઃસ્વાર્થ રીતે, કશું પણ બાકાત રાખ્યા સિવાય, આત્મ-સમર્પણ કરે, તો તે અગવાનની યોજનાને સમજવા માટે થકિતમાન બને, ત્યારે તેને ખબર પડે કે આ સૃષ્ટિ એક કૂર મશકરી નથી, યોગ્રાક પ્રહરો ખમીને તમારે આરંભ બિદ્ધુ પ્રત્યે વાંકે માર્ગ પાછા ફરવાનું નથી. તેથી ઊંબટું, સમગ્ર સૃષ્ટિને અસ્તિત્વનો આનંદ માણસના સૃષ્ટિએ શીખવવાનું છે, સૃષ્ટિની સુંદરતા, મહત્ત્તા, ઉદાત્ત જીવનની અભ્યન્તા, તે આનંદ, સૌન્દર્ય, મહત્ત્તાની સતત પ્રગતિ અને વૃજિ શીખવાઉવાનાં છે. પછી દરેક વસ્તુ અર્થવાળી બની જાય છે, પછી માણસને સંધર્ષ કર્યાનિ અને દુઃખ લોાગવ્યાનો પશ્ચાત્તાપ થતો નથી. પછી તેને દિવ્ય લક્ષ્ય સિદ્ધ કરવા માટે ઉત્સાહ જ બાકી રહે છે, પછી તે લક્ષ્યની અને વિજયની ખાતરી-પૂર્વક સાક્ષાત્કાર માટે ઊંઘું ધાલીને જંપલાવે છે.

પણ તે જાણવા માટે માણસે અહંતાને દૂર કરવી જોઈએ, તેણે સ્વાર્થી વ્યક્તિન મટી જવું જોઈએ, પરમ ઉદ્ગમસ્થાનથી ભિન્ન વ્યક્તિન મટી જવું જોઈએ. અહંતાને દૂર કરવા માટે તે કરવું જોઈએ. તે એક જ માર્ગ છે, જેના વડે માણસ પોતાના સાચા લક્ષ્યને જાહી શકે!

ઉપરનું વખ હોય તેમ અહંતાને ફળાવી દવી જોઈએ.

જે પ્રયાસો કરવાના છે, તેમને યોગ્ય જ મહાન પરિણામ પ્રાપ્ત થાય છે. પછી માર્ગ ઉપર તે માણસ એકલો નથી હોતો, જો તેનામાં વિશ્વાસ હશે, તો અગવાન તેને મદદ કરશે જ.

જો તમને એક કાણ માટે પણ અગવાનની કૃપાનો સંપર્ક થયો હશે, જે કૃપા અદ્ભુત છે, તમને માર્ગ કાપવા માટે વેગ આપે છે, તમારું વહન કરે છે

તમારે ઉત્તરાણ કરવાની છે એ વાતને પણ ભુલાવી હે છે, તો તે કૃપાને તમે પ્રયત્ન કરશો તો પણ ભૂલી જઈ નહિ શકો. બાળકની એઠે બાળક લેવી નિર્દેખતા, સાથે, બાળકને જેમ કોઈ ગુંઘવાડા નથી હોતા તેમ ગુંઘવાડા વગર, તમે તમારું ગમર્ખણું તે કૃપાને કરી દો, અને બધું જ કર્યું તેને કરવા દો.

જે પ્રતીકાર કરે છે, વિરોધ કરે છે, તેની વાત ન સાંભળો. વિશ્વાસ રાખો, સાચો વિશ્વાસ રાખો. જાણતરી કર્યા વગર, વિશ્વાસપૂર્વક, તમારી જાતનું ગમર્ખણું તે કૃપાને કરી દો; તેમાં સોછો કરવાની ભાવના ન રાખશો. વિશ્વાસ રાખો, જે વિશ્વાસ કરે છે કે ભગવાન, મારે માટે આ કે પેલું કરો; હું તે બધું તમારા પર છાડું છું.

એ સૌથી કોઈ માર્ગ છે.

\*

## ૨૬ નવેમ્બર ૧૯૫૮

“નેવી રીતે મન અલી અજ્ઞાનના પાયા પર પ્રતિષ્ઠિત થયેલું છે, તે જ્ઞાનને શેષે છે અને તેમાં વૃદ્ધિ પામે છે, તેવી રીતે અતિમનસને અહીં જ્ઞાનના પાયા પર સ્થાપિત થવાનું છે, અને પોતાના મહત્ત્ર પ્રકાશમાં વૃદ્ધિ પામવાની છે પણ જ્યાં સુધી આધ્યાત્મિક માનસિક પ્રાણી પરિપૂર્ણ રીતે અતિમનસમાં ઉદ્ય ન પામે અને પોતાની શક્તાઓ પાર્વિવ અસ્તિત્વમાં ન લાવે, ત્યાં સુધી તે શક્ય નથી. કારણું મન અને અતિમનસ વચ્ચેની આઈ પર મુલ બાધવાનો છે, બધું માર્ગો ચોલી દેવાના છે, અને અત્યારે જ્યાં શૂન્ય અવકાશ અને મૌન છે ત્યાં આરોહણ અવરોહણના માર્ગો ચોલવાના છે. આ કાર્ય ત્રિવિષ રૂપાંતર વડે જ સિદ્ધ થઈ શકે, જેને ઉલ્લોખ અમે આગળ કરી જયા છીએ. પ્રથમ તો ચૈતસિક પરિવર્તન થણું જોઈએ, આપણા અત્યારના સમગ્ર સ્વભાવનું એક આત્મકરણના રૂપમાં પરિવર્તન થણું જોઈએ. તેની સાથે સાથે આધ્યાત્મિક પરિવર્તન થણું જોઈએ, ઉચ્ચતર પ્રકાશ, જ્ઞાન, શક્તિ, આનંદવિશુદ્ધિનું અવતરણ થણું જોઈએ. તે અવતરણ સમગ્ર અસ્તિત્વમાં, પ્રાણના, શરીરના નિમ્નતમ ભાગોમાં, અવચેતનના અધ્યકરમાં પણ થણું જોઈએ. છેલ્દણું અનિમાનસિક રૂપાંતર થણું જોઈએ, અતિમનસમાં

આરોહણની શિખરકૃપ ગતિ થવી જોઈએ, આપણા સમગ્ર અસ્તિત્વમાં અને સ્વભાવમાં અતિમાનસ ચેતનાનું દૃપાંતરકારી અવતરણ થવું જોઈએ.”

(દિવ્ય જીવન, પૃષ્ઠ ૮૦-૮૧)

આત્માને શો ભાગ ભજવવાનો છે?

એમ કહી શકાય કે તે પરમાત્મા અને તેમના આવિભાવ વચ્ચેનો સચેતન દૂત છે, પરમાત્માનું અને તેમના આવિભાવનું મિલન સ્થાન છે.

આત્મા ઉચ્ચતર પરમાત્માને સમજવા અને તેમની સાથે સંબંધ બાંધવા સર્વથ્ર છે. સાથે સાથે તે ખૂબ ખૂબ બાહ્ય આવિભાવમાં પરમાત્માનો સૌથી વધારે વિશુદ્ધ અને ઓછામાં ઓછો વિકૃત દૂત છે. જીવાત્માની મદદથી, આત્મા ચેતનાને પરમાત્મા પ્રત્યે વાળો છે; આત્મામાં જ ચેતના પરમાત્માને સમજવાની શરૂઆત કરી શકે છે.

એમ કહી શકાય કે આત્મા એ ભગવાનની કૃપા વડે ભૌતિક જગતમાં લાવવામાં આગેલું વાયુમંડળ છે, ક્રેથી તે પોતાના ઉદ્ગમસ્થાનની ચેતના પ્રાયે જંગૃત બને અને તેની પ્રાયે પાછા જવાની અભીષ્ટા સેવે તે વાયુમંડળ મુક્તિ આપનારું, દ્વારોને જોલી નાંખનારું, ચેતનાને મુક્ત કરનારું હોય છે. તે સત્યના સાક્ષાત્કારને શક્ય બનાવે છે, અને અભીષ્ટાને સિદ્ધ માટેની પરિપૂર્ણ શક્તિ આપે છે.

ઉચ્ચતર દૃષ્ટિબિન્દુથી, આ વાતને જુદી રીતે કહી શકાય: આ કાર્ય આત્માનું હોય છે, તેની તૌંબય અને મુક્તિ આપનારી અસર હોય છે. જે આપણે માટે પરમાત્માના માર્ગને ખુલ્લો કરી આપે છે, આપણે જેમાં ચેંટી ગયા છીએ તે અશાનના કાદરમાંથી આપણને બહાર ચેંચી કાઢે છે, આપણે માટે દ્વાર જોલી નાંખે છે, આપણને માર્ગ બતાવે છે, આપણને લક્ષ્ય પ્રત્યે લઈ જાય છે, તેને બેકો આત્મા કહે છે. જગત જે અંધકારમાં પડ્યું છે તેનાંથી તેનો ઉદ્ઘાર કરવા માટે ભગવાનની કૃપા વડે સંજ્ઞેલું વાયુમંડળ તે આત્મા છે. .

જીવાત્મા આ કૃપાનું એક પ્રકારનું વ્યક્તિગત સધન રૂપ છે, માનવમાં તે કૃપાનો પ્રતિનિધિ છે. જીવાત્મા માનવતાનું એક ખાસ રૂપ છે, તે માત્ર માનવમાં જ અસ્તિત્વ ધરાવે છે. તે આત્માની માનવમાં એક ખાસ અભિવ્યક્તિ છે. બીજાં

જગતોનાં સત્ત્વોમાં જીવાત્મા નથી હોતો, પણ તેઓ આત્મામાં જીવી શકે છે. એમ કહી શકાય કે જીવાત્મા માનવ જીતિમાં આત્માનો પ્રતિનિધિ છે, તેને જલ્દી લક્ષ્ય પ્રત્યે દોરી જવાની ખાસ મદદ છે. જીવાત્મા વ્યક્તિત્વને વિકાસને શક્ય બનાવે છે. પોતાના મૂળ રૂપમાં, આત્માને વધારે સામૂહિક કર્વાનું હોય છે.

અત્યારે આત્મા મદદગાર તરીકે અને માર્ગદર્શક તરીકે ભાગ ભજવી રહ્યો છે; પણ તે ભૌતિક આવિભાવનો અત્યારે સર્વ શક્તિમાન સ્વામી નથી. જ્યારે નવીન જગતમાં અતિમનસ સંગઠિત બનશે, ત્યારે આત્મા સ્વામી બનશે અને સ્પષ્ટ તથા દૃષ્ટિગોચર રીતે પ્રકૃતિનું શાસન કરશે.

આધ્યાત્મિક જીવનમાં, આધ્યાત્મિક ચેતનામાં જે જન્મ થાય છે, તેને ‘નવીન જન્મ’ કહેવામાં આવે છે. તે નવીન જન્મમાં માણસ આત્માની કોઈક એવી વસ્તુનું પોતામાં વહન કરે છે, કે જે વ્યક્તિત્વને રીતે, જીવાત્મા દ્વારા. જીવન પર શાસન કરવાની શરૂઆત કરે છે, અસ્તિત્વના સ્વામી બનવાનો પ્રારંભ કરે છે. પણ અતિમાનસ જગતમાં, આત્મા આ સમગ્ર જગતનો અને તેના આવિભાવનો સ્વાભાવિક રીતે જ, આપોઆપ સ્વામી બનશે.

વ્યક્તિત્વનું અસ્તિત્વમાં તે જે વસ્તુ તફાવત ઉલ્લેખ કરે છે. જ્યાં સુધી માણસ આત્મા વિષે વાત કરે છે, જે તેણે વાંચ્યું હોય છે, જેનું અસ્તિત્વ માણસ અસ્પષ્ટ રીતે જાણુતો હોય છે, પણ તેની ચેતના માટે જે હજુ સધન વાસ્તવિકતા-રૂપ બન્યો નથી, તો તેનો અર્થ એ થયો કે તે હજુ આત્મામાં જન્મ્યો નથી. જ્યારે માણસ આત્મામાં જન્મે છે, ત્યારે તે આત્મા ખૂબ સધન બની જાય છે, ખૂબ જીવંત, વાસ્તવિક, અને સમગ્ર ભૌતિક જગત કરતાં વધારે સ્પર્શગમ્ય બની જાય છે. આ જ વસ્તુ પ્રાણીઓ વચ્ચે તાત્ત્વિક તફાવત પેદા કરતી હોય છે. જ્યારે તે આત્મા આપોઆપ વાસ્તવિક, સધન, સત્ય અસ્તિત્વ બની જાય છે, જેનું વાયુ-મંડળ ને માણસ મુક્ળ રીતે સ્થાસમાં લેતો હોય છે, ત્યારે તેને માલબ પડે છે કે હું બીજું બાજુએ પહોંચી ગયો છું. પણ જ્યાં સુધી તે અસ્પષ્ટ અને ધૂંધળું હોય છે, તાં સુધી તેસે સંભળ્યું હોય છે કે, આત્મા છે, તમે જાણુતા પણ હો છો કે, તે છે, પણ તે તમારે માટે એક સધન વાસ્તવિકતા બની હોતી નથી, પણ તમને નવીન જન્મ પ્રાપ્ત થયો હોતો નથી. જ્યાં સુધી તેસે એમ કહેતા હો છો કે “હા, હું આને જોઈ શકું છું, મને થતાં હું અનુભવી શકું છું, મને સત્તાવતી ભૂખને હું અનુભવી શકું છું, મને જરૂર બનાવી દેતી નિદ્રાને હું અનુભવી શકું”

દુઃ, આ વસ્તુ સાચી અને સધન છે ” ( માતાજી હસે છે ), તેનો અર્થ એ થયો કે તમે હજુ તરીને પાર ગયા નથી, તમે આત્મામાં જન્મ્યા નથી.

( મૌન )

હકીકતમાં, ઘણાખરા લોકો કેદીઓ જેવા હોય છે, જેમની જેવના બારી-બારણાં બંધ હોય છે; તેથી સ્વાભાવિક રીતે જ તેઓ ગુંગળાના હોય છે. પણ તેમની પાસે બારીબારણાં ખોલ્લી નાંખનારી ચાવી છે. પણ તેનો તેઓ ઉપયોગ કરતા હોતા નથી. બેશક, એવો સમય હોય છે કે જ્યારે તેઓ જાણતા હોતા નથી કે અમારી પાસે ચાવી છે, પણ તે ચાવી પોતાની પાસે છે એમ જાણ્યા પછી પણ, તેમને તે વાત કહેવામાં આવી હોય. ત્યાર પછી પણ, તેઓ તે ચાવીનો ઉપયોગ કરવામાં આનાકાની કરતા હોય છે, તે ચાવી બારીબારણાં ખોલ્લી શક્યે કે કેમ તે બાબતની તેમને શંકા હોય છે, અરે, બારીબારણાં ખોલ્લી નાંખવા તે સારું છે કે નહિ તે બાબતની પણ તેમને શંકા હોય છે ! અને વાંચા સમય સુધી આમ ચાલ્યા જ કરતું હોય છે. બારીબારણાં ખોલ્લી નાંખવા તે સારું છે, એમ જાણ્યા પછી પણ, તેમનામાં લીનિ રહેતી હોય છે કે જ્યારે આ બારીબારણાં ખોલ્લી દેવામાં આવશે, ત્યાર પછી શું થશે ? તે પ્રકાશમાં અને મુક્તિમાં જતાં. તેમને ઊર વાગતો હોય છે. પોતે જેવાં છે તેવા જ રહેવા તે માગતા હોય છે. તેમને તેમનું જૂઠાણું અને બંધન ગમતાં હોય છે. તેમનામાંના કથાકને તે ગમતું હોય છે, તે તેને ચીટકી રહેતું હોય છે. તેમને એમ વાગતું હોય છે કે અમારી મર્યાદાઓ સિવાય અમારું અસ્તિત્વ જ ન રહે.

તેથી યાત્રા વાંબી અને મુશ્કેલ બની જય છે. જો માણસ<sup>‘</sup> પોતાનું અસ્તિત્વ મિટાવી દેવામાં સંમનિ આપે, તો બધું જ સરલ, અડપી, પ્રકાશમય, આનંદ-પૂણું બની રહે, પણ માણસો જે અર્થમાં આનંદ અને આરામ સમજે છે તે રીતે નહિ. હકીકતમાં, એવા લોકો બહુ થોડા હોય છે, જેમને ઝઘડવામાં મજા ન પડે. બહુ થોડા લોકોને રાત્રિ ચાલી જાય તે ગમતું હોય છે. બહુ થોડા લોકો પ્રકાશ અંધકરનો વિરોધી છે, તેવા અર્થ સિવાય, પ્રકાશનો જ્યાલ કરી શકતા હોય છે. તેઓ વિચારતા હોય કે, “ છાયાઓ સિવાય ચિત્ર ન બની શકે. સંધર્ષ સિવાય વિનય પ્રામ ન થાય. દુઃખ સિવાય આનંદ પ્રામ ન થઈ શકે. ” જ્યાં સુધી માણસ તે પ્રકારે વિચારતા હોય છે, ત્યાં સુધી તે, આત્મામાં જન્મ્યો હોતો નથી.

( કીંદંગણમાં આપેલો આ છેલ્લો વાર્તાવાપ છે )

\*



શાખાસ્ત્રચ

અદ્વિતીયાન, ૬૪  
 અતિમાનસ  
 ઉધર્ણનું અને નિગૂઢ, ૧૫૧-૧૫૨  
 -નો વ્યાપ, ૧૫૮  
 -ની સ્થાપના, ૩૮૨  
 -ની અનુભૂતિ : કેખાશ્યભોગાં, ૨૮  
 -અગતરણ : શરીરમાં, ૮૨  
 -માનિબ્દી, ૮૭  
 અતિમાનસ  
 -જીવનનું સ્પષ્ટીકરણ, ૨૬૮  
 શરીરનું રૂપાંતર અને-૧૨૬-૧૨૭  
 -પદાર્થ, ૨૬૮  
 -પ્રગતિ, ૧૮૨  
 અતિમાનસ, ૧૮૨  
 અતિમાનસ  
 -રૂપાંતરનો કમ, ૨૨૬  
 -કૃપથી, ૧૬૮-૧૬૯  
 -શક્તિ તત્ત્વ, ૨૨૬  
 -નો પ્રલાપ, ૪૦  
 અતિમાનસક સંધ, ૧૩૬-૧૩૭  
 અતિમાનસક કરણું  
 પદાર્થનું, ૪૪૫  
 અનપેક્ષિત વસ્તુઓ, ૧૪૧  
 અનુભૂતિ  
 -ની અગત્ય, ૩૯૩  
 -નો મનોમય અનુવાદ, ૩૬૬  
 અતાંત કૃપા, ૩૮૬  
 આધુનિક સ્નેહિ, ૧૪૪  
 આર્દ્રસભાન મનુષ્યો, ૪૭  
 અભીષ્ટા અને સમર્પણ, ૨૮૨  
 શ્રી અરવિંદની નિવૃત્તિ, ૧૪૨-૧૪૩

શ્રી અરવિંદ  
 -સનાતન જરૂર, ૧૬૪-૧૭૦-૧૭૧  
 અવતરણ : ૩૫, ચેતના, અભીષ્ટાનું, ૨૦૮  
 અવતારેનાં કાર્યો, ૧૮૮-૧૮૯  
 અસંયમ : વાણીનો, ૧૩૮  
 અસ્તિત્વનો આનંદ, ૧, ૨૩-૨૪  
 -નો હેતુ, ૧૭  
 આદિતા, ૩૮૧  
 અજ્ઞાતનું શાસન, ૮  
 આકૃપણું અને આધુનિક, ૧૭૨  
 આજમણ, : દિવ્ય સત્ત્વોનું ૧૪૫  
 આદમેતારણું, ૩૦૧  
 આત્મસ્વામિત્વ, ૮૦-૮૧  
 આત્માની સાચી અનુભૂતિ, ૩૦૬-૩૦૯  
 -ની શોધ, ૨૮૫  
 આદર્શી ભાગિક, ૮૦  
 આદ્યાત્મિક અનુભૂતિ : ચાર માર્ગ  
 ૩૧૫-૩૧૭  
 -જીવન, ૩૮૦-૩૮૧  
 -પ્રેરણા, ૮૧-૮૨  
 -બળ, ૫  
 -શક્તિ ૩૮૫  
 -સત્ત્વ, ૩૧૦-૩૧૧  
 આનંદ, ૮  
 -આત્મપ્રાગદ્યનો, ૨૪૫  
 -તત્ત્વ, ૨૪૬  
 -નું બળ, ૫  
 -ભગવાનનો, ૧  
 આજ્ઞામ  
 -નો અતિમાનસ ઉપર ઓકાધિકાર નથી,  
 ૪૦-૪૧

- માં આગમનનું કરણ, ૧૮-૧૯  
 -નું અરન, ૩૪૨-૩૪૪  
 -નું મહાન જીવન, ૭૧  
 -નો લાભ, ૩૪૦-૩૪૩  
 -નો વ્યાપ, ૧૬૫  
 -નાં બાળકો, ૮૩-૮૪  
 -માં સામાન્ય ચેતના, ૧૬૫  
 એકતાની સમૃતિ, ૫૮  
 એકાયતા, ૩૩૦  
 -અને વ્યગતા, ૮૨  
 એક ખૌલ કથા, ૫૨-૫૩  
 અંગત અને પ્રવાહભત વિશ્વાર્દી, ૪૫  
 અંગોતું રૂપાંતર, ૮૬  
 -ને બદલે ચકો, ૧૬૮  
 અંધારા, ૧૬  
 અંત અને આરંભ, ૭૨  
 અંતરની અતુભૂતિઓ, ૩૪૭-૩૪૮  
 આંતર હર્ષનો, ૩૨૬-૩૨૮  
 -ની શક્તિ, ૩૨૬  
 આંતર મદ્દો, ૩૧૬  
 આંતરિક માર્ગદર્શન, ૩૨૮  
 ઉજળી અને મેલી વિદ્યાઓ, ૩૫૮  
 ઉપધાસ, ૧૧૩-૧૧૪  
 ઉમેદવાર અતિમાનવેદ, ૩૭૭  
 ઉત્કાનિતનો અવસ્થાક્રમ, ૨૭૮-૨૭૯  
 -ની કમિક અવસ્થાઓ, ૩૮૭  
 -માં નિરૂપયોગી કરણનો ત્યાગ, ૧૪૦  
 -નું લક્ષ્ય, ૧૭૫  
 -નો વધાંક, ૨૨૧  
 -મય પ્રકૃતિ, ૩૦૪  
 -અને રૂપાંતર, ૧૦૪  
 કર્મ અને મલુકૂપા, ૫૮
- ક્ષાયો, અતિમાનસ જીવનમાં, ૧૨૦  
 કેવના, ૩૪૮-૩૪૯  
 કામના, ૨૨  
 -ની ગુપ્તિ, ૮૮  
 કાર્ય : બંને છેદા પરની, ૬૩  
 કેન્દ્રસ્થ ડેટુ, ૧૮૮  
 કેન્દ્રાચાતું જાંજન, ૧૩૨  
 કેપાણુંઓમાં શરૂઆત, ૧૫૭  
 કુંડિની, ૧૪૭  
 કમિક અવસ્થાઓ : રૂપાંતરની, ૧૦૫  
 કમિક અતિ, ૧૮૧  
 એંચવાની ડિયા, ૨૪  
 એટી સોખત, ૮૦  
 ગમા-અસુગમા, ૧૭૨-૧૭૩  
 ગાળા : ઉત્કાનિત અને અવકાનિત, ૩૧૭  
 શુંગ વાતો, ૫૭-૫૮  
 શુદ્ધ વિદ્યા, ૩૩૩-૩૩૪  
 શુંશબ્દો અને લિઙ્ગાદો, ૧૬૨-૧૬૩  
 શૂદ્ધવાદ, ૧૭૭-૧૭૮  
 -ની ફોર્મુલાઓ, ૩૫૮-૩૬૦  
 ચાર અલિગેનો, ૩૧૨-૩૧૪  
 ચેતનાની ઉલ્લંઘણી, ૩૮૦  
 -નું પરિવર્તન, ૧૧૬  
 ચોપ અને કાય, ૧૧૯  
 ચીલાચાતું કાર્ય, ૪૮  
 ચૌથ્ય લાજરી, ૧૮  
 -તાવ, ૨૪૮  
 -સત્તા, ૨૦૪  
 ઝંદ, તારાઓ, અચિંયવાણી,  
 ૨૬૩-૨૬૪  
 છટકારી : ધ્યાનમાં, ૮૨  
 જરૂતા અને પેઢાથી તત્ત્વ, ૩૫

- જગતાની પ્રાથમિક અવસ્થા, ૨૭૪  
 —ની વાસ્તવિકતા, ૧૮૩-૧૮૪  
 —વિષેની સમજુતિઓ, ૧૮૩  
 —નું સત્ય, ૭૧  
 જાતીય લેખ : પ્રાસુરમણ જગતોમાં, ૧૦૨  
 —સનાતન નથી, ૧૦૧, ૧૦૨  
 જગૃતિ : અલીપ્સાની, ૧૫૪  
 જીવનકાર્ય વિષે સભાતાટા, ૬૦-૬૧  
 જીવનનું સંગ્રહન, ૮૩  
 —નું નિયમન, ૮૭  
 —નો હેતુ, ૧૭  
 જીવનું જગત : દેવો અને ધર્મ, ૧૪૪  
 ટોલેસ્ટોયનો પુત્ર, ૫૫  
 ટ્રાન્સમિટરો જેવાં આગોં, ૧૩૮  
 ડરની શાનિત, ૬૫  
 તર્કાભુદ્ધિની અગત્ય, ૬૮  
 તત્ત્વચિંતનો, ૩૭૧  
 તાંત્રક મદ્દિયાએ, ૧૪૬-૧૪૮  
 તેલોમણ દેહ, ૮૫  
 ત્રણુ કાનિયોં, ૭૫-૭૬  
 ત્લેર્સેન, ૫૮  
 હવાએ, ૧૧૮-૧૨૦  
 દર્શનોનો સમન્વય, ૭૭  
 દર્શનોનું માણસ્તય, ૨૬૮  
 હિંદુ જીવન ૧૫  
 દુઃખ અને રોક ૪૧  
 —ની શીખ, ૪૩  
 દુષ્કર્તનો ચેપ, ૫૭  
 દુષ્પ સત્તો, ૧૭૩-૧૭૪  
 દેશ અને કાળ, ૨-૩  
 દેશના ભાગ્યા, એક વિકૃતિ, ૨૮  
 દ્વેદી : અધિમનસના, ૩૪૫  
 ખર્માંથ, ૩૨૩, ૩૨૪, ૩૭૪, ૩૨૦,  
 ૩૨૧  
 ધ્યાત, અને મૌત, ૧૧૧-૧૧૨  
 —શ્રી માતાજીએ આપેલા વાક્ય ઉપર,  
 ૩૪૬-૩૪૭  
 નથા વર્ષનો સેદેશા, ૨, ૨૨૮-૨૩૧  
 નથી માનવજીતિ, ૧૭૪  
 નવીન, અનુભૂતિ, ૨૮૩  
 —જાન્મ, ૩૦૮, ૩૬૪  
 —રૂપાંતર, ૨૭૧  
 —સંધર્ષ, ૨૭૪  
 —થકિતાઓ, ૨૭૬  
 —જગત; ૧૪૩, ૧૪૫, ૧૪૨, ૧૪૦,  
 ૧૪૧  
 —સાહસ, ૧૪૫-૧૪૬  
 —અને જુન્ઝ જગત, ૧૫૧-૧૫૨  
 નિઘૂઠ અતિમનસ; ૧૫૦, ૧૫૧, ૧૫૨  
 નિઘૂઠ તિરૈલૂલ તત્ત્વો, ૧૮૫  
 નિર્ધર્થકતા : ઉત્કાનિતની, ૨૩૨  
 નિર્જીવક વળાંક, ૭૪  
 નિઅતાર ગોળાધો, ૧૪-૧૫  
 નિર્ધાર્થ, ૮-૯-૧૩  
 નિર્ધિકય ધ્યાત, ૪૦  
 પદ્ધયદો પડવાની વાતાં, ૧૨૪  
 પરમાત્મા, ૧  
 —નું ધ્યાન, ૧૬  
 —શું છે, ૨  
 —અને પ્રકૃતિ, ૧૦  
 —નું પર્સ્ટન, ૨૪૬  
 પરિપૂર્ણતા : ઉચ્ચ અને નિમન-૮૮-૮૦  
 પરિપૂર્ણતા, ૮૮  
 પરિવર્તન : સર્વગ્રાહી, ૧૬૦-૧૬૧



- |                                  |                                   |
|----------------------------------|-----------------------------------|
| —નો પણુંઓ ઉપર પ્રભાવ, ૨૦૭        | —ના શત્રુઓ, ૫૭                    |
| —ની સંમતિ                        | માંદગી દ્વાટા, બેર, ૧૨૦           |
| મનોભય તત્ત્વ : સ્પષ્ટ વિચારની    | —અને પ્રાણની થકિત, ૧૧૭            |
|                                  | માંદગી, ૧૧૬-૧૧૮                   |
| અખુલિંકુ, ૨૫-૨૬                  | રમતો, ૩૬-૩૭                       |
| મરકરી, ૧૨                        | રમતગમતો, ૮૬, ૮૪, ૮૫               |
| મહારામા, ૬૭-૭૧                   | રહસ્યવાદ, ૧૭૬, ૧૭૭-૧૭૮            |
| મેડમ એડ (ડેવિડ ઓ'નિલ), ૫૨        | રેણ્ઝ : માનવબુદ્ધિનો —૮૩          |
| મૌન, ૧૧૦-૧૧૧                     | રેણ્ઝિટ વલાણુ, ૪૩                 |
| મંત્ર, ૩૬૦                       | રૂપનું નિર્માણુ, ૪૮               |
| મૃત વ્યક્તિ સાથે સંપર્ક, ૩૩૧-૩૩૨ | રૂપોની ઉત્કાનિતનું મૂળ, ૨૪૦-૨૪૧   |
| મૃત્યુ, ૩૪, ૩૫,                  | રૂપાંતર, ૧૩, ૮૪, ૮૮, ૧૦૨-૧૦૩,     |
| માણ ની પ્રગતિ, ૧૮૮-૧૮૦           | ૩૬૭, ૩૬૭, ૩૭૭.                    |
| માનવના આવિર્ભાવની પ્રક્રિયા,     | ૩૬ રચનાઓ, ૨૭૧-૨૭૨                 |
|                                  | લાદ્ય માસિ અને વિરોધો, ૩૦         |
| —ની કુદ્ભમય સ્થિતિ, ૨૮૦          | લીલા, ૧૧                          |
| —માંથી અતિમાનવ, ૨૭૨-૨૭૩          | ધર્યાગધારની જાતિ, ૨૦૫             |
| —નું પ્રાગટ્ય, ૨૨૧-૨૨૩           | —નો સ્થિતિ, ૬૫, ૩૭૬               |
| માનસિક પ્રમાણીકરણ, ૩૦૦, ૩૦૨      | —ની જાતિ અને જગત, ૨૮૮             |
| માનસિક અને પ્રમાણીક              | વાધનો સામનો, ૫૩-૫૪                |
|                                  | વાણીનો અસંયમ, ૧૩૮                 |
| અસ્તિત્વને, ૨૫૦                  | વાનર અને માનવ, ૨૦૨                |
| માનવનો પ્રેમ, ૨૮                 | —માં અલ્લીખા? ૨૦૮                 |
| શ્રી માતાજી                      | વિકસનું આત્મનિર્માણ ૨૦૫           |
| અતિમાનસ અનુભૂતિ, ટીકાકારો,       | વિકૃત વિનાતા ૩૬                   |
|                                  | વિકૃતિનું શ્રી માતાજીને દર્શન ૨૭૬ |
| ૨૫૮-૨૫૮                          |                                   |
| અતિમાનસ જગત, નોકા, વિ. ૨૫૧-૨૫૮   | -૨૭૭                              |
| —માટે અસત્ય વસ્તુઓ, ૨૬૨          | -વિષે વાદરાની વાર્તા, ૮૮-૮૯       |
| —જગતની કૃત્રિમતાની અનુભૂતિઓ,     | -ઓક રોગ, ૮૮                       |
|                                  | વિચારિનો ઉદ્ગમ, ૨૩૨, ૨૩૩          |
| ૨૬૦-૨૬૧                          | વિચાર એટલે દર્શન, ૨૬૮..           |
| —પાસે ધ્યાન, ૩૪૬-૩૪૭             | -શરૂદશી નવતંત્ર, ૨૬૮              |
| —નું સ્વભાવ અવતારોનું ઉદ્ગમ.     |                                   |
|                                  |                                   |
| સ્થાન, ૩૦૪                       |                                   |

- नी गति, ४५  
**विजय** ६४-६५ ८-९  
**विविध धर्मोत्तुं शिक्षाण्**, ७६  
**विद्रोहिनों सुमेह** ७७  
**विशुद्ध आनंद** २१  
**विश्व आपुं के? १३-१४**  
 —नुं सर्वन्, १.  
 —परमात्मानुं हृष्य स्वरूप, २८५.  
**विज्ञान अने गूढवाह** ३५७-३५८, ३६१  
**वौहिक अने कार्डियानी** ४२-४२, ३०५  
**वौशिक उत्कान्ति**, १७५, २१२,  
                                   २१३-२१५,  
 —चेतना ६६  
 —चेतनामां अकस्मात्, १२  
 —हृषीकरण, १६८  
 —सत्, २४१  
**व्याङ्कतनी उत्कान्ति**, २१०-२११  
 —गत ध्यान, ३८  
 —गत प्रयत्न, ६  
**व्यक्तिता**, ४७  
**व्यक्तित अने नाम**, ४६  
**सक्ति** ध्यान, ४०  
**सतनों आनंद**, २  
 —नी चेतना, २  
**सनातन कीडा**, ११  
**सभानश्चन**, २४४  
 —व्यक्तितो, ८१  
 —व्यायाम, १४८-१५०  
**समय हर्षननी कमिक अलिल्यजित**,  
                                   १८५  
**समक्षयानों सामनों**, २८१  
**समतुल्य**, ११७.  
**सत्यनी साधिती**, २३७  
**साचो नेता**, ८१  
 —मित्र, ५४-५६  
**साचुं उक्ति**, ८४  
**सामूहिक ध्यान**, ३८  
 —नां परिसामो, ३८-३९  
 —अने प्रणाति, १३७  
 —संगठनो, ३३८-३३९  
**सामूहिक संकेतनी जड़ू** १५२-१५३  
 —योग, १३३  
**साक्षात्कार**, २४५, ११५  
**सिद्धिनी शहआत**, २८८  
**सेवनी गति**, २६२  
**संगठित सत्**, ३७०  
**संभविति** : आध्यात्मिक बनवानी  
                                   ७४-७५, ७८,  
**संहार अने सर्वन्**, ७२  
**संघिक शब्दन** : आशममां १६५-१६६  
**सुधोपलोग अने भोजमल**, ४२  
**सुखुस मतिलानी जगृति**, ३६४-३६५  
**सुहिम हर्षन**, १३३-१३४  
**सूक्ष्म पर्सुओनी स्थायी सधनता**, १२६  
 —शक्तितो, ८६  
**स्थूल डियाए**, १४८-१४९  
**स्थूलतातुं विशिष्ट स्थायीत्व**, १२५  
**स्थूल जगत् अने अतिभानस जगत्**,  
                                   २५१  
**सूक्ष्मो आरंभ**, २१  
 —नो ईतिहास, १८५-१८८  
 —नां अपरिवर्तनशील तत्त्वो, २१६-२२०  
**स्त्री पुरुष** : जातीय भेदो, १००-१०२,  
                                   १२७-१२८

- સ્વર્ગનોની અલ્પીખસા, ૧૫૫-૧૫૬  
 સ્વતંત્રતા અને ચુલાઓ, ૫૦  
 —પ્રકૃતિ અને તેની થકિતથી ૨૦૨  
**સ્વાભાવિક ટેક્ના,** ૪૭  
**સ્વૈચ્છિક વિસ્તૃતા**  
 નવી આધમાનસિક સુધિનું ૧૪૩  
**શારીર :** આત્માનું કરણ ૮૨  
 એક સંકુલ વસ્તુ, ૩૧૮  
 —માં દિવ્ય જીવન, ૧૦૭-૧૦૮  
 —ની પૂર્ણતા, ૮૪  
 —ની મર્યાદાઓ, ૪૪-૪૫  
 —નું ઝ્યાંતર, ૨૮૭, ૧૦૨  
 —સત્યનું પરિસ્તામ, ૧૦૬  
 —અને સૂક્ષ્મ વસ્તુઓની સિધરતા, ૧૨૫  
**શારીરિક ચેતના,** ૧૦૬-૧૦૭  
 —ભય, ૧૧૮  
**શાશ્વત અસ્તિત્વ,** ૨૪૭  
**શાસ્વતી અને અમૃતાન,** ૭૨  
**શાસ્ત્ર અને વિશ્વારેણી રમત,** ૩૩૨  
 —અને શરીર, ૧૨૨  
 —અને શંકા, ૩૨૧  
**શ્રેષ્ઠ ભિત્તિ :** અમૃતાન, ૫૭  
**શ્રીમતી એકરા.**  
 સ્થૂલ વસ્તુઓની ગતિ, ૬૦-૬૧, ૫૮  
**શ્રીમતી દ્વાંશો.**  
 અનેક દેહોની બહાર ગતિ, ૫૮  
 આરથની વાતા, ૬૧  
 પૂજ્યમાળાની વાતા, ૬૨  
 —ની પ્રાણથક્ષિત પ્રામિ, ૫૮-૬૦  
 —ની પ્રાણથક્ષિત, ૬૧  
 બરફનાં સત્ત્વની વાતા, ૬૨-૬૩  
 સમાધિમાં વાણી, ૫૮  
 સ્થૂલ વસ્તુઓની આરપાર ગતિ, ૬૨  
**હિનેટિકમ :** દુર્ઘયોગો, ૩૬૩-૩૬૪  
**હિમત અને અલ્પીખસા,** ૩૮  
**હિમત,** ૩૬૦  
**હાટેલકૃપી પ્રતીક,** ૧૩૩-૧૩૫.

\*